

જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ

ભાગ-૧

: પ્રણેતા :

શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયા

: સંપાદક :

આ. શ્રી વિજય મુનિયન્દ્રસૂરીશ્વરજી મ. સા.

: પ્રકાશક :

આ. શ્રી ડૉક્ટરશ્રી જ્ઞાનમંદિર-સુરત

॥ ચરમતીર્થકર શ્રી મહાવીરસ્વામીને નમઃ ॥
॥ શ્રી ભદ્ર-ૐકાર-ભુવનભાનુસૂરિ સદ્ગુરુભ્યો નમોઃ ॥
આચાર્ય શ્રીૐકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલિ મૌકિક : ૨૭

જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાગ-૧

(ખંડ-૧)
સાર્વજનીન સાહિત્ય



—: પ્રણેતા :—
હીરાલાલ રસિકદાસ કાપડિયા

—: સંપાદક :—
આચાર્ય શ્રી વિજયમુનિયન્દ્રસૂરીશ્વરજી મ. સા.

—: પ્રકાશક :—
આચાર્ય શ્રી ૐકારસૂરિજ્ઞાનમંદિર
ગોપીપુરા, સૂરત.

**JAIN SANSKRIT
SAHITYANO ITIHAS**

**Author :
KAPADIA HIRALAL RASIKLAL**

**Editor :
Ac. Munichandrasuri M. S.**

—: પ્રકાશક :—

આચાર્યશ્રી ઔંકારસૂરિ જ્ઞાનમંદિર
સુભાષચોક, ગોપીપુરા, સૂરત-૩૯૫૦૦૧
ફોન : ૨૪૨૬૫૩૧, ૨૪૦૧૪૬૮
E-Mail : omkarsuri@rediffmail.com

પ્રાપ્તિસ્થાન

ઔંકાર સાહિત્યનિધિ
વિજયભદ્રચેરીટેબલ ટ્રસ્ટ
હાઈવે, મુ. ભીલડીયાજી (જિ. બનાસકાંઠા)
ફોન : ૯૫૨૭૪૪-૨૩૩૧૨૯

આચાર્યશ્રી ઔંકારસૂરિ જ્ઞાનમંદિર
સુભાષચોક, ગોપીપુરા, સૂરત-૩૯૫૦૦૧
ફોન : ૨૪૨૬૫૩૧, ૨૪૦૧૪૬૮
E-Mail : omkarsuri@rediffmail.com

સરસ્વતી પુસ્તક ભંડાર
હાથીખાના, રતનપોળ અમદાવાદ-૧
ફોન : ૨૫૩૫૬૬૯૨

સાન્તાકુઝ જૈન તપગચ્છ સંઘ
જૈન દેરાસર માર્ગ, સાન્તાકુઝ (વેસ્ટ)
મુંબઈ-૪૦૦૦૫૪. ફોન : ૨૬૪૯૪૨૩૪

કિંમત
રૂ. ૨૫૦-૦૦

: પ્રકાશન વર્ષ :

વીર સંવત-૨૫૩૦

વિક્રમસંવત ૨૦૬૦

ઈસ્વીસન ૨૦૦૪

: કમ્પોઝ-પ્રિન્ટીંગ-બાઈન્ડીંગ :

ભરત ગ્રાફીક્સ

**ન્યુ માર્કેટ, પાંજરાપોળ,
રિલીફ રોડ, અમદાવાદ-૧,**

ફોન : ૨૨૧૩૪૧૭૬, ૨૨૧૨૪૭૨૩

AC Shree Omkarsuri Gyan Mandir Granthavali-27

A HISTORY OF THE SANSKRIT LITERATURE OF THE JAINAS

VOLUME I

Secular

Hiralal Rasikdas Kapadia [M. A.]

Formely Lecturer in Mathematics and subsequently Professor of
Ardhamagadhi and University Teacher For Ph. D. in Ardhamagadhi

Editor :

Ac Vijay Munichandrasuri

Published by :

Acharya Omkarsuri Gyan Mandir - Surat.

સમ્મતિ પત્ર

પૂ. આ. ભ. શ્રી યશોદેવસૂરિ મ.સા.ની પ્રેરણા અને પ્રયાસથી આ ગ્રંથનું પ્રકાશન શ્રીમુક્તિ-કમલ-જૈન મૌહનમાલા વડોદરાથી થયું હતું. પૂ. આ. ભ. શ્રીએ પણ આના પુનઃ પ્રકાશન માટે સહર્ષ સંમતિ આપી છે. પૂજ્યશ્રીને ભાવભરી વંદના.

[પ્રસ્તુત ગ્રંથના પુનઃપ્રકાશન માટે શ્રી કાપડિયાના સુપુત્રોએ સમ્મતિ આપી છે. એ બદલ તેઓના આભારી છીએ.

આ કાર્ય શ્રી રમણલાલ ચી. શાહે પોતાનું સમજીને કરી આપ્યું છે. તેઓને પણ ખૂબ ધન્યવાદ ! પ્રકાશક.]

પરમ પૂજ્યશ્રી મુનિચન્દ્રસૂરિજી મ. સા.

જત ડૉ. રમણભાઈ શાહ દ્વારા જાણવા મળ્યું કે અમારા પિતાશ્રી સ્વ. ડૉ. હીરાલાલ રસીકદાસ કાપડિયાએ લખેલ ગ્રંથ “જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ” (ભા.૧-૨-૩) આપ શુદ્ધિ-વૃદ્ધિ સાથે એક જ વોલ્યુમમાં પ્રકાશિત કરવા ઇચ્છો છો, કારણ કે આ ગ્રંથ હાલ અપ્રાપ્ય છે. આ ગ્રંથ પ્રકાશિત કરવા માટે અમારા તરફથી કોઈ પણ અપેક્ષા વગર સહર્ષ સંમતિ આપીએ છીએ.

લી.

બિ. હી. કાપડિયા

V. H. Kapadia

શ્રી કુન્થુનાથસ્વામિને નમઃ

જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ

ભાગ ૧,૨,૩ના

પ્રકાશનનો સંપૂર્ણ લાભ

શ્રી શાન્તાકુમ્ભ જૈન તપગચ્છ સંઘ
જૈન દહેરાસર માર્ગ, શાન્તાકુમ્ભ (વેસ્ટ),
મુંબઈ-૪૦૦ ૦૫૪. ફોન : ૨૬૪૯૪૨૩૪
(જ્ઞાનદ્રવ્યમાંથી) લીધો છે.

ધન્યવાદ !

લી. પ્રકાશક.



પ્રકાશકીય

“જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ” ભાગ- ૧,૨,૩ ડૉ. હીરાલાલ કાપડિયાએ તૈયાર કર્યા હતા.

આ ત્રણ ભાગોનું પ્રકાશન પૂ. આ. ભ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. સા., મુનિપ્રવરશ્રી યશોવિજયજી મ. સા. (હાલ પૂ. આ. ભ. શ્રી યશોદેવસૂરિ મ. સા.) ની પ્રેરણા અને માર્ગદર્શન પ્રમાણે “શ્રી મુક્તિકમલ જૈન મોહનમાલા” વડોદરા દ્વારા ઇ. સ. ૧૯૫૬, ઇ. સ. ૧૯૬૭ અને ઇ. સ. ૧૯૭૦માં થયું હતું.

ઘણાં વર્ષોથી દુર્લભ બનેલા આ ગ્રંથોનું પુનઃપ્રકાશન કરતાં અમને ઘણો હર્ષ થાય છે.

પૂ. આ. ભ. શ્રી અરવિન્દસૂરિ મ. સા., પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરિ મ. સા. આદિના માર્ગદર્શન મુજબ અમારી ગ્રંથમાલામાં વિવિધ ગ્રંથો પ્રગટ થતાં રહે છે.

પ્રસ્તુત ગ્રંથનું સંપાદન પૂ. આ. ભ. શ્રી વિજયમુનિયન્દ્રસૂરિ મ. સા. એ કર્યું છે. તેઓશ્રીએ શ્રી કાપડિયાના લખાણને એ જ પ્રમાણે રહેવા દીધું છે. જ્યાં નવી વિગતો, હકીકતકેર કે સુધારો જરૂરી જણાયો ત્યાં તેઓશ્રીએ ચોરસ કૌંસ [] માં સુધારા, ઉમેરા વગેરે મુક્યા છે.


આ પ્રકાશનથી જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ જાણવામાં ઘણી સહાય થશે. અભ્યાસીઓ આ ગ્રંથનો વધુને વધુ ઉપયોગ કરે એ જ અભિલાષા...

•

આ. ઝુંકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલિ
આ. ઝુંકારસૂરિ આરાધના ભવન
સુભાષચોક, ગોપીપુરા, સૂરત.

લી.
ટ્રસ્ટીગણ

આચાર્ય શ્રી ઐકારસૂરિ જ્ઞાનમંદિર - ગ્રંથવાલી



- શ્રી સમસ્ત વાવપથક જૈન સ્થ. મૂ. પૂ. સંઘ- ગુરુસ્મૃતિ પ્રતિષ્ઠા સ્મૃતિ
- શેઠ શ્રી ચંદુલાલ કક્લચંદ પરિવાર (વાવ) (બનાસકાંઠા)
- શેઠ શ્રી ધુડાલાલ પુનમચંદ હેક્કડ પરિવાર
- પાલીતાણા ચાતુર્માસ સમિતિ (જુનાડીસા) જ્ઞાનદ્રવ્યમાંથી
- શ્રી ધર્મોત્તેજક પાઠશાળા - શ્રી ઝીંજુવાડા જૈન સંઘ
- સૂઈગામ જૈન સંઘ - સૂઈગામ (બનાસકાંઠા)
- શ્રી વાંકડિયા વડગામ જૈન સંઘ - વાંકડિયા વડગામ (રાજસ્થાન)
- શ્રી ગરાંબડી જૈન સંઘ - ગરાંબડી (બનાસકાંઠા)
- શ્રી રાંદેર રોડ જૈન સંઘ - સુરત.

પ્રભુવાણી પ્રસાર અનુમોદક

- શ્રી મોરવાડા જૈન સંઘ-મોરવાડા (બ.કાં.)
- શ્રી ઉમરા જૈન સંઘ-સુરત
- શ્રી શત્રુંજય ટાવર જૈન સંઘ-સુરત

પ્રભુવાણી પ્રસાર ભક્ત

શ્રી દેશલપુર (કંઠી) શ્રી પાર્શ્વચન્દ્રગચ્છ (મુનિભવનચન્દ્રજીની પ્રેરણાથી)
શ્રી ધ્રાગંધ્રા શ્રી પાર્શ્વચન્દ્રસૂરીશ્વરગચ્છ (મુનિભવનચન્દ્રજીની પ્રેરણાથી)

પત્રવ્યવહાર : સેવંતીલાલ એ. મહેતા

આચાર્ય શ્રી ઐકારસૂરિ આરાધના ભવન, સુભાષચોક, ગોપીપુરા, સુરત-૩૯૫૦૦૧

ફોન : ૦૨૬૧-૨૪૨૬૫૩૧, ૨૪૩૯૦૨૪

E-mail : omkarsuri@rediffmail.com

બે બોલ

વર્ષો અગાઉ જાણીતા પીઠ કર્મઠ સાહિત્યકાર શ્રીયુત મોહનલાલ દ. દેસાઈકૃત. ‘જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ,’ મેક્રડોનલકૃત ‘સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ’ અને એના જેવાં અન્યાન્ય જૈન અજૈન પુસ્તકોને જોઈને એક સ્ફુરણ થયેલી કે પ્રાકૃત તેમજ સંસ્કૃત સાહિત્યને લગતા જૈનધર્મના તમામ ગ્રંથોનું, તેના પરિચય સાથે એક સંસ્કરણ તૈયાર થવું જોઈએ. તે પછી તો જેઓને શ્રેષ્ઠ-શ્રેષ્ઠતમ કોટિના ગણી શકાય, તેવો વિદ્વાનો, ખાસ કરીને અજૈન વિદ્વાનોના હાથે લખાયેલાં ઇતિહાસ વિષયક પુસ્તકો અને તેમાંનાં પ્રકરણો આંખે ચઢવા માંડ્યાં, અને જ્યારે એમાં જૈન સાહિત્ય તેમજ તેના સાંસ્કૃતિક વિષય અંગેની અલ્પજ્ઞતા અને અજ્ઞાનતા જોઈ, ત્યારે તો તે માટે મને ભારે દુઃખ થયું અને આપણા શ્રીસંઘની બેદરકારી માટે શરમ પણ ઊપજી. અરે ! કેટલાક લેખકોએ તો જાણે-અજાણે પણ, જૈનધર્મના મર્મની સમજણોના અભાવે, તેના સિદ્ધાન્તો અને સંસ્કૃતિને ભારે અન્યાય આપતી વિકૃત રજૂઆતો પણ કરેલી જોઈ, ત્યારે તો મારી પૂર્વોક્ત ભાવના બળવત્તર બની ગઈ. આમાં મને ચોક્કસપણે એ પણ લાગ્યું પહેલા અપરાધી જો કોઈ હોય તો તે જૈન ધર્મ-સંસ્કૃતિના ઉપાસકો તરીકે ગણાતા આપણે જ છીએ, જેમણે પોતાની અજોડ, અદ્ભુત, અનુપમ અને વિશ્વોપકારક સાહિત્યની કીમતી સમૃદ્ધિને, પ્રસિદ્ધિનો જોઈએ તેવો પ્રકાશ આપ્યો નથી. પરિણામે ભગવાન્ જિનેશ્વરદેવની મુદ્રાથી અંકિત, આપણા સંગીન અને મૌલિક સાહિત્યની પુનિત અને નિર્મળ ગંગા, યોગ્ય આત્માઓના હૃદય-નયનપથ સુધી બરાબર પહોંચી શકી નથી અને એનો સુયોગ્ય વિદ્વાનોને પણ, બહુ ઓછો લાભ મળ્યો છે. આમ છતાંયે મારે એ કહેવું જ જોઈએ કે આજ સુધીમાં જેટલું જૈન સાહિત્ય પ્રસિદ્ધ થયું છે તે પણ વિપુલ પ્રમાણમાં છે અને છેલ્લા દશકામાં તો આધુનિક દૃષ્ટિએ સંપાદિત થયેલું સાહિત્ય પણ ઠીક ઠીક પ્રમાણમાં બહાર પડી ચૂક્યું છે, છતાં આજના વિદ્વાન લેખકો તેને લક્ષ્યપૂર્વક વાંચતા નથી, સમજતા નથી અને ઉપર ઉપરથી વાંચીને ઇધર-તિધરથી ઉઠાવીને પોતાના ગ્રંથમાં માત્ર બે ત્રણ પાનાં, જૈન-દર્શન, સાહિત્યને લગતાં લખવાનાં રાખ્યાં હોય તે ભરી દે છે અને પોતાની જાતને સંતોષ મનાવે છે. પણ આ રીતે માત્ર પાનાં ભરવાથી જૈન સાહિત્યને ક્યારેય ન્યાય કે સંતોષ આપી શકાતો નથી. અને આ જ કારણે બીજા નંબરના અપરાધી તરીકે હું લેખકોને સૂચવી શકું !

પણ હવે બન્નેએ નિરપરાધી બનવું જોઈએ. જૈનસંઘ તરફથી તો છેલ્લા દશ વર્ષમાં અનેકદેશીય સાહિત્ય બહાર પડ્યું છે ને હવે એ દિશામાં સારા પ્રમાણમાં પ્રયત્નો જારી પણ છે. એટલે હવે લેખકોને પોતાનો ધર્મ બજાવવાનો રહે છે. એટલે કે તેઓએ જૈન સાહિત્યનો ઊંડા ઉત્તરોને મનનપૂર્વક ઠીક ઠીક અનુગમ કરવાં જ જોઈશે એના મૌલિક ઉદ્દેશો ને ઉચ્ચતમ સિદ્ધાન્તો, એની પરિભાષાઓ ને અજોડ ખૂબીઓ અને વળી, એના સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેને, ખૂબ ખૂબ અર્થપૂર્ણ રીતે સમજવા જોઈશે.

જૈન દર્શન એ એક નિરાલું દર્શન છે. એની સર્વજ્ઞમૂલક ખૂબીઓ અનન્ય છે. મધ્યસ્થભાવે આમૂલયૂલક અધ્યયન કર્યા વિના એનું સાચું રહસ્ય લાધશે નહિ અને એનું સાંસ્કૃતિક ગૌરવ પણ સમજાશે નહીં. અન્ય સંસ્કૃતિઓના અધ્યયન સાથે ભારતની આ મહાન્ સંસ્કૃતિનું અધ્યયન નહિ થાય

ત્યાં સુધી અન્ય સાંસ્કૃતિક અધ્યયનો અપૂર્ણ જ રહેશે અને વિદ્વાનોને તે ચમકતાં નહિ જ લાગે. આ વાત હું જ કહું છું એમ નથી પણ આજના માધ્યમ્યવૃત્તિ ધરાવનારા અજૈન વિદ્વાનો પણ આ જ હકીકતને જાહેરમાં જોરશોરથી કહે છે. એટલે અજૈન વિદ્વાનોને મારી વિનંતિ છે. કે તેઓ જરી-પુરાણા થયેલા અસત્ પૂર્વ ગ્રહોને હવે ઝડપથી છોડે, પરાયા ભાવને તિલાંજલિ આપે, અને જૈન સંસ્કૃતિનું અધ્યયન-અધ્યાપન કરવા-કરાવવામાં, પૂરતો રસ અને ઉત્સાહ દાખવે.

આ ઠેકાણો મને જણાવતાં આનંદ થાય છે કે, આપણા કેટલાય ભારતીય વિદ્વાનોને એ પ્રતીતિ થઈ છે કે જૈન સાહિત્યમાં સાર્વદેશીય અને સાર્વક્ષેત્રીય હકીકતનો અખૂટ ખજાનો ભર્યો છે. એટલે તે તરફ હવે તેઓનું ઠીક ઠીક પ્રમાણમાં આકર્ષણ વધતું ચાલ્યું છે. તેઓ જૈન-સંસ્કૃતિના અધ્યયનમાં રસ લઈ રહ્યા છે, અને અધ્યયનની વિશિષ્ટ દિશાને ખુલ્લી કરી મોકળી કરી રહ્યા છે. અને તેમના જ હાથે-

“જૈનસંઘ પાસે વિપુલ સાહિત્ય સમૃદ્ધિ નથી, અને સાર્વદેશીય સાહિત્ય-સર્જન છે જ ક્યાં?”

ઈત્યાદિ જે જે ગેરસમજ ભર્યા અભિપ્રાયો, ખોટી રીતે બંધાયા હતા અને તેથી કેટલાકના હાથે જે અસંબદ્ધ વિધાનો બોલાયાં, લખાયાં અને છપાયાં હતા, એનાં પરિમાર્જનની શરૂઆત પણ થઈ ચૂકી છે. એ ખરેખર! એક અતિ આનંદનો વિષય છે.

જૈનસંઘને મારી સૂચના છે-વિનંતિ છે કે, વર્તમાન પરિસ્થિતિ, જૈન સંસ્કૃતિના પ્રકાશ અને પ્રચાર માટે તો એટલી અને એવી અનુકૂળ છે કે, જો જૈન સંસ્કૃતિના પ્રચાર અને પ્રકાશ માટે, વિવિધ પ્રકારે હરણફાળ ભરવામાં આવે તો જૈન સંસ્કૃતિનો પ્રવાહ વિશ્વભરમાં વહેતો કરી શકાય અને એ પ્રવાહમાં અનેક આત્માઓ ડૂબકી મારીને પાવન બની શકે ! પણ અફસોસની વાત એ છે કે, વર્તમાન કલહ-કંકાસમાં અટવાઈ ગયેલા જૈનસંઘના સૂત્રધારોને પ્રચારનું મૂલ્ય સમજાયું જ નથી. અને જેઓને સમજાયું હશે તેઓ સક્રિય પ્રયત્નશીલ નથી. પરિણામે વર્તમાનની સાનુકૂળ પરિસ્થિતિનો સર્વાંગી લાભ શ્રીસંઘ ઉઠાવી શકતો નથી એ બીના જેટલી ખેદજનક છે તેટલી જ દુઃખદ છે આ દુઃખદ પરિસ્થિતિનો જલ્દી અંત લાવવો જોઈએ.

આટલી વાત તો પ્રાસંગિક હેયે હતી, તેમાંથી થોડીક હોઠે આવી અને કલમે અહીં ટપકાવી.

હવે મૂળ મુદ્દા પર આવું.

આ પુસ્તક પ્રકાશક સંસ્થાના સૂત્રધારોને, વર્તમાન સમયમાં જાહેર પ્રજાને પોતાના સમૃદ્ધ વારસાનાં દર્શન કરાવવાની અને જૈનધર્મની સેવામાં પોતાનો યત્કિંચત્ ફાળો નોંધાવવાની, જૈન સંસ્કૃતિ અને સાહિત્યની પ્રૌઢતા, પ્રખરતા અને ગંભીરતા જોવાની ભાવના પ્રગટી અને જાણીતા સુરતનિવાસી, અનેક કૃતિઓના સંશોધક, સંપાદક અને અનુવાદક, વિદ્વાન લેખક શ્રીયુત્ હીરાલાલ રસિકલાલ કાપડિયાને મળવાનું થયું ત્યારે તેઓએ પોતાના પ્રકાશિત પ્રાકૃત ભાષાના ઇતિહાસની જેમ, જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ લખવાની પ્રેરણા કરી, અને પોતાની પાસે તેની કચી સામગ્રી સારા પ્રમાણમાં હોવાનું પણ જણાવ્યું. અર્થાત્ આ વિષયમાં તેમણે ઘણી સારી તૈયારી બતાવી. પૂજ્ય ગુરુદેવો અને સંસ્થાના કાર્યકરોને આ વાત કરતાં, પ્રસ્તુત વાતને તેઓએ સહર્ષ વધાવી લીધી. પછી શ્રી કાપડિયા સાથે, તેની રૂપરેખા, કાર્ય

મર્યાદાને ગ્રંથમર્યાદા નક્કી થઈ. પછી એમણે કાર્ય શરૂ કર્યું. રૂપરેખા તો ઠીક જળવાઈ, પણ બાકીની મર્યાદાઓ જળવાઈ ન શકી. ગ્રંથમર્યાદા તો ત્રિગુણાધિક થઈ ગઈ, જેથી ત્રણ ખંડો પાડવાનું નક્કી થયું, અને પરિણામે સંસ્થા આજે તેનો પેલો ભાગ જ પ્રસિદ્ધ કરી રહી છે. આ પ્રકાશન દ્વારા જૈન સંસ્કૃત સાહિત્યની વિશાળતાનો અને તેની અનેકવિધ ખૂબીઓનો અર્થાત્ જૈન વિદ્વાનોએ વિદ્યા-કલા અને સાહિત્યના કેટકેટલાં ક્ષેત્ર ઉપર કલમ ચલાવી છે તેનો ખ્યાલ મળશે, અને ઘણા ભ્રમો, અધૂરા ખ્યાલો દૂર થશે અને વળી આ પ્રકાશનથી જૈન-જૈનેતર વિદ્વાન વાચકોને પ્રચૂર માહિતીઓ અને અનુભવો પણ મળશે. આશા છે કે, જૈન-અજૈન જનતા, આવા ઉપયોગી પ્રયત્નનો જરૂર સમાદર કરશે.

આ ગ્રંથમાં ઉઠાવેલા પ્રબલ પરિશ્રમ અંગે વિદ્વાન્ લેખક શ્રી કાપડિયાને સહર્ષ ધન્યવાદ આપું છું, અને તેમની જૈન સાહિત્યની શેષ સેવાઓનું વિધવિધ રીતે દર્શન કરાવવાની તેમની અખૂટ ભાવના સફળ બને એવી શુભેચ્છા સેવું છું.

આટલું કહ્યા બાદ એક વાતનું સંસૂચન કરવાનું ઉચિત સમજું છું તે એ કે—

ઇતિહાસ-સાહિત્ય વગેરે એવી ચીજ છે કે, એમાં પૂરેપૂરા નિર્ણયો લેવાયા જ છે એવું નથી હોતું. જે હોય છે તેમાં કેટલાક એવા પણ હોય છે કે જે સંપૂર્ણ રીતે સાચા ન પણ હોય, આનુમાનિક પણ હોય, ને છેવટે સંભવિત પણ રાખવામાં આવ્યા હોય. મારે અહીં એ કહેવું જોઈએ કે, વિદ્વાનોએ કેટલાક સંયોગોમાં ઉપરોક્ત સ્થિતિને માન્ય રાખી છે, પણ તે એવા સાધનો અને સાહિત્ય માટે કે જે અપ્રાપ્ય હોય અને જેની હકીકતો મળતી ન હોય ! પરંતુ આમાં, કેટલીક પ્રકાશિત અને લઘ્ય કૃતિઓ માટે એવું બને ત્યારે તે કેમ ગમે ? અને આથી અમુક કૃતિ પ્રત્યક્ષ રીતે એક માહિતી આપતી હોય ત્યારે આ પ્રકાશનમાં બીજી જ માહિતી જણાવતી હોય ! ક્યાંક ક્યાંક તો ઉલ્ટી જ હકીકત પણ રજૂ થઈ હોય. વળી, કેટલીક પ્રાકૃત કૃતિઓને સંસ્કૃત માનીને, અજૈન કૃતિને જૈન ગણીને, પ્રકાશિત કૃતિને અપ્રકાશિત સમજીને પરિચય અપાયો છે. ક્યાંક અનૈતિહાસિક વિધાન પણ નજરે ચઢી જાય છે.

આ માટે આપણા માનનીય લેખક વિદ્વાને, થોડોક વધુ પરિશ્રમ કરીને. જો સંસ્થાઓની સૂચીઓ મેળવી લીધી હોત, અને થોડી વધુ જાંચ કરી હોત તો, સૂચિત ક્ષતિઓથી આ સંસ્કરણને જરૂર બચાવી શકાયું હોત ! અને આવું અતિપરિશ્રમ અને વ્યય સાધ્ય પ્રકાશન, શહાદતો (References) માટેનું પ્રામાણિક સાધન બની ગયું હોત !' અને આ ગ્રંથ લખાવવા પાછળ સંસ્થાની જે ભાવના અને લક્ષ્ય હતું તે વધુમાં વધુ રીતે પાર પડ્યું હોત ! અસ્તુ !

અન્તે જૈન શ્રીસંધને વિનંતિ કે, સંઘના પ્રત્યેક અંગને, પોતાની અણમોલ સાહિત્ય સંપત્તિનું દર્શન થાય અને તેમાંથી અનેકવિધ કલ્યાણકર પ્રેરણાઓ મેળવે, એ માટે આ પ્રકાશનને જરૂર વસાવી લે.

[પ્રથમ આવૃત્તિમાંથી સાભાર.]



શ્રીચશોવિજય મ. સા.

માટુંગા (મુંબઈ) જેઠ સુદિપૂર્ણિમા
વિ. સં. ૨૦૧૦

॥ હર્ષ ॥

॥ જયઉવીર સચ્ચઉરી મંડળ ॥

॥ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ॥

॥ શ્રી સિદ્ધિ-ભદ્ર-વિલાસ-જનક-ઝંકાર-હ્રીકાર-ભદ્રંકર-અરવિંદ-યશોવિજય-જિનચન્દ્રવિજયેભ્યો નમઃ ॥

સંપાદકીય નિવેદન

શ્રી હીરાલાલ કાપડિયા દ્વારા રચિત જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાગ-૧નું પુનઃપ્રકાશન થઈ રહ્યું છે ત્યારે ઘણો હર્ષ થાય છે.

ઇતિહાસનું આલેખન અતિ જટીલ કાર્ય છે.

ત્રિપુટી મહારાજે ત્રીસથી ચાલીસ હજાર ગ્રંથો, લેખો, પ્રશસ્તિઓ આદિના અધ્યયન પછી ‘જૈન પરંપરાનો ઇતિહાસ’ ભાગ-૧,૨,૩,૪ દ્વારા (વિ.સં. ૨૦૦૯ થી ૨૦૩૯ સુધીમાં) આચાર્યો, રાજાઓ, શ્રેષ્ઠિઓ આદિની પરંપરાને આલેખી છે.

મોહનલાલ દલીચંદ દેસાઈએ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” લખી જૈન સાહિત્યકારોએ રચેલા ગ્રંથોની વિસ્તૃત નોંધ આપી છે.

શ્રી હીરાલાલ કાપડિયાએ આ સાહિત્યમાંથી સંસ્કૃત ભાષામાં રચાયેલા સાહિત્યનો વિભાગવાર પરિચય આપ્યો છે.

એમાં પણ આ પ્રથમ વિભાગમાં સાર્વજનીન સાહિત્યનો પરિચય આપ્યો છે.

આ ગ્રંથ દ્વારા આપણને સંસ્કૃત વ્યાકરણ વગેરે વિષયોમાં જૈન ગ્રંથકારોએ કેટલા અને કેવા ગ્રંથો રચ્યા છે, એ ગ્રંથો કોના કોના દ્વારા ક્યારે સંપાદિત, સંશોધિત અને પ્રકાશિત થયાં છે તે અને એ ગ્રંથોની વિશેષતા, અન્ય ગ્રંથો સાથે એની તુલના વગેરે શ્રી કાપડિયાએ આ ગ્રંથમાં આપી છે.

કોઈ પણ ગ્રંથ અને ગ્રંથકાર કે પ્રકાશક વગેરેની વિગત સહેલાઈથી અભ્યાસીઓ મેળવી શકે માટે ગ્રંથકાર, લેખક, સંપાદક, સંશોધક વગેરેની અકારાદિ સૂચી પૃષ્ઠાંકો સાથે પ્રથમ પરિશિષ્ટમાં આપી છે.

બીજા પરિશિષ્ટમાં ગ્રંથો, લેખો વગેરેની અકારાદિ સૂચિ આપી છે. આ બન્ને પરિશિષ્ટમાં ત્રણ વિભાગ દ્વારા શ્વેતાંબર (અને યાપનીય), દિગંબર અને અજૈન ગ્રંથ-ગ્રંથકારોની વિગતો જુદી જુદી આપી છે. ત્રીજા પ્રકીર્ણ નામોના પરિશિષ્ટમાં પ્રકાશકો અન્ય વ્યક્તિઓ વગેરેની અકારાદિ સૂચિ છે.

પુનર્મુદ્રણ—

આજથી પચાસ વર્ષ પૂર્વે જ્યારે સાધન સામગ્રી ઓછી હતી અને મુદ્રણ વ્યવસ્થા સુગમ ન હતી ત્યારે પણ ટાંચા સાધનો દ્વારા પણ જે ઇતિહાસો લખાયા છે એવું કાર્ય કરવાવાળા આજે આપણને ક્યાંય નજરે પડતાં નથી. પરંતુ વર્ષોથી દુર્લભ બનેલા આ ગ્રંથોને સુલભ કરવા પુનર્મુદ્રણ / પુનઃપ્રકાશનની પ્રવૃત્તિ જોવા મળે છે.

જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૧,૨ અને ઉનું પુનઃપ્રકાશન તાજેતરમાં (૨૦૫૬, ૨૦૫૭, ૨૦૫૮માં) યશોવિજય જૈન આરાધના ભવન દ્વારા પાલીતાણાથી થયું. જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ ના ૧ થી ૭ ભાગોનું પુનર્મુદ્રણ પાર્શ્વનાથ શોધપીઠ વારાણસીથી થયું છે.

ખ. પાર્શ્વનાથ કી પરંપરા કા ઈતિહાસ -લે. જ્ઞાનસુંદર. આનું ત્રણ ભાગમાં પુનઃ પ્રકાશન પં. શ્રી રત્નસેનવિજયજીના સંપાદનપૂર્વક દિવ્યસંદેશ-મુંબઈથી થયું છે.

‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પ્રવચન પ્રકાશન-પુનાથી પુનર્મુદ્રિત થયો છે.

(આ પુનઃપ્રકાશન પ્રાયઃ ફોટો ઝેરોક્ષ પદ્ધતિથી મર્યાદિત નકલોમાં થયું હોવાથી અપ્રાપ્ય બની ગયું છે. આ ઇતિહાસનું ઓફસેટ પદ્ધતિથી મોટી સાઈઝમાં પુનઃપ્રકાશન કાર્ય શરૂ થયું છે. અને આ. ઊંકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલિમાં ટુંકમાં પ્રગટ થશે.) અમને થયું કે કાપડિયાના ઇતિહાસના ભાગોનું પણ પુનઃપ્રકાશન થવું જોઈએ. આ બાબત મેં સુહૃદ્વર આચાર્યપ્રવર શ્રી રત્નસુંદરસૂરિ મ. સા. ને જણાવી.

તેઓનો ઉત્તર આવ્યો કે આના પુનઃપ્રકાશન સંપાદન વગેરે બાબતો આપ જ સંભળો અને આના પ્રકાશન-ખર્ચનો લાભ શ્રી સાંતાકુઝ જૈન તપાગચ્છ સંઘને આપો.

આ પછી શ્રી સાંતાકુઝ જૈન તપાગચ્છ સંઘ (પશ્ચિમ) ના ટ્રસ્ટીવર્યો રૂબરૂ મળીને આ ગ્રંથ સારામાં સારી રીતે પ્રકાશિત કરવા અને એનો સંપૂર્ણલાભ સંઘના જ્ઞાનખાતામાંથી લેવાની ભાવના વ્યક્ત કરી.

આ પછી આ ગ્રંથનું કાર્ય તુરંત શરૂ થયું. પ્રથમ ભાગ આપના હાથમાં છે. ભાગ ૨ અને ૩ પણ આ જ ગ્રંથાવલિમાં આના અનુગામિ બનીને આની સાથે જ પ્રગટ થઈ રહ્યા છે.

લેખકશ્રીનો પરિચય :

શ્રી હીરાલાલ કાપડિયાના પરિચય માટે શ્રી રમણલાલ સી. શાહનો લેખ અન્યત્ર આપ્યો છે તેમાંથી લેખકશ્રીના જીવન અને સાહિત્ય વિશે વિશેષ પરિચય મળી જશે.

આનંદદાયક સમાચાર :

શ્રી હીરાલાલભાઈએ લખેલા બધા લેખો વગેરે સાહિત્ય પ્રગટ થઈ શક્યું નથી. જે છપાયું છે તે પણ જુદા જુદા અનેક પત્ર, પત્રિકાઓના વિવિધ અંકોમાં પ્રગટ થયું હોવાથી વાચકો માટે

આવા અનેક સ્થળેથી પ્રગટ થયેલા લેખોનો સંગ્રહ કરી પ્રકાશિત કરવાનું આયોજન પં. જિતેન્દ્રકુમાર બી. શાહ (ડાયરેક્ટર લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિર) એ ગોઠવ્યું છે.

લગભગ ૫૦૦ જેટલા લેખો પાંચ વોલ્યુમમાં શેઠ કસ્તુરભાઈ લાલભાઈ શ્રુતનિધિ દ્વારા પ્રકાશિત થવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રગટ થતાં શ્રી કાપડિયાનું દુર્લભ સાહિત્ય સુલભ થશે.

પ્રસ્તુત સંસ્કરણ :

જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ફોટો-ઝેરોક્ષ પદ્ધતિથી એમનો એમ પ્રગટ થયો છે. મ. પાર્શ્વનાથ કી પરંપરા કા ઈતિહાસ અને જૈ. સા. બૃહદ્ ઇતિહાસ સાત ભાગોનું પણ સુધારા-વધારા વિના પુનર્મુદ્રણ જ થયું છે. જૈન પરંપરાનો ઇતિહાસ બીજી આવૃત્તિમાં પુનરુક્તિ દૂર કરી રાખી સંક્ષેપીકરણ કર્યું છે. ક્યાંક સામગ્રીનો સ્થળ-બદલો કરાયો છે. પણ નવી કોઈ વિગતો જોડવામાં આવી નથી. જ્યારે પ્રસ્તુત પ્રકાશનમાં અનેકવિધ સામગ્રી જોડવામાં આવી છે.

છેલ્લા બે-ત્રણ દશકામાં વિપુલ પ્રમાણમાં સાહિત્યનું પ્રકાશન થયું છે.

અનુસંધાન (એપ્રિલ-૨૦૦૩)ના અંકમાં આ. શીલચન્દ્રસૂરિ મ. સા. લખે છે કે—

સદ્રત વિદ્વાન પ્રા. હીરાલાલ રસીકદાસ કાપડિયાએ “જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ” લખ્યો છે, તેમાં એક સ્વતંત્ર ગ્રંથ લખીને ઉમેરવો પડે તેટલી કૃતિઓ તો તે પછી પ્રકાશમાં આવી ગઈ છે. અને પ્રકાશમાં ન આવેલી કૃતિઓનો જથ્થો તો હજી એવા કેટલા ગ્રંથ માગશે તેની કલ્પના જ કરવી પડે.

પ્રસ્તુત સંસ્કરણમાં નવા પ્રગટ થયેલા સંસ્કૃત સાહિત્યની મળે તેટલી વિગત મુકવા અમે પ્રયાસ કર્યો છે. કેટલાક પ્રકાશનોની વિગત ગ્રંથમાં તે તે ગ્રંથની વિગત હોય ત્યાં જ આપી છે. કેટલાકની પ્રકરણના છેડે આપી છે. આ વિગતોમાં આવતાં ગ્રંથ, ગ્રંથકાર, પ્રકાશક આદિ નામો તે તે પરિશિષ્ટમાં ઉમેરી દેવાયા છે.

પૃષ્ઠાંકો વિષે :

પ્રથમ સંસ્કરણનો આજ સુધી ઉપયોગ થતો રહ્યો છે. શ્રી હીરાભાઈએ પણ એમના અનેક ગ્રંથો લેખોમાં પ્રથમ સંસ્કરણના પેજ નંબરો આપ્યા છે. એટલે પ્રથમ સંસ્કરણના પેજ નંબર પણ આ દ્વિતીય સંસ્કરણમાં મળી શકે તે માટે દરેક પેજમાં P કરીને જુના સંસ્કરણના પેજ નંબર લખ્યા છે.

આ સંસ્કરણના પેજ ૧ માં P ૧થી P ૨ પહેલાનું લખાણ જુના સંસ્કરણમાં ૧નં. પેજમાં છે.

જે લીટી સામે P પછી જે અંક લખ્યો છે તે પંક્તિથી જુના સંસ્કરણનું તે પેજ શરૂ થાય છે. એમ સમજવું.

આ ઉપરાંત એકી પેજના મથાળે હેડીંગમાં પણ પ્ર. આ. પછી જુના સંસ્કરણના કયાથી કયા પૃષ્ઠનું લખાણ આ બે પૃષ્ઠોમાં છે તે જણાવ્યું છે. જુના અને નવા સંસ્કરણના પૃષ્ઠાંકોમાં ગેરસમજ ન થાય તે માટે અમે ત્રણે ભાગમાં સર્વત્ર જુના સંસ્કરણ માટે ૧, ૨, ૩ એમ ગુજરાતી અંકો અને નવા સંસ્કરણ વિષે 1, 2, 3 એ રીતે અંગ્રેજીમાં વપરાતા અંકો વાપર્યા છે. વાચકોએ આની ખાસ નોંધ લેવી.

ટિપ્પણો વિષે :

શ્રી હીરાલાલભાઈએ એમની પદ્ધતિ મુજબ જે ગ્રંથ કે ટીકાના પ્રકાશનની વિગત અગાઉ આપી હોય તો તે સ્થળે ટિપ્પણમાં આ પ્રકાશિત છે જુઓ પૃ. અમુક ટિપ્પણ અમુક.

અમે આવા સ્થળે તે તે પેજમાં બતાવેલી વિગત ઉમેરી દીધી છે. અને જુઓ પૃ. વાળી વિગત કાઢી નાંખી છે.

દાખલા તરીકે આ સંસ્કરણમાં પૃ. ૧૨૯ થી ટિ. ૧ અને ૩ માં ‘આ ગુજરાતી અનુવાદ સહિત સારાભાઈ નવાબ દ્વારા પ્રકાશિત છે.’

આ ટિપ્પણો જુના સંસ્કરણમાં પૃ. ૨૧૨ ટિ. ૧ અને પૃ. ૨૧૩ ટિ. ૧ તરીકે છે. ત્યાંનું લખાણ આ પ્રમાણે છે.

‘આ ગુજરાતી અનુવાદ સહિત પ્રકાશિત છે. જુઓ પૃ. ૨૧૧.’

આવા અનેક સ્થળે અમે પૃ. નંબર કાઢી નાંખીને તે પૃષ્ઠમાં બતાવેલી વિગત ત્યાં મુકી દીધી છે. જેથી વાચકોને સરળતા રહે.

સંપાદકીય ઉમેરણ :

૧. શ્રી હીરાલાલભાઈએ પાછળથી મળેલી વિગતો પરિશિષ્ટ, અનુલેખ, પૂરવણી, વૃદ્ધિપત્ર આદિમાં જોડી છે. અમે આ બધી વિગતો તે તે સ્થળે મુકી દીધી છે.
૨. જ્યાં જ્યાં વિશેષ વિગતો અમારા ધ્યાનમાં આવી ત્યાં અમે તે વિગતો તે તે સ્થળે ચોરસ કૌંસમાં [] ઉમેરી છે. આ વિગતો ટુંકમાં આવી છે.
- A. તે ગ્રંથનું નવું સંસ્કરણ બહાર પડ્યાની વિગત જુઓ પૃ. ૮ છેલ્લી ૨ પંક્તિ, પૃ. ૧૪ ટિ. ૧, પૃ. ૧૬ ટિ. ૨, પૃ. ૨૦ પં. ૧૭-૧૮, પૃ. ૩૯ ટિ. ૧-૨, પૃ. ૪૪ ટિ. ૬, પૃ. ૪૬ ટિ. ૧૧, પૃ. ૫૨ ટિ. ૧, પૃ. ૫૩ ટિ. ૭, પૃ. ૭૩ ટિ. ૩, પૃ. ૭૬ ટિ. ૮, પૃ. ૯૨ ટિ. ૪, પૃ. ૧૦૮ ટિ. ૨ વગેરે.
- B. નવા અપ્રગટ ગ્રંથની વિગત પૃ. ૨૭ પં. ૧૪-૧૬, પૃ. ૭૦ પં. ૧, પૃ. ૮૮ પં. ૨૦ થી, પૃ. ૧૧૪ પં. ૬ થી, પૃ. ૧૧૭ પં. ૧૨ થી, પૃ. ૧૨૫ ટિ. ૨.
- C. નવા પ્રગટ ગ્રંથની વિગત. પૃ. ૭૭ પં. ૮, પૃ. ૧૦૬ પં. ૧૮ થી, પૃ. ૧૦૮ ટિ. ૪, પૃ. ૧૧૧ પં. ૧૦, પૃ. ૧૪૪ પં. ૮
- D. ગ્રંથ અસિદ્ધ હોવાની વિગત. પૃ. ૨૨ પં. ૮ થી, પૃ. ૫૧ ટિ. ૧, પૃ. ૭૨ પં. ૧૩, ૨૨, પૃ. ૧૦૨ પં. ૫
- E. ગ્રંથ અપ્રસિદ્ધ હોવાની વિગત પૃ. ૮૭ પં. ૨૩, ૨૭

- F. તે વિષયમાં આધુનિક વિદ્વાનના લેખ, નિબંધ, ગ્રંથની વિગત. પૃ.37 ટિ.૪
- G. તે ગ્રંથ ઉપર થયેલા વિવેચન, અનુવાદ વગેરેની વિગત. પૃ.57 ટિ.૪, પૃ.88 પં.૨૨, પૃ.107 પં.૫થી
- H. તે ગ્રંથનું સંશોધન-સંપાદન ચાલુ હોય તેની વિગત પૃ.68 ટિ.૪,૮.
- I. તે ગ્રંથની મુદ્રણયોગ્યપ્રતિ તૈયાર થયાની વિગત પૃ.68 પં.૩
- J. તે ગ્રંથકારના અન્ય ગ્રંથોની વિગતમાં ઉમેરો પૃ.69 પં.૧૪
- K. ગ્રંથકાર-ટીકાકાર વિષે વિશેષ વિગત પૃ.78 પં.૧૧
- L. ગ્રંથની હસ્તલિખિત પ્રતિ વિષે પૃ.88 પં.૫

અનુવાદ :

ઈતિહાસ ગ્રંથોના પુનર્મુદ્રણો થતા રહ્યા છે તેમ એના અનુવાદનો પણ પ્રારંભ થયો છે.

વારાણસીથી જૈન સંસ્કૃત સાહિત્ય કા ઈતિહાસ ભાગ ૧ થી ૭ બે વાર પ્રગટ થયેલા. તે ૭ ભાગોનું ગુજરાતીમાં ભાષાંતર કરાવી પ્રગટ કરવાનો પ્રારંભ '૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન ટ્રસ્ટ' પાલિતાણા દ્વારા થયો છે. ભા. ૧ અને ભા. ૨ પ્રગટ થયા છે. આ. ભ. શ્રી ચંદ્રોદયસૂરિ મ. સા., આ. ભ. શ્રી સોમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી આ પ્રકાશન કાર્ય થઈ રહ્યું છે. અનુવાદ કાર્ય પ્રો. રમણીકભાઈ શાહ અને પ્રો. નગીનભાઈ શાહ કરી રહ્યા છે. આમ ગુજરાતી વાચકો માટે આ ઈતિહાસ ગ્રંથો ઉપયોગી બની રહેશે.

ઋણસ્વીકાર - ધન્યવાદ :

પરમકૃપાળુ પરમાત્મા અને પૂ. આ. ભ. શ્રી અરવિંદસૂરિ મ. સા., પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરિ મ. સા., પૂ. ગુરુદેવ શ્રી જિનચન્દ્રવિજયજી મ. સા. આદિના મંગલ આશીર્વાદના પ્રતાપે જ આ ગ્રંથ સંપાદન કાર્ય શક્ય બન્યું છે.

ઉપકારી દેવ-ગુરુના ચરણે અનંત અનંત વંદના.

સંપાદનના આ શ્રમસાધ્ય કાર્યમાં પ્રુફ-વાંચન, પરિશિષ્ટો તૈયાર કરવા, પૃષ્ઠાંકો બદલવામાં અનેક મુનિરાજો, સાધ્વીજીઓ, શ્રાવક-શ્રાવિકાઓ સહાયક બન્યા છે. સહુનો આભાર. શ્રુતભક્તિની અનુમોદના !

જુદા જુદા અનેક જ્ઞાનભંડારોના ગ્રંથો, સૂચીપત્રો વગેરેનો અમે ઉપયોગ કર્યો છે. તે બધાં અને વિશેષતઃ કોબા સ્થિત આ. કેલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરના કોમ્પ્યુટરમાં સંચિત વિગતો વગેરેની માહિતી અમને ઉપલબ્ધ કરી આપવા માટે વિદ્વદર્થ મુનિરાજશ્રી અજયસાગરજી મ. તથા જ્ઞાનમંદિરના સંચાલકો, કાર્યકરો વગેરે વિશેષ ધન્યવાદને પાત્ર છે !


જિનાજા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડં

ક્ષતિઓ તરફ ધ્યાન દોરવા વિદ્વાનોને વિનંતી.

પ્રસ્તુત ગ્રંથનો ઉપયોગ કરી જૈન સાહિત્યના વિપુલ વૈભવને જાણીએ, માણીએ, પીછાણીએ, અવગાહીએ એ જ આશા સાથે.

આ. શ્રી ઝુંકારસૂરિ આરાધના ભવન
જસવંતપુરા, જિ. જાલોર રાજસ્થાન
મા. સુ. ૬, વિ. સંવત ૨૦૬૦
(આ. વિજયભદ્રંકરસૂરિ મ.સા. સ્વર્ગવાસ દિન)

પૂ. આ. ભ. શ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજ સા. ના
શિષ્યરત્ન મુનિરાજશ્રી જિનચન્દ્ર વિ. મ. સા. ના
વિનેય આ. વિજયમુનિચન્દ્રસૂરિ





स्व. प्रो. हिरालाल रसिकदास कापडिया

(१८८४-१९७९)

સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા

એક પરિચય

લે. રમણલાલ ચી. શાહ


સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા (ઈ.સ. ૧૮૮૪-૧૯૭૯) એટલે જૈન સાહિત્ય-સંશોધનના ક્ષેત્રે વીસમી સદીમાં થઈ ગયેલી એક વિરલ વિભૂતિ. જેમણે કૉલેજ કે યુનિવર્સિટીની કક્ષાએ પ્રાકૃત-અર્ધમાગધીનો વિષય નહોતો લીધો છતાં કૉલેજ અને યુનિવર્સિટીની કક્ષાએ એ વિષયનું અધ્યાપનકાર્ય કર્યું હતું, જેઓ પોતે પી.એચ.ડી. થયા નહોતા છતાં પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓના માર્ગદર્શક બન્યા હતા અને ડિ. લિટ્.ની ડિગ્રી માટે નિર્ણાયક (રેફરી) બન્યા હતા, જેમણે સિત્તેરથી વધુ ગ્રંથો અને એક હજારથી વધુ લેખો લખ્યા હતા, જેઓ રણજિતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય પરિષદનું પ્રમુખસ્થાન કે વિભાગીય પ્રમુખસ્થાન કે ઓરિએન્ટલ કોન્ફરન્સનું પ્રમુખસ્થાન કે પ્રાકૃત-અર્ધમાગધી વિભાગનું પ્રમુખસ્થાન અધિકારપૂર્વક પ્રાપ્ત કરી શક્યા હોત, પરંતુ માન-સત્કાર કે એવાં પદો માટે હંમેશાં નિઃસ્પૃહ અને અલિપ્ત રહ્યા હતા, તથા એ માટે ક્યારેય આયાસ કર્યો નહોતો કે આકાંક્ષા સેવી નહોતી, એવા પ્રો. હીરાલાલભાઈએ પોતાનું સમગ્ર જીવન સતત આર્થિક સંઘર્ષોની વચ્ચે વિદ્યાવ્યાસંગને માટે સંપૂર્ણપણે સમર્પિત કરી દીધું હતું. માત્ર જૈન સાહિત્ય જ નહિ, ઈતર સાહિત્યનો અને સાહિત્યેતર વિષયોનો એમનો અભ્યાસ ઘણો ઊંડો હતો. એમની પ્રતિભા એવી બહુમુખી હતી કે કોઈપણ વિષયમાં એમને અચૂક રસ પડે જ અને એવા વિષય પર પોતે ઉચ્ચસ્તરીય લેખ લખી શકે. એમનું સાહિત્ય વાંચતાં આશ્ચર્ય થાય કે અહો, એમણે કેટલા બધા વિષયોનું કેટલું બધું વાંચ્યું છે ! પાને પાને એમણે સંદર્ભો આપ્યા જ હોય. આટલું બધું એમણે ક્યારે વાંચ્યું હશે ? એવો પ્રશ્ન થાય. એમની સાથે કોઈ પણ વિષયની વાત કરીએ તો જાણે માહિતીનો સ્રોત વહેવા લાગે. એમાં પણ એમની ચીવટ અને ચોકસાઈ એટલી બધી કે આપણે એ માટે એમના ઉપર સંપૂર્ણપણે આધાર રાખી શકીએ.

હીરાલાલભાઈનો જન્મ ૨૮મી જુલાઈ ૧૮૮૪ના રોજ (વિ.સં. ૧૯૫૦ના અષાઢ વદ અગિયારસના દિવસે) સુરતમાં થયો હતો. એમના પિતાનું નામ રસિકદાસ અને માતાનું નામ ચંદાગૌરી હતું. તેઓ સુરતમાં ત્યારે નાણાવટમાં રહેતા હતા.

રસિકદાસને પાંચ સંતાનો હતાં, ત્રણ દીકરા અને બે દીકરી. એમાં સૌથી મોટા તે હીરાલાલ. બીજા બે દીકરા તે મણિલાલ અને ખુશમનભાઈ. બે દીકરીઓ તે નયનસુખ અને શાન્તાબહેન. રસિકદાસના પાંચે સંતાનો બહુ તેજસ્વી હતાં.

સદ્ભાગ્યે હીરાલાલભાઈની જન્મકુંડળી એમનાં સ્વજનો પાસેથી મળી છે. ભવિષ્યમાં કોઈને આ કુંડળીના આધારે એમના જીવનનો અભ્યાસ કરવો હોય તો તે ઉપયોગી થઈ શકે એ આશયથી એક દસ્તાવેજ માહિતી તરીકે આ કુંડળી અહીં આપી છે. હીરાલાલભાઈનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હતો.

(આ ગ્રહોનાં અંશ આ પ્રમાણે છે : સૂર્ય-૧૨, ચંદ્ર-૧૩, મંગળ-૨૦, બુધ-૧, ગુરુ-૨, શુક્ર-૯ શનિ-૨૬, રાહુ-૧૧)



રસિકદાસના પિતા તે વરજદાસ અને એમના પિતા તે દુલ્લભદાસ. એમની પેઢીનાં નામ આ પ્રમાણે મળે છે : રસિકદાસ-વરજદાસ-દુલ્લભદાસ-હરકિશનદાસ-ગુલાબચંદ-ઝવેરશા-કસ્તુરશા-લખમીશા.

રસિકદાસના વડવાઓ ઈસ્વીસનની અઢારમી સદીમાં ભાવનગરથી સૂરત વેપારાર્થે આવીને વસેલા. આ વડવાઓના પણ વડવાઓ મૂળ ઉત્તર ગુજરાતમાં પાટણના વતની હતા. તેઓ વૈષ્ણવ ધર્મ પાળતા હતા. તેઓ સ્થળાંતર કરતા

કરતા કાઠિયાવાડમાં આવેલા. ત્યાંથી કેટલાક સૂરત આવીને વસેલા. એમની જ્ઞાતિ દશા દિશાવળ હતી. આ જ્ઞાતિના કેટલાક સભ્યો જૈન ધર્મ પાળતા અને કેટલાક વૈષ્ણવ ધર્મ. તેઓ વચ્ચે રોટી-બેટીનો વ્યવહાર રહેતો. એમની જ્ઞાતિ પાટણ, ભાવનગર, સૂરત, મુંબઈ વગેરે શહેરો અને આસપાસનાં ગામોમાં પથરાયેલી રહી છે. દુલ્લભદાસે વેપારાર્થે સૂરતમાં આવીને નાણાવટમાં વસવાટ ચાલુ કરેલો.

દુલ્લભદાસના પુત્ર વરજદાસના જીવનમાં એક ઘટના એવી બની કે જેથી તેઓ વૈષ્ણવ મટીને જૈન બની ગયા હતા. એક વખત સૂરતના પોતાના ઘરના વાડામાં ખોદકામ કરતાં ધાતુની એક નાની જિનપ્રતિમા નીકળી. પોતે વૈષ્ણવ હતા એટલે આ પ્રતિમાનું શું કરવું તે વિશે વિચાર કરતાં છેવટે એવો નિર્ણય લીધો કે પ્રતિમાને તાપી નદીમાં પધરાવી દેવી. તેઓ પ્રતિમા લઈને નદીએ ગયા. નદીના સહેજ ઊંડા પાણીમાં જઈને પ્રતિમા જાતે પધરાવવી જોઈએ એટલે કિનારે એક જોડ કપડાં મુકી તેઓ નદીમાં ઊતર્યા. કમર સુધીના પાણીમાં જઈને તેમણે પ્રાર્થના કરીને પ્રતિમા પધરાવી. ત્યાર પછી તેઓ પાછા ફરતા હતા ત્યારે લાગ્યું કે પોતાના ધોતિયામાં કોઈ પથરો ભરાઈ ગયો છે. એમણે એ હાથમાં લઈને જોયું તો પેલી પ્રતિમા જ હતી. પ્રતિમા પોતે એવી ચીવટપૂર્વક પાણીમાં પધરાવી હતી કે ધોતિયામાં ભરાઈ જાય એવી કોઈ શક્યતા નહોતી. એટલે એમને આ ઘટનાથી આશ્ચર્ય થયું. પ્રતિમા હાથમાં લઈ ફરી તેઓ ઊંડા પાણીમાં ગયા અને પ્રતિમા ચોક્કસાઈપૂર્વક આથે પધરાવી. પછી પાણીમાં પાછા ફરતા હતા ત્યાં ફરીથી એમને લાગ્યું કે ધોતિયાનો છેડો ઝંચાય છે. પ્રતિમા પાછી તો નહિ આવી હોય ને ? પાણીમાં હાથ નાખીને વસ્તુ બહાર કાઢી તો એમના આશ્ચર્ય વચ્ચે એ જ પ્રતિમા જોવા મળી. બે વખત આવું બન્યું એથી વરજદાસ એકદમ વિચારે ચઢી ગયા. હવે પ્રતિમા પધરાવવી કે નહિ તેની વિમાસણ થઈ. છેવટે એમ નિર્ણય કર્યો કે કોઈની સલાહ લઈને પછી પ્રતિમા પધરાવવી. ઘરે આવીને એમણે બધાને વાત કરી. બધાંનો એવો મત પડ્યો કે કોઈક જૈન સાધુ મહારાજને પૂછીને પછી એ કહે તેમ કરવું કે જેથી મનમાં વહેમ ન રહી જાય. બીજે દિવસે વરજદાસ પ્રતિમા લઈને પાસેના ઉપાશ્રયમાં એક જૈન સાધુ ભગવંત પાસે ગયા. વિગત જાણીને સાધુ મહારાજે કહ્યું કે 'એવું અનુમાન થાય છે કે તમારા મકાનના આગળના કોઈક માલિકોમાંથી કોઈકને ત્યાં ઘરદેરાસર હશે અને તેઓએ કોઈક આપત્તિના પ્રસંગમાં પ્રતિમાને જમીનમાં

ભંડારી દીધી હશે. આ અખંડિત પ્રતિમા નમિનાથ ભગવાનની છે. તમારા હાથે જમીનમાંથી બહાર આવી છે અને તમે એને નદીમાં બે વખત પધરાવવા છતાં એ તમારી પાછળ આશ્ચર્યકારક રીતે આવી છે એટલે એમાં કોઈ સંકેત લાગે છે. પ્રતિમાને તમારું ઘર છોડવું નથી.’ ઘણું મંથન કર્યા પછી વરજદાસે નિર્ણય કર્યો કે પોતાના મકાનમાં ઘરદેરાસર (ગૃહચૈત્ય) કરાવવું અને ત્યાં જિનપ્રતિમાની વિધિસર પ્રતિષ્ઠા કરાવવી. એ પ્રમાણે નિર્ણય કરીને એમણે જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તેમના કુટુંબે જૈન ધર્મ અંગીકાર કર્યો. આ ઘટના પછી જેમ જેમ ચડતી થતી ગઈ તેમ તેમ ઉત્તરોત્તર જૈન ધર્મમાં એમની શ્રદ્ધા દૃઢ થતી ગઈ. એમના પુત્ર રસિકદાસને તો આ જૈન ધર્મ જન્મથી જ વારસામાં મળ્યો હતો.

રસિકદાસનું કુટુંબ સંસ્કારી અને ધર્મપરાયણ હતું. સૂરતમાં એમનો કાપડનો વેપાર હતો. નાણાવટમાં એમની કાપડની દુકાન હતી. કાપડના એમના વેપારને કારણે એમની અટક કાપડિયા થઈ ગઈ. એની પહેલાં એમની અટક શી હતી તે જાણવા મળતું નથી. પરંતુ ‘શાહ’, ‘મહેતા’ અથવા ‘પટણી’ અટક હોવાનો સંભવ છે એમ એમનાં કુટુંબીજનો કહે છે. અંગ્રેજોના આગમન પૂર્વે લોકોમાં અટકનું બહુ મહત્વ નહોતું.

રસિકદાસની આર્થિક સ્થિતિ મધ્યમ કક્ષાની થઈ ગઈ હતી. એમનો કાપડનો વેપાર જેમતેમ ચાલતો હતો. આથી જ એમણે પોતાના ત્રણે તેજસ્વી દીકરાઓને પોતાના કાપડના વ્યવસાયમાં ન જોડતાં, મુંબઈ મોકલીને કોલેજ અને યુનિવર્સિટીનું શિક્ષણ અપાવીને ત્યાંના શિક્ષણક્ષેત્રમાં મોકલ્યા હતા. એમની બન્ને દીકરીઓ મેટ્રિક સુધી ભણી હતી, જે એ જમાનામાં અસાધારણ ઘટના ગણાતી.

હીરાલાલભાઈ ભણવામાં એટલા તેજસ્વી હતા કે મિડલસ્કૂલમાં અને હાઈસ્કૂલમાં એમને શિષ્યવૃત્તિ મળી હતી. એમણે ૧૯૧૦માં વર્નાક્યુલર ફાઈનલ અને મેટ્રિક્યુલેશનની એમ બંને પરીક્ષા સાથે આપી હતી. અને બંનેમાં સારા માર્ક્સ સાથે તેઓ ઉત્તીર્ણ થયા હતા. હીરાલાલભાઈ ૧૯૧૦માં મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા હતા. ત્યારે કૉલેજનો ચાર વર્ષનો અભ્યાસક્રમ હતો : પ્રિવિયસ, ઈન્ટર, જુનિયર અને સિનિયરનો.

ઈન્ટર આર્ટસની પરીક્ષામાં સારા માર્ક્સ મળતાં હીરાલાલભાઈને શિષ્યવૃત્તિ મળી હતી. વળી ગણિતના વિષયમાં સૌથી વધુ માર્ક્સ મેળવવાને માટે એમને ‘કામા પ્રાઈઝ’ મળ્યું હતું. આ પ્રાઈઝને લીધે જ તેઓ ગણિત જેવો અત્યંત કઠિન વિષય બી.એ.માં પણ લેવા પ્રેરાયા હતા. ૧૯૧૪માં તેઓ ગણિતના વિષય સાથે પરીક્ષામાં બેઠા અને બી.એ. ઓનર્સની ડિગ્રી પ્રાપ્ત કરી. એમાં પણ ઘણા સારા માર્ક્સ સાથે તેઓ પાસ થયા અને આગળ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મળી એટલે એમ.એ.માં પણ તેમણે એ જ વિષય રાખ્યો હતો. ત્યારે એમ.એ.નો અભ્યાસ જાતે કરવો પડતો. તૈયારી થાય ત્યારે વિદ્યાર્થીઓ અગાઉથી નામ નોંધાવીને પરીક્ષા આપી શકતા. હીરાલાલભાઈને એ તૈયારી કરતાં ચાર વર્ષ લાગ્યા.

૧૯૧૮માં ગણિતના વિષય સાથે હીરાલાલભાઈ મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. ગણિતનો વિષય એટલો કઠિન ગણાતો કે બી. એ. માં જ બહુ ઓછા વિદ્યાર્થીઓ એ વિષય લેતા અને એમ.એ.માં તો એથી પણ ઓછા વિદ્યાર્થીઓ રહેતા. વળી એ વિષયના પ્રશ્નપત્રો એટલા અઘરા નીકળતા કે કેટલીવાર

તો કોઈ વિદ્યાર્થી પાસ ન થઈ શકે. હીરાલાલભાઈ એમ.એ. થયા એ વર્ષે ગણિતના વિષયમાં પાસ થનાર ફક્ત તેઓ એકલા જ હતા.

હીરાલાલભાઈ બી.એ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હતા ત્યારે ઓગણીસ વર્ષની વયે, ઈ.સ. ૧૯૧૩માં (વિ. સં. ૧૯૬૯)માં વૈશાખ વદ તેરસના રોજ એમનાં લગ્ન ભાવનગરના, એમની દશા દિશાવળ જ્ઞાતિના શેઠ શ્રી છોટાલાલ કલ્યાણદાસનાં દીકરી ઈન્દિરાબહેન સાથે થયાં હતાં. ઈન્દિરાબહેનની ઉંમર ત્યારે પંદર વર્ષની હતી. એમનો જન્મ ભાવનગરમાં ઈ. સ. ૧૮૯૮ (વિ. સં. ૧૯૫૪માં) માહ સુદ સાતમના રોજ થયો હતો. એમનું કુટુંબ વૈષ્ણવ ધર્મ પાળતું હતું.

ઈન્દિરાબહેને નાની વયમાં જ માતાપિતા ગુમાવ્યાં હતાં. આથી એમનો ઉછેર એમના મોટા ભાઈ રાવસાહેબ વૃંદાવન છોટાલાલ જાદવ અને એમનાં પત્ની સન્મુખગૌરીની છત્રછાયામાં થયો હતો.

ઈન્દિરાબહેન ભણવામાં તેજસ્વી હતાં. શાળામાં તેઓ પ્રથમ નંબરે આવતાં. એમણે અંગ્રેજી ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેર વર્ષની વયે એમણે ભાવનગરના દશા દિશાવળ કેળવણી મંડળ તરફથી યોજાયેલી નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. નિબંધનો વિષય હતો ‘મા-બાપની છોકરાઓ પ્રત્યેની ફરજ અને છોકરાંઓની મા-બાપ પ્રત્યેની ફરજ’ આ સ્પર્ધામાં એમનો નિબંધ સર્વશ્રેષ્ઠ ગણાયો હતો અને એમને પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું હતું.

શાળામાં ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યા પછી ઈન્દિરાબહેને ઘરે રહીને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો. લગ્ન પછી એમણે ઈ.સ. ૧૯૧૭માં પોતાની જ્ઞાતિના એ જ કેળવણી મંડળ તરફથી યોજાયેલી નિબંધ સ્પર્ધામાં ‘પોતે કરેલા ખાસ પ્રવાસનું વર્ણન’ એ વિષય પર નિબંધ લખી પ્રથમ પારિતોષિક મેળવ્યું હતું.

૧૯૧૮માં એમ. એ. થયા પછી હીરાલાલભાઈને મુંબઈની વિલસન કૉલેજમાં ગણિતના પ્રાધ્યાપક તરીકે નિમણૂક મળી હતી. એ દિવસોમાં શાળા અને કૉલેજમાં અધ્યાપક તરીકે નોકરી કરનાર માટે બી.ટી. (આજની બી.એડ.)ની ડિગ્રી ફરજિયાત હતી. હીરાલાલભાઈ પાસે એ ડિગ્રી નહોતી. પરંતુ અરજી કરનાર ઉમેદવારોમાં તેમના માર્ક્સ સૌથી સારા હતા અને એમનો ઈન્ટરવ્યૂ પણ એવો સારો ગયો હતો કે કૉલેજ યુનિવર્સિટીની ખાસ પરવાનગી મેળવીને બી.ટી.ની ડિગ્રી વગર ગણિતના પ્રાધ્યાપક તરીકે એમની નિમણૂક કરી હતી.

કૉલેજમાં નોકરી મળતાં તેઓ ઈન્દિરાબહેન સાથે મુંબઈ રહેવા આવ્યા હતા. ભૂલેશ્વરમાં ભગતવાડીમાં તેમણે એક મકાનમાં ત્રીજે માળે ડબલ રૂમ ભાડે રાખી હતી. તેઓ ત્યાંથી પગે ચાલીને રોજ વિલસન કૉલેજમાં જતા. એ દિવસોમાં તેઓ કોટ, પેન્ટ, ટાઈ, બુટ, મોજાં વગેરે પહેરતા. ઘરમાં પહેરણ અને ધોતિયું પહેરતા. તેઓ ધાર્મિક વૃત્તિના હતા એટલે કૉલેજમાં જતાં પહેલાં રોજ સવારે નાહીને પાસે આવેલા ચિંતામણિ પાર્શ્વનાથ કે ગોડીજી પાર્શ્વનાથના દેરાસરે પૂજા કરવા જતા. સવારના શાક વગેરે લાવવાનું કામ પણ જાતે કરતા. વિલસન કૉલેજમાં ભણાવ્યા પછી એમણે ધોબીતળાવ પર આવેલી સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ કૉલેજમાં ગણિતના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું અને ત્યાર પછી બે વર્ષ એ જ વિસ્તારમાં

બાજુમાં આવેલી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગણિતના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું હતું. આમ ૧૯૧૮થી ૧૯૨૪ સુધી હીરાલાલભાઈ ગણિતના વિષયના પ્રાધ્યાપક રહ્યા હતા.

ગણિતના વિષયમાંથી પ્રાકૃતના વિષય તરફ હીરાલાલભાઈ કેવી રીતે વળ્યા એ પણ એક રસિક ઘટના છે. તેઓ ગણિતનો વિષય કૉલેજમાં ભણાવતા હતા તે દરમિયાન કુટુંબના ધર્મસંસ્કાર તથા સાધુ-ભગવંતો સાથેના પરચિયથી એમને જાણવા મળ્યું હતું કે જૈન શાસ્ત્રગ્રંથોમાં ગણિતાનુયોગ નામનો વિભાગ છે. આથી એ વિષયમાં પ્રવેશવાની એમને સહજ રુચિ થઈ. પરંતુ એ બધું સાહિત્ય તો અર્ધમાગધી ભાષામાં હતું. આથી એમણે સ્વબળે અર્ધમાગધી પણ શીખવા માંડ્યું. દરમિયાન એમને એવો વિચાર પણ આવ્યો કે જૈન ગણિતાનુયોગની કેટલીક વાતો જો અંગ્રેજીમાં મૂકવામાં આવે તો ઘણા લોકો સુધી, ખાસ તો એ વિષયના વિદ્વાનો સુધી પહોંચે. આથી એમણે ‘Jain Mathematics’ એ વિષય પર સંશોધન લેખ તૈયાર કરવા માટે મુંબઈ યુનિવર્સિટીને અરજી કરી. તે મંજૂર થઈ અને એમને રિસર્ચ ગ્રાન્ટ મળી. આથી તેઓ એ વિષયમાં પૂરા મનથી લાગી ગયા અને થોડા વખતમાં જ પ્રાકૃત ભાષાના રસિયા બની ગયા.

હીરાલાલભાઈ કૉલેજમાં ગણિતનો વિષય ભણાવતા હતા, પરંતુ બી.એ. અને એમ.એ.માં એ વિષય લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી જ ઓછી રહેતી હોવાનો કારણે પ્રાધ્યાપક તરીકેની નોકરીની અનિશ્ચિતતા રહેતી. વિલસન કૉલેજના યુરોપિયન પ્રિન્સિપાલ પોતે ગણિતના વિષયના પ્રાધ્યાપક હતા. એટલે એમને હીરાલાલભાઈ પ્રત્યે સદ્ભાવ હતો. તેઓ હીરાલાલભાઈને નભાવતા. પરંતુ પછી એ નોકરી છોડવાનો વખત આવ્યો. અલબત્ત ત્યાર પછી એમને તરત બીજે નોકરી મળી ગઈ. પણ મનમાં ખાતરી થઈ ગઈ કે આગળ જતાં મુશ્કેલી આવશે. આથી એમણે પોતાનું ધ્યાન પ્રાકૃત ભાષા તરફ વાળ્યું. એવામાં પૂનાના ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરની જાહેરાત આવી. તેઓને સરકાર તરફથી મળેલી જૈન ધર્મની, અર્ધમાગધીમાં લખાયેલી હસ્તપ્રતોનું વર્ણનાત્મક સૂચીપત્ર તૈયાર કરાવવું હતું. એ માટે હીરાલાલભાઈએ અરજી કરી અને બી.એ. તથા એમ. એ. માં એમનો અર્ધમાગધી વિષય ન હોવા છતાં એમની એ વિષયની સજ્જતા જોઈને હસ્તપ્રતોના કામ માટે સંસ્થાએ એમની નિમણૂક કરી હતી.

ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરમાં ૧૯૩૦ થી ૧૯૩૬ના ગાળા સુધીમાં થોડો થોડો વખત મુંબઈથી પૂના જઈને અને ત્યાં રહીને એમણે હસ્તપ્રતોનું કામ કરવા માંડ્યું હતું. એ રીતે તેઓ બધું મળીને સાડા ત્રણ વર્ષ પૂનામાં રહ્યા હતા. ત્યાં એમણે એ સંસ્થાની જૈન ધર્મની સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં લખાયેલી આશરે સાડાત્રણ હજાર હસ્તપ્રતોનું સૂચીપત્ર (Descriptive Catalogue) તૈયાર કરી આપ્યું, જે એ સંસ્થા તરફથી પ્રકાશિત થયેલું છે. આ રીતે સાડા ત્રણ હજાર હસ્તપ્રતોનાં પાનેપાનાં એમના હાથમાં ફરી ગયાં. હસ્તપ્રતોની લિપિ વાંચવાનું કામ ઘણું શ્રમભરેલું છે. આ કામ કરવાથી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની એમની સજ્જતા વધતી ગઈ. એમનું શબ્દજ્ઞાન પણ વધતું ગયું. પ્રાકૃત ભાષાનો એમણે કોઈ શૈક્ષણિક સંસ્થામાં વ્યવસ્થિત અભ્યાસ કર્યો નહોતો. એ વિષયમાં એમણે કોઈ ડિગ્રી પણ મેળવી નહોતી. એમ છતાં કુટુંબના સંસ્કાર, દૃઢ મનોબળ, ખંત, ઉત્સાહ સૂઝ ને અભ્યાસથી એમણે પ્રાકૃત-અર્ધમાગધી ભાષા પર, અસાધારણ પ્રભુત્વ મેળવી લીધું હતું. એમાં પૂનાના હસ્તપ્રતોના કામે ઘણી સહાય કરી. પ્રાકૃત ભાષા માટે એમની પ્રીતિ એટલી બધી વધી ગઈ કે એને માટે સંસ્કૃત શબ્દ ‘પ્રાકૃત’ બોલવાને બદલે ‘પાઈય’ શબ્દ બોલવો અને લખવો એમને વધુ ગમતો. પાઈયમાં બોલવું

કે લખવું એ એમને મન રમત વાત થઈ ગઈ. એમણે પ્રાકૃત ભાષાનું વ્યાકરણ લખ્યું અને એનો શબ્દકોશ પણ તૈયાર કરીને છપાવ્યો. આ રીતે ગણિત ઉપરાંત વ્યાકરણ અને શબ્દકોશ પણ એમના રસના વિષયો બની ગયા. આગળ જતાં એમણે ‘પાઈય (પ્રાકૃત) ભાષા અને સાહિત્ય’ એ નામનો ગ્રંથ લખ્યો. એમાં એમણે પ્રાકૃત ભાષાનું સ્વરૂપ, એના પ્રકારો અને એમાં લખાયેલા સાહિત્યનો સવિગત પરિચય આશરે અઢીસો પેટાશીર્ષક હેઠળ આપ્યો છે.

હીરાલાલભાઈ અને ઈન્દિરાબહેનનું દામ્પત્યજીવન કેટલું મધુર હતું. તેની પ્રતીતિ તો હીરાલાલભાઈએ એમનાં અંગ્રેજી પુસ્તક ‘The student's English Paia Dictionary’ની અર્પણ પત્રિકા વાંચતાં થાય છે. આ પુસ્તક એમણે ઈન્દિરાબહેનને અર્પણ કર્યું છે અને એની અર્પણપત્રિકા પ્રાકૃત ભાષામાં લખી છે, જે નીચે પ્રમાણે છે :

પણામપત્તિમા -જીઈ મજ્જા નાનારાહણમ્મિ સયયમમેગહા સુગમત્તળં કહં તીઈ મે ધમ્મપદિણીઈ ઇન્દિરાઈ
પણમિજ્ઞાઈ સાણન્દં ઇમો વિજ્જત્થિણો અઙ્ગિલ-પાઈય સદ્ધકોસો હીરાલાલેણ સિરિ રસિકદાસ તણેણ વીરસંવચ્છરે
૨૪૬૭ મે નાણ પચ્ચમીઈ ઇન્દુવાસરે (૪-૧૧-૪૦)

રસિકદાસના ત્રણે દીકરાઓ મુંબઈ રહેવા ગયા હતા. બીજી બાજુ સૂરતમાં એમની તબિયત સારી રહેતી નહોતી અને દુકાન પણ બરાબર ચાલતી નહોતી. આથી તેઓ પત્ની સાથે મુંબઈમાં હીરાલાલભાઈ સાથે રહેવા આવી ગયા.

આ બાજુ પૂનાના ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરનું કાર્ય પૂરું થઈ જતાં અને આવક બંધ થતાં હીરાલાલભાઈ માટે ફરી પાછો કુટુંબના નિર્વાહનો સવાલ ગંભીર બની ગયો હતો. તેમાં માતાપિતા સૂરતથી રહેવા આવેલાં. બંને નાના ભાઈઓ અને બંને બહેનોનાં લગ્નના ખર્ચ થોડે થોડે વખતે આવેલા. બીજા વ્યવહારો કરવાના આવતા. પોતાના સંતાનોને ભણાવવાનો ખર્ચ હતો. કમાણી કંઈ જ નહિ અને ખર્ચ તો વધતા જ જતા હતા. માથે દેવું થતું જતું હતું. આવી તંગ પરિસ્થિતિમાં કામકાજ વગરના હીરાલાલભાઈ વારંવાર નિરાશ થઈ જતા. એમ કરતાં કરતાં તનાવ અને તીવ્ર હતાશાને લીધે તેઓ માનસિક રીતે ભાંગી પડવા લાગ્યા. તેમને નર્વસ બ્રેકડાઉન જેવું થઈ ગયું હતું. આવી માનસિક દશામાં એમના વિષમ દિવસો પસાર થતા હતા. એવામાં એક દિવસ આપઘાત કરવાનો વિચાર એમના મનમાં આવી ગયો. તેઓ મકાનના કંઠેડા ઉપર ચઢી પડતું મૂકવા જતા હતા ત્યાં એમનું સતત ધ્યાન રાખનાર એમનાં પત્ની ઈન્દિરાબહેને તરત પાસે દોડી જઈ એમનું પહેરણ ખેંચીને નીચે ઉતાર્યા અને ઘરમાં લઈ આવ્યાં. ત્યાર પછી તેઓ સતત હીરાલાલભાઈની સંભાળ રાખવા લાગ્યાં અને સાંત્વન આપવા લાગ્યા. આ માનસિક માંદગી બે વર્ષ ચાલી એની અસર હીરાલાલભાઈના શરીર ઉપરાંત એમની બુદ્ધિશક્તિ અને સ્મરણશક્તિ ઉપર થઈ. કુટુંબીજનોએ એક કુશળ વૈદ્યના ઉપચાર ચાલુ કર્યા. વૈદ્ય એક ઔષધિ દૂધમાં પલાળીને રોજ સવારના ખાવા માટે આપી હતી. એમ કરતાં ધીરે ધીરે એમની માનસિક સ્વસ્થતા વધતી ગઈ અને સ્મરણશક્તિ પણ પાછી આવવા લાગી. બે વર્ષને અંતે તેઓ પહેલાંના જેવા જ સ્વસ્થ થઈ ગયા. સ્મૃતિશક્તિ બરાબર સારી થઈ ગઈ. ત્યાર પછી તેઓ પોતાનું લેખનકાર્ય પહેલાંની જેમ જ વ્યવસ્થિત રીતે કરવા લાગ્યા હતા.

હીરાલાલભાઈનાં ચારે સંતાનો ભણવામાં તેજસ્વી હતાં. એમને ભણાવવાનો ખર્ચ વધતો જતો હતો, પરંતુ પોતાને કોઈ નોકરી મળતી નહોતી. સંશોધનકાર્ય માટે યુનિવર્સિટી તરફથી મુકરર રહેલી સહાય મળતી. પણ એવી નજીવી રકમમાંથી કુટુંબનું ભરણપોષણ ક્યાંથી થાય ? એવામાં એક સગાની ભલામણથી સૂરતના એક મહિલા વિદ્યાલયમાં એમને એક શિક્ષક તરીકેની નોકરી મળી ગઈ એટલે તેઓ સપરિવાર સૂરત આવીને રહ્યા. સૂરતમાં સમય મળતો હોવાથી એમની તથા ઈન્દિરાબહેનની લેખનપ્રવૃત્તિ ફરીથી ચાલુ થઈ.

ઈન્દિરાબહેનમાં લેખનશક્તિ તો હતી, પણ લગ્ન પછી સંયુક્ત કુટુંબનું જીવન, સૂરત, મુંબઈ, પૂના એમ જુદે જુદે સ્થળે ઘર વસાવવું, ઘરકામ કરવું, સંતાનોને ઉછેરવાં અને પતિ હીરાલાલભાઈની સારસંભાળ રાખવી તથા એમનાં લખાણોની નકલ કરી આપવી, ગ્રંથોમાંથી સંદર્ભો કાઢી આપવા વગેરેમાં એમનો સમય વપરાઈ જતો. આથી તેઓ ખાસ કશું લખી શકેલાં નહિ, પરંતુ સૂરત આવવાનું થયું ત્યાર પછી એમને કેટલોક સમય મળવા લાગ્યો. એ વખતે એમણે ‘પ્રાચીન અને અર્વાચીન સમયની સ્ત્રીઓનો પહેરવેશ’ એ વિષય ઉપર એક સચિત્ર પુસ્તક તૈયાર કર્યું જે ૧૯૩૯માં પ્રકાશિત થયું છે. આ પુસ્તક વાંચતાં પ્રતીતિ થાય છે કે આટલા એક નાના વિષયનો કેટલો બધો ઊંડો અભ્યાસ એમણે કર્યો છે ! એમાં કેટલી બધી પારિભાષિક માહિતી એમણે આપી છે, જેમાંની કેટલીક તો હવે કાલગ્રસ્ત થઈ ગઈ છે. કોઈ યુનિવર્સિટીના પીએચ.ડી.ના શોધપ્રબંધ જેટલી યોગ્યતા આ ગ્રંથ ધરાવે છે. આ ગ્રંથ પછી એમની લેખનપ્રવૃત્તિ ફરી શાન્ત થઈ ગઈ, કારણ કે એમણે બધો સમય હીરાલાલભાઈના લેખનકાર્યમાં સહાયરૂપ થવામાં જ સમર્પિત કર્યો હતો.

મહિલા વિદ્યાલયની નોકરી અને લેખનકાર્ય ચાલતાં હતા તે દરમિયાન એમ.ટી.બી. કૉલેજના પ્રાધ્યાપક અને આચાર્ય શ્રી એન. એમ. શાહે હીરાલાલભાઈમાં અંગત રસ લીધો. પ્રાકૃત ભાષામાં હીરાલાલભાઈએ જે સંગીન કાર્ય કર્યું તેને પરિણામે એમને સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં આચાર્ય શ્રી એન. એમ. શાહે પ્રાકૃત-અર્ધમાગધી વિષયમાં પ્રાધ્યાપક તરીકે નિમણૂક અપાવી. હીરાલાલભાઈએ બી.એ. અને એમ.એ.માં પ્રાકૃતનો વિષય લીધો નહોતો અને યુનિવર્સિટીના નિયમ મુજબ તો જેમણે બી.એ. અને એમ.એ.માં પ્રાકૃતનો વિષય લીધો હોય તે જ કૉલેજમાં એ વિષય ભણાવી શકે. પરંતુ હીરાલાલભાઈએ પ્રાકૃત ભાષાના વિષયમાં જે સંશોધન લેખો લખ્યા હતા અને પૂનામાં એ વિષયમાં જે સંગીન કાર્ય કર્યું હતું તે જોતાં, એમની સજ્જતા અને યોગ્યતાની પ્રતીતિ થતાં મુંબઈ યુનિવર્સિટીએ એ વિષયમાં એમની પ્રાધ્યાપક તરીકે નિમણૂક કરવાની અપવાદરૂપે છૂટ એમ.ટી.બી. કૉલેજને આપી હતી. આ ઘટના પણ એ વાતની ખાતરી કરાવે છે કે તેઓ જે વિષયનો અભ્યાસ કરતા તેમાં ઘણાં ઊંડા ઊતરતા અને તેમાં લેખન-અધ્યયન કરવાની તથા અધ્યાપન કરાવવાની યોગ્યતા પ્રાપ્ત કરતા.

હીરાલાલભાઈએ પહેલાં મુંબઈમાં ગણિતના વિષયના અને પછીનાં વર્ષોમાં સૂરતમાં એમ.ટી.બી. કૉલેજમાં પ્રાકૃત-અર્ધમાગધીના વિષયના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. આ પ્રાકૃત ભાષાનો વિષય લેનારા વિદ્યાર્થીઓ પણ હંમેશા ઘણાં જ ઓછાં રહ્યાં છે. આથી ઈતર વિષયોના પ્રાધ્યાપકોને જેટલું કામ રહે તેટલું ગણિત કે પ્રાકૃતના પ્રાધ્યાપકોને ન રહે. એટલે હીરાલાલભાઈને પહેલેથી જ લેખન-વાંચન માટે ઘણો અવકાશ રહ્યો અને એમની રુચિ પણ એ પ્રમાણે ઘડાતી રહી હતી. તેઓ ગ્રંથો વસાવતા કે જેથી જ્યારે

જે ગ્રંથ જોવો હોય તે તરત ઘરમાં હાજર હોય. એમનો ગ્રંથસંગ્રહ વિશાળ હતો. તેઓ સવારે સાડાનવથી દસ વાગ્યા સુધીમાં જમી લેતા અને પછી વાંચવા-લખવા બેસી જતા. એક સાથે ઘણાં પુસ્તકોનાં સંદર્ભ જોવાના હોય એટલે તેઓ પલંગમાં ઈસ્કોતરો રાખી તેના પર લખતા અને પોતાની આજુબાજુ જરૂરી પુસ્તકો રહેતાં લેખના વિષય પ્રમાણે પુસ્તકો બદલાતાં. એમનાં પત્ની અને સંતાનો તેઓ મંગાવે તે પુસ્તક અભરાઈ કે કબાટમાંથી કઢી લાવતા. હીરાલાલભાઈ સ્ટીલની ટાંકવાળા હોલરથી, ખડિયામાં તે બોળી બોળીને લખતા. તેઓ બજારમાંથી લાલ, ભૂરી, કાળી શાહીની ટીકડીઓ લાવી હાથે શાહી બનાવીને મોટા ખડિયામાં ભરી લેતા. તેમણે જિંદગીભર હોલરથી જ લખ્યું છે. ઈન્ડિયનની શોધ થયા પછી પણ તેમણે હોલરથી જ લખવાનું ચાલું રાખ્યું હતું. લખતી વખતે તેઓ પાસે ચણા-દાળિયા રાખતા. લખતાં થાક લાગે ત્યારે વચ્ચે તે ખાઈ લેતા. લખવા માટે તેઓ નવા કોરા કાગળ અનિવાર્ય હોય ત્યારે જ વાપરતા. એકંદરે તો ગાંધીજીની કરકસરની ભાવનાથી પ્રભાવિત થયેલા એટલે છાપેલા કાગળોની પાછળની કોરી બાજુમાં પોતાના લેખ લખતા. કેટલીક વાર તેઓ ટપાલમાં આવેલી નિમંત્રણ પત્રિકાઓ ઇત્યાદિના કોરા હાંસિયામાં મુદ્દા ટપકાવી લેતા અને પીન ભરાવીને રાખતા.

એ જમાનામાં અંગ્રેજીમાં લખાયેલા સંશોધનલેખો પ્રકાશિત કરવા માટે માત્ર ગુજરાત જ નહિ, સમગ્ર ભારતમાં ખાસ કોઈ સામાયિકો નહોતાં. બહુધા એવા વિદ્વદ્ભોગ્ય સંશોધન લેખો યુનિવર્સિટીઓનાં જર્નલોમાં છપાતા. યુનિવર્સિટીઓમાં સંશોધન દાન (Research Grant)ની વ્યવસ્થા હતી. ભિન્ન ભિન્ન પ્રકારની શિષ્યવૃત્તિઓ પણ એ માટે અપાતી. પ્રાકૃત-અર્ધભાગધી ભાષા અને જૈન સાહિત્યના વિષયોમાં અંગ્રેજી ભાષામાં સંશોધન લેખો લખનાર વિદ્વાનો ત્યારે ગુજરાતમાં જૂજ હતા એટલે એ વિષયમાં હીરાલાલભાઈને મુંબઈ યુનિવર્સિટીમાંથી શિષ્યવૃત્તિ કે સંશોધન દાન મળતાં. એ માટે તેઓ વિવિધ વિષયો તૈયાર કરતા. સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં તેઓ ભણાવતા હતા તે દરમિયાન તથા એ કૉલેજમાંથી નિવૃત્ત થયા તે પછી એમણે કેટલુંક લેખનકાર્ય મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે કર્યું હતું. હીરાલાલભાઈએ સંશોધનદાનની યોજના હેઠળ ભિન્ન ભિન્ન સમયે નીચે પ્રમાણે અંગ્રેજીમાં સંશોધનગ્રંથો તૈયાર કર્યા હતા, જે યુનિવર્સિટીએ અથવા અન્ય કોઈ સંસ્થાએ પ્રકાશિત કર્યા હતા.

(1) The Jain Mathematics. (2) Outlines of Paleography. (3) The Jain System of Education. (4) The Doctrine of Ahimsa in the Jain Canon. (5) Reconstruction of Ardhamagadhi Grammar. (6) A History of the Canonical Literature of the Jainas.

મુંબઈ યુનિવર્સિટીએ હીરાલાલભાઈને વખતોવખત સંશોધનદાન આપ્યું હતું. એ દર્શાવે છે કે યુનિવર્સિટીની એ વિષયની સમિતિને એમના સંશોધનકાર્યથી પૂરો સંતોષ થયો હતો. એમનું સંશોધનકાર્ય અભ્યાસનિષ્ઠ, પ્રમાણભૂત, તટસ્થ અને નાની નાની જાણવા જેવી ઘણી બધી વિગતોથી સભર હતું.

હીરાલાલભાઈએ આ રીતે ૧૯૩૯ થી ૧૯૪૯ સુધી એમ.ટી.બી. કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. તેમની સજ્જતા એવી હતી કે યુનિવર્સિટીએ પછીથી એમની પીએચ.ડી.ના ગાઈડ તરીકે નિમણૂક કરી હતી. તદુપરાંત ‘સ્પ્રિન્ગર સ્કોલરશીપ’ના રેફરી તરીકે એમની નિમણૂક કરી હતી. જે એ દિવસોમાં ઘણું મોટું માન ગણાતું. યુનિવર્સિટી પ્રાકૃત ઉપરાંત સંસ્કૃત ભાષાના વિષયમાં પણ એમ.એ.ની કક્ષાએ પરીક્ષક તરીકે એમની નિમણૂક કરતી હતી. શિક્ષણ ક્ષેત્રે તેઓ કેવું ઉચ્ચ સ્થાન ધરાવતા હતા તે આ બધી વિગતો ઉપરથી જોઈ શકાય છે.

હીરાલાલભાઈ ધર્મશ્રદ્ધાવાલા હતા. તેઓ એક મહારાજશ્રીએ બતાવ્યા પ્રમાણે સવારસાંજ ધૂપદીપ સાથે પોણો કલાક અનુષ્ઠાનપૂર્વક મંત્રજાપ કરતા. તેઓ જૈનધર્મ વિશે સારી જાણકારી ધરાવતા હતા એટલે ઘણા બધા આચાર્ય ભગવંતો અને મુનિ મહારાજોના નિકટના સંપર્કમાં આવ્યા હતા. તેઓ સૂરતમાં નાણાવટમાં, મુંબઈમાં અને ફરી સૂરતમાં ગોપીપુરામાં સાંકડી શેરીમાં અને પછી કાયસ્થ મહોલ્લામાં રહ્યા હતા. એટલે ત્યાં ચાતુર્માસ અર્થે પધારેલા આચાર્ય ભગવંતો વગેરેને મળવાનું થતું. શેષકાળમાં સૂરતમાંથી પસાર થતાં સાધુ-સાધ્વીઓને પણ વંદન કરવા તેઓ જતા. યુવાનીના દિવસોમાં જૈન ધર્મ વિશેની જાણકારી માટે અથવા પોતે કંઈ લખ્યું હોય તો તે બતાવવા માટે પણ મુંબઈમાં સાધુસાધ્વીઓ પાસે જતા. એમને યુવાન વયે મુંબઈમાં કાશીવાળા વિજયધર્મસૂરીશ્વરજી સાથે ગાઢ પરિચય થયો હતો. એમના બે શિષ્યો તે ન્યાયવિશારદ મુનિશ્રી ન્યાયવિજયજી તથા ન્યાયવિશારદ મુનિશ્રી મંગલવિજયજી પાસે હીરાલાલભાઈએ જૈન દર્શનનો ઊંડો અભ્યાસ કર્યો હતો. આથી હીરાલાલભાઈ તેઓને પોતાના વિદ્યાગુરુ તરીકે ઓળખાવતા. આ ઉપરાંત શ્રી મોહનલાલજી મહારાજ, શ્રી દાનસૂરિજી મહારાજ, શ્રી પ્રેમસૂરિજીદાદા, નેમિસૂરિજી મહારાજ, શ્રી આનંદસાગરસૂરિજી (સાગરજી મહારાજ), શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજ, શ્રી લાવણ્યસૂરિજી મહારાજ, શ્રી કસ્તૂરસૂરિજી મહારાજ વગેરે સાથે તથા તેઓના શિષ્યો-પ્રશિષ્યો સાથે એમને ગાઢ સંબંધ રહ્યો હતો. વિજયરામચંદ્રસૂરિજીએ એક વાર એમને કહ્યું હતું કે ‘તમારા જેવા શાસ્ત્રજ્ઞાતા તો અમારી પાસે પાટ ઉપર શોભે. તમે જો દીક્ષા લેવા તૈયાર થાવ તો તમારા કુંટુંબના ભરણપોષણની જવાબદારી સંઘ પાસે હું કરાવી આપું. એ માટે એક લાખ રૂપિયાની રકમ પહેલાં અપાવું.’ પરંતુ ચારિત્ર્યમોહનીય કર્મના ઉદયને કારણે હીરાલાલભાઈ દીક્ષા લઈ શક્યા નહોતા.

એમ.ટી.બી. કૉલેજમાંથી નિવૃત્ત થયા પછી હીરાલાલભાઈએ પોતાના જીવનનાં ઘણાં વર્ષ સૂરતમાં રહીને સ્વાધ્યાય, સંશોધન, લેખન ઇત્યાદિ પ્રકારના વિદ્યાવ્યાસંગમાં પસાર કર્યાં હતાં. નોકરી છોડ્યા પછી આવકનું કોઈ સાધન રહ્યું નહોતું. લેખનમાંથી ખાસ કોઈ આવક થતી નહિ. લેખોનો પુરસ્કાર આપવાની પ્રથા ત્યારે નહિવત્ હતી. તેમાં વળી આવા સંશોધન લેખો માટે પુરસ્કારની અપેક્ષા રાખવી જ વ્યર્થ હતી. એ લેખો ક્યાંક છપાય એ જ એનું ઈનામ હતું. આથી હીરાલાલભાઈ પોતાની નહિ જેવી બચતમાંથી પોતાનો જીવનવ્યવહાર ચલાવતા. નવા નવા ગ્રંથો ખરીદીને વસાવવાનો યુગ હવે પૂરો થયો હતો. પોતાની પાસેના હવે બિનજરૂરી થયેલા ગ્રંથો પુસ્તકવિકેતાઓને આપીને બદલામાં નવા ગ્રંથો લેવાનું ચાલું થયું હતું. હીરાલાલભાઈનું જીવન એકદમ સાદું અને સંયમી હતું. એમાં એમના પત્ની ઈન્દિરાબહેનનો ઉખાભર્યો સહકાર રહેતો. હીરાલાલભાઈ કહેતા કે ‘હું લક્ષ્મી (ઈન્દિરાનો એક અર્થ લક્ષ્મી) પતિ હોવા છતાં મારે અને લક્ષ્મીને કાયમ બારમો ચંદ્રમા રહ્યો છે.’ હીરાલાલભાઈ હાથે ધોયેલાં સૂતરાઉ ખાદીનાં સફેદ પહેરણ, ધોતિયું અને ટોપી પહેરતા. એમનો જીવનવ્યવહાર સંતોષપૂર્વક ચાલતો. આવી નબળી આર્થિક સ્થિતિમાં પણ એમણે ધન માટે ક્યાંય લોલુપતા કે લાચારી બતાવી નથી. એમનાં દીકરા-દીકરી સૂરત બહાર નોકરીએ લાગી ગયાં હતાં. એટલે એમની જવાબદારી કે ચિંતા પોતાને માથે રહી નહોતી. આવા દિવસોમાં પણ હીરાલાલભાઈની વિદ્યાવ્યાસંગની પ્રવૃત્તિ યથાવત્ રહી હતી. સૂરતમાં એમને ઘેર જ્યારે જ્યારે હું ગયો છું ત્યારે આ મેં નજરે નિહાળ્યું છે. જે દિવસે કોઈ લેખ તૈયાર થઈ જાય તે દિવસે આનંદ આનંદ. રોજ સવારથી તેઓ લેખનકાર્યમાં લાગી ગયા હોય. બપોરના ભોજન પછી પણ એ ચાલુ

હોય. સાંજના ચાર વાગ્યા પછી રોજ નિયમિત તેઓ નજીકના કોઈક ઉપાશ્રયે જઈને કોઈક સાધુભગવંત સાથે જ્ઞાનગોષ્ઠી કરતા અથવા કોઈ ગ્રંથાલયમાં જઈ ગ્રંથો વાંચતા. આ રીતે એમનો દિવસ પૂરો થતો. તેઓ રાતના વહેલા સૂઈ જતા. ઉજાગરો ભાગ્યે જ કરતા. નાટક-સિનેમા જોતા નહિ અને સગાસંબંધીઓને ત્યાં અનિવાર્ય હોય તો જ જતા.

હીરાલાલભાઈને વિદ્યાવ્યાસંગની એટલી બધી ધૂન હતી કે કેટલીક વાર તો તેઓ એમાં જ ખોવાયેલા રહેતા. ગણિતના વિદ્યાર્થી અને અધ્યાપકને જ્યાં સુધી કોઈ દાખલાનો જવાબ ન જડે ત્યાં સુધી એ દાખલો એમના મનમાં રમ્યા જ કરતો હોય તેવું હીરાલાલભાઈના જીવનમાં પહેલાં ગણિતમાં અને પછી સાહિત્ય સંશોધનના વિષયમાં પણ બનતું. તેઓ ખાતા હોય ત્યારે ખબર ન હોય કે ભાષામાં શું પીરસાયું છે. એમને ન્હાવું હોય તો ઈન્દિરાબહેન બાથરૂમમાં પાણી, સાબુ, ટુવાલ, કપડાં વગેરેની બધી તૈયારી કરી આપે ત્યારે હીરાલાલભાઈ સ્નાન કરે. આ રીતે પોતાના ધૂની લેખક પતિની ઘણી જવાબદારી ઈન્દિરાબહેને સ્વેચ્છાપૂર્વક હાંશથી ઉપાડી લીધી હતી. લેખનકાર્યમાં પણ ઈન્દિરાબહેને પુસ્તકો ગોઠવવાં, લેખોની ફાઈલો રાખવી વગેરે ઘણી મદદ જીવનભર હીરાલાલભાઈને કરી હતી અને ઓછી આવક થઈ ગઈ ત્યારે પણ ઘર સારી રીતે સંભાળી લીધું હતું. એમણે એક ભારતીય સન્નારીનો આદર્શ પૂરો પાડ્યો હતો.

નિવૃત્તિનાં વર્ષોમાં આર્થિક સંજોગોને કારણે હીરાલાલભાઈમાં કેટલીક વ્યાવહારિક સ્પષ્ટતા આવી ગઈ હતી. એક વખત હું મારા એક પત્રકાર મિત્ર સાથે સૂરતમાં એમને ઘરે મળવા ગયો હતો. મેં મારા પત્રકાર મિત્રનો પરિચય કરાવ્યો. પછી પત્રકાર મિત્રે પોતાના સામયિકની એક નકલ એમને આપી. નકલ જોઈ લીધા પછી એમણે એ પત્રકાર મિત્રને પાછી આપી. પત્રકારે કહ્યું, આપ રાખો, આપને માટે એ ભેટ નકલ છે. હીરાલાલભાઈએ કહ્યું, ‘ભેટનકલ પણ હું રાખતો નથી. મને એવા અનુભવો થયા છે કે ચાર છ મહિના સામયિક ભેટ તરીકે મોકલ્યા પછી પત્રકારો તરફથી લવાજમ ભરવા માટેના ઉપરાઉપરી કાગળો આવતા હોય છે. ક્યારેક તો કડવો ઠપકો પણ આપતા હોય છે. એટલે મેં નક્કી કર્યું છે કે કોઈ સામયિકની ભેટ નકલ પણ ન લેવી ટપાલમાં આવતાં સામયિકો હું ટપાલીને પાછાં આપી દઉં છું. તંત્રી સાથે વાદવિવાદમાં ઊતરવાનું મને ન પરવડે. એટલે તમારું સામયિક પાછું આપ્યું છે તેથી માફ ન લગાડશો. એક વખત એવો હતો કે સામયિક ભેટ આવે તો પણ હું એનું લવાજમ ભરતો. હવે એ વખત ગયો છે.’

હીરાલાલભાઈના જ્યેષ્ઠ પુત્ર, ડૉ. બિપિનચંદ્ર મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને એમ.એ. થયા પછી, ‘ઋગ્વેદમાં સોમરસ’ એ વિષય પર શોધપ્રબંધ લખીને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. ત્યારપછી એમણે વલ્લભવિદ્યાનગરની કૉલેજમાં અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં સંસ્કૃત અને અર્ધમાગધી વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. જર્મન ભાષાના પણ જાણકાર ડૉ. બિપિનચંદ્રે જૈન ધર્મના વિવિધ વિષયો પર લેખો લખ્યા છે, જે ‘જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન’ના નામથી ગ્રંથસ્થ થયેલા છે.

હીરાલાલભાઈના સુપુત્રી મનોરમાબહેને એમ.એ. અને બી.ટી. સુધીનો અભ્યાસ કર્યા પછી, સૂરત તથા મુંબઈમાં શિક્ષિકા તરીકે કામ કર્યું હતું. તેઓ અપરિણીત રહ્યાં હતાં. એમણે આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરિ (સાગરજી મહારાજ)નું જીવનચરિત્ર લખ્યું હતું તથા કેટલાંક ગ્રંથાવલોકન લખ્યાં હતાં.

હીરાલાલભાઈના બીજા પુત્ર ડૉ. વિબોધચંદ્રની શૈક્ષણિક કારકિર્દી પણ તેજસ્વી હતી. મેટ્રિકની પરીક્ષામાં, સૂરત કેન્દ્રમાં ગુજરાતી વિષયમાં પ્રથમ આવી તેમણે પારિતોષિક મેળવ્યું હતું. એમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બાયોકેમિસ્ટ્રીના વિષયમાં સંશોધન કરીને શોધપ્રબંધ લખીને એમ.એસસી.ની અને ત્યારપછી પૂનાની નેશનલ કેમિકલ લેબોરેટરીમાં વનસ્પતિશાસ્ત્ર (Natural Products)ના વિષયમાં, સંશોધન કરીને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને નિવૃત્તિવય સુધી ત્યાં જ રહ્યા હતા. એમણે કરેલું સંશોધન ઇન્ટરનેશનલ જર્નલોમાં પ્રકાશિત થયું છે.

હીરાલાલભાઈના ત્રીજા પુત્ર નલિનચંદ્રે મુંબઈ યુનિવર્સિટીની બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરીને, વિ.જે.ટી.આઈ.માં ડાઈગ અને બ્લીચીંગનો ડિપ્લોમા મેળવ્યો હતો. મુંબઈમાં આઈ.સી.આઈ.માં કાર્ય કર્યા પછી, તેમણે સ્વેચ્છાએ નિવૃત્તિ સ્વીકારી હતી.

ખાનપાનની ચીવટપૂર્વકની નિયમિતતાના કારણે જીવનભર હીરાલાલભાઈની તબિયત સારી રહી હતી. પણ લેખનવાંચનની સતત પ્રવૃત્તિને લીધે એમની આંખોને ઘણો શ્રમ પડતો. યુવાન વયે જ એમને ચશ્માં આવી ગયાં હતા. એમ છતાં એમની વાંચનલેખનની પ્રવૃત્તિ એકધારી જ રહ્યા કરી હતી. દર થોડાં વર્ષે, એમનાં ચશ્માંનો નંબર વધતો જતો હતો. કૉલેજના અધ્યાપન કાર્યમાંથી તેઓ નિવૃત્ત થયા ત્યારે એમનાં ચશ્માંનો નંબર પંદર સુધી પહોંચી ગયો હતો. એટલા જાડા કાચવાળા ચશ્માં પહેરીને પણ તેઓ સ્વાધ્યાયમાં મગ્ન રહેતા. વાંચવા માટે બિલોરી કાચ રાખતા. ચશ્માં એમના શરીરનું અનિવાર્ય અંગ બની ગયું હતું. ચશ્માં વગર સરખું દેખાય નહિ. પાંસઠની ઉંમર પછી એમને આંખે મોતિયો ચાલુ થયો હતો. એટલે તો વળી મુશ્કેલીમાં વધારો થયો. બોતેર વર્ષની વયે બંને આંખે મોતિયો પાકતાં, એમણે ઓપરેશન કરાવી, મોતિયો ઉતરાવ્યો હતો. ત્યાર પછી પણ આંખે કંઈક ને કંઈક તકલીફ ચાલતી રહેતી. એમ છતાં એમનું લેખનવાંચનનું કાર્ય જીવનના અંત સુધી ચાલ્યું હતું.

જીવનનાં છેલ્લાં વર્ષોમાં, નાજુક તબિયત અને અન્ય પ્રતિકુળતાઓને કારણે તથા સંતાનો મુંબઈ અને પૂનામાં હોવાથી, હીરાલાલભાઈ તથા ઈન્દિરાબહેન, પોતાનું સૂરતનું ઘર કાયમને માટે બંધ કરી દઈને ૧૯૭૨માં પોતાના પુત્રને ત્યાં મુંબઈ રહેવા આવી ગયાં હતાં. હવે એમની સ્વાધ્યાય અને લેખનની પ્રવૃત્તિ મંદ પડી ગઈ હતી, પરંતુ બંધ પડી નહોતી. તેમના લેખો પ્રકાશિત થવામાં જે ગતિ હતી તેના કરતાં લેખનની ગતિ વિશેષ રહી હતી. એટલે જ્યારે પણ એમને પૂછીએ ત્યારે એમની પાસે, કેટલાક અપ્રકાશિત લેખો તો પ્રકાશન માટે તૈયાર હોય જ. વળી એની સાથે સાથે સ્ફૂરેલા નવા નવા વિષયો માટે, તૈયાર કરેલી ટાંચણ-યાદી પણ હોય જ.

હીરાલાલભાઈએ સાડા છ દાયકાના લેખનકાર્ય દ્વારા, વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. એમાં વૈવિધ્ય પાર વિનાનું છે. તેઓ પોતે જ ‘હીરક-સાહિત્ય-વિહાર’ નામની પોતાની પુસ્તિકામાં જણાવે છે કે ‘ગણિત જેવો શુષ્ક વિષય પણ મને તો ખૂબ રસપ્રદ જણાયો છે. એટલે જ્ઞાનની કોઈપણ શાખા પ્રત્યે મને અરુચિ થવા પામી નથી. આને લીધે મારો વિદ્યાવ્યાસંગ કોઈ એક જ દિશા કે ક્ષેત્ર પૂરતો પરિમિત બન્યો નથી. આથી કરીને હું આજે પણ જાતજાતના વિષય પર લેખ લખવા લલચાઉં છું.’

હીરાલાલભાઈએ પોતાની લેખનપ્રવૃત્તિ, ૧૯૨૦ના ગાળામાં શરૂ કરી દીધી હતી. એમણે સંસ્કૃત, અર્ધમાગધી. ગજરાતી અને અંગ્રેજી એમ ચાર ભાષામાં, કાવ્યો, સમશ્લોકી પદ્યાનુવાદો, ગદ્યાનુવાદો,

સંપાદન, સંશોધન, જીવનચરિત્ર, ઇતિહાસ, નિબંધ, કથા, સૂચિપત્ર ઇત્યાદિ પ્રકારનું પુષ્કળ લેખનકાર્ય કર્યું છે.

એમણે ધર્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, કેળવણી, લિપિશાસ્ત્ર, વ્યાકરણ, કોશ, ભાષાવિજ્ઞાન, છન્દશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, સંગીત, ગણિત, જ્યોતિષ, પાકશાસ્ત્ર, વૈદક, પ્રાણીશાસ્ત્ર, કૃષિશાસ્ત્ર, સમાજરચના, વસ્ત્રાલંકાર, રમતગમત, રીતરિવાજો, પર્વો, પક્ષીઓ, લોકસાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ, સદાચાર વગેરે અનેક વિષયો ઉપર પોતાની કલમ ચલાવી છે અને એક હજારથી વધુ લેખો આપણને આપ્યા છે. એમના જમાનામાં ઝેરોક્ષની શોધ નહોતી થઈ અને કાર્બન કોપી કરવામાં વાર ઘણી લાગતી. એટલે પોતાના લેખો છાપવા માટે મોકલાવ્યા પછી, એની નકલ પોતાની પાસે રહેતી નહિ. એમના કેટલાયે લેખો છપાયા નથી અને પાછા આવ્યા પણ નથી. એમના છપાએલા લેખોની યાદી ‘હીરક-સાહિત્ય-વિહાર’માં જે છપાઈ છે તેના ઉપર નજર ફેરવતાં જ ખ્યાલ આવે છે કે હીરાલાલભાઈ પાસે કેટકેટલા વિષયો પર અધિકૃત જાણકારી હતી. વિવિધ પ્રકારની માહિતીનો તેઓ જાણે ખજાનો ધરાવતા હતા. એમની સાથે કોઈપણ વિષયની વાત કરીએ તો કંઈક નવું જ જાણવા મળે.

હીરાલાલભાઈના ઘણા લેખો ‘ગુજરાત મિત્ર’, ‘પ્રતાપ’, ‘સાંજ વર્તમાન’, વગેરે દૈનિકોમાં છપાયા છે. તદુપરાંત ‘જૈન ધર્મ-પ્રકાશ’, ‘જૈન’, ‘જૈન-સત્ય-પ્રકાશ’, ‘આત્માનંદ પ્રકાશ’, ‘સિદ્ધચક્ર’, ફાર્બસ ગુજરાતી ત્રૈમાસિક, ‘ગુજરાતી’માં અને કેટલાંયે સામયિકોના દીપોત્સવી અંકોમાં છપાયા છે. હીરાલાલભાઈની લેખનપ્રસાદીનો પ્રારંભ, સંસ્કૃત ભાષામાં કાવ્યરચનાથી થયેલો. વિલસન કૉલેજમાં તેઓ પ્રાધ્યાપક હતા ત્યારે ૧૯૨૦ થી ૧૯૨૩ના ગાળામાં કૉલેજના અર્ધવાર્ષિક મુખપાત્ર Wilsonianમાં એમનાં ‘પરીક્ષાપર્વ’, ‘અહો વૈચિત્ર્યમ્’ ઇત્યાદિ નામના કાવ્યો સંસ્કૃતમાં છપાયેલાં છે. પચીસ વર્ષની ઉંમરે, સંસ્કૃત ભાષા પર તેઓ કેવું સરસ પ્રભુત્વ ધરાવતા હતા તેની પ્રતીતિ આ કાવ્યો કરાવે છે. પ્રાકૃત-અર્ધમાગધી ભાષા તો જાણે એમની બીજી માતૃભાષા હોય એટલી સરસ રીતે તેઓ તેમાં લખી-બોલી શકતા. પાઈય (પ્રાકૃત) ભાષા માટે હીરાલાલભાઈનો પ્રેમ અનન્ય હતો.

હીરાલાલભાઈએ ઈ. સ. ૧૯૩૮માં પ્રકાશિત કરેલ પોતાના પુસ્તક ‘પતંગપુરાણ યાને કનકવાની કથની’ વાંચતાં આશ્ચર્યથી મુગ્ધ થઈ જવાય છે. જૈન શાસ્ત્રોના અભ્યાસી લેખક પતંગ જેવા કુલ્લક વિષય પર લખવા બેસે તો તેમાં પણ રસ લઈ કેટલા બધા ઓતપ્રોત થઈ શકે છે તે આ ગ્રંથ વાંચતાં જોવા મળે છે. એક નાનો નિબંધ કે લેખ લખી શકાય એવા વિષય પર એક સમર્થ સંશોધક લખવા પ્રવૃત્ત થાય તો કેટલીબધી નાની નાની વિગતોમાં કેટલા ઊંડા ઊતરી શકાય છે તે આ ગ્રંથમાં સાક્ષાત્ જોવા મળે છે. આ ગ્રંથના દોઢસોથી વધુ પેટાશીર્ષકો પરથી જ ખ્યાલ આવી શકે કે કેટકેટલી માહિતી આ ગ્રંથમાં સમાવી લેવામાં આવી છે. અનેક પાદનોંધો અને પરિશિષ્ટો સહિત લખાયેલો આ ગ્રંથ એ વિષયનો એક શોધપ્રબંધ બની રહે છે. પતંગ વિષે પોતાને લખવાનું કેમ મન થયું તે વિશે ગ્રંથની પ્રસ્તાવનામાં તેમણે નોંધ્યું છે : ‘હું આજથી ૨૫ વર્ષ ઉપર એલ્ફિન્સ્ટન કૉલેજમાં ગણિત શીખતો હતો ત્યારે કનકવાને લગતા કેટલાક પ્રશ્નોનો ગણિતશાસ્ત્રની દૃષ્ટિએ વિચાર કરવાનું મને મન થયું.’

લેખકે જાતઅનુભવ પરથી તથા અન્યને પૂછીને પુષ્કળ માહિતી આ ગ્રંથમાં આપી છે. એ માહિતી મેળવવા માટે એમણે એ વિષયમાં ઠીક ઠીક વાંચી લીધું હતું અને અનેક લોકોને પૂછીને પણ માહિતી એકત્ર

કરી હતી. એમણે પ્રસ્તાવનમાં લખ્યું છે કે ‘મારા જૂના મહોલ્લામાં નાણાવટમાં નવલશાના કોઠા આગળ જવાનું થયું અને મારા સદ્ગત પિતાના એક બાલસ્નેહી અને કનકવાના શોખીન અને ઉસ્તાદને મળવાનું થયું. એમનું નામ છગનલાલ છબીલદાસ. એમની પાસેથી પતંગ-માંજો વગેરેની નવીન બાબતોની માહિતી મળી હતી !

આ ગ્રંથ સાચવવા જેવો અને પુનર્મુદ્રિત કરવા જેવો છે.

હીરાલાલભાઈએ આગમો અને આગમસાહિત્ય વિશે ગુજરાતી અને અંગ્રેજીમાં વિવિધ પ્રકારના લખો લખ્યા છે. એમાં ૧૯૪૮ છપાયેલો એમનો ‘આગમોનું દિગ્દર્શન’ નામનો ગ્રંથ મહત્વનો છે. એમાં પિસ્તાલીસ આગમસૂત્રોનો સવિગત પરિચય આપવામાં આવ્યો છે તથા આગમો વિશે લખાયેલા વિવરણાત્મક સાહિત્યનો પણ પરિચય આપવામાં આવ્યો છે.

આગમ સાહિત્યના વિવિધ વિષયો પર એમણે અંગ્રેજીમાં ઘણા લેખો લખ્યા છે. અનુવાદરૂપે કે લેખરૂપે અંગ્રેજી ભાષામાં એમનું યોગદાન ઘણું મોટું છે. એમના જમાનામાં કોઈએ અંગ્રેજીમાં આટલું બધું લેખનકાર્ય કર્યું નથી. એ ફરીથી ગ્રંથસ્વરૂપે પ્રકાશિત કરવા જેવું છે.

હીરાલાલભાઈએ વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીના સંગીત વિભાગના ઉપક્રમે ૧૯૫૫માં ‘સંગીત, નૃત્ય અને નાટ્યસંબંધી જૈન ઉલ્લેખો અને ગ્રંથો’ એ વિષય પર વિદ્વાતાપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું. આ વ્યાખ્યાન પૂ. શ્રી યશોવિજયજી (હાલ પૂ. યશોદેવસૂરિજી)ની પ્રેરણાથી ગ્રંથરૂપે ૧૯૭૩માં પ્રકાશિત થયું છે. એમાં એમણે સાત સ્વરો, એનાં કુળ, એના દેવતા, નાટ્ય, ગેય અને અભિનેય અલંકારો, મૂર્ચનાઓ, રાસ, વાદ્યો, રાગ, ગીત, નૃત્ય નાટક ઇત્યાદિ વિશે ઝીણવટભરી પારિભાષિક માહિતી આધાર સાથે આપી છે. આ વિષયમાં પણ હીરાલાલભાઈની સજ્જતા કેટલી બધી હતી તેની ખાતરી આ પુસ્તક વાંચતાં થાય છે.

હીરાલાલભાઈએ ‘શ્રી હરિભદ્રસૂરિ’, ‘યશોદોહન’ અને ‘વિનયસૌરભ’ નામના ત્રણ ગ્રંથો આપ્યા છે, જેમાં એમણે અનુક્રમે સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અને શ્રી વિનયવિજયજી મહારાજના જીવન અને કવનનો સવિસ્તર પરિચય કરાવ્યો છે. ‘શ્રી હરિભદ્રસૂરિ’ લગભગ ચારસો પાનાનો ગ્રંથ છે. ૧૯૬૩માં તે પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા તરફથી પ્રકાશિત થયો છે. એમાં શ્રી હરિભદ્રસૂરિના જીવન વિશે તથા એમની કૃતિઓ વિશે લગભગ ત્રણસોથી વધુ પેટાશીર્ષક હેઠળી માહિતી આપવામાં આવી છે. શ્રી હરિભદ્રસૂરિ વિશે આટલી બધી માહિતી અન્ય કોઈ એક જ ગ્રંથમાં હજુ સુધી જોવા નથી મળી. ‘યશોદોહન’ ગ્રંથ એમણે વર્તમાનકાળના પૂ. શ્રી યશોદેવસૂરિની પ્રેરણાથી લખ્યો હતો. એમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવન અને કવન વિશે પુષ્કળ માહિતી આપવામાં આવી છે. ‘વિનય-સૌરભ’ પ્રમાણમાં નાનો ગ્રંથ છે. એમાં રાંદેરના શ્રી વિનયવિજયજી મહારાજના જીવનકવનનો પરિચય આપવામાં આવ્યો છે.

હીરાલાલભાઈએ ભગવાન મહાવીર સ્વામી વિશે જુદે જુદે સમયે કેટલાક લેખો લખ્યા હતા. આવા કેટલાક લેખો, વાર્તાલાપો, સ્તુતિઓ ઇત્યાદિનો એક સંગ્રહ પૂ. શ્રી વિજયકસ્તુરસૂરિના શિષ્ય પૂ. શ્રી વિજયચંદ્રોદયસૂરિની પ્રેરણાથી ‘જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર’ના નામથી ૧૯૬૮માં પ્રકાશિત

કરવામાં આવ્યો હતો. આ ગ્રંથમાં તીર્થંકરોનાં લાંછનો અને લક્ષણો, આઠ પ્રાતિહાર્ય, મહાવીર સ્વામીના વિવિધ ભવોના સગાં, મહાવીર સ્વામીના પૂર્વ ભવના બે વૈરીઓ, મહાવીરસ્વામીનો સાંસારિક પક્ષ, વીર વર્ધમાનસ્વામીના વર્ષાવાસ, મહાવીર સ્વામીની સાધનાની પરાકાષ્ઠા, મહાવીર સ્વામીના જીવનની વિશિષ્ટ ઘટનાઓ ઇત્યાદિ પચીસેક લેખો તથા 'વીરથુઈ'નો ગુજરાતી ભાવાનુવાદ ઇત્યાદિ આપવામાં આવ્યાં છે. આ બધામાંથી ઘણી બધી પારિભાષિક માહિતી આપણને સાંપડે છે અને લેખકનું વાંચન કેટલું બધું વિશાળ હશે એની પ્રતીતિ કરાવે છે.

હીરાલાલભાઈ જેમ સમર્થ સંશોધક છે તેમ મર્મજ કવિ પણ છે. એમની સાહિત્યિક કારકિર્દી સંસ્કૃતમાં કાવ્યરચનાથી થઈ હતી. એમણે જુદે જુદે વખતે ભિન્ન ભિન્ન પ્રકારની કાવ્યરચના કરી હતી. એમણે આગમોનાં પદ્યોનો અનુવાદ ગુજરાતી પદ્યોમાં કર્યો છે. આ ઉપરાંત એમણે વિવિધ પ્રકારનાં કાવ્યો લખ્યાં છે, જેનો વિષય મુખ્યત્વે ધાર્મિક રહ્યો છે. એમણે સવાસોથી વધુ જે કાવ્યો લખ્યાં છે તેમાં ૩૬ કાવ્યો તો હરિયાળીના પ્રકારનાં છે. આ પ્રકારની કૃતિઓમાં એમનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. 'હરિયાળી-સંચય' નામનો એમનો સંગ્રહ ૧૯૬૮માં પ્રકાશિત થયો છે. હરિયાળીનો પ્રકાર ઉખાણાં જેવો છે. એટલે એવી કવિતાનું વિવરણ સામાન્ય વાચક માટે આવશ્યક છે. એમણે આ હરિયાળીઓનાં વિવરણ પણ સાથે આપેલાં છે.

જૈન સાહિત્ય અત્યંત વિશાળ છે. જૈનોનું મુખ્ય સાહિત્ય અર્ધમાગધીમાં છે, પરંતુ સંસ્કૃત ભાષામાં લખાયેલું જૈન સાહિત્ય પણ અત્યંત વિપુલ છે. જ્યાં સુધી એની વ્યવસ્થિત પ્રકાશિત માહિતી ન સાંપડે ત્યાં સુધી જૈન-અજૈન સર્વમાં એવો ભ્રમ રહે કે જૈનોએ સંસ્કૃત ભાષામાં બહુ ખેડાણ કર્યું નથી. આથી કેટલાંક વર્ષ, પૂર્વે પૂ. શ્રી યશોદેવસૂરિએ હીરાલાલભાઈને 'જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ' લખી આપવાનું સૂચન કર્યું હતું અને તે મુજબ હીરાલાલભાઈએ તે લખી આવ્યો હતો. એ ત્રણ ભાગમાં છપાયો છે. એમાં વ્યાકરણ, કોશ, નામમાલા, અલંકારશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, કામશાસ્ત્ર, સ્થાપત્ય, ગણિત, નિમિત્ત, વૈદક, પાક, નીતિશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, ન્યાય, યોગ, અધ્યાત્મ, મંત્રશાસ્ત્ર, અનુષ્ઠાનવિધિ, ધ્યાન, કાવ્ય, સ્તોત્ર, મહાકાવ્ય, ચંપૂકાવ્ય, ગદ્યકૃતિઓ ઇત્યાદિ વિષયના અનેક ગ્રંથોનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. આ દળદાર ઇતિહાસનો પ્રથમ ભાગ ૧૯૫૬માં અને છેલ્લો ભાગ ૧૯૭૦માં છપાયો હતો, કારણ કે જેમ જેમ નાણાંની વ્યવસ્થા થતી ગઈ તેમ તેમ પ્રકાશન કાર્ય આગળ ચાલતું ગયું હતું.

જીવનની ઉત્તરાવસ્થામાં આંખો નબળી હોવા છતાં, ઇતિહાસના આ ગ્રંથલેખનનું અને પ્રૂફ સુધારવાનું કાર્ય એમણે પંદર વર્ષ સુધી કર્યું હતું. (આ ગ્રંથ શુદ્ધિ-વૃદ્ધિ સાથે નવેસરથી એક જ વોલ્યુમમાં કોઈ સંસ્થાએ છપાવવાનું કાર્ય ઉપાડી લેવા જેવું છે) એમના હાથે આ એક બહુમૂલ્ય સાહિત્યસેવા થઈ છે.

જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ લખ્યા પછી હીરાલાલભાઈએ જૈન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવાનું ચાલુ કર્યું હતું, પરંતુ એ કાર્ય પુરું થઈ શક્યું નહિ અને જેટલું લખાયું તે પણ ક્યાં કેવી રીતે લુપ્ત થઈ ગયું તેની કશી ખબર એમના અવસાન પછી મળી નથી. તેઓ ૧૯૭૬માં પૂના પોતાના પુત્ર વિબોધચંદ્રને ત્યાં ગયા હતા. ત્યારે દ્રેઈનમાં એમના લખાણો અને પુસ્તકોની એક બેગ ગુમ

થઈ ગઈ હતી. તદુપરાંત એમના અવસાન પછી એમના પુત્ર નલિનચંદ્ર પાસેથી એક જૈન પત્રકાર અપ્રસિદ્ધ લેખોની ફાઈલો લઈ ગયા હતા. પરંતુ થોડા વખતમાં જ એ પત્રકારનું અવસાન થતાં એ ફાઈલ પાછી મળી નહોતી.

હીરાલાલભાઈએ જીવનભર અનેકવિધ વિષયો પર વાંચન અને લેખન કર્યાં કર્યું હતું. ઘણીખરી વાર લેખનના નિમિત્તે એમનું વાંચન થયું છે અથવા કંઈક નવું વાંચવામાં આવે તો એ વિશે વધુ માહિતી સાથે લખવાનું એમને મન થયા કરતું. એમને એક પછી એક વિષયો સતત સ્ફુરતા રહેતા હતા. જે વિષય પર લખવું હોય તે અંગેની માહિતી એમની પાસે તૈયાર હોય જ. એમણે ક્યારેય માત્ર સપાટી પરનું છીછરું લખાણ કર્યું નથી. દરેક વિષયના ઊંડાણમાં તેઓ ઊતર્યા છે. એમની પાસેથી કંઈક વિશેષ જાણકારી હંમેશા મળ્યા કરી છે. સંદર્ભો માટે એમની પાસે સરસ ગ્રંથસંગ્રહ હતો. એટલે ઘરમાં બેઠાં બેઠાં જ તેઓ પુસ્તકો પર નજર ફેરવીને પોતાના વિષયના સંદર્ભો મેળવી લેતા. કેટલીયે માહિતી, શ્લોકો, ગાથાઓ વગેરે એમને કંઠસ્થ હતાં. એમનું લખાણ પદ્ધતિસરનું, ચોક્કસાઈવાળું અને ચીવટપૂર્વકનું રહેતું. એટલે લગભગ ઘણાખરા ગ્રંથોમાં એમણે સંકેતોની સમજણ આપી જ છે, જેથી ભાષાનો બહુ વિસ્તાર કરવો ન પડે.

હીરાલાલભાઈની લેખનશૈલી અનોખી હતી. પોતે ગણિતના પ્રાધ્યાપક હતા. ચોક્કસાઈની ટેવ એમનામાં હોય એ સ્વાભાવિક હતું. નિરાધાર કશું લખવું નહિ એ એમની પ્રકૃતિ હતી. ગણિતના દાખલાઓમાં એક પણ આંકડો વધારાનો હોય કે એક આંકડો ઓછો હોય તે ન જ ચાલે. ગણિતમાં બધું મુદ્દાસર અને ક્રમાનુસાર જ લખવાનું હોય. આવા મહાવરાને લીધે હીરાલાલભાઈ જ્યારે કોઈ એક વિષય પર લેખ લખવા બેસે ત્યારે બધા જ મુદ્દાઓ એમણે ક્રમાનુસાર આવરી લીધા હોય. આથી જ કોઈ એક મુદ્દાને એમણે બહુ વિકસાવ્યો હોય એવું ખાસ જોવા ન મળે. એમનો કોઈ લેખ પેટાશીર્ષકો વગરનો હોય નહિ. બીજી બાજુ દરેક મુદ્દા વિશે જો કંઈ વધારાની પ્રકીર્ણ માહિતી આપવાની હોય અને તે મૂળ લખાણમાં ન લેવાની હોય તો તે પાદનોંધમાં તેઓ આપતા. આથી જ એમનાં લખાણો પાદનોંધોથી સભર છે. ક્યારેક તો લેખના દરેક પાને પાદનોંધ હોય. એમણે પાદનોંધો એટલી બધી (સાલ, આવૃત્તિ, પૃષ્ઠ નંબર, તારીખ ઇત્યાદિ સહિત) આપી હોય કે એમની માહિતીને કોઈ પડકારી શકે નહિ. બીજી બાજુ એ બધી પાદનોંધો વાંચતાં આશ્ચર્ય થાય કે અહો ! આ લેખકે ક્યાં, ક્યાંથી કેટલી બધી માહિતી એકત્ર કરી છે !

હીરાલાલભાઈ કોઈપણ નવા વિષય પર તરત બેસીને ક્રમાનુસાર લખીને લેખ પૂરો કરતા એવું બહુ ઓછું બનતું. જે વિષય પર લેખ લખવો હોય તેના મુદ્દા તૈયાર કરતા અને જુદા જુદા કાગળ પર તેની માહિતી ટપકાવી લેતા. તે પછી બધા મુદ્દાઓને ક્રમાનુસાર ગોઠવી લેખ તૈયાર કરી લેતા. કોઈક મુદ્દા વિશે માહિતી ન મળી હોય તો પાદનોંધમાં એનો ઉલ્લેખ કરતા. એમનું લખાણ હંમેશા મુદ્દાવાર, મુદ્દાસર અને વ્યવસ્થિત રહેતું. અનેક વિષયોનું રસપૂર્વક વાંચન કર્યું હોવાને લીધે તથા સાડા ત્રણ હજાર હસ્તપ્રતો વાંચી હોવાને લીધે અને પોતાની સ્મૃતિ સતેજ હોવાને કારણે તેઓ કોઈપણ વિષય ઉપર લેખ કે ગ્રંથ લખવા બેસે એટલે તે માટેની સામગ્રી ક્યાં ક્યાંથી ઉપલબ્ધ છે એની જાણકારી એમની પાસે હોય જ. આમ છતાં લેખનશ્રમ કરવાનો ઉત્સાહ ન હોય તો આટલું બધું કામ થાય નહિ. એટલે જ એમણે એકલે હાથે જે કાર્ય કર્યું છે તે જોઈ સહેજે આશ્ચર્ય થાય એમ છે. આપણે માટે દુઃખની વાત એટલી છે કે એમની સાહિત્યજગતમાં જેટલી કદર થવી જોઈતી હતી તેટલી થઈ નથી.

જીવનમાં અંતિમ વર્ષોમાં હીરાલાલભાઈ તથા ઈન્દિરાબહેન એમના સૌથી નાના પુત્ર નલિનચંદ્રના ઘરે મુંબઈમાં વરલી ઉપર 'મધુહંસ' નામના બિલ્ડિંગમાં કાયમ માટે રહેવા આવી ગયાં હતાં. ત્યારે હજુ હીરાલાલભાઈની તબિયત સારી હતી અને રોજ બે વાર ચાર દાદર ચઢતા-ઊતરતા. પરંતુ પછી ૮૫મા વર્ષે એમને અશક્તિ વરતાવા લાગી. એમનો દેહ ક્ષીણ થવા લાગ્યો. ૧૯૭૯ના માર્ચ મહિનામાં તેઓ પથારીવશ થઈ ગયા. તબીબી ઉપચારો ચાલુ થયા પણ તબિયતમાં સુધારો થયો નહિ. શૌચાદિ ક્રિયા પણ પથારીમાં કરાવવી પડતી. સ્વજનોએ હોસ્પિટલમાં દાખલ થવા માટે કહ્યું, પરંતુ ત્યાં જવાની એમની બિલકુલ ઈચ્છા નહોતી. એમ કરતાં બે અઠવાડિયાં થઈ ગયાં. છેવટે જ્યારે ડૉક્ટરની સલાહ અનુસાર હોસ્પિટલમાં લઈ જવાનો સ્વજનોનો મક્કમ નિર્ણય થયો એ વખતે એમણે પોતાના બહેન શાંતાબહેનને બોલાવીને સમજાવ્યાં કે 'મને ચાર દિવસ પછી હોસ્પિટલમાં લઈ જાવ, ત્યાં સુધી હું મારી આરાધના કરી લઉં.' શાંતાબહેને બધાંને સમજાવ્યાં અને હોસ્પિટલમાં જવાનું ચાર દિવસ પછી રાખવામાં આવ્યું. હીરાલાલભાઈએ સંધારાની જેમ એ દિવસથી અન્ન, જળ, ઔષધ વગેરેનો પર્યખ્યાણપૂર્વક ત્યાગ કરી દીધો. આ વાતની ખબર પડતાં, મુંબઈમાં બિરાજમાન એક આચાર્ય ભગવંતે ઘરે આવી માંગલિક સંભળાવ્યું. પછી એમણે એક શાસ્ત્રજ્ઞ શ્રાવકને હીરાલાલભાઈ પાસે મોકલ્યા. તેઓ રોજ આવીને હીરાલાલભાઈને નિર્ધામણ કરાવતા હતા. એમ કરતાં ચોથે દિવસે એટલે કે તા. ૨૩મી માર્ચ, ૧૯૭૯ના રોજ સવારે પોણાચાર વાગ્યે બ્રાહ્મ મૂહુર્તે ૮૫ વર્ષની વયે એમણે સમાધિપૂર્વક દેહ છોડ્યો હતો. હોસ્પિટલમાં ન જવાનો પોતાનો સંકલ્પ સમાધિપૂર્વક એમણે પાર પાડ્યો હતો.

હીરાલાલભાઈ અને ઈન્દિરાબહેને સાડા છ દાયકાનું દામ્પત્યજીવન ભોગવ્યું. હવે ઈન્દિરાબહેનની તબિયત બગડી હતી. એમણે ૧૨મી સપ્ટેમ્બર ૧૯૮૨ના રોજ ૮૪ વર્ષની વયે દેહ છોડ્યો. યુવાન વયે હીરાલાલભાઈની કારકિર્દીનું ઘડતર મુંબઈમાં થયું. એમના દામ્પત્યજીવનનો પૂર્વકાલ મુંબઈમાં વીત્યો હતો અને બંનેએ અંતિમ શ્વાસ પણ મુંબઈમાં લીધા હતા.

સ્વેચ્છાએ અકિંચન રહી, સાદાઈ અને સરલતાપૂર્વક હીરાલાલભાઈએ સરસ્વતી દેવીની આજીવન અવિરત ઉપાસના અનન્યભાવે કરી હતી. આ શ્રુતોપાસક શ્રાવકના હસ્તે જૈન સાહિત્યના ક્ષેત્રે જે લેખનકાર્ય થયું છે તે અજોડ છે. એમનો યુગ એમની કદર કરી શક્યો નહિ. પણ જેમ જેમ એમનું સાહિત્ય પ્રકાશમાં આવશે અને ગ્રંથસ્થ થશે અને ગ્રંથોની પુનરાવૃત્તિઓ થશે તેમ તેમ ભાવિ પ્રજા એમની અવશ્ય યોગ્ય કદર કરશે. જૈન સાહિત્યના ઇતિહાસમાં એમનું નામ અને સ્થાન અવિસ્મરણીય રહેશે.

[સાંપ્રત સહચિંતન ભા. ૧૩માંથી ટુંકાવીને સાબાર.]



વિષય-સૂચી

પૃ. 43-79 ઉપોદ્ધાત

પ્રકાશકીય	6	ચારકૃતિ, માનાર્થ પ્રયોગ, ગ્રંથકારાદિને લગતી ત્રણ	
ઐકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલિ	7	સૂચીની સમજણ, “જૈનગ્રંથ” એટલે શું?, નામોનો	
બેબોલ (મુનિશ્રી યશોવિજયજી મ. સા.)	8-10	વિનિમય, અકારાદિ ક્રમના પ્રકાર, અટકને પ્રાધાન્ય	
સંપાદકીય નિવેદન	11-16	તેમજ વિવરણોનાં વિશિષ્ટ નામોનું સૂચન	56
શ્રી કાપડિયાનો પરિચય	17-32	(આ) મૂલ્યાંકન :	57-59
(લે. રમણલાલ ચી. શાહ)		ગ્રંથપ્રણયનનો હેતુ, જૈન સાહિત્યની વિશાળતા	
વિષયસૂચી	33	અને વિવિધતા, મધ્યયુગનો અર્ધકારપાટ,	
વિસ્તૃત વિષયાનુક્રમ ભાગ-૧	34-43	શ્રમણાદિનો ફાળો, પાઈય, સંસ્કૃત અને	
શુદ્ધિ-પત્રક	43	ગુજરાતીમાં કૃતિઓ રચનારા જૈન ગૃહસ્થોનાં નામ	
પ્રકાશિત ગ્રંથો	44	તેમજ સૈકાદીઠ સાહિત્યનો ફાલ અને વિષયદીઠ	
૧૩ પર્યાય, મહત્ત્વ અને ઉપયોગિતા		વિકાસક્રમ દર્શાવવા માટેનો પ્રયાસ.	
(અ) નિવેદન : પ્રથમ અંશ :-	45-56	જૈન મૌલિક ગ્રંથોનું મૂલ્યાંકન :	59
ઉત્થાનિકા, સુયોગ, અભ્યાસ, યોગ્યતા, ‘પાઈય’ના		પંદર વિષયો અને એને અંગેની	
અર્થની વ્યાપકતા, અભિલાષા, યોજના-પુસ્તકના બે		કૃતિઓની સંખ્યા	59
ખંડ અને એનાં નામ, સાર્વજનીન સાહિત્યની		ચિત્રકળા	61
વ્યાખ્યા અને એનાં અંગો (Technical Sci-		વ્યાકરણાદિનું વિહંગાવલોકન	61
ences), ધાર્મિક સાહિત્યની વ્યાખ્યા અને એનાં		ત્રણ અને ચાર વિષયની એકકર્તૃક કૃતિઓ	74
ચાર ઉપખંડ, ધાર્મિક સાહિત્યના નવ વર્ગ અને તેની		સૈકાદીઠ ફાલ	74
સમજણ, લલિત અને લલિતેતર સાહિત્ય, કેટલીક		નિવેદન : દ્વિતીય અંશ-	75
સામગ્રીનું વિભાગદીઠ વિભાજન, જૈન સાહિત્યનો		રચનાસમયની સૂચી અને કર્તવ્ય	75
પરિચય આપતી વેળા કાલક્રમને, નહિ કે સંપ્રદાને		પ્રયાસ તેમજ ભારતીય સાહિત્યના તથા સંસ્કૃત	
અપાયેલું પ્રાધાન્ય, જૈન સંસ્કૃત સાહિત્યના પાંચ		સાહિત્યના ઇતિહાસને લગતા વિવિધ ભાષાઓમાં	
પ્રકારની ગોઠવણી અંગે વિચારણા, સાધ્ય ને સાધન,		રચાયેલાં પુસ્તકોની સૂચી	76
‘વિજ્ઞાન’ નામના પંદરમા પ્રકરણના વિષયોનો ક્રમ,		પ્રસ્તુત પુસ્તકની આવશ્યકતા	77
વ્યાકરણનાં સૂત્રથી ગર્ભિત કૃતિઓ, અમરકોશ		ઋણસ્વીકાર	78
(શ્લો.૧)ની પાઠપૂર્તિરૂપ કૃતિ, દ્વયાશ્રય-કાવ્ય,		પૂર્તિ	79
ત્રૈવિદ્યગોષ્ઠી, કૃતિઓના પરિચયની પદ્ધતિ,		અલંકારચૂર્ણિ	79
પ્રકાશનોની નોંધ, પ્રકાશનોનો પરિચય આપનારી		યંત્રરાજ	80

૧. આ પૃષ્ઠાંક છે.

૨. દ્વિતીય અંશ માટે જુઓ પૃ. ૬૮-૭૪.

૩ (ભા.૧)

વિસ્તૃત વિષયાનુક્રમ ભાગ-૧

વિષય	પૃષ્ઠ
પ્રકરણ ૧: પ્રાસ્તાવિક	૧-૪
જગતની અનાધનન્તતા	૧
સાહિત્યની ભાષાનો ઉદ્ભવ	૧
ભાષાઓનું વર્ગીકરણ	૨
૫ ભાષા કોની?	૨
‘જૈન’ સંસ્કૃત	૩
ઉપલબ્ધ સાહિત્યની ઇયત્તા	૩
પુસ્તકની મર્યાદા	૩-૪
સંસ્કૃત કૃતિઓના સાત વર્ગ	૪
૬૦ પ્રકરણ ૨ : વ્યાકરણ	૫-૩૪
વ્યાકરણના પર્યાયો	૫
વેદનાં છ અંગ	૫
વ્યાકરણનો ઉદ્ભવ	૫
(૧) વ્યાકરણો	૫
(૧) અજૈનઈદ્ર (ઐન્દ્ર) વ્યાકરણ	૫-૬
(૨) જૈન ઐન્દ્ર વ્યાકરણ અને એની ઉત્પત્તિ ૬-૭	
(૩) સદપાહુડ (શબ્દપ્રાભૃત)	૭-૮
(૪) જૈનેન્દ્ર વ્યાકરણ યાને પંચાધ્યાયી: ૭-૧૨	
દિ૦ પૂજ્યપાદનો પરિચય, બે વાચના, અસલી સૂત્રપાઠની ટીકાઓ, સ્વોપજ ન્યાસ ને ભાષ્ય, મહાવૃત્તિ, શબ્દાંભોજ-ભાસ્કર, પંચવસ્તુ, (૪-અ) શબ્દાર્ણવપ્રક્રિયા તેમજ જૈનેન્દ્ર વ્યાકરણની અનિદ્સ્વરાન્તકારિકા	
ભગવદ્વાગ્વાદિની	૧૨
(૫) વિશ્રાન્તવિદ્યાધર:	૧૨-૧૩
આ જૈન કૃતિ છે? વામનનો સમય, સ્વોપજ બૃહદ્વૃત્તિ અને મલ્લવાદીનો ન્યાસ	
(૬) (જૈન) શાકટાયન શબ્દાનુશાસન : ૧૩-૧૭	
શાકટાયનનું વાસ્તવિક નામ એમની કૃતિઓ, સ્વોપજ અમોઘવૃત્તિ, ન્યાસનું કર્તૃત્વ,	

વિષય	પૃષ્ઠ
ચિન્તામણિ અને એની ટીકા, પ્રક્રિયાઓ:	
પ્રક્રિયાસંગ્રહ, શાકટાયન-ટીકા અને	
રૂપસિદ્ધિ, લિંગાનુશાસનને ધાતુપાઠ	
(૭) પંચગ્રંથી યાને બુદ્ધિસાગર:	૧૭-૧૮
પરિમાણ, રચનાનો હેતુ, વ્યાકરણનાં પાંચે	
અંગોની છન્દોબદ્ધ રચના અને ઉલ્લેખો.	
(૮) હૈમપંચાંગ વ્યાકરણ : સ્વોપજવૃત્તિ,	
પ્રક્રિયાઓ અને સારાંશ.	૧૮-૧૯
(૯) ભદ્રેશ્વર-વ્યાકરણ : ભદ્રેશ્વરસૂરિનું	
પ્રાધાન્ય.	૧૯
(૧૦) ગણરત્નમહોદધિ: સ્વોપજવૃત્તિ, વર્ધમાન-	
સૂરિકૃત સિદ્ધરાજ-વર્ણન, પાણિનિ વગેરેની	
પ્રશંસા અને અજ્ઞાતકર્તૃક અવચૂરિ.	૧૯
(૧૧) શબ્દાનુશાસન યાને મુષ્ટિવ્યાકરણ:	
સ્વોપજવૃત્તિ, હાથીપોથીઓ,	
મુષ્ટિવ્યાકરણનાં રસનાસમય,	
ઉપયોગ અને પ્રભાવ તથા	
વિષમપદવિવરણ	૨૦-૨૨
(૧૨) પ્રેમલાભ-વ્યાકરણ: યોજનાની સ્વતંત્રતા. ૨૨	
(૧૨ ^મ) બાલબોધવ્યાકરણ: એનાં છ વિવરણો	
તેમજ કાતન્ત્રની વૃત્તિરૂપ	
આ વ્યાકરણ હોવાનો સંભવ.	૨૨
(૧૩) વિદ્યાનન્દ-વ્યાકરણ: કર્તાનો પરિચય,	
ગુર્વાલીમાં આ વ્યાકરણનો ‘સર્વોત્તમ’ તરીકે	
ઉલ્લેખ, આ વ્યાકરણનાં ત્રણ નામાંતરો	
અને એના કર્તાનું અન્ય નામ..	૨૨
ઓદ્યાયચિન્તામણિ	૨૩-૨૪
‘પાઈય’ (પ્રાકૃત) ભાષાનું વ્યાકરણ, દિ૦	
શ્રુતસાગરનો પરિચય, એમણે પોતાને માટે	
વાપરેલાં વિશેષણો અને એમની કૃતિઓ..	

વિષય	પૃષ્ઠ	વિષય	પૃષ્ઠ
(૧૫) ચિન્તામણિ વ્યાકરણ કર્તાની શિષ્યપરંપરા અને વિવિધ કૃતિઓ, પાઈય ભાષાનું વ્યાકરણ અને સ્વોપજવૃત્તિ..	૨૪-૨૬	પ્રકરણ ૩: હૈમ પંચાંગ વ્યાકરણ	૩૫-૫૯
(૧૬) શબ્દભૂષણ: પદ્યાત્મક વ્યાકરણ અને મુસ્લિમ માટેની આ રચના..	૨૬	'સિદ્ધહેમચંદ્ર' નામના બે અંશના અર્થ	૩૫
(૧૭) શબ્દાર્ણવ: વ્યાકરણ કે કોશ અને સ્વોપજટીકા..	૨૭	હેમચન્દ્રસૂરિની જીવનરેખા.	૩૫
ગણદર્પણ, નૂતનવ્યાકરણ, પ્રયોગમુખ્યવ્યાકરણ	૨૮	(અ) સૂત્રપાઠ સિંહેની રૂપરેખા, એનું પરિમાણ, રચનાની યોજના, સંજ્ઞા અને સૂત્રોનું સંતુલન તેમજ પાંત્રીસ પદ્યો.	૩૬-૩૯
[૨] ઔક્તિકો	૨૮-૩૦	સ્વોપજ લઘુવૃત્તિ, પ્રકાશિકા અને લઘુવૃત્તિનાં વિવરણો	૩૯-૪૦
મુગ્ધાવબોધ: કુલમંડનસૂરિની જીવનરેખાને કૃતિઓ	૩૦	રહસ્યવૃત્તિ	૪૦
વાક્યપ્રકાશ: ઉદયધર્મકૃત મહાવીરસ્તવન અને વાક્યપ્રકાશની પાંચ ટીકાઓ પર અન્ય ઔક્તિકો	૩૦-૩૧	કાયસ્થ કાકલની વૃત્તિ	૪૧
[૩] આંશિક વ્યાકરણો:	૩૧-૩૨	મધ્યમવૃત્તિ	૪૧
(૧) ઉપસર્ગમંડન: મંડનનો પરિચય અને એમની કૃતિઓ	૩૨	બૃહદ્વૃત્તિ (તત્ત્વપ્રકાશિકા) તેમજ એની સ્વોપજ લઘુવૃત્તિ તથા અમોઘવૃત્તિ સાથે સરખામણી. ૪૧-૪૨ સત્તાવન ન્યાયો અને એને અંગેની વૃત્તિ અને અવચૂરિ.	૪૨
(૨) ધાતુમંજરી : સિદ્ધિચન્દ્રગણિનો પરિચય અને એમની મૌલિક અને વિવરણાત્મક કૃતિઓ.	૩૨-૩૩	(અ) ગણપાઠ:	૪૨
(૩) મિશ્રલિંગકોશ, મિશ્રલિંગનિર્ણય કિંવા લિંગાનુશાસન: કર્તા કલ્યાણસાગર.	૩૩	બૃહદ્વૃત્તિની અવચૂરિકા, એનું કનકપ્રભકૃત ન્યાસ સાથે સામ્ય, બૃહદ્વૃત્તિને લગતાં વિવરણો અને સંક્ષેપ.	૪૩
(૪) ઉજ્જાદિપ્રત્યય: કર્તા દિગંબર છે? અને સ્વોપજ ટીકા.	૩૩	બૃહદ્વૃત્તિની અવચૂરિકા, એનું કનકપ્રભકૃત ન્યાસ સાથે સામ્ય, બૃહદ્વૃત્તિને લગતાં વિવરણો અને સંક્ષેપ.	૪૩
પારસી(ક)ભાષાનુશાસન: ફારસી ભાષાનું વ્યાકરણ અને એના કર્તા વિક્રમસિંહ	૩૩	બૃહદ્વૃત્તિની અવચૂરિકા, એનું કનકપ્રભકૃત ન્યાસ સાથે સામ્ય, બૃહદ્વૃત્તિને લગતાં વિવરણો અને સંક્ષેપ.	૪૩
કર્ણાટક-શબ્દાનુશાસન: દિ. ૦ અકલંકકૃત કાનડી ભાષાનું વ્યાકરણ, વૃત્તિ અને વ્યાખ્યાન [૪] પરિશિષ્ટો.	૩૩-૩૪	તત્ત્વપ્રકાશિકા-પ્રકાશ.	૪૪
પરિશિષ્ટ ૧ : ચંદ્ર વ્યાકરણ: કર્તા ચન્દ્રગોમિ (બૌદ્ધ) અને સ્વોપજવૃત્તિ.	૩૪	વિવિધ લઘુન્યાસો ઇત્યાદિ.	૪૪
		પ્રાકૃતરૂપસિદ્ધિ, પ્રાકૃતવૃત્તિદ્વંદ્વિકા ઇત્યાદિ.	૪૫
		પ્રક્રિયા-ગ્રન્થો.	૪૫
		પ્રક્રિયાથી લાભાલાભ.	૪૫-૪૬
		હૈમ (લઘુ) પ્રક્રિયા: વિનયવિજયગણિનો પરિચય અને એમની કૃતિઓ.	૪૬-૪૭
		હૈમપ્રકાશ યાને હૈમ પ્રક્રિયાબૃહદ્વૃત્તિ.	૪૭
		મેઘવિજયગણિકૃત ત્રણ હૈમપ્રક્રિયા: ચન્દ્રપ્રભા યાને હૈમકૌમુદી ઇત્યાદિ.	૪૭-૪૮
		હૈમપ્રક્રિયા શબ્દસમુચ્ચય ઇત્યાદિ	૪૮
		હૈમવિભ્રમ તથા એની વૃત્તિ (તત્ત્વપ્રકાશિકા) અને અવચૂરિ	૪૮-૫૦

વિષય	પૃષ્ઠ	વિષય	પૃષ્ઠ
સિદ્ધસારસ્વત (સિ૦ હે૦નો ઉદ્ધાર)	૫૦-૫૧	(૫) બુદ્ધિસાગરીયનિઘંટુઃ આ કૃતિની અનુપલબ્ધિ. ૬૪	
ઉણાદિ સૂત્રો	૫૧	(૬) અભિધાન-ચિન્તામણિઃ ચાર હેમ કોશો,	
(૬) ઉણાદિગણસૂત્રો અને એની સ્વોપજ્ઞ ટીકા.		અ૦ચિ૦ની યોજના, મહત્વ, વિષય,	
ઉણાદિનામમાલા.	૫૨	ઉપયોગ અને રચનાસમય તેમજ સ્વોપજ્ઞ	
(૬) પાતુપાઠ.	૫૩	વિવૃત્તિ તથા અન્યકર્તૃક સાત ટીકાઓ. ૬૪-૬૭	
પાતુ પારાયણ ઇત્યાદિ	૫૩	બીજક નામની ત્રણ કૃતિઓ અને પ્રતીકાવલી. ૬૬-૬૭	
પાતુરત્નાકર અને ઉક્તિરત્નાકર..	૫૩-૫૪	શેષનામમાલા યાને શેષસંગ્રહનામમાલા	
(૩) લિંગાનુશાસન	૫૪	અને એની બે ટીકા.	૬૭
(૩) હેમલિંગાનુશાસન અને એની સ્વોપજ્ઞ વૃત્તિ. ૫૪		શિલોંછ અને એની ટીકા	૬૭
દુર્ગપદ્મબોધ ઇત્યાદિ.	૫૫	(૭) સુન્દરપ્રકાશ, પદ્યાર્થ ચિન્તામણી કિંવદ્ધાબ્દાર્ણવ. ૬૮	
હેમ વ્યાકરણનાં સન્માન, પ્રચાર અને ઓટ. ૫૫-૫૬		(૮) શબ્દભેદનામમાલા.	૬૮-૬૯
પ્રકીર્ણક કૃતિઓ.	૫૬-૫૯	(૯) નામસંગ્રહ, નામમાલાસંગ્રહ કિંવા	
સ્યાદિશબ્દસમુચ્ચયઃ અમરચન્દ્રસૂરિનો		વિવિક્તનામસંગ્રહઃ	૬૮
પરિચય અને એમના ગ્રંથો.	૫૬-૫૭	ભાનુચન્દ્રગણિની જીવનરેખા અને	
ન્યાયર્થમંજૂષા અને એનો સ્વોપજ્ઞ ન્યાસ.	૫૭	એમની મૌલિક અને વિવરણાત્મક કૃતિઓ.	
કિયારત્નસમુચ્ચયઃ ગુણરત્નસૂરિની મૌલિક અને		(૧૦) શબ્દસંદોહસંગ્રહ	૬૯
વિવરણાત્મક કૃતિઓ તેમજ એમની જીવનરેખા.		(૧૧) શારદીય નામમાલા યાને શાર-	
કવિકલ્પદ્રુમઃ અજૈન કૃતિનું અનુકરણ.	૫૮-૫૯	દીયાભિધાનમાલા.	૬૯
તિલ્લવ્યોક્તિ	૫૯	હર્ષકીર્તિસૂરિનો પરિચય અને એમની કૃતિઓ. ૬૯	
કેટલાંક પ્રકાશનો	૫૯	(૧૨) શેષનામમાલા યાને	
		શેષસંગ્રહનામ-માલાઃ કર્તા સાધુકીર્તિ.	૬૯
		(૧૩) શબ્દરત્નાકરઃ સાધુસુન્દરગણિની કૃતિઓ. ૬૯	
		લઘુતમનામકોશ	૬૯
		આંશિક કોશો. [નામકોશ]	૭૦
		[અ]	
		(૧) પંચવર્ગસંગ્રહનામમાલાઃ	
		શુભશીલગણિની કૃતિઓ.	૭૦
		(૨) દ્વયક્ષરનામમાલાઃ	૭૦
		(૩) પંચવર્ગ પરિહારનામમાલાઃ	
		આઠ સ્થાન અને વાક્યાતુર્ય	૭૦
		(૪) અપવર્ગ-નામમાલાઃ	
		જિનભદ્રસૂરિનો પરિચય.	૭૧
		(૫) અન્ય અપવર્ગનામમાલા.	૭૧
પ્રકરણ ૪ : કોશ યાને નામામાલા	૬૦-૭૭		
ભાષાની સમૃદ્ધિ, નિઘંટુ અને એના			
અર્થ તથા ત્રિવિધ કોશ.	૬૦		
[૧] એકાર્થક નામમાલા.	૬૦-૬૧		
(૧) અમરકોશ.	૬૦		
(૨) ધનંજય-નામમાલાઃ ધનંજયનો પરિચય,			
એમની કૃતિઓ તથા એમનો સમય તેમજ			
ધનંજય-નામમાલાનું ભાષ્ય.	૬૧-૬૨		
(૩) નિઘણ્ટુસમય (ધનંજયનો)	૬૨		
(૪) ધનપાલીય કોશઃ ધનપાલનાં			
સગાંવહાલાંને એમનો કૃતિકલાપ.	૬૨-૬૪		

વિષય	પૃષ્ઠ	વિષય	પૃષ્ઠ
[આ]		(૩) કાનડી દિ૦ જયકીર્તિનું	
(૧) સટીક નિઘણુશેષ: નિઘણુના અર્થ, અજૈન		છન્દો-કનુશાસન:	૮૧-૮૨
નિઘણુઓ અને વનસ્પતિના છ ભેદ.	૭૧-૭૨	(૪) બુદ્ધિસાગરસૂરિનું છન્દ:શાસ્ત્ર:	૮૩
(૨-૪) નિઘણુસંગ્રહ, ઔષધીનામમાલા		(૫) રાજશેખરનું છન્દ:શેખર	૮૩
અને બીજાનિઘણુ.	૭૨	(૬) સમાનનાયક કૃતિ	૮૩
[૨] અનેકાર્થક કોશો.	૭૨-૭૪	(૭) હેમ છન્દોકનુશાસન:	
(૧) અનેકાર્થનામમાલા: એની સંક્ષિપ્ત ટીકા.	૭૨	છન્દશ્રુડા-મણિ, યશોવિજય-ગણિની	
(૨) હેમ અનેકાર્થનિઘણુ.	૭૩	વૃત્તિ અને વર્ધમાનસૂરિની ટીકા..	૮૩-૮૬
(૩) અનેકાર્થસંગ્રહ: યોજના,		(૮) અજ્ઞાતનકર્તૃક રત્નમંજૂષા: ભાષ્ય:	૮૬-૮૭
રચનાસમય તેમજ અનેકાર્થકૈરવાકર		(૯) છન્દોરત્નાવલી: કર્તા અમરચન્દ્રસૂરિ	૮૭
કૌમુદી વગેરેવૃત્તિ ઇત્યાદિ.	૭૩-૭૪	(૧૦) છન્દોકનુશાસન: વાગ્ભટની સ્વોપજ્ઞવૃત્તિ	૮૭
વિશ્વલોચનકોશ	૭૪	ગાહાલક્ષ્મણ અને	
(૪) અનેકાર્થનામમાલા.	૭૪	છન્દકોસની એકેક સંસ્કૃત ટીકા	૮૭
એકાક્ષર નિઘણુ	૭૫	છન્દ:શાસ્ત્ર સંબંધી અન્ય	
[૩] એકાક્ષરી નામમાલા.	૭૪-૭૭	બાર કૃતિઓ અને કેટલીકનાં વિવરણો.	૮૮
(૨) અમરચન્દ્રસૂરિની એકાક્ષરનામમાલા.	૭૫	કેટલાંક નવાં પ્રકાશનો	૮૮
(૩) એકાક્ષર નામમાલા સુધાકલશની		પ્રકરણ ૬: અલંકારશાસ્ત્ર(કાવ્યશાસ્ત્ર)	૮૮-૧૦૭
જીવન રેખા અને કૃતિઓ	૭૫	‘અલંકાર’ના અર્થો.	૮૮
અવ્યયેકાક્ષર નામમાલા	૭૫	આગમોમાં અલંકારો.	૮૮
એકાક્ષરકોષ	૭૫	(૧) કવિશિક્ષા: કર્તા બપ્પલક્ષ્મિસૂરિ.	૮૮-૯૦
(૪) અમરકૃત એકાક્ષર નામમાલિકા	૭૬	(૨) અજિતસેનકૃત શૃંગારમંજરી	૯૦
(૫-૬) બે એકાક્ષરનામમાલા	૭૬	(૩) વાગ્ભટાલંકાર:	૯૦-૯૨
અભિધાનરાજેન્દ્રકોશ	૭૫-૭૬	વાગ્ભટ પહેલાનો પરિચય, દસ શ્લોકોબરીય ટીકા,	
પારસીકનામમાલા યાને શબ્દવિલાસ	૭૭	એક દિગંબરીય ટીકા અને બે અજૈન ટીકા	
સંદિગ્ધ કૃતિઓ.	૭૭	તેમજ બે ગુજરાતી બાલાવબોધ.	
પ્રકરણ ૫: છન્દ: શાસ્ત્ર	૭૮-૮૮	(૪) હેમ કાવ્યાનુશાસન: નામ, વિભાગ,	
પદ્યાત્મક કૃતિ પહેલી કે ગદ્યાત્મક ?	૭૮	વિષયને રચનાસમય, તથા	
(૧) પૂજ્યપાદનું છન્દ:શાસ્ત્ર.	૭૮	અલંકારચૂડામણિ અને વિવેક,	
(૨) જયદેવચ્છન્દસુ: જયદેવનો સંપ્રદાય,		કાવ્યાનુશાસનની વિવિધ સમીક્ષા તેમજ	
એમનો સમયનિર્ણય, જયદેવચ્છન્દસુ		અઠ્યૂની યશોવિજયતૃત વૃત્તિ.	૯૨-૯૭
સંબંધી ઉલ્લેખો અને એનાં હર્ષટની		(૫) જયમંગલસૂરિકૃત કવિશિક્ષા	૯૭
વિવૃત્તિ ઇત્યાદિ વિવરણો.	૭૮-૮૧	કલ્પલતા, પલ્લવ, વિવેક	૯૭

વિષય	પૃષ્ઠ	વિષય	પૃષ્ઠ
(૬) અમરચન્દ્રસૂરિની કાવ્યકલ્પલતા: કવિશિક્ષા ઇત્યાદિ ત્રણ સ્વોપજવૃત્તિઓ તેમજ મકરન્દ અને યશોવૃત્તિ. ૯૭-૯૯		પ્રકરણ ૭: નાટ્યાશાસ્ત્ર ૧૦૮-૧૧૧ નાડયવિહિપાહુડ ૧૦૮ દ્વિકર્તૃક નાટ્યદર્પણ: ૧૦૮-૧૧૦	
(૭) કલ્પલતા: પલ્લવ અને વિવેક ૯૯-૧૦૧		રામચન્દ્રસૂરિના સોપ્રબંધો, અગિયાર દશ્ય કાવ્યો, વીસેક સ્તવો અને ત્રણ દ્વાત્રિંશિકા તેમજ ગુણચન્દ્રગણિની સહકર્તૃક કૃતિઓ..	
(૮) અલંકારપ્રબોધ: કર્તા અમરચન્દ્રસૂરિ ૧૦૨		સ્વોપજ વિવૃત્તિ તેમજ એની દશરૂપક અને હૈમ કાવ્યાનુશાસન સાથે તુલના..૧૧૦-૧૧૧	
(૯) કવિશિક્ષા: કર્તા વિનયચંદ્ર ૧૦૨		કેટલાંક નવાં પ્રકાશનો ૧૧૧	
યોર્યાશી દેશોની રૂપરેખા ૧૦૨		પ્રકરણ ૮: સંગીતશાસ્ત્ર ૧૧૨-૧૧૪	
(૧૦) અલંકાર મહોદધિ: ૧૦૨-૧૦૩		સંગીત સંબંધી લેખો. ૧૧૨	
નરચન્દ્રસૂરિનો પરિચય ને એમનો કૃતિકલાપ તથા સ્વોપજવૃત્તિ અને અર્થાલંકારવર્ણન. ૧૦૨-૧૦૩		(૧) સંગીતસમયસાર ૧૧૨	
(૧૧) કાવ્યનુશાસન: કર્તા વાગ્ભટ ૧૦૩-૧૦૪		(૨-૩) સંગીતોપનિષદ્ અને સંગીતોપનિષત્સારોદ્ધાર ૧૧૨-૧૧૩	
વાગ્ભટ બીજાનો પરિચય અને એમની કૃતિઓ તેમજ સ્વોપજ અલંકારતિલક.		વીણાવાદનનું વ્યસન. ૧૧૩	
(૧૨) ભાવદેવસૂરિકૃત અલંકારસાર, અલંકારસંગ્રહ યાને કાવ્યાલંકારસંગ્રહ: ૧૦૪		(૪-૭) સંગીતમણ્ડન, સંગીતદીપક, સંગીતરત્નાવલી અને સંગીતસહચિંગલ. ૧૧૩	
ભાવદેવસૂરિની કૃતિઓ.		સંગીત, નૃત્ય અને નાટ્ય સંબંધી જૈન ઉલ્લેખો. ૧૧૪	
(૧૩) અલંકારમણ્ડન. ૧૦૪		કેટલાંક નવાં પ્રકાશનો ૧૧૪	
(૧૪) શાન્તિચન્દ્રકૃત કવિતામદ-પરિહાર: એની સ્વોપજવૃત્તિ ૧૦૫		પ્રકરણ ૯: કામશાસ્ત્ર ૧૧૫	
(૧૫) અલંકારચિન્તામણિ: એની ટીકા ૧૦૫		કામવિષયક કૃતિની અલ્પ સંખ્યા હોવાનું કારણ. ૧૧૫	
(૧૬) અલંકારસંગ્રહ: કર્તા અમૃતનંદિ ૧૦૫		(૧) કન્ધર્પયૂકામણિ ૧૧૫	
(૧૭) કાવ્યલક્ષણ. ૧૦૫		(૨-૩) કામપ્રદીપ અને કોકપ્રકાશસાર ૧૧૫	
(૧૮) કાવ્યામ્નાય: ૧૦૬		(નર્મદાચાર્યાની કોકશાસ્ત્ર-ચોપાઈ)	
આ શું ચન્દ્રાલોકની ટીકા છે?		પ્રકરણ ૧૦: સ્થાપત્ય અને મુદ્રાશાસ્ત્ર ૧૧૬-૧૧૭	
(૧૯-૨૧) અવશિષ્ટ કૃતિઓ: ૧૦૬		શિલ્પશાસ્ત્રને લગતાં પ્રકીર્ણક ઉલ્લેખો ૧૧૬	
ચાર આંશિક કૃતિઓ ૧૦૬-૧૦૭		વત્સુસારપરણ ૧૧૭	
રૂપકમંજરી, બે રૂપકમાલા અને વક્રોક્તિ-પંચાશિકા ૧૦૬-૧૦૭		શિલ્પશાસ્ત્ર ૧૧૭	
કેટલાંક નવાં પ્રકાશનો ૧૦૭		દ્વ્યપરિક્ષા ૧૧૭	
		મુદ્રાશાસ્ત્ર સંબંધી સંસ્કૃત કૃતિનો અભાવ ૧૧૭	
		કેટલાંક નવાં પ્રકાશનો ૧૧૭	

૧-૨. આ ટિપ્પણગત વિગત છે.

વિષય	પૃષ્ઠ	વિષય	પૃષ્ઠ
પ્રકરણ ૧૧: ગણિતશાસ્ત્ર	૧૧૮-૧૨૧	ઉદયપ્રભસૂરિનો પરિચય ને એમની કૃતિઓ	
(ગણિતની શાખાઓ)	૧૧૮	તેમજ સુધી શૃંગાર (આરંભસિદ્ધિની ટીકા)	
(૧) ગણિતસારસંગ્રહ:	૧૧૮-૧૧૯	(૬) જ્યોતિ:સાર યાને નારયન્દ્ર જ્યોતિ:સાર: ૧૨૬	
આઠ વ્યવહારોનું નિરૂપણ અને સ્મલન,		નરયન્દ્રસૂરિની કૃતિઓ અને	
ગ્રન્થનો સત્કાર તેમજ સંસ્કૃતમાં બે		સાગરચન્દ્રનું ટિપ્પણ.	૧૨૬
તથા કાનજી અને તેલુગુમાં એકેક ટીકા..		(૭) હેમપ્રભસૂરિકૃત ત્રેલોક્યપ્રકાશ:	૧૨૬
ડૉ. દત્તના લેખો.	૧૨૦	ચાર નામાંતરો	
(૨) યલ્લાચાર્યકૃત ગણિતસંગ્રહ	૧૨૦	(૮) જન્મસમુદ્ર યાને જન્માંભોધિ:	૧૨૬
ગણિતશાસ્ત્ર	૧૨૦	બેડા નામની સ્વોપજ વૃત્તિ	
(૪) ગણિતસાર	૧૨૦	(૯) પ્રશ્નશતક: સ્વોપજ અવયૂર્ણિ	૧૨૬
(૩) ગૃહસ્થે રચેલું પાત્ર ગણિત	૧૨૦	(૧૦) ઠક્કર કેરુનો જ્યોતિ:સાર: સ્વોપજવૃત્તિ ૧૨૭	
ઠક્કર કેરુની કૃતિઓ	૧૨૦	(૧૧) હર્ષકીર્તિસૂરિકૃત જ્યોતિ:સાર:	૧૨૭
તિલક	૧૨૦	હર્ષકીર્તિસૂરિકૃત ટીકાઓ	
સિદ્ધભૂપદ્ધતિની ટીકા.	૧૨૦-૧૨૧	(૧૨-૧૫) ચાર જન્મપત્રીપદ્ધતિ	૧૨૭
વીરસેનનો પરિચય તેમજ એમની		(૧૬) માનસાગરી-પદ્ધતિ	૧૨૭
ધવલા અને જયધવલા નામની ટીકાઓ.	૧૨૧	[૨] સામુદ્રિક-શાસ્ત્ર	૧૨૮-૧૩૧
(૫) નેમિચન્દ્રીય ક્ષેત્રગણિત	૧૨૧	(૧) સામુદ્રિકતિલક:	૧૨૮
તત્ત્વાર્થસૂત્રના ભાષ્ય વગેરેમાં		જગદેવની કૃતિઓ	
ભૂમિતિને લગતાં છ કારણો.	૧૨૧	(૨) સામુદ્રિક-શાસ્ત્ર વિવેકવિલાસ સાથે સામ્ય ૧૨૯	
બૈજિક યાને રેખાગણિત	૧૨૧	(૩) પાશ્ચાત્યકૃત હસ્તકાણ્ડ	૧૨૯
		(૪) હસ્તસંજીવન યાને સિદ્ધજ્ઞાન: ૧૩૦-૧૩૧	
પ્રકરણ ૧૨: નિમિત્તશાસ્ત્ર	૧૨૨-૧૩૯	સ્વોપજ ટિપ્પણને સામુદ્રિકલહરી	
નિમિત્તશાસ્ત્રની વ્યાપકતા.	૧૨૨	નામની સ્વોપજ વિવૃત્તિ	
નિમિત્તના આઠ અને છ પ્રકારો.	૧૨૨	લોકકલ્પ	૧૩૧
[૧] જ્યોતિષ	૧૨૩-૧૨૭	(૩) શકુનશાસ્ત્ર	૧૩૧-૧૩૩
(૧-૨) પ્રશ્નપ્રકાશ અને કાલજ્ઞાન:	૧૨૩-૧૨૪	(૧) નરપતિજયર્થા	૧૩૧
પાદલિપ્તસૂરિનો પરિચય અને એમનો કૃતિકલાપ.		શકુનરહસ્ય	૧૩૨
(૩) ઋષિપુત્રની કૃતિ	૧૨૪	(૨) માણિક્યસૂરિકૃત શકુનશાસ્ત્ર	
જ્યોતિર્જ્ઞાનવિધિ	૧૨૪	યાને શકુનસારોદ્ધાર	૧૩૨
(૪) ભુવનદીપક યાને ગ્રહભાવપ્રકાશ:		(૩-૯) શકુનશાસ્ત્ર સંબંધી	
એનાં પાંચ વિવરણો.	૧૨૪-૧૨૫	અન્ય સાતકૃતિઓ	૧૩૨-૧૩૩
(૫) આરંભસિદ્ધિ યાને વ્યવહારચર્યા: ૧૨૫-૧૨૬		(૪) સ્વપ્નશાસ્ત્ર	૧૩૩

વિષય	પૃષ્ઠ	વિષય	પૃષ્ઠ
(૧) જગદેવકૃત સ્વપ્નશાસ્ત્ર	૧૩૩	અજૈન વૈદ્યક ગ્રન્થોની વૃત્તિઓ	૧૪૨
સુમણિસત્તરિયાની વૃત્તિ	૧૩૩	(૧૨) યોગાચિન્તામણિ, વૈદ્યકસારસંગ્રહ	
(૨) સ્વપ્નપ્રદીપ યાને સ્વપ્નવિચાર	૧૩૩	કિંવા વૈદ્યકસારોદ્ધાર	૧૪૩
(૫) રમલશાસ્ત્ર	૧૩૪	(૧૩) હસ્તરુચિકૃત વૈદ્યવલ્લભ	૧૪૩
(૧-૩) ત્રણ રમલશાસ્ત્ર	૧૩૪	(૧૪) યોગરત્નાકર (ગુજરાતી)	૧૪૩
(૪) પાશક-કેવલી ૨ કૃતિઓ	૧૩૪	(૧૫-૨૧) દ્રવ્યાવલી-નિઘણ્ટુ, વૈદ્યકલ્પ,	
(૬) અંગવિદ્યા	૧૩૪	વૈદ્યકસાર, સિદ્ધયોગમાલા, રસપ્રયોગ,	
(૧-૨) અંગચેષ્ટાવિદ્યા અને અંગસ્ફુરણ-વિચાર	૧૩૪	રસચિન્તામણિ અને માધરાજપદ્ધતિ	૧૪૩-૧૪૪
(૭) પ્રશ્નવિચાર	૧૩૪-૧૩૭	(૨૨-૨૮) આઠ સંદિગ્ધકૃતિઓ	૧૪૪
પણલાવાગરણની ત્રણવૃત્તિ: ચૂડામણિ,			
લીલાવતી અને દર્શનજયોતિર્વૃત્તિ	૧૩૪	પ્રકરણ ૧૪ : પાકશાસ્ત્ર	૧૪૫
(૧) ચન્દ્રોન્મલીન અને એની ટીકા	૧૩૪	નલપાકદર્પમ અને ક્ષેમકુતૂહલ (અજૈન કૃતિઓ)	
તીર્થકેવલિપ્રશ્ન આદિ	૧૩૫	તેમજ પોરાગમ	૧૪૫
આયજ્ઞાનતિલક વગેરે	૧૩૬	પ્રગટ કરવા યોગ્ય ગ્રંથો	૧૪૫
(૨) ફલાફલવિષયક પ્રશ્નપત્રક	૧૩૬		
(૩) મેઘવિજયકૃત ઉદયદીપિકા	૧૩૭	પ્રકરણ ૧૫ : વિજ્ઞાન	૧૪૬-૧૪૮
(૪) મેઘવિજયકૃત પ્રશ્નસુન્દરી	૧૩૭	[૧]	
(૮) પ્રકીર્ણક	૧૩૭-૧૩૮	અમરચન્દ્રકૃત કલાકલાપ	૧૪૬
(૧) મેઘવજિયકૃત વર્ષ પ્રબોધ યાને મેઘમહોદય:		[૨]	
રચનાસમય અને અવતરણો	૧૩૭-૧૩૮	(૧) હંસદેવકૃત મૃગપક્ષશાસ્ત્ર	૧૪૬
પંચાંગતત્ત્વ આદિ	૧૩૮	(૨) જગદેવકૃત ગજપ્રબન્ધ	૧૪૬
(૨) ઉત્તરલાવયંત્ર અને એની ટીકા	૧૩૮	(૩-૫) જગદેવકૃત તુરંગપ્રબન્ધ, ભોજકૃત	
		શાલિહોત્ર અને અજ્ઞાતકર્તૃકઅશ્વાદિગુણ	૧૪૬-૧૪૭
પ્રકરણ ૧૩ : વૈદ્યકશાસ્ત્ર	૧૪૦-૧૪૪	(૬-૭) શ્વાનસપ્તતિકા અને શ્વ-રુદિત	૧૪૭
(૧) સમન્તભદ્રકૃત સિદ્ધાન્તરસાયનકલ્પ:	૧૪૦	(૭ ^મ) કાકરુત (ગુજરાતી)	૧૪૭
અમૃતનન્દિનો પારિભાષિક શબ્દકોશ		[૩]	
(૨-૭) પૂજ્યપાદ, પાત્રકેસરી, સિદ્ધસેન,		(૧) ધનુર્વિદ્યા: એની વૃત્તિ	૧૪૮
દશરથગુરુ, મેઘનાદ અને સિંહનાદની		[૪]	
એકેક કૃતિ	૧૪૦	(૧) સમસ્તરત્નપરીક્ષા	૧૪૮
(૮) વૈદ્યકગ્રન્થ	૧૪૦	(૨) રત્નપરીક્ષા	૧૪૮
નાડીપરીક્ષા વગેરે	૧૪૦-૧૪૧	(૩) હીરકપરીક્ષા	૧૪૮
(૯-૧૧) કલ્યાણકારક નામની ત્રણ કૃતિઓ	૧૪૨	(૪) ઠક્કર ફેરુકૃત ધાતુપરીક્ષા	૧૪૮

વિષય	પૃષ્ઠ	વિષય	પૃષ્ઠ
[૫]		(૬-૭) વિવેકકલિકા અને વિવેકપાદ્ય	૧૫૫
(૧-૬) મધીવિચાર, લેખપદ્ધતિ,		(૮) તિલકપ્રભકૃત સુભાષિતાવલી	૧૫૫
લેખન-પ્રકાર, વિજ્ઞાનચન્દ્રિકા,		(૯) મન્મથસિંહકૃત સૂક્તરત્નાકર	૧૫૫
વિજ્ઞાનર્ણવ અને વિજ્ઞાનાર્ણવોપ-નિષદ્ધ	૧૪૮	(૧૦) વસ્તુપાલકૃત સૂક્તિસમુચ્ચય	૧૫૫
પ્રકરણ ૧૬ : નીતિશાસ્ત્ર	૧૪૮-૧૬૩	(૧૧) લક્ષ્મણકૃતસૂક્તાવલી યાનેસૂક્ત-સંગ્રહ	૧૫૬
‘નીતિ’ના અર્થ	૧૪૮	(૧૨) અજ્ઞાતકર્તૃક સૂક્તમુક્તાવલી	૧૫૬
(૧) સામાન્ય નીતિ	૧૪૮-૧૫૧	(૧૩) સૂક્તાવલી યાને કર્પૂરપ્રકર: એનાં ચારેક વિવરણ	૧૫૬
(૧) પ્રશ્નોત્તરરત્નમાલ યાને રત્નમાલિકા:	૧૪૮-૧૫૦	(૧૪) અજ્ઞાતકર્તૃક સૂક્તમુક્તાવલી	૧૫૭
ચાર વિવરણો અને મૂળ કૃતિનાં રૂપાંતરો		(૧૫) સૂક્તસંગ્રહ: એની અવયૂરિ	૧૫૭
(૨) સમાનનામક કૃતિ	૧૫૦	(૧૬) હીરવિજયકૃત સૂક્ત-રત્નાવલી	૧૫૭
(૩) નીતિશાસ્ત્ર:	૧૫૦	(૧૭) હેમવિજયકૃત સૂક્તમુક્તાવલી:	
તિલકપ્રભસૂરિની કૃતિઓ.		એમની અન્ય કૃતિઓ	૧૫૭
(૪) નીતિધનદ:	૧૫૦-૧૫૧	(૧૮) સિદ્ધિચન્દ્રકૃત સૂક્તિરત્નાકર	૧૫૮
ધનદનાં સર્ગપહલાં અને એમની બે અન્યકૃતિઓ.		(૧૯) સૂક્તિ(ક્ત)દ્વાત્રિંશિકા: એનું સ્વોપજ વિવરણ	૧૫૮
(૫-૧૧) નીતિશાસ્ત્ર, નીતિસાર નામની ત્રણ કૃતિ, નીતિસારસમુચ્ચય, નીતિરસાયન અને નીતિગ્રન્થ.	૧૫૧	(૨૦) કસ્તૂરીપ્રકર: એની સ્વોપજવૃત્તિ કર્પૂરપ્રકરણ	૧૫૮
(૧૨) મલ્લિપેશકૃત સજ્જન ચિત્તવલ્લભ:	૧૫૧	(૨૧) હિંગુલપ્રકર: એનો અનુવાદ તથા વિનયસાગર તે કોણ ?	૧૫૮-૧૫૯
એની સંસ્કૃત અને કાનડી ટીકા		(૨૨-૨૫) સદ્ભાષિતાવલી, સુભાષિતવિજય-મતશાસ્ત્ર, આર્યાગાથા, સુભાષિતરત્નકોશ અને સૂક્ત-મુક્તાવલી યાને સૂક્તિમુક્તાવલી	૧૫૯
(૧૩) શિવકોટિકૃત રત્નમાલા.	૧૫૧	(૨૬) સૂક્તરત્નાવલી: એની સ્વોપજવૃત્તિ તેમજ ક્ષમા-કલ્યાણની જીવનરેખા અને એમની મૌલિક અને વિવરણાત્મક કૃતિઓ	૧૫૯-૧૬૦
(૨) સુભાષિત	૧૫૧	(૨૭-૪૪) સુભાષિતપદ્યરત્નાકર, જે સૂક્તસન્દોહ તેમજ અન્ય સોળ કૃતિઓ	૧૬૦-૧૬૧
(૧) સૂક્તિસમુચ્ચય	૧૫૧	(૩) રાજનીતિ	૧૬૨-૧૬૩
(૨) સુભાષિતરત્નસન્દોહ:	૧૫૨	(૧) નીતિવાક્યામૃત: એની ટીકા અને સોમદેવસૂરિની અન્ય કૃતિઓ	૧૬૨-૧૬૩
અભિતગતિ ખોજાની કૃતિઓ		(૪) પ્રકીર્ણક	૧૬૩
(૩) હેમચન્દ્રવચનામૃત	૧૫૨-૧૫૩	(૧) બુદ્ધિસાગર	૧૬૩
(૪) સૂક્તિમુક્તાવલી, સિન્દૂરપ્રકર યાને સોમશતક: સિન્દૂરપ્રકરનાં આઠ વિવરણો તેમજ મૂળ કૃતિનાં ઈટાલિયન અનુવાદ અને અનુકરણો	૧૫૩-૧૫૪		
(૫) અમરચન્દ્રકૃત સૂક્તાવલી	૧૫૫		

વિષય	પૃષ્ઠ	વિષય	પૃષ્ઠ
પ્રકરણ ૧૭ : અજૈન લાક્ષણિક સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો	૧૬૪	(૧૧) ભોજકૃત સરસ્વતી કણભરણઃ આજડકૃત પદપ્રકાશ	૧૭૮-૧૭૯
જૈન માનસ	૧૬૪	(૧૨) જયદેવકૃત ચન્દ્રાલોકઃ કાવ્યાભ્યાસ	૧૭૯
અજૈનકૃતિઓ અંગે જૈનોનો કાળો	૧૬૫	(૧૩) ધર્મદાસકૃત વિદગ્ધમુખમણ્ડનઃ એની સાત ટીકા અને બાલાવબોધ	૧૭૯
(૧) પાણિનીય અષ્ટાધ્યાયીઃ શબ્દાવતાર ન્યાસ, કાશિકા અને એની પંજિકા	૧૬૫-૧૬૬	(૧૪) શ્રીધરકૃત ગણિતસાર. એની વૃત્તિ. ૧૭૯-૧૮૦	
(૨) વિશ્રાન્તવિદ્યાધરઃ મલ્લવાદીનો ન્યાસ	૧૬૭	(૧૫) શ્રીપતિકૃત ગણિતતિલક યાને ગણિતપાટીઃ સિંહાતિલકસૂરિની વૃત્તિ	૧૮૦
(૩) કાતન્ત્રઃ એની ચૌદેકવૃત્તિ, કલાપવ્યાકરણ-સંધિગર્ભિતસ્તવ અને એની અવચૂરિ તેમજ		(૧૬) વરાહનિહિરનું લઘુજાતકઃ એની વૃત્તિ ૧૮૦	
સંગ્રામસિંહકૃત બાલશિક્ષા	૧૬૭-૧૬૮	(૧૭) શ્રીપતિકૃત જાતક(કર્મ)પદ્ધતિઃ સુમતિહર્ષની ટીકા, અન્ય કૃતિઓ.	૧૮૦
(૪) નરેન્દ્રાર્યકૃત સારસ્વત વ્યાકરણ. ભોજનવ્યાકરણ, સારસ્વત ઉપરની ઓગણીસ અને સિદ્ધાન્તચન્દ્રિકા ઉપરની પાંચ જૈન ટીકા, સારસ્વતમણ્ડન, સારસ્વતનો ધાતુપાઠ, વીરસ્તવ અને એની ટીકા, જિનચન્દ્રકૃત સિદ્ધાન્તરત્નિકા તેમજ		(૧૮) હરિભટ્ટકૃત તાજિકસારઃ સુમતિહર્ષકૃત ટીકા.	૧૮૧
સારસ્વતવિભ્રમની અવચૂર્ણિ	૧૬૮-૧૭૩	(૧૯) ભાસ્કરકૃત કરણકુતૂહલઃ સુમતિહર્ષની ગણકકુમુદકૌમુદી.	૧૮૧
અનિટ્કારિકાઃ એનાં ત્રણ વિવરણ આદિ	૧૭૩	(૨૦) કાલિદાસકૃત જયોતિર્વિદ્યાભરણઃ ભાવરત્નની સુબોધિનીગ	૧૮૧
ભૂ-ધાતુઃ	૧૭૩	(૨૧) મહાદેવકૃત મહાદેવીસારણીઃ ધનરાજકૃત દીપિકા ઇત્યાદિ.	૧૮૧
(૫) અમરસિંહકૃત અમરકોશ આશાધરકૃત ટીકા ને 'શંખેશ્વર' પાર્શ્વનાથની સ્તુતિ	૧૭૩	(૨૨) વિવાહપટલઃ અમરનો બાલાવબોધ.	૧૮૧
(૬) શ્રુતબોધઃ એની છ ટીકા	૧૭૪	(૨૩) ગણેશકૃત ગ્રહલાઘવઃ એનાં ટીકા અને દિપ્પણ તેમજ યશસ્વત્સાગરની કૃતિઓ	૧૮૧
(૭) કેદારકૃત વૃત્તરત્નાકરઃ એની છ ટીકા ૧૭૪-૧૭૫		(૨૪) દિનકરની ચન્દ્રાર્કીઃ કૃપાવિજયની વૃત્તિ ૧૮૨	
(૮) દંડિકૃત કાવ્યદર્શઃ		(૨૫) ભટ્ટોત્પલની પટપંચાશિકાઃ મહિમોદયની ટીકા.	૧૮૨
ત્રિભુવન-ચન્દ્રની ટીકા	૧૭૫-૧૭૬	(૨૬) હરિભટ્ટકૃત ભુવનદીપકઃ લક્ષ્મીવિજયનો બાલાવબોધ.	૧૮૨
(૯) રુદ્રકૃત કાવ્યાલંકારઃ	૧૭૬-૧૭૭	(૨૭) રાજર્ષિભટ્ટકૃત ચમત્કારચિન્તામણિઃ અભયકુશળની બાલાવબોધિની	૧૮૨
નમિસાધુની વૃત્તિ ને આશાધરકૃત નિબન્ધન		(૨૮) હોરામકરન્દઃ સુમતિહર્ષની ટીકા	૧૮૨
(૧૦) મમ્મટકૃત કાવ્યપ્રકાશઃ એની સંકેતાદિ છ ટીકા, સંકેતનું અઠ્યાય		(૨૯) વસન્તરાજયશકુન, શકુનનિર્ણય યાને શકુનાર્ણવઃ ભાનુચન્દ્રગણિની વૃત્તિ.	૧૮૨
અને વિવેક સાથે સામ્ય તેમજ કાવ્યપ્રકાશનો અભ્યાસ.	૧૭૭-૧૭૮		

વિષય	પૃષ્ઠ	વિષય	પૃષ્ઠ
(૩૦) વાગ્ભટકૃત અષ્ટાંગહૃદયઃ		(૩૨) વરરુચિકૃત યોગશતઃ	૧૮૩
આશાધરકૃત ટીકા.	૧૮૩	પૂર્ણસેનની વૃત્તિ.	૧૮૪
(૩૧) નાગાર્જુનકૃત આશ્ચર્યયોગમાલા		ભર્તૃહરિકૃત નીતિશતક.	૧૮૪
યાને યોગરત્નમાલાઃ ગુણાકરની વિવૃત્તિ.	૧૮૩	ધનસારની ટીકા અને સર્વાર્થ સિદ્ધિમણિમાલા.	૧૮૫

પરિશિષ્ટ : ૧


ગ્રંથકારોની સૂચી	૧૮૬-૧૮૮	(આ) દિગમ્બર	૧૮૪-૧૮૫
(અ) શ્વેતામ્બર અને યાપનીય ગ્રંથકાર	૧૮૬-૧૮૩	(ઈ) અજૈન	૧૮૬-૧૮૮

પરિશિષ્ટ : ૨

ગ્રંથો અને લેખોની સૂચી	૨૦૦-૨૩૫	(આ) દિગમ્બરગ્રંથો	૨૨૫-૨૩૦
(અ) શ્વેતામ્બર અને યાપનીય ગ્રંથો	૨૦૦-૨૨૫	(ઈ) અજૈનગ્રંથો	૨૩૦-૨૩૫

પરિશિષ્ટ : ૩

પ્રકીર્ણક વિશેષનામો	૨૩૬-૨૫૩	સંકેતસૂચી	૨૫૪-૨૫૫
---------------------	---------	-----------	---------



શુદ્ધિ-પત્રક

પૃ.	પં.	અશુદ્ધ	શુદ્ધ	પૃ.	પં.	અશુદ્ધ	શુદ્ધ
૩૪	૨૬	ચિત્રાલંકાર	[ચિત્રાલંકાર	૧૨૧	૨૩	વ્યાખ્યા	વ્યાખ્યા]
૩૪	૨૮	નં. ૫૧	નં. ૫૧]	૧૪૪	૨૩	તત્ત્વાર્થ	[તત્ત્વાર્થ
૬૩	૩૦	ટિ. ૫	ટિ. ૭	૧૪૪	૨૪	ગંગા	ગંગા]
૧૦૬	૨૧	પ્રકાશ	પ્રકાશન	૧૪૫	૧૪	શ્રી હિમાંશુ	[શ્રી હિમાંશુ
૧૦૭	૧૨	કેશરિયા	[કેશરિયા	૧૪૮	૨૦	રુપ્ય	રૂપ્ય
૧૦૭	૨૬	જિ.આ.દ્ર.	જિ.આ. ટ્રસ્ટ	૧૮૫	૧૩	પાણિનીય	[પાણિનીય
૧૦૭	૨૭	ભારતી	ભારતી]	૧૮૫	૧૫	વધટીકા	વધટીકા
૧૧૪	૮	કાવ્યાનુ	[કાવ્યાનુ	૧૮૫	૨૦	સાધુ આનંદ સાગરજી	સાધુ.]
૧૧૪	૩૧	1972 A.D.	1972 A.D.]	૨૧૪૨/૩૨		મેઘમાલા	મેઘમાલા
૧૧૫	૮	જ. સા.	જૈ. સા.	૨૧૪૨/૩૩		મેઘમાલા	મેઘમાલા
૧૨૧	૧૪	Aspects	[Aspects	૨૧૪૨/૩૩		મેઘમાલા	મેઘમાલા



આચાર્ય શ્રી વિજયમુનિયન્દ્રસૂરિ સંપાદિત-સંકલિત
પ્રકાશિત ગ્રંથો

હીરસૌભાગ્ય (સટીક)

પ્રવચન સારોદ્ધાર વિષમપદ વ્યાખ્યા

દસસાવગચરિયં

ધર્મરત્નકરંડક

કથારત્નાકર

પ્રભાવકચરિત્ર (ગુજરાતી ભાષાંતર)

ઉપમિતિ કથોદ્ધાર કર્તા : પં. શ્રી હંસરત્નગણી

વીરનિર્વાણ સંવત ઔર જૈન કાલગણના : લે. પં. કલ્યાણવિજય ગણી

શ્રમણ ભગવાન મહાવીર : પં. કલ્યાણવિજય ગણી

જીવાજીવાભિગમ આ. હરિભદ્રસૂરિટીકા (મુદ્રણાલયમાં)

જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ લે. મોહનલાલ દેસાઈ

દસવૈકલિકસૂત્ર : પૂ. આ. ભ. શ્રી ભદ્રંકરસૂરિ મ. સા. ના વિવેચન સાથે

કર્મગ્રંથ ૧ થી ૫ : રમ્યરેણુ, શાંતિનાથ ચરિત્ર-સાનુવાદ : રમ્યરેણુ,

દાનોપદેશમાલા-સવિવેચન : રમ્યરેણુ

પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરિ મ. સા.ની વાચનાઓ

દરિસણ તરસિએ ભા. ૧

દરિસણ તરસિએ ભા. ૨

આપ હિ આપ બુઝાય

ઋષભ જિનેશ્વર પ્રિતમ માહરો

આતમજ્ઞાની શ્રમણ કહાવે

આત્માનુભૂતિ

બિછુરત જાયે પ્રાણ

સો હિ ભાવ નિર્ગ્રંથ

મેરે અવગુણ ચિત્ત ન ધરો

પ્રભુનો પ્યારો સ્પર્શ


અસ્તિત્વનું પરોઢ

અનુભૂતિનું આંકાશ

—: પ્રાપ્તિસ્થાન :—

આ. શ્રી ઝંકારસૂરિ આરાધના ભવન

સુભાષચોક, ગોપીપુરા, સૂરત-૩૯૫૦૦૧. ફોન : ૨૪૨૬૫૩૧



ઉપોદ્ધાત, પ્રસ્તાવના અને ભૂમિકા એ સામાન્ય રીતે પર્યાયવાચક શબ્દો ગણાય છે. તેમ છતાં ‘ઉપોદ્ધાત’ એ વધારે ગૌરવશાળી શબ્દ ગણાય છે. એને માટે અંગ્રેજીમાં ઇન્ટ્રોડક્શન (Introduction) શબ્દ વપરાય છે.

‘ઉપોદ્ધાત’ એ ગ્રંથનું મહત્વનું અંગ છે. આના સમર્થનાર્થે એટલું જ કહેવું બસ થશે કે નિર્યુક્તિકાર ભદ્રબાહુસ્વામી એ જે આવસ્સયની નિજજુતિ રચી છે. તેનો પ્રારંભ એના અંશરૂપ ઉવગ્ધાયનિજજુતિ (ઉપોદ્ધાત-નિર્યુક્તિ)થી કરાયો છે.

‘ઉપોદ્ધાત’ એ ગ્રંથના પ્રવેશ-દ્વારની ગરજ સારે છે અને સાથે સાથે એના હાર્દ ઉપર પ્રકાશ પાડે છે-એના નિષ્કર્ષની રજૂઆત કરે છે. આ બાબતોને લક્ષ્યમાં રાખી હું અહીં ઉપોદ્ધાત લખું છું. સૌથી પ્રથમ હું એને બે વિભાગોમાં વિભક્ત કરું છું. (૧) નિવેદન અને (૨) મૂલ્યાંકન. નિવેદન દ્વારા મેં કઈ પરિસ્થિતિમાં આ પુસ્તક રચવાનું માથે લીધું-એને અંગે મારી શી તૈયારી હતી તેમજ આ પુસ્તકની રચના મેં કઈ પદ્ધતિએ કરી છે એ બે મુખ્ય બાબતો હું વિચારવા ઈચ્છું છું. તેમ કર્યા પછી ‘મૂલ્યાંકન’ રૂપ બીજા વિભાગમાં હું ચાર બાબત વિચારીશ.

- (૧) જૈન સંસ્કૃત સાહિત્યમાં શ્રમણવર્ગ અને શ્રાવક-વર્ગમાંથી કોનો કેવો અને કેટલો ફાળો છે?
- (૨) જૈન સંસ્કૃત સાહિત્યનો યુગદોષ ફાલ શો છે ?
- (૩) એ સાહિત્યનાં વિવિધ અંગોનો વિકાસક્રમ કેવો છે ?
- (૪) એનો નિષ્કર્ષ કેવો છે ?

(અ) નિવેદન

ઉત્થાનિકા— આ પૃથ્વી ઉપરના સમસ્ત જીવોમાં મનુષ્યો એની વાણી અને વિચારશક્તિને લઈને અગ્રસ્થાન ભોગવે છે. આ બે અમૂલ્ય સાધનોના સદુપયોગ દ્વારા એ સમગ્રવિશ્વનું કલ્યાણ કરી શકે એવું એનામાં સામર્થ્ય છે, પરંતુ એના આવિર્ભાવમાં બાહ્યપરિસ્થિતિની અનુકૂળતા પણ જેવો તેવો ભાગ ભજવતી નથી.

સુયોગ— સામાન્ય મનુષ્યોનો વિચાર કરીશું તો જણાશે કે એની શક્તિનો વિકાસ એની ઐશ્વિક પ્રવૃત્તિને પલ્લવિત, પુષ્પિત અને ફલિત કરવા માટે કેવું સ્થાન મળે છે તે ઉપર આધાર રાખે છે. સૌ કોઈને સર્વદા આંતરિક યોગ્યતા અને માનસિક વલણ અનુસાર જ કાર્યો કરવાનાં મળે એવો સુયોગ સાંપડવો મહામુશ્કેલ છે. સદ્ભાગ્યે મારા જીવનના એક ક્ષેત્રમાં તો મને આ જાતનો સુયોગ ઓછેવત્તે અંશે પણ પ્રાપ્ત થયો છે.

ઐશ્વિક વિષય તરીકે ‘ગણિત’ પસંદ કરી બી.એ.ની પરીક્ષામાં અને આગળ જતાં એમ. એ. માટે પણ એ જ વિષય ચાલુ રાખી એ પરીક્ષામાં પણ હું ઉત્તીર્ણ થયો. પરીક્ષાની દૃષ્ટિએ તો ગણિતના અભ્યાસની આ પૂર્ણાહૂતિ ગણાય. મારું ગણિતનું જ્ઞાન કટાઈ ન જાય એટલું જ નહિ પણ એમાં હું ઉત્તરોત્તર વૃદ્ધિ કરી શકું એવો સુયોગ પણ મને એમ.એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ તરત જ સને ૧૯૧૮માં ગણિતના અધ્યાપક તરીકે મુંબઈની વિલ્સન કોલેજમાં મારી નિમણૂક થવાથી મળ્યો.

P-૧૫

અભ્યાસ— ગણિતશાસ્ત્ર એ વિચારશક્તિને વ્યવસ્થિત, વિકસિત અને કેન્દ્રિત કરવામાં સબળ ફાળો આપે છે. આથી ગણિતજ્ઞને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં વિહરવું સુગમ થઈ પડે છે. ગમે તેમ પણ મને આ ક્ષેત્રે પ્રથમથી જ આકર્ષ્યો છે, એને લઈને “શાસ્ત્રવિશારદ” જૈનાચાર્ય સ્વ. વિજયધર્મસૂરિજીનું મુંબઈમાં ચાતુર્માસ થતાં એમના વિદ્વાન શિષ્યોના-ખાસ કરીને ‘ન્યાયતીર્થ’ ‘ન્યાયવિશારદ’ ઉપાધ્યાય સ્વ.મંગળવિજયજી અને ‘ન્યાયવિશારદ’ ‘ન્યાયતીર્થ’ મુનિરાજશ્રી ન્યાયવિજયજીના જ્ઞાનનો આ દિશામાં મેં લાભ લીધો. એથી હું તત્ત્વજ્ઞાન અને સાહિત્યના વિશિષ્ટ અને સમુચિત અભ્યાસ માટે શ્રીગણેશ માંડી શક્યો.

સને ૧૯૨૩માં “મુંબઈ વિદ્યાપીઠ” તરફથી ગણિતશાસ્ત્રને અંગે સંશોધનદાન (Research grant) મળતાં જૈન સાહિત્ય વિષે વિચારવાની મને અમૂલ્ય તક મળી. સાથે સાથે એ અરસામાં ઉપર્યુક્ત ન્યાયવિજયજીની ન્યાયકુસુમાંજલિના અંગ્રેજી અને ગુજરાતી અનુવાદો તેમજ સ્પષ્ટીકરણો તૈયાર કરવાનો લાભ મળતાં હું કલમ પકડતાં શીખ્યો.

P-૧૬

ઝોગ્યતા—મારા અભ્યાસને દઢીભૂત કરવા માટે અને એનો યથેષ્ટ વિકાસ સાધવા માટે મેં એક પછી એક નાની મોટી કૃતિઓ તૈયાર કરવા માંડી. તેમ થતાં જૈન સાહિત્યથી ધીમે ધીમે વધારે ને વધારે પરિચિત બનતો ગયો. અનેકવિધ ભાષાઓમાં રચાયેલા આ વિશાળ ક્ષેત્રને પહોંચી વળવા માટે મારામાં બળ હતું નહિ. પરંતુ મારી પરિસ્થિતિએ મને પુણ્યપત્તન (પૂના)ના “ભાંડારકર પ્રાચ્ય-વિદ્યા-સંશોધન-મંદિર” દ્વારા મુંબઈ સરકારની માલિકીની પાંચેક હજાર જૈન હસ્તલિખિત પ્રતિઓનું વિસ્તૃત અને વર્ણનાત્મક સૂચીપત્ર તૈયાર કરવા જેવું ભગીરથ કાર્ય ઉપાડવા પ્રેર્યો. આનું પરિણામ એ આવ્યું કે હું જૈન સાહિત્યના ઇતિહાસની આછી રૂપરેખા આલેખવા જેટલી શક્તિ મેળવી શક્યો. તેમ થતાં મેં જૈન સાહિત્યને ‘આગમિક’ અને ‘અનાગમિક’ એમ બે વર્ગમાં વિભક્ત કરી પ્રથમ વર્ગને અનુલક્ષીને એનો ઇતિહાસ અંગ્રેજીમાં આલેખ્યો, અને “મુંબઈ વિદ્યાપીઠ” તરફથી પ્રકાશન-દાન (Publication grant) મળતાં એ સને ૧૯૪૧માં મેં પ્રસિદ્ધ પણ કર્યો. આ કાર્ય થતું હતું, તે દરમ્યાન અનાગમિક સાહિત્યનો પણ અંગ્રેજીમાં ઇતિહાસ રચવા માટેની સામગ્રી હું તૈયાર કરતો ગયો. આ ઇતિહાસનું કાર્ય તો આજે કેટલાંયે વર્ષો થયાં પૂરું થયું છે, પરંતુ એના પ્રકાશન-ખર્ચને પહોંચી વળવા જેવી મારી આર્થિક પરિસ્થિતિ નહિ હોવાથી એ આજે તો અપ્રકાશિત છે. આ કાર્ય ઉપાડી લેવા માટે મેં વિવિધ સંસ્થાઓને પત્રો લખ્યા તેમજ જૈન કોમને ઉદ્દેશીને લેખ પણ લખ્યો, પરંતુ અત્યાર સુધી તો એના પ્રકાશન માટે કશો પ્રબંધ થયો નથી. એથી મને સ્વાભાવિક રીતે થોડોક તો ખેદ થાય જ ને? વિશેષ ખેદ તો એ થાય છે કે મુંબઈ વિદ્યાપીઠે આ પુસ્તક અંગે પ્રકાશન-દાન આપવાની બબ્બેવાર ઇચ્છા દર્શાવી છતાં તેનો હું લાભ લઈ શક્યો નથી.

અનાગમિક સાહિત્યના ઇતિહાસ માટે મેં લીધેલો પરિશ્રમ સર્વથા નિષ્ફળ ગયો નથી એ આનંદની વાત છે, કેમકે એમાં પીરસેલી સામગ્રીનો થોડોક ઉપયોગ પાઈય (પ્રાકૃત) ભાષાઓ અને

૧. આનું નામ “અનાગમિક સાહિત્યનો ઇતિહાસ” છે. એ લેખ “આત્માનંદ પ્રકાશ” (પુ-૪૭ અં.૧૦)માં પ્રસિદ્ધ કરાયો છે.

૨. આના પ્રકાશનનો તમામ ખર્ચ મેં પૂરો પાડ્યો છે, જોકે પ્રકાશક તરીકે મારું નામ નથી.

સાહિત્ય નામના મારા પુસ્તકમાં તેમજ આ પ્રસ્તુતમાં પણ કરી શક્યો છું. એવી રીતે 'આગમોનું દિગ્દર્શન' નામનું મારું પુસ્તક પણ મને પ્રસ્તુત પુસ્તક લખવામાં અંશતઃ ઉપયોગી નીવડ્યું છે.

'પાઈય'ના અર્થની વ્યાપકતા—જૈન સાહિત્યના પાઈય, સંસ્કૃત અને દ્રાવિડ એમ ભાષાદષ્ટિએ મુખ્ય ત્રણ ખંડો પડે છે. 'પાઈય'નો અર્થ વ્યાપક સ્વરૂપે વિચારાય તો એ ભાષાથી મરહટ્ટી (માહારાષ્ટ્રી), સોરસેણી (શૌરસેની), માગહી (માગધી), પેસાઈ (પૈશાચી), અને ચૂલિયાપેસાઈ (ચૂલિકાપૈશાચી) એ પાંચ જ કે એ ઉપરાંત અવહટ્ટ (અપભ્રંષ્ટ) નામની છઠ્ઠી ભાષા કે પાલિ શુદ્ધાં સમજવાની છે એમ નહિ, પરંતુ આપણા દેશની વિવિધ પ્રાદેશિક ભાષાઓ સુધી એના ક્ષેત્રનો વિસ્તાર છે.

P-૧૭

પાલિ અને પ્રાદેશિક ભાષાઓને બાદ કરતાં અન્ય ભાષાઓમાં રચાયેલી કૃતિઓ વિષે મેં ઉપર્યુક્ત બે પુસ્તકમાં વિચાર કર્યો છે અને એ દ્વારા અર્ધમાગહી (અર્ધમાગધી) વગેરે પાઈય ભાષામાં રચાયેલા સાહિત્ય પૂરતો સામાન્ય પરિચય તો હું જગત્ સમક્ષ રજૂ કરી શક્યો છું. આમ મેં પ્રથમ ખંડ માટે નમ્ર પ્રયાસ કર્યો છે.

બીજો ખંડ એટલે જૈન ગ્રન્થકારોએ સંસ્કૃત ભાષામાં સર્જેલું વિવિધ અને વિપુલ સાહિત્ય. આનો પરિચય થોડે ઘણે અંશે પણ આ પુસ્તક પૂરો પાડે છે. એ તૈયાર કરવાનું કામ મને “શ્રીમુક્તિ-કમલ-જૈન-મોહન-માલા”ના કાર્યાધિકારી શ્રીલાલચંદ નંદલાલ વકીલ તરફથી તા. ૬-૮-૫૨ ને રોજ સોંપાયું હતું અને મેં તમામ લખાણ તા. ૧૬-૧૨-૫૩ને રોજ એમને પહોંચતું કર્યું હતું. ગયે વર્ષે સપ્ટેમ્બર માસમાં એનું મુદ્રણ કાર્ય શરૂ કરાયું હતું.

અભિલાષા—ત્રીજો ખંડ દ્રાવિડભાષામાં ગુંથાયેલા સાહિત્યને લગતો છે એટલે એનો ઇતિહાસ તો હું સ્વતન્ત્રપણે હાલ તુરંત આલેખી શકું તેમ નથી. આથી અત્યારે તો મારે પ્રાદેશિક ભાષાઓમાં-પાસ કરીને ગુજરાતીમાં રચાયેલી જૈન કૃતિઓનો વિષયદીઠ ઇતિહાસ તૈયાર કરવાનું કામ બાકી રહે છે. આ માટે ઉપયોગી થઈ પડે એવા મારા કેટલાક લેખો પ્રસિદ્ધ થયા છે અને કેટલાક છપાયા વિનાના મારી પાસે છે. આ તેમજ બીજી આવશ્યક સામગ્રી એકત્રિત થતાં આ ઇતિહાસનું કાર્ય પણ કરી શકાય. જો આ સંસ્થા કે અન્ય કોઈ એનો પ્રકાશનાર્થે પ્રબંધ કરવા તૈયાર થશે તો એ હું સાનંદ હાથ ધરીશ.

P-૧૮

યોજના—પ્રસ્તુત પુસ્તક મેં બે ખંડમાં વિભક્ત કર્યું છે અને એનાં “સાર્વજનીન સાહિત્ય” અને “ધાર્મિક સાહિત્ય” એવાં નામ અનુક્રમે યોજ્યાં છે. “સાર્વજનીન” શબ્દ જ સૂચવે છે તેમ આ ખંડમાં રજૂ કરાયેલા વિષયો સૌ કોઈને માટેના છે તેમજ સૌ કોઈને ઉપયોગી થાય તેવા છે. એમાં સાંપ્રદાયિકતાને માટે અવકાશ નથી. આમ એ બિનસાંપ્રદાયિક (secular) છે. બાકી એ વાત તો સાચી છે કે લેખકની પોતાની ધાર્મિક માન્યતાઓનું આછું પ્રતિબિંબ તો કોઈપણ કૃતિમાં પ્રકટ કે પ્રચ્છન્ન સ્વરૂપે પ્રાયઃ પડે જ.

૧. આના પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ મેં પૂરો પાડ્યો છે.

૨. ‘કલિકાસર્વજન’ હેમચન્દ્રસૂરિએ સિદ્ધહેમચન્દ્ર (અ.ટ., પા. ૧, સૂ.૩)માં આ ભાષાને ‘આર્ય પ્રાકૃત’ કહી છે.

૩. ‘દ્રાવિડ’થી કાનડી, તામિલ, તેલુગુ અને મલયાલમ એ ચાર ભાષા ગણાવાય છે. પ્રો. એ. ચક્રવર્તીએ “Jaina Literature in Tamil” નામનો નિબંધ લખ્યો છે અને એ “જૈન સિદ્ધાંત ભવન” તરફથી આરાધી ઇ. સ. ૧૯૪૩માં છપાવાયો છે.

૪. “સાર્વજનીન”નો અર્થ સર્વજનોને હિતકારી એવો પણ થાય છે પણ એ અર્થ અહીં સર્વાંશે અભિપ્રેત નથી. અહીં તો સાર્વજનિક એ અર્થમાં મેં આનો પ્રયોગ વિશેષતઃ કર્યો છે.

સાર્વજનીન સાહિત્ય એ સર્વદેશીય સાહિત્ય છે અને એમ હોવાથી એમાં નીચે મુજબનાં શાસ્ત્રોને મેં સ્થાન આપ્યું છે.

વ્યાકરણ, કોશ, છંદ:શાસ્ત્ર, અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર), નાટ્યશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, કામશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, સ્થાપત્ય, મુદ્રાશાસ્ત્ર, વૈદ્યક, પાકશાસ્ત્ર, વિજ્ઞાન અને નીતિશાસ્ત્ર.

આ બધાં શાસ્ત્રો લાક્ષણિક સાહિત્યનાં અંગો ગણાય છે. એને અંગ્રેજીમાં "Technical Sciences" કહે છે.

P-૧૮ સમગ્ર સાહિત્યમાંથી સાર્વજનીન સાહિત્ય બાદ કરતાં બાકી જે રહે તેને મેં અસાર્વજનીન કે એકદેશીય કે સાંપ્રદાયિક ન કહેતાં 'ધાર્મિક' કહ્યું છે. 'સાંપ્રદાયિક' એવો પ્રયોગ ખોટો નથી, પણ કેટલાકને એમાં અન્ય પ્રકારની ગંધ આવે છે. એથી મેં એ જતો કર્યો છે. ધાર્મિક સાહિત્યમાં પ્રાયઃ વિષયની મહત્તાની અપેક્ષાએ એમાં એના લેખકની ધર્મભાવનાનું વર્ચસ્વ વિશેષ હોય છે. એ લેખકને જે ધર્મ પ્રિય છે- આત્મોત્થાતિ માટે એને જે માર્ગનું દર્શન કરાવવું ઉચિત જણાયું છે તે માર્ગને સચોટ રીતે રજૂ કરવાની એની પ્રબળવૃત્તિ હોય છે. આમ એ સાહિત્યધાર્મિક છે એટલે એ સર્વદેશીય નહિ પણ એકદેશીય છે અને સાંપ્રદાયિક છે, કેમકે ભિન્ન વાતાવરણમાં ઉછરેલા અને અન્ય માર્ગે મુક્તિ મેળવવાનો મનોરથ સેવનારને જૈનમાર્ગ રુચિકર ન જણાય તો તેમાં નવાઈ નહિ.

આ "ધાર્મિક સાહિત્ય" નામના દ્વિતીયખંડના મેં ચાર ઉપખંડ પાડ્યા છે. (૧) લલિત સાહિત્ય(Belles-Lettres), (૨) દાર્શનિક સાહિત્ય, (૩) અનુષ્ઠાનાત્મક સાહિત્ય અને (૪) અવશિષ્ટ સાહિત્ય. અન્ય રીતે વિચારતાં સમગ્ર "ધાર્મિક સાહિત્ય"ના નવ વર્ગો પાડી શકાય.

(૧) શ્રવ્ય કાવ્યો, (૨) દૃશ્ય કાવ્યો (નાટકો ઇત્યાદિ), (૩) ઐતિહાસિક સાહિત્ય, (૪) દાર્શનિક સાહિત્ય, (૫) ઔપદેશિક (Didactic) સાહિત્ય, (૬) આધ્યાત્મિક સાહિત્ય, (૭) મંત્રશાસ્ત્ર અને કલ્પ, (૮) વિધિવિધાન (ક્રિયાકાંડ) અને (૯) પ્રકીર્ણક.

અહીં 'શ્રવ્ય' કાવ્યોથી જિનચરિત્રો, પુરાણો અને અન્ય મહાકાવ્યો, દ્વયાશ્રય-કાવ્યો, અનેકસંધાન-કાવ્યો, લઘુ-કાવ્યો, ખંડ-કાવ્યો, ચંપૂઓ અને સ્તુતિસ્તોત્રો તેમજ કથાઓ, ચરિત્રો અને પ્રબંધો સમજવાનાં છે.

ઐતિહાસિક સાહિત્યમાં ઐતિહાસિક પ્રબંધો અને વિજ્ઞાપિત્રો ઉપરાંત શિલાલેખો વગેરે ઐતિહાસિક સામગ્રીનો સમાવેશ કરાયો છે.

દાર્શનિક સાહિત્યથી ખાસ કરીને ન્યાય અને તત્ત્વજ્ઞાન (દર્શનમીમાંસા) એ બે અભિપ્રેત છે.

P-૨૦ સાહિત્યના (૧) લલિત અને (૨) લલિતેતર એમ પણ બે વિભાગ પડાય છે. તેમાં 'લલિત' સાહિત્યથી શ્રવ્ય અને દૃશ્ય કાવ્યો, વાર્તાઓ ઇત્યાદિ સમજવાનાં છે, જ્યારે લલિતેતર સાહિત્યથી

૧. વ્યાકરણ ઇત્યાદિ લાક્ષણિક સાહિત્ય ઉત્કીર્ણ સ્વરૂપે જણાતું નથી એથી એના ઉપખંડ પડાયા નથી.

૨. આ બે વિભાગ પાડી એના ઉપપ્રકારોની સમજણ શ્રી. ઇશ્વરલાલ, ૨. દવેએ રચેલો અને સને ૧૯૫૨માં પ્રકાશિત થયેલો ગુજરાતી સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (ભા. ૨, પૃ.૯) પૂરી પાડે છે.

૩. આમાં કથાઓ, ટુચકાઓ, નવલિકા, નવલકથા, મહાનવલ ઇત્યાદિનો સમાવેશ કરાય છે.

ઈતિહાસ, તત્ત્વચિંતન, બોધપ્રધાન સાહિત્ય, ભાષા-શાસ્ત્ર ઇત્યાદિ સમજવાનાં છે. લલિત સાહિત્યમાં રસ કેન્દ્ર સ્થાને હોય છે અને એ કલ્પના, ઊર્મિ, સૌંદર્ય ઇત્યાદિ તત્ત્વો વડે શોભે છે.

જૈનોને હાથે સર્જાયેલા સંસ્કૃત સાહિત્યની વિશાળતાનો મને પૂરેપૂરો ખ્યાલ નહિ હોવાથી અને એવો ખ્યાલ આપનારું કોઈ વિશિષ્ટ સાધન પણ નહિ જણાયાથી એકબાજુ આ સાહિત્યના ઇતિહાસનું કલેવર ધારવા કરતાં વધારે વધી ગયું એથી અને બીજી બાજુ આ પુસ્તક એક જ હમે અને તે પણ સત્વર પ્રકાશિત કરવાનો પ્રબંધ થઈ શકે તેમ ન હતું એથી પૃ.૧-૪૮ છપાઈ જતાં એ ત્રણ હમે પ્રસિદ્ધ કરવાનું નક્કી કરાયું અને એને લઈને “અજૈન કૃતિઓનાં જૈન વિવરણો” નામનું જે અંતિમ પ્રકરણ હતું તેને, ત્રણે પરિશિષ્ટોને તેમજ આ ઉપોદ્ધાતના ખાસ કરીને મૂલ્યાંકનરૂપ અંશને ત્રણ ભાગોમાં વિભક્ત કરવાની યોજના હાથ ધરાઈ. એ યોજના મુજબ પ્રસ્તુત પુસ્તક ત્રણ વિભાગમાં પ્રસિદ્ધ થનાર છે. ‘પ્રથમ વિભાગમાં “સાર્વજનીન સાહિત્ય” નામના પ્રથમ ખંડનો સર્વાંશે સમાવેશ કરાયો છે, બીજા વિભાગમાં “ધાર્મિક સાહિત્ય” નામના દ્વિતીયખંડના પ્રથમ ઉપખંડ નામે ‘લલિત સાહિત્ય’ને સ્થાન અપાયું છે, અને ત્રીજા (અંતિમ) વિભાગમાં એ ખંડના બાકીના ઉપખંડોને લગતું નિરૂપણ રજૂ કરાયું છે.

જૈનોના ‘શ્વેતાંબર’ અને ‘દિગંબર’ એ બે વિભાગો આજે પણ મોજુદ છે અને સુપ્રસિદ્ધ છે, પરંતુ એક વેળા ‘યાપનીય’ તરીકે ઓળખાવાતા જૈનો પણ હતા, એ ત્રણેના સાહિત્યનો પૃથક્ પૃથક્ પરિચય ન આપતાં એ ત્રણેના સાહિત્યનો એક સાથે સામટો સૈકાદીઠ મેં વિચાર કર્યો છે. શ્વેતાંબરોનો, યાપનીયોનો તેમજ દિગંબરોનો ફાળો કેટકેટલો છે એ સહેલાઈથી જુદો જાણી શકાય તે માટે મેં પરિશિષ્ટમાં એ રીતે નોંધ લીધી છે.

જૈનોએ જે જાતજાતના વિષય પરત્વે કૃતિઓ સંસ્કૃત ભાષામાં રચી છે. એના મુખ્ય બે વિભાગો પાડી શકાય. (૧) મૂળ કૃતિઓ અને (૨) વિવરણાત્મક કૃતિઓ. બીજા વિભાગના ચાર પેટાવિભાગો પડાય.

- (૧) જૈન સંસ્કૃતકૃતિઓ અંગેનાં સંસ્કૃત વિવરણો.
- (૨) જૈન પાઈયકૃતિઓ પરત્વેનાં સંસ્કૃત વિવરણો.
- (૩) અજૈન સંસ્કૃતકૃતિઓ ઉપરનાં સંસ્કૃત વિવરણો.
- (૪) અજૈન પાઈયકૃતિઓ પરત્વેનાં સંસ્કૃત વિવરણો.

આમ એકંદર પાંચ પ્રકારનું જે સંસ્કૃત સાહિત્ય જૈનોએ રચ્યું છે તેને કયા ક્રમે રજૂ કરવું એ પ્રશ્ન મને આ કાર્ય મેં સ્વીકાર્યું તેવામાં મૂંઝવતો હતો. એનું એક કારણ એ હતું કે જે અજૈન કૃતિઓ ઉપર જૈન વિવરણો મળે છે તે મૂળ પ્રકૃતિઓનો બપ પૂરતો પરિચય તો જરૂર જ આપવો એવી પ્રકાશન-સંસ્થા તરફથી મુનિશ્રી યશોવિજયજીએ દર્શાવેલી સબળ ઇચ્છાને મારે માન આપવાનું હતું.

૧. આને લઈને અંતિમ પ્રકરણનાં નિમ્નલિખિત ત્રણ પ્રકરણો પડાયાં છે

- (અ) અજૈન લાક્ષણિક સાહિત્યમાં જૈન સંસ્કૃત વિવરણો.
- (આ) અજૈન સાહિત્યમાં જૈન સંસ્કૃત વિવરણો.
- (ઇ) અજૈન દાર્શનિક સાહિત્યમાં જૈન સંસ્કૃત વિવરણો.

૨. વિચારો ગઉડવહની હરિપાલકૃત ટીકા અને સંનેહચરણ નામની મુસ્લિમ કૃતિના વિવરણો.

૪ (ભા.૧)

ઉપર્યુક્ત પાંચ પ્રકારના સાહિત્ય પૈકી પાઈય કૃતિનાં સંસ્કૃત વિવરણોરૂપ બે પ્રકારને બાજુએ રાખતાં બાકીના ત્રણના ક્રમને અંગે નીચે મુજબના ત્રણ માર્ગ મને સ્ફૂર્યા હતા.

P-૨૨

(૧) સૌથી પ્રથમ જૈન ગ્રન્થકારની મૂળ કૃતિનો પરિચય આપી સાથે સાથે જ એ વિષયની જે અજૈનકૃતિને લક્ષીને જે વિવરણાત્મક સાહિત્ય એમણે યોજ્યું હોય તેનો વિચાર કરવો અને એ રીતે પ્રત્યેક વિષયનું તે ગ્રન્થકાર પૂરતું સળંગ વક્તવ્ય રજૂ કરવું.

(૨) પ્રકરણના બે વિભાગો પાડી બીજા વિભાગમાં અજૈનકૃતિના વિવરણાત્મક સાહિત્યનો ઉલ્લેખ કરવો.

(૩) વિવિધ વિષયોને લગતી જે જે અજૈનકૃતિઓ ઉપર જૈન વિવરણો છે તેનો પુસ્તકનાં અંતમાં એક સામટો એક સ્વતન્ત્ર પ્રકરણરૂપે પૂર્વે ચર્ચાયેલા વિષયના ક્રમે વિચાર કરવો.

અહીં જે ત્રણ માર્ગ સૂચવાયા છે તે પૈકી પ્રથમ માર્ગ ગ્રહણ કરાય તો અજૈનકૃતિઓનો સંક્ષિપ્ત પરિચય તે સ્થળે આપવાની વાત તો જતી કરવી પડે. નહિ તો આ પુસ્તકની યોજના પાછળનો આશય યથાયોગ્ય સ્વરૂપે જળવાઈ ન રહે અને જૈનોનો અજૈનકૃતિઓને અંગે જે મહત્ત્વનો ફાળો છે તેનો ભાગ્યે જ ખ્યાલ આવે.

બીજો માર્ગ પસંદ કરાય તો તેમાં બે વાંધા આવે. (૧) કાલક્રમે વિષયની અખંડિતતા જળવાઈ ન રહે અને (૨) જૈનોનો અજૈનકૃતિઓને અંગેના ફાળાનો ખ્યાલ તો આવે પણ એ કટકે કટકે રજૂ થતો હોવાથી એનો એકદમ પરિપૂર્ણ ખ્યાલ ન આવે.

ત્રીજો માર્ગ સ્વીકારવાથી જૈનોનો ફાળો તો સમગ્રપણે જોવા જાણવાની તક મળે પરંતુ ‘જૈન’ અને ‘અજૈન’ એવા સાહિત્ય અંગે પણ ભેદો પડાય તેનું શું ? એવો પ્રશ્ન કોઈ ઉઠાવે. આનો ઉત્તર એ છે કે એ ભેદો તો સમગ્ર સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ લખનાર ન પાડે તો હજી ચાલે, પરંતુ પ્રસ્તુત પુસ્તકનું નામ જ અને ઉદ્દેશ કહી આપે છે તેમ એ બે ભેદો તો જૈનોના ફાળાના મૂલ્યાંકન અંગે જરૂરી જ છે એટલે પાડવા જ પડે. આમ આનું સમાધાન થઈ શકે એટલે પહેલા બે માર્ગ કરતાં આ ત્રીજો માર્ગ સમુચિત જણાય છે.

P-૨૩

આમ એક યા બીજી રીતની જે આપત્તિ ત્રણે માર્ગ માટે સૂચવી શકાય તેનો તોડ મેં એમ કાઢ્યો છે. કે કોઈપણ વિષયનો સળંગ પરિચય આપતી વેળા જે અજૈનકૃતિને અંગે વિવરણાત્મક સાહિત્ય હોય તેની તેના પ્રણેતાના ઉલ્લેખ વેળા નોંધ કરવી, પરંતુ મૂળકૃતિના નામોલ્લેખ ઉપરાંત એ વિષે વિશેષ કશું ત્યાં ન કહેતાં અજૈનકૃતિઓનાં જૈન સંસ્કૃત વિવરણોને અંગે લખાયેલ સ્વતન્ત્ર પ્રકરણ જોઈ લેવાની ભલામણ જરૂર જણાય તો ટિપ્પણ દ્વારા કરવી.

આ પુસ્તકમાં જે સાહિત્ય રજૂ થયું છે તેની ભાષાના સંસ્કૃત અને પાઈય એ બે ભેદને લઈને વિવરણોના બે પ્રકારો પડે છે. (૧) સંસ્કૃતકૃતિઓનાં સંસ્કૃત વિવરણો અને (૨) પાઈયકૃતિઓનાં સંસ્કૃત વિવરણો. આ બંનેનું નિરૂપણ ભેગું આપવું કે કેમ એ પ્રશ્ન પણ પ્રસ્તુત પુસ્તકની યોજના વિચારતાં ઉપસ્થિત થયો હતો. એનો તોડ મેં એવો કાઢ્યો છે કે બંનેને પૃથક્સ્થાન આપવું જેથી ચંદ્રર્ષિ અને શીલાંકસૂરિ જેવાને એ દ્વારા સ્થાન મળી રહે, કેમકે આ સૂરિઓની એકે સંસ્કૃત સ્વતંત્ર રચના કે સંસ્કૃત ગ્રન્થના વિવરણરૂપ રચના હજી સુધી તો મળી આવી નથી. આને લઈને “જૈન

પાઈયકૃતિઓનાં સંસ્કૃત વિવરણો” એ નામથી મેં એક પૃથક્ પ્રકરણ રચ્યું છે, અને એ વિવરણોનો ઉલ્લેખ પૂર્વેનાં પ્રકરણોમાં યથાસ્થાન તે તે પાઈયકૃતિઓના વિવરણકારનો સૈકો વિચારતી વેળા શક્ય હતું ત્યાં કર્યો છે. જૈનોનાં સંસ્કૃત વિવરણોથી વિભૂષિત અજૈન પાઈયકૃતિઓ ગણીગાંઠી છે, અને તે પણ કાવ્યોને અંગેની જ હોય એમ લાગે છે. આથી એને માટે સ્વતંત્ર પ્રકરણ ન યોજતાં મેં “અજૈન ‘લલિત’-સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો” નામના પ્રકરણમાં એનો સમાવેશ કર્યો છે. સંસ્કૃત કાવ્યોનો વિષય પૂર્ણ થતાં એના પછી અને સ્થાન આપ્યું છે.

આ પુસ્તકનો વિષય જૈન સંસ્કૃત સાહિત્ય છે એટલે એમાં સમસંસ્કૃત કૃતિઓનું નિરૂપણ તો હોય જ અને છે, પરંતુ એવી પણ કેટલીક જૈનકૃતિઓ છે કે જે સંપૂર્ણતયા સંસ્કૃતમાં નથી. આવી કૃતિઓમાં (૧) અર્ધસંસ્કૃત, (૨) સંસ્કૃત વગેરે અનેક (બે કરતાં વધારે) ભાષાઓમાં રચાયેલી કૃતિઓ એટલે કે અનેકભાષાત્મક (Poly-glott) કૃતિઓ, (૩) ચૂણિઓ અને (૪) મુખ્યતયા પાઈયમાં રચાયેલી પરંતુ કોઈ કોઈવાર-સંસ્કૃતિમાં કંડિકાઓ રજૂ કરતી કૃતિઓનો-ધવલા વગેરેનો સમાવેશ થાય છે. આ ચારે જાતની કૃતિઓ પૈકી છેલ્લી બે જાતની કૃતિઓને મેં અહીં સ્થાન આપ્યું નથી. જ્યારે પહેલી બેના વિચાર માટે મેં સ્વતંત્ર પ્રકરણ ન યોજતાં એનો યથાસ્થાન નિર્દેશ કર્યો છે, કેમકે એની સંખ્યા અલ્પ છે અને એનો સંબંધ કાવ્યો સાથે-મુખ્યતયા સ્તુતિસ્તોત્રો સાથે છે. તેમ છતાં આની એક સળંગ નોંધ હોય તો સારું એમ વિચારી સમસંસ્કૃત અર્ધસંસ્કૃત અને અનેકભાષાત્મક કૃતિઓની ક્રમવાર સૂચી બીજા વિભાગમાં મેં આપી છે.

P-૨૪

લલિત સાહિત્યના નિરૂપણને અંગે મને જે ચાર પ્રશ્નો સ્ફૂર્્યા હતા અને એનો મેં જે તોડ કાઢ્યો હતો તે બાબતને પ્રસ્તુત પુસ્તક ત્રણ વિભાગમાં પ્રસિદ્ધ કરવાનું નક્કી થતાં મેં અહીંથી જતી કરી દ્વિતીય વિભાગના ઉપોદ્ઘાતમાં સ્થાન આપ્યું છે.

સાધ્ય અને સાધન— સાહિત્યની સૃષ્ટિનાં બે મુખ્ય અંગ છે. (૧) સાહિત્યનું સર્જન અને (૨) એને માટેના આવશ્યક બોધની સામગ્રી. આમાં સામગ્રીરૂપ સાહિત્યને એક રીતે સાધ્યની કોટિમાં મૂકી શકાય તો બીજી રીતે વિચારતાં એને સાધનની કોટિમાં સ્થાન અપાય. આથી એમ કહી શકાય કે વ્યાકરણ, કોશ, છંદ અને અલંકારને અંગેના ગ્રન્થો એ સાધ્ય તેમજ સાધન બંનેની ગરજ સારે છે અને તેમ હોવાથી-એ સાધનરૂપ હોવાથી પ્રસ્તુત સાહિત્યના ઇતિહાસમાં મેં એનાથી શરૂઆત કરી છે.

P-૨૫

‘વિજ્ઞાન’ નામના પંદરમાં પ્રકરણમાં વિવિધ વિષયોને લગતી કૃતિઓ આપતી વેળા મેં વિષયની પ્રાયઃ મહત્તા કે વ્યાપકતાને લક્ષ્યમાં રાખી વિષયોનો ક્રમ ગોઠવ્યો છે અને એ ક્રમ લક્ષ્યને કાલક્રમ રાખ્યો છે. એમાં મેં એક જ વિષયની કૃતિઓનો એકસાથે પરિચય આપ્યો છે.

સત્તરમાં (અંતિમ) પ્રકરણમાં વ્યાકરણના સૂત્રોથી ગર્ભિતકૃતિઓને તેમજ અમરકોશના આદ્ય પદ્યની પૂર્તિરૂપ કૃતિને પણ મેં સ્થાન આપ્યું છે, જો કે આ કૃતિઓ તે તે મૂળ અજૈન ગ્રન્થોનાં વિવરણરૂપ નથી. આનાં ત્રણ કારણ છે.

(૧) આ પ્રકારની કૃતિઓની સંખ્યા ગણીગાંઠી છે.

(૨) આ કૃતિઓનું પરિમાણ અલ્પ છે.

૧. આ જાતની કૃતિઓની નોંધ મેં પાઈય (પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય (પૂ.૨૧૫-૨૧૮)માં લીધી છે.

(૩) આ કૃતિઓ કંઈ કોઈ લલિત કાવ્યની પાદપૂર્તિરૂપ નથી કે જેથી એ સાહિત્યના નિરૂપણના પ્રસંગે એનો વિચાર કરી શકાય.

દ્વયાશ્રય-કાવ્ય— કેટલાક જૈન ગ્રંથકારોએ ભટ્ટિકાવ્યની જેમ ‘દ્વયાશ્રય-કાવ્ય’ રચ્યાં છે અને એ દ્વારા વ્યાકરણના વિષયને સ્થાન આપ્યું છે. આ પરિસ્થિતિમાં એ પ્રશ્ન કોઈ ઉઠાવે કે આ પુસ્તકના ત્રીજા પ્રકરણમાં ‘કલિંકાલસર્વજ્ઞ’ હેમચન્દ્રસૂરિકૃત દ્વયાશ્રયકાવ્યને અને સત્તરમાં પ્રકરણમાં જિન્મભસૂરિકૃત દ્વયાશ્રયકાવ્યને કેમ સ્થાન અપાયું નથી? આનો ઉત્તર એ છે કે આ જાતનાં કાવ્યોમાં વ્યાકરણ ઉપરાંત કાવ્યતત્ત્વ પણ અગ્રસ્થાન ભોગવે છે એટલે એકીવખતે તો ગમે તે એકને જ પ્રાધાન્ય આપી એનો પરિચય આપી શકાય. વિશેષમાં આ કૃતિઓનાં નામમાં ‘કાવ્ય’ એવો અંશ જોડી એનો જેમ વ્યવહાર કરાય છે તેમ વ્યાકરણ જોડીને કરાતો નથી. વળી કાવ્યોના પરિચય માટે દ્વિતીયખંડનો પ્રથમ ઉપખંડ છે જ એટલે અહીં એ દ્વયાશ્રય-કાવ્યોનો પરિચય આપ્યો નથી. તેમ છતાં જો આ ન્યૂનતા જ જણાતી હોય તો આ ઉપોદ્ઘાત દ્વારા એની હું નોંધ તો લઉં છું.

ત્રેવિધગોષ્ઠી— આ કૃતિ વ્યાકરણ, છંદ, કાવ્યશાસ્ત્ર અને તર્ક એમ ચાર વિષયોને સ્પર્શે છે એટલે એનો પરિચય અહીં કે દ્વિતીયખંડના દ્વિતીયઉપખંડમાં આપી શકાય. આ બે વિકલ્પમાંથી મેં બીજો વિકલ્પ સ્વીકાર્યો છે, કેમકે આ કૃતિમાં તત્ત્વનું-દેવ, ગુરુ અને ધર્મના સ્વરૂપનું નિરૂપણ સૌથી વધારે પ્રમાણમાં છે. તેમ છતાં બાકીના ત્રણ વિષયની સંક્ષિપ્ત રૂપરેખા તો પૃ. ૩૦૧-૩૦૨, ૩૦૪ અને ૩૦૫-૩૦૬ મેં આલેખી છે.

કૃતિઓના પરિચયની પદ્ધતિ— આ પુસ્તકમાં મેં જે વિવિધ કૃતિઓનો પરિચય આપ્યો છે તેમાં સ્વતન્ત્ર જૈનકૃતિનો પરિચય આપતી વેળા મેં સૌથી પ્રથમ એનાં નામાંતર હોય તો તે સાથે સાથે દર્શાવી એના રચના સમયનો-એના ગ્રંથકારે નિર્દેશેલા કે કામચલાઉ અનુમનાયેલા સમયનો ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ એના કર્તાનું નામ મળતું હોય તો તેનો નિર્દેશ કરી એમના ગુરુ વગેરેની અને સાંસારિક સંબંધી માહિતી જાણવામાં હોય તો તેની તેમજ એમની અન્ય કૃતિની નોંધ લીધી છે. અમુક અમુક ગ્રંથકારની કૃતિઓની સંખ્યા ઘણી મોટી હોય એવે પ્રસંગે મેં એ કૃતિઓનાં નામ ગણાવ્યાં નથી, કેમકે તેમ કરવા જતાં એ પૈકી જેટલી કૃતિઓ પ્રકાશિત થયેલી હોય તેની નોંધ મારે મેં સ્વીકારેલી પદ્ધતિ અનુસાર ટિપ્પણીમાં કરવી પડે અને એમ કરવા જતાં તો ગ્રંથના મૂળ લખાણ અને ટિપ્પણીનું સમતોલપણું જળવાઈ ન રહે.

ગ્રંથકાર વિષે પરિચય આપ્યા બાદ એની પ્રસ્તુત કૃતિના બાહ્ય કલેવરનો-એના શાબ્દિક

૧. આ સિદ્ધહેમચંદ્ર નામના વ્યાકરણમાંના સંસ્કૃત અને પાઈય ભાષાને લગતા નિયમો ઉપર પ્રકાશ પાડે છે. સાથે સાથે એ [મૂલરાજથી માંડી] ‘પરમાર્હત’ કુમારપાલને અંગે માહિતી પૂરી પાડે છે.
૨. આ કાતંત્ર વ્યાકરણની દુર્ગસિંહે રચેલી વૃત્તિના સ્પષ્ટીકરણની ગરજ સારે છે. એમાં શ્રેણિકનરેશ્વરનું ચરિત્ર આલેખાયું છે.
૩. નામ અને ભાષા એ પણ શાબ્દિક સ્વરૂપનાં અંગ છે.

સ્વરૂપનો એટલે કે એનાં પરિમાણ, વિભાગ અને રચના-શૈલીનો અને ત્યાર પછી એના આંતરિક કલેવરનો-આર્થિક સ્વરૂપનો અર્થાત્ એનાં વિષય, સંતુલન વિવરણ ઇત્યાદિનો મેં વિચાર કર્યો છે.

વિવરણાત્મક સાહિત્યનો મૂળકૃતિ સાથે ઘણો ગાઢ સંબંધ હોવાથી મૂળકૃતિની સાથે સાથે જ, નહિ કે કાલાનુક્રમે પૃથક્ વિચાર કરાયો છે.

ટિપ્પણમાં પ્રકાશનને અંગે અને સાક્ષીરૂપે કંઈ લખાણ હોય તો તેનાં નામ, સ્થળ ઇત્યાદિ વિષે મેં નોંધ લીધી છે.

પ્રકાશનો— કેટલાક જૈન ગ્રંથ એક જ વ્યક્તિ કે સંસ્થાતરફથી ફરી ફરીને પ્રકાશિત કરાયા છે તો કેટલાક જૈન ગ્રંથનાં સંસ્કરણોના પ્રકાશક ભિન્ન-ભિન્ન છે. આમ જે કેટલાક ગ્રંથ એક કરતાં વધારે વાર છપાયા છે એ દરેકની નોંધ કરવા માટે તે તે પ્રકાશન જોવા જાણવા મળે તેમ નહિ હોવાથી તેમજ આ પુસ્તકની મર્યાદા ઇત્યાદિ જોતાં એની આવશ્યકતા પણ નહિ જણાયાથી ઘણી ખરી વાર કોઈ એક જ પ્રકાશનની નોંધ લઈ મેં સંતોષ માન્યો છે. કેટલાક ગ્રંથો પ્રકાશિત હોવા છતાં તેના પ્રકાશકાદિનો ઉલ્લેખ અહીં ન થયો હોય એમ બનવા જોગ છે, કેમકે મુદ્રિત જૈન ગ્રંથોનું વિગતવાર અદ્યતન સૂચીપત્ર પ્રસિદ્ધ કરાયું હોય એમ જણાતું નથી એટલું જ નહિ, પણ કેટલીયે જૈન સંસ્થાઓએ પોતપોતાનાં સૂચીપત્રો પણ સાહિત્યના ઇતિહાસ માટે કામ લાગે એવાં પ્રકાશિત કરેલાં જણાતાં નથી. આ પરિસ્થિતિમાં નિમ્નલિખિત પુસ્તકોની હું નોંધ લઉં છું.

P-૨૮

(૧) *Essai de Bibliographie Jaina* આ ફ્રેન્ચ કૃતિના રચનાર ડૉ. એ. ગેરિનો (Guerinot) છે. એમાં ઇ. સ. ૧૮૮૫ સુધીમાં છપાયેલાં જૈન પુસ્તકોની માહિતી અપાઈ છે.

(૨) 'શ્રીશ્વેતાંબરીય જૈનગ્રંથ માર્ગદર્શક (જૈન ગ્રંથગાઈડ)-આની યોજના શ્રીવિજયાનન્દસૂરિજી (આત્મરામજી મહારાજ)ના શિષ્ય ઉપાધ્યાય વીરવિજયજીના શિષ્ય વિનયવિજયજીએ કરી છે. એમાં એમણે ૫૫ ગ્રંથોનો પરિચય આપ્યો છે અને એમાં આલેખાયેલા લગભગ ૪૭૫ વિષયોનો એમણે ઉલ્લેખ કર્યો છે. વળી એમણે ગ્રંથના કર્તા, પ્રકાશન, પ્રકાશનસ્થળ ઇત્યાદિની પણ નોંધ લીધી છે.

(૩) મુદ્રિત જૈન શ્વેતાંબરાદિ ગ્રંથ નામાવલિ (ગાઈડ)-આના યોજક શ્રીવર્ધમાન સ્વરૂપચંદ છે. આ કૃતિમાં સંસ્કૃત, પાઈય, ગુજરાતી વગેરે ભાષામાં રચાયેલાં ત્રણેકહજાર પુસ્તકોની અને કેટલાક નકશાની નોંધ છે. વિશેષમાં ડૉ. ગેરિનોના ઉપર્યુક્ત પુસ્તકમાં જે ગ્રંથકારો અને ગ્રંથોનો ઉલ્લેખ છે તે બંનેની અલગ અલગ સૂચી અપાઈ છે. આ ઉપરાંત એ ફ્રેન્ચ વિદ્વાનની કૃતિ નામે *Repertoire de Epigraphie Jaina* આધારે કયા નગર કે ગામના કેટલા શિલાલેખ ઇ. સ. ૧૮૮૫ સુધીમાં છપાયા છે તેની અહીં નોંધ લેવાઈ છે.

૧. આ કૃતિ "જૈન આત્મનન્દ સભા" એ ભાવનગરથી ઇ. સ. ૧૯૧૪માં પ્રસિદ્ધ કરી છે.

૨. આ કૌસગત લખાણ મૂળ લેખકનું છે, મારું નથી.

૩. આ કૃતિ "શ્રીમદ્ બુદ્ધિસાગર ગ્રંથમાલા"ના ગ્રંથાંક ૧૦૬ તરીકે "અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડલ" તરફથી ઇ. સ. ૧૯૨૬માં પ્રકાશિત કરાઈ છે.

૪. આ કૌસગત લખાણ મૂળ લેખકનું છે.

P-૨૯

(૪) Jinaratnakos'a [An Alphabetical Register of Jaina Works & Authors] (Vol. 1) આ પુસ્તક પ્રો. હરિ દામોદર વેલણકરે અંગ્રેજીમાં રચ્યું છે. એમાં એમણે જૈનોના મુખ્યત્વે સંસ્કૃત અને પાઈયમાં રચાયેલા પ્રકાશિત તેમજ અપ્રકાશિત ગ્રંથોની અકારાદિ ક્રમે નોંધ લીધી છે. પ્રકાશિત ગ્રંથો માટે પ્રકાશકના નામ, પ્રકાશનવર્ષ ઇત્યાદિનો અને અપ્રકાશિત ગ્રંથોની હાથપોથીઓ માટે ભંડારોનો એમણે ઉલ્લેખ કર્યો છે.

માનાર્થ પ્રયોગ— આજથી સોએક વર્ષ પૂર્વે થઈ ગયેલા ગ્રંથકારો, રાજમહારાજાઓ વગેરેને અંગે કેટલાક વિદ્વાનો તરફથી સામાન્ય રીતે એકવચનનો પ્રયોગ કરાતો જોવાય છે. મેં ગ્રંથકારો પૂરતી તો આ પ્રથા અપનાવી નથી અર્થાત્ એમને વિષે મેં માનાર્થે બહુવચનનો પ્રયોગ કર્યો છે અને એ દ્વારા મેં એમના પ્રત્યેનો મારો આદર તેમજ એમની કૃતિ પ્રત્યેનો મારો અનુરાગ વ્યક્ત કર્યો છે.

P-30

આધુનિક શ્રમણવર્ગ મોટે ભાગે જૈન મુનિવરોનાં નામ આગળ ‘શ્રી’ શબ્દ યોજે છે.^૧ આ સંબંધમાં મેં આ શબ્દ વિદ્યમાન તેમજ આજથી લગભગ અડધા સૈકાની અંદર કાલધર્મ પામેલા મુનિવરો માટે યોજ્યો છે. બાકી એથી પ્રાચીન મુનિવરોનો નિર્દેશ કરતી વેળા મેં એ શબ્દ વાપર્યો નથી. તેમ છતાં એમને અંગેનું મારું બહુમાન એક યા બીજી રીતે દર્શાવવા મેં પ્રયાસ કર્યો છે.

‘શ્રી’— કેટલીવાર મુનિવરોનાં નામમાં ‘શ્રી’ એ માનાર્થક શબ્દ નહિ હોઈ એમના અંશરૂપે એ જોવાય છે. જેમકે શ્રીચંદ્ર. આજે એનો એ પ્રમાણે નિર્ણય કરવામાં કોઈ કોઈવાર મુશ્કેલી નડે છે એટલે આવા સંયોગમાં ‘શ્રી’ શબ્દ નહિ વાપરવાનો મારો નમ્ર મત આવકાર્ય ગણાશે.

આ પુસ્તકને બંને તેટલે અંશે પરિપૂર્ણ અને ઉપયોગી બનાવવાના હેતુથી મેં ત્રણ પરિશિષ્ટો આપ્યાં છે. (૧) ગ્રંથકારોની સૂચી, (૨) ગ્રંથોની અને લેખોની સૂચી અને (૩) પ્રકીર્ણક વિશેષ નામોની સૂચી, પ્રથમ સૂચીને મેં ત્રણ વર્ગમાં વિભક્ત કરી છે. (અ) શ્વેતાંબર અને યાપનીય, (આ) દિગંબર અને (ઇ) અજૈન. બીજી સૂચી માટે પણ આ પદ્ધતિ મેં સ્વીકારી છે. ત્રીજી સૂચીમાં તીર્થંકરોનાં, જાતજાતના સંપ્રદાયનાં, અનુયાયીઓનાં, મુનિવરોનાં, ગચ્છોનાં, નૃપાદિક ગૃહસ્થોનાં, બિરુદોનાં, ભૌગોલિક સ્થળોનાં, સંપાદકોનાં, પ્રકાશકોનાં, પ્રકાશન-સંસ્થાઓનાં, સામયિકોનાં, સંસ્કૃતભાષાના કેટલાક પ્રકારોનાં પ્રકાશકોનાં, તેમજ કેટલીક સંસ્કૃતેતર ભાષાઓનાં નામ અપાયાં છે. વિશેષમાં વીરસંવત્ અને શકસંવત્ એ બે સંવતોની તેમજ ભારતની આધુનિક પ્રાદેશિક ભાષાઓમાં તથા વિદેશી ભાષાઓમાં રચાયેલાં ભાષાંતર (અનુવાદ) અને રૂપાંતરોની તેમજ પ્રસ્તાવનાની નોંધ આ પરિશિષ્ટમાં મેં લીધી છે.

‘યાપનીય’ સંપ્રદાયના ગ્રંથકારો અને ગ્રંથોની નોંધ બીજા બેની જેમ સ્વતંત્ર રીતે ન લેતાં મેં

૧. આ પુસ્તકનો પ્રથમ ખંડ (વિભાગ) “ભા. પ્રા. સં. મં.” તરફથી “Government Oriental Series Class C No. 4” તરીકે પૂનાથી ઇ. સ. ૧૯૪૪માં પ્રસિદ્ધ કરાયો છે. બીજો વિભાગ હજી સુધી અપ્રકાશિત છે.

કન્ડમાં રચાયેલા જૈન ગ્રંથોની-ખાસ કરીને એના પ્રજ્ઞેતાઓની નોંધ આર. નરસિંહાચાર્યે કર્ણાટકકવિચરિતમાં ત્રણ વિભાગમાં લીધી છે. એ બેંગ્લોરથી ઇ. સ. ૧૯૨૪ અને ત્યાર પછી પ્રકાશિત થયા છે.

૨. આ કૌસગત લખાણ મૂળ લેખકનું છે.

૩ કેટલીક વાર કૃતિઓનાં અને પ્રકાશકસંસ્થાઓનાં નામ આગળ પણ “શ્રી શબ્દનો વ્યવહાર કરાયેલો જોવાય છે પણ મેં એની સ્વતંત્ર નોંધ લેતી વેળા “શ્રી” શબ્દ ત્યાંથી જતો કરી એને પાછળ સ્થાન આપ્યું છે.

શ્વેતાંબરની સાથે સાથે લીધી છે, કેમકે એક તો એ સંપ્રદાયની કૃતિઓ અલ્પ પ્રમાણમાં છે અને બીજું એનાં મંતવ્યોનો જોક શ્વેતાંબરીય સિદ્ધાન્ત તરફનો છે.

શ્વેતાંબર ગ્રંથકારો પૈકી મુનિવરોનાં નામ પ્રથમ પરિશિષ્ટમાં આપતી વેળા મેં કૌંસમાં યથાશક્ય એમના ગચ્છનો નિર્દેશ કર્યો છે. આમ કરવાનું કારણ એ છે કે ગચ્છદીઠ ફાળાની તારવણી કરવી હોય તો તે સુગમ થઈ પડે.

P-૩૧

અભારતીય નામો ગુજરાતીમાં દર્શાવતી વેળા મેં એના શુદ્ધ ઉચ્ચાર જાણવાની તક મળે એ માટે અંગ્રેજી જોડણી પણ આપી છે.

“જૈન ગ્રંથ”થી અત્ર ત્રણ પ્રકારના ગ્રંથ અભિપ્રેત છે.

- (૧) જૈના કર્તા જૈન હોય અને જૈનો વિષય જૈનધર્મ કે સાહિત્ય હોય..
- (૨) જૈના કર્તા જૈન હોય પરંતુ જૈની રચના અજૈન કૃતિને ઉદ્દેશીને હોય. પછી એ લખાણ એ મૂળ (અજૈન) કૃતિના વિવરણ, અનુવાદ, સારાંશ કે પરિચયરૂપે હોય.
- (૩) જૈના લેખક અજૈન હોય પરંતુ વિષય જૈનધર્મ કે સાહિત્યને લગતો હોય.

આ વિવક્ષાને લક્ષ્યમાં લેતાં અને શ્વેતાંબરત્વને પ્રાધાન્ય આપતાં નીચેની હકીકત ફલિત થાય છે.

- (૧) લેખક શ્વેતાંબર હોય અને લખાણ શ્વેતાંબર મંતવ્યને અનનુસરતું હોય તો તે લખાણ ‘શ્વેતાંબરકૃતિ’ ગણાય.
- (૨) લેખક દિગંબર હોય અને લખાણ દિગંબર મતને અનુરૂપ હોય તો તે લખાણ ‘દિગંબરકૃતિ’ ગણાય.
- (૩) લેખક અજૈન હોય અને વિષય પણ અજૈન સંપ્રદાય અનુસાર હોય તો તે ‘અજૈનકૃતિ’ ગણાય.
- (૪-૫) લેખક શ્વેતાંબર હોય અને લખાણ દિગંબર કે અજૈનકૃતિને લગતું હોય તો તે ‘શ્વેતાંબરકૃતિ’ ગણાય. જેમકે અષ્ટસહસ્રીવિવરણ અને રઘુવંશની ટીકા.
- (૬) લેખક અજૈન કે દિગંબર હોય પણ લખાણ શ્વેતાંબર મંતવ્ય કે સાહિત્યને લગતું હોય તો તે ‘શ્વેતાંબરકૃતિ’ ગણાય. દા. ત. જિનરત્નકોશ અને મણિ.

P-૩૨

ગ્રંથકાર અથવા ગ્રંથ જૈન છે કે અજૈન એનો નિર્ણય જ્યાં થઈ શક્યો નથી એવા પ્રસંગે એનો ‘જૈન’ તરીકે કામચલાઉ નિર્દેશ કર્યો છે. એવી રીતે જ્યાં શ્વેતાંબર કે દિગંબર વિષે અંતિમ નિર્ણય થઈ શક્યો નથી ત્યાં તેને શ્વેતાંબર ગણી લઈ નિર્દેશ કરાયો છે.

નામોનો વિનિમય— ગ્રંથકારોનાં અને ગ્રંથોનાં નામોની સંપ્રદાયદીઠ તારવણી કરવા માટે પૂરતાં સાધનો મને નહિ મળવાથી એ બનવા જોગ છે કે જે કેટલાંક નામોને મેં જૈન તરીકે નોંધ્યાં હોય તે ખરી રીતે અજૈનનાં હોય અને એવી રીતે શ્વેતાંબર અને દિગંબર નામો માટે પણ બનવા પામ્યું હોય. આ પરિસ્થિતિમાં નામોની જે ફેરબદલી કરવાની રહે છે તે સૂચવવાનું કાર્ય હાલ તુરત તો હું સાધનસંપન્ન સુજ્ઞજનોને ભળાવું છું.

અકારાદિ ક્રમ— પરિશિષ્ટોમાં અંગ્રેજી વગેરે વિદેશી ભાષામાં લખાયેલાં નામો સિવાયનાં

૧. આ નામો ગુજરાતી અને હિન્દીમાં નિર્દેશાયેલાં નામ પછી રોમન લિપિમાં તે તે પરિશિષ્ટના અંતમાં અપાયાં છે.

નામો નાગરી લિપિ અનુસાર અકારાદિ ક્રમે મેં આપ્યાં છે. તેમ કરતી વેળા સંસ્કૃત-અંગ્રેજી અને સંસ્કૃત-ગુજરાતી જેવા કોશોમાં દષ્ટિગોચર થતી પદ્ધતિ મેં સ્વીકારી છે અને એથી સાર્થ ગુજરાતી જોડણીકોશ જેવોમાં અકારાદિ ક્રમ માટે અપનાવાયેલી પદ્ધતિથી અંશતઃ અને જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં અનુસારાયેલી પદ્ધતિથી અધિક પ્રમાણમાં ભિન્નતા રહે છે.

P-૩૩

અટકને પ્રાધાન્ય— આધુનિક સમયના ગૃહસ્થોને તેમની અટક દ્વારા સંબોધવાની આજકાલ પ્રથા હોવાથી તેમજ કેટલાકનાં પૂરા નામ જાણવામાં નહિ હોવાથી મેં એમની નોંધ લેતી વેળા એમની અટકને અગ્રસ્થાન આપ્યું છે.

કેટલીક વ્યક્તિઓનાં નામ પ્રથમ પરિશિષ્ટમાં ('ગ્રંથકાર' તરીકે) તેમજ ત્રીજા પરિશિષ્ટમાં પણ અપાયાં છે. આમ આ નામ બેવડાવાનું કારણ એ છે કે વ્યક્તિનો ગ્રંથકાર તરીકે નિર્દેશ હોય ત્યારે એનું નામ એ નામાવલીમાં અને એ વ્યક્તિનો ઇતર સ્વરૂપે નિર્દેશ હોય ત્યારે એનું નામ ત્રીજા પરિશિષ્ટમાં આપવું સમુચિત હોવાથી મેં તેમ કર્યું છે. એક જ વાક્યમાં બંને જાતનો નિર્દેશ હોય તેવા પ્રસંગે પ્રાયઃ “ગ્રંથકાર” તરીકે જ નોંધ લીધી છે.

'સંસ્કૃત' શબ્દનો ઉલ્લેખ ત્રીજા પરિશિષ્ટમાં નથી. આનું કારણ એ છે કે આ સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ હોઈ એ નામ તો લગભગ પ્રત્યેક પૃષ્ઠ ઉપર સહજ આવે એટલે એ નોંધવાનો શો અર્થ ?

વિવરણોનાં વિશિષ્ટ નામો— સંસ્કૃત કે પાઈયમાં રચાયેલી કૃતિના સંસ્કૃતમાં કરાતા સ્પષ્ટીકરણને વિવિધ નામે ઓળખાવાય છે. જેમકે ટીકા, વૃત્તિ, વિવૃત્તિ, વિવરણ, વ્યાખ્યા અને બાલાવબોધ. આ પૈકી વૃત્તિ શબ્દ વૃત્ ધાતુ ઉપરથી તેમજ વિવૃત્તિ અને વિવરણ એ બે શબ્દો વૃ ધાતુ ઉપરથી ઉદ્ભવ્યા છે.

શબ્દાર્થ પૂરતા સંક્ષિપ્ત વિવેચનને 'અવચૂરિ' કે 'અવચૂર્ણિ' કહે છે. એને માટે 'અવચૂરિકા' અને 'અવચૂર્ણિકા' શબ્દ પણ વપરાય છે. 'ટિપ્પણી' અને 'ટિપ્પન' એ એના પર્યાય ગણાય છે.

P-૩૪

કેટલાક ટીકા રચનાર પોતાની ટીકાનો ટીકા જેવા સામાન્ય નામે ઉલ્લેખ ન કરતાં એનું વિશિષ્ટ નામ યોજે છે. આવી પ્રથાને લઈને કેટલાક ગ્રન્થનાં વિવરણોનાં વિશિષ્ટ નામ મળે છે. એથી એ વિવરણોની નોંધ મેં તે તે ગ્રન્થના પેટામાં ન લેતાં એનાં સ્વતન્ત્ર નામે જ કરી છે. વિશેષમાં આ વિવરણાત્મક ગ્રન્થ છે, નહિ કે મૌલિક એ દર્શાવવા મેં* (ફૂદડી) જેવા ચિહ્નથી એ નામ અંકિત કર્યું છે.

(આ) મૂલ્યાંકન

“નિવેદન” અંગે મારું વક્તવ્ય આગળ ચલાવું તે પૂર્વે “મૂલ્યાંકન”નો વિષય હવે હું હાથ ધરું છું. એ પૂર્ણ થતાં નિવેદનને લગતી બાકીની બાબત રજૂ કરીશ.

ગ્રંથપ્રણયનનો હેતુ— પ્રાચીન સમયના જૈન શ્રમણવર્ગોને 'ગ્રંથકાર' બનવાની કે કહેવડાવવાની

૧. આ પદ્ધતિ શાસ્ત્રીય નથી તેમજ સમુચિત પણ નથી એવું મારું નમ્ર મતવ્ય છે.

૨. હિન્દી ટીકાઓ-સ્પષ્ટીકરણને ભાષાટીકા, વચનિકા ઇત્યાદિ નામે ઓળખવાય છે.

૩. કેટલીકવાર 'વિવૃત્તિ' શબ્દ પણ વપરાયેલો જોવાય છે.

૪. સામાન્ય રીતે આ ગુજરાતીમાં હોય છે. એને 'ટબ્બો' પણ કહે છે.

જરા પે લાલસા હતી નહિ. એઓ તો પોતાના શિષ્યપરિવારને આત્મોત્તરિમાં સહાયક થઈ પડે એવો બોધ સચોટ કરાવવા માટે સદા ઉત્સુક રહેતા. આથી પુવ્વગય (પૂર્વગત)થી જે જે વિષયનું કાર્ય સરે તેમ હતું તે તે વિષયમાં એમણે તે તે ગ્રંથો પોતાના શિષ્યપરિવારના પઠન-પાઠન માટે પસંદ કર્યા અને એ દિશામાં નવીન ગ્રંથો સર્જવા એઓ લલચાયા નહિ, પરંતુ, આગળ જતાં આ સ્થિતિમાં ફેર પડ્યો. સાંપ્રદાયિક સ્પર્ધા જાગી અને અજૈનો તરફથી જૈનોની સાહિત્યિક સંપત્તિ વિષે ટકોર થતાં પ્રત્યેક વિષયને અંગે સ્વતંત્ર ગ્રંથ રચવાની એમને ફરજ પડી. એ પહેલાં એકંદર રીતે વિચારતાં એમ કહી શકાય કે જૈન દર્શનનાં મૂળભૂત મંતવ્યો વિષે ખોટા આક્ષેપો થવાથી અને ગેરસમજ ફેલાવાથી હોવાથી એના પ્રતિકારરૂપે જૈન શ્રમણોને તત્ત્વજ્ઞાન પરત્વે તાર્કિક દૃષ્ટિએ ગ્રંથો રચવા માટે કલમ હાથમાં ઝાલવી પડી હતી.

જૈન સાહિત્યના સર્જક શ્રમણોને ધન, કીર્તિ કે કહેવાતી સેવાની એષણા ન હતી. એમણે પરોપકારાર્થે અને કેટલીક વાર સાહિત્યના અનુરાગની ખાતર ગ્રંથો રચ્યા છે. એથી કરીને એમાં ગંભીરતા, સરળતા, સુબોધકતા અને સમુચિતતા આગળ તરી આવે છે.

P-3૫

જૈન સાહિત્યની વિશાળતા અને વિવિધતા— આજે જે જૈન સાહિત્ય ઉપલબ્ધ છે તે જોતાં એમ બેધડક કહી શકાય કે ભારતીય વાઙ્મયની વિવિધ શાખાને સમૃદ્ધ કરવા માટે ઈસવી સનની પહેલી સદીની શરૂઆતથી માંડીને તે આજ દિન સુધી પ્રાયઃ પ્રત્યેક શતાબ્દીમાં જૈનો તરફથી એક યા બીજા સ્વરૂપે ફાળો અપાયો છે. આ સંબંધમાં હું પ્રો. મોરિસ વિંતર્નિત્સ (Maurice Winternitz)ના જર્મન પુસ્તકના અંગ્રેજી અનુવાદ નામે A History of Indian Literature (Vol. II. p. 483)માંની નિમ્નલિખિત કંડિકા રજૂ છું.

"There is scarcely any province of Indian Literature in Which the Jains have not been able to hold their own. Above all, they have developed a voluminous narrative Literature, they have written epics & novels, they have composed dramas & hymns; sometimes they have written in the simple language of the people, at other times they have competed, in highly elaborate poems, with the best masters of ornate court poetry, & they have also produced important works of Scholarship."

મધ્ય યુગનો અંધકાર-પટ— શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ (ઈ.સ. પૂર્વે ૫૨૭) પછીની દસ શતાબ્દીઓ તેમજ છેલ્લી દસ શતાબ્દીઓને અંગે જૈનોની સામાજિક અને સાહિત્યિક પ્રવૃત્તિ ઉપર પણ પ્રકાશ પાડનારાં સાધનો સારા પ્રમાણમાં મળી આવ્યાં છે. એ બાદ કરતાં બાકીની શતાબ્દીઓ^૧ (ઈ.સ. ૪૭૩ ઈ. સ. ૯૫૬) ઉપર તો અંધકાર-પટ પથરાયો હોય એમ લાગે છે. આ લગભગ ૫૦૦ વર્ષનો વચગાળાનો સમય રાષ્ટ્રિય ઇતિહાસની દૃષ્ટિએ તો ખૂબ જાહોજલાલીવાળો જણાય છે. તેમ છતાં જૈન ધર્મની અને વિશેષતઃ તો શ્વેતાંબર સંપ્રદાયની સાહિત્ય અને સ્થાપત્ય

P-૩૬

૧. જુઓ પૃ. ૩૨-૩૩.

૨. Geschichte der Indischen Litteratur.

૩. ભારતવર્ષના ઇતિહાસમાં આ સમયને કેટલાક 'મધ્યયુગ' તરીકે ઓળખાવે છે.

પરત્વે શી સ્થિતિ હતી તે વિષે ચોક્કસ માહિતી યથેષ્ટ પ્રમાણમાં મળતી નથી એમ વિદ્વાનોનું કહેવું છે. એમ કહેવાય છે કે આ યુગના બે ચીની મુસાફરો પૈકી એકે દક્ષિણ ભારતના થોડાક દિગંબરો વિષે સૂચન કર્યું છે તેને બાજુએ રાખીએ તો સમગ્ર જૈન સમાજ, શ્રમણસુમદાય, સાહિત્ય કે સ્થાપત્ય વિષે ભાગ્યે જ કશી નોંધ લીધી છે.

ચૈત્યવાસીઓની માલિકીનાં જિનમંદિરોમાંથી ઉત્કીર્ણ સામગ્રી ભાગ્યે જ મળી શકે. કેટલાક પ્રાથમિક વિદેશી સંશોધકોએ કેટલાંયે જૈન સ્તૂપો, ગુફાઓ, પ્રતિમાઓ વગેરેને 'બૌદ્ધ'માની લેવાની ભૂલ કરી છે એમ વિન્સન્ટ સ્મિથ અને ડૉ. ફ્લીટ જેવાએ કહ્યું છે.

P-૩૭ **શ્રમણાદિનો ફાળો**— ઉપલબ્ધ જૈન સાહિત્ય જોતાં એમ ભાસે છે કે જૈન સાહિત્ય એ મુખ્યત્વે જૈન શ્રમણોએ-નિર્ણયોએ આ ક્ષેત્રમાં સેવેલા પરિશ્રમનું મનોરમ ફળ છે. જૈન ગૃહસ્થોનો-શ્રાવકવર્ગનો ફાળો પ્રમાણમાં અલ્પ છે. પુરુષ અને સ્ત્રી એમ બે જાતિનો વિચાર કરતાં દરેક દેશમાં જોવાય છે તેમ અહીં આપણા દેશમાં પણ લેખિકાઓની સંખ્યા ગણીગાંઠી છે. જૈન સાહિત્યના સર્જનમાં ભાગ્યે જ દસેક સ્ત્રીઓનો હિસ્સો હશે. પ્રથમ-આદર્શ તૈયાર કરનાર તરીકે પણ નારીઓની સંખ્યા ગણીગાંઠી જોવાય છે. એમાં ઉપમિતિભવપ્રપંચાકથાનો પ્રથમ-આદર્શ તૈયાર કરનાર ગણા સાધ્વી જેવી વિદ્વદ્ધી બહુ જ થોડી છે.

P-૩૮ **જૈન ગૃહસ્થોની કૃતિઓ**— જૈન ગૃહસ્થો એટલે ગર્વશ્રીમંત જ એમ નહિ. એમાંના ઘણા ખરાને તો આજીવિકા અર્થે-પોતાના કુટુંબ પરિવારના નિર્વાહ માટે પરિશ્રમ કરવાનો હોય. વળી અનેકવિધ સાંસારિક પ્રવૃત્તિઓમાં એમને ભાગ લેવાનો હોય. આને લઈને સાહિત્યની યથેષ્ટ ઉપાસના માટે-વિદ્યાવિલાસી જીવન જીવવા માટે-એમને પૂરતો સમય ક્યાંથી મળે? આ ઉપરાંત એઓ જે કૃતિ રચે તેના પ્રચાર માટે પણ એમને કોઈ ઉદાર દિલના ધનાઢ્યનો કે કોઈ રાજા જેવાનો આશ્રય લેવાનો રહે. વિશેષમાં એમણે રચેલી કૃતિ સચવાઈ રહે એવો પ્રબંધ પણ ભાગ્યે જ થઈ શકે. આવી પરિસ્થિતિમાં વિક્રમની ૧૮મી સદીની પૂર્વે થઈ ગયેલા જૈન ગૃહસ્થોએ રચેલી કૃતિઓ જે થોડીક પણ મળે છે તે આનંદનું ચિહ્ન ગણાય. આવી પાઈયકૃતિઓમાં કવિવર ધનપાલની પાઈયલચ્છી નામમાલા, ઉસભપંચાસિયા ઇત્યાદિ કૃતિઓ, ભાંડાગારિક નૈમિચ્દ્રે ૧૬૧ ગાથામાં રચેલું સંક્રિસયગપયરણ અને એમનું પાસનાહથોત અને ઠક્કર ફેરુની દવ્યપરિક્ષા, વત્થુસારપયરણ વગેરે કૃતિઓનો સમાવેશ થાય છે. સંસ્કૃતકૃતિઓ રચનારા તરીકે નીચે મુજબનાં નામ ગણાવી શકાય.

૧. જુઓ પ્રાચીન જૈન લેખસંગ્રહના દ્વિતીયવિભાગની પ્રસ્તાવના (પૃ.૧૧).
૨. યવનચંગ (Yuan Chwang) (હ્યુએન સંગ અને (Hien Tsang) ઇત્સિંગ.
૩. ચોતાંબરીય આગમિક સાહિત્ય આ સમયમાં સર્જાયું છે પણ અનાગમિક સાહિત્યનું શું ?
૪. આ સંબંધમાં 'દક્ષિણવિહારી' અમરવિજયજીના શિષ્ય સ્વ. ચતુરવિજયજીએ "જૈન ગૃહસ્થોની સાહિત્યસેવા" એ નામના લેખમાં વિસ્તારથી વિચાર કર્યો છે. આ લેખ "જૈન સત્યપ્રકાશ" (વ. ૭, અં. ૧-૩, પૃ. ૧૬૪-૧૭૪)માં છપાયો છે. એમાં પાર્થપરાક્રમવ્યાયોગ રચનાર પ્રહ્લાદનદેવનો ઉલ્લેખ છે તો શું તેઓ જૈન છે ? અક્ષાદને પાર્શ્વજિનસ્તોત્ર રચ્યાનો આ લેખમાં ઉલ્લેખ છે.
૫. એમના પુત્ર તે 'ખરતર' ગચ્છના જિનપતિસૂરિ પછી એ ગચ્છના નાયક બનેલા જિનેશ્વરસૂરિ (વિ. સં. ૧૨૪૫-વિ. સં. ૧૩૩૧) છે.
- ૬-૭. આ બે કૃતિઓ તેમજ આ નૈમિચ્દ્રે અપભ્રંશમાં રચેલું 'જિણવલ્લહસૂરિ-ગુરુગુણવજ્રણ' ધષ્ટિશતક પ્રકરણમાં છપાયો છે.

અનંતપાલ (દિ.), આજડ, આશાધર (દિ.), આસડ (શ્રીમાળી), *આક્ષાદ (મંત્રી), કુમારપાલ (નૃપતિ), ચંડપાલ (પોરવાડ વણિક), જગદેવ (પોરવાડ વણિક), જગદેવ (પોરવાડ વણિક), ઠક્કર કેરુ, દલપતિરાય, દુલભરાજ (જગદેવના પિતા), ધનદ (મંડન મંત્રીના કાકાના પુત્ર), ધનંજય (દિ.), ધનપાલ (વિપ્ર), ધર્મશ્રેષ્ઠી, નંદલાલ, નરપતિ, નેમિચંદ્ર, પદ્માનંદ, મંડન (મંત્રી શ્રીમાળી), મન્મથસિંહ, માધસિંહ, યશ:પાલ (મંત્રી, મોઢ), *યશોવીર (મંત્રી), વસ્તુપાલ (મહામાત્ય વણિક), વાગ્ભટ (બાહડ), વાગ્ભટ (દિ.?), વિક્રમસિંહ, *વિજયપાલ (પોરવાડ વૈશ્ય, સિદ્ધપાલના પુત્ર), *શિવનાગ (કરોડપતિ), *શ્રીપાલ (પ્રજ્ઞાયક્ષુ, પોરવાડ વૈશ્ય, વિજયપાલના પિતામહ અને સિદ્ધપાલના પિતા), સંગ્રામસિંહ (ભંડારી, ઓસવાલ) અને સિદ્ધપાલ (શ્રીપાલના પુત્ર).^૧

વિશિષ્ટ બાબત— પ્રસ્તુત પુસ્તક એ એક પ્રકારનો ઇતિહાસ છે એટલે એમાં કાલક્રમને પ્રાધાન્ય આપવાની નીતિને મેં સ્વીકારી છે અને તદનુસાર મેં વિવિધ વિષયોને લગતી કૃતિઓનો સૈકાદીઠ વિચાર કર્યો છે, પણ જો હું આટલેથી જ અટકું તો એ સર્વાંશે પરિપૂર્ણ ન ગણાય. આથી અહીં નીચે મુજબની બે બાબત આલેખું છું.

P-૩૯

(૧) સૈકાદીઠ સાહિત્યનો ફાલ— આ દ્વારા હું પ્રાયઃ પ્રત્યેક સૈકામાં-યુગમાં કયા કયા વિષયના ક્ષેત્રમાં કેવું કેવું અને કેટકેટલું ખેડાણ થયું છે તે સૂચવીશ.

(૨) વિષયદીઠ વિકાસક્રમ— પ્રત્યેક વિષયની સાંગોપાંગ છણાવટ અને રજૂઆતને લક્ષ્યમાં લેતાં એનો જ્યાં વિકાસક્રમ દર્શાવી શકાય ત્યાં એની ચર્ચા કરવાનો ઇરાદો રખાયો છે.

આ જાતનું સાંગોપાંગ આલેખન તે તે વિષયનો પરિપૂર્ણ અભ્યાસ માંગી લે છે એટલે એ મહાભારત કાર્યને તો હું પહોંચી વળું તેમ નથી. એથી એની આછી રૂપરેખા આલેખી અને કેટલીકવાર તો થોડુંક માર્ગદર્શન કરીને મારે વિરમવું પડે તેમ છે. એમાં મારી શક્તિની, સમયની અને સાધનોની મર્યાદા કારણભૂત છે. આ ન્યૂનતા દૂર કરવા માટે હું વિશેષજ્ઞોને સાદર વિનવું છું.

જૈન મૌલિક ગ્રંથોનું મૂલ્યાંકન— આ પ્રથમખંડમાં સત્તર પ્રકરણો અને એની પુરવણી છે. એ દ્વારા મેં જે ગ્રંથોનો પરિચય આપ્યો છે તેના મુખ્ય બે વર્ગ પાડી શકાય. (૧) મૌલિક અને (૨) વિવરણાત્મક. પહેલાં સોળ પ્રકરણમાં મેં મુખ્યત્વે મૌલિક જૈન ગ્રંથોની અને સાથે સાથે એ પૈકી જેનું જેનું વિવરણાત્મક સાહિત્ય હોય તેના તેના એ સાહિત્યની પણ નોંધ લીધી છે, જ્યારે સત્તરમાં-અંતિમ પ્રકરણમાં તો આ કાર્ય મેં કેવળ અજૈન ગ્રંથો પૂરતું જ કર્યું છે અહીં તો હું મોટે ભાગે જૈન મૌલિક સંસ્કૃત ગ્રંથોનો જ વિચાર કરીશ.

પંદર વિષયો અને એને અંગેની કૃતિઓની સંખ્યા— આ ખંડમાં ‘વ્યાકરણ’થી માંડીને ‘નીતિશાસ્ત્ર’ સુધીના પંદર વિષયોને મેં સ્થાન આપ્યું છે. એનાં નામ તેમજ એને અંગેની મૌલિક જૈન સંસ્કૃતકૃતિઓ તથા જૈન વિવરણાથી વિભૂષિત અજૈનકૃતિઓની સંખ્યા નીચે મુજબ છે.

P-૪૦

૧. *કૂદડી જેવા આ ચિહ્નથી અંકિત ગૃહસ્થની કૃતિ આ ખંડમાં નોંધાઈ નથી.
૨. વિક્રમની સત્તરમી સદી સુધીમાં ગુજરાતીમાં કૃતિ રચનારા પૈકી કેટલાકના નામ હું નીચે મુજબ ગણાવું છું. અમીપાલ, ઋષભદાસ, ખીમો, ગોડીદાસ, ભીમ (ભાવસાર), લીંબો, વચ્ચ (ભંડારી), વસ્તિક, વાનો, શાન્તિદાસ, સોલાણ અને હીરાણંદ.

વિષય	નામ	^૧ જૈનકૃતિઓ	^૨ અજૈનકૃતિઓ	કુલસંખ્યા
૧	વ્યાકરણ	૩૦	૫	૩૫
૨	કોશ	૪૩	૧	૪૪
૩	છન્દ	૨૨	૨	૨૪
૪	અલંકાર	૨૭	૬	૩૩
૫	નાટ્યશાસ્ત્ર	૧	૦	૧
૬	સંગીત	૭	૦	૭
૭	કામશાસ્ત્ર	૩	૦	૩
૮	સ્થાપત્ય	૧	૦	૧
૯	મુદ્રાશાસ્ત્ર	૦	૦	૦
૧૦	ગણિત	૬	૨	૮
૧૧	નિમિત્ત	૪૯	૧૩	૬૨
૧૨	વૈદ્યક	૩૬	૨	૩૮
૧૩	પાકશાસ્ત્ર	૧	૦	૧
૧૪	વિજ્ઞાન	૨૧	૦	૨૧
૧૫	નીતિ	૫૮	૧	૫૯

P-૪૧

- ૧-૨. આ કૃતિઓની સંખ્યા કામચલાઉ છે, કેમકે અમુક અમુક કૃતિ મૌલિક છે કે વિવરણાત્મક તેનો તેમજ અમુક અમુક કૃતિ જૈન છે કે અજૈન તેનો અંતિમ નિર્ણય કરવો બાકી રહે છે.
૩. આ પૈકી છ કૃતિ આંશિક છે.
૪. વિશ્રાંતવિદ્યાધર જૈન કૃતિ ન જ હોય તો પાંચને બદલે 'છ' અને ત્રીસને બદલે 'ઓગણત્રીસ' જોઈએ.
૫. આ પૈકી પાંચ કોશ આંશિક છે.
૬. લોકસંવ્યવહાર કોશ હોય તો આ સંખ્યા બરાબર છે, નહિ તો એક ઓછી ગણાવી જોઈએ.
૭. સંગીતસહર્ષિંગલ એ છન્દની તેમજ સંગીતની પણ એમ બે વિષયની કૃતિ હોય એમ લાગે છે એટલે એનો અહીં તેમજ સંગીતમાં ઉલ્લેખ કરાયો છે. આમ આ કૃતિ બેવડાઈ છે.
૮. કાવ્યવ્યાખ્યામૌલિક જૈનકૃતિ ગણી લીધી છે. ચારકૃતિ આંશિક છે.
૯. લોકસંવ્યવહાર નીતિનો ગ્રંથ હોય તો ૫૮ને બદલે ૫૯ જોઈએ અને કુલ સંખ્યા ૫૯ને બદલે ૬૦ની જોઈએ.
૧૦. ઉપલક દષ્ટિએ ૩૩૭ કૃતિ થાય પરંતુ સંગીતસહર્ષિંગલ નામની કૃતિ બેવાર ગણાઈ હોવાથી ખરી રીતે ૩૩૬ કૃતિ ગણાય.

ચિત્રકળા— લલિત કળા (Fine arts)ના વિવિધ પ્રકારો છે. એમાં જેમ સંગીત-કળા અને શિલ્પ-કળાને સ્થાને છે તેમ ચિત્રકળાને પણ છે. તેમ છતાં મેં વિષયો ગણાવતી વેળા એનો ઉલ્લેખ કર્યો નથી. તેનું કારણ એ છે કે કેટલાંયે ચિત્રો કામોદીપક અને સંસારવર્ધક બને તેમ હોવાથી મહર્ષિ બુદ્ધે પોતાના શિષ્યોને આ કળાથી અલિપ્ત રહેવા જેમ સૂચવ્યું હતું તેમ જૈન શ્રમણોને માટે પણ જૈન શાસ્ત્રમાં એવાં વિધાન જોવાય છે. આ પરિસ્થિતિમાં જૈન શ્રમણે તો શું પણ જૈન ગૃહસ્થે સુદ્ધાં સંસ્કૃતમાં કે પાઈયમાં ચિત્રકળા અંગે સ્વતંત્ર પુસ્તક રચ્યું હોય એમ જાણવામાં નથી એટલે એનો ઉલ્લેખ ક્યાંથી હોય ? બાકી આ આધુનિક સમયમાં તો જૈન ચિત્રકળાનો પરિચય આપનારાં સચિત્ર પુસ્તકો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ઓછાવત્તા પ્રમાણમાં પ્રકાશિત થયેલા જોવાય છે. એ પૈકી સોળ પ્રકાશનોની સૂચી ‘ખરતર’ ગચ્છના ઉપાધ્યાય મુખસાગરજીના શિષ્ય મુનિશ્રી કાન્તિસાગરજીએ “**खोज की पगडण्डियां**” નામના પુસ્તક (પૃ. ૫૮-૫૯)માં આપી છે.

P-૪૨

(૧) વ્યાકરણ : ૩૦ જેનફુતિઓ (વિ. સં. પૂર્વે ૬૪૬-લ. વિ.સં. ૧૮૦૦)

આપણે માનવીઓ વિશ્વના જેટલા ભાગમાં આજે હરીફરી શકીએ તેમ છે. તેટલા ભાગમાં આધુનિક ગણતરી પ્રમાણે એશિયા વગેરે પાંચ ખંડમાં ઓછેવત્તે અંશે પ્રચલિત ભાષાઓની સંખ્યા ૨૮૦૦ છે. ભાષાના બંધારણનો બોધ કરાવવા માટે તેમજ તેમાં અનુચિત વિકૃતિ થતી અટકાવવા માટે વ્યાકરણની રચના આવશ્યક છે. કોઈપણ ભાષાનું વ્યાકરણ તે જ ભાષામાં રચાય એ સ્વાભાવિક ઘટના છે અને એ ભાષા બોલનારને માટે તો એ રાજમાર્ગ છે. આજકાલ આપણી દુનિયાના બંને છેડા આધુનિક સાધનોને લઈને પહેલાંની જેમ દૂર રહ્યા નથી. આ પરિસ્થિતિમાં કેટલીક ભાષાનાં વ્યાકરણો તે જ ભાષામાં ન રચાતાં અન્ય ભાષામાં પણ રચાયાં છે અને રચાય છે. કેટલીક ભાષા માટે આમ માધ્યમ (Medium) એક કરતાં વધારે છે.

સંસ્કૃત ભાષાના બે પ્રકાર ગણાવાય છે. (૧) ઋગ્વેદ વગેરેની ભાષા અને (૨) રઘુવંશ વગેરેની ભાષા. આ બંને પ્રકારની ભાષાને અનુક્રમે “વૈદિકસંસ્કૃત” અને “લૌકિકસંસ્કૃત” તરીકે ઓળખાવાય છે. વૈદિકસંસ્કૃત ભાષાનું સ્વતંત્ર અને સાંગોપાંગ વ્યાકરણ કોઈએ પણ-વૈદિક ધર્માવલંબીએ સુદ્ધાં-સંસ્કૃતમાં રચ્યું હોય એમ જણાતું નથી. આનું કારણ એ હશે કે આ ભાષામાં રચાયેલું સાહિત્ય

P-૪૩

૧. સમવસરણનું ચિત્ર આજથી લગભગ બારસો વર્ષ ઉપર તો આલેખાતું એમ આવસ્સય અને એની નિજજુતિ (ગા.૫૬૦)ની શ્રીહરિભદ્રસૂરિકૃત ટીકા (પત્ર-૨૩૩ આ)માંનો નિમ્નલિખિત ઉલ્લેખ જોતાં જણાય છે.

“पूर्वाचार्योपदेशलिखितपट्टकादिचित्रकर्मबलेन तु सर्वा एव देव्यो न निषीदन्ति ॥”

૨. આ પુસ્તક “ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી ઈ. સ. ૧૯૫૩માં પ્રકાશિત કરાયું છે. એમાં જૈનાશ્રિત ચિત્રકલા, બૌદ્ધ ધર્માશ્રિત ચિત્રકલા, મહાકોસલનાં જૈન-ભિત્તિ-ચિત્ર, ભારતીય શિલ્પ અને ચિત્રકલામાં કાષ્ઠનો ઉપયોગ અને રાજસ્થાનમાં સંગીત એ બાબતો આ પુસ્તકના ત્રણ ખંડો પૈકી પ્રથમ ખંડ નામે “લલિતકલા”માં રજૂ થઈ છે.

૩. જુઓ ભગવદ્ગોમંડલ (ભા. ૭, પૃ.૬૬૯૯). આ ઈ. સ. ૧૯૫૩માં પ્રકાશિત ભાગમાં આ સંખ્યા “ફેચ એકેડેમિ” પ્રમાણે હોવાનો ઉલ્લેખ છે.

૪. વૈદિકભાષાનું વ્યાકરણ ગુજરાતીમાં પણ રચાયું હોય તેમ જાણવામાં નથી. અંગ્રેજીમાં તો આર્થર એન્થની મેક્ડોનેલ (Arthur Anthony Macdonell) A Vedic Grammar for Students રચ્યું છે અને એ ઈ. સ. ૧૯૧૬માં પ્રકાશિત થયું છે. વિલિયમ ડ્વાઈટ વ્હિટનીએ (William Dwight Whitney) A Sanskrit Grammar રચ્યું છે. અને એની પહેલી આવૃત્તિ ઈ. સ. ૧૮૭૯માં અને પાંચમી આવૃત્તિ ૧૯૨૪માં પ્રસિદ્ધ કરાઈ છે. એમાં વેદની અને બ્રાહ્મણની ભાષાઓનો પણ વિચાર કરાયો છે.

અમુક વર્ગ પૂરતું જ મર્યાદિત મનાયું છે. બ્રાહ્મણવર્ણની વનિતાઓને પણ વેદના પઠન-પાઠનનો અધિકાર અપાયો નથી. તો ઇતરવર્ણની વનિતાઓની તો વાત જ શી કરવી? ગમે તેમ પણ વૈદિકભાષાનો સંબંધ સાંપ્રદાયિક સાહિત્ય સાથે છે એમ મનાતું હોવાથી સર્વોપયોગી વ્યાકરણ રચનારા જૈન ગ્રંથકારો તો એને સ્થાન ન આપે એ સ્વભાવિક નહિ તો કાંતવ્ય તો ગણાય જ. ‘પાલિ’ ભાષા એ પાઈયનો એક પ્રકાર છે. તેમ છતાં એનું પણ સંસ્કૃતમાં વ્યાકરણ પાઈયનું સ્વતંત્ર વ્યાકરણ રચનાર વરુચિ વગેરેએ પણ રચ્યું નથી. તે પણ ‘પાલી’ એ બૌદ્ધોની જ ભાષા મનાવાને લઈને હશે. સિ.હે.માં ‘કલિ.’ હેમચંદ્રસૂરિએ આ પાલિને કે વૈદિકસંસ્કૃત ભાષાને સ્થાને આપ્યું નથી એટલું જ નહિ, પરંતુ જૈન આગમોની “અદ્વમાગહી” ભાષાનું પણ સર્વાંગીણ અને સ્વતંત્ર નિરૂપણ એમણે કર્યું નથી તો તે પણ આવી પરિસ્થિતિને આભારી હશે.

P-૪૪

પ્રસ્તુત પુસ્તકની અપેક્ષાએ સંસ્કૃતભાષાનાં સંસ્કૃતમાં રચાયેલાં વ્યાકરણો મુખ્ય ગણાય. ત્યાર પછીનું સ્થાન એ ભાષા સાથે નિકટ સંબંધ ધરાવનારી પાઈય ભાષાના સંસ્કૃતમાં રચાયેલાં વ્યાકરણોને મળે. પ્રસંગવશાત્ ફારસી અને કાનડી ભાષાનું એકેક વ્યાકરણ જૈનોએ સંસ્કૃતમાં રચેલું હોવાથી એનો પણ આ પુસ્તકમાં પૃ.૫૬માં પરિચય અપાયો છે. આ ઉપરાંત સંસ્કૃત ભાષાનાં વ્યાકરણ ગુજરાતી, હિંદી વગેરે ભારતીય પ્રાદેશિક ભાષામાં તેમજ અંગ્રેજી વગેરે અભારતીય ભાષાઓમાં રચાયેલાં છે એ પૈકી જુની ગુજરાતીરૂપ માધ્યમ દ્વારા રચાયેલી અને ‘ઔક્તિક’ તરીકે ઓળખવાતી પાંચકૃતિઓને પણ આ પુસ્તકમાં સ્થાન અપાયું છે. એમાં મુગ્ધાવબોધ અને વાક્યપ્રકાશ એ બે ઔક્તિકો વિશેષ મહત્વનાં જણાય છે અને એ બંને પ્રકાશિત છે.

પાઈય ભાષાના મરહટ્ટી ઇત્યાદિ છ પ્રકાર છે. આ વિવિધ પ્રકારોને અંગે સંસ્કૃતમાં વ્યાકરણ રચાયાં છે. ઔદાર્યચિન્તામણિ અને ચિન્તામણિ એ પાઈયના બે સ્વતંત્ર જૈન વ્યાકરણો છે અને એ બંનેના કર્તા દિગંબર છે. આવી અદ્વમાગધી પૂરતી એક આધુનિક કૃતિ તે જૈન-સિદ્ધાન્ત-કૌમુદી છે. (જુઓ ટિ. ૧) અને એના કર્તા શ્વેતાંબર છે. બાકી સંસ્કૃતની સાથે સાથે એક જ ગ્રન્થરૂપે પાઈયનું અને ખાસ કરીને અપભ્રંશનું વ્યાકરણ તો ‘કલિ.’ હેમચંદ્રસૂરિએ રચ્યું છે અને એને સિદ્ધહેમચંદ્રમાં આઠમા અધ્યાય તરીકે સ્થાન આપ્યું છે.

P-૪૫

સંસ્કૃતભાષાનાં પુષ્કળ વ્યાકરણો સંસ્કૃતમાં રચાયાં છે. આ પ્રકારના વ્યાકરણનાં પાંચ અંગ ગણાવાય છે. (૧) સૂત્રપાઠ, (૨) ગણપાઠ, (૩) ધાતુપાઠ, (૪) લિંગાનુશાસન અને (૫) ઉણાદિસૂત્ર. એમાં સૂત્રપાઠ મુખ્ય છે. એથી તો એ એક જ અંગ પૂરતી કૃતિ પણ ‘વ્યાકરણ’ કહેવાય છે. પાંચે અંગોના નિરૂપણરૂપ વ્યાકરણ ‘પંચાંગી’ કહેવાય છે. એના બે પ્રકાર પડે છે. (૧) એકકર્તૃક અને (૨) અનેકકર્તૃક. પ્રથમ પ્રકારનાં ત્રણ પંચાંગી વ્યાકરણો છે. (૧) શાકટાયન, (૨) બુદ્ધિસાગર અને (૩) સિદ્ધહેમશમ. ઐંદ્ર અને સદપાહુડ એ બે જૈન વ્યાકરણો તો ક્યારનાં લુપ્ત થઈ ગયાં છે એટલે એ બેમાં તેમજ નિમ્નાલિખિત અનુપલબ્ધ જણાતાં ચાર જૈન વ્યાકરણોમાં કેવળ સૂત્રપાઠને જ સ્થાન અપાયું હશે કે એ બધાં ‘પંચાંગી’ હશે તે જણાવું બાકી રહે છે.

૧. આનું સ્વતંત્ર વ્યાકરણ સંસ્કૃતભાષામાં ‘શતાવધાની’ રત્નચંદ્રજીએ રચ્યું છે અને એનું નામ જૈનસિદ્ધાંતકૌમુદી રાખ્યું છે. એ વ્યાકરણ ઇ. સ. ૧૯૨૫માં પ્રકાશિત કરાયું છે.

૨. બાકીનાં ત્રણ પૈકી એકના કર્તા સૌમપ્રભસૂરિ અને બીજાના જિનચંદ્ર છે, જ્યારે ત્રીજાના કર્તાનું નામ જણાવામાં નથી. વિશેષમાં આ ત્રણે અપ્રકાશિત છે. અજ્ઞાતકર્તૃક ઔક્તિકની એક હાથપોથી તો અહીંના (સુરતના) હુકમમુનિજીના ભંડારમાં હોવાનું કહેવાય છે.

^૧વિશ્રાન્તવિદ્યાધર, ^૨ભદ્રેશ્વર, ^૩પ્રેમલાભ અને નૂતનવ્યાકરણ.

જૈનેન્દ્ર અને મુષ્ટિ-વ્યાકરણમાં સૂત્રપાઠ તો છે જ. બાલબોધ, વિદ્યાનન્દ અને શબ્દભૂષણમાં પણ તેમ હશે. શબ્દાર્ણવ વ્યાકરણ જ હોય તો એ માટે પણ એમ જ સમજવાનું રહે છે. શબ્દભૂષણ પદ્યાત્મક રચના છે.

પ્રક્રિયા-ગ્રન્થોનો મુખ્ય સંબંધ સૂત્રપાઠની જ સાથે છે. એ એની સાધનિકાની દૃષ્ટિએ ગોઠવણી છે.

ગણપાઠ પૂરતી સ્વતન્ત્ર મુખ્ય કૃતિ છે: ગણરત્નમહોદધિ અને ગણદર્પણ. વિશેષમાં આ બંને પદ્યાત્મક છે. ઉપસર્ગમંડન વ્યાકરણ-વિષયક કૃતિ હોય તો એ કૃતિ પણ એક રીતે ગણપાઠ સંબંધી ગણાય.

ધાતુપાઠને અંગે સિદ્ધિચન્દ્રગણિકૃત ધાતુમંજરી છે.

લિંગાનુશાસન તરીકે મિશ્રલિંગકોશ છે.

ઉણાદિસૂત્ર પરત્વે ^૪વસુનન્દિકૃત ઉણાદિપ્રત્યય છે.

આમ ગણપાઠાદિને લગતી કૃતિઓ છ છે. એ પૈકી છેલ્લી ચારને માટે મેં ‘આંશિક’ એવો નિર્દેશ કર્યો છે. P-૪૬

આદ્ય વ્યાકરણ— આપણા આ દેશમાં વ્યાકરણોની રચના ઘણા પ્રાચીન સમયથી હાથ ધરાઈ છે. તેમ છતાં ભગવાન મહાવીરસ્વામીની પૂર્વે કોઈ જૈને-મુનિવરે કે ગૃહસ્થે-સંસ્કૃતમાં વ્યાકરણ રચ્યું હોય એમ જણાતું નથી. એ હિસાબે ^૧ઐદ્રવ્યાકરણ એ વીરશાસનની સ્થાપના કરતાં પહેલાનું છે અને ^૨સંદપાહુડ વીરશાસન સ્થપાતાં રચાયું છે. એ જૈનોનાં સૌથી પ્રાચીન-વ્યાકરણો છે પરંતુ એ બેમાંથી એકે આજે તો ઉપલબ્ધ નથી. આથી ઉપલબ્ધ સાહિત્યનો વિચાર કરતાં જણાય છે કે દિ. દેવનન્દિએ જે ^૩જૈનેન્દ્ર-વ્યાકરણ રચ્યું છે તે સમગ્ર ઉપલબ્ધ જૈનવ્યાકરણોની અપેક્ષાએ પ્રાચીનતમ ગણાય. એવી રીતે ‘યાપનીય’ સંપ્રદાયનું આદ્ય વ્યાકરણ તે યાપનીય શાકટાયનકૃત ‘શબ્દાનુશાસન’ છે. શ્વેતાંબરોનું ઉપલબ્ધ થતું સૌથી પ્રથમ વ્યાકરણ તે બુદ્ધિસાગરસૂરિકૃત ^૪બુદ્ધિસાગર છે. જૈન ન્યાસોમાં તો દિ. દેવનન્દિએ પાણિનિકૃત અષ્ટાધ્યાયી ઉપર ^૫શબ્દાવતાર નામનો રચેલો ન્યાસ સૌથી પ્રાચીન છે. જ્યારે વિશ્રાન્તવિદ્યાધર ઉપર મલ્લવાદીએ રચેલો ^૬‘યાસ’ એ સૌથી પ્રથમ શ્વેતાંબરીય ન્યાસ છે.

સર્વોત્તમ વ્યાકરણ— સમસ્ત જૈન-વ્યાકરણોમાં ‘કલિ.’ હેમચન્દ્રસૂરિકૃત સિંહ ૬૦ નામનું વ્યાકરણ એની સાંગોપાંગતા, સરળતા અર્થમાધુર્ય ઇત્યાદિને લઈને કળશરૂપ છે. એ એક વેળા ગુજરાતનું પ્રધાનતમ વ્યાકરણ હતું અને આજે પણ છે. એ વ્યાકરણ પાણિનીય અષ્ટાધ્યાયી ઇત્યાદિથી ચડિયાતું છે એમ પ્રબંધચિન્તાણિમાં નિમ્નલિખિત પદ્યમાં સૂચવાયું છે. P-૪૭

૧. આ મજેન છે એવું માનવા માટે કોઈ સબળ પ્રમાણ જણાતું નથી.

૨-૩ આ બંનેની નોંધ જૈન ગ્રન્થાવલીમાં છે અને જિનરત્નકોશના પ્રથમવિભાગ (પૃ.૨૮૦)માં પ્રેમલાભનો ઉલ્લેખ છે, બાકી એની એકે હાથપોથી કોઈ સ્થળે મળતી હોય તો તેની એમાં નોંધ નથી. આથી મેં એને ‘અનુપલબ્ધ’ કહ્યાં છે.

૪. એઓ દિગંબર હશે.

૫. જુઓ. પૃ. ૬-૭. ૬. જુઓ. પૃ. ૭-૮. ૭. જુઓ. પૃ. ૮-૧૧. ૮. જુઓ. પૃ. ૧૩-૧૪.

૯. જુઓ. પૃ. ૧૭-૧૮. ૧૦. જુઓ. પૃ. ૯. ૧૧. જુઓ. પૃ. ૧૩.

“ભ્રાત! સંવૃણુ પાણિનિપ્રલપિતં કાતન્ત્રકન્થા વૃથા । મા કર્ષીઃ કટુ શાકટાયનવચઃ ક્ષુદ્રેણ ચાંદ્રેણ કિમ્ ? ॥
કિં કળ્પઠાભરણાદિભિર્બઠરયસ્યાત્માનમન્ચૈરપિ? । શ્રૂયન્તે યદિ તાવદર્શ્યમધુરાઃ શ્રીસિદ્ધહેમોક્તયઃ ॥”

આ પદ્ય દ્વારા અષ્ટા૦ને પ્રલાપ. ^૧કાતનન્ત્રને કન્થા, શાકટાયનને કટુ, ચાન્દ્રને ક્ષુદ્ર અને સરસ્તવતીકંઠાભરણને જડતાપોષક કહ્યાં છે.

સિ૦ હે૦ની બૃહદ્વૃત્તિની અવયૂર્ણિકામાં કહ્યું છે (જુઓ પૃ.૪૩) કે સિ૦ હે૦ અતિવિસ્તીર્ણ કે વિપ્રકીર્ણ નથી તેમજ એ કાતન્ત્રની જેમ સંકીર્ણ પણ નથી.

પ્રભાવકચરિત- (શુંગ-૨૨, શ્લો. ૮૨)માં કહ્યું છે કે અત્યારે જે કલાપક લક્ષણ અર્થાત્ વ્યાકરણ પ્રવૃત્ત છે તે સંક્ષિપ્ત છે અને એમાં શબ્દની નિષ્પત્તિ જેવી જોઈએ તેવી નથી. વળી પાણિનિ એ વેદનું અંગ છે. એમ કહી બ્રાહ્મણો ગર્વથી એ વ્યાકરણ ઉપર ઈર્ષ્યા કરી ભણાવતા નથી માટે તમે નવું વ્યાકરણ રચો.

વ્યાકરણોની રચના મુખ્યતઃ સૂત્રાત્મક હોવાથી એ ગદ્યમાં હોય એ સ્વભાવિક છે. તેમ છતાં જૈનોને હાથે નીચે મુજબનાં બે વ્યાકરણો પદ્યમાં યોજાયાં છે.

(૧) બુદ્ધિસાગરસૂરિકૃત બુદ્ધિસાગર (વિ. સં. ૧૦૮૦).

(૨) દાનવિજયકૃત શબ્દભૂષણ (લ. વિ. સં. ૧૭૭૦).

ભોજવ્યાકરણ પદ્યમાં છે ખરું પણ એ કંઈ સ્વતન્ત્ર-મૌલિક કૃતિ નથી. એ તો સારસ્વત વ્યાકરણના વિવરણરૂપ છે.

સિદ્ધહેમચન્દ્રની સર્વોત્તમતા- સહસ્રાવધાની મુનિસુંદરસૂરિએ વિ. સં. ૧૪૫૫ માં બાલ્યાવસ્થામાં જીભની પટુતા કેળવવા માટે જે ^૨ત્રૈવિદ્યગોષ્ઠી યાને ^૩ત્રૈવિદ્યગોષ્ઠિકા રચી છે તેમાં (પત્ર-૨, અ ૨-આમાં) એમણે નીચે મુજબના ક્રમે ૨૦ વ્યાકરણોનો ઉલ્લેખ કર્યો છે.

(૧) ઐન્દ્ર, (૨) જૈનેન્દ્ર, (૩) સિદ્ધહેમચન્દ્ર, (૪) ચાંદ્ર, (૫) પાણિનિ (૬) સારસ્વત, (૭) શાકટાયન, (૮) વામન, (૯) વિશ્રાંત, (૧૦) બુદ્ધિસાગર, (૧૧) ^૪સરસ્વતીકંઠાભરણ, (૧૨) વિદ્યાધર, (૧૩) મુષ્ટિવ્યાકરણ, (૧૪) કલાપક, (૧૫) ^૫ભીમસેન, (૧૬) શિવ, (૧૭) ગૌડ, (૧૮) નન્દિ, (૧૯) જયોત્પલ અને (૨૦) જયદેવ.

૧. આ કાતન્ત્ર વ્યાકરણની રચના પ્રક્રિયા અનુસાર છે. જુઓ સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રકા ઇતિહાસ (ભા.-૧, પૃ.૩૭૫).

૨. આ નામ અંતમાંના દ્વિતીય પદ્યમાં છે. એ નીચે મુજબ છે.

“શરણમનુ (૧૪૫૫) મિતવર્ષે સ્વસ્યાન્વેષાં ચ શૈશવે સુધિયામ્ । જિહ્વાપટિમોપકૃતે વિદધે ત્રૈવિદ્યગોષ્ઠીયમ્ ॥ ૨ ॥”

૩. આ નામ પ્રારંભમાં બીજા પદ્યમાં છે.

૪. આ નામનું અલંકારશાસ્ત્ર રચનારા ભોજદેવની આ કૃતિ છે. એમાં ચચ્યાર પાદવાળા આઠ-અધ્યાય છે અને ૬૪૨૧ સૂત્રો છે. પહેલા સાત-અધ્યાયમાં લૌકિક શબ્દોને સ્થાન અપાયું છે, જ્યારે આઠમા-અંતિમ અધ્યાયમાં સ્વરપ્રકરણ અને ઐદિક શબ્દોનું અન્વાખ્યાન છે. આ વ્યાકરણ પાણિનીય અષ્ટા૦ અને ચંદ્ર વ્યાકરણને આધારે રચાયું છે. આ વ્યાકરણમાં પરિભાષા, લિંગાનુશાસન, ઉણાદિ અને ગણપાઠનું તે તે અધિકારમાં નિરૂપણ છે એ એની વિશેષતા ગણાય છે.

૫. પાણિનિએ રચેલા મનાતા ધાતુપાઠને અંગે ધાતુઓના અર્થ જે ભીમસેને આપ્યા છે એ ભીમસેન અત્ર અભિપ્રેત હોય તો DCGCM (Vol. II. Pt. I, Nos. 208-217) જોવું ઘટે.

વિશેષમાં પત્ર ૮-આમાં એમણે કહ્યું છે કે જો તમને લક્ષણાનુગામિની (અર્થાત્ વ્યાકરણવિષયક) ગોષ્ઠી ગમતી હોય તો હાલમાં બધાંયે લક્ષણોમાં (વ્યાકરણોમાં) શ્રીસિદ્ધહેમચન્દ્ર જ લક્ષણ મુખ્ય છે એમ તજજ્ઞોનું કહેવું છે. આમ અહીં એમણે સિંહેડેને સર્વોત્તમ વ્યાકરણ કહ્યું છે.

P-૪૯

સિદ્ધહેમચન્દ્ર સર્વોત્તમ કે વિદ્યાનંદ વ્યાકરણ ? — સહસ્રાવધાની મુનિસુંદરસૂરિએ વિ.સં. ૧૪૬૬માં રચેલી ગુર્વાવલીના નિમ્નલિખિત ૧૭૧માં પદ્યમાં વિ. સં. ૧૩૧૨ કરતાં પહેલાં રચાયેલા વિદ્યાનંદ વ્યાકરણનું મૂલ્ય આંક્યું છે.

“વિદ્યાનન્દાધિધં તેન કૃતં વ્યાકરણં નવમ્ । ભાતિ સર્વોત્તમં સ્વલ્પસૂત્રં બહુર્થસદ્ગ્રહમ્ ॥૧૭૧॥”

આમ અહીં વિદ્યાનન્દ વ્યાકરણને નવીન કહ્યું છે. વિશેષમાં આ વ્યાકરણમાં સૂત્ર થોડાં અને અર્થ ઘણો છે અને એ સમયે મુનિસુંદરસૂરિ સામે જે જે ‘વ્યાકરણો હશે, (સિંહેડે તો હતું જ) તેમાં આ વ્યાકરણ એમને ‘સર્વોત્તમ’ જણાયાનો ઉલ્લેખ છે.

જિનરત્નકોશના પ્રથમવિભાગમાં આ વ્યાકરણની નોંધ નથી એટલે એની કોઈ હાથપોથી પણ આજે ઉપલબ્ધ છે કે કેમ તે જાણવું બાકી રહે છે. આમ જ્યારે આ વ્યાકરણ મારા તો જોવામાં જ આવ્યું નથી તો એનું જે મૂલ્યાંકન મુનિસુંદરસૂરિએ કર્યું છે તે ચકાસી જોવાની વાત હું જતી કરું છું. બાકી નવાઈની વાત તો એ છે કે કે ત્રૈવિદ્યગોષ્ઠીમાં વિદ્યાનન્દ વ્યાકરણનો ઉલ્લેખ સરખો યે નથી. તેમ છતાં એને ગુર્વાવલીમાં સિંહેડે કરતાં પણ ચડિયાતું કહ્યું છે.

આથી પ્રશ્ન ઉદભવે છે કે શું વિ. સં. ૧૪૫૫માં દર્શાવેલા અભિપ્રાયને વિ. સં. ૧૪૬૬માં બદલી નાંખવા માટે મુનિસુંદરસૂરિને કોઈ સબળ કારણ મળ્યું હશે કે પહેલો ઉલ્લેખ બાલ્યાવસ્થાનો હોવાથી આગળ ઉપર-અગિયાર વર્ષે એ સમુચિત ન જણાતાં એમણે ભિન્ન અભિપ્રાય દર્શાવ્યો ?

P-૫૦

પ્રક્રિયા-ગ્રંથ— વ્યાકરણના સૂત્રપાઠગત સૂત્રોનો ક્રમ સાધનિકા માટે ભાગ્યે જ યોગ્ય હોય એટલે એના અર્થોનો માટે પ્રક્રિયા-ગ્રંથ યોજાય એ સ્વાભાવિક છે. આવું કાર્ય પ્રત્યેક વ્યાકરણને અંગે થઈ તો શકે, પરંતુ વિશેષ પ્રચારમાં આવનારા અને મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા વ્યાકરણ માટે આ ઘટના સહજ બને. પાણિનિકૃત અષ્ટાદશ માટે કેટલાકને મતે બૌદ્ધ ધર્મકીર્તિએ લ. વિ. સં. ૧૧૪૦માં રૂપાવતાર નામનો પ્રક્રિયા-ગ્રંથ રચ્યો છે અને ભટ્ટોજિ દીક્ષિતે વિ.સં. ૧૫૧૦થી ૧૫૭૫ના ગાળામાં સિદ્ધાંતકૌમુદી નામનો પ્રક્રિયા-ગ્રંથ રચ્યો છે અને નરેન્દ્રાચાર્યે લ. વિ. સં. ૧૩૦૦માં રચેલા સારસ્વત વ્યાકરણ પરત્વે અનુભૂતિસ્વરૂપાચાર્યે પ્રક્રિયા-ગ્રંથ રચ્યો છે તેમ ઉપલબ્ધ જૈન-વ્યાકરણો પૈકી દ્વિ. દેવનન્દિકૃત જૈનેન્દ્ર વ્યાકરણ ઉપર શ્રુતનન્દિએ તેમજ ચારુકીર્તિએ એકેક પ્રક્રિયા-ગ્રંથ રચ્યો છે અને શાકટાયન વ્યાકરણને અંગે અભયચંદ્રે પ્રક્રિયા-સંગ્રહ, ભાવસેને શાકટાયન-ટીકા અને દયાપાલમુનિએ રૂપસિદ્ધિ એમ ત્રણ પ્રક્રિયા-ગ્રંથો રચ્યા છે તેમજ સિંહેડેને અંગે વિનયવિજયગણિએ હેમલધુપ્રક્રિયા અને મેઘવિજયગણિએ ચંદ્રપ્રભા ઇત્યાદિ ત્રણ કૃતિ અને વીરસેને હેમપ્રક્રિયા રચી છે. આમ સિંહેડેને અંગે આધુનિક રચનાઓ બાદ કરતાં પાંચ પ્રક્રિયા-ગ્રંથો રચાયા છે.

૧. વીસ વ્યાકરણોનો ઉલ્લેખ ત્રૈવિદ્યગોષ્ઠીમાં છે. જુઓ. પૃ.૨૦ (ઉપોદ્ધાત).

૨. જુઓ સં૦ વ્યા૦ ઇ૦ (ભા.-૧, પૃ.-૪૫૩.) ૩. જુઓ પૃ.-૪૭-૪૮.

આ ઉપરથી એ ફલિત થાય છે કે જૈન-વ્યાકરણો પૈકી ત્રણ જ વ્યાકરણ અંગે પ્રક્રિયા-ગ્રંથ છે. સૌથી વધારે પ્રક્રિયા-ગ્રંથ સિંહ હેંને લક્ષીને છે અને એવી રચના વિ. સં. ૧૭૧૦ પહેલાં કોઈએ કર્યાનું જણાતું નથી (વીરસેનનો સમય જાણવામાં નથી.) એવી રીતે જૈનેન્દ્ર વ્યાકરણ પરત્વે વિક્રમની બારમી સદી પહેલાં અને શાકટાયનને અંગે વિક્રમની અગિયારમી સદી પહેલાં કોઈ પ્રક્રિયા-ગ્રંથ રચાયો લાગતો નથી. જો આમ કહેવું વાસ્તવિક હોય તો જૈન વ્યાકરણોમાં પ્રક્રિયા-ગ્રંથથી વિભૂષિત થનારા વ્યાકરણ તરીકે શાકટાયન વ્યાકરણ સૌથી પહેલું છે.

સિંહ હેંનો ઉદ્ધાર કરી સિદ્ધ-સારસ્વત નામનું નવીન વ્યાકરણ દેવાનન્દસૂરિએ લ. વિ. સં. ૧૨૭૫માં રચ્યું. એ પૂર્વે કોઈએ તેમ કર્યું છે ખરું ?

પાંચ અજૈન વ્યાકરણો— આપણા આ દેશમાં સંસ્કૃત ભાષાનાં સંસ્કૃતમાં વ્યાકરણો જે રચાયાં છે તેમાં વૈદિક હિંદુઓનો સબળ ફાળો છે. અહીં એમણે રચેલાં નિમ્નલિખિત ચાર વ્યાકરણો વિશે વિચાર કરાયો છે.

(૧) ઐદ્ર, (૨) અષ્ટા (૩) કાતન્ત્ર અને (૪) સારસ્વત.

ઐદ્ર વ્યાકરણ સિવાય બાકીનાં સંપૂર્ણ મળે છે. કાતન્ત્રનો અને ખાસ કરીને સારસ્વત વ્યાકરણનો જૈનોમાં જેટલો પ્રચાર થયેલો જણાય છે તેટલો અષ્ટાનો થયો નથી.

P-૫૨

ઉવસ્સગઢરથોતની દ્વિજપાર્શ્વદેવગણિએ રચેલી લઘુ ટીકામાં એ ગણિએ કાતન્ત્રના સૂત્રો આપ્યાં છે. વળી તત્ત્વાર્થસૂત્ર ઉપર દિ.શ્રુતસાગરે રચેલી તત્ત્વાર્થવૃત્તિમાં એ મુનિએ માટે ભાગે કાતન્ત્રનાં અને કોઈ કોઈવાર પાણિનિકૃત અષ્ટાનાં સૂત્રો આપ્યાં છે.

પાંચમું અજૈન વ્યાકરણ તે ચન્દ્ર વ્યાકરણ છે. એ બૌદ્ધ રચના છે અને એ મહત્ત્વની છે. ઉસભપંચાસિયા વગેરે રચનારા ધનપાલે આ વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો. બુદ્ધિસાગરસૂરિ વગેરે શ્વેતાંબર વૈયાકરણોએ પોતપોતાનું વ્યાકરણ રચતી વેળા આ વ્યાકરણનો ઉપયોગ કર્યો હતો.

પાઈય, કાનડી અને ફારસી ભાષાનાં સંસ્કૃત વ્યાકરણો— બધાંયે જૈન સંસ્કૃત વ્યાકરણો કંઈ કેવળ એ જ ભાષાનાં જ વ્યાકરણો નથી. સિંહ હેંને તો સંસ્કૃત ભાષાનું વ્યાકરણ હોવા ઉપરાંત પાઈય ભાષાના વિવિધ પ્રકારોને લગતું અમુક કક્ષાનું તો વ્યાકરણ છે જ.

સિંહ હેંની પૂર્વેનાં કોઈ જૈન વ્યાકરણમાં પાઈય ભાષાના વ્યાકરણને સ્થાન અપાયું હોય એમ જણાતું નથી એટલું જ નહિ પણ આ ભાષાને અંગેનું સ્વતન્ત્ર વ્યાકરણ તો દિ. શ્રુતસાગરકૃત^૧ ઔદાર્યચિંતામણિ કરતાં પહેલાં કોઈ રચાયું હોય એમ જાણવામાં નથી.


દ્વિ. અકલંકે ‘કાનડી’ ભાષાનું વ્યાકરણ સંસ્કૃતમાં રચ્યું છે^૨. એવી રીતે ‘પારસીક’ (ફારસી) ભાષાનું સંસ્કૃત વ્યાકરણ ગૃહસ્થ વિક્રમસિંહે રચ્યું છે^૩.

વ્યાકરણોનું વિહંગાવલોકન પૂરું થાય છે એટલે લગભગ વિ. સં. ૧૮૦૦ સુધીમાં રચાયેલાં વ્યાકરણોને વિષેની કેટલીક હકીકત હું નીચે મુજબ કોષ્ટક દ્વારા સૂચવું છું.

૧. જુઓ પૃ. ૨૩.

૨. જુઓ પૃ. ૩૩

૩. જુઓ પૃ. ૩૩.




(૨) કોશ : ૪૨ જૈન કૃતિ (લ. વિ. સં. ૧૦૦૦-વિ. સં. ૨૦૦૫)

P-૫૪

સંસ્કૃત શબ્દોના સંસ્કૃતપર્યાય રજૂ કરતા સંસ્કૃત કોશ યાને નામમાલાને લગતી કૃતિઓના મુખ્ય બે વર્ગ પાડી શકાય તેમ છે. (૧) એકાર્થક નામમાલા અને (૨) અનેકાર્થક નામમાલા. પ્રથમ વર્ગના એકાક્ષરી અને અનેકાક્ષરી એમ બે પેટાવર્ગ પાડતાં નામમાલાના ત્રણ પ્રકાર ઉદ્ભવે છે. આ ત્રણ જાતની નામમાલા પૈકી 'અનેકાક્ષરી' નામમાલામાંની કેટલીક અમુક જ પ્રકારના શબ્દો કે અમુક જ વિષયને રજૂ કરે છે અને એ દૃષ્ટિએ 'આંશિક' નામમાલા છે. એના શબ્દ અને વિષયની દૃષ્ટિએ બે ભેદ પડે છે. આ વાત ઝટ સમજાય તે માટે હું એને નીચે મુજબ રજૂ કરું છું અને એની સંખ્યા દર્શાવવાની સાથે સાથે શ્લેષાંબર અને દિગંબર કૃતિની સંખ્યા પણ નોંધું છું.

સંસ્કૃત ભાષાની જૈન નામમાલા (૪૨)



P-૫૫

પદાત્મક રચના— આ તમામ નામમાલાઓ પદાત્મક છે. આ ઘટના મુખ્યત્વે નામમાલા કંઠસ્થ કરવાની અનુકૂળતાને આભારી જણાય છે.

શ્વેતાંબર અનેકાક્ષરી એકાર્થક કોશોમાં જેમ 'અનજુભ્' છન્દમાં ૧૮૮ પદોમાં રચાયેલો લઘુત્તમનામકોશ સૌથી નાનો છે તેમ દિગંબર કોશોમાં ધનંજયનામમાલા છે. ત્રણેક દસકા ઉપર કેટલાયે શ્વેતાંબર મુનિઓ (દા.ત. શ્રીવિજયપ્રતાપસૂરિજી) પોતાના પ્રાથમિક અભ્યાસ દરમ્યાન આ નામમાલા કંઠસ્થ કરતા હતા એ એની અભ્યાસની દૃષ્ટિએ ઉપયોગિતા સૂચવે છે.

પ્રથા— જેમ મુખ્યત્વે અજૈનોમાં અમરકોશ કંઠસ્થ કરવાની પ્રથા આજે પણ જોવાય છે તેમ ખાસ કરીને શ્વેતાંબરોમાં-તેરાપંથની કેટલીક સાધ્વીઓમાં સુદ્ધા-અભિધાનચિંતામણિ મોઢે કરવાની પ્રથા છે.

ન્યૂનતા— અભિ.૦ ચિ.૦માં કેટલાક શબ્દો પૂરતી ન્યૂનતા જણાતાં શેષનામમાલા અને શિલોંછની રચના કરાઈ અને એ દ્વારા એ કોશને પરિપૂર્ણ બનાવવા પ્રયાસ કરાયો, પરંતુ હજી પણ કોઈ કોઈ શબ્દ (દા.ત. પાટીર) એમાં જણાતા નથી.

વિશેષમાં આ તેમજ અન્ય જૈન કોશો જે મેં અહીં નોંધ્યા છે. તેમાં જૈનોના પૌરિભાષિક શબ્દો.

૧. પારસીક કોશ પણ છે.
૨. નાનાર્થ-કોશના કર્તા અસંગને દિગંબર અને નાનાર્થસંગ્રહને અનેકાર્થક ગણી આ સંખ્યા દર્શાવાઈ છે.
૩. શબ્દભેદનામમાલા આંશિક કોશ હોય તો નવને બદલે 'દસ' જોઈએ અને સંપૂર્ણની સંખ્યા વીસને બદલે 'ઓગણીસ' જોઈએ.
૪. આ શબ્દ યશોવિજયગણિકૃત જ્ઞાનસારના "ભાવપૂજાષ્ટક" નામના ૨૯મા અષ્ટકના દ્વિતીય પદમાં વપરાયો છે.
૫. દાર્શનિક સાહિત્યને લગતો પારિભાષિક શબ્દોનો કોશ પણ સત્વર રચાવો જોઈએ પણ એ વાત હું અહીં જતી કરું છે.

બહુજ અલ્પ પ્રમાણમાં નજરે પડે છે. આથી પહેલી તકે બે કાર્ય થવાં જોઈએ. (૧) ખૂટતા શબ્દો રજૂ થવા જોઈએ અને (૨) કંઈ નહિ તો કથાનુયોગને લગતી જૈન સંસ્કૃત કૃતિઓમાં આવતા પારિભાષિક શબ્દો અર્થ સહિત અપવા જોઈએ. આ તો એક કામચલાઉ પુરવણીની વાત થઈ. બાકી બીજાં બે વિશેષ મહત્વનાં કાર્ય કરવાં જેવાં છે. એક તો જૈનોના પ્રૌઢ અને પ્રાચીન સંસ્કૃત ગ્રંથોના નિર્દેશપૂર્વકનો કોશ જોઈએ. બીજો કોશ વિશેષ પ્રયાસ માંગી લે તેમ છે, કેમકે એમાં સમય અને સ્થાનને લઈને જે શબ્દના અર્થમાં પરિવર્તનો થયાં હોય તેની પણ નોંધ હોવી ઘટે. ખરી રીતે તો સમગ્ર જૈન તેમજ અજૈન સંસ્કૃત સાહિત્યને લક્ષીને આ બીજી જાતનો મહાકોશ રચાવો જોઈએ, એ કાર્ય સુગમ બને તે માટે પણ જૈન વિભાગ તો જુદો તૈયાર થવો ઘટે.

P-૫૬

ફારસીકોશ— જેમ ફારસી ભાષાનું સંસ્કૃત વ્યાકરણ **વિક્રમસિંહ** નામના જૈને રચ્યું છે તેમ આ ભાષાનો શબ્દકોશ કેટલાકને મતે સપાદલક્ષ નામના જૈને રચ્યો છે.

P-૫૭

(૩) છન્દ:શાસ્ત્ર: ૨૨ જૈનકૃતિ (વિક્રમની છઠ્ઠી સદીથી ચૌદમી સદી)

છંદને અંગે જે બાવીસ જૈન કૃતિઓ રચાઈ છે એમાં દસેક સંદિગ્ધ છે. પૂજ્યપાદ તેમજ બુદ્ધિસાગરસૂરિએ રચેલું એકેક છન્દ:શાસ્ત્ર હજી સુધી તો મળી આવ્યું નથી. આથી છન્દ:શાસ્ત્રને લગતી બાકીની ઉપલબ્ધ કૃતિઓમાં જયદેવ અને દિ. જયકીર્તિની કૃતિઓ સૌથી પ્રાચીન ગણાય. એ પછીની કૃતિઓ તે છન્દ:શેખર, હૈમ છન્દોડનુશાસન ઇત્યાદિ છે. આ બધી કૃતિઓમાં હૈમ છન્દોડનુશાસન એની સ્વોપજ્ઞવૃત્તિ વગેરેને લઈને ઘણું અગત્યનું સ્થાન ભોગવે છે.

ઉપર્યુક્ત પૂજ્યપાદ એ સર્વાર્થસિદ્ધિના કર્તા જ હોય તો છન્દ:શાસ્ત્રની સ્વતન્ત્ર રચનાની શરૂઆત વિક્રમની છઠ્ઠી સદીથી ગણાય. વિક્રમની ચૌદમી સદી પછી કોઈ સ્વતન્ત્ર નોંધપાત્ર રચના થઈ હોય એમ જણાતું નથી.

છન્દ:શાસ્ત્રને અંગે જેમ પદ્યાત્મક રચના મળે છે. તેમ હૈમ છન્દોડનુશાસન જેવી કૃતિ ગદ્યમાં-સૂત્રરૂપે યોજાયેલી મળી આવે છે. કંઠસ્થ કરનારની દૃષ્ટિએ પદ્યાત્મક કૃતિ વિશેષ અનુકૂળ ગણાય.

કાનડી છન્દ:શાસ્ત્ર— જેમ કાનડી ભાષાનું સંસ્કૃતમાં વ્યાકરણ મળે છે (જુઓ. પૃ.-૫૬) તેમ જયકીર્તિકૃત છન્દોડનુશાસન કેટલાક કાનડી છંદો ઉપર પ્રકાશ પાડે છે.

૧. આવા શબ્દો શબ્દરત્નમહોદધિ નામના સંસ્કૃત-ગુજરાતી કોષમાં અપાયા છે. આ મહકાય કોશના સંગ્રાહક ખંન્યાસ શ્રીમુક્તિવિજયગણિ (જન્મવર્ષ વિ. સં. ૧૯૪૨) છે. આ કોશ “શ્રીહેમચન્દ્રાચાર્ય જૈન ગ્રંથમાલા”માં બે ભાગમાં અનુક્રમે ઇ. સ. ૧૯૩૭ અને ઇ. સ. ૧૯૪૧માં પ્રકાશિત કરાયો છે (એની એક નકલ મને પં. સંપત્તિવિજયજી તરફથી ભેટ મળી હતી). [તાજેતરમાં આ. ભ. હેમપ્રભસૂરિ મ. સા.ની પ્રેરણાથી આનું પુન:પ્રકાશન કેટલાક શબ્દો ઉમેરવાપૂર્વક ત્રણ ભાગમાં થયું છે.] વિ. સં. ૧૯૫૬માં ભાવનગરથી દોલતરાય મગનલાલ શાહે પ્રસિદ્ધ કરેલો અને સાવઈલાલ વિ. છોટાલાલ વો’રોએ યોજેલો શબ્દચિંતામણિ નામનો સંસ્કૃત-ગુજરાતી કોશ અપ્રાપ્ય. બનતાં એ ખોટ પૂરી પાડવાના ઉદ્દેશથી આ કોશ યોજાયો હતો.

૨. આવો કોશ હોય તો તત્ત્વાર્થાધિગમસૂત્ર (અ.પ. સૂ.૪૨)માંના ‘અનાદિ’ અને ‘આદિમાન’ શબ્દના અર્થ ઉપર પ્રકાશ પડે આ બે શબ્દના પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ અર્થને અંગે થોડીક ચર્ચા પં. સુખલાલે એમના ગુજરાતી વિવેચન (પૃ. ૨૪૮-૨૪૯, તૃતીય આવૃત્તિ, ઇ. સ. ૧૯૪૯)માં કરી છે.

૩. જુઓ પૃ.૮૨-૮૩.

P-૫૮

(૪) અલંકારશાસ્ત્ર: ૨૯ જૈન કૃતિ (વિક્રમની નવમી સદીથી અઢારમી સદી)

કાવ્યશાસ્ત્રને અંગે જે ૨૯ કૃતિઓ છે તેમાં ચાર આંશિક છે. આ શાસ્ત્રમાં શ્વેતાંબરોનો કાળો દિગંબરો કરતાં વિશેષ છે, કેમકે દિ. કૃતિ ગણીગાંકી છે બપ્પભટ્ટિસૂરિ કરતાં પહેલાં આ વિષયની કોઈ સ્વતંત્રકૃતિ રચાઈ હોય એમ જણાતું નથી.

‘ચારાપદ્ર’ ગચ્છના નમિસાધુએ રુદ્રટકૃત કાવ્યાલંકાર ઉપર વિ. સં. ૧૧૨૫માં ટીકા રચી. એમને હાથે આ જાતનું દ્વાર યોગ્ય પ્રમાણમાં ખુલ્લું મૂકાતાં આગળ ઉપર આ માર્ગે અન્ય જૈન લેખકો વિવરણકાર તરીકે વિહરે છે. એ દરમ્યાનમાં વાગ્ભટ અને ‘કલિં’ હેમચન્દ્રસૂરિ જેવા તો સ્વતંત્ર કૃતિ પણ રચે છે.

સમસ્ત કૃતિઓમાં હૈમ કાવ્યનુશાસન સૌથી મોખરે છે. એની બે સ્વોપજ ટીકા એની મહત્તામાં વૃદ્ધિ કરે છે. આ કાવ્યાનુશાસન ગદ્યમાં સૂત્રરૂપે છે. એટલે પદ્યાત્મક કૃતિઓમાં તો અલંકારમહોદધિ ઉત્તમ છે.

P-૫૯

(૫) નાટ્યશાસ્ત્ર : ૧ જૈન કૃતિ (લ. વિ. સં. ૧૨૦૦)

નાટ્યશાસ્ત્રને અંગે નાટ્યદર્પણ ઉપરાંત કોઈ સ્વતંત્ર ગ્રંથ જૈનોએ રચ્યો હોય એમ જણાતું નથી એટલે એ વિષે વિશેષ કહેવાનું રહેતું નથી.

(૬) સંગીતશાસ્ત્ર : ૭ જૈન કૃતિ (વિ. સં. ૧૩૫૦- લ. વિ. સં. ૧૫૦૦)

સંગીતશાસ્ત્રને લગતી સાત કૃતિઓ છે. તેમાંની ચાર તો લ. વિ. સં. ૧૩૫૦થી લ. વિ. સં. ૧૪૯૦ના ગાળામાં રચાયેલી છે. બાકીની ત્રણ કૃતિ વિષે વિશેષ માહિતી મળી શકી નથી. આ પરિસ્થિતિમાં આ બધી કૃતિમાં દિ. પાર્શ્વચન્દ્રની કૃતિને હું અગ્ર સ્થાન આપું છું.

સુધાકલશની બંને કૃતિ અત્યારે તો અપ્રસિદ્ધ છે અને એમાંની પહેલી તો અદ્યાપિ અપ્રાપ્ય છે એટલે બીજી પ્રસિદ્ધ કરાય તો આ દિશામાં વિશેષ પ્રકાશ પડે.

(૭) કામશાસ્ત્ર: ૩ જૈન કૃતિ (વિક્રમની ૧૭મી સદી)

કામશાસ્ત્રને અંગે જૈન કૃતિઓ ત્રણથી વધારે નથી અને તેમાં બે તો અપ્રકાશિત છે. વળી કંદર્પયૂદામણિ જૈને કૃતિ હોય તો પણ તે વિ. સં. ૧૬૩૩ની રચના છે. આ વિષય જૈનોને હાથે એમના ધાર્મિક વલણને લઈને લગભગ અણખેડાયેલો જ રહ્યો છે એમ કહું તો કેમ ?

(૮) સ્થાપત્ય : ૧ જૈન કૃતિ (ઉ. વિ. સં. ૧૪૦૦)

એકસંધિએ શિલ્પશાસ્ત્ર નામની કૃતિ રચી છે. એ ઉપરાંત કોઈ જૈને આ વિષયની કોઈ કૃતિ રચ્યાનું જણાતું નથી તેમજ ઉપર્યુક્ત કૃતિ વિષે વિશેષ માહિતી મને મળી શકી નથી એટલે મૂલ્યાંકન અંગે હું કશું કહેતો નથી.

૧. શૃંગાર-ચંદ્રિકા, શૃંગાર-મંજરી અને નેમિકુમારના પુત્ર વાગ્ભટે રચેલું કાવ્યાનુશાસન. આ વાગ્ભટ દિગંબર હશે એવી સંભાવના “જૈન સાહિત્ય ઔર ઇતિહાસ” (પૃ.-૪૮૭)માં કરાઈ છે.

૨. આમાંથી એક અવતરણ યશોવિજયગણિએ પ્રતિમાશતક (શ્લોક.-૧૬)ની સ્વોપજવૃત્તિ (પત્ર-૬૫)માં આપ્યું છે એમ એ વર્તિગત નિમ્નલિખિત પાઠ ઉપરથી જાણી શકાય છે.

“ ‘પર્યાયોક્ત્યંગ[ય]સ્યોક્તિઃ પર્યાયોક્તમ્’ ઇતિ હૈમવચનાત્” “વ્યઙ્ગ્યસ્ય પર્યાયોક્તમ્” એ હૈમકાવ્યાનુશાસનના છઠ્ઠા-અધ્યાયનું નવમું સૂત્ર છે.

(૯) મુદ્રાશાસ્ત્ર

આ શાસ્ત્ર માટે તો કોઈ જૈને સંસ્કૃત કૃતિ રચી જ જણાતી નથી તો મૂલ્યાંકનની વાત જ શી કરવી ?

(૧૦) ગણિતશાસ્ત્ર : ૬ જૈન કૃતિ (લ. વિ. સં. ૯૦૦-લ. વિ. સં. ૧૪૦૦)

P-૬૦

ગણિતશાસ્ત્રને અંગેની આઠકૃતિ પૈકી છ ના કર્તા જૈન છે^૧ અને એ છ જે કૃતિ સંસ્કૃતમાં છે એમ માની લઈએ તો પાટીગણિતની ચાર અને ક્ષેત્રગણિતની^૨ બે કૃતિ છે એમ કહેવાય. આ બધી કૃતિઓમાં લ. વિ. સં. ૯૦૦માં રચાયેલ^૩ ગણિતસારસંગ્રહ વિશેષતઃ નોંધપાત્ર છે. એ પૂર્વ વિદ્યાવારિષિ ઉમાસ્વાતિ જેવા જૈન ગણિતજ્ઞો થઈ તો ગયા છે પણ એમની કોઈ સ્વતન્ત્રકૃતિ હજી સુધી તો મળી આવી નથી.

જૈનભૂગોળ અને ખગોળ જોતાં ગણિતની અને ખાસ કરીને ક્ષેત્રગણિતની મહત્વની કૃતિઓ સર્જ્યાની આશા તો રખાય, પણ કોણ જાણે કેમ એ દિશામાં વિક્રમની ચૌદમી સદી પછી અંધકારપટ છવાયો હોય એમ લાગે છે. આજે થોડાક જૈન ગૃહસ્થો ગણિતની વિવિધ શાખાના સારા જાણકાર છે પણ એમાં સંસ્કૃત ગ્રંથ રચે તેવા તો કોઈક જ છે ને? આથી અત્યારે તો ગણિતશાસ્ત્રની વિવિધ શાખાઓ ઉપર પ્રકાશ પાડતી સબળ સંસ્કૃતકૃતિ રચાય એવો સંભવ બહુ જ ઓછો છે.

(૧૧) નિમિત્તશાસ્ત્ર: ૪૯ જૈનકૃતિ (લ. વિ. સં. ૧૭૫-લ. વિ. સં. ૧૭૫૫)

નિમિત્તશાસ્ત્ર સંબંધી જૈન કૃતિઓને આપણે આઠ વિભાગમાં વિભક્ત કરી શકીએ. (૧) જ્યોતિષ (ફલાદેશ), (૨) સામુદ્રિક, (૩) શકુન, (૪) સ્વપ્ન, (૫) રમલ, (૬) અંગવિદ્યા, (૭) પ્રશ્નવિચાર અને (૮) પ્રકીર્ણક. આ વિભાગોની કૃતિઓની સંખ્યા અનુક્રમે નીચે પ્રમાણે છે.

^૧ ૬, ૪, ૮, ૮, ૩, ૨, ૪ અને ૨.

નિમિત્તશાસ્ત્રની આઠ બે કૃતિઓ નામે પ્રશ્નપ્રકાશ અને કાલજ્ઞાન વિક્રમની બીજી સદીમાં થઈ ગયેલા પાદદિપ્તસૂરિની રચના છે, પરંતુ એ સંસ્કૃતમાં છે કે કેમ તે જણાવું બાકી રહે છે. વિશેષમાં એમાંથી એકે કૃતિ હજી સુધી તો મળી આવી નથી.

જ્યોતિષની કૃતિઓમાં નિમ્નલિખિત કૃતિઓ નોંધપાત્ર જણાય છે.

ગ્રહભાવપ્રકાશ, આરંભસિદ્ધિ, નારચંદ્ર, જ્યોતિસાર અને માનસાગરીપદ્ધતિ.

લ. વિ. સં. ૧૨૧૬થી લ. વિ. સં. ૧૭૩૫ના ગાળામાં સામુદ્રિકશાસ્ત્ર સંબંધી કૃતિઓ રચાઈ છે. તેમાં હસ્તસંજ્ઞવન મોખરે છે.

૧. ગણિતસાર અને ગણિતતિલક એ બે તો અજૈનકૃતિ છે.

૨. સિદ્ધભૂપદ્ધતિ જૈનની ક્ષેત્રગણિતને અંગેની કૃતિ હોય એમ લાગે છે.

૩. પ્રશ્નપ્રકાશ એ પ્રશ્નવિચારની કૃતિ હોય તો આ સંખ્યા ૧૫ની અને પ્રશ્નવિચારની કૃતિઓની સંખ્યા પાંચની ગણાય.

P-૬૧

શકુનશાસ્ત્રને અંગે સમંતભદ્રે રચેલી કૃતિ નામે લોકકલ્પ તો મળતી નથી એટલે નરપતિજયચર્યા આ વિષયની પ્રથમ કૃતિ ગણાય.

વિ. સં. ૧૨૨૦માં રચાયેલું સ્વપ્નશાસ્ત્ર એ સ્વપ્નશાસ્ત્રની આઘ કૃતિ હોય એમ લાગે છે. નિમિત્તશાસ્ત્રોમાં મેઘમહોદય એકંદર રીતે વિશેષ મહત્વની કૃતિ છે.

નિમિત્તશાસ્ત્ર સંબંધી કોઈ વિશિષ્ટ કૃતિ વિક્રમની ૧૮મી સદી પછી રચાયેલી જણાતી નથી. વિશેષમાં આ શાસ્ત્રને અંગે કોઈ દિગંબરે કેવલજ્ઞાનપ્રશ્નચૂડામણિ ઉપરાંત મહત્વની કોઈ કૃતિ સંસ્કૃતમાં રચી હોય એમ જાણવા જોવામાં નથી. જો એમ જ હોય તો તેનું શું કારણ ?

નિમિત્તશાસ્ત્રને અંગે જેટલી જૈન કૃતિઓ રચાઈ છે એટલી લાક્ષણિક સાહિત્યના કોઈ અંગ વિશે રચાયેલી જણાતી નથી. વળી આ વિષયની તેર-અજૈનકૃતિઓ ઉપર જૈન વિવરણો રચાયાં છે એટલે વ્યાકરણ વગેરેને લગતી અજૈનકૃતિઓનાં જૈન વિવરણોમાં આ વિવરણોની સંખ્યા સૌથી વધારે છે.

P-૬૨

(૧૨) વૈદ્યકશાસ્ત્ર : ૩૬ જૈન કૃતિ (લ. વિ. સં. ૬૦૦-લ. વિ. સં. ૧૭૧૦)

વૈદ્યકને અંગે સાત કૃતિઓ કલ્યાણકારકમાં નોંધાયેલી છે પરંતુ વૈદ્યકગ્રંથ તેમજ કલ્યાણકારક જે પૂજ્યપાદની રચના ગણાય છે તે પૈકી એકે આ સાત કૃતિમાં આવી જાય છે કે નહિ તેનો નિર્ણય કરવો બાકી રહે છે. એને સ્વતંત્ર ગણીએ તો પૂજ્યપાદે ઓછામાં ઓછી ત્રણ અને વધારેમાં વધારે પાંચ કૃતિ રચેલી ગણાય કેમકે ‘પૂજ્યપાદ’ એવા કર્તાના નામવાળી કૃતિઓ પૈકી કેટલી એકકર્તૃક છે તેની તપાસ કરવી બાકી રહે છે. ઉપર્યુક્ત નવ કૃતિઓમાંની એક તે સમંતભદ્રે રચેલો સિદ્ધાન્ત-રસાયનકલ્પ છે. એ સૌથી પ્રાચીન જણાય છે. ત્યાર પછીનો વૈદ્યકગ્રંથ તે દિ. ઉગ્રસેનકૃત કલ્યાણકારક છે અને એ પ્રકાશિત છે એથી જ નહિ, પણ એ મધ, મધ અને માંસના સેવન વિના રોગીના રોગ દૂર કરવાની માહિતી પૂરી પાડે છે એ દૃષ્ટિએ ખાસ મહત્વનો છે. કોઈ શ્વેતાંબર કૃતિ વિક્રમની નવમી સદી પહેલાં-બલ્કે સત્તરમી સદી પહેલાં રચાઈ હોય એમ જણાતું નથી. એવી રીતે યોગરત્નાકર કરતાં વૈદ્યકની કોઈ પ્રાચીન ગુજરાતી કૃતિ હોય એમ પણ જણાતું નથી.

પૂ.૧૪૪માં નોંધાયેલી આઠ સંદિગ્ધ કૃતિ વિશે ચોક્કસ કંઈ કહી શકાય નહિ એટલે અવશિષ્ટ કૃતિઓ વિચારવાની રહે છે ખરી, પણ એ સંબંધમાં વિશેષ માહિતી મળ્યા વિના શું કહેવાય?

(૧૩) પાકશાસ્ત્ર: ૧ જૈન કૃતિ (ઉ. વિક્રમની છઠ્ઠી સદી)

પોશાગમ એ પાકશાસ્ત્રની જ કૃતિ હોય તો પણ એ અનુપલબ્ધ છે એટલું જ નહિ પણ P-૬૩ એનો વિશિષ્ટ પરિચય પણ પૂરું પાડનારું કોઈ સાધન જણાતું નથી તો આ પરિસ્થિતિમાં પાકશાસ્ત્રને લગતી કૃતિના મૂલ્યાંકનની વાત જતી જ કરવી પડે ને?

(૧૪) વિજ્ઞાન: ૨૧ જૈન કૃતિ (લ. વિ. સં. ૧૨૭૫-વિ. સં. ૧૮૦૦)

અમરચન્દ્રસૂરિકૃત કલાકલાપના વિષય વિશે આપણે અજ્ઞાત છીએ એટલે એ કૃતિને બાજુએ રાખતાં આ પ્રકરણમાં નોંધાયેલી સંસ્કૃત કૃતિઓને આપણે ચારવર્ગમાં વિભક્ત કરી શકીએ.

૧. શાલાક્યતંત્ર, વૈદ્યકગ્રંથ, કલ્યાણકારક, નાડીપરીક્ષા અને નિદાનમુક્તાવલી.

(૧) પશુ-પંખીનો પરિચય, (૨) ધનુર્વિદ્યા, (૩) રત્નો અને ધાતુની પરીક્ષા અને (૪) પ્રકીર્ણક. આને અંગે અનુક્રમે ૮, ૨, ૪ અને ૬ કૃતિઓ છે.

મૃગ-પક્ષિ-શાસ્ત્ર— જેવી કૃતિ વિરલ અને લગભગ ૭૦૦ વર્ષ જેટલી પ્રાચીન હોવાથી એ પહેલી તકે પ્રસિદ્ધ થવી ઘટે. વિશેષમાં એની સમીક્ષારૂપ લખાણ પ્રાણિવિદ્યાના કોઈ સદૃશ્ય સમર્થ સાક્ષર પાસે તૈયાર કરાવવું ઘટે.

હાથી, ઘોડા અને કૂતરાને લક્ષીને અનુક્રમ ૧, ૩ અને ૨ કૃતિ યોજાઈ છે.

પશુપંખીની બોલી જાણવાની કળા પ્રાચીન સમયમાં વિકસિત થઈ હતી એમ જૈન કથાસાહિત્યમાં આવતા ઉલ્લેખો જોતાં જણાય છે. આ જાતના ઉલ્લેખો એકત્રિત કરાય તો આ વિષય ઉપર પ્રકાશ પડે.

રત્નોની પરીક્ષા માટે ત્રણ કૃતિ છે. તેમાંની હીરાને લગતી કૃતિ તો કોઈ દિગંબરે યોજી છે.

રત્નપરીક્ષા— તેમજ ધાતુપરીક્ષા વિક્રમની ચૌદમી સદીની કૃતિઓ છે એટલે તેમજ આજે પણ આ જ્ઞાન ગૃહસ્થ-જીવનમાં ઉપયોગી હોઈ એના પ્રકાશનાર્થે પ્રબંધ થવો ઘટે.

P-૬૪

આજે શાહી પહેલાંના જેવી બનતી નથી એમ મનાય છે તો તેનું કારણ વિચારવામાં મધીવિચાર જેવી કૃતિ કામમાં લઈ શકાય.

(૧૫) નીતિશાસ્ત્ર: ૫૮ જેન કૃતિ (લ. વિ. સં. ૯૦૦-લ. વિ. સં. ૧૮૫૦)

આ નામના પ્રકરણમાં (૧) સામાન્ય નીતિ, (૨) સુભાષિત, (૩) રાજનીતિ અને (૪) પ્રકીર્ણક એમ મુખ્ય ચાર વિષયને મેં સ્થાન આપ્યું છે અને એને અંગે અનુક્રમે ૧૩, ૭૩, ૧ અને ૧ સ્વતન્ત્ર કૃતિનો પરિચય આપ્યો છે.

સામાન્ય નીતિને લગતી કૃતિઓ રચવાની શરૂઆત મોડામાં મોડી વિ. સં. ૯૦૦માં થઈ અને એ કાર્ય ચારેક સૈકા સુધી બંધ રહ્યા બાદ વિક્રમની ઓગણીસમી સદી સુધી ચાલું રહ્યું અને ત્યાર બાદ એ અટકી ગયું હોય એમ લાગે છે. આ વિષયની આઘ કૃતિ પ્રશ્નોત્તર શૈલીએ યોજાઈ છે. આવી બે જ કૃતિ જોવા જાણવામાં છે. એ બંનેનું નામ પ્રશ્નોત્તરરત્નમાલા છે.

આ વિષયના નિરૂપણમાં શ્વેતાંબર તેમજ દિગંબર એમ બંને ફિરકાનો ફાળો છે.

તિલકપ્રભસૂરિકૃત નીતિશાસ્ત્ર તો મળતું નથી એટલે બાકીની કૃતિઓમાં લોકપ્રિયતાની દૃષ્ટિએ વિમલસૂરિકૃત પ્રશ્નોત્તરરત્નમાલા આદ્યસ્થાન ભોગવે છે, જ્યારે એ સિવાયની કૃતિઓમાં મલ્લિષેષ-કૃત સજ્જનચિત્તવલ્લભ જેવી નાનકડી કૃતિ તેમજ એથી મોટી એવી રત્નમાલા, નીતિ-ધનદ અને ઈન્દ્રનિદ્રકૃત નીતિસાર નોંધપાત્ર જણાય છે.

સુભાષિતોને અંગે ૪૩ કૃતિઓ છે. આ પૈકી નિમ્નલિખિત ત્રણ કૃતિઓ આધુનિક શ્વેતાંબર મુનિવરોએ પ્રાચીન કૃતિઓમાંથી તારવી કાઢેલાં સુભાષિતોના સંગ્રહરૂપ છે.

P-૬૫

૧. લોકસંવ્યવહાર નીતિશાસ્ત્રની કૃતિ હોય તો ૧૩ને બદલે ૧૪ જોઈએ.

હેમચન્દ્ર-વચનામૃત-સુભાષિત-પદ્ય-રત્નાકર અને જૈન-સૂક્ત-સંદોહ.

સુભાષિતોને લગતી કૃતિઓની રચનાનો પ્રારંભ વિ. સં. ૧૦૨૫ની આસપાસમાં થયો હોય એમ લાગે છે અને આ જાતની સ્વતન્ત્ર કૃતિની રચનાનું કાર્ય લગભગ વિ. સં. ૧૮૪૭ સુધી ચાલુ રહ્યું છે.

શ્વેતાંબરોમાં સિન્દૂરપ્રકરે અને દિગંબરોમાં સુભાષિતરત્નસંદોહે આદરણીય સ્થાન પ્રાપ્ત કર્યું છે અને તે સમુચિત છે.

વિક્રમની સત્તરમી સદીમાં સુભાષિતોને અંગે જેટલી કૃતિ રચાઈ છે એટલી અન્ય સદીમાં રચાઈ હોય એમ જણાતું નથી.

સોળમાં પ્રકરણમાં સુભાષિતોને લગતી કૃતિની સંખ્યા ઘણી મોટી છે. એ જોતાં અને આ વિષયની મહત્તા અને ગ્રાહકતા વિચારતાં મારી એ નમ્ર સૂચના છે કે આ જાતની પ્રકાશિત તેમજ અપ્રકાશિત સમગ્ર જૈન કૃતિઓનાં પદોનો એક કોશ સુભાષિતરત્નભાંડાગર જેવા સ્વરૂપે તૈયાર કરવાનું કાર્ય કોઈ મુનિવરે ઉપાડી લેવું જોઈએ અને એનું પ્રકાશન કોઈ સમૃદ્ધ સમીક્ષાત્મક સંસ્કારરૂપે કરવું જોઈએ.

રાજનીતિને અંગે એક જ ગ્રન્થ છે અને એ મહત્વનો છે.

બુદ્ધિસાગર જેવી પ્રકીર્ણક કૃતિ પણ ગણીગાંડી હશે એટલે એના પર તુલનાત્મક મૂલ્યાંકન માટે વિચાર કરવાનો રહેતો નથી.

ત્રણ અને ચાર વિષયની એકકર્ણક કૃતિઓ— લાક્ષણિક સાહિત્યનાં જે પંદર વિષયોને આ પુસ્તકમાં સ્થાન અપાયું છે એ દરેકને અંગે સંસ્કૃતમાં એકેક કૃતિ પણ રચી હોય એવા જૈનગૃહસ્થ કે મુનિવર નથી અને એમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી, કેમકે સામાન્ય રીતે એક જ વ્યક્તિ એક કે બે જ વિષયની કૃતિ રચે એ સ્વાભાવિક ઘટના છે. આથી અહીં હું લાક્ષણિક સાહિત્યના ત્રણ અને ચાર વિષયો પરત્વે કૃતિ રચનારનો અનુક્રમે ઉલ્લેખ કરું છું. તેમાં ત્રણને અંગે રચનાર નીચે મુજબ છે.

વ્યાકરણ, છન્દ અને વૈદ્યક : પ્રણેતા પૂજ્યપાદ.

વ્યાકરણ, અલંકાર અને સંગીત : પ્રણેતા મંડન (મન્ત્રી).

ચાર વિષયો ઉપર કૃતિ રચનાર તરીકે બે વ્યક્તિઓ છે : (૧) કલિઠ હેમચન્દ્રસૂરિ અને (૨) હર્ષકીર્તિસૂરિ. વ્યાકરણ, કોશ, છન્દ અને અલંકાર એ ચાર વિષયો ઉપર 'કલિઠ' હેમચન્દ્રસૂરિએ અને વ્યાકરણ, કોશ, વૈદ્યક અને નિમિત્ત એ ચારને અંગે હર્ષકીર્તિસૂરિએ કૃત રચી છે.

સૈકાદીઠ ફાલ

(૧) ભગવાન મહાવીરસ્વામીના જન્મ સમય થૂર્વે લાક્ષણિક સાહિત્યની કોઈ કૃતિ સ્વતન્ત્ર સ્વરૂપે રચાઈ હોય તો તે આજે મળતી નથી.

૧. આથી વધારે વિષયની લાક્ષણિક સાહિત્યને લગતી કૃતિ કોઈ જૈને રચી નથી એટલે એનો નિર્દેશ કરવાનો રહેતો નથી.
૨. વ્યાકરણનાં પાંચે અંગ ઉપર એકેક કૃતિ, સૂત્રપાઠ ઉપર લઘુ અને બૃહદ્વૃત્તિ તથા ન્યાસ તેમજ પાતુપાઠ, લિંગાનુશાસન અને ઉણાદિસૂત્ર ઉપર એકેકવૃત્તિ.
૩. કોષ ચાર છે. જુઓ પૃ. ૬૪ બે કોષ ઉપર સ્વોપજ્ઞવિવરણ છે.
૪. આના ઉપર એક કૃતિ છે અને એ સ્વોપજ્ઞવૃત્તિથી વિભૂષિત છે.
૫. આને અંગે એક કૃતિ છે અને તે વૃત્તિ અને તેના ઉપરની વૃત્તિ (Supercommentary)થી અલંકૃત છે.

(૨) ઇ. સ. પૂર્વે ૫૮૦ અને ઇ.સ. પૂર્વે ૫૫૭માં એકેક જૈન વ્યાકરણ રચાયું ત્યાર બાદ ઇ. સ. ૧૨૦ સુધીમાં એટલે કે ૭૧૦ વર્ષ સુધીના ગાળામાં લાક્ષણિક સાહિત્યની એકે જૈન કૃતિ જોવાતી નથી.

(૩) ઇ. સ. ૧૨૦ના અરસામાં પાદલિપ્તસૂરિએ કૃતિઓ રચી પછી પૂજ્યપાદના સમય સુધી કોઈ કૃતિ રચાયેલી જણાતી નથી. આમ પાછો ત્રણ-ચાર સૈકાનો ગાળો પડે છે. વિ. સં. ૬૦૧થી વિ. સં. ૮૩૮ સુધી પણ આવી અંધકારમય સ્થિતિ પ્રાયઃ પ્રવર્તે છે.

(૪) વિ. સં. ૮૪૦માં હરિવંશપુરાણ રચાતાં સાહિત્યનું ક્ષેત્ર ઠીક ઠીક ખેડાવા માંડે છે. તેમાં લ. વિ. સં. ૮૦૦માં ‘યાપનીય’ સંઘના તે સમયના અગ્રણી શાકટાયનથી ‘યાપનીય સાહિત્ય’ રચાય છે, પરંતુ એ પ્રવૃત્તિ થોડાક સૈકા બાદ બંધ પડે છે. વિશેષમાં ‘યાપનીય’ સંપ્રદાયની કોઈ વ્યક્તિ આજે પાંચેક સૈકાથી તો અસ્તિત્વ ધરાવતી જણાતી નથી.

(૫) લ. વિ. સં. ૧૦૮૦થી ચેતાંબર લાક્ષણિક સાહિત્યની રચનાના ત્રીગણેશ કોઈ એવા શુભ મુહૂર્તમાં મંડાયા કે એ પ્રવૃત્તિ આજ દિન સુધી ઓછેવત્તે અંશે ચાલુ રહેલા પામી છે.

(૬) વિક્રમની બારમી-તેરમી સદીમાં લાક્ષણિક સાહિત્યની લહાણી થતી જોવાય છે. એમાં ‘કલિં’ હેમચન્દ્રસૂરિની પ્રવૃત્તિ વિશેષ ધ્યાન ખેંચે છે. પછી કંઈક ઓટ આવે છે. આગળ જતાં વિક્રમની સત્તરમી સદી સાહિત્યપ્રવૃત્તિથી ગાજી ઉઠે છે, જોકે એમાં મૌલિકતાની-સંગીન ઉમેરાની-ન્યૂનતા જોવાય છે. યશોવિજયગણિ આ ન્યૂનતા નવ્ય ન્યાયની ઝમકવાળી કૃતિઓ રચી અમુક અંશે દૂર કરે છે. ત્યાર પછી તો એવું થોડુંક કાર્ય પણ ભાગ્યે જ કોઈએ સંસ્કૃત સાહિત્ય પરત્વે કર્યું છે અને આજે કરે છે.

જૈન જગતના ચેતાંબર અને દિગંબર એવા બે સ્પષ્ટ વિભાગ પડ્યા બાદ દિગંબરીય સાહિત્ય-ગગનમાંના ‘પાર્થય’ દિગ્-વિભાગમાં જેમ કુન્દકુન્દાચાર્ય જેવો સમર્થ તેજસ્વી મહાતારક ઊગ્યો તેમ ‘સંસ્કૃત’ દિગ્-વિભાગમાં સમન્તભદ્ર ગણાય છે. આશાધર નામનો તારો આ મહાતારકોના હિસાબે ઓછો તેજસ્વી છે. એ આથમી જતાં એટલા યે તેજથી દિગંબરીય સંસ્કૃત દિગ્-વિભાગને પ્રકાશિત કરનાર કોઈ તારો આજદિન સુધીમાં ઊગ્યો હોય એમ જણાય છે ખરું ?

મૂલ્યાંકનનું કાર્ય પૂરું થયું છે એટલે પૃ. ૧૨માં સૂચવાયા મુજબ હું ‘નિવેદન’નો અવિશિષ્ટ અંશ રજૂ કરું છું.

રચનાસમયની સૂચી— આ પ્રથમખંડમાં લાક્ષણિક સાહિત્યને અંગેની જૈન સંસ્કૃત કૃતિઓના પ્રણેતાઓનો પરિચય આપતી વેળા મેં એ પ્રણેતાઓ પૈકી ઘણા ખરાની અન્ય વિષયોની કૃતિઓ હોય તો તે કૃતિઓનો પણ ઉલ્લેખ કર્યો છે. એ સમગ્ર કૃતિઓના રચનાસમયની એક કામચલાઉ સૂચી મેં તૈયાર કરી છે. એ એકાંગી હોવાથી આગળ ઉપર ત્રીજા વિભાગના અંતમાં એવી બીજી બે સૂચી જે બીજા બે વિભાગો માટે મેં યોજી છે તેની સાથે એને ભેળવી દઈ ત્રણ વિભાગની એક અખંડ સૂચી આપવાનો ઈરાદો રાખું છું.

કર્તવ્ય— આર્ય સંસ્કૃતિરૂપ અખંડ તેલમાં તરબોળ એવી નાનીમોટી જૈન કલમરૂપ વાટોને પ્રતિભારૂપ દીપ-શિખા વડે પ્રજ્વલિત કરી દાનવતારૂપ ધૂમ્રથી રહિત જ્ઞાનરૂપ પ્રકાશ દસે દિશામાં સમુચિત સ્વરૂપે સબળ પ્રમાણમાં સતત પ્રસરતો જોવાની અભિરુચિ હર કોઈ જૈનને હોય જ. આથી

P-૬૭

P-૬૮

એની પ્રાથમિક ભૂમિકારૂપ જે કાર્ય કરવું જોઈએ તે એ છે કે જૈન ભંડારોના કાર્યવાહકો પોતપોતાના હસ્તકના ભંડારોમાંની હાથપોથીઓનું વર્ણનાત્મક સૂચિપત્ર યોગ્ય વિદ્વાનો દ્વારા તૈયાર કરાવી તેને સત્વર પ્રસિદ્ધ કરે. એ દ્વારા પંદરેક લાખ જેટલી જૈન હાથપોથીઓ જે આજે મોજુદ છે તેમાં પિરસાયેલી સામગ્રીની માહિતી મળતાં જૈન સાહિત્યના જ ઇતિહાસ ઉપર વેધક પ્રકાશ પડશે એટલું જ નહિ પણ આપણા આ સમગ્ર આર્યાવર્તના-ભરતભૂમિના સાહિત્યિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસની પણ અનેક ગુંચો આપોઆપ ઉકલી જશે.

P-૬૯

પ્રયાસ— જૈન ધર્મ એ આત્મત્રતિનો અને સાથે સાથે વિશ્વની સાચી અને સનાતન શાન્તિ માટેનો રામબાણ ઉપાય છે. તેમ છતાં એના સમુચિત અને સર્વાંગીણ પરિચય માટે આધુનિક યુગના માનસને અનુલક્ષીને જેવો જોઈએ તેવો વ્યાપક પ્રયાસ જૈન સમાજ તરફથી હજી સુધી તો થયો નથી. આવી શોચનીય પરિસ્થિતિ આ ધર્મના પુરસ્કાર અનુયાયીઓ દ્વારા રચાયેલા વિશાળ, વિવિધ, વેધક, ઉપયોગી અને ઉદાત્ત એવા જૈન સાહિત્ય પરત્વે પણ જોવાય છે. અરે આ સાહિત્યના એક સબળ અંગરૂપ સંસ્કૃત સાહિત્યના પરિચય માટે પણ પરિપૂર્ણ પ્રયાસ કરવો. બાકી રહે છે. પ્રસ્તુત પુસ્તક તો એ દિશામાં માંડમાંડ એક પગલું માંડે છે. બાકી અહીં રજૂ કરાયેલી પદ્ધતિ ઉપરાંત બીજી અનેક પદ્ધતિએ આ સંસ્કૃત સાહિત્યનો અને વિશેષતઃ સમગ્ર જૈન સાહિત્યનો યથેષ્ટ પરિચય પૂરો પાડનાર મહાકાય ગ્રંથ યોજાવો અને પ્રકાશિત થવો ઘટે. મારા આ વિચારના સમર્થનાર્થે તેમજ અન્ય જૈન સાહિત્યના સાચા સેવકોને એનો ભિન્ન-ભિન્ન રીતે પરિચય કરાવવા માટે માર્ગદર્શનો મળે એ આશયથી ભારતીય સાહિત્યને અંગે તેમજ એના એક મહત્વના વિભાગરૂપ સંસ્કૃત સાહિત્ય પરત્વે અત્યાર સુધીમાં જે પ્રયાસ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી અને જર્મનમાં થયાનું મારા જાણવામાં છે તેની હું અહીં નોંધ લઉં છું.

(અ) ગુજરાતી

પ્રેકેસર એ. મેક્ડોનલ કૃત સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ પ્રો. મોહનલાલ પા. દવે (અનુવાદક), ૧૯૨૧.

(આ) હિન્દી

P-૭૦

સંસ્કૃત સાહિત્ય કા ઇતિહાસ (પ્રથમ ભાગ) : કનૈયાલાલ પોદ્દાર, ૧૯૩૮.

સંસ્કૃત વાઙ્મય : બલદેવ ઉપાધ્યાય, ૧૯૪૫.

સંસ્કૃત સાહિત્યકી રૂપરેખા : ચંદ્રશેખર પાળડેય તથા શાંતિકુમાર વ્યાસ, ૧૯૫૧ (તૃતીય સંસ્કરણ).

(ઇ) સંસ્કૃત

સંસ્કૃત સાહિત્યેતિહાસ: (ભાગ ૧-૨) : હંસરાજ અગ્રવાલ, ૧૯૫૧, ૧૯૫૨.

૧. સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈએ પુષ્કળ પરિશ્રમ લઈને જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ એ નામનો ગ્રંથ આઠ વિભાગમાં સિદ્ધસેનયુગ, હરિભદ્રયુગ, હેમયુગ, સોમસુંદરયુગ, હૈરકયુગ અને યશોવિજયયુગ એ છ યુગમાં વિભક્ત કરીને આલેખ્યો છે. એમાં અનેક ગ્રંથોની નોંધ છે પણ એ મોટે ભાગે તો સંક્ષિપ્ત છે. વળી એમાં વિષયદીઠ કૃતિઓનો એકધારો પરિચય અપાયો નથી તેમજ દ્રાવિડ ભાષાઓમાં રચાયેલી કૃતિઓ મોટે ભાગે જતી કરાઈ છે. એથી વિશિષ્ટ પ્રયાસ માટે અવકાશ રહે છે.

૨. આ ગુજરાતી અનુવાદ "ગુજરાતી સાહિત્ય પરિષદ ભંડોળ કમિટી" તરફથી મુંબઈથી પ્રસિદ્ધ કરાયો છે.

(ઈ) અગ્રંજી

- A History of Sanskrit Literature : 'Arthur A. Macdonell. 1900.
 A SHort History of Indian Literature : Ernst Horowitz, 1907.
 The History of Literature : Albrecht Weber. 1914.
 Classical Sanskrit Literature : A. B. Keith. 1923.
 A History of Ancient Sanskrit Literature : Max Muller. 1926.
 A History of Indian Literature : (Vols. I-II) : Mayrice Winternitz. 1927, 1933.
 A History of Sanskrit Literature : A. B. Keith. 1928.
 History of Sanskrit Literature : C. V. Vaidya, 1930.
 A SHort History of Indian Literature : M. D. Chakravarty, 1936.
 A SHort History of Indian Literature : K. N. Kaul. 1937.
 Classical Sanskrit Literature : M. Krishnamacariar. 1937.
 An Introduction of Classical Sanskrit : G. Shastri. 1943.
 A Hand- Book of Classical Sanskrit Literature : U. V. Rao. 1946.
 History of Sanskrit Literature (Vol. I) : S. N. Dasgupta & S. K. De. 1947.
 Sanskrit Literature : (The P. E. N. Books No. 12), K. Chadrasekharan & V. H. Subramania Sastri. 1951.

P-૭૧

(ઉ) જર્મન

Gaschichteder Indischen Litteratur (Vol. II³) : Maurice Winternitz. 1920. 1922.

જેમ આ પૃથ્વી મહાસાગરોથી અલંકૃત છે તેમ સંસ્કૃતની સૃષ્ટિ પણ ભારતીય સાહિત્ય, યુરોપીય સાહિત્ય એમ જાતજાતના સાહિત્યરૂપ મહાસાગરોથી વિભૂષિત છે. ભારતીય સાહિત્યરૂપ મહાસાગર સંસ્કૃત, પાઈય અને દ્રાવિડ એમ ત્રણ ભાષામાં રચાયેલા વિવિધ, વિશાળ અને વરેણ્ય ગ્રંથોરૂપ ત્રણ સમુદ્રથી પુષ્ટ બન્યો છે. આ સમુદ્રો પૈકી સંસ્કૃત સાહિત્યરૂપ સમુદ્ર વૈદિક, બૌદ્ધ અને જૈન સંપ્રદાયોની મહામૂલ્યશાળી કૃતિઓરૂપ સિંધુ, બ્રહ્મપુત્રા અને ભાગીરથીરૂપ સરિતાઓના સંગમસ્થાનરૂપ છે. આમ જૈન સંસ્કૃત સાહિત્ય એ એક મોટી સરિતા છે, પરંતુ વિશ્વ-સાહિત્યરૂપ વિરાટ મહાસાગરને હિસાબે તો એ બહુ નાની ગણાય. અરે ભારતીય સાહિત્ય તો શું પણ સમગ્ર જૈન સાહિત્યને હિસાબે પણ એ નાની નદી છે. આને લઈને એનું સમુચિત મૂલ્યાંકન થવામાં મુશ્કેલી નડે તે સ્વાભાવિક છે. અજૈન વિદ્વાનોને હાથે જે ભારતીય સાહિત્યના અને સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ આલેખાયા છે. તેમાં આ નાનકડી નદીનો સમુચિત પ્રમાણમાં ભાવ પૂછાવો રહી ગયો છે, અને એ સંકલનાઓના ઉદ્દેશ જોતાં તેમ થયું તેમાં કંઈ ખોટું પણ નથી. આવી પરિસ્થિતિમાં આ પુસ્તકની

P-૭૨

૧. આનો ગુજરાતીમાં અનુવાદ થયેલો છે. જુઓ. પૃ.૩૨.
૨. આ ગ્રન્થકારના મૂળ જર્મન ગ્રંથનો અંગ્રેજી અનુવાદ છે. એના અનુવાદક મિસિસ એસ. કેટકર અને મિસ એચ. કોન (Kohn) છે.
૩. દ્વિતીય આ વિભાગમાં બૌદ્ધ અને જૈન સાહિત્યનું નિરૂપણ છે.

રચના આવશ્યક ગણાશે એવું મારું નમ્ર મંતવ્ય છે. સાહિત્યની પ્રત્યેક નાની-મોટી નદીનાં યથાર્થ દર્શન કરાવનાર પુસ્તકો હોય તો એ ઉપરથી વિશ્વસાહિત્યરૂપ વિરાટ મહાસાગરનો પૂરતો ખ્યાલ મેળવવો સુગમ થઈ પડે એમ માની મેં આ દિશામાં યથામતિ પ્રયાસ કર્યો છે. એમાં જે ક્ષતિઓ અને ત્રુટિઓ જણાય તેના તરફ મારું સત્વર લક્ષ્ય ખેંચવા વિશેષજ્ઞો કૃપા કરશે તો અન્યત્ર એનો હું લાભ લઈ શકીશ અને સ્ખલનોનું પુનરાવર્તન થતું અટકશે.

P-૭૩

આભ-સ્વીકાર— જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ તૈયાર કરવાનો મને જે સુયોગ મળ્યો તે પ્રસ્તુત સંસ્થાના કાર્યવાહક મહાશયને મુનિશ્રી યશોવિજયજીએ કરેલી પ્રેરણાને અને એમના ગુરુવર્ય જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિજીએ આપેલી સંમતિને આભારી છું. આ પુસ્તકના પ્રકાશનથી જો એના અર્થાને લાભ થાય તો તે બદલ તેમણે આ સંસ્થાનો ઉપકાર માનવો ઘટે.

આ સમગ્ર પુસ્તક (ત્રણે વિભાગ) તૈયાર કરવામાં આ ક્ષેત્રમાં મારા પુરોગામીઓને હાથે જે જે વિષયને અંગે સબળ રચનાઓ થઈ છે એ સમગ્ર સામગ્રીનો તો હું લાભ લઈ શક્યો નથી, પરંતુ જે જે કૃતિઓ મને એક યા બીજા સ્વરૂપે અલ્પ કે અધિક અંશે સહાયક નીવડી છે તેના પ્રણેતાઓનો તેમજ એના પ્રકાશકોનો વ્યક્તિગત ઉલ્લેખ કરી આભાર માનવાનું આ સ્થળે શક્ય નહિ હોવાથી હું એમનો સામુદાયિક સ્વરૂપે આભાર માનું છું. આ પુસ્તકમાં મેં જે અન્યાન્ય કૃતિઓનો તેમજ લેખો વગેરેનો ઉલ્લેખ કર્યો છે તેમાંથી મેં શેનો શેનો શી શી રીતે ઉપયોગ કર્યો છે તે, તે વિષયના નિષ્ણાતોને કહેવું પડે તેમ નહિ હોવાથી તેમજ આ પુસ્તક માટે અમુક મર્યાદા નક્કી કરાયેલી હોવાથી એ વિષે હું ઉલ્લેખ કરતો નથી.

આ સમગ્ર પુસ્તકના બંને ખંડનાં તમામ પ્રકરણોને તેમજ લલિત અને દાર્શનિક સાહિત્ય અંગેના વિભાગોને કયા ક્રમે રજૂ કરવા તે વિષે વિચારોની આપેલી કરવાની મને આવશ્યકતા જણાતાં એ કાર્યમાં મને અહીંની એમ ટી. બી. કોલેજના ભૂતપૂર્વ સંસ્કૃતના પ્રાધ્યાપક શ્રીમોહનલાલ પાર્યતીશંકર દવેએ સાનંદ સહકાર આપ્યો હતો એટલે એની હું અહીં સાભાર નોંધ લઉં છું.

પરિશિષ્ટોનું લખાણ તપાસી જવામાં મને મુનિશ્રી સૂર્યોદયવિજયજીએ જે સહકાર આપ્યો હતો તે બદલ હું એમનો ઋણી છું.

P-૭૪

આ પુસ્તકના ત્રણે વિભાગની મુદ્રણાલય-પુસ્તિકા (Press-Copy) મારી પુત્રી ચિ. મનોરમા એમ. એ., બી. ટી. દ્વારા તૈયાર થઈ છે અને મારું મૂળ લખાણ એ સાથે મેળવી જવામાં અને પરિશિષ્ટો માટે નામોની તારવણી વગેરે કરવામાં મારી ધર્મ-પત્ની ઈન્દિરાએ મને સહાય કરી છે. આ બંને મારાં સ્વજનો હોઈ મારે એમનો ઉપકાર માનવો કે કેમ અને માનવો હોય તો શી રીતે એ પ્રશ્ન મને મુંઝવે છે એટલે આટલેથી જ હું વિરમું છું.

સાંકડી શેરી, ગોપીપુરા, સુરત
વિક્રમ સંવત્-૨૦૧૨
અષાઢ કૃષ્ણ એકાદશી
(તા. ૨-૮-'૧૬)

હીરાલાલ ર. કાપડિયા

તા. ૬. (૧) “અનુલેખ”માં વ્યાકરણ વગેરે જે જે વિષયની વધારાની કૃતિનો પરિચય મેં આપ્યો છે તે તે વિષયની જૈન કૃતિઓની સંખ્યામાં તે પ્રમાણમાં વધારો સમજી લેવાનો છે.

(૨) સમગ્ર પુસ્તક તૈયાર કરી પ્રકાશન સંસ્થાને સોંપાયા પછી પ્રસિદ્ધ થયેલાં પુસ્તકો વગેરેને લગતા ઉલ્લેખો મેં આ ખંડના મુદ્રણ-કાર્ય દરમ્યાન કોઈ કોઈવાર કર્યા છે એટલો કાલાનુક્રમદોષ (Anachronism) હું સ્વીકારું છું.

(૩) ઉપોદ્ધાતમાંનાં વિશેષનામોને પરિશિષ્ટ ૧-૩ પ્રમાણે વિભક્ત કરી મેં એની સૂચી તૈયાર કરી છે પણ અત્યારે તો એ છપાવાય તેમ નથી.

પૂર્તિ— ઉપોદ્ધાતનું પૃ.૭૨ સુધીનું લખાણ છપાઈ ગયા બાદ મને અલંકારચંદ્રિકા અને અલંકારચૂર્ણની જે એકેકે હાથપોથી જિ. ૨. કો. (ખંડ ૧, પૃ.૧૭)માં નોંધાયેલી છે તે શ્રીમાણિક્યસાગરસૂરિજી પાસે જોવા મળી. અલંકારચંદ્રિકાની હાથપોથીનો ક્રમાંક ૨૩૮૦ છે. એમાં ૧૭ પત્ર છે. એમાં અપ્પય્ય દીક્ષિતે રચેલી મનાતી અને કાવ્યશાસ્ત્રને લગતી કુવલયાનન્દકારિકા નામની અજૈન કૃતિનું ‘લક્ષ્યલક્ષણ’ નામનું ૧૫૭ પદ્યનું પ્રથમ પ્રકરણ અપાયું છે. વિશેષમાં આ અજૈન કૃતિ ઉપર આશાધર ભટ્ટે અલંકારદીપિકા નામની જે વ્યાખ્યા રચી છે તેનું “ગુણદોષો બુધો”થી શરૂ થતું પદ્ય એમાં પત્ર ‘આ માં ત્રીજા પદ્ય તરીકે ગૂંથી લેવાયું છે. અંતમાં અપાયેલી પુષ્પિકામાં ભટ્ટ વિઠ્ઠલસૂરિના પુત્ર રામચંદ્રસૂરિના પુત્ર વૈદનાથે અલંકારચંદ્રિકા રચ્યાનો ઉલ્લેખ છે. આ હાથપોથીમાં કુવલયાનન્દકારિકાના પદ્યો લખતી વેળા એની અલંકારચંદ્રિકા નામની ટીકા લખી શકાય એવી રીતે એ પદ્યો વચ્ચે કોરી જગ્યા રખાઈ છે ખરી પણ એ ટીકા એમાં લખાઈ નથી. એ ટીકા અનેક સ્થળેથી પ્રસિદ્ધ થયેલી છે. એ ટીકાના રચનાર અજૈન છે એટલે આ પુસ્તકમાં અલંકારચંદ્રિકાનો ઉલ્લેખ જે મેં પૃ.૧૭૮માં કર્યો છે તે રદબાતલ ગણી લેવો. [આ આવૃત્તિમાં દૂર કર્યો છે.]

P-૭૫

અલંકારચૂર્ણની— હાથપોથીનો ક્રમાંક ૧૭૮૯ છે. એમાં બાર પત્ર છે. એ દરેક પત્રને બન્ને બાજુએ લગભગ ૩૨ અક્ષરની એકેક પંક્તિ એવી તેર પંક્તિઓ છે. આની પુષ્પિકા જોતાં આ કૃતિનું ખરું નામ અલંકારાવચૂરિ છે. આ અવચૂરિ ૩૫૦ શ્લોક જેવડી અને ઓછામાં ઓછા પાંચ પરિચ્છેદ પૂરતી કોઈ કાવ્યશાસ્ત્રવિષયક કૃતિની નાનકડી-૧૫૦૦ શ્લોક જેવડી વૃત્તિ છે. આ અવચૂરિમાં મૂળ કૃતિના પ્રતીક અપાયાં છે. પ્રારંભિક ભાગ નીચે મુજબ છે.

“અથ (૧) સાન્ વ્યાચિચ્છ્યાસુરાહ સાધુપાં યથા ભોજ્યં શાલિદાલિપ્રભૃતિસાધુપાકેડપિ સૂપકારેણ નિષ્પાદિતેડપિ નિર્લવણં સત્ અનાસ્વાદ્યં અસ્વાદુ સ્યાત્ તથૈવ કાવ્યં કુશલકવિકૃતમપિ શૃંગારાદિરસરહિતં અનાસ્વાદ્યં ન ચતુરચેતાંસિ ચમત્કરોતિ ॥”

P-૭૬

પત્ર ૫-અમાં નીચે મુજબની પાંચમી પંક્તિ છે.

“નાયિકભેદાનાં લક્ષણાન્યાહ નીલીં પ્રિયં”

વિશેષ પ્રતીકો એકત્રિત કરાતાં મૂળ કૃતિ શી છે તે જણાવા સંભવ છે પણ અત્યારે એ કાર્ય મારાથી થઈ શકે તેમ નથી. ગમે તેમ પણ આ અવચૂરિમાં એક સ્થળે (પત્ર-૧૨ અમાં) જિનનો ઉલ્લેખ છે અને આ ટીકાનો ‘અવચૂરિ’ તરીકે નિર્દેશ છે એ જોતાં આ અવચૂરિ કોઈક જૈને રચ્યાનું કલિત થાય છે.

ચંત્રરાજ— આની એક આવૃત્તિની નોંધ મેં પૃ.૧૩૬માં લીધી છે પણ એ આવૃત્તિની નકલ હજી સુધી તો મળી નથી. હાલમાં “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી ઇ. સ. ૧૯૩૬માં પ્રકાશિત યંત્રરાજ નામનું પુસ્તક મારા જોવામાં આવ્યું છે. એ ઉપરથી મેં “યંત્રરાજનું રેખાદર્શન” નામનો લેખ લખી એમાં યંત્રરાજ અને એની મલયેન્દુસૂરિકૃત ટીકા વિષે વિસ્તારથી વિચાર કર્યો છે. એ લેખ અત્યારે તો અપ્રકાશિત છે એટલે આને અંગે અહીં સંક્ષિપ્ત પરિચય આપું છું.

P-૭૭ **યંત્રરાજ**— નામની સંસ્કૃત કૃતિ પાંચ અધ્યાયમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૭૩ (૭૧+૨), ૭, ૨૮, ૩ અને ૬૭ પદો છે. કર્તાએ આઘ પદમાં પ્રસ્તુત કૃતિને સદ્યંત્રરાજાગમ અને અંતિમ પદમાં યંત્રરાજાગમ કહી છે. પાંચે અધ્યાયોનાં નામ સાન્વર્થ છે. એ નીચે મુજબ છે.

ગણિત, યંત્રઘટના, યંત્રરચના, યંત્રશોધન અને યંત્રવિચારણા.

સર્વજ્ઞના ચરણકમળનો અને મદનસૂરિ નામના ગુરુનો હૃદયમાં પરામર્શ કરીને યંત્રરાજની રચના કરાઈ છે. પ્રથમ અધ્યાયમાં જ્યા, કાન્તિ, દ્યુજ્યાના ફળ, સૌમ્ય યંત્ર અને યામ્ય યંત્રને અંગે ઈષ્ટ અક્ષાંશોના ઉત્તર વલય-કેન્દ્રના વ્યાસાર્ધ, સાયન સૂર્ય દ્વારા બત્રીસ નક્ષત્રો અને ધ્રુવકો, નક્ષત્રોમાં દૃકકર્મ ઇત્યાદિ લાવવાની રીત દર્શાવાઈ છે. બીજા અધ્યાયમાં યંત્રની રચનાનો પ્રકાર વિચારાયો છે. ત્રીજામાં યંત્રના ભેદો તેમજ સૌમ્ય યંત્ર વગેરેને અંગે કેટલાંક સાધનોની સમજણ અપાઈ છે. ચોથામાં યંત્રના શોધનનો વિચાર કરાયો છે. પાંચમામાં ગ્રહો અને નક્ષત્રોનો અંશો લાવવાની રીત, બાર આંગળના શંકુ ઉપરથી સાત આંગળના શંકુની તેમજ સાત આંગળના શંકુ ઉપરથી બાર આંગળના શંકુની છાયા લાવવાની રીત તેમજ યંત્ર દ્વારા ભૌમાદિના ઉદય અને અસ્તનું જ્ઞાન એમ વિવિધ બાબતો વિચારાઈ છે.

ટીકા— મલયેન્દુસૂરિએ આ સંસ્કૃત ટીકાની શરૂઆત એક પદથી કરી છે. વળી પ્રત્યેક અધ્યાયને અંતે પણ એકેક પદ છે. પાંચમા અધ્યાયને અંતે ત્રણ વધારાનાં પદો છે. ટીકામાં વિવિધ કોષ્ટકો અપાયાં છે એથી એનું મહત્ત્વ વધ્યું છે.

—હી. ર.



૧. એમાં યંત્રરાજ ઉપરની મલયેન્દુસૂરિએ રચેલી ટીકા, વિશ્રામકૃત યંત્રશિરોમણિ તેમજ ચોદ યંત્રને સ્થાન અપાયું છે. એનું સંપાદન અહીંના જોષી કૃષ્ણશંકર કેશવરામ રૈફ્વેએ કર્યું છે. એમણે ટીકા યંત્રરાજ તેમજ યંત્રશિરોમણિનો સંસ્કૃતમાં વિષયાનુક્રમ આપ્યો છે.

॥ શ્રી વીતરાગાય નમઃ ॥

જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ

ખંડ ૧ : સાર્વજનીન સાહિત્ય

પ્રકરણ ૧ : પ્રાસ્તાવિક

P. ૧

ભાષાના ઉદ્ભવનો સમય—‘જગત્ એટલે શું ?’ અને ‘એ ક્યારથી ઉદ્ભવ્યું ?’ એ બાબત વિવિધ મંતવ્યો પ્રવર્તે છે. આધુનિક વૈજ્ઞાનિકોનું—રસાયણશાસ્ત્રીઓનું માનવું એ છે કે પુદ્ગલ (matter) અવિનાશી છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે પુદ્ગલાત્મક જગત્ અનાદિ અનંત છે. જૈનદર્શનનું પણ મંતવ્ય આ જ છે, પરંતુ પુદ્ગલરૂપ નિર્જીવ પદાર્થ કાલાંતરે—ભલે યુગોના યુગો—કલ્પોના કલ્પો પછીથી યે સજીવ બન્યો P. ૨ અને બને છે એ આધુનિક જીવનશાસ્ત્ર (biology)ના મત સાથે તો એ મળતું આવતું નથી.

આપણે આજે જે પૃથ્વી ઉપર જીવીએ છીએ એ પૃથ્વીનું આયુષ્ય આશરે અઢી અબજ વર્ષનું છે, એમ સર જેઈમ્સ જીન્સ જેવા કેટલાક આધુનિક વિદ્વાનોનું કહેવું છે. વિશેષમાં એમની માન્યતા મુજબ મનુષ્ય અને વાનરના એક જ જાતના પૂર્વજોનો ઉદ્ભવ થયાને ઘણું કરીને ત્રણથી સાડાત્રણ કરોડ વર્ષો વ્યતીત થયાં છે.^૧ વળી આ પૃથ્વી ઉપર વસતા બધા જ મનુષ્યોનો જે એક જ જાતમાં સમાવેશ કરાય છે તે જાતની ઉત્પત્તિ લગભગ દસ લાખ વર્ષો પહેલાં થયેલી મનાય છે.^૨

કેટલાક આધુનિક ભાષાશાસ્ત્રીઓનું એમ માનવું છે કે આજે જે અનેક પ્રકારની ભાષાઓથી આપણે આ પૃથ્વી ઉપર રહેનારા માનવીઓ પરિચિત છીએ તે પ્રથમથી જ આ જ સ્વરૂપે હતી નહિ, પરંતુ ધીરે ધીરે વિકસિત થયેલી છે. આ હિસાબે મનુષ્યને વાચા કૃત્તાં અને એ વાણી સાહિત્યની ભાષા તરીકે ઘડાતાં એકાદેક લાખ વર્ષો વ્યતીત થયાં હશે. એ હિસાબે સાહિત્યની પ્રથમ કૃતિ આઠેક લાખ વર્ષો ઉપર ઉદ્ભવેલી ગણાય. જૈન દષ્ટિ પ્રમાણે તો મનુષ્ય-જાતિ અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી રહેવાની છે. વળી પ્રત્યેક મનુષ્યની વાણીની શરૂઆત મનુષ્ય તરીકેના એ જીવનના જન્મ બાદ ‘ભાષા-પર્યાપ્તિ’ નામ-કર્મના ઉદયકાળથી P. ૩ થાય છે. એમ પણ એ માને છે.

ભાષાનું વર્ગીકરણ—જૈન દષ્ટિ સમગ્ર ભાષાઓને સંસ્કૃત અને પાઈય (પ્રાકૃત) એમ બે વિભાગોમાં

૧. જુઓ પ્રો. ડૉ. રતિલાલ દેવચંદ આડતિયાનું સને ૧૯૫૧નું “માનવ ઉત્પત્તિ અને વિકાસ” નામનું ભાષણ (પૃ. ૧૯). આ ભાષણ સને ૧૯૫૦ અને ૧૯૫૧નાં અન્ય ભાષણો સહિત મુંબઈની “જ્ઞાન પ્રસારક મંડળી” તરફથી સને ૧૯૫૨માં પ્રકાશિત થયેલાં છે.
૨. જુઓ ઉપર્યુક્ત ભાષણ (પૃ. ૧૯).
૩. જાતજાતની ભાષાઓ અને બોલીઓના—દહર પ્રકારની વાણીના નમૂના The Gospel in Many Tonguesમાં જોવા મળે છે. ઈ. સ. ૧૯૩૫માં છપાયેલા આ પુસ્તકમાં વિવિધ લિપિના પણ નમૂના છે.

વિભક્ત કરે છે.’ આનો એક રીતે વિચાર કરીએ તો ‘સંસ્કૃત’ ભાષા એ પાઈય ભાષાનું વ્યાકરણાદિની દૃષ્ટિએ—શિષ્ટતાદિની અપેક્ષાએ ઘડાયેલું સ્વરૂપ છે. આ હિસાબે તો સંસ્કૃત ભાષા પાઈયની જેમ અનાદિ કાળની ઠરે. અહીં જે ‘સંસ્કૃત સાહિત્ય’નો વિચાર કરવાનો છે તેને આ અનાદિકાલીન સંસ્કૃત સાથે સીધો સંબંધ નથી એટલું જ નહિ, પરંતુ સમગ્ર દુનિયામાં આજે જે પ્રાચીનમાં પ્રાચીન કૃતિ તરીકે ઋગ્વેદનાં અમુક મંડળો અને કેટલીક વાર અથર્વવેદનો અમુક ભાગ ગણાવાય છે એ ‘વૈદિક’ ભાષા સાથે પણ સાક્ષાત્ નિસ્ખત નથી. આ વૈદિક ભાષાના વિવિધ પરિવર્તનો થયાં છે. ઋગ્વેદ વગેરે વેદો જે ભાષામાં ગ્રન્થસ્થ સ્વરૂપે આજે આપણને ઉપલબ્ધ છે, એ ભાષાની નાની બેનરૂપ ‘અવેસ્તા’ ભાષામાં લખાયેલા પારસીઓના ધાર્મિક ગ્રંથોની તેમજ વેદોના પ્રણયનકાલ પછીના રચાયેલા ‘બ્રાહ્મણોની ભાષા ઋગ્વેદ આદિની ભાષાથી થોડીઘણી ભિન્નતા ધરાવે છે. આ બ્રાહ્મણો પૈકી કેટલાકથી તો યાસ્કનું નિરુક્ત અર્વાચીન છે જ. એની ભાષા એ પ્રાચીન બ્રાહ્મણોથી અંશતઃ ભિન્ન છે. યાસ્કે નિરુક્તની ભાષાને ‘ભાષા’ કહી છે. આ નિરુક્તની રચના બાદ ઉપનિષદોનું સર્જન થયું છે. આગળ જતાં કોઈ વિદ્વાનના મતે ઈ. સ.ની પૂર્વે છઠ્ઠી સદીમાં અને અન્ય કેટલાકના મતે ઈ. સ.ની પૂર્વે ચોથી સદીમાં પાણિનિ થયા. એમણે અષ્ટાધ્યાયી નામનું વ્યાકરણ રચી એમના સમયમાં શિષ્ટ P. ૪ જનોમાં બોલાતી ભાષાને નિયંત્રિત કરી. આ ભાષાને ‘વૈદિક’ યાને ‘છાંદસ’ ભાષાથી ભિન્ન બતાવવા તેમજ એમાંથી એની ઉત્પત્તિ સૂચવવા લૌકિક (classical) સંસ્કૃત એવું નામ આધુનિક વિદ્વાનોએ આપ્યું છે. આ વ્યાકરણમાં નહિ નોંધાયેલા એવા કેટલાક પ્રયોગો ‘ભાસની કૃતિઓમાં મળે છે. તેમ છતાં એની પણ ભાષા તો આ લૌકિક સંસ્કૃત જ છે, અને ભાસ પછી થયેલા દરેક સંસ્કૃત ગ્રંથકારની ભાષા આ જ રહી છે. આજે પણ આ ભાષામાં પુસ્તકો રચાય છે (નહિ કે વૈદિક ભાષામાં) અને પ્રસંગવશાત્ ભાષણો અપાય છે એટલે આ દૃષ્ટિએ તો આ ભાષા જીવંતીજાગતી જ છે. એ મૃત ભાષા (dead language) ન જ ગણાય અને ગણાવી પણ ન જ જોઈએ.

જૈન લિપિબદ્ધ સાહિત્ય શ્રમણ ભગવાન મહાવીરસ્વામી (ઈ. સ. પૂર્વે ૫૮૯ થી ઈ. સ. પૂર્વે ૫૨૭) પૂર્વેનું મળતું નથી. એ રીતે વિચારતાં જૈનોને હાથે સંસ્કૃતમાં લખાયેલી તમામ કૃતિઓ અશ્વઘોષ, ભાસ વગેરેના ગ્રંથોની પેઠે લૌકિક સંસ્કૃત ભાષામાં જ છે.

ભાષા કોની ?—ભાષા એ તો વિચારોને વ્યક્ત કરવાનું એક વાહન છે (અને એ પણ સર્વાંશે સંપૂર્ણ નથી) તો પછી અમુક ભાષા તે અમુક લોકોની કે અમુક સંપ્રદાયની છે એમ કેમ કહેવાય ? જે કોઈ જે ભાષા બોલે એમાં વિચાર કરે અને લખે તેની તે ભાષા ગણાય તેમ છતાં એવો ભ્રમ સેવાતો જોવાય છે કે જાણે ‘વૈદિક’ ભાષા અર્થાત્ વેદાદિની સંસ્કૃત ભાષા તે બ્રાહ્મણોની જ, ‘અવેસ્તા-પહેલવી’ તે પારસીઓની જ, ‘પાલિ’ તે બૌદ્ધોની જ અને ‘અદ્ભમાગહી’ (અર્ધમાગધી) તે જૈનોની જ ભાષા છે. આ વસ્તુસ્થિતિ સાચી નથી P. ૫ એ મેં પાઈય (પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય નામના મારા પુસ્તકમાં સૂચવ્યું છે. એમાં મેં મરહૂમ અને સોરસેણીના ભેદ ગણાવતાં ‘જઈણ’ વિશેષણ જે વાપર્યું છે તે આધુનિક પાશ્ચાત્ય વિદ્વાનોના કથનને અનુલક્ષીને છે.

૧. જુઓ ઠાણ (ઠા. ૭; સુત ૫૫૩; પત્ર ૩૮૪અ.)

૨. યજ્ઞસંગે કામમાં લેવાતા મંત્રોના ઉપયોગ અને અર્થ ઉપર પ્રકાશ પાડનારાં આ એક જાતનાં વિવરણ છે.

૩. એમની કૃતિઓમાં કેટલેક સ્થળે ‘અપાણિનીય’ ગણાય એવા પ્રયોગો છે. જુઓ ભાસનાટકચક્રનું દ્વિતીય પરિશિષ્ટ (પૃ. ૫૬૯-૫૭૩).

‘જૈન’ સંસ્કૃત—બ્લૂમફીલ્ડે જૈનોની કેટલીક સંસ્કૃત કૃતિઓની ભાષાને ‘જૈન સંસ્કૃત’ કહી છે. એનું કારણ એ છે કે એ ભાષા અષ્ટાઠને સર્વાંશે અનુસરતી નથી એટલું જ નહિ પણ એના ઉપર અ. મા. નો—પાઈય ભાષાનો પાસ જોવાય છે. તેમ છતાં આ ભાષા “‘આદું ચ મરચાં’” જેવા શ્લોક દ્વારા સૂચિત બનાવટી સંસ્કૃત નથી જ.

ખરેખરી સંસ્કૃત ભાષા ગણાય એવી ભાષામાં અનેક ગ્રંથો જૈનોને હાથે રચાયેલા છે. એના હિસાબે “‘ઘોટકે ચિતિતઃ’” જેવા “જૈન સંસ્કૃત”માં બહુ ઓછા ગ્રંથો—ગ્રંથાંશો છે. એની પણ હું અહીં નોંધ લેનાર છું.

મર્યાદા—અત્યાર સુધીમાં જેટલી કૃતિઓ આ દેશના કે અન્ય દેશના કોઈ પણ માનવીને હાથે રચાઈ છે તે નિરવધિ કાળ પર્યંત સચવાઈ જ રહે એમ બને જ નહિ. આથી તો આપણને અનેક ગ્રંથકારોની કૃતિ આજે મળતી નથી. જૈન સાહિત્ય પૂરતો વિચાર કરીશું તો જણાશે કે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના જન્મ પ. ૬ પૂર્વે કોઈ સાર્વજનીન જૈન કૃતિ રચાઈ હોય તો તે જળવાઈ રહી નથી. વળી ધાર્મિક સાહિત્યને અંગે પણ એમની પૂર્વે થઈ ગયેલા ‘પુરુષાદાનીય’ પાર્શ્વનાથ (ઈ. સ. પૂર્વે ૮૭૭—ઈ. સ. પૂર્વે ૭૭૭)ના તીર્થમાં રચાયેલી દ્વાદશાંગી પણ સચવાઈ રહી નથી. હા, એમ બન્યું હોય કે એમાંના કેટલાક ભાગોને વિનયમૂર્તિ ઈન્દ્રભૂતિ વગેરે અગિયારે ગણધરોએ જે જે એકેકે દ્વાદશાંગી રચી તે પૈકી સુધર્મસ્વામી નામના પાંચમા ગણધરકૃત દ્વાદશાંગીમાં સ્થાન અપાયું હોય. આવા ભાગો કઈ ભાષામાં હશે અને એ કયા હશે એનો સર્વમાન્ય નિર્ણયાત્મક ઉત્તર આપવાનું કોઈ સાધન જણાતું નથી. પાંચમા ગણધરે રચેલી દ્વાદશાંગી પણ સર્વાંશે આજે ઉપલબ્ધ નથી. દિઢિવાય નામનું બારમું અંગ આજે મળતું નથી, એનો મહત્ત્વનો અને મહાકાય વિભાગ નામે ‘પુવ્વગય’ લુપ્ત થયો છે. એના ચૌદ વિભાગરૂપ ચૌદ ‘પુવ્વ’ (પૂર્વ) સંસ્કૃત ભાષામાં રચાયાં હોવાની માન્યતાનું સમર્થન પ્રાચીન અવતરણરૂપ એકાદ બે પદ્યો અને ખાસ કરીને તો પ્રભાચંદ્રસૂરિએ વિ. સં. ૧૩૩૪માં રચેલા પ્રભાવકચરિત (શુંગ ૮, શ્લો. ૧૧૩)માં કરેલા નિર્દેશ દ્વારા થઈ શકે તેમ છે, પરંતુ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત વિસેસાવસ્સયભાસગત નિહવ—વાદને અંગે ‘મલધારી’ હેમચન્દ્રસૂરિએ પોતાની ટીકામાં પુવ્વમાંથી ઉદ્ધૃત કરાયેલી જે પંક્તિઓ આપી છે એ તો પાઈય ભાષામાં છે તેનું કેમ એમ એની વિરોધનો સૂર પણ ઉઠાવી શકાય તેમ છે.^૧ આવી પરિસ્થિતિમાં પણ ચૌદ પુવ્વની મોટા ભાગની ભાષા સંસ્કૃત હશે એમ માની લઈએ તો પણ એ ભાષામાં કયા કયા વિષયો ચર્ચાયા હશે તેનો નિર્ણય કરવા માટે આશરે પંદરસો વર્ષ પૂર્વેનું કોઈ સાધન પ. ૭ જણાતું નથી. આથી કરીને ઉપલબ્ધ જૈન સંસ્કૃત સાહિત્યની કોઈ પણ કૃતિ ઈ. સ.ના પહેલા સૈકાની પૂર્વે રચાયેલી છે એમ ભાગ્યે જ કહી શકાય. આથી તો આ પુસ્તકમાં જે વિવિધ વિષયોની કૃતિઓ હું વિચારવા ઈચ્છું છું તેની એક કાલ-મર્યાદા આ પ્રમાણેની છે. જ્યારે બીજી કાલમર્યાદા તરીકે મેં પહેલાં તો ‘ન્યાયાચાર્ય’ ‘ન્યાયવિશારદ’ યશોવિજયગણિનો લગભગ વિ. સં. ૧૭૪૩ સુધીનો જીવન-કાળ પસંદ કર્યો હતો (કેમ કે

૧. “આદું ચ મરચાં લસણં ચ લીમ્બું, ધાણાશ્ચ જીરૂં મીતું નાહી દેવું ।

પાષાણમધ્યે પરિમર્દયામિ, इदं प्रमाणे चटणी भवन्ति ।।”

આવાં અન્ય ઉદાહરણો માટે—સંસ્કૃતાભાસના નમૂના માટે જુઓ મારો “ગુજરાતમિત્ર તથા ગુજરાતદર્પણ”ના તા.

૧૮-૫-૪૭ના અંકમાં પ્રકાશિત થયેલો લેખ નામે ‘બનાવટી સંસ્કૃત’

૨. આ ચર્ચા માટે જુઓ મારાં પુસ્તકો નામે A History of the canonical Literature of the Jainas (પૃ. ૮૯-૯૦) અને આગમોનું દિગ્દર્શન (પૃ. ૨૧૨-૨૧૩).

એમના સ્વર્ગવાસ પછી ભાગ્યે જ કોઈ નોંધપાત્ર જૈન મૌલિક કૃતિ સંસ્કૃતમાં રચાયેલી હશે) પરંતુ સાહિત્યના ઇતિહાસના કેટલાક આધુનિક લેખકોએ પોતાના સમય સુધીની કૃતિઓનો પરિચય આપ્યો છે એથી તેમજ એ દ્વારા છેલ્લાં અઢીસો વર્ષ દરમ્યાન કઈ જાતની સાહિત્યપ્રવૃત્તિએ વેગ પકડ્યો છે તેનો ખ્યાલ આપવો ઉચિત જણાવાથી હું પ્રથમ વિચારને છોડી દેવાની તૈયારીમાં હતો તેવામાં અહીં (સુરતમાં) જૈનાચાર્ય શ્રીવિજયપ્રતાપસૂરીશ્વરના શિષ્યરત્ન આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીનું આગમન થતાં તેમની ઈચ્છા પણ આજ દિન સુધીની સમુચિત કૃતિની નોંધ લેવાય તો સારું એવી હોવાથી મેં કાલ-મર્યાદા લંબાવી છે, જો કે પ્રકાશક તરફથી નક્કી કરાયેલી પૃષ્ઠસંખ્યામાં રહીને કામ કરવાનું હોવાથી મુખ્ય મુખ્ય કૃતિઓની પ્રસંગોપાત્ત નોંધ લઈ સંતોષ માનવો પડ્યો છે - પૂર્વગામી ગ્રંથોની પેઠે પરિચય આપવાનું માંડી વાળવું પડ્યું છે.

વર્ગીકરણ—જૈન ધર્મના અનુયાયીઓએ ભારતવર્ષની વિવિધ ભાષાઓમાં કૃતિઓ રચી છે. એમના મહામૂલ્યશાળી ઉપલબ્ધ આગમો અર્ધમાગધીમાં રચાયેલા હોવા છતાં એમણે સંસ્કૃત ભાષાને પણ સમુચિત સ્થાન આપવામાં સંકોચ રાખ્યો નથી. વિશેષમાં જે કોઈ ગ્રંથ પોતાના શિષ્યાદિના પઠનપાઠન માટે ઉપયોગી લાગ્યો તેના ઉપર તેમજ અન્ય રીતે પણ જે મહત્વનો જણાયો તેના ઉપર એમણે વિવરણ રચ્યાં છે. પછી P. ૮ ભલેને એ ગ્રંથ અજૈન સંપ્રદાયનો કેમ ન હોય ? કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પૈકી ત્રીજા પુરુષાર્થને જ પ્રધાનપણે ઉદ્દેશીને લખાયેલો પણ કેમ ન હોય ? વળી એમણે પાઈય કૃતિઓ ઉપર પણ સંસ્કૃત ભાષામાં વિવરણો રચ્યાં છે અને કેટલીક વાર એના પ્રતિસંસ્કૃતરૂપ સાહિત્ય પણ સર્જ્યું છે. આ ઉપરાંત એમણે ‘સમસંસ્કૃત’ કૃતિઓની જેમ ‘અર્ધસંસ્કૃત’ કૃતિઓ અને એક જ વાક્યમાં અમુક અંશ સંસ્કૃતમાં અને બાકીનો પાઈયમાં હોય એવી એટલે કે ‘મિશ્રભાષામાં’ ગુંથાયેલી કૃતિઓ અથવા વચ્ચે વચ્ચે સંસ્કૃત ભાષાની કંડિકાઓ હોય એવી પણ પાઈય કૃતિઓ રચી છે. આને લઈને એમણે રચેલી સંસ્કૃત કૃતિઓને આપણે નીચે મુજબના મુખ્ય સાત વર્ગમાં વિભક્ત કરી શકીએ :-

- | | |
|-------------------------------------------------------|--------------------------------------------|
| (૧) સ્વતંત્ર સંસ્કૃત કૃતિઓ. | (૪) અજૈન સંસ્કૃત ગ્રંથોનાં સંસ્કૃત વિવરણો. |
| (૨) સંસ્કૃત કૃતિઓનાં સ્વોપજ્ઞ સંસ્કૃત વિવરણો. | (૫) જૈન પાઈય કૃતિઓનાં સંસ્કૃત વિવરણો. |
| (૩) ભિન્નકર્તૃક જૈન સંસ્કૃત ગ્રંથોનાં સંસ્કૃત વિવરણો. | (૬) અજૈન પાઈય કૃતિઓના સંસ્કૃત વિવરણો. |
| | (૭) પ્રતિસંસ્કૃત સાહિત્ય. |

હવે આપણે આ વર્ગોનો વિષયદીઠ વિચાર કરીશું.

Cosmology : Old and New Pro. G. R. Jain “ભારતીય જ્ઞાનપીઠ”

Ambika : In Jain Art And Literature. લે. મારુતિનંદન તિવારી “ભારતીય જ્ઞાનપીઠ”



૧. સરખાવો અંગ્રેજીમાં macaronic તરીકે ઓળખાવાતી કૃતિઓ, આ શબ્દનો અર્થ “ધ કોન્સાઈઝ ઓફસર્ફડ ડિક્શનરી”માં નીચે મુજબ અપાયો છે :-

“(verses) of burlesque form containing Latin (or other foreign) words & vernacular words with Latin etc. terminations”.

પ્રકરણ ૨ : વ્યાકરણ

P. ૯

પર્યાય—વ્યાકરણ કહો કે શબ્દશાસ્ત્ર કહો, શબ્દાગમ કહો કે શબ્દાનુશાસન કહો એ એક જ છે. એને અંગ્રેજીમાં ગ્રામર (grammar) કહે છે. ‘કલિકાલસર્વજ્ઞ’ હેમચન્દ્રસૂરિએ **અભિધાનચિન્તામણિ** (કાંડ ૨, શ્લો. ૧૬૪-૧૬૫)માં વેદના નીચે મુજબ છ અંગો ગણાવ્યાં છે :—

(૧) ^૧શિક્ષા, (૨) ^૨કલ્પ, (૩) વ્યાકરણ, (૪) છંદ, (૫) જયોતિષ અને (૬) ^૩નિરુક્ત.

વ્યાકરણની પ્રાચીનતા—ઉપર્યુક્ત અંગો પૈકી બીજા અને પાંચમા અંગો સિવાયનાં બાકીનાં ચારે તો ભાષાશાસ્ત્રને લગતાં છે. અને ત્રીજું અંગ તે વ્યાકરણ છે. આ ઉપરથી વ્યાકરણના પરામર્શની પ્રાચીનતાનો કંઈક ખ્યાલ આવી શકશે. ઋગ્વેદમાં કેટલાક શબ્દોની વ્યુત્પત્તિ નજરે પડે છે. બ્રાહ્મણ તરીકે ઓળખાવાતા ગ્રંથોમાં ગોપથ (૧-૨૪) વગેરેમાં વ્યાકરણને લગતી કેટલીક સંજ્ઞાઓનાં નામ જોવાય છે. જેમકે લિંગ, વચન, વિભક્તિ, આખ્યાત, કુર્વન્ત (કૃદન્ત) ઇત્યાદિ. વિવિધ પ્રાતિશાખ્યો વ્યાકરણ-વિષયક કેટલીક માહિતી પૂરી પાડે છે. ઈ.સ. પૂર્વે ૬૦૦ કરતાં તો પહેલાં થઈ ગયેલા યાસ્કનું **નિરુક્ત** વ્યાકરણના ક્ષેત્રમાં એ સમયમાં થયેલા વિકાસ ઉપર વેધક પ્રકાશ પાડે છે. એમાં આપણને નામ, સર્વનામ, આખ્યાત, ઉપસર્ગ, નિપાત વગેરે શબ્દો નજરે પડે છે. યાસ્કના સમય પહેલાં વ્યાકરણનું ક્ષેત્ર ખૂબ ખેડાયું હશે એમ લાગે છે, કેમકે એ આચાર્ય P. ૧૦ ‘પ્રાચ્ય’ અને ‘ઉદીચ્ય’ એવી બે શાખાઓનો ભેદ દર્શાવતાં વીસેક આચાર્યોનાં નામ ગણાવે છે. એમાં શાકટાયન, ગાર્ગ્ય અને શાકલ્ય એ નામો સુપ્રસિદ્ધ છે. આ શાકટાયને તો દરેક શબ્દની નિષ્પત્તિ ધાતુમાંથી માની છે. આમ આપણા દેશમાં વ્યાકરણનું ક્ષેત્ર ઓછામાં ઓછાં ચારેક હજાર વર્ષોથી ખેડાયું છે, અને જાતજાતનાં વ્યાકરણો રચાયાં છે.

ઈન્દ્ર (ઐન્દ્ર) વ્યાકરણ— (લ.ઈ.સ. પૂર્વે ૧૦૦૦)

[૧]

પાણિનિકૃત અષ્ટા૦ (અધ્યાય ૧, પાદ ૧, સૂ. ૧) ઉપરના મહાભાષ્ય (આદિક ૧ પૃ. ૧૮, ચૌખંબા સિરિઝ)માં પતંજલિએ કહ્યું છે કે બૃહસ્પતિએ દિવ્ય સહસ્ર વર્ષો સુધી^૧ પદે પદે કહેલા શબ્દોનું શબ્દ-પારાયણ કહ્યું અર્થાત્ એકેક શબ્દ છૂટો છૂટો કહ્યો.^૨ **તૈત્તિરીયસંહિતા** (૬-૪-૭)માં નીચે મુજબ ઉલ્લેખ છે :—

“વાગ્ વૈ પરાચ્યવ્યાકૃતાઽવદત્ । તે દેવા ઇન્દ્રમબ્રુવન્ -

इमां नो वाचं व्याकुर्विति ।...तामिन्द्रो मध्यतोऽवक्रम्य व्याकरोत् ॥”

૧. આમાં વર્ણોનું વિવેચન છે.

૨. આનો અર્થ ‘આચાર’ થાય છે.

૩. આનો વિષય વ્યુત્પત્તિ છે.

૪. આ વૈદિક યાને છાંદસ વ્યાકરણોની કેટલેક અંશે ગરજ સારે છે.

૫. **પ્રક્રિયાકૌમુદી** (ભા. ૧, પૃ. ૭) પ્રમાણે આટલાં વર્ષ સુધી અભ્યાસ કરવા છતાં ઈન્દ્ર શબ્દ-પારાયણનો પાર પામી શક્યો નહિ.

૬. જુઓ “આનંદાશ્રમ ગ્રંથાવલી” (ભાગ ૮), ગ્રંથાંક ૪૨નું પૃ. ૪૧૧૮.

આની વ્યાખ્યા સાયણાચાર્યે આપી છે. એને લક્ષ્યમાં લેતાં એમ કહી શકાય કે પુરાતન સમયમાં વાણી અવ્યાકૃત એટલે કે વ્યાકરણ સંબંધી પ્રકૃતિ, પ્રત્યય આદિ સંસ્કારોથી રહિત અખંડિત પદરૂપ બોલાતી હતી. દેવોએ (પોતાના રાજા) ઇન્દ્રને એને વ્યાકૃત એટલે પ્રકૃતિ, પ્રત્યય વગેરેના સંસ્કારવાળી બનાવવા કહ્યું. P. ૧૧ ઇન્દ્રે એ ઉપરથી એ વાણી વચમાંથી તોડીને વ્યાકૃત બનાવી. આમ ઇન્દ્રે વ્યાકરણ રચ્યું. એને ઇન્દ્ર-વ્યાકરણ, ઐન્દ્ર-વ્યાકરણ તેમજ ઐન્દ્ર-તન્ત્ર તરીકે ઓળખાવાય છે. જેમ વ્યાકરણના પ્રથમ પ્રવક્તા તરીકે બ્રહ્માનો નિર્દેશ કરાય છે તેમ વ્યાકરણના આદિમ સંસ્કર્તા તરીકે ઉપર્યુક્ત ઇન્દ્રનો ઉલ્લેખ કરાય છે. આ ઇન્દ્રનો પરિચય શ્રી. યુધિષ્ઠિર મીમાંસકે સંસ્કૃત વ્યાકરણશાસ્ત્ર કા ઇતિહાસ નામના હિંદી પુસ્તક (ભા. ૧, પૃ. ૫૭-૫૮)માં આપ્યો છે. અહીં એમણે કહ્યું છે કે આ ઇન્દ્ર વિક્રમથી સાડા આઠ હજાર (૮૫૦૦) વર્ષ પૂર્વે થઈ ગયા છે, પરંતુ આ સમય પરત્વે મતભેદ જોવાય છે.

કથાસરિત્સાગરમાં સૂચવાયા મુજબ ઉપર્યુક્ત ઇન્દ્ર-વ્યાકરણ ઘણાં સમયથી નાશ પામ્યું છે. જૈન શાકટાયન-વ્યાકરણ (૧-૨-૩૭)માં વૈયાકરણ ઇન્દ્રનો મત દર્શાવાયો છે. દિગંબર સોમદેવે રચેલા યશસ્તિલક-ચંપૂ (આશ્વાસ ૧, પૃ. ૮૦)માં આ ઇન્દ્ર-વ્યાકરણનો નિર્દેશ છે. ભટ્ટારક હરિશ્ચન્દ્રે ચરકની વ્યાખ્યામાં નીચે મુજબ કહ્યું છે :- “શાસ્ત્રેષ્વપિ ‘અથ વર્ણસમૂહઃ’ ઇતિ ઐન્દ્રવ્યાકરણસ્ય ।”

દુર્ગાચાર્યે નિરુક્ત-વૃત્તિ (પૃ. ૧૦)ના પ્રારંભમાં ઇન્દ્ર-વ્યાકરણનું એક સૂત્ર નીચે મુજબ ઉદ્ધૃત કર્યું છે :- “નૈકં પદં જાતમ્, યથા ‘અર્થઃ પદમ્’ ઇત્યૈન્દ્રાણામ્ ।”

આ ઐન્દ્ર વ્યાકરણને અંગે ચીની, ટિબેટીય અને ભારતીય સાહિત્યમાં જે જે ઉલ્લેખો મળે છે તેના સંગ્રહ તરીકે ડૉ. એ.સી. બર્નેલે નીચે મુજબના નામથી એક મોટો ગ્રંથ રચ્યો છે :-

On the Aindra School of Sanskrit Grammarians.

[૨]

P. ૧૨ ઐન્દ્ર વ્યાકરણ (ઈ. સ. પૂર્વે ૫૮૦)ની ઉત્પત્તિ—ચેતાંબરોની કેટલીક કૃતિઓમાં ઐન્દ્ર વ્યાકરણની ઉત્પત્તિનો પ્રસંગ આલેખાયો છે. એ સૌમાં પ્રાચીનતાની દૃષ્ટિએ આવસ્સય ઉપરની ભદ્રબાહુસ્વામીએ રચેલી નિજજુત્તિ (પત્ર ૧૮૨અ) અગ્રસ્થાન ભોગવે છે. આ ભદ્રબાહુસ્વામી તે ચતુર્દશ-પૂર્વધર યાને ‘શ્રુતકેવલી’ છે એમ જૈન પરંપરાનું માનવું છે અને એ પરંપરા અનુસાર એમનો સ્વર્ગવાસ વીરસંવત્ ૧૭૦માં થયો છે. આધુનિક કેટલાક વિદ્વાનોનો મત જુદો છે. તેમનું કહેવું એ છે કે આ તેમજ અન્ય નિજજુત્તિઓના કર્તા તો બીજા ભદ્રબાહુ છે અને એમનો સમય વિક્રમની પાંચમી શતાબ્દી છે. આવસ્સયની નિજજુત્તિને અંગે કોઈ કોઈ એમ પણ કહે છે કે એનો અમુક ભાગ ‘શ્રુતકેવલી’ ભદ્રબાહુની રચના છે. ગમે તેમ પણ ઇન્દ્રવ્યાકરણ સંબંધી ઉલ્લેખ માટે તો ઉપર્યુક્ત નિજજુત્તિ જ સૌથી પ્રાચીન સાધન જણાય છે એટલે હું પ્રસ્તુત ભાગ અત્રે ઉદ્ધૃત કરું છું :-

“સક્કો ય તસ્સમક્કં ભગવંતં આસણે નિવેસિત્તા । સહસ્સ લક્કણં પુચ્છે વાગરણં અવયવા ઇદં ॥”

આનો અર્થ એ છે કે શકે તેની (લેખાચાર્યની) સમક્ષ ભગવાન (મહાવીરસ્વામી)ને આસન ઉપર ૧. આ પુસ્તક પં. ભગવદ્ધતજી તરફથી વિ. સં. ૨૦૦૭માં પ્રકાશિત થયેલું છે. [એની બીજી આવૃત્તિ પણ પ્રકટ થઈ છે.]

બેસાડી શબ્દનું લક્ષણ પૂછ્યું. (ભગવાને) વ્યાકરણ (કહ્યું) (અર્થાત્ સ્પષ્ટીકરણ કર્યું) (કેટલાંક) અવયવો (લેખાચાર્યે ગ્રહણ કર્યાં). (આ ઉપરથી) ઈન્દ્ર (ઐન્દ્ર) (વ્યાકરણ બન્યું).

જિનદાસગણિએ રચેલી મનાતી આવસ્સયની યુણિષ (ભા. ૧, પત્ર ૨૪૮) અને એ આવસ્સયની હરિભદ્રસૂરિકૃત ટીકા (પત્ર ૧૮૨અ) એ ઉપર્યુક્ત નિજજુતિ પછી અગ્ર સ્થાન ભોગવે છે. આ યુણિષમાં કહ્યું છે કે ‘ભગવાન (મહાવીરસ્વામી) આઠ વર્ષથી કંઈક અધિક ઉમ્મરના થયા ત્યારે એમણે સ્નાન કર્યું અને શ્વેત P. ૧૩ વસ્ત્ર ધારણ કર્યું. એમના માતાપિતાએ એમને અલંકારાદિથી વિભૂષિત કર્યા અને એમને હાથી ઉપર બેસાડી ઠાઠમાઠથી પરિવારાદિ સહિત લેખાચાર્ય પાસે એઓ લઈ ગયા. એ લેખાચાર્યનું ખૂબ મોટું આસન મોડેલું હતું. (ત્રણ જ્ઞાનના ધારક પ્રભુને આ પ્રમાણે શિષ્યરૂપે લઈ આવેલા જાણી) શક ઈન્દ્રનું આસન ચલિત થયું અને એ લેખાચાર્ય પાસે સત્વર આવ્યો. પછી એણે પેલા આસન ઉપર પ્રભુને બેસાડ્યા. પેલા લેખાચાર્ય પણ ત્યાં જ હતા. પણ શકે હાથ જોડીને (વ્યાખ્યારૂપે વ્યાકરણાર્થે ઉપોદ્ઘાત, પદ, પદાર્થ, ક્રમ, ગુરુલાઘવ, સમાસ, વિસ્તાર, સંક્ષેપ, વિષય, વિભાગ, આક્ષેપ તેમજ પરિહાર એ બાબતો) અકાર આદિના પર્યાય, ભંગ અને ગમ પૂછ્યા. ત્યારે પ્રભુએ એનું અનેક પ્રકારે વ્યાકરણ (સ્પષ્ટીકરણ) કર્યું. લેખાચાર્યે એ સાંભળ્યું. એ ઉપરથી લેખાચાર્યને કેટલાક પદ-અર્થો સમજાયા. (એ ઉપરથી) ત્યારથી ઐન્દ્ર વ્યાકરણ ઉદ્ભવ્યું.’

મહત્તર યાકિનીના ધર્મપુત્ર હરિભદ્રસૂરિએ આવસ્સયની ટીકા (ભા. ૧, પત્ર ૧૮૨ અ)માં કહ્યું છે કે ‘શકે લેખાચાર્યની સમક્ષ ભગવાનને આસન ઉપર બેસાડી શબ્દનું લક્ષણ પૂછ્યું. ભગવાને એનું વ્યાકરણ કહ્યું - સ્પષ્ટીકરણ કર્યું. લૌકિક અને સામાયિક શબ્દોનું જે વડે સ્પષ્ટીકરણ કરાય તે ‘વ્યાકરણ’-‘શબ્દશાસ્ત્ર.’ એનાં કેટલાંક અવયવો ઉપાધ્યાયે (લેખાચાર્યે) ગ્રહણ કર્યાં. તે ઉપરથી ઐન્દ્ર વ્યાકરણ બન્યું. આમ એમણે પણ આની ઉત્પત્તિ ઉપર મુજબ સૂચવી છે.

‘કલિ.’ હેમચન્દ્રસૂરિએ પણ યોગશાસ્ત્ર (પ્ર. ૧, શ્લો. ૫૬-૫૮સ્વોપજીવિવરણ પત્ર ૩આ)માં ઐન્દ્ર વ્યાકરણની ઉત્પત્તિને અંગે ઉપર મુજબ વિધાન કર્યું છે.

આ ઐન્દ્ર વ્યાકરણ એ શકે પૂછેલા પ્રશ્નો, મહાવીરસ્વામીએ આપેલા ઉત્તરો અને લેખાચાર્યે કરેલી P. ૧૪ સંકલના એમ ત્રિવેણીના સંગમરૂપ છે. એની રચના ઈ. સ. પૂર્વે ૫૮૦માં થયેલી છે.

જૈન પરંપરા અનુસાર રચાયેલા મનાતા આ ઐન્દ્ર વ્યાકરણને જ કેટલાકે જૈનેન્દ્ર-વ્યાકરણ કહ્યું છે. દા. ત. વિનયવિજયગણિએ પજ્જોસવણાકપ્પ (સુ. ૧૦૮) ઉપર સુબોધિકા નામની જે ટીકા વિ. સં. ૧૬૯૬માં રચી છે એમાં એમણે આને જૈનેન્દ્ર-વ્યાકરણ કહ્યું છે.

આ ઐન્દ્ર વ્યાકરણ કઈ ભાષાનું હશે અને એ કઈ ભાષામાં રચાયું હશે તેનો કોઈ ઉલ્લેખ જણાતો નથી. મગધ (બિહાર)માં એ રચાયું હોવાથી એ સમયની સામાન્ય લોકોની કે શિષ્ટ જનોની ત્યાંની ભાષાને લગતું એટલે કે તો માગધીનું કે કાં તો સંસ્કૃતનું એ વ્યાકરણ હશે, અને લેખાચાર્ય બ્રાહ્મણ હશે એટલે એ સંસ્કૃતમાં રચાયું હશે. આ વ્યાકરણ આજે લગભગ પંદર સૈકા થયાં તો મળતું નથી એટલે એ વિષે આટલું જ કહેવું બસ થશે.

સદપાહુડ (શબ્દપ્રાભુત) (ઈ. સ. પૂર્વે ૫૫૭)

દિક્ષિવાય નામના બારમા અંગમાં ચૌદ પુવ્વ છે, અને એ દરેક પુવ્વના વત્થુ (વસ્તુ) નામે ઓછાવત્તા

વિભાગ છે, અને એ વિભાગના પાહુડ (પ્રાભૃત) નામે પેટા-વિભાગ છે. આવસ્સયની ચુણ્ણિમાં તેમજ અણુઓગદારની ચુણ્ણિ (પત્ર ૪૭)માં સદ્પાહુડનો ઉલ્લેખ છે, જ્યારે એના સંસ્કૃત સમીકરણરૂપ શબ્દપ્રાભૃતનો ઉલ્લેખ વાચકવર્ય ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર યાને તત્ત્વાર્થસૂત્ર (અ. ૧, સૂ. ૫)ની ભાષ્યાનુસારિણી ટીકા (પૃ. ૫૦)માં સિદ્ધસેનગણિએ અને અણુઓગદાર (સુત ૧૩૦)ની ટીકા (પત્ર ૧૫૦આ)માં ‘મલધારી’ P. ૧૫ હેમચંદ્રસૂરિએ કર્યો છે. સિદ્ધસેનગણિએ કહ્યું છે કે ‘શબ્દપ્રાભૃત’ પૂર્વમાં છે. એમાંથી આ વ્યાકરણ આવ્યું છે. એ શબ્દપ્રાભૃત જે જાણે તે ‘પ્રાભૃતજ’ એમ એમણે કહ્યું છે.

ત. સૂ. (અ. ૧, સૂ. ૫) ઉપરના સ્વોપજ ભાષ્ય (પૃ. ૪૪)માં ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે ‘આગમમાં પ્રાભૃતજ દ્રવ્ય એટલે ભવ્ય (અર્થાત્ થવાની યોગ્યતાવાળું) એમ કહે છે.’ આવો ઉલ્લેખ કરી એમણે “દ્રવ્યં ચ ભવ્ય” એવો પાઠ આપ્યો છે. આ અષ્ટા૦ (અ. ૫, પા. ૩)માં ૧૦૮માં સૂત્રરૂપે જોવાય છે. એ સૂત્ર મૂળે જો એનું ન જ હોય તો એ શબ્દ-પ્રાભૃતનું તો નહિ હોય ? એવો પ્રશ્ન મને સ્ફુરે છે.

આ સદ્પાહુડ કેટલાયે સૈકાઓ થયા લુપ્ત થઈ ગયું છે. એ અમુક જ ભાષાનું અને તે પણ અમુક જ ભાષામાં રચાયેલું વ્યાકરણ હોવું જોઈએ એવો અંતિમ નિર્ણય કરવાનું કોઈ સાધન જણાતું નથી, પણ એ સંસ્કૃતમાં હશે એમ માની એની અહીં મેં નોંધ લીધી છે.

‘જૈનેન્દ્ર-વ્યાકરણ યાને પંચાધ્યાયી (વિક્રમની છઠ્ઠી સદી) જૈન ઉપલબ્ધ સાહિત્યની દૃષ્ટિએ આ P. ૧૬ જૈનોનું સૌથી પ્રથમ વ્યાકરણ છે. એના કર્તા દિગંબર મુનિવર પૂજ્યપાદ ઉર્ફે ‘દેવનંદિ’^૩ યાને જિનેન્દ્રબુદ્ધિ છે. પ એમણે વિદ્યાવારિષિ ઉમાસ્વાતિએ રચેલા ત.સૂ. ઉપર ‘સર્વાર્થસિદ્ધિ’ નામની સંસ્કૃત વૃત્તિ રચી છે. એમણે અષ્ટા. ઉપર શબ્દાવતાર નામનો ન્યાસ રચ્યો છે, પણ એ મળતો નથી. વળી એમણે પોતાના વ્યાકરણને અંગે સ્વોપજ

૧. અભયનંદિકૃત ટીકા સહિત આ વ્યાકરણ “પંડિત, નવીન ગ્રંથમાળા”માં પુ. ૩૧-૩૪ તરીકે છપાયું છે. “સનાતન જૈન ગ્રંથમાલા” તરફથી બનારસથી ઈ. સ. ૧૯૧૫માં આ મૂળ કૃતિ શબ્દાર્ણવચન્દ્રિકા સહિત પ્રકાશિત થઈ છે.

૨. મૂળ સંસ્કૃત શબ્દ ‘દેવનંદિન્’ છે. એ પ્રમાણે યથાસ્થાન સમજી લેવું.

૩. સંક્ષેપમાં ‘દેવ’ એવો વ્યવહાર કરાય છે. દા. ત. જિનસેને આદિપુરાણ (પર્વ ૧, શ્લો. ૫૨)માં અને વાદિરાજસૂરિએ પાર્શ્વનાથચરિત (સ. ૧, શ્લો. ૧૮)માં આવો ઉલ્લેખ કર્યો છે.

૪. આ નામના એક બૌદ્ધ સાધુ થઈ ગયા છે. એ વૈયાકરણે અષ્ટા.ની કાશિકા નામની વૃત્તિ ઉપર ન્યાસ રચ્યો છે. એમાં એમણે “બ્રાહ્મણશ્રમણમ્” એવું એક સમાહાર-દ્વંદ્વનું ઉદાહરણ આપ્યું છે. આ પૂર્વે આ ઉદાહરણ કોઈએ આપ્યું છે ખરું ?

૫. પ્રસ્તુત વ્યાકરણના કર્તા દેવનંદિ જ છે એ બાબત વિવિધ પ્રમાણો પં. નાથુરામ પ્રેમીએ “દેવનંદિ और उनका जैनन्द्र व्याकरण” નામના હિંદી લેખમાં આપ્યાં છે. આ લેખ “જૈન હિતૈષી”માં ઈ. સ. ૧૯૨૧માં છપાયો હતો. એને ઈ. સ. ૧૯૪૮માં પ્રસિદ્ધ કરાયેલા જૈન સાહિત્ય और इतिहास નામના પુસ્તક (પૃ. ૯૩-૧૨૮)માં સ્થાન અપાયું છે. આ અભ્યાસપૂર્ણ લેખનો મેં યથાસ્થાન ઉપયોગ કર્યો છે. આ લેખમાં બે ન્યૂનતા છે અને એનો સ્વીકાર પં. પ્રેમીએ કર્યો છે એવો ઉલ્લેખ સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૩૨૮)માં છે.

૬. આ વૃત્તિનું મૂળ સહિત “તત્ત્વાર્થવૃત્તિ: સર્વાર્થસિદ્ધિ:” એ નામથી બીજું સંસ્કરણ કોલ્હાપુરથી કલાપ્પા ભરમાપ્પા નિટવેએ પોતાના ‘જૈનેન્દ્ર’ મુદ્રણાલયમાં શકસંવત્ ૧૮૩૯માં છાપ્યું હતું. આની એક નકલ જે અહીંના ‘જૈનાનંદ પુસ્તકાલય’માં છે તેમાં આગમોદ્ધારક શ્રીઆનંદસાગરસૂરજિએ કરેલી કેટલીક નોંધ નજરે પડે છે. [સર્વાર્થસિદ્ધિ ટીકા ભારતીય જ્ઞાનપીઠ કાશીથી હિંદી અનુવાદ સાથે પ્રગટ થઈ છે.]

ન્યાસ રચ્યો હોય એમ માનવાનું કારણ મળે છે (એ પણ મળતો નથી). આ ઉપરાંત એમણે 'ઈષ્ટોપદેશ અને P. ૧૭
'સમાધિતંત્ર રચ્યાં છે. 'દશભક્તિ', 'સારસંગ્રહ તેમજ કોઈ 'વૈદ્યક ગ્રંથ પણ એમને હાથે રચાયાં હોય એમ
લાગે છે. કેટલાકને મતે 'અર્હત-પ્રતિષ્ઠા-લક્ષણ, 'જૈનાભિષેક અને 'શાન્ત્યષ્ટક પણ એમની કૃતિઓ છે.

'પૂજ્યપાદનો સમય વિક્રમની છઠ્ઠી શતાબ્દીનો પ્રારંભ છે એમ મનાય છે. સિદ્ધસેન દિવાકર અને દિ.
સમંતભદ્ર એમના પૂર્વગામી છે એ વાત નિર્વિવાદ છે.

પરિચય-જૈનેન્દ્ર વ્યાકરણ એ પાંચ અધ્યાયોમાં રચાયું છે. આથી તો આને કેટલાક પંચાધ્યાયી P. ૧૮
તરીકે ઓળખાવે છે. એ પ્રત્યેક અધ્યાયના ચચ્ચાર પાદ છે અને એ દરેકમાં ઓછાંવત્તાં 'સૂત્રો છે. એ ઘણાં
સંક્ષિપ્ત છે. વળી એમાં 'સંજ્ઞાકૃત લાઘવ છે કે જે લાઘવ અષ્ટાની યોજનામાં પણ નથી. આ ઉપરાંત આ

૧. આ કૃતિ દિ. આશાધરકૃત સંસ્કૃત ટીકા સહિત માણિકયાચન્દ્ર દિગંબર જૈન ગ્રંથમાલા''માં ગ્રંથાંક ૧૩ તરીકે વિ.
સં. ૧૯૭૫માં પ્રસિદ્ધ થઈ છે. વળી એ ''દિગંબર જૈન ગ્રંથભંડારમાલા''માં ગ્રંથાંક ૧ તરીકે બનારસથી વિ. સં.
૧૯૮૨માં પ્રકાશિત થઈ છે.
૨. ''સનાતન જૈન ગ્રંથમાલા''માં ગ્રંથાંક ૧માં આને ઈ. સ. ૧૯૦૫માં સ્થાન અપાયું છે. પં. કૃતેહચંદે દિલ્હીથી પણ
આ કૃતિ વિ. સં. ૧૯૭૮માં પ્રકાશિત કરી છે. એમ. એન. દ્વિવેદીના અંગ્રેજી અનુવાદ સહિત મૂળ કૃતિ ઈ. સ.
૧૯૮૫ (?)માં છપાઈ છે. આ મૂળ કૃતિની મરાઠી અનુવાદ સહિતની બીજી આવૃત્તિ સોલાપુરથી ઈ. સ.
૧૯૪૦માં પ્રસિદ્ધ થઈ છે.
૩. આ નામની કૃતિ દિ. પ્રભાચન્દ્રકૃત ટીકા અને મરાઠી અનુવાદ સહિત સોલાપુરથી ઈ. સ. ૧૯૨૧માં પ્રકાશિત
થયેલી છે.
૪. આનો ઉલ્લેખ છખંડાગમના 'વેયણા'ખંડ ઉપર દિ. વીરસેને રચેલી ધવલામાં છે, પણ હજી સુધી તો આ કૃતિ
મળી આવી નથી.
૫. કેટલાકને મતે વૈદ્યસાર એમની કૃતિ છે. આ કટકે કટકે ''જૈનસિદ્ધાંત ભાસ્કર''માં પ્રકાશિત કરાઈ છે.
૬. દિ. ચન્દ્રવ્ય નામના એક કવિએ 'કાનડી' ભાષામાં જે પૂજ્યપાદચરિત રચ્યું છે તેમાં આ કૃતિનો તેમજ
શાંત્યષ્ટકનો નિર્દેશ છે.
૭. 'શ્રવણ બેલ્ગોલ'ના શિલાલેખ (ક્રમાંક ૪૦)માં આ કૃતિની નોંધ છે.
૮. જુઓ ટિપ્પણ ૬
૯. વર્ધમાનસૂરિએ વિ. સં. ૧૧૯૭માં રચેલા ગણરત્નમહોદધિ (પૃ. ૨)માં આ પૂજ્યપાદનું દિગ્વચ્ચ એ નામથી
સ્મરણ કર્યું છે.
૧૦. વ્યાકરણના વિષયમાં જેવી સૂત્રાત્મક શૈલી જોવાય છે એવી અન્ય સાહિત્યિક કૃતિઓમાં નજરે પડતી નથી. ગમે
તેમ પણ આ જાતની અનુપમ કળા આપણા આ ભારતવર્ષમાં જ ઉદ્ભવી અને વિકસી છે. સમગ્ર યુરોપીય
સાહિત્ય ભારતીય સાહિત્ય કરતાં વિશાળતા અને વિવિધતામાં પણ ભલે ચડિયાતું ગણાતું હોય, પણ આવી
સૂત્રાત્મક યોજના તો ત્યાં જોવાતી નથી
૧૧. નાથારંગજી ગાંધી તરફથી વીરસંવત્ ૨૪૪૪માં દિ. પં. વંશીધરે સિદ્ધાંતકૌમુદીની શૈલીમાં રચેલી જૈનેન્દ્ર-
પ્રક્રિયા પ્રસિદ્ધ થઈ છે. જૈનેન્દ્ર વ્યાકરણમાંની સંજ્ઞાઓનાં ઈતર વ્યાકરણગત સંજ્ઞા સાથે સમીકરણો અપાયાં છે.
વિશેષમાં અષ્ટા. સાથે સંતુલન કરી બાર વિશિષ્ટતા દર્શાવાઈ છે. એમાં પ્રક્રિયાકૃત લાઘવનો પણ ઉલ્લેખ છે.

વ્યાકરણમાં ‘એકશેષ’ પ્રકરણ નથી.^૧ આમ આ અનેકશેષ છે. એ એની એક રીતે વિશિષ્ટતા ગણાય.

અષ્ટા.માં વૈદિક પ્રયોગો પણ સિદ્ધ કરાયા છે એમ એ છાંદસ અને લૌકિક એમ બંને પ્રકારની સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે, જ્યારે આ તો કેવળ લૌકિકનું છે. તેમ છતાં છાંદસ અધિકારમાં પાણિનિએ સિદ્ધ કરેલા કેટલાક શબ્દોને ‘લૌકિક’ માની અહીં સિદ્ધ કરાયા છે.

દ્વિવિધ વાચના:—આ વ્યાકરણના મૂળ સૂત્ર—પાઠના બે પ્રકાર જોવાય છે—બે વાચના મળે છે: (૧) જેના ઉપર દિ. આચાર્ય અભયનંદિની મહાવૃત્તિ અને દિ. શ્રુતકીર્તિકૃત પ્રક્રિયા છે તે અને (૨) જેના ઉપર દિ. સોમદેવસૂરિકૃત શબ્દાર્ણવ—ચન્દ્રિકા અને દિ. ગુણનંદિકૃત પ્રક્રિયા છે તે. પ્રથમ પ્રકારના સૂત્ર—પાઠમાં લગભગ P. ૧૯ ૩૦૦૦ સૂત્રો છે, જ્યારે બીજામાં આશરે ૩૭૦૦ સૂત્રો છે. તેમ છતાં બંનેમાં મોટે ભાગે સૂત્રો સમાન છે, અને મંગળાયરણ પણ એકસરખું જ છે, જો કે કેટલીક સંજ્ઞાઓમાં ભેદ છે.

પ્રથમ પ્રકારનો સૂત્ર—પાઠ પાણિનીય સૂત્ર—પાઠની શૈલીએ રચાયો છે. શાકટાયન-વ્યાકરણની પરિપૂર્ણ સ્વરૂપે રચાયાની પ્રતિષ્ઠા જામતાં આ સૂત્રપાઠ અપૂર્ણ જણાતાં મહાવૃત્તિમાં અનેક વાર્તિક અને ઉપસંખ્યાન^૨ ઇત્યાદિ રચીને એ પૂર્ણ બનાવાયો છે. બીજા પ્રકારનો સૂત્ર—પાઠ એ પ્રથમ સૂત્ર—પાઠનાં સેંકડો સૂત્રોને પરિવર્તિત અને પરિવર્ધિત કરીને સંભવતઃ દિ. આચાર્ય ગુણનંદિએ યોજ્યો છે, અને તેમ થવાથી એ પ્રાયઃ પૂર્ણ બન્યો છે, અને એથી તો એના ટીકાકારોને વાર્તિકાદિ રચવાં પડ્યાં નથી.

પ્રથમ સૂત્રપાઠ જ અસલી છે. આ સિદ્ધ કરવા માટે પં. નાથુરામ પ્રેમીએ કેટલાંક કારણો દર્શાવ્યા છે.^૩

પ્રથમ સૂત્રપાઠનું આદ્ય સૂત્ર જે નીચે મુજબ છે તે એના કર્તા પૂજ્યપાદનો અનેકાંતવાદ તરફનો પક્ષપાત—ઉચિત ગુણાનુરાગ સૂચવે છે :— “સિદ્ધિરનેકાન્તાત્”

પૂજ્યપાદે આ વ્યાકરણમાં નિમ્નલિખિત છ આચાર્યોનાં નામો સૂચવ્યાં છે :—

(૧) પ્રભાચન્દ્ર, (૨) ભૂતભલિ, (૩) યશોભદ્ર, (૪) શ્રીદત્ત, (૫) સમંતભદ્ર અને (૬) સિદ્ધસેન.^૪

P. ૨૦ કેટલાક આ નામોને બનાવટી ગણે છે તો કેટલાક એને વૈયાકરણોનાં નામ ગણે છે, પણ એ વાત તો ચોક્કસ છે કે આ છ બે વ્યક્તિઓ વિશિષ્ટ ગ્રંથકારો હોવા જોઈએ અને એમણે એમની કૃતિઓમાં વ્યાકરણ વિષયક કોઈ કોઈ વિશિષ્ટ પ્રયોગો કર્યા હશે.

સિદ્ધસેન દિવાકરકૃત વેદવાદ—દ્વાત્રિંશિકાના એટલે કે નવમી દ્વાત્રિંશિકાના ૨૨મા પદ્યમાં વિદ્રતે એવો જે પ્રયોગ છે તેને લક્ષીને “વેત્તે: સિદ્ધસેનસ્ય” એવું સૂત્ર રચાયું હશે એમ લાગે છે.

૧. શબ્દોમાં એકત્વ, બહુત્વ ઇત્યાદિના વાચકત્વની સ્વાભાવિક શક્તિનું સમર્થન કરી ‘એક—શેષ’ પ્રકરણની પ્રક્રિયાનું નિરસન કરાયું છે.

૨. વ્યાકરણના મૂળ સૂત્રમાં જે કહ્યું ન હોય તેને ઉદ્દેશીને વાર્તિકકારને જે કહેવું પડે તેને ‘ઉપસંખ્યાન’ કહે છે.

૩. જુઓ એમનો ઉપર્યુક્ત લેખ. સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૨૩)માં પ્રથમ અને દ્વિતીય સૂત્રપાઠને અનુક્રમે ઔદીચ્ય સંસ્કરણ અને દાક્ષિણાત્ય સંસ્કરણ તરીકે ઓળખાવાયા છે અને ઔદીચ્યને જ પૂજ્યપાદકૃત માન્યો છે, કેમકે એમાં ‘એકશેષ’ પ્રકરણ નથી.

૪. જુઓ અનુક્રમે ૪-૩-૧૮૦, ૩-૪-૮૩, ૨-૧-૮૯, ૧-૪-૩૪, ૫-૪-૧૪૦ અને ૫-૧-૭.

અસલી સૂત્રપાઠની ટીકાઓ—અસલી સૂત્રપાઠ ઉપર નીચે મુજબની ટીકાઓ રચાઈ છે:—

- | | |
|--------------------------|----------------------------------------------------------|
| (૧) 'સ્વોપજ ન્યાસ. | (૪) પ્રભાચંદ્રકૃત શબ્દાંભોજભાસ્કર |
| (૨) ભાષ્ય. | નામનો ન્યાસ. |
| (૩) અભયનંદિકૃત મહાવૃત્તિ | (૫) આર્ય શ્રુતકીર્તિકૃત પંચવસ્તુ—પ્રક્રિયા. ^૧ |

સ્વોપજ ન્યાસ અને ભાષ્ય—આજે આ બેમાંથી એકે ઉપલબ્ધ નથી, પરંતુ પંચવસ્તુના કર્તાએ નીચે મુજબની મતલબનો જે ઉલ્લેખ કર્યો છે તે તેમજ અસલી સૂત્રપાઠનું સંજ્ઞા વગેરેથી ઉદ્ભવતું લાઘવ જોતાં એ હોવો જોઈએ એમ લાગે છે :—

જૈનેન્દ્ર—વ્યાકરણ એ પ્રાસાદ છે, એનાં મૂળ સૂત્ર એ એનાં સ્તંભ છે, એનો ન્યાસ એ એની રત્નમય P. ૨૧ ભૂમિ છે, એની વૃત્તિ એ એનાં દ્વાર છે, એનું ભાષ્ય એ એનું શ્યાતલ છે, એની ટીકા એ એનો માળ છે, અને આ પંચવસ્તુ ટીકા એ એ પ્રાસાદ ઉપર પહોંચવા માટેનું સોપાન છે.

મહાવૃત્તિ—આના કર્તા અભયનંદિ છે. એ દિ. રાજવાર્તિકકાર અકલંક પછી અને દિ. શ્રુતકીર્તિની પહેલાં કોઈક સમયે થયા હોય એમ લાગે છે. આ મહાવૃત્તિ લગભગ ૧૨૦૦૦ શ્લોક જેવડી છે અને ઉપલબ્ધ ટીકાઓમાં એ સૌથી પ્રાચીન જણાય છે.^૨

શબ્દાંભોજભાસ્કર—આ ન્યાસનું પરિમાણ આશરે ૧૬૦૦૦ શ્લોક જેટલું હશે. આની રચના અભયનંદિકૃત મહાવૃત્તિને અનુલક્ષીને દિ. પ્રભાચન્દ્રે કરી છે. એમનો સમય ઈ. સ. ૮૮૦થી ૧૦૬૫ સુધીનો હોવાનું અનુમાન પં. મહેન્દ્રકુમારે પ્રમેયકમલમાર્તંડની પ્રસ્તાવના (પૃ. ૬૭)માં કર્યું છે.

આ ન્યાસમાં પ્રમેયકમલમાર્તંડ અને ન્યાયકુમુદચંદ્રનો જે રીતે ઉલ્લેખ છે^૩ તે વિચારતાં આ બેના કર્તા તે જ ન્યાસકાર છે એમ જણાય છે. આ ન્યાસ હજી સુધી તો પૂરો મળ્યો નથી. અ. ૪, પા. ૩, સૂ. ૨૧૧ સુધીનો જ ન્યાસ અત્યારે તો મળે છે. શું આ ન્યાસ પૂરો નહિ રચાયો હોય ?

પંચવસ્તુ—આ પ્રક્રિયાક્રમને અનુસરનારી ટીકા છે. એનું પરિમાણ લગભગ ૩૩૦૦ શ્લોક જેટલું છે. P. ૨૨ એ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. એના કર્તા આર્ય શ્રુતકીર્તિ હોય એમ જણાય છે, અને એમનો સમય વિક્રમની બારમી સદી હોવાનું મનાય છે.

શબ્દાર્ણવ—જૈનેન્દ્ર વ્યાકરણના પ્રથમ પ્રકારના સૂત્રપાઠને અપૂર્ણ જોઈ, એને સર્વાંગે પરિપૂર્ણ બનાવવા માટે દિ. આચાર્ય ગુણનંદિએ પ્રયાસ કરી એને વિસ્તૃત બનાવ્યો તેનું ફળ તે શબ્દાર્ણવ—વ્યાકરણ છે. આથી

૧. અષ્ટસહસ્રી (પૃ. ૧૩૨) માં “પ્યલ્લે કર્મણ્યુપસદ્ધ્યાનાત્” એવું જે અવતરણ અપાયું છે એ અષ્ટાના વાર્તિકમાં નથી તો એ સ્વોપજ ન્યાસનું હશે.

૨. દિ. પં. મહાચંદ્રે લઘુ જૈનેન્દ્ર નામની કૃતિ મહાવૃત્તિને આધારે રચી છે અને દિ. પં. બંશીધરે જૈનેન્દ્ર-પ્રક્રિયા રચી છે.

૩. [આ મહાવૃત્તિ ભારતીય જ્ઞાનપીઠ કાશીથી પ્રસિદ્ધ છે.] આ ટીકાના આધારે દિ. પં. રાજકુમારે લઘુવૃત્તિ રચી છે, અને એ બનારસથી ઈ. સ. ૧૯૨૪ માં પ્રકાશિત થઈ છે.

૪. “તદાત્મકત્વં ચાર્થસ્યાધ્યક્ષતોઽનુમાનાદેશ્ચ યથા સિદ્ધ્યતિ તથા પ્રપજ્ઞતઃ પ્રમેયકમલમાર્તંડે ન્યાયકુમુદચન્દ્રે ચ પ્રરૂપિતમિહ દ્રઢવ્યમ્” ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૭૨)

તો એમાં પ્રથમ પ્રકારના સૂત્રપાઠમાંનાં અડધાં ઉપરનાં સૂત્રો એનાં એજ છે.^૧ આ દિ. ગુણનંદિ તે કાં'તો દિ. વીરનંદિની ગુરુપરંપરામાં થયેલા પ્રથમ ગુણનંદિ (વિ. સં. ૮૫૯) હશે અથવા દિ. ત્રૈવિદ્ય મેઘચન્દ્રના ગુરુ ગુણનંદિ (વિ. સં. ૧૧૭૨) હશે.

એના ઉપર બે ટીકા છે: (૧) શબ્દાર્ણવ-ચન્દ્રિકા અને (૨) શબ્દાર્ણવ-પ્રક્રિયા—અ બંનેમાં એકશેષ પ્રકરણ છે. શબ્દાર્ણવચન્દ્રિકાના કર્તાદિ. સોમદેવ છે અને એમણે આ ટીકા દિ. મેઘચન્દ્રના પ્રશિષ્ય હરિચન્દ્રને માટે શકસંવત્ ૧૧૨૭માં રચી છે.

શબ્દાર્ણવપ્રક્રિયા—આ ઉપર્યુક્ત ચન્દ્રિકાને આધારે શ્રુતકીર્તિના પુત્ર અને શિષ્ય ચારુકીર્તિએ રચી હોય એમ લાગે છે. આ પ્રક્રિયા જૈનન્દ્ર-પ્રક્રિયા એ નામથી સ. જૈ. ગ્રં. માં ગ્રંથાંક પાંચ તરીકે ઈ. સ. ૧૮૧૪માં છપાઈ છે,^૨ અને એના કર્તા તરીકે ગુણનંદિનું નામ છપાયું છે, પણ એ ભૂલ છે એમ પં. નાથુરામ પ્રેમીનું કહેવું છે.^૩

ભગવદ્વાગ્વાદિની—(લ.વિ.સં. ૧૭૯૭) આ રત્નર્ષિ નામના કોઈ મુનિની રચના છે. એમાં જૈનેન્દ્ર વ્યાકરણ અંગે શબ્દાર્ણવચન્દ્રિકાના કર્તાઓ માન્ય રાખેલો ૮૦૦ શ્લોકપ્રમાણ કેવળ સૂત્રપાઠ છે. (જુઓ. જૈ.સા.ઈ. પૃ. ૧૨૫) આની વિશેષતા એ છે કે દેવનન્દિ જૈનેન્દ્ર વ્યાકરણના કર્તાનથી પરંતુ ભ.મહાવીરસ્વામિ છે એમ સિદ્ધ કરવા એમાં પુષ્કળ પ્રયાસ કરાયો છે. જુઓ જૈ.સા.ઈ. પૃ. ૧૧૫.

પ. ૨૩ કારિકા—જિનરત્નકોશ (ખંડ ૧, પૃ. ૭)માં આનંદવિમલના શિષ્ય વિજયવિમલે રચેલી અને સ્વોપજ્ઞ અવયૂરિથી વિભૂષિત કરેલી અનિટ્સ્વરાંતકારિકાની નોંધ છે. એ કારિકા જૈનેન્દ્ર વ્યાકરણને અંગેની છે એમ અહીં કહ્યું છે.

આ કારિકાની તેમજ એની સ્વોપજ્ઞ અવયૂરિની એક હાથપોથી વિ. સ. ૧૬૨૮માં લખાયેલી મળે છે.

વિશ્રાન્તવિદ્યાધર—(ઉ. વિ. સં. ૭૦૦) સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૩૩૩)માં આનો 'જૈન' વ્યાકરણ તરીકે ઉલ્લેખ છે, પણ એમ માનવા માટે કોઈ પ્રમાણ અપાયેલું જણાતું નથી તેમ મને પણ એવું કોઈ પ્રમાણ મળ્યું નથી. જિ. ૨. કો. (ખંડ ૧)માં આ વ્યાકરણની કોઈ હાથપોથી નોંધાઈ નથી. એ ઉપરથી પણ એવી સંભાવના થઈ શકે કે આ જૈન વ્યાકરણ નહિ હોય.

બીજી રીતે વિચારતાં આ વ્યાકરણનો જૈન^૪ કૃતિઓમાં અવતરણપૂર્વક નિર્દેશ છે તેમજ આને 'જૈન' વ્યાકરણ માનવામાં બાધક ગણાય એવું કોઈ પ્રમાણ હજી સુધી તો મને મળ્યું નથી. આથી હું એનો અહીં વિચાર કરું છું.

વિશ્રાન્તવિદ્યાધરના કર્તા વામન છે. આ હકીકત ગ. ૨. મ. (પૃ. ૨)માં સ્પષ્ટપણે કહેવામાં આવી છે. વિશેષમાં એના પૃ. ૧૬૮માં 'વામન'નો 'સહદયયકવર્તી' તરીકે ઉલ્લેખ છે. આના પૃ. ૨૩૭ ઉપરથી એ જાણવા મળે છે કે વામને પોતાના વ્યાકરણ ઉપર બૃહદ્વૃત્તિ રચી હતી. આથી એવું અનુમાન દોરાય કે એમણે લઘુવૃત્તિ પણ રચી હશે. મૂળ વ્યાકરણની પેઠે આ બે વૃત્તિઓ પણ હજી સુધી તો મળી આવી નથી.

૧. આવી પરિસ્થિતિને લઈને કેટલાક આ જ વ્યાકરણને જૈનેન્દ્ર કહે છે તે વાત ઘટાવી શકાય.

૨. આના સંપાદક શ્રીલાલ જૈન છે.

૩. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૧૧૪).

૪. જિનેશ્વરસૂરિએ પ્રમાલક્ષ્મીની સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ૯૦ અ)માં વિશ્રાન્તનો ઉલ્લેખ કર્યો છે. તે વિશ્રાન્ત-વિદ્યાધર હશે.

વામનનો સમય નક્કી કરવા માટેનું પ્રબળ સાધન એમના આ વ્યાકરણ ઉપર ન્યાય રચનાર P. ૨૪ મલ્લવાદીના સમય ઉપર અવલંબે છે. મલ્લવાદી બે થયા છે એટલે એ પૈકી આ કોણ છે તેનો નિર્ણય કરતાં વામનના સમયનો અંતિમ નિર્ણય થઈ શકે. સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૩૪)માં તો એમને ‘પ્રથમ મલ્લવાદી’ માની વામનના સમય માટે વિ. સં. ૪૦૦ અથવા તો વિ. સં. ૬૦૦ થી પ્રાચીન એમ બે વિકલ્પ દર્શાવાયા છે.

વિશ્રાન્તવિદ્યાધર વ્યાકરણ આજે મળતું નથી, પરંતુ એનાં અનેક સૂત્રો ગ. ર. મ.માં ઉદ્ધૃત કરાયાં છે.^૧ આ નામના વૈયાકરણનો ઉલ્લેખ ‘કલિ.’ હેમચન્દ્રસૂરિએ સિ. હે. (૧-૪-૫૨)ના સ્વોપજ્ઞ બૃહત્યાસ (પૃ. ૨૬૩)માં કર્યો છે.^૨

ન્યાસ-આપણે ઉપર જોઈ ગયા તેમ મલ્લવાદીએ વિશ્રાન્ત-વિદ્યાધર ઉપર ન્યાસ રચ્યો છે. પ્ર. ચ. (મલ્લવાદિ-પ્રબંધ, શૃંગ ૧૦ શ્લો. ૩૮)માં વિશ્રાન્તવિદ્યાધર નામના શબ્દશાસ્ત્રનો અને એના ઉપર ન્યાસ રચનારા તરીકે પ્રથમ મલ્લવાદીનો-મહાતાર્કિકનો ઉલ્લેખ છે. ‘હરિભદ્રસૂરિએ અનેકાન્ત જયપતાકામાં અ. ૧, પૃ. ૫૮માં ને અ. ૨, પૃ. ૧૧૬માં આ મલ્લવાદીએ રચેલી સમ્મર્ષપયરણની ટીકામાંથી એકેક અવતરણ આપ્યું છે. એ હિસાબે આ મલ્લવાદી એમના પૂર્વગામી ઠરે છે. સિદ્ધસેન દિવાકર એમના વિદ્યાગુરુ હશે એવી P. ૨૫ સંભાવના કરાય છે. એ ઉપરથી આપણે એમને વિક્રમની પાંચમી-છઠ્ઠી સદીમાં થયેલા માની શકીએ. જો એઓ બીજા મલ્લવાદી હોય તો એઓ ન્યાયબિન્દુની ‘ટીકાના ટિપ્પણકાર ગણાય, અને એ હિસાબે એઓ ઈ. સ.ની આઠમી સદીમાં થયેલાં મનાય.

‘કલિ૦’ હેમચન્દ્રસૂરિએ સિ. હે.ની સ્વોપજ્ઞ ટીકામાં આ ન્યાસમાંથી ઉદ્ધરણ આપ્યાં છે.^૩ ગ. ર. મ. (પૃ. ૭૧ ને ૮૨)માં વિશ્રાન્તવિદ્યાધરના ન્યાસનો ઉલ્લેખ છે.

(‘શાકટાયન’) શબ્દાનુશાસન-(લ. વિ. સં. ૮૦૦)-મુગ્ધ બોધના કર્તા પં. બોપદેવે પાતુપાઠમાં જે આઠ વૈયાકરણોનાં નામ ગણાવ્યાં છે તેમાં શાકટાયનનું પણ નામ છે. આ નામના એક વૈયાકરણ તો પાણિનિયી જ નહિ પણ યાસ્કની પણ પૂર્વે થઈ ગયા છે. અહીં જે શાકટાયન પ્રસ્તુત છે તેઓ તો ‘જૈન’ છે. એમનું વાસ્તવિક નામ પાલ્યકીર્તિ છે એમ દિ. વાદિરાજસૂરિકૃત પાર્શ્વનાથચરિત વગેરે જોતાં જણાય છે. એમનું ‘શાકટાયન’ એવું નામ તો પાછળથી પડ્યું જણાય છે. નંદીની ટીકા(પત્ર^૩ ૧૬અ)માં મલયગિરિસૂરિએ

૧. આ ઉપરથી જોઈ શકાશે કે લુપ્ત થયેલા ગ્રંથો ઉપર પ્રકાશ પાડવામાં પણ જૈન ગ્રંથો સહાયક થઈ પડે તેમ છે. આથી પણ જૈન ગ્રંથોનો પરિશીલનપૂર્વક વિસ્તૃત પરિચય કરાવનાર પુસ્તકની આવશ્યકતા સિદ્ધ થાય છે.

૨. જુઓ સિ. હે.ની શ્રી વિજયલાવણ્યસૂરિએ વિ. સં. ૨૦૦૭માં સંપાદિત કરેલી આવૃત્તિ.

૩. આધુનિક વિદ્વાનોના મોટા ભાગની માન્યતા મુજબ એમનો સમય વિ. સં. ૭૫૭-૮૨૭ છે. શ્રી યુધિષ્ઠિર મીમાંસક તો એમને વિ. સં. ૭૫૭થી પ્રાચીન માને છે, અને એમનો સ્વર્ગવાસ વિ. સં. ૫૮૫માં થયાની જૈન શ્રુતિ-પરંપરાને સમુચિત ગણે છે. જુઓ સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૩૨).

૪. આ ટીકાના કર્તા બૌદ્ધ આચાર્ય ધર્મોત્તર છે.

૫. જુઓ સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૩૨)

૬. અભયચંદ્રકૃત શાકટાયન-પ્રક્રિયાસંગ્રહ સહિત આ વ્યાકરણ જેષ્ઠરામ મુકુંદજીએ મુંબઈથી ઈ. સ. ૧૮૦૭માં પ્રકાશિત કર્યું છે.

૭. મેં જે પત્રાંક આપ્યો છે તે તો આગમોદય સમિતિ તરફથી ઈ. સ. ૧૯૨૪માં છપાયેલી આવૃત્તિનો છે. જૈ. સા. ઈ.માં પત્રાંક તરીકે ૨૩નો ઉલ્લેખ અને આનંદબોધિની વૃત્તિ સહિતની સિ. હે.ની આવૃત્તિની પ્રસ્તાવના (પૃ. ‘ખ’)માં ૧૫નો ઉલ્લેખ છે તો એ નંદી (સદીક)ની કઈ કઈ આવૃત્તિઓને અંગે છે ?

P. ૨૬ એમને ‘યાપનીય’ યતિઓના સમુદાયના અગ્રણી કહ્યા છે, અને એમના સ્વોપજ શબ્દાનુશાસનની નિમ્નલિખિત પ્રારંભિક પંક્તિ પણ રજૂ કરી છે :-

“શ્રીવીરમમૃતં જ્યોતિર્નત્વાડિં સર્વવેધસામ્”

આ શાકટાયને પોતાના શબ્દાનુશાસન ઉપર અમોઘવૃત્તિ રચી છે. વળી એમણે^૧ સ્ત્રીમુક્તિ-કેવલિભુક્તિ-પ્રકરણ રચ્યું છે. રાજશેખરે કાવ્યમીમાંસામાં પાલ્યકીર્તિનો મત નોંધ્યો છે. એ ઉપરથી એમણે કોઈ અન્ય સાહિત્યિક કૃતિ પણ રચી હોય એમ ભાસે છે.

આ સિદ્ધાંતજ્ઞ અને તાર્કિક (અભિનવ) શાકટાયન નૃપતિ અમોઘવર્ષના સમકાલીન છે. એ હિસાબે એમનો સમય વિ. સં. ૮૭૧ થી ૯૨૪ની આસપાસનો ગણાય.

શાકટાયન ૨વ્યાકરણ- મંગલ-શ્લોકથી શરૂ થતું આ વ્યાકરણ ચચ્યાર પાદવાળા ચાર અધ્યાયમાં વિભક્ત છે. આમ આમાં જે સોળ પાદ છે તેની સૂત્ર-સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે :-

૧૮૦, ૨૨૩, ૧૮૫, ૧૨૩, ૨૨૮, ૧૭૨, ૧૧૩, ૨૩૮, ૨૦૧, ૨૨૭, ૨૮૧, ૧૪૬, ૨૭૧, ૨૬૧, ૨૮૮ અને ૧૮૬. આમ અહીં એકંદરે ૩૩૩૬ સૂત્રો છે.

(શાકટાયન) શબ્દાનુશાસનમાં ચાર અધ્યાય છે અને પ્રત્યેક અધ્યાયમાં ચચ્યાર પાદ છે. બધું મળીને ૩૩૩૬ સૂત્રો છે. આ વ્યાકરણ એવી રીતે રચાયું છે કે ઈષ્ટિ^૨ અને ઉપસંખ્યાનની આવશ્યકતા રહેતી નથી. ‘જે અહીં નથી તે અન્યત્ર પણ નથી’^૩ એવું વિધાન પણ આને અંગે યક્ષવર્માએ કર્યું છે.

આ શબ્દાનુશાસનમાં^૪ આર્યવજ્ર, ઈન્દ્ર^૫ અને સિદ્ધનંદિ^૬ એમ ત્રણ પૂર્વાચાર્યોનો ઉલ્લેખ છે. છેલ્લા બે ‘યાપનીય’ હશે અને પહેલા તો સુપ્રસિદ્ધ વજ્રસ્વામી હશે કે જેમનો સ્વર્ગવાસ વીરસંવત્ ૫૮૪માં થયો છે. તિલોયપણજાતિમાં જે વજ્રયશ નામના અંતિમ પ્રજાશ્રમણનો ઉલ્લેખ છે તે આ વજ્રસ્વામી હશે.^૭

P. ૨૭ સ્વોપજ અમોઘવૃત્તિ-શાકટાયને પોતાના શબ્દાનુશાસનની ઉપર આ વૃત્તિ રચી છે. એના નામગત ‘અમોઘ’ શબ્દ અમોઘવર્ષ નામના નૃપતિનો સૂચક છે. આ વૃત્તિનું પરિમાણ લગભગ ૧૮૦૦૦ શ્લોક જેવું છે. આ વૃત્તિમાં શ્વેતાંબર સાહિત્ય તરીકે સુપ્રસિદ્ધ આવશ્યક,^૮ કાલિકસૂત્ર,^૯ છેદસૂત્ર^{૧૦} અને નિર્યુક્તિનો^{૧૧} ઉલ્લેખ છે.

૧. આ “જૈન સાહિત્ય સંશોધક” (ભા. ૨, અં. ૩-૪ ઈ.સ. ૧૯૨૫)માં છપાયું છે. [પૂ. મુનિશ્રી જંબૂવિજય મ. એ સંશોધિત. સંપાદિત થઈ પ્રગટ થયેલ છે.]

૨. આ વ્યાકરણ યક્ષવર્માએ રચેલી ચિન્તામણિ નામની લઘુવૃત્તિ સહિત તેમજ સૂત્રપાઠ, અમોઘવૃત્તિમાંથી ઉદ્ભૂત અને સિદ્ધાન્તકૌમુદી પ્રમાણે સંસ્કારિત કરેલા ગણપાઠ, સૂત્રની અકારાદિ ક્રમે સૂચી, પાતુપાઠ, તથા પાતુપાઠની અનુક્રમણિકા સહિત ડૉ. જગન્નાથપ્રસાદે ઈ.સ. ૧૯૨૧માં પ્રસિદ્ધ કર્યું છે.

૩. જે સૂત્ર અને વાર્તિકથી સિદ્ધ ન થાય, પરંતુ ભાષ્યકારના પ્રયોગાદિ વ્યવહારથી સિદ્ધ થાય તેને ‘ઈષ્ટ’ કહે છે.

૪. વ્યાસ અને બાણની કૃતિ માટે પણ આમ કહેવાય છે.

૫-૭. જુઓ અનુક્રમે ૧-૨-૧૩, ૧-૨-૩૭ અને ૨-૧-૨૨૮.

૮. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૧૬૨)

૯. જુઓ ૧-૨-૨૦૩ અને ૧-૨-૨૦૪ ની વૃત્તિ.

૧૧. જુઓ ૪-૪-૧૩૩ ની વૃત્તિ.

૧૦. જુઓ ૩-૨-૪૭ ની વૃત્તિ.

૧૨. જુઓ ૪-૪-૧૪૦ની વૃત્તિ.

અહીં “ઉપસર્વગુણં વ્યાખ્યાતારઃ” એ ઉલ્લેખ દ્વારા સર્વગુણને શ્રેષ્ઠ વ્યાખ્યાતા કહ્યા છે. એઓ આરાહણા (આરાધના)ના કર્તા શિવાર્યના વિદ્યાગુરુ હશે.^૧

વર્ધમાનસૂરિએ ગ. ર. મ. (પૃ. ૮૨ અને પૃ. ૮૦)માં આ અમોઘવૃત્તિમાંથી ઉદ્ભવ આપી એના કર્તા તરીકે શાકટાયનનો ઉલ્લેખ કર્યો છે. સર્વાનંદે અમરટીકા-સર્વસ્વમાં આ અમોઘવૃત્તિમાંથી પાલ્યકીર્તિના નામપૂર્વક ઉદ્ભવ આપ્યું છે.

અમોઘવૃત્તિમાં “અદહદમોઘવર્ષોઽરાતીનૃ” એવું ઉદાહરણ છે. અહીં જે અમોઘવર્ષનો ઉલ્લેખ છે એ જૈન વિદ્વાનોના આશ્રયદાતા અને શકસંવત્ ૭૩૬માં ગાદીએ બેસનારા નૃપતિ છે. આ ઉપરથી આ વૃત્તિની રચના શકસંવત્ ૭૩૬થી ૭૮૮ના ગાળામાં થઈ છે. એમ કહી શકાય.^૨

અમોઘવૃત્તિનો ન્યાસ-આના કર્તા દિ. પ્રભાચન્દ્ર છે અને તે પણ શબ્દાંભોજ ભાસ્કરના કર્તા છે એમ કેટલાક સોળમી સદીના શિલાલેખ અને કેટલીક કિંવદન્તીને આધારે માને છે, પરંતુ પ્રમેયકમલમાર્તંડની P. ૨૮ પ્રસ્તાવના (પૃ. ૬૮)માં પં. મહેન્દ્રકુમારે આ બાબત શંકાસ્પદ હોવાનું કહ્યું છે અને સાથે સાથે એ માટે નીચે મુજબનાં આઠ કારણો પણ એમણે રજૂ કર્યા છે :-

- (૧) મંગલશ્લોક નથી તેનું શું ?
- (૨) ગ્રંથમાં કોઈ સ્થળે પ્રભાચન્દ્રનું નામ નથી.
- (૩) પ્રસ્તુત ન્યાસ માટે કોઈ વિશિષ્ટ નામ ન્યાસકારે આપ્યું નથી.
- (૪) શાકટાયનની સ્ત્રીમુક્તિ અને કેવલિ-ભુક્તિને અંગેની માન્યતાઓનું ખંડન કરનાર કહર દિ. પ્રભાચન્દ્ર એ શાકટાયનના વ્યાકરણ ઉપર ન્યાસ રચે ખરા ?
- (૫) શાકટાયન માટે વપરાયેલાં ગૌરવશાળી વિશેષણોનું ન્યાસમાં સમર્થન છે તો પ્રભાચન્દ્ર તેમ કરે ખરા ?
- (૬) શાકટાયન-વ્યાકરણમાંથી, જૈનેન્દ્ર-વ્યાકરણની પેઠે પ્રભાચન્દ્રીય કૃતિમાં એક પણ સૂત્ર ઉદ્ધૃત કરાયું નથી તેનું શું ?
- (૭) આ ન્યાસમાં પ્રભાચન્દ્રની કોઈ કૃતિનો કે એમની અન્ય કોઈ કૃતિમાં આ ન્યાસનો ઉલ્લેખ નથી તેનું શું ?
- (૮) શબ્દાંભોજભાસ્કર જેવી પ્રસન્ન શૈલી આ ન્યાસમાં નથી તેનું શું ?

આવી પરિસ્થિતિમાં પં. મહેન્દ્રકુમાર તો આ ન્યાસના કર્તા શાકટાયન જ હશે એવી કલ્પના કરવા પ્રેરાયા છે, અને પ્રભાચન્દ્રની જૈનેન્દ્ર વ્યાકરણ ઉપરના ન્યાસકાર તરીકેની પ્રસિદ્ધિ શાકટાયનીય ન્યાસના કર્તા મનાવવામાં કારણભૂત બની હશે એમ એમણે સૂચવ્યું છે.

તેરમી સદીના લીલાશુક મુનિએ “દૈવમ્”ની પુરુષકાર ટીકા. (પૃ.૬૬)માં શાકટાયન-ન્યાસમાંથી P. ૨૮ અવતરણ આપ્યું છે,^૩ એ આ જ ન્યાસનું હશે, માધવીય ધાતુવૃત્તિમાં પણ ન્યાસમાંથી અવતરણ અપાયું છે.^૪

ચિન્તામણિ-આ ઉપર્યુક્ત વ્યાકરણની યક્ષવર્માકૃત લઘુવૃત્તિ છે. એના પ્રારંભમાં બાર પદો છે. એનાં ત્રીજા અને ચોથા પદમાં આ વ્યાકરણના કર્તા શાકટાયનની અને પાંચમા અને છઠ્ઠામાં એમના આ વ્યાકરણની પ્રશંસા છે. સાતમા પદમાં અતિમહત્તી વૃત્તિના સંક્ષેપરૂપે આ લઘુવૃત્તિ રચ્યાનો ઉલ્લેખ છે. આ

૧. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૧૫૩).

૩. જુઓ સં. વ્યા. ઈ. (પૃ. ૪૩૮)

૨. એજન, પૃ. ૧૬૧.

૪. જુઓ જિ. ર. કો. (ખંડ ૧, પૃ. ૩૭૭)

લઘુવૃત્તિનું પરિમાણ છ હજાર શ્લોક જેવું છે એમ નવમા પદ્યમાં કહ્યું છે. દસમા પદ્યમાં એવો ઉલ્લેખ છે કે આ લઘુ વૃત્તિમાં ઈન્દ્ર, ચન્દ્ર વગેરે વૈયાકરણોએ જે કહ્યું છે તે બધું આમાં છે અને જે અહીં નથી તે અન્યત્ર નથી. આ ડો. જગન્નાથપ્રસાદ દ્વારા ઈ.સ. ૧૯૨૧માં પ્રસિદ્ધ છે. જુઓ પૃ. ૧૪ ટિ. ૨

અ. ૧, પા. ૩ ને અંગેની લઘુવૃત્તિની પુષ્પિકામાં પ્રસ્તુત શાકટાયનને 'શ્રુતકેવલિદેશીય' કહ્યા છે.

આ ચિન્તામણિટીકા અને એની ટીકા— ચિન્તામણિ ટીકા એ અમોઘવૃત્તિના સંક્ષેપરૂપ છે. એના કર્તા યક્ષવર્મા છે. એ કોઈ ગૃહસ્થ હશે. આ 'ચિન્તામણિ-ટીકા' ઉપર દિ. આચાર્ય અજિતસેને 'મણિ' નામની ટીકા રચી છે.

પ્રક્રિયાઓ—

'પ્રક્રિયા-સંગ્રહ'—આની શૈલી સિદ્ધાંત-કૌમુદીને મળતી આવે છે. એના કર્તા દિ. અભયચન્દ્ર છે. વિદ્યાર્થીઓ માટે એ યોજાયેલી હોવાથી એમાં શબ્દાનુશાસનનાં તમામ સૂત્રોની વ્યાખ્યા નથી.

શાકટાયન-ટીકા—આ પ્રક્રિયાનુસારી ગ્રંથ છે. એના કર્તા 'વાદિપર્વતવજ્ર' ને નામે ઓળખાતા દિ. ભાવસેન^૩ ત્રૈવિદ્ય છે.

'રૂપસિદ્ધિ'—આ લઘુપ્રક્રિયારૂપ છે. એના કર્તા દિ. દયાપાલમુનિ છે. એઓ 'દ્રવિડ' સંઘના મતિસાગરના શિષ્ય થાય છે. એઓ વિ. સં. ૧૦૫૨ની આસપાસમાં થયા છે.

૭ લિંગાનુશાસન^૪—ભાષા શબ્દોની બનેલી છે. એ શબ્દો કયા લિંગના અર્થાત્ કઈ જાતિના ગણવા એ બાબત એને અંગેની પરંપરા ઉપર આધાર રાખે છે. હિંદી જેવી ભાષા પુલ્લિંગ અને સ્ત્રીલિંગ એમ બે જ જાતિમાં સમગ્ર શબ્દોને વિભક્ત કરે છે, જ્યારે ગુજરાતી, અંગ્રેજી વગેરે ભાષાઓ એ બે ઉપરાંત નપુંસક-લિંગ પણ ગણાવે છે. સંસ્કૃત અને પાઈય ભાષાઓમાં પણ આ ત્રણ લિંગ છે. કયો શબ્દ કયા લિંગનો ગણવો એ માટે વ્યાપક સ્વરૂપે સામાન્ય નિયમો ઘડી શકાય તેમ ન હોવાથી સંસ્કૃત શબ્દોનાં લિંગો સૂચવનારી કૃતિની આવશ્યકતા સિદ્ધ થાય છે. વળી આવી કૃતિની યોજના એ વ્યાકરણ સાથે અગત્યનો અને અનિવાર્ય સંબંધ ધરાવનારા અંગની બોધક બને છે. આથી આવી કૃતિઓ પાણિનિના^૫ સમયથી તો રચાતી આવી છે.

મુખ્ય મુખ્ય વૈયાકરણોની શાખાઓ ગણાય છે. તે તે શાખા વ્યાકરણનાં સૂત્રપાઠ, ગણપાઠ, ઉણાદિસૂત્ર, ધાતુપાઠ, લિંગાનુશાસન એમ પાંચે અંગોને બોધ કરાવનારી સામગ્રી પૂરી પાડે એ સ્વાભાવિક છે, પરંતુ સૂત્રપાઠ રચનાર જ બાકીનાં ચારે અંગો રચે એવો કંઈ નિયમ નથી. તેમ છતાં એ બધાં જો

૧. સમંતભદ્રે આ ટીકાનાં વિષમ પદો ઉપર ટિપ્પણ રચ્યું છે, અને એ ટિપ્પણનો ઉલ્લેખ માધવીય ધાતુવૃત્તિમાં છે.

૨. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૨૫ ગુસ્તવ આપર્ટને આ કૃતિ ઈ. સ. ૧૮૯૩માં પ્રસિદ્ધ કરી છે. એમાં એમણે શાકટાયનને 'પ્રાચીન શાકટાયન' માનવાની ભૂલ કરી છે. [સન્ ૧૯૭૦માં મુંબઈથી જયેષ્ઠારામ મુકુંદજીએ પણ પ્રક્રિયાસંગ્રહ પ્રસિદ્ધ કર્યો છે.]

૩. એમણે વિશ્વતત્ત્વપ્રકાશ રચ્યો છે.

૪. આ પ્રકાશિત છે.

૫. આ અમુદ્રિત હોય એમ જણાય છે.

૬. સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૧૫૯) પ્રમાણે પાણિનિએ પંચાંગ વ્યાકરણ રચ્યું છે.

એક જ કર્તાની રચના હોય તો તે ઇષ્ટ ગણાય. ગમે તેમ પણ શાકટાયન વગેરે^૧ કેટલાક જૈન વૈયાકરણોએ તો પોતે આ જાતની કૃતિ રચી છે, અને એને લિંગાનુશાસન તરીકે ઓળખાવી છે. શાકટાયનકૃત લિંગાનુશાસનની હાથપોથી મળે છે. એ ‘આર્યા’ છંદમાં રચાયેલી ૭૦ પદ્યોની કૃતિ છે.

ધાતુપાઠ^૨—શાકટાયને આના મંગલાચરણરૂપ પદ્યમાં ‘જિન’ને નમસ્કાર કરી “एधि वृद्धौ, स्पधि P. ૩૧ સંઘર્ષે” થી શરૂઆત કરી છે. એમણે ૧૩૧૭ (૧૨૮૦+૩૭) ધાતુઓ અર્થ સહિત આપ્યા છે. અંતમાના ૩૭ કંડ્વાદિ ધાતુઓ સિવાયના ધાતુઓને એધ, અદ, હુ, દિવ, ષુ, ક્રી, તુદ, તન્, રુધ, ચુર અને યુજ્ એમ ૧૧ શીર્ષકમાં વિભક્ત કર્યા છે. આ તેમજ એવા બીજા ૩૬ ધાતુઓને ‘વિકલ્પ-ણિજન્ત’ તરીકે એટલે કે વિકલ્પે ‘અય્’ પ્રત્યય લેનારા તરીકે ઓળખાવાયા છે, જ્યારે ચુર વગેરેને ‘નિત્ય-ણિજન્ત’ ધાતુ કહ્યા છે.

પંચગ્રંથી યાને બુદ્ધિસાગર—(વિ. સં. ૧૦૮૦)—આ વ્યાકરણના કર્તા બુદ્ધિસાગરસૂરિ છે. એમણે લિંગાનુશાસન પણ રચ્યું છે.^૩ એઓ ‘ચંદ્ર’કુળના વર્ધમાનસૂરિના શિષ્ય થાય છે. પ્રમાલક્ષ્મ યાને પ્રમાલક્ષ્મણના કર્તા જિનેશ્વરસૂરિ એમના સહોદર થાય છે. બુદ્ધિસાગરસૂરિએ આ વ્યાકરણ ‘જાબાલિપુર’માં વિ. સં. ૧૦૮૦માં રચ્યું છે. આ વાત તેમજ આ આદ્ય વ્યાકરણ છે એ હકીકત પણ એના અંતિમ પદ્યમાં ગ્રંથકારે જાતે કહી છે. વિશેષમાં એમણે અહીં આ ગ્રંથનું ‘પરિમાણ ૭૦૦૦ શ્લોકનું કહ્યું છે. પ્ર. ચ. P. ૩૨ (અભયદેવસૂરિચરિત’ શૃંગ ૧૯, શ્લો. ૮૮)માં તો આનું પરિમાણ ૮૦૦૦ દર્શાવાયું છે. સાથે સાથે આ નવું વ્યાકરણ બુદ્ધિસાગરસૂરિએ રચ્યું છે અને એનું નામ બુદ્ધિસાગર છે એવો પણ અહીં ઉલ્લેખ છે.

આ વ્યાકરણની એક તાડપત્રીય પ્રતિ જેસલમેરના ભંડારમાં છે. એનો આદિમ ભાગ નીચે મુજબ છે :—

“सिद्धं जिनं सर्वविदं निरञ्जनं सवीर्यमीशं कमलालयं गुरून् ।

नत्वा प्रबद्धो लघुपूर्णपद्यवाक् लब्ध(?) लक्ष्म्याऽबुधबुद्धिवृद्धये ॥”

રચનાનો હેતુ—આ વ્યાકરણ તેમજ પ્રમાલક્ષ્મ રચવાનો હેતુ પ્રમાલક્ષ્મનાં નિમ્નલિખિત પદ્યોમાં સ્પષ્ટપણે દર્શાવાયો છે :—

૧. વગેરેથી ખાસ કરીને બુદ્ધિસાગરસૂરિ અને કલિ. હેમચન્દ્રસૂરિ એ બે નામો હું સૂચવું છું.
૨. આ શાકટાયનીય ધાતુપાઠ પં. ગૌરીલાલ જૈને વીરસંવત્ ૨૪૩૭માં છપાવ્યો છે. અંતમાં ધાતુઓની અકારાદિ ક્રમે સૂચી અપાઈ છે.
૩. આ વ્યાકરણ કોઈ સ્થળેથી પ્રસિદ્ધ થયું હોય એમ જણાતું નથી. [અપૂર્ણ પ્રતિના આધારે પ્રો. કંસારા સંપાદનનો પ્રાયસ કરે છે.]
૪. આ નામની નીતિવિષયક કૃતિ સોની સંગ્રામસિંહે વિ. સં. ૧૫૨૦માં રચી છે અને એ છપાયેલી છે.
૫. આ પ્રમાણનો ઉલ્લેખ “મદ્રાસ વિદ્યાપીઠ” તરફથી પ્રકાશિત હર્ષવર્ધનકૃત લિંગાનુશાસનની ભૂમિકા (પૃ. ૩૪)માં એના સંપાદકે કર્યો છે. અને એ યથાર્થ છે, કેમકે આ વ્યાકરણના અંતિમ ભાગમાં નીચે મુજબનું પદ્ય છે :—

“શ્રી વિક્રમાદિત્યનરેન્દ્રકાલાત્ સાશીતિકે યાતિ સમાસહસ્ત્રે ।

સત્રીક ‘જાબાલિ’પુરે તદાદ્યં, હવ્યં મયા સપ્તસહસ્રકલ્પમ્ ॥”

૬. આ પરિમાણ આ વ્યાકરણના મૂલપાઠ અને એની વૃત્તિ સહિતનું છે એમ સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૪૭)માં કહેવાયું છે.

“તૈરવધીરિતે યત્ તુ પ્રવૃત્તિરાવયોરિહ । તત્ર દુર્જનવાક્યાનિ પ્રવૃત્તેઃ સન્નિબન્ધનમ્ ॥૪૦૩॥

શબ્દલક્ષ્મ પ્રમાલક્ષ્મ યદેતેષાં ન વિદ્યતે । નાદિમન્તસ્તતો હ્યેતે પરલક્ષ્મોપજીવિનઃ ॥૪૦૪॥”

આનો અર્થ એ છે કે મારી અને બુદ્ધિસાગરસૂરિની પ્રવૃત્તિમાં દુર્જનોનાં વાક્યો કારણરૂપ છે. એ વાક્યો એ છે કે આ લોકો પાસે-શ્વેતાંબરોની પાસે, નથી શબ્દલક્ષ્મ યાને ‘વ્યાકરણ કે નથી

P. ૩૩ પ્રમાણલક્ષ્મ યાને પ્રમાલક્ષણ’. આ લોકો કંઈ પહેલેથી નથી; એઓ તો પાછળથી જન્મ્યા છે. એથી એઓ ‘બૌદ્ધ’ વગેરેના ગ્રંથો ઉપર આધાર રાખનારા છે. એના વડે એઓ જીવે છે.

આધાર-પ્રમાલક્ષ્મના અંતિમ (૪૦૫માં) શ્લોકમાં કહ્યું છે કે આચાર્ય બુદ્ધિસાગરે વ્યાકરણ વૃત્તોમાં રચ્યું છે. આનો અર્થ સ્વોપજા વૃત્તિ (પત્ર ૮૦ અ)માં સૂચવતાં જિનેશ્વરસૂરિએ કહ્યું છે કે બુદ્ધિસાગરસૂરિએ આ વ્યાકરણ પાણિનિ, યન્ત્ર, જૈનેન્દ્ર, વિશ્રાન્ત અને ‘દુર્ગ-ટીકાને જોઈને ધાતુ(પાઠ), સૂત્ર(પાઠ), ગણ(પાઠ) અને ઉણાદિ(સૂત્ર)ની વૃત્તમાં રચના કરી છે. આથી એ વાત સ્પષ્ટ રીતે ફલિત થાય છે કે સમગ્ર પંચાંગ વ્યાકરણ છંદોબદ્ધ છે.

ઉલ્લેખ-ધનેશ્વરસૂરિએ વિ. સં. ૧૦૮૫માં રચેલી સુરસુંદરીચરિય (પરિચ્છેદ ૧૬, શ્લો. ૨૪૫)માં બુદ્ધિસાગરસૂરિનો ઉલ્લેખ છે. પંચાસગની અભયદેવસૂરિએ વિ. સં. ૧૧૨૦માં રચેલી વૃત્તિ (પ્રશસ્તિ, શ્લો. ૩)માં, ગુણચન્દ્રે વિ. સં. ૧૧૩૮માં રચેલા મહાવીરચરિય (પ્રસ્તાવ ૮, શ્લો. ૫૩)માં, જિનદત્તસૂરિએ ગણહરસદ્સયગના હલમાં પદ્યમાં, પદ્યપ્રભે કુંથુનાથચરિતમાં અને ઉપર સૂચવ્યા મુજબ પ્ર. ચ.માં આ

P. ૩૪ બુદ્ધિસાગર વ્યાકરણ વિષે ઉલ્લેખ છે. અભિધાનચિન્તામણિ કાંડ ૩, શ્લો. ૨૬૭)ની સ્વોપજા વિવૃત્તિ (પૃ. ૨૪૫)માં બુદ્ધિસાગરનો જે ઉલ્લેખ છે એ કર્તાના નામને અંગે હોય એમ લાગે છે.

હૈમ પંચાંગ વ્યાકરણ (લ. વિ. સં. ૧૧૮૩)- વ્યાકરણનાં (અ) સૂત્રપાઠ, (આ) ઉણાદિસૂત્રો, (ઈ) ધાતુપાઠ, (ઈ) ગણપાઠ અને (ઉ) લિંગાનુશાસન એમ પાંચ અંગ ગણાય છે. ‘કલિ.’ ‘હૈમચન્દ્રસૂરિએ પંચાંગ વ્યાકરણ રચ્યું છે. વિશેષમાં એમણે એનાં પાંચે અંગોને સ્વોપજા વૃત્તિ વડે વિભૂષિત કર્યા છે.

૧. જુઓ પં. બેચરદાસ. દોશીનો લેખ નામે “ગુજરાતનું પ્રધાન વ્યાકરણ” (પૃ. ૮૩). આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં રજૂ કરાયેલા નિબંધરૂપ આ લેખ “પુરાતત્વ” (પૃ. ૪, અં. ૧-૨, પૃ. ૬૧-૧૦૦)માં છપાયો છે. પૃ. ૮૩માં અંતિમ ભાગ અપાયો છે.

૨. સિદ્ધસેન દિવાકરે ન્યાયાવતાર અને સ. પ. રચ્યાં છે તેનું શું ? શું દુર્જનોએ આનો અપલાપ કર્યો હશે ?

૩. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૨૪)માં આનો અર્થ એમ કરાયો છે કે આ વ્યાકરણ છંદોબદ્ધ છે, અને એ અર્થ બરાબર છે, પરંતુ “ગુજરાતનું પ્રધાન વ્યાકરણ” નામના લેખ (પૃ. ૮૪)માં તો કહ્યું છે કે ‘આ વ્યાકરણ જોતાં જણાય છે કે એ કેવળ પદ્યોમાં નથી પણ ગદ્યપદ્યરૂપ છે.’

૪. આ વિશ્રાન્ત તે વામનકૃત વિશ્રાન્તવિધાધર વ્યાકરણ હશે.

૫. કાતન્ત્ર વ્યાકરણ ઉપર દુર્ગસિંહે જે ટીકા રચી છે તે આ છે. ચતુર્વિંશતિપ્રબંધ (પ્રબંધ ૨૪, પૃ. ૨૨૬)માં દુર્ગસિંહકૃત વૃત્તિનો ઉલ્લેખ છે. સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૦૮) પ્રમાણે દુર્ગટીકા કાશિકા કરતાં પહેલાં રચાઈ છે અને કાશિકા એ વામને અને જયાદિત્યે સાથે મળીને રચેલી ટીકા છે અને એની રચના ભારવિના સમય પછી થયેલી છે.

૬. એમના જીવનની રૂપરેખા માટે જુઓ ત્રીજા પ્રકરણનો પ્રારંભિક ભાગ.

આગળ ઉપર એના એક અંગરૂપ ‘સૂત્રપાઠની પ્રક્રિયારૂપે સંકલના કરાઈ છે એટલું જ નહિ પણ આ વ્યાકરણને ઉદ્દેશીને સ્વતંત્ર અને સંક્ષિપ્ત કૃતિઓ પણ રચાઈ છે. આમ આ પંચાંગ વ્યાકરણને અંગે પુષ્કળ ‘સાહિત્ય યોજાયું છે. એનું યથેષ્ટ નિરૂપણ ખૂબ જગ્યા માગી લે તેમ છે એટલે એને અહીં સ્થાન ન આપતાં હું એનો સ્વતંત્ર પ્રકરણરૂપે હવે પછી વિચાર કરીશ.

ભદ્રેશ્વર વ્યાકરણ (ઉ. વિ. સં. ૧૧૯૭)- ગ. ર. મ.ની સ્વોપજ વૃત્તિમાં દીપકકર્તા તે ભદ્રેશ્વરસૂરિ છે અને આધુનિક વૈયાકરણોની અપેક્ષાએ એમનું પ્રાધાન્ય છે એમ કહ્યું છે. આથી એમણે કોઈ વ્યાકરણ રચ્યું ન. ૩૫ હશે એમ લાગે છે. એ અનુપલબ્ધ વ્યાકરણનું નામ જાણવામાં નથી એટલે મેં અહીં આ નામ યોજ્યું છે.

ગણરત્નમહોદધિ (વિ. સં. ૧૧૯૭) અને એની સ્વોપજ વૃત્તિ- આ વ્યાકરણનો ગ્રંથ ગોવિન્દસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિએ પોતાના શિષ્યની પ્રાર્થના અનુસાર વિ. સં. ૧૧૯૭માં રચ્યો છે, અને એને ૪૨૦૦ શ્લોક જેવડી સ્વોપજ વૃત્તિથી વિભૂષિત કર્યો છે. આ ઉપરાંત એમણે ‘સિદ્ધરાજ-વર્ણન નામનો ગ્રંથ રચ્યો છે. સિદ્ધરાજ જયસિંહના દરબારમાંના કેટલાક વિદ્વાનોમાંના એઓ એક હતા. એઓ ‘કલિ.’ હેમચન્દ્રસૂરિના સમકાલીન થાય છે. તેમ છતાં એકે બીજાનો પોતાની કોઈ કૃતિમાં ઉલ્લેખ કરેલો હોય એમ જાણવામાં નથી.

વર્ધમાનસૂરિએ ગ. ર. મ.ને આઠ અધ્યાયમાં વિભક્ત કર્યો છે. એમણે પાણિનીયાદિ વ્યાકરણોને સંમત નામોના ગણોને, નહિ કે ભ્વાદિ નવ કે દસ ધાતુના ગણોને શ્લોકોમાં રજૂ કર્યા છે. આમ કરવા માટે એમણે અષ્ટાંના અધ્યાયોનો ક્રમ ન સ્વીકારતાં પ્રકરણ અનુસાર રચના કરી છે. જેમકે પ્રથમ ‘નામ-ગણ’ અધ્યાયમાં એમણે ગતિ, ઉપસર્ગ, અવ્યય, નિપાત, સર્વનામ વગેરેના ગણો આપ્યા છે. અ. ર.માં સમાસાશ્રિત ગણોને, અ. ૩-૭માં તદ્વિત-ગણોને અને અ. ૮માં કૃત્ અને આખ્યાત સંબંધી ગણોને એમણે P. ૩૬ સ્થાન આપ્યું છે. ભીમસેન શર્માએ પ્રાસ્તાવિક (પૃ. ૨)માં કહ્યું છે કે અષ્ટા.ને સ્થાને અન્ય વ્યાકરણ પ્રચારમાં હશે એથી તો અષ્ટા.ગત ગણસૂત્રો ન આપતાં એ અષ્ટા.ને જોઈને એના ઉપરથી કોઈએ સંક્ષેપમાં રચેલાં સૂત્રો વૃત્તિમાં ઉદ્ધૃત કરાયેલાં જોવાય છે.

૧. “ઋષભદેવજી છગનીરામજી સંસ્થા” તરફથી ઉજજૈનથી ઈ. સ. ૧૯૪૩માં હેમચન્દ્રકૃતિકુસુમાવલીના નામથી જે પુસ્તક પ્રસિદ્ધ કરાયું છે તેમાં પ્રારંભમાં સિ. હે.ના અ. ૫, પા. ૨ સુધીનાં સૂત્રો અપાયાં છે. ત્યાર બાદ ઉણાદિ-સૂત્રો, પછી સિ. હે. નાં બાકીનાં સૂત્રો, વ્યાકરણવિષયક કેટલીક કારિકાઓ, ન્યાયસંગ્રહ (૧૪૦ ન્યાયો), હૈમ લિંગાનુશાસન, હૈમ કાવ્યાનુશાસન તેમજ બે હૈમ દ્વાત્રિશિકા (અયોગ-વ્યવચ્છેદ-દ્વાત્રિશિકા અને અન્ય-યોગ-વ્યવચ્છેદ-દ્વાત્રિશિકા) અપાયાં છે.

૨. મેં “હૈમ પંચાંગ વ્યાકરણના અભ્યાસ માટેનાં સાધનો” નામના લેખમાં આ સાહિત્યની રૂપરેખા આલેખી છે.

૩. આનું સંપાદન જે. એગ્લિંગે (Eggling) “સંસ્કૃત ટેક્સ્ટ સોસાયટી” માટે કર્યું છે. એમાં ૪૬૦ પદ્યો છે. એ ઈ.સ. ૧૮૭૯-૮૧માં પ્રસિદ્ધ થયું છે. ભીમસેન શર્માએ પણ આ મૂળ કૃતિનું સ્વોપજ વૃત્તિ સહિત સંપાદન કર્યું છે. એમણે પ્રારંભમાં ગણોની સૂચી અધ્યાય દીઠ આપી છે અને અંતમાં અકારાદિ ક્રમે શબ્દસૂચી આપી છે.

૪. આનું એક પદ્ય એગ્લિંગની આવૃત્તિના પૃ. ૩૭૨માં અને ભીમસેન શર્માની આવૃત્તિના પૃ. ૧૯૭માં નજરે પડે છે.

પ્રથમ પદમાં વાગ્દેવતાની અને દ્વિતીય પદમાં શાલાતુરીય (પાણિનિ), શકટાંગજ (શાકટાયન), 'ચંદ્રગોમિ', 'દિગ્વજ્ર (દિવનંદિ), ભર્તૃહરિ, વામન, ભોજ અને દીપકકર્તા (ભદ્રેશ્વરસૂરિ)ની સ્તુતિ છે. આની સ્વોપજ વૃત્તિમાં કહ્યું છે કે આ દીપકકર્તાનું પ્રાધાન્ય આધુનિક વૈયાકરણોની અપેક્ષાએ છે. આથી આ ભદ્રેશ્વરે વિ.સં. ૧૧૮૭ પહેલાં કોઈ વ્યાકરણ રચ્યું હોય એમ લાગે છે.

વર્ધમાનસૂરિએ ઉપર્યુક્ત ગણોના પ્રત્યેક પદની વ્યાખ્યા ઉદાહરણપૂર્વક આપી છે. આમાં એમણે અનેક વૈયાકરણોના મતો નોંધ્યા છે. વળી એમણે પોતાના સમકાલીન અને સિદ્ધરાજને અંગે કોઈ કાવ્ય રચનારા સાગરચંદ્રના આ કાવ્યમાંથી શ્લોકો ઉદ્ધૃત કર્યા છે. આ ઉપરાંત 'તદ્વિત' પ્રત્યયોનાં ઉદાહરણો આપતી વેળા એમણે 'ભટ્ટિકાવ્યમાંથી તેમજ 'માલવ'ના 'પરમાર' રાજાઓને લગતા કોઈ કાવ્યમાંથી અનેક પદ્યો ઉદ્ધૃત કર્યા છે.

અવસૂરિ-ગ. ર. મ. ઉપર કોઈકે અવસૂરિ રચી છે. આની વિ. સં. ૧૫૨૮માં લખાયેલી એક હાથપોથી ભા. પ્રા. સં. મં.માં છે.

શબ્દાનુશાસન યાને મુષ્ટિવ્યાકરણ (ઉ. વિ. સં. ૧૨૩૦)- આના કર્તા મલયગિરિસૂરિ છે. એમણે અ. મા.માં રચાયેલા વિવિધ આગમો ઉપર તેમજ જ. મ.માં રચાયેલા કેટલાક અનાગમિક ગ્રંથો P. ૩૭ ઉપર પણ વિવરણો રચ્યાં છે. એમાં દાર્શનિક ચર્ચાઓની વિપુલતા હોવા છતાં વિશદતામાં એમણે ન્યૂનતા આવવા દીધી નથી. આથી એમણે સમર્થ વિવરણકાર તરીકે ખૂબ નામના મેળવી છે. એમની સ્વતંત્ર રચના તરીકે તો અત્યારે આ પ્રસ્તુત વ્યાકરણ જ જાણવામાં છે. એના ઉપર એમણે ૪૩૦૦ શ્લોક જેવડી સ્વોપજ વૃત્તિ રચી છે અને એની હાથપોથીઓ મળે છે. [પં. ભેચરદાસ દોશી દ્વારા સંપાદિત આ મલયગિરિ શબ્દાનુશાસન (અપૂર્ણ) એલ. ડી. ઈસ્ટીટયુટ અમદાવાદથી પ્રસિદ્ધ થયું છે. એના પરિશિષ્ટમાં ૭ વ્યાકરણોના સૂત્રોની તુલના આપી છે.]

મલયગિરિસૂરિએ 'કલિ.' હેમચન્દ્રસૂરિને 'ગુરુ' કહી સંબોધ્યા છે,^૧ અને એ રીતે એમના તરફનો પોતાનો પૂજ્ય ભાવ વ્યક્ત કર્યો છે. આ મલયગિરિસૂરિ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલના તેમજ 'કલિ.' હેમચન્દ્રસૂરિના સમકાલીન છે.

મલયગિરિસૂરિએ રચેલા વ્યાકરણને સામાન્ય રીતે શબ્દાનુશાસન તરીકે ઓળખાવાય છે. એને કેટલાક મુષ્ટિવ્યાકરણ કહે છે. એમાં ચચ્યાર પાદ્મજાળા બાર અધ્યાયો છે.^૨ વિદ્વદ્વલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીએ એક^૩ લેખમાં કહ્યું છે કે આજે આ વ્યાકરણ પૂરેપૂરું મળતું નથી. વિશેષમાં એમણે બે હાથપોથીનો નીચે મુજબની મતલબનો પરિચય આપ્યો છે.

૧. વૃત્તિમાં 'ગોમિ'નો અર્થ 'પૂજ્ય' કરાયો છે.

૨. આનો સામાન્ય અર્થ 'દિગંબર' થાય છે. પૃ. ૧૬૪માં દિગંબરો સામે કટાક્ષ કરાયો છે (જુઓજૈ. સા. ઈ.નું પૃ. ૨૬૨)

૩. આ કાવ્યની શૈલી દ્વાયાશ્રયના જેવી છે.

૪. જુઓ આવસ્સયની વૃત્તિ (પત્ર ૧૧આ) પ્રસ્તુત ઉલ્લેખ નીચે મુજબ છે : "તથા ચાહુ: સ્તુતિષુ ગુરવઃ"

૫. આનું પરિમાણ ૬૦૦૦ શ્લોકનું છે એમ જૈ. સા. સં. ઈ. (પૃ. ૨૭૪)માં નોંધ છે.

૬. આ લેખનું નામ "આચાર્ય શ્રીમલયગિરિ અને તેમનું શબ્દાનુશાસન" છે. એ લેખ "જૈન સત્ય પ્રકાશ" (વર્ષ ૭, અંક ૧-૩, પૃ. ૧૪૧-૧૪૪)માં છપાયો છે. આનો મેં અહીં ઉપયોગ કર્યો છે. આ લેખમાં "મુષ્ટિ-વ્યાકરણ" એ નામ નથી.

(૧) પાટણના વાડી-પાર્શ્વનાથના ભંડારમાં આ વ્યાકરણની કાગળ ઉપર લખેલી હાથપોથીમાં પંચસંધિ, નામ, આખ્યાત અને કૃત્ સુધીનો અધિકાર છે. અર્થાત્ એમાં ચતુષ્ક-વૃત્તિ, આખ્યાત-વૃત્તિ અને કૃદ્-વૃત્તિ એમ ૫. ૩૮ ત્રણ વૃત્તિનાં મળીને ત્રીસ પાદ જેટલો વિભાગ છે, પણ ૧૮ પાદ જેટલી તદ્વિત-વૃત્તિ એમાં નથી.

(૨) પાટણમાં સંઘવીના પાડામાં તાડપત્રીય પ્રતિ છે પણ એ ખંડિત છે. એમાં તદ્વિત-વૃત્તિ તો છે, જો કે અપૂર્ણ છે. તદ્વિતના અ. ૨, પા. રના અપૂર્ણ અંશથી માંડીને દસમા પાદની સમાપ્તિ સુધીનો ભાગ એમાં જોવાય છે. આમ તદ્વિતનો દોઢેક અધ્યાય જેટલો ભાગ નાશ પામ્યો છે.

ભા. પ્રા. સં. મં.માં તાડપત્રીય પ્રતિ છે. એનો પરિચય મેળવવો બાકી રહે છે.

મુષ્ટિવ્યાકરણમાં પ્રારંભમાં નિમ્નલિખિત સૂત્રો છે :-

“સિદ્ધિરનેકાન્તાત્ । લોકાદ્ વર્ણક્રમઃ ।”

આ વ્યાકરણની સ્વોપજ વૃત્તિમાં મલયગિરિસૂરિએ પોતાને ‘આચાર્ય કલ્યા છે અને આ વ્યાકરણને શબ્દાનુશાસન કહ્યું છે. પુણ્યવિજયજીને મતે આ સ્વોપજ વૃત્તિ એ સિ. હે.ની સ્વોપજ વૃત્તિનું પ્રતિબિંબ જ છે.’

મુષ્ટિવ્યાકરણમાં કૃદ્-વૃત્તિ પાઠ ઉમાં ‘ચ્ચાતે દૃષ્યે’ એવું બાવીસમું સૂત્ર છે. એની સ્વોપજ વૃત્તિમાં “અદહદરાતીન્ કુમારપાલઃ” એવું ઉદાહરણ છે. આ ઉપરથી એમ અનુમાન થાય છે કે સ્વોપજ વૃત્તિ તો કુમારપાલના રાજ્યસમયમાં જ રચાઈ છે. મૂળ વ્યાકરણની રચના સિ. હે. પછી અને તે પણ કુમારપાલના રાજ્ય દરમ્યાન થઈ હશે અથવા સિદ્ધરાજ જયસિંહના રાજ્યકાળમાં થઈ હશે એમ જે બે ૫. ૩૮ વિકલ્પો પુણ્યવિજયજીએ દર્શાવ્યા છે તેમાંનો બીજો વિકલ્પ હું પસંદ કરું છું. આનું કારણ એ છે કે સિ. હે. રચાયા બાદ એનું જે બહુમાન કરાયું છે અને એના પઠન-પાઠન માટે જે વ્યવસ્થા કર્યાના ઉલ્લેખ મળે છે તે પછી મલયગિરિસૂરિને નવું વ્યાકરણ રચવા માટે કોઈ વિશિષ્ટ કારણ ભાગ્યે જ હોઈ શકે. કદાચ ભિન્ન રુચિ ધરાવનાર જનોને ઉદ્દેશીને રચ્યું હોય તો ના નહિ. એવી પણ કલ્પના સ્ફુરે છે કે મુષ્ટિવ્યાકરણની સંપૂર્ણ રચના અને તેમ નહિ તો એની શરૂઆત સિ. હે. પહેલાં થઈ હશે. અહીં મને બે પ્રશ્ન સ્ફુરે છે :-

(૧) સ્વોપજ વૃત્તિ એ અમોઘવૃત્તિના આધારે તો રચાઈ નથી ?

(૨) મલયગિરિસૂરિએ પોતાના વ્યાકરણને સાંગોપાંગ બનાવવા ધાતુ-પાઠ, ઉણાદિ-સૂત્ર વગેરે વ્યાકરણનાં અન્ય અંગો રચ્યાં હશે કે કેમ ?

ઉપયોગ- પુણ્યવિજયજીએ એમના પ્રસ્તુત લેખ (પૃ. ૧૪૨)માં એ મતલબનો ઉલ્લેખ કર્યો છે કે સિ. હે. નાં અને મલયગિરિસૂરિકૃત શબ્દાનુશાસનનાં સૂત્રોમાં એટલું બધું સામ્ય છે કે એને લઈને મલયગિરિસૂરિકૃત જે ટીકાઓ છપાઈ છે તેમાં આવતાં સૂત્રો એમના જ વ્યાકરણનાં હોવા છતાં કેટલાંકને સિ. હે. પ્રમાણે અને કેટલાંકને અષ્ટા. પ્રમાણે અંક અપાયા છે અને કેટલાંક એ બેમાંથી એકે વ્યાકરણનાં જણાયાં નહિ તેને માટે અંક જતા કરાયા છે, અને આમ ખૂબ જ ગોટાળો થવા પામ્યો છે.

૧. આવો ઉલ્લેખ એમણે અન્યત્ર કર્યો હોય એમ જાણવામાં નથી. ગમે તેમ પણ સ્વોપજ વૃત્તિ એ આચાર્ય બન્યા પછીની કૃતિ છે એ વાત આથી ફલિત થાય છે.

૨. જુઓ એમનો ઉપર્યુક્ત લેખ જે. સ. પ્ર. વર્ષ ૧૭, અંક ૧-૩ (પૃ. ૧૪૨).

આ સંબંધમાં મારું કહેવું એ છે કે મલયગિરિસૂરિનું વ્યાકરણ મારી સામે નથી કે એમની વાત હું ચકાસી જોઉં, પણ એમ તો જરૂર ભાસે છે કે મલયગિરિસૂરિએ પોતે શબ્દાનુશાસન રચ્યા બાદ જે P. ૪૦ ટીકાઓ રચી હોય તેમાં એમના જ વ્યાકરણનાં સૂત્રો હોય એ સ્વભાવિક ઘટના છે.^૧

પ્રભાવ-ક્ષેમકીર્તિસૂરિએ કપ્પની ટીકાની ઉત્થાનિકા (અંશ ૧, પૃ. ૧૭૮)માં મલયગિરિસૂરિ માટે જે નિમ્નલિખિત વિશેષણ વાપર્યું છે એ ઉપરથી એમ લાગે છે કે સિ. હે.ના પ્રણયન પછી એનો પ્રચાર થયેલો હોવા છતાં વિદ્વદ્-મંડળમાં મલયગિરિસૂરિકૃત શબ્દાનુશાસનનો પ્રભાવ પડતો હતો :-

“શબ્દાનુશાસનાદિવિશ્વવિદ્યામયજ્યોતિઃપુઞ્જપરમાણુઘટિતમૂર્તિભિઃ”

વિષમપદવિવરણ-જૈ. ગ્રં. (પૃ. ૨૮૮)માં આ વિવરણની નોંધ છે. એની ૨૮ પત્રની એક હાથપોથી અમદાવાદના એક ભંડારમાં છે.

પ્રેમલાભ વ્યાકરણ (વિ. સં. ૧૨૮૧)- આના કર્તા ‘અંચલ’ ગચ્છના પ્રેમલાભ છે.^૨ એમણે આ કૃતિ વિ.સં. ૧૨૮૧માં ૨૨૨૩ શ્લોક જેવડી રચી છે.^૩ આનું નામ જોતાં એ વ્યાકરણ હોય એમ લાગે છે. એ વાત સાચી હોય તો પણ એ સ્વતંત્ર વ્યાકરણ છે કે સિ. હે. ઉપરથી યોજાયેલું વ્યાકરણ છે કે કેમ તેનો નિર્ણય કરવો બાકી રહે છે. [આ સ્વતંત્ર વ્યાકરણ છે. જૈ. સા. બૃ. ઈ. ભા.-૫ પૃ. ૨૭]

બાલબોધ વ્યાકરણ (વિ. સં. ૧૩૦૪)- જૈ. ગ્રં. (પૃ. ૨૮૭) પ્રમાણે આ વ્યાકરણ આઠ P. ૪૧ અધ્યાયમાં ૨૭૫ શ્લોક જેવડું મેરુંતુંગે વિ. સં. ૧૩૦૪માં રચ્યું છે. અહીં કહ્યું છે કે એના ઉપર મેરુંતુંગે ૪૮૦ અને ૫૭૮ શ્લોક જેવડી એકેક વૃત્તિ રચી છે. તેમાં પ્રથમ વૃત્તિ છ પાદ પૂરતી છે. વળી એમણે ૨૧૧૮ શ્લોક જેવડું ચતુષ્ક-ટિપ્પન અને ૭૬૭ શ્લોક જેવડું કૃદ્-વૃત્તિ-ટિપ્પન રચ્યાં છે. આ ઉપરાંત ૧૭૩૪ શ્લોક જેવડી આખ્યાત-વૃત્તિ-હુંદિકા અને ૨૨૮ શ્લોક જેવડી પ્રાકૃત-વૃત્તિ રચી છે. આ સાતેની હાથપોથી પાટણના ભંડારમાં હોવાનો અહીં ઉલ્લેખ છે.

જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૮૨)માં કહ્યું છે કે આ બાલબોધ વ્યાકરણ તો કાતંત્ર વ્યાકરણ ઉપરની મેરુંતુંગની બાલાવબોધ વૃત્તિ હોવાનો સંભવ છે, પણ જૈ. ગ્રં.માં આપેલો રચના-સમય અશક્ય છે. [વિશેષ માટે જુઓ “મેરુંતુંગ બાલાવબોધ વ્યાકરણ” લે. પ્રો. નારાયણ કંસારા. અનુસંધાન ૧૫.]

વિદ્યાનન્દ વ્યાકરણ (ઉ. વિ. સં. ૧૩૧૨) - આ વ્યાકરણના કર્તા વિદ્યાનન્દ છે. આમ આ વ્યાકરણનું નામ પણ બુદ્ધિસાગરની જેમ એના પ્રણેતાના નામ ઉપરથી પડાયું છે. આ વિદ્યાનન્દ એ સંસારીપણામાં શ્રેષ્ઠી જિનચન્દ્રના પુત્ર વીરધવલ થાય અને ‘ભીમસિંહ’ એ એમના નાના ભાઈ થાય. વીરધવલે દેવેન્દ્રસૂરિ પાસે વિ.સં. ૧૩૦૨માં પોતાના લગ્નના પ્રસંગે દીક્ષા લીધી હતી. એમને વિ.સં.

૧. સર્વાર્થસિદ્ધિ માટે પણ હું આવું અનુમાન કરું છું અને એથી તો એમાં અષ્ટા. વગેરેનાં સૂત્રાદિ તેમજ પૂજ્યપાદનાં પોતાનાં સૂત્રો હોવાનો જે મત પં. નાથૂરામ પ્રેમીએ જૈનેન્દ્ર વ્યાકરણ અંગેના લેખમાં (જૈ. સા. ઈ. પૃ. ૧૦૪માં) દર્શાવ્યો છે તેને હું આવકારતો નથી.

૨. આ હિસાબે આ વ્યાકરણનું નામ પણ બુદ્ધિસાગરની જેમ કર્તાના નામ ઉપરથી યોજાયું છે.

૩. જુઓ જૈ. ગ્રં. (પૃ. ૨૮૭). ૪. પ્રેમલાભ એ સ્વતંત્ર વ્યાકરણ જ હોય તો એનો પણ અહીં ઉલ્લેખ સમજવો ઘટે.

૫. એમણે દીક્ષા લીધી ત્યારે એમનું નામ ‘ધર્મકીર્તિ’ રખાયું હતું.

૧૩૨૩માં અને મતાંતર પ્રમાણે ૧૩૦૪માં ‘સૂરિ’ પદ મળ્યું હતું. ‘ખરતર’ ગચ્છના જિનેશ્વરસૂરિના શિષ્ય ઉપાધ્યાય ચન્દ્રતિલકે વિ. સં. ૧૩૧૨માં જે અભયકુમારચરિત રચ્યું છે તેની પ્રશસ્તિમાં એમણે કોની કોની પાસે શેનો શેનો અભ્યાસ કર્યો હતો તે કહ્યું છે. એમ કરતી વેળા (જિનપતિસૂરિના શિષ્ય) સુરપ્રભ પાસે વિદ્યાનન્દ વ્યાકરણ પોતે ભણ્યા હતા એમ એમણે કહ્યું છે. આ ઉપરથી આ વ્યાકરણ વિ. સં. ૧૩૧૨ કરતાં તો અર્વાચીન નથી જ એમ ફલિત થાય છે.

ઉપર્યુક્ત વ્યાકરણનો ઉલ્લેખ ‘સહસ્રાવધાની’ મુનિસુન્દરસૂરિએ ગુર્વાવલી (શ્લોક. ૧૭૧)માં P. ૪૨ કર્યો છે. ત્યાં એમણે કહ્યું છે કે આમાં સૂત્રો થોડાં છે, પણ અર્થ ઘણો સંગ્રહાયો છે, અને એથી એ ‘સર્વોત્તમ’ જણાય છે.

જિ. ર. કો. (ખંડ ૧, પૃ. ૮૪)માં કાતન્ત્રોત્તર વ્યાકરણનાં સિદ્ધાનન્દ, વિજયાનન્દ અને વિદ્યાનન્દ એમ ત્રણ નામાંતરો અપાયાં છે. અહીં આના કર્તા તરીકે વિજયાનન્દ ઉર્ફે વિદ્યાનન્દસૂરિનો ઉલ્લેખ છે. વિશેષમાં આ વ્યાકરણ સમાસ-પ્રકરણ સુધી જ છે એમ અહીં કહ્યું છે. જેસલમેરમાં આની તાડપત્રીય પ્રતિઓ છે. પ્રો. પિટર્સને એમના ચોથા હેવાલમાં આ વ્યાકરણમાંથી અવતરણ આપ્યું છે.

કાતન્ત્ર વ્યાકરણની મહત્તા વધારવા માટે વિજયાનન્દે કાતન્ત્રોત્તર નામની કૃતિ રચી છે અને એનું બીજું નામ વિદ્યાનન્દ છે એમ સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૦૬)માં ઉલ્લેખ છે.

જૈન-પુસ્તક-પ્રશસ્તિ-સંગ્રહ (પૃ. ૧૦૬)માં નીચે મુજબની પંક્તિ છે :-

“इति विजयानन्दविरचिते कातन्त्रोत्तरे विद्यानन्दापरनामि तद्धितप्रकरणं समाप्तम् सं. १२०८॥”

‘ઔદાર્ય-ચિન્તામણિ’ (લ. વિ. સં. ૧૫૭૫)- આ દિ. શ્રુતસાગરે રચેલું વ્યાકરણ છે, જ્યારે કેટલાકને મતે આ એ વ્યાકરણ ઉપરની સ્વોપજ વૃત્તિ છે. આ પાઈય ભાષાને અંગેનું છ અધ્યાયનું P. ૪૩ વ્યાકરણ હૈમ વ્યાકરણ અને ત્રિવિક્રમકૃત વ્યાકરણ કરતાં મોટું છે”. શ્રુતસાગર મૂલ સંઘ, સરસ્વતી ગચ્છ, બલાત્કાર ગણમાં થયા છે. એઓ દિ. ‘વિદ્યાનંદિના શિષ્ય થાય છે અને એમણે મલ્લિભૂષણને પોતાના ગુરુભાઈ કહ્યા છે. શ્રુતસાગરના એક શિષ્ય શ્રીચન્દ્રે વૈરાગ્યમણિમાલા રચી છે.

આ શ્રુતસાગરને પોતાને માટે ખૂબ માન હશે, કેમકે એમણે પોતાને માટે નીચે મુજબનાં વિશેષણો વાપર્યાં છે :-

ઉભયભાષાકવિચક્રવર્તી, કલિકાલ-ગૌતમ, કલિકાલસર્વજ્ઞ, તાર્કિક-શિરોમણિ, નવનવતિ-મહાવાદિ-વિજેતા, પરમાગમપ્રવીણ, વ્યાકરણ-કમલ-માર્તંડ ઇત્યાદિ.

૧. આ ત્રણમાંથી એક પણ નામે આ વ્યાકરણની અહીં નોંધ નથી.

૨. આના પહેલા ત્રણ અધ્યાય પૂરતો વિભાગ વિજાગપટ્ટમથી પ્રકાશિત થયેલો છે. જુઓ ABORI (Vol. XIII, pp. 52-53)

૩. જૈ. સા. ઈ. (પૃ. ૪૧૨)માં બીજા અધ્યાયની પુષ્પિકા અપાયેલી છે.

૪. એમના પરિચય માટે જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૪૦૬-૪૧૨)

૫. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૪૦૮).

૬. એઓ દિ. પદ્મનંદિના શિષ્ય અને ઉત્તરાધિકારી દિ. દેવેન્દ્રકીર્તિના ઉત્તરાધિકારી છે.

શ્રુતસાગર કદર દિગંબર છે એટલું જ નહિ પરંતુ આવેશપૂર્ણ ગાળ દેનારા પણ છે. તીર્થંકરની પ્રતિમા નહિ માનનારા ઉપર એમણે ખૂબ પ્રહાર કર્યા છે. એવાને એમણે ‘નાસ્તિક’ કહ્યા છે અને એમને વિષ્ણુથી લિપ્ત જોડા મારે તો એ પાપ નથી એવા આકોશ-વચનો ઉચ્ચાર્યા છે.^૧

શ્રુતસાગરે ‘વ્રતકથાકોશ’ રચ્યો છે. વળી એમણે નાનકડી શ્રુતસંઘપૂજા રચી છે. બાકી એમની P. ૪૪ સુપ્રસિદ્ધ કૃતિઓ મુખ્યત્વે વિવરણરૂપ છે અને એમાં મૂળ ગ્રંથાકારને ન અનુસરતાં પોતાની ગાંઠની વાત પણ એમણે કેટલીક વાર ઉમેરી છે.^૨ આ કૃતિઓ યાને વિવરણો નીચે મુજબ છે :-

એકીભાવ સ્તોત્રટીકા (આ ટીકાની એક હાથપોથી ભાં. પ્રા. સા. મં.માં છે.) જિનસહસ્રનામ-ટીકા, ‘તત્ત્વત્રયપ્રકાશિકા, ‘તત્ત્વાર્થવૃત્તિ, મહાભિષેક’-ટીકા’ અને ‘યશસ્તિલક-ચંદ્રિકા અને પદપ્રાભુત ટીકા’^૩

શ્રુતસાગર વિક્રમની સોળમી સદીમાં થયા છે, કેમકે મહાભિષેકની ટીકાની એક હાથપોથી વિ. સં. ૧૫૮૨માં લખાયેલી મળે છે.

ચિન્તામણિ-વ્યાકરણ (લ. વિ. સં. ૧૬૦૫)- આના કર્તા દિ. ભટ્ટારક શુભચન્દ્રસૂરિ છે. એઓ ‘મૂલ’ સંઘ, ‘સરસ્વતી’ ગચ્છ અને ‘બલાત્કાર’ ગણના જ્ઞાનભૂષણના પ્રશિષ્ય અને વિજયકીર્તિના શિષ્ય થાય છે. એ શુભચન્દ્રસૂરિની શિષ્યપરંપરાનો ક્રમ નીચે મુજબ છે :

સુમતિકીર્તિ, ગુણકીર્તિ, વાદિભૂષણ, રામકીર્તિ, યશઃકીર્તિ, પદ્મનંદિ ઇત્યાદિ^૪.

P. ૪૫ આ શુભચન્દ્રસૂરિને ‘ત્રૈવિદ્ય-વિદ્યાધર’ની તેમજ ‘પદ્મભાષા-કવિ-ચક્રવર્તી’ની પદવી હતી.^૫ એમણે સાહિત્યનાં વિવિધ અંગોનો અભ્યાસ કર્યો હતો. એમણે વિ. સં. ૧૬૦૮માં રચેલા પાંડવપુરાણની પ્રશસ્તિમાં પોતાની મૌલિક તેમજ વિવરણાત્મક અનેક કૃતિઓ ગણાવી છે :-

૧. જુઓ દિ. કુંદકુંદાર્યાર્થકૃત દંસણ-પાહુડ (ગા.૧)ની શ્રુતસાગરીય ટીકા તેમજ જૈ. સા. ઈ. (પૃ.૪૦૭)
૨. આમાં આકાશ-પંચમી, ચંદન-પછી, મુકુટ-સપ્તમી, અષ્ટાક્ષિકા ઇત્યાદિ વ્રતો સંબંધી કથાઓ છે. દેવેન્દ્રકીર્તિ, ધર્મચંદ્ર, મલ્લિષેણ અને સકલકીર્તિ દ્વારા એકેક વ્રતકથાકોશ રચાયો છે.
૩. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૪૦૮)
૪. મૂળના કર્તા આશાધર છે. એમણે રચેલી ટીકા સંપૂર્ણપણે શ્રુતસાગરે અપનાવી છે. તેમ છતાં એ આશાધરનો ઉલ્લેખ જિનસહસ્રનામ-ટીકામાં શ્રુતસાગરે કર્યો નથી. આવી હકીકત ત. સૂ.ની ટીકા માટે પણ જોવાય છે. એમાં સવાર્થસિદ્ધિ અપનાવાઈ છે.
૫. દિ. શુભચન્દ્રકૃત જ્ઞાનાર્ણવ યાને યોગપ્રદીપમાં જે ગદ્યાત્મક લખાણ છે તેની આ ટીકા છે.
૬. આ તા. સૂ. સહિત “ભારતીય જ્ઞાનપીઠ” તરફથી કાશીથી ઈ.સ. ૧૯૪૯માં પ્રકાશિત થઈ છે.
૭. આ આશાધરકૃત નિત્ય-મહોદ્ધોતની ટીકા છે.
૮. શ્રુતસાગર દેશવ્રતી યાને બ્રહ્મચારી હતા તે સમયની આ રચના છે.
૯. આ યશસ્તિલક-ચંપૂની અપૂર્ણ ટીકા છે. પાંચમા આશ્વાસને અંગે થોડાક ભાગની તેમજ છઠ્ઠા આશ્વાસની ટીકા નથી. આ ટીકા સહિત મૂળ કૃતિ કાવ્યમાલામાં છપાયેલી છે.
૧૦. આ એમની છેલ્લી કૃતિ હોવાનું મનાય છે.
૧૧. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૫૨૮-૫૨૯)
૧૨. જુઓ કત્તિકેયાણુવેદખાની શુભચંદ્રસૂરિએ વિ. સં. ૧૬૧૩માં રચેલી ટીકાની પુષ્પિકા. આ ટીકાની પ્રશસ્તિ જૈ. સા. ઈ. (પૃ. ૫૨૮)માં છપાઈ છે.

(૧) અંગપણ્ણતિ (¹અંગપ્રજ્ઞતિ,) (૨) ²અપશબ્દખંડન, (૩) ચન્દના-કથા (યાને ચન્દના-ચરિત), (૪) ચન્દ્રનાથ-ચરિત્ર (યાને ચન્દ્રપ્રભ-ચરિત), (૫) ચિન્તામણિ-વ્યાકરણ, (૬) ³જીવક-ચરિત્ર (યાને જીવંધર-ચરિત), (૭) તત્ત્વનિર્ણય, (૮) ⁴નંદીશ્વર-કથા, (૯) ⁵પદ્મનાભ-ચરિત્ર, (૧૦) ષડ્વાદ, (૧૧) ⁶સંશયિવદનવિદારણ. (૧૨-૧૩) સર્વતોભદ્ર અને એની ટીકા, (૧૪) પાર્શ્વનાથકાવ્ય (યાને પાર્શ્વભ્યુદય)ની પંજિકા, (૧૫) અધ્યાત્મપદ્યવૃત્તિ, (૧૬) આશાધરની અર્ચા (યાને જિનયજ્ઞકલ્પ કિંવા નિત્યમહોદ્ધોત)ની ટીકા અને (૧૭) સ્વરૂપસંબોધનની વૃત્તિ.

આ ઉપરાંત (૧૮) ⁷કર્મદાહ વિધિ, (૧૯) ⁸ચતુર્ચિંશદધિકદ્વાદશ-શતવ્રતોદ્યાપન, (૨૦) P. ૪૬ ⁹પલ્લોપમવિધ્યુદ્યાપન (યાને પલ્લવ્રતોદ્યાપન) એ ત્રણ કૃતિઓ તેમજ (૨૧) ગણનાથસમર્થન (યાને ¹⁰ગણધરવલ્લયપૂજા), (૨૨) 'ચિન્તામણિ'(યંત્ર)પૂજા, (૨૩) ¹¹ત્રિંશચ્યતુર્વિંશતિપૂજા, (૨૪) સરસ્વતી-પૂજા અને (૨૫) ¹²સિદ્ધચક્રવ્રતપૂજા એમ ચાર પૂજા તેમજ (૨૬) ¹³સ્તોત્ર-સમુચ્ચયનો પણ અહીં ઉલ્લેખ છે.

ઉપર્યુક્ત પાંડવપુરાણની રચના બાદ એમણે ¹⁴કરકંડુ-ચરિત્ર વિ. સં. ૧૬૧૧માં અને કતિકેયાણુવેકાની¹⁵ ટીકા વિ. સં. ૧૬૧૩માં રચ્યાં છે. નીતિરસાયન નામની કૃતિ શું આ શુભચન્દ્રસૂરિની કૃતિ છે ?

૧. આ પાઈયમાં રચાયેલી કૃતિ છે. એ ત્રણ પરિચ્છેદમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૭૭, ૧૧૭ અને ૫૪ પદ્યો છે. એ બાર અંગોના વિષય ઉપર પ્રકાશ પાડે છે. આ પાઈય કૃતિ મ. દિ. ગ્રં.માં ગ્રંથાંક ૨૧ તરીકે વિ. સં. ૧૮૭૮માં પ્રસિદ્ધ કરાયેલી છે.
૨. જિ. ૨. કો. માં આની નોંધ નથી. ત્યાં તો કીર્તિચન્દ્રની ૧૦૦ શ્લોક જેવડી અને આ નામની કૃતિની નોંધ છે.
૩. આની રચના વિ. સં. ૧૫૮૬માં થયેલી છે.
૪. આને કેટલાક સિદ્ધચક્ર-કથા કહે છે.
૫. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૩૩)માં આનો 'પુરાણ' તરીકે નિર્દેશ છે. અહીં એનું પરિમાણ ૨૫૦૫ શ્લોક જેવડું કહ્યું છે.
૬. આ ચેતાંભરોની સ્ત્રીની મુક્તિ જેવી માન્યતાના ખંડનરૂપ કૃતિ છે. ભ. રત્નભૂષણે સંશય-વચન-વિચ્છેદ નામની એક કૃતિ સંસ્કૃતમાં રચી છે.
૭. આ નામની એકેક કૃતિ દિ. ચન્દ્રકીર્તિએ તેમજ દિ. રત્નનંદિએ રચી છે.
૮. આમાં ૧૨૩૪ વ્રતોના ઉદ્યાપનની હકીકત છે.
૯. આ નામની એકેક કૃતિ દિ. અનંતકીર્તિએ, દિ. દેવેન્દ્રકીર્તિએ અને દિ. વૃષભનાથે રચી છે.
૧૦. દિ. શ્રુતસાગરે તેમજ દિ. સકલકીર્તિએ પણ આ નામની એકેક કૃતિ રચી છે.
૧૧. ભવશર્માએ આ નામની એક કૃતિ રચી છે.
૧૨. દિ. આશાધરે તેમજ દિ. પ્રભાચન્દ્રે આ નામની એકેક કૃતિ રચી છે.
૧૩. શુભચન્દ્રસૂરિએ અનેક સ્તોત્રો રચ્યાં છે. એ ઉપરથી આ નામ મેં યોજ્યું છે.
૧૪. આ કૃતિ સકલભૂષણની સહાયતાપૂર્વક રચાયેલી છે.
૧૫. આમાં દિ. નેમિચન્દ્રકૃત દવ્યસંગ્રહ ઉપરની બ્રહ્મદેવે રચેલી ટીકામાંથી અનેક અવતરણો અપાયાં છે.

આ ચિન્તામણિ વ્યાકરણ વિવિધ પ્રકારની પાઈય ભાષાને લગતું છે. એમાં ૧૨૨૪ સૂત્રો છે. એ ચચાર પાઠવાળા ત્રણ અધ્યાયમાં રજૂ કરાયાં છે. આ વ્યાકરણનો ઉલ્લેખ ઉપર્યુક્ત પાંડવપુરાણની પ્રશસ્તિમાં છે. આ વ્યાકરણ ઉપર સ્વોપજ વૃત્તિ છે. આ વ્યાકરણને અંગે ડૉ. એ. એન. ઉપાધ્યે એ એક લેખ લખ્યો છે અને એ દ્વારા એમાં અપાયેલી બાબતોનું નિરૂપણ કર્યું છે.

ચિન્તામણિની ટીકા-આ ટીકા ચિન્તામણિમાંના વિષમ ઉદાહરણોની સિદ્ધિને માટે રચાઈ છે. એના કર્તા સમંતભદ્ર છે એમ 'કન્નડપ્રાન્તીય તાડપત્રીય ગ્રન્થસૂચી' (પૃ. ૨૮૮)માં ઉલ્લેખ છે. વિશેષમાં આ પૃષ્ઠ ઉપર આ ટીકાની 'કન્નડ' લિપિમાં લખાયેલી ૫૦ પત્રની હાથપોથીની નોંધ છે. એમાં પત્રદીઠ દોઢ સો દોઢ સો અક્ષરવાળી સાત સાત પંક્તિ છે. આ હાથપોથીમાંની કૃતિ અપૂર્ણ છે. એવી રીતે પૃ. ૧૦૭માં નોંધાયેલી હાથપોથીમાં પણ અપૂર્ણ કૃતિ છે. એ પૃષ્ઠ ઉપર નીચે મુજબનું પ્રારંભિક પદ્ય અપાયું છે :-

“જિનચિન્તામણિમીશં નત્વા ચિન્તામણેઃ સ્ફુટાં ટીકામ્ ।

વિષમોદાહૃતિસિદ્ધ્યૈ કુર્વે શક્ત્યા સમન્તભદ્રોઽહમ્ ॥”

અહીં જે ચિન્તામણિનો ઉલ્લેખ છે તે શું દિ. શુભચન્દ્રસૂરિકૃત વ્યાકરણ હશે?

મન્ત્રવ્યાકરણ-આ વ્યાકરણનો ગ્રંથ છે, એના કર્તા સમંતભદ્ર છે અને એની છપ્પન છપ્પન અક્ષરની પાંચ પાંચ પંક્તિવાળાં સોળ પત્રની એક હાથપોથી 'કન્નડ' લિપિમાં લખાયાનો ઉલ્લેખ ક. તા. ગ્રં. (પૃ.૨૨૩)માં કરાયો છે. શું આ સમંતભદ્રે ચિન્તામણિની ટીકા રચી છે?

P. ૪૭ શબ્દ-ભૂષણ (લ. વિ. સં. ૧૭૭૦)- આના કર્તા દાનવિજય છે. એઓ 'તપા' ગચ્છના વિજયરાજસૂરિના શિષ્ય થાય છે. એમણે પોતાના શિષ્ય દર્શનવિજય માટે પજ્જોસવણાકપ્પ ઉપર દાનદીપિકા નામની વૃત્તિ વિ. સં. ૧૭૫૦માં રચી છે. એમની આ શબ્દ-ભૂષણ નામની કૃતિ એ પદ્યમાં રચાયેલું વ્યાકરણ છે. એ ૩૦૦ શ્લોક જેવડું છે અને એ વિ. સં. ૧૭૭૦ની આસપાસમાં, ગુર્જરધરામાં પ્રખ્યાત શેખ ફત્તેના પુત્ર બડેમિયાને માટે રચાયું છે. શું એ સિ. હે.નું રૂપાંતર છે ?

૧. જુઓ ABORI (Vol. XIII, pp. 46-52)

૨. આ પુસ્તક “ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી ઈ. સ. ૧૯૪૮માં પ્રસિદ્ધ કરાયેલું છે. એમાં મૂડીબદ્ધીના કેટલાક ભંડારની, કારકલના જૈન મઠની, અલિપૂરના આદિનાથ-ગ્રન્થભંડારની તેમજ કન્નડ પ્રાન્તમાંના કેટલાક અન્ય સામાન્ય ભંડારોની કન્નડ લિપિમાં લખાયેલી અને સંસ્કૃત, પાઈય અને કન્નડ ભાષામાં રચાયેલા ગ્રન્થોની ૩૫૬૮ તાડપત્રીય અને થોડીક કાગળ ઉપરની હાથપોથીઓની વિષયદીઠ સૂચી અપાઈ છે. એની હિન્દી પ્રસ્તાવનામાં પૃ. ૧૫-૧૭માં જૈનોના સંસ્કૃત સાહિત્યની આછી રૂપરેખા આલેખાઈ છે અને પૃ. ૨૪-૨૮માં સંસ્કૃત, પાઈય અને કન્નડમાં રચાયેલા પરંતુ ઈ. સ. ૧૯૪૮ સુધી તો અપ્રકાશિત જણાતા એવા ગ્રન્થોનાં તેમજ એના પ્રણેતાનાં નામ વગેરે અપાયાં છે. એમાંથી આ ખંડ માટે ઉપર્યુક્ત ટીકા તેમજ બીજી કેટલીક કૃતિઓની મેં નોંધ લીધી છે, કેમકે એના ગ્રન્થકારોનાં નામ જોતાં તેઓ જૈન હોય એમ લાગે છે. આ ક. તા. ગ્ર. મખ્યતયા દિ. ગ્રન્થોને અંગે છે.

૩. જુઓ જૈ. ગ્રં. (પૃ. ૨૮૮).

શબ્દાર્ણવવ્યાકરણ (લ. વિ. સં. ૧૬૮૦)— આ ખરતરગચ્છીય રત્નસાગરના શિષ્ય સહજકીર્તિગણિની ૧૭૦૦૦ શ્લોક જેવડી કૃતિ છે. એમાં સંજ્ઞા વગેરે દસ અધિકાર છે. એ સહજકીર્તિએ નિમ્નલિખિત કૃતિઓ પણ રચી છે :-

(૧) અનેકશાસ્ત્રસારસમુચ્ચય, (૨) એકાદિદશપર્યન્તશબ્દસાધનિકા, (૩) 'કલ્પમંજરી' (વિ. સં. ૧૬૮૫), (૪) 'નામકોશ', (૫) પ્રીતિષદ્ત્રિંશિકા (વિ. સં. ૧૬૮૮), (૬) 'ફલવર્દિ-પાર્શ્વનાથ-માહાત્મ્ય-મહાકાવ્ય', (૭) મહાવીરસ્તુતિ (વિ. સં. ૧૬૮૬), (૮) 'લોદ્રપુરીય-પાર્શ્વનાથ-સ્તુતિ' (વિ.સં. ૧૬૮૩) અને (૯) સારસ્વતવૃત્તિ.

મનોરમા— આ સ્વોપજવૃત્તિ છે.

શબ્દાર્ણવ - જૈ. ગ્રં. (પૃ. ૨૮૮) પ્રમાણે આ સહજકીર્તિની રચના છે. આ પૃષ્ઠ ઉપરના ટિપ્પણ પ્રમાણે આ કૃતિનું નામ સિદ્ધ-શબ્દાર્ણવ છે. અને એ ૧૩૦૦ શ્લોક જેવડું છે. અહીં આ કૃતિને વ્યાકરણ ગણ્યું છે. પરંતુ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૩૮) પ્રમાણે તો આ છ પ્રકરણમાં વિભક્ત એવો કોશ છે અને એનું બીજું નામ ઋજુ-પ્રાણ-વ્યાકરણ-પ્રક્રિયા છે. વિશેષમાં ઉપર્યુક્ત સહજકીર્તિને 'ખરતર' ગચ્છના ઉપા. હેમનન્દનના શિષ્ય હોવાનું અહીં કહ્યું છે. સાથે સાથે આના ઉપર સ્વોપજ ટીકા હોવાનો અહીં ઉલ્લેખ છે.

[શબ્દાર્ણવવૃત્તિ: સહજકીર્તિ ગણિએ રચેલી ૧૭૦૦૦ શ્લોક પ્રમાણની સ્વોપજ ટીકાની હાથપોથી ખંભાતસ્થિત વિજયનેમિસૂરિ જ્ઞાનભંડારમાં છે. જૈ. સા. બૃ. ઇ. ભા. પ. પૃ.૨૬]

'જૈનસિદ્ધાન્ત કૌમુદી' (વિ. સં. ૧૮૮૧)—આના કર્તા 'શતાવધાની' મુનિશ્રી રત્નચન્દ્રજી છે. એઓ 'લોકા' ગચ્છમાં અંતર્ગત 'લીંબડી' સંપ્રદાયના શ્રીગુલાબચન્દ્રજીના શિષ્ય થાય છે. એમણે આ વ્યાકરણ ચચ્યાર પાદવાળા ચાર અધ્યાયમાં વિભક્ત કર્યું છે. એ સોળ પાદની સૂત્રસંખ્યા અનુક્રમે નીચે પ્રમાણે છે :- ૪૬, ૩૨, ૧૦૦, ૧૪૫, ૮૪, ૪૦, ૫૧, ૧૦૭, ૧૮૫, ૭૧, ૬૮, ૪૦, ૮૬, ૫૧, ૬૫ અને ૧૧૮. આ ૧૩૦૧ સૂત્રોને તેમજ એના ઉપરના સ્વોપજ વાર્તિકને પ્રક્રિયા ક્રમે રજૂ કરી એનું કર્તાએ જાતે રચેલું વિવરણ અપાયું છે. એ સમગ્ર રચનાને જૈનસિદ્ધાન્તકૌમુદી નામ અપાયું છે. એના પૂર્વાર્ધમાં નિમ્નલિખિત નામવાળાં પ્રકરણો અનુક્રમે અપાયાં છે—

સંજ્ઞા પરિભાષા, સ્વરસન્ધિ, વ્યંજનસન્ધિ, સ્વરવિકાર, વ્યંજનવિકાર, વિભક્તિ, અવ્યય, સ્ત્રીપ્રત્યય કારક, સમાસ અને તદ્વિત. ઉત્તરાર્ધમાં આખ્યાત-પ્રક્રિયા અને કૃદન્ત-પ્રક્રિયાનું નિરૂપણ છે.

૧. આમાં શ્રીસાર નામના એમના ગુરુભાઈનો પણ હિસ્સો છે. આમ આ દ્વિકર્તૃક રચના છે. એ પજજોસવણાકપ્પની વૃત્તિ છે.

૨. આ કૃતિ લિંગનિર્ણયની સાથે છ કાંડમાં રચાઈ છે. આ બાબત પૃ. ૧૨૧માં ઉમેરવી.

૩. આમાં ૨૪ સર્ગ છે. [આમાં ૩૦૦ વિવિધ છંદમય શ્લોકો છે. આની હસ્ત લિખિત પ્રત લા. દ. વિ. માં છે.]

૪. આ 'શતદલકમલ'થી અલંકૃત છે.

૫. આ કૃતિ ભૈરવદાને અને જયેષ્ઠમલ્લે પોતાના બિકાનેરના મુદ્રણાલયમાં છાપી ઈ. સ. ૧૮૨૫માં પ્રસિદ્ધ કરી છે. એમાં અંતમાં સૂત્રપાઠ, વાર્તિક, ધાતુપાઠ તેમજ સૂત્રોની અકારાદિ ક્રમે સૂચી અપાઈ છે.

ગણદર્પણ (લ. વિ. સં. ૧૨૨૫) - આ વ્યાકરણના કર્તા તરીકે 'પરમાર્હત' કુમારપાલ ભૂપાલનો ઉલ્લેખ એની એક હાથપોથીમાં કરાયો છે. એમનો જન્મ વિ. સં. ૧૧૪૮માં થયો હતો. એમણે વિ. સં. ૧૧૮૮થી ૧૨૩૦ સુધી ગુજરાત ઉપર રાજ્ય કર્યું હતું. એમણે વિ. સં. ૧૨૧૬માં જૈન ધર્મ સ્વીકાર્યો હતો. વિ. સં. ૧૨૩૦માં એમનું અવસાન થયું હતું. એમણે "નમ્રાખિલાખણ્ડલ" થી શરૂ થતું 'સાધારણજિન-સ્તવન' રચ્યું છે.

ગણદર્પણ એ ચચ્યાર પાદવાળા ત્રણ અધ્યાય પૂરતી તો પદ્યાત્મક કૃતિ છે. એ પાણિનીય ગણપાઠના સ્પષ્ટીકરણરૂપ છે. એ ૮૦૦ શ્લોક જેટલા પરિમાણવાળી કૃતિ પ્રતિહાર ભોજદેવ અને દંડનાયક વોસરિ માટે યોજાઈ હતી. પ્રા. ભોગીલાલ જયચંદભાઈ સોડેસરાએ આ ગણદર્પણને અંગે 'એક લેખ લખ્યો છે. એનું નામ નીચે મુજબ છે :-

"The 'Ganadarpana' a work on Sanskrit grammar ascribed to King Kumarapala (1143-1174 A. D.) of Gujarat"

નૂતન વ્યાકરણ (લ. વિ. સં. ૧૪૪૦)-આના કર્તા 'કૃષ્ણર્ષિ' ગચ્છના મહેન્દ્રસૂરિના શિષ્ય જયસિંહસૂરિ છે. એમણે કુમારપાલચરિત્ર રચ્યું છે તેમજ ભાસર્વજ્ઞકૃત ન્યાયસાર ઉપર ન્યાયતાત્પર્યદીપિકા નામની વૃત્તિ રચી છે. વળી એમણે "સારંગ પંડિતને વાદમાં હરાવ્યો હતો. આ બાબતનો તેમજ ઉપર્યુક્ત વ્યાકરણના પ્રણેતા તરીકેનો ઉલ્લેખ આ જયસિંહસૂરિના શિષ્ય નયચન્દ્રસૂરિએ હમ્મીરમહાકાવ્ય (સ. ૧૪, શ્લો. ૨૩-૨૪)માં કર્યો છે.

પ્રસ્તુત વ્યાકરણ સિ. હે.ના આધારે યોજાયું છે કે એ સ્વતંત્ર કૃતિ છે તે જાણવું બાકી રહે છે એટલું જ નહિ પણ આનું નામ પણ જાણવામાં નથી.

પ્રયોગમુખ્યવ્યાકરણ- આ અજ્ઞાતકર્તૃક કૃતિની ૩૪ પત્રની એક હાથપોથી જેસલમેરના ભંડારમાં છે.

ઔક્તિક

'મુઘાવબોધ ઔક્તિક (વિ. સં. ૧૪૫૦)- આના કર્તા દેવસુંદરસૂરિના શિષ્ય કુલમંડનસૂરિ છે. એમનો જન્મ વિ. સં. ૧૪૦૮માં થયો હતો. વિ. સં. ૧૪૧૭માં દીક્ષા લઈ વિ. સં. ૧૪૪૨માં સૂરિ બનનારા

૧. આ હાથપોથી શકસંવત્ ૧૩૮૩માં લખાયેલી છે. એમાં, પહેલાં બે પત્ર નથી. એ હાથપોથી જોધપુરના જ્ઞાનભંડારમાં છે. [શ્રી. વિનયસાગરના સૌજન્યથી કેશરિયાજી ભંડારની પ્રતની ઝેરોક્ષ અમને મળી છે.]

૨. આ સ્તવન જૈન સ્તોત્ર સંગ્રહ (ભા. ૧, પૃ. ૧૮-૨૨)માં પ્રસિદ્ધ કરાયું છે.

૩. આ લેખ "મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય"ના સામયિકના ઈ. સ. ૧૮૫૩ના માર્ચના અંકમાં છપાયો છે. એને આધારે મેં ગણદર્પણ વિષે આ સંક્ષિપ્ત નોંધ લીધી છે.

૪. આ વિ. સં. ૧૪૪૦ની આસપાસમાં રચાયું છે.

૫. આ સારંગ તે 'શાકંભર'ના રાજા હમ્મીરરાજનો પંડિત હશે કે જેણે શાડર્ગધરપદ્ધતિ રચી છે અને જેની એક હાથપોથી વિ. સં. ૧૪૧૮માં લખાયેલી મળે છે. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૪૦).

૬. સ્વ. હરિલાલ હર્ષદ ધ્રુવે "મુઘાવબોધઔક્તિક"ના નામથી આ કૃતિ સંપાદિત કરી છે અને એ સને ૧૮૮૮માં સ્વીડનમાં ભરાયેલી "ઓરિએન્ટલ કોન્ફરન્સ" દ્વારા પ્રકાશિત થયેલી છે.

એઓ વિ. સં. ૧૪૫૫માં સ્વર્ગ સંચર્યા. એમણે વિ. સં. ૧૪૪૩માં ‘વિચારામૃતસંગ્રહ અને કોઈક સમયે P. ૪૮ સિદ્ધાંતાલાપકોદ્ધાર રચ્યા છે. એમણે કેટલાક સ્તવ રચ્યા છે. જેમકે ‘કાયઠિઈથોત્ત, “વિશ્વશ્રીદ્ધ” થી શરૂ થતો અને અષ્ટાદશચિત્રચક્રથી વિભૂષિત ‘વીરસ્તવ અને “ગરીયોગુણ” થી શરૂ થતો ‘પંચજિનહાર-બંધ-સ્તવ. વળી એમણે નિમ્નલિખિત કૃતિઓ ઉપર અવચૂર્ણિ (અવચૂરિ) રચી છે :-

પજ્જોસવણાકપ્પ, “પડિક્કમણસુત્ત અને પણ્ણવણાતર્થપયસંગહણી.”

ગુજરાતી ભાષા દ્વારા સંસ્કૃત ભાષાના વ્યાકરણનું શિક્ષણ આપવા માટે કેટલાક પ્રયાસ થયા છે. દા ત. શ્રીમાલ ઠક્કુર કૂરસિંહના પુત્ર ‘સંગ્રામસિંહે આ જાતનો પ્રયાસ કર્યો છે એમ કાતંત્ર વ્યાકરણનો બોધ કરાવવા માટે એમણે વિ. સં. ૧૩૩૬માં રચેલી “બાલશિક્ષા” જોતાં જણાય છે. આના પછીના બીજા P. ૪૮ પ્રયાસનું ફળ તે પ્રસ્તુત કુલમંડનસૂરિએ વિ.સં. ૧૪૫૦માં રચેલું મુગ્ધાવબોધ ઔક્તિક છે. આ કંઈ ગુજરાતી ભાષાનું વ્યાકરણ નથી પરંતુ વિક્રમની પંદરમી સદીની જૂની ગુજરાતીમાં લખાયેલી સમજૂતી પૂર્વકનું સંસ્કૃત ભાષાનું પ્રાથમિક વ્યાકરણ છે. આનો પરિચય સ્વ કે. હ. ધ્રુવે ‘સાહિત્ય અને વિવેચન નામના એમના લેખસંગ્રહમાં નીચે મુજબ આપ્યો છે :-

“ઔક્તિકનાં છેલ્લાં છ પ્રકરણ કેવળ સંસ્કૃતમાં છે. પહેલાં, બીજા અને સાતમા આઠમા પ્રકરણમાં સૂત્ર અને કારિકા સંસ્કૃતમાં છે, અને વિવેચન પ્રાકૃતમાં છે. ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને નવમું એ પાંચ પ્રકરણો તો કેવળ પ્રાકૃતમાં છે. આ રીતે ભિન્નભિન્ન અર્થ ઉપરાંત ભાગ પ્રાકૃતમાં એટલે જૂની ગુજરાતીમાં લખાયેલો છે.”

“નામની વિભક્તિ આદિનાં ઉદાહરણમાં સર્વજિનસાધારણસ્તોત્ર આપ્યું છે. તે તો જયાનંદનું છે.”- પૃ. ૫૫

૧. જિ. ર. કો. (ખંડ ૧, પૃ. ૩૫૨)માં આની વિચારસંગ્રહ તરીકે નોંધ છે. અને એના જ નામાંતર તરીકે સિદ્ધાંતાલાપકોદ્ધારનો ઉલ્લેખ છે તો શું આ બે ભિન્ન કૃતિ નથી ?

૨. આ ચોવીસ પદ્યની કૃતિ એક અવચૂરિ સહિત જૈ. આ. સ. તરફથી વિ. સં. ૧૮૬૮માં પ્રકાશિત કરાઈ છે. એમાં તો મૂળ કૃતિના કર્તા તરીકે કુલમંડનસૂરિનો ઉલ્લેખ છે. આ અવચૂરિની વિ. સં. ૧૫૩૭માં લખાયેલી હાથપોથી મળે છે. જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૪૩)માં તો મૂળ કૃતિનાં કર્તા તરીકે કુલમંડનસૂરિનો ઉલ્લેખ નથી, પરંતુ એના ઉપર એક અવચૂરિ રચનાર તરીકે છે.

૩. આ સ્તવ જૈન સ્તોત્ર સમુચ્ચય (પૃ. ૮૭-૮૯)માં છપાયો છે.

૪. આ “ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થા” તરફથી પ્રકાશિત પયરણસંદોહના અંતમાં છપાયેલો છે.

ILDના બીજા હપ્તામાં (ARTS NO. 30 JUB)માં પૃ. ૧૧૪-૧૧૬માં આ સ્તવ છપાયો છે.

૫-૬. જુઓ જૈ. સા. સં. ઈ. પૃ. ૪૪૩). અહીં પણ્ણવણા-સંગહણીને બદલે પ્રજ્ઞાપનાસૂત્રનો ઉલ્લેખ છે તો શું એ ભ્રાન્ત નથી ?

૭. જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૨૧)માં કહ્યું છે કે “કર્તા જૈનેતર લાગે છે.

૮. આને અંગેનો પં. લાલચન્દ્ર ભગવાનદાસ ગાંધીનો લેખ નામે “બાલશિક્ષા (પ્રાચીન ગુજરાતી સંસ્કૃત વ્યાકરણ)” પુરાતત્ત્વ (પુ. ૩, અં. ૧, પૃ. ૪૦-૫૩)માં છપાયો છે. એમાં કૂરસિંહને બદલે ‘કૂરસિંહ’ છે.

૯. બાલશિક્ષા નામનું એક વ્યાકરણ ભક્તિલાભે રચ્યું છે.

૧૦. આ લેખસંગ્રહ (ભા. ૨, પૃ. ૫૧-૭૮)માં સ્વ. કે. હ. ધ્રુવના ઈ.સ. ૧૮૮૮માં “ગુજરાતી શાળાપત્ર”માં છપાયેલા “મુગ્ધાવબોધ ઔક્તિક” નામના લેખને સ્થાન અપાયું છે. આ ભાગમાં એમના બીજા પણ લેખો છે. આ ભાગ ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી” (હવે ગુજરાત વિદ્યાસભા) તરફથી ઈ.સ. ૧૯૪૧માં પ્રસિદ્ધ કરાયો છે.

“સંસ્કૃત ઉક્તિ એટલે બોલવાની રીત વિષે, મુગ્ધાવબોધ ઔક્તિકમાં નિયમો આપ્યા છે એથી અથવા તો પાઘરી અને વાંકુડી ચાને કર્તા, કર્મ અને ભાવિ ઉક્તિનું એમાં મુખ્યત્વે વિવેચન કરાયું છે. એથી એને ઔક્તિક નામ અપાયું છે. આ સંસ્કૃત ભાષાના વ્યાકરણને લગતો નાનો સરખો નિબંધ છે. કેવળ સંસ્કૃત દ્વારા જે મુગ્ધ જાણેને વ્યાકરણ શીખવું અઘરું પડે તેને માટે ખાસ કરીને આમાં ઠેકાણે ઠેકાણે જૂની ગુજરાતીમાં સમજુતી અપાઈ છે. ‘વ્યાકરણના સંપ્રદાય પ્રમાણે ઉક્તિઓનો પ્રાકૃતમાં સંગ્રહ’ કરવાનો પોતાનો વિચાર છે એમ કહી ગ્રંથકાર આ ગ્રંથ શરૂ કરે છે.”

મુગ્ધાવબોધ ઔક્તિકમાં વિભક્તિ-વિચાર, કૃદંત-વિચાર, ઉક્તિ-ભેદ અને શબ્દ-સંગ્રહ જે આવે છે તેટલા પૂરતો વિભાગ પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ (પૃ. ૧૭૨-૧૮૦)માં છપાયો છે. આની પછી P. ૫૦ “ઔક્તિકપદાનિ” એવા શીર્ષકપૂર્વક જે લખાણ પૃ. ૧૮૧-૨૦૪માં અપાયું છે અને જેના અંતમાં “ઔક્તિકપદાનિ સમાપ્તાનિ” એવો ઉલ્લેખ છે તે મુગ્ધાવબોધ ઔક્તિકથી ભિન્ન કોઈ કૃતિ હોય એમ મને લાગે છે. આ સંબંધમાં છેવટનો નિર્ણય કરવાનું સુગમ સાધન આનું મુદ્રિત પુસ્તક છે, પણ હજી સુધી એ મને કોઈ સ્થળેથી જોવા મળ્યું નથી.

પ્રસ્તુત ઔક્તિકના સ્વરૂપ પરત્વેની ગેરસમજની તેમજ એની કેટલીક હાથપોથીઓની નોંધ મેં “મુગ્ધાવબોધ ઔક્તિક” નામના મારા ‘લેખમાં લીધી છે. આ ઔક્તિકની મુદ્રણાલય-પુસ્તિકા મેં કેટલીક હાથપોથીને આધારે વર્ષો થયાં તૈયાર કરી છે પણ પ્રકાશકના અભાવે એ છપાવી શકાઈ નથી.

‘વાક્યપ્રકાશ (વિ. સં. ૧૫૦૭) - આ ઔક્તિક ‘બૃહત્ તપા’ ગચ્છના રત્નસિંહસૂરિના શિષ્યાણુ ઉદયધર્મે વિ. સં. ૧૫૦૭માં ‘સિદ્ધપુર’ નગરમાં રચ્યું છે. એમણે ‘દ્વાત્રિશદ્દલકમલ’ રૂપ બંધધી વિભૂષિત અને “સત્રમત્રિદર્શન” થી શરૂ થતું ૧૮ પદ્યનું “મહાવીરસ્તવન પણ રચ્યું છે. એમના આ P. ૫૧ વાક્યપ્રકાશમાં ૧૨૮ પદ્યો છે. આ રચના પ્રાથમિક સ્મૃતિના કારણે કરાઈ છે. એનો ઉદ્દેશ ગુજરાતી દ્વારા સંસ્કૃત ભાષાનું વ્યાકરણ શિખવવાનો છે. આથી તો અહીં કેટલાંક પદ્યોમાં ગુજરાતીમાં લખાણ છે અને એની સાથે સાથે સંસ્કૃતમાં એનો અનુવાદ છે. આ કૃતિનો પ્રારંભ ઉક્તિના ‘પ્રાધ્વર’ અને ‘વક’ એ બે પ્રકારો અને એના ઉપપ્રકારોથી કરાયો છે. આગળ જતાં કર્તરિ અને કર્મણિના પ્રત્યયો ગણાવાયા છે અને એનાં ઉદાહરણ અપાયાં છે. (શ્લો. ૨ અને ૨૮માં ‘સકર્મક’ એ અર્થમાં ‘સાધ્ય’ શબ્દ વપરાયો છે). ત્યાર બાદ ગણજ, નામજ અને સૌત્ર (કણ્ડવાદિ) એમ ધાતુના ત્રણ પ્રકાર દર્શાવી એનું સ્વરૂપ સમજાવાયું છે. ‘પરસ્મૈપદી’ વગેરે એમ પણ ધાતુના ત્રણ ભેદ પડાયા છે. ત્યાર બાદ ‘વર્તમાના’ વગેરે દસ વિભક્તિ, તદ્વિત-પ્રત્યયો અને સમાસની સમજણ અપાઈ છે.

૧. આ લેખ “સિદ્ધચક્ર” (વ. ૧૨, અં. ૧૧)માં છપાયો છે.

૨. આ કૃતિ કોઈકની ટીકા સહિત મહેસાણાની “યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાલા” તરફથી ઇ. સ. ૧૯૧૩માં પ્રકાશિત સ્તોત્રરત્નાકર (ભા.૧)ના અંતમાં છપાયેલી છે. આ ટીકાનો પ્રારંભ “શ્રીમજ્જિનેન્દ્રમાનમ્” થી કરાયો છે. મૂળ કૃતિની વિ. સં. ૧૫૦૭માં લખાયેલી એક હાથપોથી મળે છે.

૩. જુઓ શ્લો. ૧૨૭ તેમજ એની ઉપર્યુક્ત ટીકાનું આદ્ય પદ.

૪. જુઓ જૈ. સા. સં. ઇ. (પૃ. ૫૧૪)

૫. આ સ્તવન જૈન સ્તોત્ર સમુચ્ચય (પૃ. ૨૬૫-૨૬૬)માં છપાયું છે અને એને અંગેનું ચિત્ર અંતમાં અપાયું છે.

આ જાતના ઔક્તિકોમાં ઉપર્યુક્ત બાલશિક્ષા અને કુલમંડન-સૂરિકૃત મુગ્ધાવબોધ ઔક્તિક એ બે કૃતિઓ ખાસ નોંધપાત્ર ગણાય છે. આ પ્રકારનાં વ્યાકરણો ભાષાના ઇતિહાસની સીમાનાં ચિહ્ન પૂરાં પાડે છે.

‘પ્રસ્તુત કૃતિ ઉપર નીચે મુજબની ટીકાઓ છે :

- (૧) ટીકા - આના કર્તા સોમવિમલના શિષ્ય હર્ષકુલ છે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૪૬)માં ઉલ્લેખ છે. જૈ. સા. સં. ઈ. (પૃ. ૫૧૮) પ્રમાણે હેમવિમલસૂરિના શિષ્ય જે હર્ષકુલગણિએ સૂયગડ ઉપર વિ. સં. ૧૫૮૩માં દીપિકા રચી છે અને જેઓ બંધહેતૂદયત્રિભંગીના કર્તા છે તેમણે હેમવિમલસૂરિના રાજ્યમાં આ વાક્યપ્રકાશ ઉપર ટીકા રચી છે.
- (૨) ટીકા- આ વાચક કીર્તિવિજયના શિષ્ય જિનવિજયની વિ. સં. ૧૬૮૪ની રચના છે. P. ૫૨
- (૩) ટીકા- જૈન ગ્રન્થાવલી (પૃ. ૩૦૭) પ્રમાણે આ રત્નસૂરિની કૃતિ છે.
- (૪) ૩ટીકા- આ અજ્ઞાતકર્તૃક રચનાનો પ્રારંભ “શ્રીમજ્જિનેન્દ્રમાનમ્ય” થી થાય છે.
- (૫) ટીકા- આના કર્તાનું નામ જાણવામાં નથી.

અન્ય ઔક્તિકો-સોમપ્રભસૂરિએ ૪૧૫ શ્લોક જેવડું એક ઔક્તિક રચ્યું છે. વળી જિનચન્દ્રે તેમજ અન્ય કોઈએ એકેક ઔક્તિક રચ્યું છે.

"The Auktikas are a sort of Prakṛta into Sanskrit Dictionaries."

અર્થાત્ ઔક્તિકો એ એક જાતના પ્રાકૃત-સંસ્કૃત કોશો છે.

આંશિક વ્યાકરણ

ઉપસર્ગ-મંડન (વિ.સં. ૧૪૮૨) આના કર્તા જૈન ગૃહસ્થ મંત્રી મંડન છે. એઓ ઝાંઝણ સંઘવીના ૧૭ પુત્રોમાંના બીજા પુત્ર બાહડના નાના પુત્ર થાય છે. એમના મોટા ભાઈનું નામ સમુદ્ર (સમધર) છે. એમની પેઠે એમના કાકા દેહડના પુત્ર ધન્યરાજ, ધનરાજ ઉર્ફે “ધનદ પણ વિદ્વાન અને ધનિક હતા. મંડને ‘ભૂષણ’ અર્થવાચક ‘મંડન’ શબ્દથી અલંકૃત નીચે મુજબની આઠ કૃતિઓ રચી એ દ્વારા પોતાના નામને P. ૫૩ એ સાથે જોડ્યું છે :-

૧. શું વિનયવિજયગણિએ હેમલઘુપ્રક્રિયાની સ્વોપણ બૃહદ્વૃત્તિમાં આ કૃતિનો ઉલ્લેખ કર્યો છે ?
૨. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૫૦
૩. આ ઔક્તિકનો પરિચય આપતાં જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૬૩)માં કૌસમાં "grammar" એટલે કે વ્યાકરણ એવો ઉલ્લેખ છે. તેમ છતાં અહીં ઔક્તિકોને અંગે નીચે મુજબ લખાણ છે તો એ વિચારણીય જણાય છે :-
૪. આ છ પે પુત્રો આલમશાહ (હોશંગ ઘોરી)ના સચિવો હતા. જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૮૦)માં કહ્યું છે કે આ આલમશાહ તે “દિલાવરખાનનો પુત્ર અલ્પખાં (વિ.સં. ૧૪૬૧-૧૪૮૬) અને પછી થયેલ હોશંગ ઘોરી.”
૫. આ ધનદે શૃંગાર-ધનદ, નીતિ-ધનદ અને વૈરાગ્ય-ધનદ એમ ત્રણ શતકો રચી એમાં પોતાનું નામ જોડ્યું છે.

(૧) 'અલંકાર-મંડન, (૨) ઉપસર્ગ-મંડન, (૩) કાદંબરી-મંડન, (૪) કાવ્ય-મંડન, (૫) ચંપૂ-મંડન, (૬) શૃંગાર-મંડન, (૭) સંગીત-મંડન અને (૮) સારસ્વત-મંડન.'

આ ઉપરાંત એમણે 'કવિ-કલ્પદ્રુમ-સ્કંધ' અને 'ચન્દ્રવિજય' એ બે કૃતિઓ પણ રચી છે. એમનું ચરિત્ર મહેશ્વર નામના કવિએ રચ્યું છે, અને એનું નામ 'કાવ્યમનોહર' રાખ્યું છે.

ઉપસર્ગમંડન નામની આ કૃતિના નામમાં કર્તાનું નામ છે અને સાથે સાથે એ જે વિષયની છે તેનું પણ નામ છે, પરંતુ 'ઉપસર્ગ' શબ્દ અનેકાર્થી છે. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને સંગમે જે પ્રતિકૂળ તેમજ સાનુકૂળ ઉપદ્રવો કર્યા હતા તે તેમજ દેવ કે મનુષ્ય તરફથી કેટલાક જૈન મુનિવરોને જે કનડગત કરાઈ હતી તે 'ઉપસર્ગ' તરીકે સુપ્રસિદ્ધ છે. ઉપસર્ગના આ અર્થ ઉપરાંત એનો બીજો અર્થ ધાતુઓ કે ધાતુ ઉપરથી બનાવાયેલા નામાદિની આગળ જોડાતો અને એના મૂળ અર્થમાં પ્રાયઃ વિશેષતા લાવતો શબ્દ કે અવ્યય એ છે. આથી અહીં ગ્રંથનું નામ વિચારતાં એ પ્રશ્ન ઉદ્ભવે કે એમાં પ્રથમ અર્થવાચક ઉપસર્ગનું P. ૫૪ નિરૂપણ છે કે દ્વિતીય અર્થવાચક ઉપસર્ગનું ? જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૫૪) પ્રમાણે એ વ્યાકરણના એક અંશરૂપ એવા દ્વિતીય અર્થનો દ્યોતક છે. આ હિસાબે આ કૃતિમાં અધિ, અનુ, અપ, અભિ, અવ, ઉપ, પર, પ્ર, સમ્ વગેરે ઉપસર્ગોનું નિરૂપણ હશે એમ કહી શકાય. આ નિરૂપણમાં સિ. હે.ની કે એની કોઈ સ્વોપજ વૃત્તિની છાયા હોય તો આ કૃતિને આના પછીના પ્રકરણમાં સ્થાન અપાવું ઘટે.

ધાતુમંજરી (લ. વિ. સં. ૧૬૫૦) - આ ૧૨૦૦ શ્લોકની કૃતિ સિદ્ધિચન્દ્રગણિએ રચી છે. આ પાણિનીય જેવા અજૈન સંસ્કૃત ધાતુપાઠને લગતી સંસ્કૃત કૃતિ નહિ હશે એમ માની એની મેં અહીં નોંધ લીધી છે. બાકી એની એક હાથપોથી જે લીંબડીના ભંડારમાં છે એ જોવા મળ્યે આ કૃતિનો વાસ્તવિક અને પરિપૂર્ણ પરિચય હું આપી શકું. એથી અત્યારે તો આ ગણિનો પરિચય આપું છું. આ ગણિ ભાનુચન્દ્રગણિના શિષ્ય થાય છે. એઓ 'શતાવધાની' યાને સો અવધાન કરનાર તરીકે પ્રખ્યાત છે. એમને અકબર બાદશાહે "ખુફહમ્"ની પદવી આપી હતી. એમણે એમના ગુરુનું 'ચરિત્ર સંસ્કૃતમાં રચ્યું છે. વૃદ્ધ-પ્રસ્તાવોક્તિ-રત્નાકર એ એમની રચના છે.^૭

૧. આ કૃતિ પાટણની "હેમચન્દ્રાચાર્ય સભા" તરફથી ૧૧મા ગ્રંથાંક તરીકે છપાઈ છે.
૨. ઉપર્યુક્ત સભા તરફથી આ આઠ કૃતિઓ પૈકી બીજી, સાતમી અને આઠમી એ ત્રણ સિવાયની બધી છપાવાઈ છે. કાવ્ય-મંડન અને શૃંગાર-મંડન એ બે કૃતિ આ સભા તરફથી વિ. સં. ૧૯૭૬માં પ્રસિદ્ધ કરાઈ છે.
૩. આ નામે આની નોંધ જિ. ૨. કો.માં નથી પરંતુ જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૮૪) પ્રમાણે Catalogus Catalogorum માં આની નોંધ છે.
૪. આ કાવ્ય પાટણની "હે. સ." તરફથી પ્રકાશિત થયેલું છે. એની વિ. સં. ૧૫૦૪માં લખાયેલી હાથપોથી મળે છે.
૫. ભક્તામરસ્તોત્રની જે વૃત્તિ આ સિદ્ધિચન્દ્રગણિએ રચી છે તેમાં પ્રારંભમાં સોનો અને અંતમાં ૧૦૮નો ઉલ્લેખ છે.
૬. આ ચરિત્ર ભાનુચન્દ્રગણિચરિત એ નામથી "સિંધી જૈન ગ્રંથમાલા"માં ઈ.સ. ૧૯૪૧માં છપાયું છે.
૭. કાદંબરી-ઉદ્ધાર યાને સંક્ષિપ્તકાદંબરીકથાનક એ એમની ગુજરાતી કૃતિ છે. આ કૃતિ પ્રાસ્તાવિક કથનપૂર્વક જિનવિજયજીએ (હવે ગૃહસ્થ) સંપાદિત કરી છે અને એ "પુરાતત્ત્વ" (પુ. ૫, અં. ૪, પૃ. ૨૪૧-૨૫૬)માં વિ. સં. ૧૯૮૩માં છપાઈ છે.

એમણે નીચે મુજબની કૃતિઓની 'વૃત્તિ રચી છે :-

(૧) (હૈમ) અનેકાર્થ નામમાલા, (૨) 'કાદંબરી (ઉત્તરાર્ધ), (૩) 'ભક્તામર-સ્તોત્ર, (૪) P. ૫૫ વાસવદત્તા, (૫) 'શોભન-સ્તુતિ અને (૬) સપ્તસ્મરણ. શું ભક્તામરસ્તોત્ર આ સપ્તસ્મરણમાં આવી જાય છે? [સૂર્યસહસ્રનામ, સ્વોપજટીકા સાથે આનું સંપાદન આ. ધુરંધરસૂરિ મ. સા. કરી રહ્યા છે.]

'મિશ્રલિંગકોશ, 'મિશ્રલિંગનિર્ણય કિંવા લિંગાનુશાસન (લ. વિ. સં. ૧૭૦૦) - આના 'કર્તા કલ્યાણસાગર છે. એઓ 'અંચલ' ગચ્છના ધર્મમૂર્તિના શિષ્ય થાય છે. એમણે પોતાના શિષ્ય વિનીતસાગર માટે આ કોશ રચી, એક કરતાં વધારે લિંગનાં એટલે કે જાતિનાં નામોની સૂચી પૂરી પાડી છે. [આમાં ૬૬૦ અને ૧૫૪૨ શ્લોકમાં ૧૩૦૦૦ શબ્દો છે. "લિંગનિર્ણય" નામથી મહા. વિનયસાગર સંશોધિત આ કૃતિ આ. કલાપ્રભસાગરસૂરિ દ્વારા સંપાદિત થઈ "આર્યજયકલ્યાણકેન્દ્ર" મુંબઈથી વિ.સં. ૨૦૩૭માં પ્રસિદ્ધ થઈ છે. પરિશિષ્ટમાં શબ્દોની અકારાદિસૂચી અભિ.ચિ.ના સ્થળ નિર્દેશ અને ગુજ: અનુવાદપૂર્વક આપી છે.]

ઉણાદિપ્રત્યય- આની હાથપોથી દિ.ના ભંડારમાં જોવાય છે. એ હિસાબે એ દિ. કૃતિ હશે. એના કર્તા વસુન્દિ છે. એમણે આ કૃતિ ઉપર સ્વોપજ ટીકા રચી છે. આ બંનેની નોંધ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૧)માં લેવાઈ છે.

પારસી(ક)ભાષાનુશાસન- આ પારસીક યાને ફારસી ભાષાનું સંસ્કૃતમાં પાંચ અધ્યાયમાં રચાયેલું P. ૫૬ વ્યાકરણ છે. એના કર્તા વિક્રમસિંહ છે. એઓ મદનપાલ ઠક્કુરના પુત્ર અને આનંદસૂરિના શિષ્ય થાય છે. આની એક હાથપોથી પંજાબના ભંડારમાં છે. એમાંથી કેટલાક ઉતારા 'A Catalogue of Manuscripts in the Punjab Jain Bhandars (pt. I)માં અપાયા છે.^૯

કર્ણાટક-શબ્દાનુશાસન (શકસંવત્ ૧૫૨૬=વિ. સં. ૧૬૬૧)- આ વ્યાકરણ દિ. અકલંકે શકસંવત્ ૧૫૨૬માં ચાર પાદમાં ૫૮૨ સૂત્રમાં રચ્યું છે.^{૧૦} આ 'કાનડી' ભાષાનું વ્યાકરણ છે. એ સર્વોત્તમ ગણાય

૧. વસંતરાજકૃત શકુનશાસ્ત્રની ભાનુચન્દ્રગણિએ રચેલી વૃત્તિનું એમણે સંશોધન કર્યું છે.

૨. આ "નિર્ણયસાગર મુદ્રણાલય" તરફથી છપાઈ છે.

૩. આ સ્તોત્રની વૃત્તિ "દે. લા. જૈ. પુ. સં." તરફથી ઈ. સ. ૧૮૩૨માં છપાયેલી "ભક્તામર-કલ્યાણમન્દિર-નમિત્રીણ-સ્તોત્રત્રય"ની મારી આવૃત્તિમાં પ્રકાશિત થયેલી છે.

૪. આની વૃત્તિ શોભન-સ્તુતિની ચાર ટીકા સહિતની મારી ઈ.સ. ૧૮૩૦માં "આ. સ." તરફથી પ્રકાશિત થયેલી આ વૃત્તિમાં છપાયેલી છે.

૫. ઉદયસાગરે વિ. સં. ૧૭૦૪માં રચેલી સ્નાત્રપંચાશિકામાં આનો શિવસિન્ધુ તરીકે ઉલ્લેખ છે.

૬. જૈ. ગ્રં. (પૃ. ૩૦૭)માં આ નામની કૃતિની નોંધ છે અને ત્યાં કર્તાનું નામ કલ્યાણસૂરિ અપાયું છે, પરંતુ મને તો આ બંને કૃતિ એક જ હોય અને કર્તાનું નામ કલ્યાણસાગર હોય એમ લાગે છે.

૭. જૈ. ગ્રં. (પૃ. ૩૧૧)ના ટિપ્પણમાં આ કલ્યાણસાગરને 'સૂરિ' કહી દેવમૂર્તિસૂરિના શિષ્ય તરીકે ઓળખાવ્યા છે, અને સાથે સાથે આ દેવમૂર્તિસૂરિને વિ. સં. ૧૪૮૬માં વિક્રમચરિત્ર રચનારા કહ્યા છે.

૮. આ સૂચીપત્ર લાહોરથી ઈ.સ. ૧૮૩૮માં પ્રકાશિત કરાયું છે.

૯. જુઓ જિ. ૨. કો. (ખંડ ૧ પૃ. ૪૬૫).

૧૦. જુઓ "અનેકાન્ત" (વર્ષ ૧, કિ. ૬-૭, પૃ. ૩૩૫).

છે અને એ વ્યાકરણ નાગવર્મકૃત કર્ણાટકભાષાભૂષણ કરતાં મોટું છે. વળી એમાં શબ્દમણિદર્પણ કરતાં અધિક વિષયો છે. પ્રસ્તુત વ્યાકરણમાં અકલંકે પોતાના ગુરુનો પરિચય આપ્યો છે. એમાં એમણે ચારુકીર્તિને અંગે અનેક વિશેષણો વાપર્યાં છે.

^૧ભાષામંજરી- આ ઉપર્યુક્ત વ્યાકરણની સંસ્કૃત વૃત્તિ છે.

^૨મંજરીમકરન્દ- આ ઉપર્યુક્ત વ્યાકરણનું સંસ્કૃત વ્યાખ્યાન છે.

P. ૫૭

પરિશિષ્ટ ૧ : ચન્દ્ર-વ્યાકરણ

ચન્દ્ર-વ્યાકરણ (ઉ. વિ. સં. ૫૫૦)- આ વ્યાકરણને ચાન્દ્ર વ્યાકરણ પણ કહે છે. એ બૌદ્ધ વિદ્વાન ચન્દ્રગોમીએ પાણિનીય અષ્ટા. અને મહાભાષ્યનો ઉપયોગ કરી રચ્યું છે. એમણે રાજતરંગિણીના કર્તા કલ્હણના કથન મુજબ 'કાશ્મીર'ના નૃપતિ અભિમન્યુની પ્રેરણાથી આ વ્યાકરણ રચી મહાભાષ્યના પ્રચારાર્થે પ્રયાસ કર્યો હતો.

ભર્તૃહરિએ વાક્યપદીય (કાંડ ૨, શ્લોક. ૪૮૭-૪૮૯)માં કહ્યું છે કે ભૈજ, સૌભવ અને હર્યક્ષ જેવા શુષ્ક તાર્કિકો સાંપ્રદાયિક અભિનિવેશને લઈને મહાભાષ્યનો નાશ કરવા લાગ્યા એ સમયે ચન્દ્રગોમીએ એની રક્ષા ન કરી હોત તો કાળ ક્યારનો યે એને સ્વાહા કરી ગયો હોત.

ઉપર્યુક્ત અભિમન્યુનો સમય કલ્હણને મતે વિક્રમથી એક હજાર વર્ષ પૂર્વેનો છે, જ્યારે કેટલાક આધુનિક વિદ્વાનોને મતે એ ઈ. સ. ૪૨૩ અને ઈ. સ. ૫૦૦ વચ્ચેનો છે.

ચન્દ્ર વ્યાકરણની સ્વોપજ વૃત્તિમાં "અજયદ્ ગુપ્તો હૂણાન્" એવું જે ઉદાહરણ છે તે ઉપરથી આ આધુનિક મત બંધાયો હોય એમ લાગે છે.

ચન્દ્રગોમીએ ચન્દ્ર વ્યાકરણની સ્વોપજ વૃત્તિમાં એને લઘુ, વિસ્પષ્ટ અને સંપૂર્ણ કહ્યું છે. સામાન્ય રીતે આ વ્યાકરણ છ અધ્યાયનું અને લૌકિક સંસ્કૃતનું મનાય છે, પણ એમાં સાતમો અધ્યાય વૈદિક ભાષાને લગતો અને આઠમો સ્વરપ્રક્રિયાને અંગેનો હતો એમ એમાં આઠ અધ્યાયો હતા અને એ લૌકિક અને વૈદિક ઉભય પ્રકારના સંસ્કૃતનું વ્યાકરણ હતું એમ સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૧૭) જોતાં જણાય P. ૫૮ છે. વિક્રમની બારમી સદીમાં વિદ્યમાન પુરુષોત્તમના સમય પહેલાં આ બે અધ્યાયો નાશ પામ્યા હતા.

મેં પરિશિષ્ટરૂપે ચન્દ્ર વ્યાકરણનો પરિચય અહીં આપ્યો છે તેનું એક કારણ એ છે કે એ ઘણું પ્રાચીન અને મહત્ત્વનું વ્યાકરણ ગણાતું હોવાથી જૈન વૈયાકરણોએ એનો ઉપયોગ કર્યો છે.^૩ વિશેષમાં કવિવર ધનપાલે તો કાતંત્રની સાથે સાથે આ ચન્દ્ર વ્યાકરણનો પણ અભ્યાસ કર્યો હતો.

ચિત્રાલંકાર કાવ્ય અને એક વિવેચન- લે. કમલા જૈન પ્ર. રત્નજૈન પુસ્તકાલય અહમદનગર

More Documents at Jain Painting and Gujarati Paintings Of 16th and later Centuries- By Dr. U. P. Shah. એલ. ડી. સિરિજ નં. ૫૧



૧-૨. એજન. ૩. જુઓ સિ. હે. (અ. ૨, પા., સૂ.)ની બૃહદ્ વૃત્તિ.

પ્રકરણ ૩ : હૈમ પંચાંગ વ્યાકરણ

P. ૬૧

પૃ. ૩૪માં સૂચવ્યા મુજબ હું હવે અહીં ‘કલિ.’ ‘હેમચન્દ્રસૂરિકૃત વ્યાકરણનો પરિચય આપું છું અને એનો પ્રારંભ એના પ્રથમ અંગરૂપ સૂત્રપાઠ નામે સિદ્ધહેમચન્દ્રથી કરું છું.

‘સિદ્ધહેમચન્દ્ર- આ નામમાં બે અંશ છે : (૧) ‘સિદ્ધ’ અને (૨) હેમચન્દ્ર. પ્રથમ અંશ ‘સોલંકી’ યાને ‘ચૌલુક્ય’ વંશના વિદ્યારસિક નરેશ્વર સિદ્ધરાજ જયસિંહ (વિ. સં. ૧૧૫૧-૧૧૮૮)ના નામનો દ્યોતક છે, અને એનું કારણ એ છે કે આ શબ્દાનુશાસનની યોજના એ નરેશ્વરની ‘અભ્યર્થનાનું પરિણામ છે.’ દ્વિતીય અંશ એના પ્રણેતા ‘કલિ.’ હેમચન્દ્રસૂરિના નામનો દ્યોતક છે. આમ આ બે અંશો અનુક્રમે P. ૬૨ અમોઘ-વૃત્તિ અને બુદ્ધિસાગર વ્યાકરણ જેવાં નામોનું સ્મરણ કરાવે છે.

‘કલિ.’ હેમચન્દ્રસૂરિનું નામ દેશવિદેશના સંસ્કૃતજ્ઞોને સુપરિચિત છે. ગુજરાતના એ પનોતા પુત્રે ગુજરાતીઓના કાનમાં અસ્મિતાનો મંત્ર ફૂંક્યો હતો અને ગુજરાતને સાહિત્યની પ્રત્યેક શાખામાં પગભર કરવા માટે એને સર્વતન્ત્ર-સ્વતન્ત્ર બનાવવા માટે ભગીરથ પ્રયાસ સેવ્યો હતો. એમણે રચેલા તમામ ગ્રંથો તો આજે મળતા નથી, પણ જે મળે છે તે વ્યાકરણ, કોશ, છંદ, અલંકાર, કાવ્ય, ન્યાય, તત્ત્વજ્ઞાન, યોગ એમ વિવિધ વિષયોનો સચોટ બોધ કરાવે છે. આ ‘પૂર્ણતલ’ ગચ્છના સૂરિવર્ધનો જન્મ વિ. સં. ૧૧૪૫માં કાર્તિક પૂર્ણિમાએ ધંધુકામાં ‘મોઢ’ જ્ઞાતિના ચચ્ચ, ચાચિગ અને ચાચ એમ ત્રિવિધ નામે ઓળખાવાતા વણિકને ત્યાં થયો હતો. એમની માતા બનવાનું સૌભાગ્ય ‘ચામુંડ’-ગોત્રીય ચાહિણી, પાહિણી અને ચંગી એમ ત્રિવિધ નામે પ્રસિદ્ધ જૈન ભામિનીને પ્રાપ્ત થયું હતું. માતાપિતાએ એમનું નામ ચંગદેવ કે ચાંગદેવ રાખ્યું હતું. વિ. સં. ૧૧૫૪માં અને મતાંતર પ્રમાણે ૧૧૫૦માં ચાંગદેવે “દેવચન્દ્રસૂરિ પાસે દીક્ષા લીધી ત્યારે એમનું નામ સોમચંદ કે સોમદેવ રખાયું હતું. એ ઉત્સવમાં ઉદયન મંત્રીએ અગ્રભાગ ભજવ્યો હતો. વિ. સં. ૧૧૬૨માં અને મતાંતર પ્રમાણે ૧૧૬૬માં એઓ સૂરિ બન્યા ત્યારે એમનું નામ બદલી ને હેમચન્દ્ર રખાયું. ગુજરાતના બે મહાનૃપતિઓ સિદ્ધરાજ અને ‘પરમાર્હત’ કુમારપાલ આ આચાર્યના પરમ ભક્ત હતા.

૧. એમનાં જીવન અને કવનની આછી રૂપરેખાં મેં “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ એટલે ?” એ નામના મારા લેખમાં આલેખી છે. આ લેખ “ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક” (વ. ૩, અં. ૪, પૃ. ૫૬૧-૬૦૪)માં છે. સ. ૧૯૩૮માં પ્રસિદ્ધ થયો છે. અનેક પૌર્વાત્ય વિદ્વાનોએ તેમજ કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ આ સૂરિવર્ધનો પરિચય આપ્યો છે. આવી એક સૂચી મેં ઉપર્યુક્ત લેખમાં આપી છે.
૨. આ મૂળ કૃતિનાં વિવિધ સંપાદનો થયાં છે. એ પૈકી મારી સામે અત્યારે “જૈન ગ્રંથ પ્રકાશક સભા” તરફથી વિ. સં. ૧૯૮૮માં દીપિકા સહિત જે સંપાદનમાં આઠ અધ્યાયો છપાયાં છે તે છે. એમાં ૩૫ પદ્યો કટકે-કટકે-પ્રત્યેક પાદને અંતે એકેક અને અંતિમ પાદને અંતે ચાર અપાયાં છે. આ સંપાદનમાં આઠે અધ્યાયોનો પાદ દીઠ ગ્રંથાગ્ર અપાયો છે. વળી આઠમા અધ્યાયને અંગે ભાષાદીઠ સૂત્રોનો પણ ગ્રંથાગ્ર અપાયો છે.
૩. જુઓ સિ. હે.ની પ્રશસ્તિ (શ્લો. ૩૫) તેમજ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રની પ્રશસ્તિ (શ્લો. ૧૮)
૪. કુમારપાલની વિજ્ઞપ્તિથી યોગશાસ્ત્ર, વીતરાગસ્તોત્ર અને ત્રિષષ્ટિ. એ ત્રણ કૃતિઓ રચાઈ છે.
૫. સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૪૮)માં ‘ચન્દ્રદેવસૂરિ’ એવો ઉલ્લેખ છે તે ભ્રાન્ત છે.

કુમારપાલના 'અવસાન પૂર્વે એક વર્ષ પહેલાં એટલે કે વિ. સં. ૧૨૨૮માં આ સૂરિવર્ધનો ૮૪ P. ૬૩ વર્ષની વયે દેહોત્સર્ગ થયો, અને તેમ થતાં ગુજરાત એક વિરલ વિભૂતિના જ્યોતિ:પુંજથી વંચિત બન્યું.

રૂપરેખાસિદ્ધહેમચન્દ્રને સંક્ષેપમાં સિદ્ધહેમ પણ કહે છે. એ કેવળ સંસ્કૃત ભાષા પૂરતું વ્યાકરણ નથી. પરંતુ પાઈય ભાષાના મરહટ્ટી, સોરસેણી, માગહી, પેસાઈ, ચૂલિયાપેસાઈ તેમજ અવહટ્ટ એ છ ભેદો ઉપર પણ પ્રકાશ પાડનારું વ્યાકરણ છે. 'અવહટ્ટને અંગે તો આપણે એમને 'ગુજરાતના પાણિનિ' કહી શકીએ. જેમ પાણિનિએ 'છન્દસિ' અને 'નિગમે' કહી વૈદિક ભાષાનો પરિચય કરાવ્યો છે તેમ આ આચાર્યે 'આર્ષ' કહી જૈનોના પ્રાચીન અને મહામૂલ્યશાળી આગમોની અ. મા. ભાષાની વિશેષતાઓની પ્રસંગોપાત નોંધ લીધી છે. પાલિ એ પણ પાઈય ભાષાનો એક પ્રકાર છે. તેમ છતાં વરરુચિ વગેરે પ્રાચીન વૈયાકરણોએ જેમ એનું નિરૂપણ કર્યું નથી તેમ આ આચાર્યે પણ આ ભાષાનું વ્યાકરણ રચ્યું નથી. જો એ કાર્ય એમણે કરી નવો ચીલો પાડ્યો હોત તો એમના પંચાંગી વ્યાકરણની સાંગોપાંગતા સોળે કળાએ ખીલી ઊઠેત.

પરિમાણ- મેરુતુંગસૂરિએ વિ. સં. ૧૩૬૧માં રચેલા પ્રબંધચિંતામણિમાં કહ્યું છે કે "સવા લાખ P. ૬૪ શ્લોક જેવડું સિદ્ધહેમ નામનું નવું પંચાંગ વ્યાકરણ હેમચન્દ્રાચાર્યે એક વર્ષમાં રચ્યું. કેટલાક આ વર્ષ તરીકે વિ.સં. ૧૧૮૩-૮૪ ગણાવે છે.

૧. વિ. સં. ૧૨૩૦માં આ રાજા જતાં ગુજરાતમાં સોલંકીઓના વૈભવનો અસ્તકાળ શરૂ થયો.
૨. પ્રા. હરિવલ્લભ ચુ. ભાષણીનું ભાષણ નામે "હેમચન્દ્રીય અપભ્રંશનું સ્વરૂપ" "કા.ગુ. સ. ત્રૈ." (પૃ. ૧૬, અં. ૪, પૃ. ૧૬૧-૧૭૧)માં છપાયું છે તે જોઈ જવું ઘટે.
૩. સિ. કૌ.માં અંતમાં વૈદિક પ્રક્રિયા અપાઈ છે. એમાં "છન્દસિ" એવા ઉલ્લેખવાળાં કેટલાંક સૂત્રો છે. એને હિસાબે "નિગમે" એવા ઉલ્લેખવાળાં સૂત્રો તો બહુ જ થોડાં છે.
૪. એના ઉદાહરણ માટે જુઓ ૭-૨-૬૪ અને ૭-૪-૭૪.
૫. હેમચન્દ્રસૂરિએ સાડા ત્રણ કરોડ શ્લોક જેટલો ગ્રંથરાશિ યોજ્યો હતો એમ કહેવાય છે. રોજ બીજું કામ કરવાનું બાજુએ રાખી, ફક્ત પંચાંગ વ્યાકરણ રચવા પાછળ જ સમય અપાયો હોય તો એ હિસાબે રોજના લગભગ સાડી ત્રણસો (કલાકના પંદરેક) શ્લોક જેટલું લખાણ તૈયાર થાય તો એક વર્ષમાં સવા લાખ શ્લોક જેટલું પંચાંગ વ્યાકરણ બને. આજે આ વ્યાકરણની વિવિધ અંગોની જે સ્વોપજ વૃત્તિ મળે છે તેનું પરિમાણ નીચે મુજબ છે :-

સિ. હે. (અ. ૧-૭)ની લઘુવૃત્તિ	શ્લો.	૬૦૦૦
સિ. હે. (અ. ૮)ની લઘુવૃત્તિ	શ્લો.	૨૨૦૦
સિ. હે. ની બૃહદ્-વૃત્તિ	શ્લો.	૧૮૦૦૦
સિ. હે. નો ન્યાસ નામે શબ્દ-મહાર્ણવ	શ્લો.	૨૦૦૦૦
ઉણાદિ-ગણસૂત્ર (સટીક)	શ્લો.	૩૨૫૦
ધાતુ-પારાયણ	શ્લો.	૫૬૦૦
લિંગાનુશાસન (સટીક)	શ્લો.	૩૬૮૪

૫૮૭૩૪

આમાં ન્યાસનો ૬૪૦૦૦ શ્લોક જેટલો ભાગ નાશ પામ્યાની વાત સ્વીકારી એ સંખ્યા ઉમેરાય તો લગભગ સવા લાખ શ્લોક થઈ રહે.

યોજના- સ. હે.માં ચચ્યાર પાઠવાળા આઠ અધ્યાયો છે. પ્રથમના સાત અધ્યાયોમાં ૩૫૬૬ સૂત્રો દ્વારા સંસ્કૃત ભાષાનું નિરૂપણ છે,^૧ જ્યારે આઠમા (અંતિમ) અધ્યાયમાં ૧૧૧૯ સૂત્ર દ્વારા પાઠ્યના છ ભેદોનું નિરૂપણ છે.^૨ આ વ્યાકરણની રચના પ્રકરણાનુસારિણી છે અને એ રીતે એ કાતન્ત્રનું સ્મરણ P. ૬૫ કરાવે છે.^૩ ટૂંકમાં કહું તો એના આઠ સાત અધ્યાયોમાં નીચે મુજબના વિષયો રજૂ કરાયા છે. :

(૧) સંજ્ઞા, (૨) સ્વર-સંધિ, (૩) વ્યંજન-સંધિ, (૪) નામ, (૫) કારક, (૬) પત્વ-જાત્વ, (૭) સ્ત્રી-પ્રત્યય, (૮) સમાસ, (૯) ‘આખ્યાત’, (૧૦) ‘કૃદંત’ અને (૧૧) ‘તદ્વિત’.

આઠમા અધ્યાયના મુખ્ય વિષયો નીચે મુજબ છે. :-

સંધિના નિયમો, સ્વરો અને સાદા વ્યંજનોમાં પરિવર્તન, સંયુક્ત વ્યંજનોનાં રૂપાંતરો, સ્વર-ભક્તિ, વ્યત્પય, સંસ્કૃત શબ્દોના આદેશો, પાઠ્ય અવ્યયો, નામ, વિશેષણ, સર્વનામ અને ક્રિયાપદનાં રૂપાખ્યાનો, ધાત્વાદેશ તેમજ સોરસેણીથી માંડીને અવહટ્ટ (પા. ૪, સૂ. ૩૨૯-૪૪૬) સુધીની ભાષાનું નિરૂપણ.

સંજ્ઞા-સંજ્ઞા-વિધાનમાં સંજ્ઞાઓ પ્રાસાદિક એટલે કે ઝટ સમજાય તેવી રખાઈ છે અને એમ કરવામાં એન્દ્ર પરંપરા, પ્રાતિશાખ્ય પરંપરા અને કાતન્ત્ર-પરંપરાનો ઉપયોગ કરાયો છે. કાત્યાયનકૃત ‘પાલિ’ ભાષાના વ્યાકરણમાં સિ. હે.ગત કેટલીક સંજ્ઞાઓ નજરે પડે છે. પાણિનીય અષ્ટાની ‘લોટ્’ અને P. ૬૬ ‘લિડ્’^૪ સંજ્ઞાને બદલે કાતન્ત્રની પેઠે સિ. હે.માં પંચમી અને ‘સપ્તમી’ સંજ્ઞા છે.

અષ્ટા.માં લટ્, લિટ્, લુટ્, લૃટ્, લેટ્, લોટ્, લઙ્, લિઙ્, લુઙ્ અને લૃઙ્ એમ દસ સંજ્ઞા છે. તેમાં ‘લેટ્’ તો વેદમાં જોવાય છે. એથી એને બાજુએ રાખતાં ‘લોટ્’ યાને આજ્ઞાર્થ એ ‘પંચમી’ અને ‘લિઙ્’ યાને વિધ્યર્થ એ ‘સપ્તમી’ ગણાય.

૧-૨. પ્રથમના સાત અધ્યાયોનો ગ્રંથાગ્ર શ્લો. ૭૮૭ અને ૬ અક્ષર પૂરતો છે, જ્યારે આઠમાનો શ્લો. ૨૪૪ ને ૪ અક્ષર પૂરતો છે; સમગ્ર કૃતિનો ગ્રંથાગ્ર શ્લો. ૧૦૩૧ અને ૧૦ અક્ષરનો છે.

૩. સંજ્ઞાઓ માટે પણ કાતન્ત્રનું અનુસરણ કરાયું છે.

૪. એ પ્રત્યેકની સૂત્ર સંખ્યા ઇત્યાદિ માટે જુઓ શ્રી. મધુસૂદન મોદી કૃત હેમસમીક્ષા (પૃ. ૩૭-૪૦). [અન્ય વ્યાકરણો સાથે તુલના માટે જુઓ આ. હેમચન્દ્ર ઔર ઉનકા શબ્દાનુશાસન પ્ર. ચૌખંબા વિદ્યાભવન વારાણસી.]

૫. આ વિષયને લગતા પ્રકરણને ‘સ્યાદિ-પ્રકરણ’ તરીકે ઓળખાવાય છે.

૬. ધાતુ અને પ્રત્યયના યોગથી ક્રિયા સિદ્ધ થતી હોવાથી ‘આખ્યાત’ કહેવાય છે.

૭. આમાં દસ કાળના પ્રત્યયો વગેરેની હકીકત છે.

૮. ચતુષ્ક અને આખ્યાત પછી કરાય તે ‘કૃત્’ કહેવાય છે.

૯. ‘કૃત્’ પ્રત્યયની વિસ્તૃત અને જટિલ ચર્ચાને લગતો આ વિષય છે.

૧૦. પ્રકૃતિને હિતકારી અણાદિ પ્રત્યયોને હિતકારી તે ‘તદ્વિત’ કહેવાય છે.

૧૧. આ તેમજ અન્ય પાણિનીય સંજ્ઞા વગેરેનો વિચાર ક્ષિતીશયન્દ્ર ચેટરજીએ સત્યપ્રસાદ ભટ્ટાચારજી દ્વારા ઈ.સ.

૧૯૪૮માં પ્રકાશિત “ઉષા સ્મારક ગ્રંથમાલા” ગ્રંથાક ૩ નામે Technical Terms and Technique of Sanskrit Grammar (part I)માં સારી રીતે કર્યો છે.

સન્તુલન-પ્ર. ચ. (શૃંગ ૨૨, શ્લો. ૮૬-૮૭) પ્રમાણે 'કલિ.' હેમચન્દ્રસૂરિને સિદ્ધરાજે જ્યારે વ્યાકરણ રચવા વિજ્ઞાપિ કરી ત્યારે એ સૂરિએ કાશ્મીરથી આઠ વ્યાકરણો મંગાવી આપવા કહ્યું. આના નામ કોઈ સ્થળે નોંધાયેલાં હોય એમ જણાતું નથી. ગમે તેમ એમણે આ આઠ વ્યાકરણોનો તો ઉપયોગ કર્યો જ હોવો જોઈએ.

પુરોગામીઓની સબળ કૃતિઓનો જેટલા પ્રમાણમાં લાભ લેવાય તેટલો લેવો અને પુસ્તક રચવામાં એના અંશો તેના તેજ સ્વરૂપમાં લેવા યોગ્ય જણાય તો તેમ પણ કરવું. આ પ્રકારની મનોદશા પ્રાચીન સમયના જૈન શ્રમણો સેવતા હતા. 'કલિ.' હેમચન્દ્રસૂરિની પણ આવી વૃત્તિ હોવાથી તેમજ રાજા તરફથી સત્વર કાર્ય કરી આપવાનું સૂચન હોવાથી એમણે શાકટાયનનાં કેટલાંયે સૂત્રો જરાયે ફેરફાર P. ૬૭ વિના અપનાવ્યાં છે,^૧ અને એનાં કેટલાંક સૂત્રો સમુચિત ન જણાતાં એમાં એમણે પરિવર્તન કરી તેને સ્થાન આપ્યું છે.

પાંત્રીસ પદ્યો-પ્ર. ચ. (શૃંગ ૨૨, શ્લો. ૧૦૧-૧૦૨^૩)માં સિ. હે.ના (અંતિમ સિવાયના) દરેક પાદને અંતે એકેક પદ્ય અને સર્વ પાદને અંતે ચાર એટલે કે ત્રીસ વક્તા પાંચ એમ ૩૫ પદ્યોની પ્રશસ્તિ હોવાનો ઉલ્લેખ છે. આજે સિ. હે.ના ૩૨ પાદ પૈકી પ્રત્યેકને અંતે એકેક પદ્ય અને અંતમાં ત્રણ વધારે એમ ૩૫ પદ્યો જોવાય છે. આ પદ્યો સિ. હે.ના સમજવાં કે એની સ્વોપજ લઘુવૃત્તિનાં કે એની બૃહદ્વૃત્તિનાં ગણવાં એવો એક પ્રશ્ન આ ત્રણેનાં વિવિધ સંપાદનો જોતાં ઉદ્ભવે છે. અંતિમ નિર્ણય કરવા માટે આ ત્રણેની પ્રાચીન હાથપોથીઓ તપાસવી ઘટે. આ સંબંધમાં થોડોક વિચાર કરતાં અત્યારે તો મારું એમ માનવું થાય છે કે એ સિ. હે.ની સ્વોપજ બૃહદ્વૃત્તિનાં જ છે.

P. ૬૮ આ ૩૫ પદ્યો પૈકી પહેલાં ૩૪ પદ્યો દ્વારા 'ચૌલુક્ય' વંશના નીચે મુજબના સાત રાજાઓની પ્રશંસા કરાઈ છે :-

(૧) મૂલરાજ, (૨) ચામુંડરાજ, (૩) વલ્લભરાજ, (૪) દુર્લભરાજ, (૫) ભીમદેવ, (૬) કર્ણદેવ, અને (૭) સિદ્ધરાજ જયસિંહ.

૧. "શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચાર સમિતિ" તરફથી વિ. સં. ૨૦૦૨માં પ્રકાશિત અને પં. ચંદ્રસાગરગણિ (હવે સૂરિ) દ્વારા સંપાદિત "શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનમ્" (ભાગ ૧)ની પ્રસ્તાવના (પૃ. 'કૂ')માં શાકટાયન વ્યાકરણ (અ. ૧, પા. ૧)માંનાં વીસ સૂત્રો આપી એનાં એ જ સૂત્રો સિ. હે.માં ક્યાં ક્યાં છે તે દર્શાવાયું છે. એના પછીના પૃષ્ઠમાં શાકટાયન વ્યાકરણમાંથી નવ સૂત્રો આપી એમાં રહેલી કિલ્લેટતા અને સંદિગ્ધતાને દૂર કરનારા સિ. હે.નાં સૂત્રો સંતુલનાર્થે રજૂ કરાયાં છે.

આ સંપાદનમાં બીજા અધ્યાયના બીજા પાદ પૂરતાં સૂત્રો અપાયાં છે. આમ અહીં સંજ્ઞા, સંધિ, નામ અને કારકને લગતાં સૂત્રો છે. એને અંગેની હૈમ બૃહદ્વૃત્તિ નામે તત્ત્વપ્રકાશિકા અને ચંદ્રસાગરજીએ તૈયાર કરેલી આનંદબોધિની નામની વિવૃત્તિ અહીં અપાઈ છે. અંતમાં ૧૪ પરિશિષ્ટો અપાયાં છે.

૨. આનો ગુજરાતી અનુવાદ હૈમ-સારસ્વત-સત્રમાં અપાયો છે. "ગુજરાતનું પ્રધાનતમ વ્યાકરણ" નામના લેખના અંતમાં આ ૩૫ પદ્યો ગુજરાતી અનુવાદ સહિત અપાયાં છે.

૩. "પાદાન્તે શ્લોકમેકકમ્ ॥૧૦૧॥ તત્ત્વતુષ્કં ચ સર્વાન્તે શ્લોકૈસ્ત્રિંશદ્વિરદ્ભુતા ।

પજ્ઞાધિકૈઃ પ્રશસ્તિશ્ચ વિહિતાઽવહિતૈસ્તદા ॥૧૦૨॥"

આ પદ્યો સંસ્કૃત દ્વ્યાશ્રય-કાવ્યનું સ્મરણ કરાવે છે. એ આ કાવ્યની રચના બાદ એના નવનીત રૂપે યોજાયાં હશે કે પછી એ પદ્યોરૂપ બીજકમાંથી સંસ્કૃત દ્વ્યાશ્રય-કાવ્યરૂપ વૃક્ષ ઉદ્ભવ્યું હશે એનો નિર્ણય કરવો બાકી રહે છે.

ઉપર્યુક્ત ૩૫ પદ્યો પૈકી અ. ૨, પા. ૨ ના અંતમાં અપાયેલા નિમ્નલિખિત પદ્યના અર્થ અને પાઠાંતર વિષે સિ. હે.ની પ્રસ્તાવના (પૃ. ગ; ધ અને ધા)માં ચંદ્રસાગરજીએ ચર્ચા કરી છે :-

“મૂલર્કઃ શ્રૂયતે શાસ્ત્રે સર્વકલ્યાણકારણમ્ । અધુના મૂલરાજસ્તુ ચિત્રં લોકેષુ ગીયતે ॥”

સ્વોયજ લઘુવૃત્તિ-સિ. હે.ના વિશદ પરંતુ સંક્ષિપ્ત સ્પષ્ટીકરણ માટે ‘કલિ.’ હેમચન્દ્રસૂરિએ આ લઘુવૃત્તિ રચી છે. ‘લઘુવૃત્તિ’ એવો પ્રયોગ અ. ૧-૭ માટેની, કેવળ અ. ૮ માટેની તેમજ અ. ૧-૮ એટલે કે સંપૂર્ણ સિ. હે. માટેની સ્વોપજ સંક્ષિપ્ત વૃત્તિ એમ ત્રણ ભિન્ન ભિન્ન અર્થમાં કરાય છે, પણ આ ત્રણોમાંથી ગમે તે જાતની લઘુવૃત્તિમાં ગણપાઠને સ્થાન નથી.

અ. ૧-૭ સુધીની લઘુવૃત્તિનું પરિમાણ છ હજાર શ્લોક જેવડું ગણાય છે અને એથી એને ‘છહજારી’ કહે છે.^૧

પ્રકાશિકા—કેવળ આઠમા અધ્યાય પૂરતી લઘુવૃત્તિને કેટલાક આ નામથી ઓળખાવે છે.^૨ એમાં પ. ૬૯ વિષયને વ્યક્ત કરવા ઉપરાંત બીજી કોઈ જાતની સામગ્રી અપાઈ નથી. અપભ્રંશનાં સૂત્રોને અંગેનાં

૧. આ છહજારી અ. ૧-૭ સુધીનાં સૂત્રો સહિત “યશોવિજય જૈન ગ્રંથમાલા”માં ઈ. સ. ૧૯૦૫માં છપાઈ હતી. એ દુષપ્રાપ્ય બનતાં “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી” તરફથી એ મૂળ સૂત્રો સહિત ઈ.સ. ૧૯૩૪માં પ્રકાશિત કરાઈ હતી. એનું સંપાદન મુનિશ્રી હિમાંશુવિજયજીએ કર્યું હતું. એમાં એમણે કેટલાંક સૂત્રોમાં સંધિ જતી કરી હતી. પં. દક્ષવિજયજીએ આ લઘુવૃત્તિનું મૂળ સહિતનું સંપાદન કર્યું છે અને એ “વિજયનેમિસૂરિ-ગ્રંથમાલા”માં ગ્રંથાંક ૩૦ તરીકે સંપાદકે તૈયાર કરેલાં ૧૩ પરિશિષ્ટો સહિત વિ. સં. ૨૦૦૮માં છપાઈ છે. તેર પરિશિષ્ટો પૈકી બાર તો ધાતુઓ સાથે એક યા બીજી રીતે સંબદ્ધ છે. “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી” તરફથી આઠે અધ્યાયની લઘુવૃત્તિ મૂળ કૃતિ તેમજ ધાતુપાઠ સહિત વિ. સં. ૧૯૫૦માં છપાવાઈ છે. [લ. વૃ. મુનિશ્રી જંબૂવિજય મ. દ્વારા સંશોધિત સંપાદિત થઈ હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર પાટણથી પ્રગટ થઈ છે. એની બીજી આવૃત્તિ પણ ટૂંકમાં પ્રગટ થશે. લ. વૃ.નો ગુજરાતી અનુવાદ પં. મેચરદાસ (પ્ર. યુનિ. ગ્રં. નિ. બોર્ડ), આ ચન્દ્રગુપ્તસૂરિ અને આ મહિમાપ્રભસૂરિના પ્રગટ થયા છે. પં. શિવલાલભાઈનું સિદ્ધહેમસારાંશ વ્યા. પણ પ્રસિદ્ધ થયેલ છે લઘુવૃત્તિ ઉપર મુનિ વિમલરત્ન વિ. કૃત ગુણરત્નાવૃત્તિ ક. સો. પેઢી પિંડવાડાથી પ્રસિદ્ધ છે.]

૨. આનું સમીક્ષાત્મક સંપાદન આર પિશલે કર્યું છે. એ વિદ્વાને જર્મન અનુવાદ આપી એની મહત્તામાં વૃદ્ધિ કરી છે. આ સંપાદન ઈ. સ. ૧૮૭૭-૮૦માં છપાયું છે, એ આજે મળતું નથી. શ્રી મોતીલાલ લાધાજી (હવે મુનિશ્રી કેવલવિજયજી) તરફથી ઈ.સ. ૧૯૨૮માં આ પ્રકાશિકા અ. ૮નાં સૂત્રો સહિત પ્રકાશિત કરાઈ છે, એનું સંપાદન ડૉ. પી. એલ. વૈદ્યે કર્યું છે. એમણે પાઈય પદ્યોની સંસ્કૃતમાં છાયા આપી એનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. અંતમાં એમણે શબ્દોની તેમજ ધાત્વાદેશની સૂચી આપી છે. “Bombay Sanskrit and Prakrit Series”માં ગ્રંથાંક ૬૦ના પરિશિષ્ટ તરીકે પૃથક્ સ્વરૂપે પ્રકાશિકા અ. ૮નાં સૂત્રો તેમજ ઉપર્યુક્ત બે સૂચી સહિત ઈ.સ. ૧૯૩૬માં છપાવાઈ છે. એનું નામ “હેમચન્દ્રનું પ્રાકૃત વ્યાકરણ” એવું રખાયું છે. [આ પછી પં. શ્રી વજ્રસેન વિ. ગણિના સંપાદન પૂર્વક પ્રાકૃત વ્યા. પ્રગટ થયું છે.]

મુક્તકો અપભ્રંશમાં છે અને એ અનેક રીતે મહત્વનાં છે. આ પ્રકાશિકાનું પરિમાણ ૨૨૦૦ શ્લોક જેવું દર્શાવાય છે. આ પ્રકાશિકાને કેટલાક બૃહદ્વૃત્તિનો ભાગ ગણે છે.

હેમ-લઘુ-વૃત્ત્યવચૂરિ-આ સિ. હે.ની લઘુવૃત્તિની અવચૂરિ હોય એમ લાગે છે એમ જ હોય તો પણ એ સ્વોપજ લઘુવૃત્તિની છે કે કેમ તે જાણવું બાકી રહે છે. ધનચન્દ્રના નામે દ્વપ પત્રની એક P. ૭૦ અવચૂરિની તેમજ ૨૨૧૩ શ્લોક જેવડી અને ચતુષ્ક-વૃત્તિ ઉપરની એક અજ્ઞાતકર્તૃક અવચૂરિની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૦૦)માં છે.

જિ. ૨. કો. (ખં. ૧, પૃ. ૩૭૬)માં જે કૃતિ દેવેન્દ્રના શિષ્ય ધનચન્દ્રે રચેલી દર્શાવાઈ છે અને જેની એક હાથપોથી વિ. સં. ૧૪૦૩માં લખાયેલી નોંધાયેલી છે તે જ આ હોય એમ લાગે છે.

હેમલઘુવૃત્તિદ્વંદ્વિકા યાને હેમલઘુવૃત્તિદ્વીપિકા—આ મુનિશેખરની ૩૨૦૦ શ્લોક જેવડી રચના છે. એની વિ. સં. ૧૪૮૮માં લખાયેલી એક હાથપોથી મળે છે. એ તપાસાય તો આ રચના અ. ૧-૭ પૂરતી છે કે આઠે અધ્યાયને અંગેની છે તેનો નિર્ણય થઈ શકે.

લઘુવૃત્ત્યવચૂરિ—આ અવચૂરિ પહેલા ચાર અધ્યાય પૂરતી છે. એ નંદસુંદરે રચી છે અને એની વિ. સં. ૧૫૧૦માં લખાયેલી હાથપોથી મળે છે.

લઘુવ્યાખ્યાનદ્વંદ્વિકા—આ ૩૨૦૦ શ્લોકની કોઈકની કૃતિ છે. એની એક હાથપોથી ચુરતમાં છે.

‘લઘુવૃત્ત્યવચૂરિ પરિષ્કાર—આનો પ્રારંભ “પ્રણમ્ય લઘ્વિદં પાશ્વ” થી કરાયો છે.

‘રહસ્ય-વૃત્તિ-સિ. હે. ઉપર જે સ્વોપજ લઘુવૃત્તિ છે તેનો અભ્યાસ ન કરી શકે એવા જનોને P. ૭૧ લક્ષીને આ રહસ્ય-વૃત્તિ રચાઈ છે. એથી તો સિ. હે.માંનાં પ્રસિદ્ધ તેમજ વિરલ પ્રસંગે ઉપયોગી એવાં તમામ સૂત્રોનું અહીં સ્પષ્ટીકરણ નથી. લઘુવૃત્તિમાં અપાયેલાં કેટલાંક ઉદાહરણો પણ અહીં જતં કરાયાં છે. આમ આ રહસ્ય-વૃત્તિ લઘુવૃત્તિને મુકાબલે નાની-^૩ લગભગ અઢી હજાર શ્લોક જેવડી અ. વિશેષ સુગમ બનાવાઈ છે. આ રહસ્ય-વૃત્તિમાં અધ્યાય પૂરો થાય એવાં એક બે સ્થળે ‘સ્વોપજ’ એવો ઉલ્લેખ જોવાય છે. એ ઉપરથી કેટલાક એના પ્રણેતા તરીકે હેમચન્દ્રસૂરિનું નામ સૂચવે છે, પરંતુ એ માબત વિચારણીય જણાય છે.

૧. આ પરિષ્કાર “શ્રીલઘ્વિસૂરીશ્વર જૈન સંસ્કૃત ગ્રંથમાલા”માં કટકે કટકે વિ. સં. ૨૦૦૨થી આજ દિન સ્પી પ્રસિદ્ધ થતો રહ્યો છે.

૨. આ રહસ્ય-વૃત્તિ સહિત એ પૂરતો સિ. હે.નો વિભાગ “જૈન શ્રેયસ્કર મંડળ” તરફથી વિ. સં. ૨૦૦૭માં પ્રકાશિત થયો છે. એનું સંપાદન પં. પ્રભુદાસ બેચરદાસ પારેખે કર્યું છે. સૂત્રોની સામે બાજુમાં વિષયસૂચક શીર્ષકો અપાયાં છે તેથી વિદ્યાર્થીનો માર્ગ સુગમ બન્યો છે. અંતમાં ગણદીઠ તેમજ પેટાગણદીઠ ધાતુઓની એના પદ અનુસાર સંખ્યા અપાઈ છે. ત્યાર પછી હૈમ ધાતુપાઠ તેમજ અનુબંધ-ફલ અને વૃત્-ગણ-ફલની કારિકાઓ અને અનિદ્-કારિકાઓ અપાઈ છે. અનિદ્ ધાતુઓને અંગે કોષ્ટક અપાયેલું છે. લગભગ પ્રારંભમાં “વર્ણોનો યંત્ર” અપાયો છે.

આ રહસ્યવૃત્તિનું સંપાદન સુરતના “જૈનાનંદ પુસ્તકાલય”ની એક હાથપોથીને આધારે કરાયું છે. અહીં જે ૭૮૩ ક્રમાંકવાળી હાથપોથી છે તે જ આ હશે.

૩. વિનયવિજયકૃત હેમલઘુપ્રક્રિયાનું પરિમાણ પણ લગભગ આટલુંજ છે, પરંતુ એ પ્રક્રિયારૂપે યોજાયેલી હોવાથી સ્વોપજ બૃહદ્-વૃત્તિના પ્રવેશદ્વારની ગરજ સારી શકતી નથી.

કાકલની કૃતિ યાને ઢુંઢિકા-દીપિકા-હેમચન્દ્રસૂરિના સમકાલીન અને સિ. હે.ના અધ્યાપન માટે નીમાયેલા મુખ્ય અધ્યાપક, કાયસ્થ, આઠ વ્યાકરણોના જ્ઞાતા કાકલે આ વ્યાકરણ ઉપર એક વૃત્તિ રચી છે. કેટલાક એને લઘુવૃત્તિ કહે છે તો કેટલાક એને મધ્યમવૃત્તિ કહે છે. વળી જિ. ર. કો. (ખંડ ૧, પૃ. ૩૭૬)માં કાકલની રચેલી લઘુવૃત્તિને ઢુંઢિકાદીપિકા કહી છે. અહીં કહ્યું છે કે આ ચતુષ્ક, આખ્યાત, કૃત્ અને તદ્વિત પૂરતી છે અને એનું પરિમાણ છ હજાર શ્લોકનું છે.

‘મધ્યમવૃત્તિ-કેટલાકનું એમ માનવું છે કે હેમચન્દ્રસૂરિએ સિ. હે. પ્રથમના સાત અધ્યાય ઉપર પ. ૭૨ આઠ હજાર શ્લોક જેવડી. મધ્યમવૃત્તિ રચી હતી અને આજે જે મળે છે તે જ એ છે.

‘બૃહદ્વૃત્તિ યાને તત્ત્વપ્રકાશિકા કિંવા અઢારહજારી-સ્વોપજ છહજારી લઘુવૃત્તિની અપેક્ષાએ આ વૃત્તિ ઘણી મોટી હોવાથી એને ‘બૃહદ્વૃત્તિ’ કહે છે. ‘કલિ.’ હેમચન્દ્રસૂરિએ જે ન્યાસ-બૃહન્યાસ રચ્યો છે તે આ બૃહદ્વૃત્તિના વિવરણરૂપ છે અને એ બૃહન્યાસનું નામ તત્ત્વપ્રકાશિકાપ્રકાશ હોવાનું સૂચવાય છે. આને લઈને કે પછી અન્ય કોઈ કારણસર બૃહદ્વૃત્તિને તત્ત્વપ્રકાશિકા કહે છે. એનું પરિમાણ ૧૮૦૦ પ. ૭૩ શ્લોક જેવડું હોવાથી એને અઢારહજારી પણ કહે છે. આ બૃહદ્વૃત્તિ પ્રથમના સાત અધ્યાય પૂરતી જ છે એમ ઘણાખરાનું માનવું છે. કેટલાકને મતે આઠમા અધ્યાય ઉપર જે સ્વોપજવૃત્તિ મળે છે તે આ બૃહદ્વૃત્તિનો ભાગ છે, કિંતુ એ સ્વોપજ વૃત્તિ મળે છે તે આ બૃહદ્વૃત્તિનો ભાગ છે, કિંતુ એ સ્વોપજ વૃત્તિમાં કોઈ વિશિષ્ટ પ્રકારની ચર્ચા નહિ હોવાથી તેમજ એની શૈલી લઘુવૃત્તિના જેવી હોવાથી એ લઘુવૃત્તિનો ભાગ ગણાવો ઘટે તેનું શું ?

૧. આનો ચતુષ્ક-વૃત્તિ પૂરતો -સિ. હે.ના ૩-૨-૧૫૬ સુધીનાં સૂત્રોને અંગેનો એક અંશ એ સૂત્રો તેમજ એને લગતી અજ્ઞાતકર્તૃક અવચૂરિ સહિત “સિદ્ધહેમ-શબ્દાનુશાસનમ્ પ્રથમો વિભાગઃ” એવા નામથી “શેઠ મોતીશા-લાલભાગ-જૈન ચેરીટી-પ્રકાશન ૨”-“શ્રીલબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાલા”ના ૩૩મા ભણિ તરીકે વિ. સં. ૨૦૦૮માં પ્રકાશિત કરાયો છે. એનાં પૃ. ૧-૨૪૮નું સંપાદન શ્રી વિજયક્ષમાભદ્રસૂરિએ અને બાકીનાનું એમના સ્વર્ગવાસ બાદ મુનિશ્રી વિક્રમવિજયજીએ કર્યું છે. આ મધ્યમવૃત્તિ અને અવચૂરિ ભા.-૨નું આ રાજશેખરસૂરિજીએ સંપાદન કર્યું છે. બીજો ભાગનું પુનઃ પ્રકાશન આ રાજશેખરસૂરિજી અને મુનિ રત્નજ્યોતિ વિ. દ્વારા સંશોધિત થઈ રંજન વિ. લાયબ્રેરી માલવાડાથી થયું છે.]

૨. સિ. હે. (અ. ૧-૭) એને અંગેની બૃહદ્વૃત્તિ તેમજ દેવેન્દ્રસૂરિના શિષ્ય કનકપ્રભકૃત બૃહન્યાસદુર્ગપદવ્યાખ્યા યાને ન્યાસસારસમુદ્ધાર (કે જે “લઘુન્યાસ” તરીકે સુપ્રસિદ્ધ છે તે) સહિત “શેઠ મનસુખભાઈ ભગુભાઈ” તરફથી વિ. સં. ૧૯૬૨માં પત્રાકારે પ્રસિદ્ધ કરાયેલ છે. પં. ચન્દ્રસાગરગણિ (હવે સૂરિ) દ્વારા ‘કારક’ પર્યંતની આનંદબોધિની નામની ટીકા સહિત આ બૃહદ્વૃત્તિ વિ. સં. ૨૦૦૨માં છપાઈ છે. એ સૂરિએ કેવળ બૃહદ્વૃત્તિ સહિત દસ પાદ સુધીનો ભાગ સંપાદિત કર્યો છે અને એ વિ. સં. ૨૦૦૭માં છપાયો છે એમાં અંતમાં અમરચન્દ્ર સૂરિકૃત સ્યાદિશબ્દસમુચ્ચય અને જ્યાનંદસૂરિકૃત સ્યાદિશબ્દદીપિકા અપાયેલ છે. ‘વ્યાકરણવિશારદ’ શ્રી વિજયલાવણ્યસૂરિજી દ્વારા સિ. હે. (અ. ૧) એને અંગેની બૃહદ્વૃત્તિ, કનકપ્રભકૃત લઘુન્યાસ તેમજ હેમબૃહન્યાસ, લિંગાનુશાસન અને એના સ્વોપજ વિવરણ તેમજ દ્વ્યાશ્રયકાવ્ય (સ. ૧) સહિત સંપાદિત થઈ એ અમદાવાદની “જૈનગ્રંથ પ્રકાશક સભા” તરફથી હાલમાં (વિ. સં. ૨૦૦૭)માં બહાર પડેલ છે. એનું નામ “શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનમ્” રખાયું છે.

૩. જિ. ર. કો. (ખંડ ૧, પૃ. ૩૭૫)માં આને બદલે પ્રકાશિકા, બલાબલવૃત્તિ અને ઢુંઢિકા એવાં નામો અપાયાં છે.

બૃહદ્વૃત્તિનું આઘ પદ્ય તેમજ એમાં અપાયેલાં 'ઉદાહરણો અને પ્રત્યુદાહરણો પૈકી કેટલાંક લઘુવૃત્તિમાં પણ જોવાય છે. આથી કેટલાક એમ માને છે કે બૃહદ્વૃત્તિ રચાયા બાદ સંક્ષિપ્ત રુચિવાળી વ્યક્તિઓને ઉદ્દેશીને લઘુવૃત્તિ રચાઈ છે.

બૃહદ્વૃત્તિના પ્રારંભમાં 'અર્હમ્'ના સ્પષ્ટીકરણમાં "સિદ્ધયક"નો ઉલ્લેખ છે. આ બૃહદ્વૃત્તિનાં રચનામાં અમોઘવૃત્તિની કેટલીક વાર પંક્તિઓ મૂળ સ્વરૂપે અને કેટલીક વાર અર્થની સ્પષ્ટતા ખાતર પરિવર્તનપૂર્વક કામમાં લેવાઈ છે.

૫૭ ન્યાયો—સાતમાં અધ્યાયની બૃહદ્વૃત્તિના અંતમાં ૫૭ ન્યાયો અપાયેલા છે. એના ઉપર 'કલિ.' હેમચન્દ્રસૂરિની કોઈ ટીકા ત્યાં જણાતી નથી તો આ ન્યાયો બૃહદ્વૃત્તિનો એક ભાગ છે કે નહીં ? હેમહંસગણિએ આ તેમજ બીજા ૮૪ ન્યાયોનો સંગ્રહ કરી એના ઉપર ન્યાયાર્થ મંજૂષા નામની વૃત્તિ વિ. સં. ૧૫૧૬માં રચી છે. એમાં એમણે કહ્યું છે કે ઉપર્યુક્ત ૫૭ ન્યાયો ઉપર પ્રકાશ પાડનારી P. ૭૪ વૃત્તિ હતી. વિશેષમાં એમણે એવો ઉલ્લેખ કર્યો છે કે આ ૫૭ ન્યાયો બૃહદ્વૃત્તિના સાતમા અધ્યાયના અંતમાં સમુચ્ચયરૂપે જોવાય છે. આ ન્યાયો તેમજ બીજા પણ કેટલાક બૃહદ્વૃત્તિમાં પ્રસંગોપાત્ત કટકે કટકે અપાયા છે.

હૈમન્યાય અને એની વૃત્તિ—હૈમ ન્યાયની બે અજ્ઞાતકર્તૃક નાનકડી કૃતિ અને એ બેમાંથી એકની કે એ નામની અન્ય કોઈ કૃતિની ૧૭૫ શ્લોક જેવડી વૃત્તિની નોંધ જૈ. ગ્ર. (પૃ. ૩૦૨)માં છે.

હૈમ-લઘુ-ન્યાય-પ્રશસ્તિ-અવચૂરિ—આના કર્તા ઉદયચંદ્ર છે અને એની ૩૭ પત્રની એક હાથપોથી મળે છે એમ જૈ. ગ્ર. (પૃ. ૩૦૨) જોતાં જણાય છે.

'ગણપાઠ'—હૈમ વ્યાકરણનું આ એક મહત્ત્વનું અંગ છે. જે શબ્દોને વ્યાકરણનો નિયમ એકસરખો લાગુ પડતો હોય તે તમામ શબ્દોને પૃથક્ પૃથક્ ન ગણાવતાં એક શબ્દ આપી બાકીનાનું 'આદિ' શબ્દ વડે સૂચન કરાય છે કે જેથી સૂત્રમાં લાઘવ રહે. આ પ્રમાણે શબ્દોનાં જુદાં જુદાં જૂથ પડે છે. એ પ્રત્યેક જૂથને 'ગણ' કહે છે. આ જાતના ગણોની સળંગ સૂચી તે 'ગણપાઠ' કહેવાય છે. આ ગણપાઠ 'કલિ.' હેમચન્દ્રસૂરિએ સ્વોપજ બૃહદ્વૃત્તિમાં તે તે સૂત્રના સ્પષ્ટીકરણના પ્રસંગે આપ્યો છે અને એના ઉપર આ બૃહદ્વૃત્તિમાં અને કોઈ કોઈ વાર બૃહદ્વૃત્તિમાં પ્રકાશ પાડ્યો છે.

ન્યાસો—બૃહદ્વૃત્તિને અંગે ન્યાસો રચાયા છે. એ સંબંધમાં પૃ. ૭૭-૭૮માં વિચાર કરાયો છે.

૧. સામાન્ય રીતે એમ મનાય છે કે હૈમ કૃતિકલાપમાં આચાર્ય હરિભદ્રનો નામોલ્લેખ જણાતો નથી, પરંતુ સિ. હે. (૨-૨-૮૭)ની આ બૃહદ્વૃત્તિ (ઋ. છ. સં., પૃ. ૮૮)માંના "સાધ્વી ચલ્વનેકાન્તજયપતાકાયાઃ કૃતિરાચાર્ય-હરિભદ્રસ્યાચાર્યહરિભદ્રેણ વા" ઉદાહરણમાં તો હરિભદ્રનું નામ છે જ. વળી હૈમ બૃહદ્વૃત્તિ (પૃ. ૧)માં પણ એ સૂરિનો 'આચાર્ય હરિભદ્રવત્' દ્વારા ઉલ્લેખ છે.

૨. આ ગિરિજાશંકર મયાશંકર શાસ્ત્રીએ યોજેલી અને ઈ.સ. ૧૯૩૧માં પ્રકાશિત હૈમ-બૃહત્-પ્રક્રિયામાં પરિશિષ્ટરૂપે અપાયો છે; બાકી આ ગણપાઠ એના સ્વોપજ સ્પષ્ટીકરણપૂર્વક પૃથક્ સ્વરૂપમાં કોઈ સ્થળેથી પ્રસિદ્ધ થયો હોય એમ જણાતું નથી. આ બૃહત્-પ્રક્રિયામાં પ્રક્રિયાક્રમે ગોઠવાયેલાં સૂત્રોની સ્વોપજ (હૈમ) બૃહદ્વૃત્તિના ઉપયુક્ત અંશ દ્વારા સમજણ અપાઈ છે.

‘બૃહદ્વૃત્તિ-અવયૂર્ણિકા’—જ્યાનંદના શિષ્ય અમરચન્દ્રે વિ. સં. ૧૨૬૪માં અવયૂર્ણિકા રચી છે. P. ૭૫ કેટલાકને મતે તો આ સિ. હે.ની બૃહદ્વયૂરિ છે, પરંતુ મુદ્રિત કૃતિ તપાસતાં તો વસ્તુસ્થિતિ ભિન્ન માલમ પડે છે. આ મુદ્રિત અવયૂર્ણિકામાં ૧૦૭ સૂત્રો જતાં કરાયાં છે એટલે કે એ ૭૫૭ સૂત્રોની બૃહદ્વૃત્તિ પૂરતી અવયૂર્ણિકા છે. એમાં અને કનકપ્રભકૃત લઘુન્યાસમાં પ્રાયઃ સામ્ય જોવાય છે. કેટલીક વાર અમરચન્દ્રે નવીન બાબતો પણ રજૂ કરી છે. એથી એનો ઉપયોગ આનંદબોધિનીમાં કરાયો છે.^૧

આ અવયૂર્ણિકા (પૃ. ૩) માં સિ. હે. બીજાં બધાં વ્યાકરણોથી શા માટે ચડિયાતું છે તેની ચર્ચા કરતાં એવો ઉલ્લેખ કરાયો છે કે એ ‘અતિવિસ્તીર્ણ’ કે ‘વિપ્રકીર્ણ’ નથી તેમજ એ કાતંત્રની જેમ સંકીર્ણ નથી. આ અવયૂર્ણિકા (પૃ. ૪-૫)માં કહ્યું છે કે પ્રથમના સાત અધ્યાય ચતુષ્ક, આખ્યાત, કૃત્ અને તદ્વિત એ ચાર પ્રકરણોમાં વિભક્ત છે. તેમાં સંધિ, નામ, કારક અને સમાસ એ ચારના સમુદાય રૂપ ‘ચતુષ્ક’ છે. એમાં દસ પાદ છે. ‘આખ્યાત’માં છ પાદ છે. ‘કૃત્’માં ચાર પાદ છે. ‘તદ્વિત’માં આઠ પાદ છે. આમ જે અહીં ચાર પ્રકરણ ગણાવાયાં છે તેને ‘પ્રકરણ’ ન કહેતાં કેટલાક ‘વૃત્તિ’ કહે છે.

બૃહદ્વૃત્તિ-સારોદ્ધાર-જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૭૬)માં આની નોંધ છે. કર્તાનું નામ અપાયું P. ૭૬ નથી. આની બે હાથપોથી વિ. સં. ૧૫૨૧માં લખાઈ છે અને એ મળે છે.

બૃહદ્વૃત્તિ-દુંઢિકા—સૌભાગ્યસાગરે વિ. સં. ૧૫૮૧માં આ દુંઢિકા રચી છે.

બૃહદ્વૃત્તિ-દીપિકા—વિજયચન્દ્રસૂરિ અને હરિભદ્રસૂરિના શિષ્ય માનભદ્રના શિષ્ય વિદ્યાકરે આ દીપિકા રચી છે.

કક્ષાપટવૃત્તિ-સ્વોપજ બૃહદ્વૃત્તિ ઉપરની આ ટીકા છે. એનું પરિમાણ ૪૮૧૮ શ્લોક જેવડું છે. જૈ. ગ્રં. (પૃ. ૨૮૮)માં આ ટીકાનો કક્ષાપટ તેમજ “બૃહદ્વૃત્તિ-વિષમ-પદ-વ્યાખ્યા” તરીકે ઉલ્લેખ છે.

બૃહદ્વૃત્તિ-ટિપ્પન-વિ. સં. ૧૬૪૬માં કોઈકે આ ટિપ્પન રચ્યું છે.

બલાબલવૃત્તિ-જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૭૭) પ્રમાણે આ બૃહદ્વૃત્તિના સંક્ષેપરૂપ છે.

હૈમોદાહરણવૃત્તિ-આ નાનકડી અજ્ઞાતકર્તૃક કૃતિની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૦૧)માં છે. આનું નામ વિચારતાં એમ લાગે છે કે આ કૃતિ હૈમ બૃહદ્વૃત્તિમાંનાં ઉદાહરણોના સ્પષ્ટીકરણરૂપ હશે.

પરિભાષા-વૃત્તિ-આ ૪૦૦૦ શ્લોક જેવડી છે એમ બૃ. ટિ.માં ઉલ્લેખ છે.

૧. સિ. હે.ના પ્રથમ નવ પાદ પૂરતી આ અવયૂર્ણિકા “દે. લા. જૈ. પુ. સં.” તરફથી ઈ. સ. ૧૯૪૮માં પ્રકાશિત કરાઈ છે. પ્રથમ પરિશિષ્ટ તરીકે સિ. હે.ના પહેલા સાત અધ્યાયનાં સૂત્રો અને દ્વિતીય પરિશિષ્ટ તરીકે ૧૦૦૬ ઉણાદિસૂત્રો અપાયાં છે. આ અવયૂર્ણિકાની હાથપોથીમાં ‘પ્રથમ પુસ્તિકા લખી’ એવો ઉલ્લેખ છે તો શું બાકીનો ભાગ રચાયો હશે કે કેમ ? તે જાણવું બાકી રહે છે.

૨. જુઓ ઉપર્યુક્ત પ્રકાશનની પ્રસ્તાવના (પૃ. ૭)

૩. પાણિનીય અષ્ટા.ના ૧-૩-૨, ૧-૩-૩, ૧-૧-૬૦ અને ૧-૩-૮ એ ચાર સૂત્રોની ગરજ સિ. હે.નું ૧-૧-૩૦ સૂત્ર સારે છે.

૪. પાણિનીય અષ્ટા.માં નામ-પ્રકરણને અનુસરતાં સૂત્રો છૂટાછવાયાં અપાયાં છે. આવી હકીકત બીજાં પણ કેટલાંક પ્રકરણો અંગે જોવાય છે.

સિદ્ધહેમસરસ્વતી— આ. પુરન્ધરસૂરિની આ પદ્યટીકા જૈન સાહિત્ય વ. સભાએ સં. ૨૦૨૮માં પ્રગટ કરી છે.

P. ૭૭ 'બૃહત્ન્યાસ' શબ્દમહાર્ણવ યાને તત્ત્વપ્રકાશિકાપ્રકાશ—'ન્યાસ'નો અર્થ 'ધાપણ' થાય છે. એના બીજા પણ અનેક અર્થો છે, પરંતુ વ્યાકરણના ક્ષેત્રમાં એનો અર્થ વ્યાકરણના સૂત્રપાઠ જેવા અંગની વૃત્તિનું વિવરણ એમ થતો હોય એમ કેટલાક ન્યાસો જોતાં જણાય છે. ગમે તેમ પણ આવો પ્રયત્ન 'કલિ.' હેમચન્દ્રસૂરિએ કર્યો છે. આ સૂરિએ સ્વોપજ્ઞ બૃહદ્વૃત્તિને અંગે ન્યાસ રચ્યો છે. આ ન્યાસ અ. ૧-૭ પૂરતી સ્વોપજ્ઞ બૃહદ્વૃત્તિને તો સર્વાંગે સ્પર્શે છે. વ્યાકરણને લગતા તમામ વિષયોને અહીં ચર્ચવામાં આવ્યા છે. પરંતુ કમનસીબે આ મહામૂલ્યશાળી ગ્રંથ સંપૂર્ણપણે સચવાઈ રહ્યો નથી. એનું પરિમાણ ૮૪૦૦૦ શ્લોક જેવું હોવાનું કહેવાય છે. તેમાંથી લગભગ ચોથા ભાગ જેટલો અંશ આજે મળે છે. પ્રથમ અધ્યાયના પ્રથમ પાદમાં ૪૨ સૂત્રો છે, પરંતુ આ બૃહત્ન્યાસ તો પહેલાં ૩૮ સૂત્ર સુધીનો જ મળે છે—બાકીનાં ચારને અંગેનો મળતો નથી. આ અધ્યાયના બીજા પાદને અંગે સમૂળગો મળતો નથી. બાકીના બે પાદોને અંગે સંપૂર્ણપણે મળે છે. બીજા અધ્યાયના ચારે પાદો ઉપર પરિપૂર્ણ સ્વરૂપમાં મળે છે. આગળ જતાં ત્રીજા અધ્યાયના ચોથા પાદને અંગે અને પછી તો છેક સાતમા અધ્યાયના ત્રીજા પાદને અંગે આ ન્યાસ મળે છે.^૧ આમ અધ્યાય ૪-૬ તો સર્વથા ન્યાસ વિનાના છે. બૃહદ્વૃત્તિ આઠમા અધ્યાયને સ્પર્શતી રચાઈ હોય એમ જણાતું નથી એટલે એના વિવરણરૂપ બૃહત્ન્યાસ આઠમા અધ્યાયને અંગે રચાયો જ ન હોય તો એ સ્વાભાવિક છે.

P. ૭૮ લઘુ ન્યાસ —'કલિ.' હેમચન્દ્રસૂરિના બહુશ્રુત શિષ્ય "કવિકટારમલ્લ," સ્વાતન્ત્ર્યપ્રિય અને "સો પ્રબંધના કર્તા રામચન્દ્રસૂરિએ ત્રેપન હજાર (૫૩૦૦૦) શ્લોક જેવડો આ ન્યાસ રચ્યો છે. વળી ધર્મધોષસૂરિએ નવ હજાર શ્લોક પૂરતો લઘુન્યાસ રચ્યો છે. કેટલાકને મતે 'કલિ.' હેમચન્દ્રસૂરિએ જાતે લઘુ ન્યાસ રચ્યો છે.

બૃહત્ન્યાસદુર્ગપદવ્યાખ્યા યાને ન્યાસસાર-સમુદ્ધાર કિંવા ન્યાસોદ્ધાર—'ચંદ્ર' ગચ્છના દેવેન્દ્રસૂરિના શિષ્ય કનકપ્રભે જે ન્યાસ રચ્યો છે એ હેમચન્દ્રસૂરિકૃત બૃહત્ન્યાસના સંક્ષેપરૂપ છે. એથી એનું 'લઘુ ન્યાસ' એવું નામ યોજાયું છે. કનકપ્રભે પોતે તો પ્રારંભમાં એને બૃહત્ન્યાસદુર્ગપદ-વ્યાખ્યા તરીકે અને અંતમાં પ્રશસ્તિમાં ન્યાસસાર-સમુદ્ધાર તરીકે ઓળખાવ્યો છે.

૧. સિ. હે.ના પહેલાં ૩૮ સૂત્રો પૂરતો બૃહત્ન્યાસ એ સૂત્રો અને એની બૃહદ્વૃત્તિ સહિત "હે. સ." તરફથી ઈ. સ. ૧૯૨૧માં છપાવાયો ત્યાર બાદ શ્રીવિજયલાલવણ્યસૂરિએ અ.૧, પા. ૧નાં છેલ્લાં ચાર સૂત્રો તેમજ બીજા પાદનાં તમામ સૂત્રો ઉપર ન્યાસ રચ્યો છે. એ સિ. હે. (અ. ૧) જે બૃહદ્વૃત્તિ વગેરે સહિત "જૈન ગ્રંથ પ્રકાશક સભા" તરફથી છપાયેલ છે તેમાં અપાયો છે.

૨. જિ. ર. કો. (ખં. ૧, પૃ. ૩૬૫)માં આનો મહાર્ણવ તરીકે પણ ઉલ્લેખ છે.

૩. બૃ. ટિ.ના સમયમાં પણ આટલો જ ન્યાસ મળતો હતો.

૪. વિ. સં. ૧૫૧૭માં ભોજપ્રબન્ધ રચનારા રત્નમંદિરગણિએ ઉપદેશતરંગિણીના પ્રથમ તરંગ (પત્ર ૧૩)માં સિદ્ધરાજ જયસિંહે રામચન્દ્રસૂરિની શીઘ્ર કાવ્ય-શક્તિથી પ્રસન્ન થઈ બિરુદ એમને આપ્યાનો ઉલ્લેખ છે.

૫. જુઓ નાટ્યદર્પણને લગતું મારું લખાણ પૃ. ૧૮૧.

૬. આ લઘુન્યાસ બૃહદ્વૃત્તિ અને સિ. હે. (અ. ૧-૭) સહિત શેઠ મનસુખભાઈ ભગુભાઈ તરફથી વિ. સં. ૧૯૬૨માં છપાવાયો છે. [આનું પુનઃ સંપાદન પં. વજ્રસેન વિ., મુનિરત્નસેન વિ. એ કર્યું છે. પુસ્તકાકારે ત્રણભાગમાં ભેરુમલ કનૈયાલાલ ટ્રસ્ટ મુંબઈથી પ્રસિદ્ધ છે.]

ન્યાસસારોદ્ધારટિપ્પણ—આ અજ્ઞાતકર્તૃક કૃતિની વિ. સં. ૧૨૭૮માં લખાયેલી હાથપોથી મળે છે.

પ્રાકૃતરૂપસિદ્ધિ—આને અંગે બૃ. ટિ.માં એવો ઉલ્લેખ છે કે એ હૈમપ્રાકૃતબૃહદ્વૃત્તિની અવચૂરિરૂપ છે. એના કર્તા ‘મલધારી’ પં. નરચંદ્ર છે અને એ અવચૂરિ ૧૬૦૦ શ્લોક જેવડી છે.

પ્રાકૃતવૃત્તિદુંઢિકા, પ્રાકૃત દીપિકા કિંવા પ્રાકૃતપ્રબોધ—આ ‘મલધારી’ ગચ્છના ઉપાઠ નરચંદ્રની આઠમા અધ્યાયની અવચૂરિ છે. ન્યાયકંઠલીની ટીકામાં રાજશેખરે એનો ઉલ્લેખ કર્યો છે એમ જિ. ર. કો. (ખંડ ૧, પૃ. ૩૭૭)માં નોંધ છે.

આ બંને ઉલ્લેખોનો વિચાર કરતાં આ કૃતિઓ અભિન્ન જણાય છે.

P. ૭૮

હૈમદુંઢિકા—આ નામની બે કૃતિ છે. એક કૃતિ ૮૦૦૦ શ્લોક જેવડી છે અને કેટલાકને મતે એ ૫૦૦૦ શ્લોક જેવડી છે. એ કૃતિ સૌભાગ્યસાગરે વિ. સં. ૧૫૮૧માં રચી છે. એ ચતુષ્ક, આખ્યાત, કૃત્ અને તદ્વિત એ ચારને અંગેની છે.

બીજી કૃતિ ૨૩૦૦ શ્લોક જેવડી છે. એને જ કેટલાક હૈમદુંઢિકાવૃત્તિ કહે છે. એના કર્તા તરીકે ઉદયસૌભાગ્યનો ઉલ્લેખ જોવાય છે.

પ્રાકૃતવૃત્તિદુંઢિકા યાને વ્યુત્પત્તિ-દીપિકા—આ ‘બૃહત્ તપા’ ગચ્છના સૌભાગ્યસાગરસૂરિના શિષ્ય હૃદયસૌભાગ્યની વિ. સં. ૧૫૮૧ની રચના છે. જૈ. ગ્રં. (પૃ. ૩૦૧)માં હૈમચતુર્થપાદવૃત્તિ તરીકે હૃદયસૌભાગ્યની જે કૃતિની નોંધ છે તે આ જ હોય એમ લાગે છે.

પ્રાકૃતપદાવચૂરિ—આ ૭૩૮ શ્લોક જેવડી અવચૂરિ હરિપ્રભસૂરિએ રચી છે.

પ્રાકૃતવૃત્તિદીપિકા યાને હૈમદીપિકા—આ ૧૫૦૦ શ્લોક જેવડી કૃતિ દ્વિતીય હરિભદ્રે રચી છે. જૈ. ગ્રં. (પૃ. ૩૦૦)માં નોંધાયેલી હૈમદીપિકા તે આજ છે.

દોષકવૃત્તિ—આ આઠમાં અધ્યાયની વૃત્તિ છે.^૧

હૈમદોષકાર્થ—આની ૧૩ પત્રની હાથપોથીની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૦૧)માં છે.

દીપિકા—જિનસાગરની આ ૬૭૫૦ શ્લોક જેવડી કૃતિની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૦૧)માં છે. અહીં એક અજ્ઞાતકર્તૃક દીપિકાનો પણ ઉલ્લેખ છે.

અષ્ટાધ્યાયતૃતીયપદવૃત્તિ—આ વિનયસાગરસૂરિની રચના છે.

P. ૮૦

હૈમદશપાદવિશેષ અને હૈમદશપાદવિશેષાર્થ—આ બે કૃતિની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૨૮૮)માં છે.

પ્રક્રિયા-ગ્રન્થો

પ્રક્રિયા-પ્રક્રિયારૂપ કૃતિ એ સાધનિકાને લક્ષીને મૂળ સૂત્રોના ક્રમમાં પરિવર્તન કરી એનું વિવરણ પૂરું પાડે છે. એ પ્રયોગો તૈયાર કરવામાં-સિદ્ધ કરવામાં સહાયક બને છે એ લાભ છે; પરંતુ સૂત્રોનો ક્રમ, એનું બલાબલ, ઉત્સર્ગ, અપવાદ, પ્રત્યયવાદ, સૂત્રો રચવાનાં પ્રયોજનો, એ રચનાને લગતા સૂક્ષ્મ ૧. આ વૃત્તિ પાટણની “હૈ. સ.” તરફથી છપાવાયેલી છે. [દોષકવ્યાખ્યાલેશ : કર્તા સુમતિરત્ન, અપ્રગટ છે.]

નિયમો વગેરે બાબતનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી બુદ્ધિનો જે વિકાસ થાય તે લાભ આ પ્રક્રિયાથી ન થઈ શકે. એ માટે તો મૂળ પ્રણેતાએ જે ક્રમે સૂત્રો રચ્યાં હોય તે જ ક્રમે એનો અભ્યાસ થવો ઘટે.

‘હૈમ-(લઘુ)-પ્રક્રિયા (વિ. સં. ૧૭૧૦)-આના કર્તા વિનયવિજયગણિ છે. એઓ સોમવિજય પાસે ભણ્યા હતા. એ સોમવિજય તે એમના દીક્ષા-ગુરુ ઉપા. કીર્તિવિજયના સંસારી અવસ્થાના સગા ભાઈ થતા હતા અને દીક્ષિત અવસ્થામાં ગુરુભાઈ થતા હતા એ વિનય-વિજયગણિનાં પિતાનું નામ તેજપાલ P. ૮૧ હતું અને એમની માતાનું નામ રાજશ્રી હતું.^૧ એઓ ‘વણિક’ જ્ઞાતિના હશે.^૨ એઓ વિ. સં. ૧૭૩૮માં રાંદેરમાં કાળધર્મ પામ્યા હતા. એમણે વિ. સં. ૧૬૯૬માં **પજ્જોસવણાકપ્પ ઉપર ‘સુબોધિકા** નામની ટીકા સંસ્કૃતમાં રચી છે. એ વેળા એમની ઉમ્મર પાંત્રીસેક વર્ષની હશે.^૩ એ હિસાબે એમનો જન્મ વિ. સં. ૧૬૬૧માં થયેલો ગણાય. એમણે સંસ્કૃતમાં તેમજ ગુજરાતીમાં કૃતિઓ રચી છે. એ પૈકી સંસ્કૃત કૃતિઓ નીચે મુજબ છે :-

અર્હતમસ્કારસ્તોત્ર, ‘આનંદલેખ, ‘ઈન્દુદૂત, ‘જિનસહસ્રનામસ્તોત્ર, ‘નયકર્ણિકા, ‘લોકપ્રકાશ, ‘શાન્તસુધારસ, ષટ્ત્રિંશજજલ્પસંગ્રહ અને સુબોધિકા તેમજ આ હૈમલઘુપ્રક્રિયા અને એની સ્વોપજ ટીકા.

૧. શ્રીવિજયદર્શનસૂરિજીના શિષ્ય મુનિશ્રી પ્રિયંકરવિજયજીના ટિપ્પણપૂર્વક આ પ્રક્રિયા વિ. સં. ૨૦૦૬માં પ્રસિદ્ધ કરાઈ છે. એ આવૃત્તિને “શ્રીનેમિ-દર્શન-પ્રિયંકર-ગ્રંથ-રત્ન-૨” તરીકે ઓળખાવાઈ છે. આમાં ‘સંજ્ઞાધિકાર’ પછી પરિભાષા-પ્રકરણ સંપાદકે ઉમેર્યું છે અને પૃ. ૮માં એની નોંધ લેતાં એ બહુ ઉપયોગી હોવાથી તેમ કર્યાનો ઉલ્લેખ કર્યો છે.

૨. જુઓ લોકપ્રકાશ (સ. ૧)નું અંતિમ પદ્ય.

૩. જુઓ શાન્તસુધારસ (ભા. ૨)નું શ્રી મોતીચંદ ગિ. કાપડિયાનું વિવેચન (પૃ. ૩૮)

૪. આની દ્વિતીય આવૃત્તિ “દે. લા. જૈ. પુ. સં.” તરફથી **પેજ્જોસવણાકપ્પ** સહિત ઈ.સ. ૧૯૨૩માં છપાવાઈ છે.

૫. જુઓ શાન્તસુધારસ (ભા. ૨)નું ઉપર્યુક્ત વિવેચન (પૃ. ૪૮)

૬. આ કૃતિ “દેશવિરતિ ધર્મરાધક સમાજ” તરફથી વિ. સં. ૧૯૮૩માં પ્રકાશિત શ્રીપ્રશસ્તિસંગ્રહમાં પૃ. ૯૬-૧૧૯માં છપાવાઈ છે. એમાં વિવિધ બંધોથી વિભૂષિત પદ્યો છે. એ મારો જે લેખ નામે “Illustrations of Letter-diagrams” મુંબઈ વિદ્યાપીઠના સામયિકમાં કટકે કટકે છપાય છે તેમાં (Arts No. 30, pp. 127-128)માં અપાયાં છે.

૭. આ કાવ્ય “કાવ્યમાલા” (ગુ. ૧૪)માં છપાયું છે.

૮. આ સ્તોત્ર “વીરસમાજ” તરફથી અમદાવાદથી વિ. સં. ૧૯૮૧માં છપાવાયું છે.

૯. આ કૃતિ ગુજરાતી અનુવાદ સહિત શ્રી. મોહનલાલ દ. દેશાઈ દ્વારા ઈ.સ. ૧૯૧૦માં છપાવાઈ છે.

૧૦. આ ગ્રંથ “દે. લા. જૈ. પુ. સં.” તરફથી ચાર ભાગમાં અનુક્રમે ઈ.સ. ૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૭માં પ્રકાશિત કરાયો છે. [પં. વજ્રસેનવિજયજીએ સંપાદિત કરેલ લો. પ્ર.ની ભદ્રંકર પ્રકાશન અમદાવાદથી બે આવૃત્તિ પ્રગટ થઈ છે.]

૧૧. આ કૃતિ ગંભીરવિજયગણિકૃત ટીકા સહિત “જૈન ધર્મ પ્રસારક સભા” તરફથી વિ. સં. ૧૯૬૮માં પ્રસિદ્ધ કરાઈ છે. [મોતીલાલ ગી. કાપડિયાના વિવેચન સાથે શા. સુ. મહાવીર વિદ્યાલય દ્વારા પ્રસિદ્ધ છે. મુનિશ્રી ધુરંધર વિ.ના સમ શ્લોકી અનુવાદ સાથે પણ ઝૂંકારસાહિત્યનિધિ દ્વારા પ્રસિદ્ધ થયેલ છે.]

એમણે વિ. સં. ૧૭૧૦માં આ હૈમલઘુપ્રક્રિયા રચી છે. મુદ્રિત આવૃત્તિ પ્રમાણે એ ત્રણ વૃત્તિમાં વિભક્ત P. ૮૨ છે.^૧ ૨૧૬માં પૃષ્ઠ ઉપર પ્રથમ વૃત્તિ પૂરી થાય છે ત્યાં પૂર્વાર્ધ પૂર્ણ થયાનો ઉલ્લેખ છે. ઉત્તરાર્ધનો પ્રારંભ ‘આખ્યાત’થી થાય છે. ત્રીજી વૃત્તિની શરૂઆત ‘કૃદંત’થી કરાઈ છે. મંગલાચરણરૂપે પણ પદો રચી સંજ્ઞા-પ્રકરણની સમજણ ૩૦ પદોમાં અપાઈ છે. ત્યાર બાદ ^૨૪ સંધિ, ^૩૬ લિંગ, યુષ્મદસ્મદ્, અવ્યય, સ્ત્રીલિંગ, કારક, સમાસ, તદ્વિત ઇત્યાદિ પ્રકરણો વિચારાયાં છે. અંતમાં પાંચ પદોની પ્રશસ્તિ છે.

હૈમપ્રકાશ યાને હૈમપ્રક્રિયા-બૃહત્યાસ (વિ. સં. ૧૭૩૭) આ ઉપર્યુક્ત હૈમલઘુ-પ્રાક્રિયાને અંગેની બૃહદ્-વૃત્તિ છે. એને કેટલાક ‘ન્યાસ’ કહે છે. એનું પરિમાણ ૩૪૦૦૦ શ્લોક જેવડું છે. એના કર્તા વિનયવિજયગણિ છે. આમ આ સ્વોપજ રચના છે. આનું રચના-વર્ષ વિ. સં. ૧૭૮૭ છે એમ જિ. ૨. કો. (ખં. ૧, પૃ. ૪૬૨)માં ઉલ્લેખ છે, પણ એ ભ્રાંત છે. સિ. હે. (૧-૨-૧) ઉપરના અર્થાત્ “સમાનાનાં તેન દોષઃ” ઉપરના હૈમપ્રકાશ (પૃ. ૬૨)માં કનકપ્રભકૃત લઘુન્યાસથી ભિન્ન મત દર્શાવાયો છે. આની આલોચના શ્રીવિજયલાવણ્યસૂરિજીએ સિ. હે. (અ. ૧)ની એમની આવૃત્તિ (પૃ. ૮૮)માં કરી છે. આ હૈમપ્રકાશમાં હૈમ બૃહત્યાસ, પ્રૌઢ-મનોરમા, સિદ્ધાન્તકૌમુદી, વાક્યપ્રકાશ અને વાક્યપદીય P. ૮૩ તેમજ વૈયાકરણભૂષણસાર જેવી લગભગ સમકાલીન કૃતિનો ઉપયોગ કરાયો છે.

હૈમ-પ્રક્રિયાઓ-પાણિનીય અષ્ટાને અંગે પ્રક્રિયાની દૃષ્ટિએ જેમ ભટ્ટોજિ દીક્ષિતે સિદ્ધાન્તકૌમુદી રચી છે તેમ વિવિધ ગ્રંથોના પ્રણેતા ઉપા. મેઘવિજયગણિએ સિ. હે.ને અંગે લઘુ, મધ્યમ અને બૃહત્ એમ ત્રણ ત્રણ પ્રક્રિયાઓ રચી છે એમ કહેવાય છે.

ચન્દ્રપ્રભા યાને હૈમકૌમુદી (વિ. સં. ૧૭૫૭)-આ મેઘવિજયગણિએ સિદ્ધાન્તકૌમુદીના અનુકરણરૂપે સિ. હે. (અ. ૧-૭)ને અંગે રચેલી પ્રક્રિયા છે.^૨ પ્રારંભમાં બે પદો છે. ત્યાર બાદ પરિભાષા, અસંધિ, વ્યંજન-સંધિ ઇત્યાદિ વિષયો આલેખતી વેળા શરૂઆતમાં ઋષભદ્રે, અજિતનાથ એમ એકેક તીર્થંકરની સ્તુતિરૂપ પદ છે. મુદ્રિત પુસ્તક પ્રથમાવૃત્તિ અને દ્વિતીયાવૃત્તિ એ બે ભાગમાં વિભક્ત કરાયું છે. પ્રથમાવૃત્તિના અંતમાં ૧૬ પદની પ્રશસ્તિ છે^૩ અને એમાં વિ. સં. ૧૭૫૭માં

૧. જુઓ પૃ. ૨૧૬, ૩૬૬ અને ૪૧૪.

૨. સ્વર-સંધિ, અ-સંધિ, વ્યંજન-સંધિ અને રેફ-સંધિ. કેટલીક વાર કોઈ કોઈ પુસ્તકમાં આ ચાર સંધિમાં સ્વાદિ-સંધિ ઉમેરી પાંચ ગણાવાય છે.

૩. સ્વરાંત શબ્દોનાં તેમજ વ્યંજનાંત શબ્દોનાં ત્રણ ત્રણ લિંગ.

૪. ઉપા. ક્ષમાવિજયગણિ (વિજયક્ષમાભદ્રસૂરિ) દ્વારા સંપાદિત આ કૃતિનો પ્રથમ વૃત્તિ પૂરતો ભાગ ઈ. સ. ૧૮૩૭માં પ્રસિદ્ધ થયો છે. આખ્યાત અને કૃદંતને અનુક્રમે ચર્ચતી બીજી બે વૃત્તિ પૂરતો ભાગ ટૂંક સમયમાં પ્રસિદ્ધ થનાર છે. પ્રથમ ભાગમાં એ ભાગ પૂરતાં સિ. હે.ના સૂત્રોની, ન્યાયોની અને ગણોની અકારાદિ ક્રમે સૂચી અપાઈ છે.

૫. આ કૃતિ “જૈન શ્રેયસ્કર મંડલ” તરફથી ઈ. સ. ૧૮૨૮માં છપાઈ છે. અંતમાં હૈમ-ધાતુપાઠ, અનુબંધ-ફળ (શ્લો. ૧-૧૦) વૃતગણફલ (શ્લો. ૧-૬), અનિટ્કારિકા (શ્લો. ૧-૭), સંગ્રહ-શ્લોક (શ્લો. ૧-૧૮) તેમજ ચન્દ્રપ્રભાને અંગે કામમાં લેવાયેલાં સિ. હે.ના સૂત્રોની અકારાદિ ક્રમે સૂચી અપાયાં છે.

૬. ‘પરતર’ ગચ્છના કૃપાચન્દ્રસૂરિએ સિ. હે.ના આઠમા અધ્યાયગત પ્રાકૃત વ્યાકરણસિદ્ધાન્તકૌમુદીની શૈલીએ રચ્યું છે.

૭. જુઓ પૃ. ૨૫૭-૨૫૮.

‘ચન્દ્રપ્રભા’ રચાયાનો ઉલ્લેખ છે. દ્વિતીયા વૃત્તિના અંતમાં એક પદ્ય છે પણ એમાં રચના-વર્ણનો નિર્દેશ નથી. પુષ્પિકામાં આને બૃહત્-પ્રક્રિયા કહી છે. પૃ. ૧૫૮ના અંતમાં બે પદ્ય છે. તેમાં પ્રથમા P. ૮૪ વૃત્તિ પૂર્ણ કરાયાનો ઉલ્લેખ છે. પુષ્પિકામાં પણ તેમજ છે. એ હિસાબે તો ત્રણ વૃત્તિ ગણાય અને તદ્વિત-પ્રકરણથી બીજી વૃત્તિની શરૂઆત મનાય.

સિ. હે. (૧-૪-૮૨) રૂપ “ઠાઠૌ સ્વરે વા” ને લગતી પ્રક્રિયા (પૃ. ૪૦)માં કીઃ, કિરૌ ઇત્યાદિ રૂપો દર્શાવતી વેળા પાણિનીય અષ્ટા.નો, નહિ કે સિ. હે.નો, આધાર લેવાયો છે અને એ સ્ખલન ગણાય એમ કેટલાક કહે છે.

હેમપ્રક્રિયા-આની રચના મહેન્દ્રસુત વીરસેને કરી છે.^૧

હેમપ્રક્રિયાશબ્દસમુચ્ચય-આ ૧૫૦૦ શ્લોક જેવડી કૃતિની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૦૩)માં જોવાય છે. આના જ આધારે જિ. ર. કો. (ખંડ ૧, પૃ. ૪૬૨)માં આ કૃતિની નોંધ લેવાઈ છે.

શ્રીહેમશબ્દસંચય-અમરચન્દ્રકૃત અવયૂર્ણિની પ્રસ્તાવના (પૃ. ૭)માં આ નામનો ગ્રંથ જૈ. ગ્રં. (પૃ. ૩૦૩)ને આધારે નોંધતાં કહ્યું છે કે એની ૪૩૬ પત્રની એક હાથપોથી પાટણના ભંડારમાં છે અને એના કર્તા અમરચન્દ્ર છે. આ અમરચન્દ્ર તે ઉપર્યુક્ત અવયૂર્ણિકાર જ હશે.

જિ. ર. કો. (ખંડ ૧, પૃ. ૪૬૩)માં જૈ. ગ્રં. (પૃ. ૩૦૩)ના ઉલ્લેખપૂર્વક ૪૨૬ શ્લોક જેવડી હેમશબ્દસંચય નામની અને અમરચન્દ્રે રચેલી કૃતિની નોંધ છે.

P. ૮૫ હેમશબ્દસમુચ્ચય-આ નામની અને ૪૮૨ શ્લોક જેવડી કૃતિની નોંધ જિ. ર. કો. (ખંડ ૧, પૃ. ૪૬૩)માં છે અને એની એક હાથપોથી પાટણના ભંડારમાં હોવાનો અહીં ઉલ્લેખ છે.

આમ જે ત્રણ કૃતિની ભિન્ન ભિન્ન નોંધ છે તે શું ખરેખર પૃથક્ પૃથક્ કૃતિ છે ?

હેમકારકસમુચ્ચય-આ શ્રીપ્રભસૂરિની રચના છે. એ શીખાઉને માટે ઉપયોગી છે અને એ ત્રણ અધિકારમાં વિભક્ત છે એમ જૈ. ગ્રં. (પૃ. ૩૦૨)માં કહ્યું છે.

હેમવિભ્રમ (વિક્રમની બારમી સદી)- ‘કાતંત્રવિભ્રમ’ તરીકે ઓળખાવાતી એક કૃતિમાં ૨૧ કારિકા છે. એ વ્યાકરણને અંગેના કોયડાની ગરજ સારે છે, કેમકે અહીં અપાયેલાં કેટલાંક રૂપો સામાન્ય

૧. જિ. ર. કો. (ખંડ ૧, પ. ૧૨૦) પ્રમાણે આ ચન્દ્રપ્રભા ૬૮૦૦૦ શ્લોક જેવડી છે.

૨. સિ. હે. (અ. ૧-૭)ને અંગે લઘુ, મધ્યમ અને બૃહત્ એમ ત્રણ પ્રકારની હેમપ્રભા નામની પ્રક્રિયા ‘તીર્થોદ્ધારક’ વિજયનેમિસૂરિએ અને આ જાતની ત્રણ પ્રક્રિયા નામે સિદ્ધપ્રભા ‘આગમોદ્ધારક’ આનન્દસાગરસૂરિએ રચી છે અને એ બધી (છ યે) પ્રસિદ્ધ થયેલી છે. આ ઉપરાંત ન્યાયતીર્થ ન્યાયવિશારદ ઉપા. મંગળવિજયજીએ ધર્મદીપિકા નામની પ્રક્રિયા અ. ૧-૭ ને અંગે રચી છે અને એ પણ છપાયેલી છે. ગિરજાશંકર મયાશંકર શાસ્ત્રીએ હેમ-બૃહત્-પ્રક્રિયા રચી છે અને એ પણ પ્રસિદ્ધ થયેલી છે.

૩. આ કૃતિ ગુણચન્દ્રસૂરિકૃત તત્ત્વપ્રકાશિકા નામની વૃત્તિ સહિત “ય. જૈ. ગ્રં.”માં વીરસંવત્ ૨૪૩૮માં પ્રકાશિત કરાઈ છે. એમાંનું છઠ્ઠું પદ્ય અવયૂર્ણિ સહિત છપાયેલી કૃતિમાં નથી. વળી આ આવૃત્તિમાં ૧૮ અંકવાળાં બે પદ્યો છે. એ હિસાબે બાવીસ પદ્યો ગણાય.

૪. આના કર્તાનું નામ જણાવામાં નથી.

રીતે સુગમતયા એક જાતનાં જણાતાં હોય તે અન્ય પ્રકારનાં છે અને જે રૂપ ઉપલક્ષ્ય દૃષ્ટિએ અશુદ્ધ લાગે તે શુદ્ધ છે એવી મતલબના ઉલ્લેખ આ કારિકાઓમાં છે. દા. ત. શોભનેષુ એ ‘શોભન’નું સાતમીનું બહુવચનનું રૂપ છે, છતાં એની અહીં ના પડાઈ છે, કેમકે એ શોભન અને ઇષુથી બનેલો ‘બહુવ્રીહિ’ સમાસરૂપ હોઈએ નાન્યતર જાતિનું પ્રથમાનું એક વચનનું રૂપ ગણી શકાય તેમ છે. એવી રીતે રાજેભ્યઃ એ અશુદ્ધ રૂપ લાગે, પરંતુ રાજન્ અને ઇભ્યથી ઉદ્ભવેલા ‘તત્પુરુષ’ સમાસનો વિચાર કરતાં એ પ્રથમાના એકવચનના રૂપ તરીકે સિદ્ધ થઈ શકે તેમ છે.^૧ આવી વ્યાકરણવિષયક વિલક્ષણતાને લઈને આ નાનકડી P. ૮૬ કૃતિ મહત્વની ગણાય એ સ્વાભાવિક છે. કેટલાક કોયડા એક જ જાતના છે અને કોઈ કોઈ વાર એક જ કોયડો ફરીથી રજૂ કરાયો છે તો તેમ ન થયું હોત તો આ કૃતિના મહત્વમાં વૃદ્ધિ થાત. ગમે તેમ પણ અત્યારે જે સ્વરૂપે આ કૃતિ યોજાયેલી મળે છે તે જટિલ છે એટલે કોયડાના ઉકેલરૂપ વિવરણની આવશ્યકતા સહેજે રહે છે. આ કાર્ય કેટલાંકે કર્યું છે.

‘તત્ત્વપ્રકાશિકા’—આ ઉપર્યુક્ત કૃતિની ગુણચન્દ્રસૂરિએ રચેલી વૃત્તિ છે. આ વૃત્તિમાં આ સૂરિએ પોતાનો પરિચય દેવસૂરિના ચરણકમળને વિષે ભ્રમર એમ આપ્યો છે. એ દેવસૂરિ તે ‘કલિ.’ હેમચન્દ્રસૂરિના સમકાલીન અને એમનાથી વયોવૃદ્ધ અર્થાત્ ‘વાદી’ દેવસૂરિજ હશે એમ લાગે છે. અંતિમ પદ્યમાં આ ગુણચન્દ્રસૂરિએ કક્કલનો વિજય વાંછતી વેળા એમને અંગે જે વિશેષણો વાપર્યા છે તે ઉપરથી આઠ વ્યાકરણના જ્ઞાતા અને સિ. હે.ના અધ્યાપક ‘કાયસ્થ’ કાકલ અભિપ્રેત છે એમ ફલિત થાય છે. આ હિસાબે તત્ત્વપ્રકાશિકાના કર્તાનો સમય વિક્રમની બારમી સદીનો ગણાય.

આ તત્ત્વપ્રકાશિકામાં ઉપર્યુક્ત કોયડાઓના ઉકેલ માટે સિ. હે.નો ઉપયોગ કરાયો છે. એથી તો મૂળ કૃતિને કાતંત્રવિભ્રમ એ નામે ન ઓળખાવતાં કેટલાક એને હૈમવિભ્રમ કહે છે. આવી રીતે ‘ખરતર’ ગચ્છના ચારિત્રસિંહે આ કૃતિ ઉપર વિ. સં. ૧૬૨૫માં જે ‘અવયૂર્ણિ’ રચી છે. તેમાં એમણે સારસ્વત P. ૮૭ વ્યાકરણનો ઉપયોગ કર્યો હોવાથી એ મૂળ કૃતિને સારસ્વત-વિભ્રમ તરીકે કેટલાક ઓળખાવે છે. ઉપર્યુક્ત ગુણચન્દ્રસૂરિએ તો એમણે રચેલી વૃત્તિના પ્રારંભમાં આ વૃત્તિને તંત્રવિભ્રમની વૃત્તિ કહી છે અને એ રીતે મૂળ કૃતિનો ‘તંત્રવિભ્રમ’ તરીકે નિર્દેશ કર્યો છે. જો ‘તંત્ર’થી ‘કાતંત્ર’ અભિપ્રેત હોય તો એમના મતે મૂળ કૃતિનું નામ કાતંત્રવિભ્રમ છે. આ મૂળ કૃતિમાં કાઠ ૧માં ‘તિવ્’, ૨માં આબન્ત, ૪માં ત્યાદન્ત, ૮માં ટાન્ત અને સુપ્, ૧૩માં શત્રન્ત, ૧૪માં સ્યાદન્ત અને ૧૮મી કારિકામાં લિટ્નો ઉલ્લેખ છે તો ‘લિટ્’ એ સંજ્ઞા કાતંત્ર વ્યાકરણની તો નથી તો શું આ બધી સંજ્ઞા મૂળે પાણિનીય અષ્ટા.ની જ છે કે કેમ તેનો નિર્ણય થવો ઘટે.

તત્ત્વપ્રકાશિકાના લગભગ અંતમાં પૃ. ૩૨-૩૩માં સિદ્ધસેન દિવાકરે કહ્યું છે એવા ઉલ્લેખપૂર્વક નિમ્નલિખિત અવતરણ અપાયું છે :-

૧. આ સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ મારો લેખ નામે “વ્યાકરણના કોયડા અને એનો ઉકેલ.”

૨. આ ય. જૈ. ગ્રં. માં પ્રકાશિત છે. જુઓ પૃ. ૮૫ = ૪૮ ટિ. ૩.

૩. આ અવયૂર્ણિ કાતંત્ર (સારસ્વત) વિભ્રમ, પચ્ચક્રખાણસરૂપ, (પ્રત્યાખ્યાનસ્વરૂપ), દાનપટ્ટત્રિશિકા, વિસેસણવર્ધ (વિશેષણવર્તી) અને વીસવીસિયા (વિંશતિવિંશિકા) સહિત “ઋ. કે. શ્વે. સં.” તરફથી ઈ. સ. ૧૯૨૭માં છપાવાઈ છે

“સ્વેદં સમુદ્વહતિ જૃમ્મણમાતનોતિ, નિદ્રાયતે કિમપિ જલ્પતિ વસ્તુશૂન્યમ્ ।

આશા વિલોકયતિ ચં પુનરેવ ધાત્રીં, ભૂતાભિભૂત ઇવ દુર્વદકઃ સભાયામ્ ॥”

આ પદ્ય સિદ્ધસેન દિવાકરની ઉપલબ્ધ દ્વાત્રિશિકા વગેરેમાં જણાતું નથી તો એ એમની કોઈ લુપ્ત થયેલી કે કોઈ ભંડારમાં એક ખૂણે પડી રહેલી અને વિદ્વાનોની જાણ બહાર રહેલી કૃતિમાનું હશે. તેમ ન જ હોય તો આ ‘અવતરણ એમને નામે ખોટું ચડાવાયું છે એમ ગણાય.’

‘સહસ્રાવધાની’ ‘મુનિસુન્દરસૂરિએ વિ. સં. ૧૪૫૫માં જે ‘ત્રૈવિદ્યગોષ્ઠી રચી છે તેમાં (પત્ર ૮આમાં) લક્ષણાનુગામિની અર્થાત્ વ્યાકરણવિષયક ગોષ્ઠી આલેખતી વેળા એમણે નીચે મુજબની જે ‘બાર બાબતો રજૂ કરી છે તે હૈમવિભ્રમનું સ્મરણ કરાવે છે— એક રીતે આ જાતની નાનકડી કૃતિની ગરજ સારે છે—

(૧-૫) અઘીયે એ ‘ઇ’ ધાતુનું રૂપ છે તેમ ‘ધી’નું પણ રૂપ છે. એવી રીતે ઉચ્યતિ એ ઉચ્ ધાતુનું પણ રૂપ છે. ‘વ્યાગ્રાઃ’ ગ્રા ઉપરથી પણ ઉદ્ભવે છે. જાગર્તિ એ જાગ્ ધાતુનું રૂપ છે તેમ ગૃનું પણ છે. વળી ષઞ્ઞ ઉપરથી પઞ્ઞઙ્ગલ એવું પણ રૂપ બને છે.

(૬) કયા ધાતુનાં પરસ્પર ભિન્ન-ભિન્ન ૧૩ રૂપ થાય છે એવો પ્રશ્ન ઉઠાવી અત્ર ઉપસર્ગપૂર્વક ગૃ ધાતુનાં ૧૩ રૂપ દર્શાવ્યાં છે.

(૭) જગમ રૂપ ગમ્ ઉપરથી જ નહિ પણ જગિ એવા વૈદિક ધાતુ ઉપરથી પણ નિષ્પન્ન કરી શકાય તેમ છે.

(૮-૯) મા રિરેકામ ની સિદ્ધિ રેક્ ધાતુ ઉપરથી દર્શાવાઈ છે. એવી રીતે મામિનીમામ માટે માર્ગદર્શન કરાવાયું છે.

(૧૦) ‘માસ’ શબ્દનું ભાષ્યકારના મતે માદ્ધ્યામ્ અને દુર્ગના મતે માસ્થ્યામ્ રૂપ થાય છે.

(૧૧) દધિસેગ્માં ‘સૂ’નો ‘ષ્’ થાય કે નહિ એની ચર્ચા કરાઈ છે.

(૧૨) જુજૌદનીયિષતિ પ્રયોગ ‘જ્ઞા+ઓદન’ ઉપરથી નિષ્પન્ન કરતી વેળા કયો ન્યાય બળવાન ગણાય તેનો વિચાર કરાયો છે.

P. ૮૮

‘સિદ્ધ-સારસ્વત (લ. વિ. સં. ૧૨૭૫)-મુનિદેવે વિ. સં. ૧૩૨૨માં રચેલા શાન્તિનાથ-ચરિત્રમાં

આ વ્યાકરણનો અને સાથે સાથે એના કર્તા તરીકે દેવાનંદસૂરિનો પણ ઉલ્લેખ કર્યો છે. આ દેવાનંદસૂરિ તે ‘ચંદ્ર’ ગચ્છના દેવભદ્રના શિષ્ય થાય છે અને રત્નપ્રભ, પરમાનંદ અને કનકપ્રભ એ ત્રણના ગુરુ થાય

૧. ‘સિદ્ધસેનીય દ્વાત્રિશિકાઓમાંથી અવતરણો’ નામનો મારો લેખ ‘આત્માનંદ પ્રકાશ’ (પૃ. ૫૭, અં. ૬)માં પ્રસિદ્ધ થયો છે.

૨. એમની જીવનરેખા અને એમના કૃતિકલાપ વિષે મેં ‘જૈન પુસ્તક પ્રચારક સંસ્થા’ તરફથી સુરતથી વિ. સં. ૨૦૦૫માં પ્રકાશિત ઉપદેશરત્નાકરની મારી ભૂમિકા (પૃ. ૫૯-૮૨)માં વિસ્તૃત પરિચય આપ્યો છે.

૩. આ કૃતિ ‘લાલબાગ જૈન સંઘ’ તરફથી મુંબઈથી વિ. સં. ૧૯૬૬માં પ્રકાશિત કરાઈ છે અને એની સંસ્કૃત પ્રસ્તાવના આગમોદ્ધારકે લખી છે.

૪. આ સંબંધમાં મુનિસુન્દરસૂરિએ જરૂર જણાઈ ત્યાં સિ. હે.નાં સૂત્રો રજૂ કર્યાં છે અને એના સંપાદક આગમોદ્ધારકે એ સૂત્રોનાં સ્થાન દર્શાવ્યાં છે.

૫. આની શું એકે હાથપોથી મળતી નથી કે જેથી એ જાતનો ઉલ્લેખ જિ. ૨. કો.માં જણાતો નથી ?

છે. કનકપ્રભના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય પ્રભાચંદ્રસૂરિએ વિ. સં. ૧૩૩૪માં પ્ર. ચ. રચ્યું છે. એમાં મહેન્દ્રસૂરિચરિત (શ્લો ૩૨૮)માં એમણે કહ્યું છે કે દેવાનંદસૂરિએ સિ. હે.નો ઉદ્ધાર કરી સિદ્ધસારસ્વત નામનું નવીન વ્યાકરણ રચ્યું.

આ ઉપરથી એમ અનુમાનાય કે સિદ્ધસારસ્વતની રચના વિ. સં. ૧૨૭૫ની આસપાસમાં થઈ હશે. આ પૂર્વે કોઈએ આ જાતનું સિ. હે.ના ઉદ્ધારરૂપે વ્યાકરણ રચ્યાનું જાણવામાં નથી. એ હિસાબે આ જાતનું આ પ્રથમ વ્યાકરણ ગણાય.

‘ઉણાદિગણસૂત્ર’—ઉણાદિ એટલે ઉ, ઉર, ઈર વગેરે (પ્રત્યય). ‘ઉણ’ એ ‘ઉ’ પ્રત્યયનો ‘ણ’ અનુબંધ (indicative sign) પૂર્વકનો નિર્દેશ છે. આ પ્રત્યયો દર્શાવવા માટે ‘કલિ.’ હેમચન્દ્રસૂરિએ ૧૮૮ ૧૦૦૬ સૂત્રોની રચના કરી છે. એ કૃતિને ઉણાદિસૂત્ર, ઉણાદિ^૨ ગણસૂત્ર અને ઉણાદિસૂત્રપાઠ એમ વિવિધ નામે ઓળખાવાય છે. આ કૃતિની ઉત્પત્તિ “उणादयः” એ સિ. હે. (અ. પ, પા. ૨)ના ૯૩મા સૂત્રને આભારી છે. આ સૂત્રની સ્વોપજ લઘુવૃત્તિમાં “सदर्थान् धातोरुणादयो बहुलं स्युः” એવું એનું સ્પષ્ટીકરણ છે.

ઉણાદિગણસૂત્રમાં અનુબંધ વગરના ધાતુને ઉણાદિ પ્રત્યયો લગાડી શબ્દો સિદ્ધ કરાયા છે—એની વ્યુત્પત્તિ દર્શાવાઈ છે. આ સમસ્ત વ્યુત્પત્તિઓ આધુનિક ભાષાશાસ્ત્રીઓને ભલે માન્ય ન હોય, છતાં એ એક વેળાની માન્યતાની સૂચક છે એ રીતે તો એ મહત્વની છે જ. વળી અહીં જે શબ્દો નોંધાયા છે તે પૈકી કેટલાયે શબ્દો દેસ્ય, દ્રાવિડ અને વિદેશીય ભાષામાં પણ જોવાય છે. એનો અભ્યાસ ભાષાનાં સ્વરૂપ અને વિકાસ ઉપર તેમજ તે સમયના લોકોની રહેણીકરણી ઉપર ન્યૂનાધિક પ્રમાણમાં પ્રકાશ પાડે તેમ છે.

‘સ્વોપજ ટીકા’—આનું આદ્ય પદ નીચે મુજબ છે:-

“श्रीसिद्धहेमचन्द्रव्याकरणनिवेशिनामुणादीनाम् । आचार्यहेमचन्द्रः करोति विवृतिं प्रणम्यार्हम् ॥१॥”

આના પછી ટીકાનો સમગ્ર ભાગ ગદ્યમાં અપાયો છે.

ઉપયોગ-અભિ. ચિ.ની સ્વોપજ વિવૃત્તિમાં અનેક શબ્દોની સિદ્ધિ માટે આ ઉણાદિગણસૂત્રનાં ‘સૂત્રોનો ઉપયોગ કરાયો છે.

૧. આનું સ્વોપજ ટીકા સહિત સંપાદન, વીએનાની “ઈમ્પેરિયલ એકેડેમિ ઓફ સાયન્સીસ”ની આજ્ઞા અનુસાર જોહ (Joh) કિર્સ્ટે (Kirste) એ કર્યું છે. એ “એજ્યુકેશન સોસાયટી”ના મુદ્રણાલય (ભાવખાલા)માં ઈ. સ. ૧૮૯૫ માં છપાયું છે. શરૂઆતમાં પૃ. ૧-૫૫માં અનેકાર્થસંગ્રહગત શબ્દોની અકારાદિ ક્રમે સૂચી છે. ત્યાર બાદ સ્વોપજ ટીકા સહિત ‘ઉણાદિગણસૂત્ર’ નામની કૃતિ અપાઈ છે. એના પછી ટિપ્પણ છે. ત્યાર બાદ ઉણાદિગણસૂત્રનાં સૂત્રોમાંના શબ્દો અકારાદિક્રમે રજૂ કરાયા છે.

મૂળ કૃતિ નામે ઉણાદિગણસૂત્ર હે. કુ. (પૃ. ૮૨-૧૨૭)માં છપાઈ છે (જુઓ પ્ર. ૨, પૃ. ૩૪). વળી એ અમરચન્દ્રકૃત બૃહદ્વૃત્તિ-અવયૂર્જિકાની મુદ્રિત પ્રતિમાં દ્વિતીય પરિશિષ્ટ તરીકે પણ છપાઈ છે. જુઓ પૃ. ૭૫.[ઉણાદિકેશ પણ પ્રગટ થયો છે.]

૨. અહીં ગણનો અર્થ ‘સમૂહ’ સમજવાનો છે.

૩. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧.

૪. આની એક સૂચી તૈયાર થવી ઘટે.

ઉણાદિનામમાલા—આ શુભશીલની કૃતિ છે. એમાં ઉણાદિસૂત્રો દ્વારા શબ્દોની સિદ્ધિ કરાઈ છે. P. ૮૦ કે કેવળ એ સૂત્રો દ્વારા સિદ્ધ થતા શબ્દોની સૂચી અપાઈ છે એમ બે પ્રશ્ન સ્ફુરે છે. જો પ્રથમ પ્રશ્નનો ઉત્તર હકારમાં હોય તો આ વ્યાકરણને અંગેની કૃતિ ગણાય; નહિ તો એ ચોથા પ્રકરણમાં કોશ તરીકે એની નોંધ થવી ઘટે.

‘ધાતુપારાયણ’—‘ધાતુપાઠ’ એ શબ્દશાસ્ત્રનું એક ઉપયોગી અંગ ગણાય છે. કિયાની અર્થતાને ધારણ કરે તે ‘ધાતુ’ કહેવાય,^૧ કેમકે ‘ધાતુ’ એ કિયાનો વાચક છે. ધાતુ એ શબ્દનું ઉત્પત્તિસ્થાન ગણાય છે. ધાતુઓનું સંપૂર્ણ નિરૂપણ તે ‘ધાતુ-પારાયણ’ કહેવાય. આ નામની કૃતિ ‘કલિ.’ હેમચન્દ્રસૂરિએ રચી છે. એમાં એમણે સિ. હે.માં નિર્દેશાયેલા ધાતુઓને નીચે મુજબના નવ વર્ગમાં વિભક્ત કર્યા છે:-

ભ્વાદિ, ^૨અદાદિ, દિવાદિ, સ્વાદિ, તુદાદિ, રુધાદિ, તનાદિ, ક્યાદિ અને ચુરાદિ.

આ પ્રત્યેક વિભાગને ‘ગણ’ કહે છે. આમ અહીં નવ ગણ છે.

પહેલા ગણની કશી નિશાની રખાઈ નથી. બાકીના ગણો માટે અનુક્રમે ક્ષ, ચ્, ટ્, ત્, પ્, ય્, શ્ અને ણ્ નો ઉલ્લેખ છે. આમ અહીં ગણસૂચક આઠ અનુબંધ છે.

P. ૮૧ પ્રત્યેક ગણના ધાતુઓના સ્વરાન્ત અને વ્યંજનાન્ત એમ બે વિભાગ પાડી અનુક્રમે એનો નિર્દેશ કરાયો છે. સંસ્કૃતમાં કોઈ અકારાન્ત ધાતુ જણાતો નથી એટલે આકારાન્તથી શરૂઆત કરાઈ છે. અપવાદરૂપે ‘ભૂ’નો સૌથી પ્રથમ નિર્દેશ છે.^૩ આકારાન્ત ધાતુઓ અકારાદિ ક્રમે ન આપતાં એનો જે ક્રમથી સિ. હે. ની બૃહદ્વૃત્તિમાં ઉલ્લેખ છે તે ક્રમથી નિર્દેશ કરાયો હોય એમ લાગે છે. બાકીના સ્વરાન્ત તેમજ વ્યંજનાન્ત ધાતુઓ માટે પણ આ શૈલી અપનાવાઈ છે.

ધાતુઓનો ઉલ્લેખ કરતી વેળા યથાસ્થાન ગણસૂચક અનુબંધ ઉપરાંત “પદ વગેરે સૂચક નિમ્નલિખિત અનુબંધો પણ અપાયા છે :-

૧. આ કૃતિનું સંપાદન જોહ કિર્સ્ટ દ્વારા કરાયું છે અને એ “એજ્યુકેશન સોસાયટી”ના મુદ્રણાલયમાં ભાચખાલામાં છપાવાઈ ઈ.સ. ૧૯૦૧માં પ્રકાશિત થયું છે. એમાં દસ ગણની વ્યવસ્થા રખાઈ છે. અંતમાં બે પરિશિષ્ટ છે. પ્રથમ પરિશિષ્ટમાં તમામ ગણના ધાતુઓ અકારાદિ ક્રમથી અપાયા છે, અને દ્વિતીય પરિશિષ્ટમાં શબ્દોની અકારાદિ ક્રમે સૂચી છે. [ધાતુપારાયણનું વિવિધ હસ્તપ્રતોના આધારે સંશોધન મુનિ હર્ષવિજયએ શરૂ કરેલ તેનું અનેકવિધ પરિશિષ્ટો ઉમેરી મુનિ મુનિચન્દ્ર વિ. એ સંપાદન કર્યું છે. ગીરધરનગર જૈનસંઘ અમદાવાદથી પ્રસિદ્ધ થયું છે.] **ધાતુપારાયણ**, એને અંગેના (વિ. સં. ૧૫૧૬ કરતાં અર્વાચીન નહિ એવા) ટિપ્પન, તેમજ કણ્ડવાદિ અને એના ટિપ્પન સહિત ઝગડિયા તીર્થની “રિખવદેવજી મહારાજની પેઢી” તરફથી ઈ. સ. ૧૯૪૦માં પ્રકાશિત થયું છે. એના સંપાદક મુનિ દક્ષવિજયજીએ મૂળ કૃતિના ટિપ્પનમાં ખૂટતા અંશોની પૂરતી કરી છે.

૨. સરખાવો સિ. હે. (અ. ૩, પા. ૩)નું તૃતીય સૂત્ર “ક્રિયાર્થો ધાતુઃ”

૩. અદાદિમાં ‘હ્વાદિ’નો અંતર્ભાવ ન કરવાને મતે નવ ગણને બદલે દસ ગણ ગણાય.

૪. આ અપવાદમાં તેમજ અદાદિ ગણ પરત્વેના એવા અન્ય અપવાદોમાં વૃદ્ધ સંપ્રદાયનું અનુસરણ કારણરૂપ છે. વૃદ્ધોના મતે ‘ભૂ’ એ મંગળવાચક શબ્દ છે.

૫. ‘પદ’થી પરસ્મૈપદ, આત્મનેપદ અને ઉભયપદ એમ ત્રણ સમજવાનાં છે.

‘इ, ई, उ ऊ ऋ ॠ, लृ, ओ, औ, औ, ग्’ અને ‘इ’ તેમજ અનુસ્વાર.

ઈકાર એ અનુબંધ આત્મનેપદનો અને ઈકાર ઉભયપદનો બોધક છે. ‘औ’ એ ધાતુ વેદ છે એ સૂચવે છે. આ ઉપરાંત ધાતુ અનિદ્ છે એ સૂચવવા અનુસ્વારનો ઉપયોગ કરાયો છે.

ધાતુના અનુબંધપૂર્વકના નિર્દેશની સાથે સાથે એનો અર્થ સંસ્કૃતમાં અપાયો છે.

‘स्वोपज्ञ वृत्ति-આનું કોઈ વિશિષ્ટ નામ નથી. આમાં ‘ગ્રંથો અને ‘ગ્રંથકારોનો જે નામોલ્લેખ P. ૮૨ છે એ એની મહત્તામાં વૃદ્ધિ કરે છે. આ વૃત્તિનો પ્રારંભ નિમ્નલિખિત પદ દ્વારા કરાયો છે. :-

“ श्रीसिद्ध हेमचन्द्रव्याकरणनिवेशितान् स्वकृतधातून् । आचार्यहेमचन्द्रो विवृणोत्यहं नमस्कृत्य ॥ १ ॥ ”

બાકીની સમગ્ર વૃત્તિ ગદ્યમાં છે જો કે અવતરણો પદ્યમાં છે. આ વૃત્તિમાં કર્તાએ પોતાને આચાર્ય કહ્યા છે.

હૈમ ધાતુપાઠ—જૈ. ગ્રં. (પૃ. ૩૦૧)માં આની નોંધ લેતાં એને પુણ્યસુંદરની ૭૬૦ શ્લોક જેવડી કૃતિ કહી છે અને એ નામની પછી કૌંસમાં “સ્વરવર્ણાનુક્રમ ૧૬” એવો ઉલ્લેખ કરાયો છે. આ નામની ૩૨૫ શ્લોક જેવડી એક અજ્ઞાતકર્તૃક કૃતિની પણ અહીં નોંધ છે.

હૈમ ધાતુવૃત્તિ— આ કોઈકની કૃતિની ૩૭૬ પત્રની એક હાથપોથી ભાવનગરના ભંડારમાં છે એમ જૈ. ગ્રં. (પૃ. ૩૦૧) જોતાં જણાય છે.

‘धातुरत्नाकर (વિ. સં. ‘૧૬૮૦)— આ ૨૧૦૦ શ્લોક જેવડી કૃતિના રચનાર ‘ખરતર’ ગચ્છના સાધુસુન્દરગણિ છે. એઓ એ ગચ્છના પાઠક સાધુકીર્તિના શિષ્ય અને વિમલતિલકના ગુરુભાઈ થાય છે. એમણે ઉક્તિ-રત્નાકર તેમજ ‘શબ્દ-રત્નાકર રચ્યા છે. વળી એમણે આ ધાતુરત્નાકર ઉપર વિ. સં. P. ૮૩ ૧૬૮૦માં ક્રિયાકલ્પલતા નામની વૃત્તિ રચી છે. આ બેમાંથી એકે કૃતિ પ્રસિદ્ધ થઈ નથી અને એકેની હાથપોથી મારા જોવામાં આવી નથી. એથી એ પ્રશ્ન સ્ફુરે છે કે આ ધાતુરત્નાકર સિ. હે.ને અનુસરે છે કે કેમ ? જો એ અનુસરતો હોય તો એને આ ત્રીજા પ્રકરણમાં સ્થાન અપાવું ઘટે પણ જો એ કોઈ અજૈન વ્યાકરણને અંગેનો ગ્રંથ હોય તો પ્ર. ૧૭માં એનો નિર્દેશ થવો જોઈએ.

૧-૨. કેટલીક વાર ‘इ’ને બદલે ‘इ’નો અને એવી રીતે ‘ई’ને બદલે ‘ग’નો ઉપયોગ કરાયો છે.

૩. આ સંજ્ઞાઓ પાણિનીય અષ્ટાથી જૂદી પડે છે. એમાં તો इ, उ, ए, ओ, ઈ, ઊ, ઈ, ઊ, ઈ, ઊ અને इ એમ સંજ્ઞાઓ છે.

૪. આ ગીરધરનગર જૈન સંઘ દ્વારા પ્રકાશિત છે. પ્રાપ્તિસ્થાન ઝૈંકારસૂરિજ્ઞાનમંદિર-સૂરત.

૫. દા. ત. ભગવદ્ગીતા. ઉપરોક્ત સંસ્કરણમાં ગ્રંથકારે સૂચવેલ મતભેદોનું પરિશિષ્ટ પણ આપ્યું છે.

૬. કાશ્મી, કાલિદાસ, કૌશિક, દ્રમિલ, માધ ઇત્યાદિ.

૭. શ્રી વિજયલાવણ્યસૂરિએ ધાતુરત્નાકર નામની કૃતિ રચી એમાં ધાતુઓનાં રૂપો આપ્યાં છે. આ કૃતિ અમદાવાદની

“જૈન ગ્રંથ પ્રકાશક સભા” તરફથી સાત ભાગમાં પ્રસિદ્ધ થઈ છે. પહેલા પાંચ ભાગ વિ. સં. ૧૯૯૫માં, છઠો

ભાગ ૧૯૯૬માં અર્ન સાતમો ૧૯૯૭માં પ્રસિદ્ધમાં મૂકાયા છે. [સાર્ત ભાગોનું પુનર્મુદ્રણ થયું છે.]

૮. જુઓ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૧૯૮).

૯. આ છ કાંડમાં ૧૦૧૧ શ્લોકમાં રચાયેલી કૃતિ “ય. જૈ. ગ્રં.”માં ગ્રંથાંક ૩૬ તરીકે વીરસંવત્ ૨૪૩૯ પ્રકાશિત કરાઈ છે.

ઉક્તિરત્નાકર (લ. વિ. સં. ૧૬૭૦) - આ ધાતુરત્નાકરના કર્તા ઉપર્યુક્ત સાધુસુન્દરગણિની કૃતિ છે. જૈ. ગ્રં. (પૃ. ૩૦૬)માં એને વ્યાકરણનો પરચૂરણ ગ્રંથ ગણ્યો છે. આ કૃતિ 'ખરતર' ગચ્છના જિનસિંહસૂરિના રાજ્ય દરમ્યાન એટલે કે વિ. સં. ૧૬૭૦થી ૧૬૭૪ના ગાળામાં રચાઈ છે.

લિંગાનુશાસન-આ કૃતિના કર્તા કલિ. હેમચન્દ્રસૂરિ છે. એમણે સૂત્રપાઠની જેમ એનું કોઈ વિશિષ્ટ નામ ન રાખતાં સામાન્ય નામ રાખ્યું છે. એ કૃતિને લિંગાનુશાસન કહી છે. એમણે આ કૃતિ ૨૫ જાતના ભિન્ન ભિન્ન છંદમાં ૧૩૯ પદોમાં ગૂંથી છે, અને એનાં નાનાં-મોટાં આઠ પ્રકરણો પાડ્યાં છે :-

P. ૯૪ પુલ્લિંગ (શ્લો. ૧૭), સ્ત્રી-લિંગ (૩૩), નપુંસક-લિંગ (૨૪), પું-સ્ત્રી-લિંગ (૧૨), પું-નપુંસક-લિંગ (૩૬), સ્ત્રી-નપુંસક-લિંગ (૬), સ્વતઃ સ્ત્રી-લિંગ (૬) અને પર-લિંગ (૪).

આ પ્રમાણેનાં ૧૩૯ પદો પછી ઉપસંહારરૂપે એક પદ છે. એ દ્વારા કર્તાએ પોતાનું નામ 'આચાર્ય હેમચન્દ્ર' એમ જણાવ્યું છે, અને આ કૃતિ નિઃશેષ (સમસ્ત) 'નામલિંગાનુશાસનો જોઈને મેં રચી છે એમ કહ્યું છે. જેમ સિ. હે. (૫-૨-૯૩)ની પુરવણીરૂપે ઉણાદિસૂત્રની રચના કરાઈ છે તેમ "પુંસ્ત્રિયોઃ સ્યમૌજસ" (૧-૧-૨૯)ની પુરવણીરૂપે આ લિંગાનુશાસન રચાયું છે.

ડો. બેલ્વલકાર જેવાનું કહેવું એ છે કે પ્રસ્તુત લિંગાનુશાસન એ શાકટાયનકૃત લિંગાનુશાસનનું કેવળ વિસ્તૃતીકરણ (enlargement) છે, પણ આ હકીકત અંશતઃ જ સત્ય છે, અને હેમ લિંગાનુશાસન એ પ્રસ્તુત વિષયનો અંતિમ (final) અને પ્રમાણભૂત (authoritative) ગ્રંથ છે એમ જે પ્રો. હરિદામોદર P. ૯૫ વેલણકરે 'સ્વોપજ વૃત્તિવાળી આવૃત્તિના અગ્રવચનમાં કહ્યું છે તેને હું મળતો થાઉં છું.'

૧. "નિર્ણયસાગર મુદ્રણાલય" તરફથી શકસંવત્ ૧૮૧૮માં પ્રકાશિત અભિધાન સંગ્રહમાં આને સ્થાન અપાયું છે. "પ. જૈ. ગ્રં."માં મૂળ કૃતિ કનકપ્રભકૃત લઘુન્યાસને આધારે યોજાયેલી અવચૂરિ સહિત ઈ. સ. ૧૯૦૫માં પ્રસિદ્ધ કરાઈ છે. ત્યાર બાદ મૂળ કૃતિ મુનિશ્રી કેશરવિજય દ્વારા ઉદ્ધૃત સંસ્કૃત ટિપ્પનિકા સહિત શ્રી૦ વિનોદચંદ મોહનલાલ વૈદ્ય તરફથી વિ. સં. ૧૯૯૩માં છપાવાઈ છે. સ્વોપજ વૃત્તિનું તેમજ એને અંગેની શ્રી વલ્લભવાચકીય દુર્ગપદ-પ્રબોધ નામની વૃત્તિ સહિત મૂળ કૃતિનું સંપાદન વિજયક્ષમાભદ્રસૂરિએ કર્યું છે અને એ શ્રી૦ હીરાલાલ સોમચંદ શાહ તરફથી વિ. સં. ૧૯૯૬માં પ્રસિદ્ધ કરાયું છે. આ સંપાદકે દુર્ગપદ-પ્રબોધ નામની વૃત્તિમાંના ગુજરાતી શબ્દોની એક સૂચી આપી, સ્વોપજ વૃત્તિગત સંસ્કૃત શબ્દોની પણ સૂચી આપી છે. આ ઉપરાંત એમણે આ બંને વૃત્તિગત સંસ્કૃત શબ્દોની પણ સૂચી આપી છે. આ ઉપરાંત એમણે આ બંને વૃત્તિમાંના વિશેષનામોની પણ આઘ સ્થળ પૂરતી એક એક સૂચી આપી છે. વળી અંતમાં મૂળ કૃતિ જે ભિન્ન ભિન્ન છંદોમાં રચાઈ છે એ છંદોનાં નામો એમણે રજૂ કર્યા છે.

લિંગાનુશાસનરૂપ મૂળ કૃતિ હે. કુ. (પૃ. ૨૦૫-૨૨૪)માં પ્રકાશિત થયેલી છે. જુઓ પૃ. ૩૪.

૨. આ જાતની કૃતિઓનો મુખ્ય ઉદ્દેશ શબ્દ-ભંડોળ રજૂ કરવાનો હોય છે. તેમ છતાં એ કૃતિઓ શબ્દોનાં લિંગ દર્શાવે છે. આવી કૃતિઓમાં સુપ્રસિદ્ધ અમર-કોશ મહત્ત્વનું સ્થાન ભોગવે છે.

૩. જુઓ ઉપરનું ટિ. ૧.

૪. પ્રત્યયોથી નિષ્પન્ન થતા સ્ત્રીલિંગી શબ્દોના નિરૂપણ માટે સિ. હે. (અ. ૨)નો આખો ચોથો પાદ કામમાં લેવાયો છે ખરો, પરંતુ આ પાદમાં સ્ત્રી-લિંગી શબ્દથી પ્રત્યયનું વિધાન કરાયું છે એટલે એ માટે સ્ત્રી-લિંગનો નિર્ણય કરવા અને અન્ય લિંગને જણાવવા માટે આવી સ્વતંત્ર કૃતિની આવશ્યકતા હોવાથી એ રચાઈ છે.

ઉલ્લેખ—અભિ. ચિ. (કાંડ ૧, શ્લો. ૧૮)માં આ લિંગાનુશાસનનો ઉલ્લેખ છે, કેમકે “લિઙ્ગં તુ જ્ઞેયં લિઙ્ગાનુશાસનાત્” એમ આ શ્લોકમાં કહી એની સ્વોપજ વિવૃત્તિ (પૃ. ૮)માં આ પોતાની કૃતિ હોવાનું કહ્યું છે.

સ્વોપજ વૃત્તિ—‘કલિ.’ હેમચન્દ્રસૂરિએ પોતાના લિંગાનુશાસન ઉપર વેધક પ્રકાશ પાડનારી લગભગ ૪૦૦૦ શ્લોક જેવડી વૃત્તિ રચી છે. એમાં એમણે ૫૭ જેટલા ગ્રંથો અને ગ્રંથકારોની સાક્ષી આપી છે.

દુર્ગપદપ્રબોધ—ઉપર્યુક્ત સ્વોપજ વૃત્તિમાં જે સ્થળો મંદ બુદ્ધિ ધરાવનારી વ્યક્તિઓને સહેલાઈથી સમજાય તેવાં ન જણાયાં તેના સ્પષ્ટીકરણરૂપે દુર્ગપદપ્રબોધ નામની વૃત્તિ ‘ખરતર’ ગચ્છના ઉપા. જ્ઞાનવિમલના શિષ્ય વાચક શ્રીવલ્લભે વિ. સં. ૧૬૬૧માં યોધપુર (જોધપુર)માં રચી છે. આમાં સંસ્કૃત શબ્દોના ગુજરાતી પર્યાયો અપાયા છે એથી આનું મહત્ત્વ વધ્યું છે.

ટીકા અને અવચૂરિ—૧૨૧૧ શ્લોક જેવડી જયાનંદસૂરિકૃત ટીકાની તેમજ એક અજ્ઞાતકર્તૃક અવચૂરિની નોંધ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૩૮)માં છે. જૈ. ગ્રં. (પૃ. ૩૦૧)માં રત્નશેખરે ૧૦૭૫ શ્લોક જેવડી અવચૂરિ રચ્યાનો ઉલ્લેખ છે, પરંતુ જિ. ૨. કો.માં એની નોંધ નથી.

‘સન્માન—હૈમ (પંચાંગ વ્યાકરણ રચાતાં એ ગ્રંથને સિદ્ધરાજ નૃપતિની સવારીના હાથી ઉપર P. ૮૬ રાખી એ રાજાના દરબારમાં લાવવામાં આવ્યો હતો. હાથી ઉપર બેઠેલી બે ચામર ધરનારી સ્ત્રીઓ એ વ્યાકરણની બંને બાજુએ ચામર ઢાળતી હતી અને એ વ્યાકરણ ઉપર શ્વેત છત્ર ધરવામાં આવ્યું હતું. એનું પૂજન રાજસભાના વિદ્વાનોએ કર્યું અને રાજાએ પૂજોપચાર કર્યો ત્યાર બાદ રાજકીય સરસ્વતી-કોષમાં એને સ્થાન અપાયું હતું.

પ્રચાર—હૈમ પંચાંગ વ્યાકરણના પ્રચાર માટે સિદ્ધરાજ જયસિંહે પુષ્કળ પ્રયાસ કર્યો હોય એમ જણાય છે. પ્ર. ચ. (શૃંગ ૨૨, શ્લો. ૧૦૪) પ્રમાણે આ રાજવીએ ૩૦૦ કુશળ લહિયાઓ રાખી એની નકલો જલદી તૈયાર કરાવી અને પછી આપણા આ ભારતવર્ષના અંગ, બંગ, કલિંગ ઇત્યાદિ વિવિધ દેશોમાં એ મોકલાવી અને તેમાં પણ વીસ નકલો તો એકલા કાશ્મીરના જ સરસ્વતી-ભંડાર માટે એમણે મોકલાવી. આઠ વ્યાકરણમાં નિષ્ણાત એવા કાકલ નામના કાયસ્થની મુખ્ય અધ્યાપક તરીકે એમણે નિમણૂક કરી. આ વ્યાકરણના અભ્યાસીઓની દર મહિને સુદ પાંચમે (જ્ઞાન-પંચમીએ) પરીક્ષા લેવાય એવો એમણે પ્રબંધ કર્યો. આ વ્યાકરણનો અભ્યાસ કરનારને ઉત્તેજનાર્થે કંકણ અપાતું અને એમાં નિષ્ણાત થનારને રેશમી વસ્ત્રો, સુવર્ણનાં આભૂષણો સુખાસન અને છત્ર અપાતાં.

એક સ્થળે એવો ઉલ્લેખ છે કે સિદ્ધરાજની હકુમત હેઠળના પ્રદેશમાં આ વ્યાકરણ ભણાવા માટે P. ૮૭ એમણે હુકમ બહાર પાડ્યો હતો.

૧. ઈ. સ. ની છઠ્ઠી સદીમાં થયેલા મેઠે હયગ્રીવવધ નામનું કાવ્ય રચ્યું છે. એ દેશના એ સમયના રાજા તરફથી એની એવી કદર કરાઈ હતી કે જેથી એ કવિને રાજાએ કહ્યું કે અર્પણ કરવા માટે સુવર્ણના કરંડકમાં એ કાવ્યને મૂકો. જુઓ Sanskrit Literature (P.E.N; p. 111)

૨. આની સંપૂર્ણ યાદી પ્ર. ચ. (શૃંગ ૨૨, શ્લો. ૧૦૬-૧૦૮)માં છે.

૩. આનાં નામ કોઈ સ્થળે અપાયાં છે ખરં ?

૪. એમ કહેવાય છે કે ભટ્ટોજિ દીક્ષિતે (લ. વિ. સં. ૧૫૧૦-૧૫૭૫) સિદ્ધાંત કૌમુદી કંઠસ્થ કરનારને સારી રકમ રાજા તરફથી ભેટ મળે એવો પ્રબંધ કરાવ્યો હતો અને એ રીતે એના પ્રચારને વેગ અપાવ્યો હતો.

ઓટ—આ પ્રમાણે આ વ્યાકરણના પઠન-પાઠન અને પ્રચાર માટે આ રાજવીએ પરિશ્રમ કરવામાં કયાસ ન રાખી. એમણે કરેલી વ્યવસ્થાનો અમલ એમના પછી કુમારપાલે પણ ચાલુ રાખ્યો હશે, પરંતુ ત્યાર બાદ આ કાર્યમાં ઓટ આવી. આનાં મુખ્ય બે કારણ જણાય છે :-

(૧) દુનિયામાં વિદ્વાનો મળવા મુશ્કેલ છે અને તેમાં પણ પરસ્પર મત્સરભાવ ન સેવનારની સંખ્યા તો અતિશય અલ્પ છે. આ પરિસ્થિતિને લઈને હેમચન્દ્રસૂરિની કીર્તિલતાને વિસ્તરતી જોઈ સંતપ્ત બનનાર કેટલાક તેજોદ્વેષી વિપ્રો આ ઓટમાં કારણરૂપ બન્યા.

(૨) કુમારપાલ પછી એમનો ભત્રીજો અજયપાલ (વિ. સં. ૧૨૩૦-૧૨૩૩) રાજા ગાદીએ આવ્યો. એ રાજા નિર્બુદ્ધિ, નિર્દય અને જૈનોનો દ્વેષી હતો. એણે અનેક જૈન મંદિરોનો નાશ કર્યો. એ દુષ્ટ રાજા હેમ વ્યાકરણના અભ્યાસને ઉત્તેજન શેનો આપે ? એમ પણ બન્યું હોય કે એનું પઠન-પાઠન શિક્ષાને પાત્ર ગણાવાયું હોય.

ગમે તેમ પણ આ વ્યાકરણનો અભ્યાસ કરાવનારની સંખ્યા અલ્પ થઈ ગઈ અને ગુજરાતનું આ ‘પ્રધાનતમ વ્યાકરણ’ વિસારે પડ્યું. એનો ઉદય ફરીથી હમણાં ત્રણેક દસકાથી થયો છે.

‘સ્યાદિશબ્દસમુચ્ચય (લ. વિ. સં. ૧૨૮૦) - આના કર્તા ‘વાયડ’ ગચ્છના જિનદત્તસૂરિના શિષ્ય ‘વેણીકૃપાણ’ અમરચંદ્રસૂરિ છે. એમણે નીચે મુજબની કૃતિઓ રચી છે :-

P. ૮૮

(૧) ‘પદ્માનંદ-મહાકાવ્ય, (૨) ‘ચતુર્વિંશતિ-જિનેન્દ્ર-સંક્ષિપ્ત-ચરિત, (૩) ‘બાલભારત, (૪) સૂક્તાવલી, (૫) છાન્દોરત્નાવલી, (૬-૭) કાવ્ય-કલ્પલતા અને એની ‘વૃત્તિ, કવિશિક્ષા’ (૮) કાવ્યકલ્પલતાપરિમલ, (૯) કાવ્યકલ્પલતામંજરી, (૧૦) અલંકારપ્રબોધ, (૧૧) કલાકલાપ અને (૧૨) ‘એકાક્ષરનામમાલા.

એઓ વીસલદેવ (ઈ. સ. ૧૨૪૩-૧૨૬૧)ના રાજ્ય દરમ્યાન વિદ્યમાન હતા. એમની મૂર્તિ પં. મહેન્દ્રના શિષ્ય મદનચન્દ્રે વિ. સં. ૧૩૩૯માં કરાવી.’

૧. આ કૃતિ જ્યાનંદસૂરિકૃત અવચૂરિ સહિત કાશીથી વીરસંવત્ ૨૪૪૧માં પ્રકાશિત થઈ છે. એ ચન્દ્રસાગરજી દ્વારા સંપાદિત થઈ પ્રસિદ્ધિમાં મૂકાઈ છે (જુઓ પૃ. ૭૨).

૨-૩. આ બંનેનું સંપાદન મેં કર્યું છે. એ બંને કૃતિ “ગાયકવાડ પૌર્વાત્ય ગ્રંથમાલા”માં ગ્રંથાંક ૫૮ તરીકે ઈ. સ. ૧૯૩૨માં પ્રકાશિત થયેલી છે. આ પૈકી પ્રથમ કૃતિની એક હાથપોથી વિ. સં. ૧૨૯૭માં લખાયેલી મળે છે.

૪. “પંડિત” ગ્રંથ ૪-૬ માં બનારસથી આ કાવ્ય પ્રસિદ્ધ થયું છે. વળી એ “કાવ્યમાલા”માં ઈ. સ. ૧૮૯૪માં (બીજી આવૃત્તિ, ઈ. સ. ૧૯૨૬માં) છપાયું છે.

૫-૬. કાવ્યકલ્પલતાવૃત્તિનું પં. જગન્નાથ શાસ્ત્રીએ સંપાદન કર્યું છે અને એ બનારસથી ઈ. સ. ૧૯૩૧માં પ્રકાશિત થયેલ છે.

૭. આનો અમરચંદ્રસૂરિની કૃતિ તરીકે જિ. ૨૦ કો. (ખંડ ૧, પૃ. ૬૧)માં ઉલ્લેખ છે

૮. જુઓ જિનવિજયજી દ્વારા સંપાદિત પ્રાચીન જૈન લેખસંગ્રહ (ભા. ૨, લેખાંક ૫૨૩). આ ભદ્રાસનસ્થ મૂર્તિ પાટણના ટાંગડિયાવાડાના જિનમંદિરમાં છે. આની નોંધ જૈન ચિત્ર કલ્પદ્રુમ (ચિત્રવિવરણ પૃ. ૧૦૩)માં છે.

ઉપર્યુક્ત 'સ્યાદિ-શબ્દસમુચ્ચય એ નામ, સર્વનામ અને સંખ્યાવાચક શબ્દોના લિંગ ઉપર પ્રકાશ પાડે છે. એ પદ્ધત્મક કૃતિ ચાર ઉલ્લાસમાં વિભક્ત છે. એમાં અનુક્રમે સ્વરાંત શબ્દો વ્યંજનાન્ત શબ્દો, P. ૯૯ સર્વનામ અને સંખ્યાને લગતા ૨૬, ૨૩, ૨ અને ૩ પદ્યો છે.' આના ઉપર 'ઉકેશ' ગચ્છના મતિસાગરના શિષ્ય વિનયભૂષણે એક ટીકા રચી છે અને એની એક હાથપોથી વિ. સં. ૧૫૩૬માં લખાયેલી છે. જ્યાંનંદસૂરિએ ૧૦૫૦ શ્લોક પૂરતી 'અવચૂરિ રચી છે. એને 'દ્વીપિકા' પણ કહે છે. એમાં શબ્દોની પ્રક્રિયા સિ. હે. અનુસાર અપાઈ છે. શબ્દનાં રૂપ સિ. હે. મુજબ સિદ્ધ કરાયાં છે.

'ન્યાયાર્થમંજૂષા (વિ. સં. ૧૫૧૬) - આના કર્તા રત્નશેખરસૂરિના શિષ્ય ચારિત્રરત્નગણિના શિષ્ય 'હેમહંસગણિ છે. એમણે 'આરંભસિદ્ધિ ઉપર વિ. સં. ૧૫૧૪માં સુધીશૃંગાર નામની વૃત્તિ રચી છે. હૈમ બૃહદ્વૃત્તિમાં જે ૫૭ ન્યાયો 'કલિ.' હેમચન્દ્રસૂરિએ આપ્યા છે તેમાં આ ગણિએ ૮૪ ન્યાય ઉમેરી એકંદર ૧૪૧ ન્યાયો રજૂ કર્યા છે. એના સંગ્રહને આ ગણિએ ન્યાયસંગ્રહસૂત્ર એવું નામ આપ્યું છે. એના ઉપર આ ગણિએ જે વૃત્તિ વિ. સં. ૧૫૧૬માં રચી છે તેને ન્યાયાર્થમંજૂષા કહે છે. કેટલાક એને હૈમવ્યાકરણ-ન્યાયસંગ્રહ કહે છે.

ન્યાસ- ન્યાયાર્થમંજૂષા ઉપર હેમહંસગણિએ જાતે ન્યાસ રચ્યો છે.^૯

P. ૧૦૦

'કિયારત્નસમુચ્ચય (વિ. સં. ૧૪૬૬)-આના કર્તા ગુણરત્નસૂરિ છે. એમણે 'કલ્પાન્તર્વાચ્ય અને વાસોન્તિકાદિપ્રકરણ યાને અંચલમતનિરાકરણ રચ્યાં છે. વળી એમણે હારિભદ્રીય ષડ્દર્શન-સમુચ્ચય ઉપર 'તર્કરહસ્યદ્વીપિકા નામની વૃત્તિ રચી છે. આ ઉપરાંત એમણે નિમ્નલિખિત કૃતિઓ ઉપર અવચૂરિ રચી છે :-

૧. મુનિ (હવે પં.) દક્ષવિજયજીએ સ્યાદાન્તરત્નાકર રચ્યો છે અને એના પ્રથમ તરંગ પૂરતો ભાગ "જૈ. ગ્રં. પ્ર. સ." તરફથી અમદાવાદથી વિ. સં. ૧૯૯૫માં છપાવાયો છે. સ્યાદિ અને ત્યાદિ એમ જે બે પ્રકારની વિભક્તિ ગણાય છે તે પૈકી પહેલી નામને અંગે છે. એનાં રૂપો સાધનિકા સહિત આ કૃતિમાં અપાયાં છે.
૨. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૫૭)માં એકંદર ૫૩ પદ્યો હોવાનો ઉલ્લેખ છે.
૩. આ પ્રકાશિત છે જુઓ પૃ. ૭૨ = ૪૧ ટિ. ૨.
૪. આ વૃત્તિ ન્યાયસંગ્રહ તેમજ સ્વોપજ ન્યાસ સહિત શ્રી. હર્ષચન્દ્ર ભૂરાભાઈ તરફથી બનારસથી વીરસંવત્ ૨૪૩૭માં પ્રકાશિત થઈ છે. [આ ન્યાસ મુનિ રત્નવલ્લભવિ. ના ગુજ. વિવેચન સાથે ઔંકારસૂરિજ્ઞાનમંદિર સૂરતથી અને મુનિ નન્દિધોષવિ.ના હિન્દી વિવેચન સાથે 'શા.ચી.એ.' અમદાવાદથી પ્રગટ થયો છે.]
૫. જયચન્દ્રસૂરિના શિષ્ય હેમહંસગણિએ "ષડાવશ્યક" ઉપર બાલાવબોધ વિ. સં. ૧૫૦૧માં રચ્યો છે.
૬. આ કૃતિ સુધીશૃંગાર સહિત "લ. જૈ. ગ્રં."માં ઈ. સ. ૧૯૪૨માં પ્રકાશિત કરાઈ છે.
૭. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૪. બૃહદ્વૃત્તિ-પ્રક્રિયાના પરિશિષ્ટમાં ન્યાયોનું નિરૂપણ છે તે આ ન્યાયાર્થમંજૂષાને અંગે રચાયું છે.
૮. આ "જૈન્ યશોવિજયગ્રંથમાલા"માં ગ્રંથાંક ૧૦ તરીકે વીરસંવત્ ૨૪૩૪માં છપાયો છે. અંતમાં ગ્રંથબીજ તરીકે નવ ગણોના બધા મળીને ૮૧૬ ધાતુઓ, સૌત્ર ધાતુઓ અને નામધાતુઓની સૂચી અપાઈ છે અને પ્રશસ્તિની નોંધ કરાઈ છે. આ ઉપરાંત ધાતુઓની અકારાદિ ક્રમે પણ સૂચી અપાઈ છે. [આનું પુનર્મુદ્રણ થયું છે.]
૯. આ કૃતિ વિ. સં. ૧૪૫૭માં રચાઈ છે.
૧૦. આ વૃત્તિ મૂળ સહિત "જૈ. આ. સ." તરફથી ભાવનગરથી વિ. સં. ૧૯૭૪માં પ્રકાશિત થઈ છે.

‘સત્તરિયા, દેવેન્દ્રસૂરિકૃત ‘કર્મગ્રંથો, નવતત્ત, ખેત્તસમાસ, આઉરપચ્ચક્રખાણ, ચઉસરણ, સંધારગ અને ભત્તપરિણ્ણા.

આ ગુણરત્નસૂરિ દેવસુંદરસૂરિના શિષ્ય અને સોમસુંદરસૂરિના ગુરુભાઈ થાય છે. એમણે આ કિયારત્નસમુચ્ચય વિ. સં. ૧૪૬૬માં રચ્યો છે. સિ. હે. ગત ધાતુઓ લઈ એમણે એનાં રૂપો (paradigms) આ કૃતિમાં આપ્યાં છે. આમ કરતી વેળા એમણે હૈમ ધાતુપારાયણમાંથી એકક ધાતુ

P. ૧૦૧ એના અર્થ સહિત કમવાર લીધો છે. પ્રારંભમાં નીચે મુજબની દસ ‘વિભક્તિઓની સમજણ આપી છે અને એ બરાબર ખ્યાલમાં આવે તેથી એને અંગે ‘ગુજરાતી ઉદાહરણો પણ આપ્યાં છે:-

(૧) ‘વર્તમાના, (૨) ‘સપ્તમી, (૩) ‘પંચમી, (૪) હ્યસ્તની, (૫) અઘતની, (૬) પરોક્ષા, (૭) આશી; (૮) શ્વસ્તની, (૯) ભવિષ્યન્તી અને (૧૦) ક્રિયાતિપત્તિ’ વિશેષમાં ‘વર્તમાના’ના ચાર પ્રકારનું એમણે નિરૂપણ કર્યું છે. તેમ કરતી વેળા વર્તમાનાના (૧) પ્રવૃત્તોપરત, (૨) વૃત્તાવિરત, (૩) નિત્ય-પ્રવૃત્ત અને (૪) સામીપ્ય એ ભેદ દર્શાવનારું અવતરણ આપ્યું છે. વિભક્તિ દસ છે અને કાળ ત્રણ છે એમ કહી “વર્તમાનકાલિ વિભક્તિ ૩ : વર્તમાના, સપ્તમી, પંચમી” (પૃ. ૧૬), “અતીતકાલિવિભક્તિ ૪ : હ્યસ્તની, અઘતની, પરોક્ષા, ક્રિયાતિપત્તિ” (પૃ. ૧૭), અને “ભવિષ્યકાલિવિભક્તિ ૩ : શ્વસ્તની, ભવિષ્યન્તી, આશી.” (પૃ. ૧૮) એવો નિર્દેશ કર્યો છે. પ્રસંગવશાત્ સિ. હે.ના સૂત્રો તેમજ અન્ય ગ્રંથોમાંથી અવતરણો આપ્યાં છે.

P. ૧૦૨ અંતમાં એમણે પોતાની ગુરુપરંપરા ૬૬ પદ્યમાં વર્ણવી છે. એનો પ્રારંભ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના પાંચમા ગણધર સુધર્મસ્વામીથી કર્યો છે.

‘કવિકલ્પદ્રુમ (વિક્રમની ૧૬મી સદી)-આના કર્તા હર્ષકુલગણિ છે. એઓ કુલચરણગણિના શિષ્ય થાય છે. એમણે આ કવિકલ્પદ્રુમની રચના હેમવિમલસૂરિના રાજ્યમાં કરી છે. આના ઉપર એમણે ધાતુચિન્તામણિ નામની સ્વોપજ ટીકા રચી છે અને એમાં (પૃ. ૬૧માં) ગુણરત્નસૂરિએ વિ. સં. ૧૪૬૬માં રચેલા કિયારત્નસમુચ્ચય જોવાની ભલામણ કરી છે. આ ઉપરથી એમનો સમય વિક્રમની સોળમી સદીનો ગણાય.

૧-૨. આને લગતી અવચૂરિઓ વિ. સં. ૧૪૫૯માં રચાઈ છે.

૩. ‘વિભક્તિશ્ચ’ એ પાણિનીય અષ્ટા. (અ. ૧, પા. ૪)નું ‘૧૦૪મું સૂત્ર છે.

૪. જુઓ પૃ. ૧૬-૧૮.

૫. આને ‘ભવન્તી’ અને ‘વૃત્તિ’ પણ કહે છે. એવી રીતે હ્યસ્તનીને ‘અનઘતનભૂત’, શ્વસ્તનનીને ‘અનઘતન-ભવિષ્યત્’ અને ક્રિયાતિપત્તિને ‘સંકેત’ કહે છે. વળી ભવિષ્યન્તીને ‘સામાન્ય ભવિષ્યકાળ’ કહે છે.

૬-૭. જુઓ પૃ. ૬૬ = ૩૭.

૮. પાણિનીય અષ્ટા. પ્રમાણે આ દસ વિભક્તિનાં નામ અનુક્રમે નીચે મુજબ છે :- લટ્, (વિધિ) લિટ્, લોટ્, લડ્, લુટ્, લિટ્, (આશિષ) લિટ્, લુટ્, લૃટ્ અને લૃડ્ આને અંગે નીચે મુજબની કારિકા છે:-

‘લટ્ વર્તમાને લેટ્ વેદે ભૂતે લુટ્-લટ્-લિટસ્તથા । વિધ્યાશિષોસ્તુ લિટ્-લોટૌ લુટ્ લૃટ્ લૃડ્ ચ ભવિષ્યતિ ॥’

૯. ‘જૈ. ય. ગ્રં.’ના ગ્રંથાક ૧૨ તરીકે આ કૃતિ અગિયારમાં પલ્લવ પૂરતી સ્વોપજ ટીકા સહિત વીરસંવત્ ૨૪૩૫માં પ્રકાશિત કરાઈ છે. સમગ્ર ટીકા ઉપલબ્ધ હોય એમ જણાતું નથી.

કવિકલ્પદ્રુમ એ પદ્યાત્મક રચના છે અને એ ૧૧ પલ્લવોમાં વિભક્ત છે. પ્રથમ પદ્યમાં કર્તા પોતે કહે છે કે આ કૃતિ એ સિદ્ધહેમ નામના વ્યાકરણમાં નિર્દેશાયેલા ધાતુઓની પદ્યમાં વિચારણારૂપ છે. પ્રથમ પલ્લવમાં એમણે સર્વ ધાતુના અનુબંધો દર્શાવ્યા છે અને એમ કરતી વેળા એમણે સિ. હે.ના અમુક અમુક 'સૂત્રો ગૂંથી લીધાં છે. એમણે પલ્લવ ૨-૧૦માં અનુક્રમે 'ભ્વાદિ'થી માંડીને 'ચુરાદિ' સુધીના નવ ગણના ધાતુઓનો અને ૧૧મા પલ્લવમાં 'સૌત્રાદિ' ધાતુઓનો વિચાર કર્યો છે.

બોપદેવે પણ 'કવિકલ્પદ્રુમ' નામનો ગ્રંથ રચ્યો છે. એના અનુકરણરૂપે હર્ષકુલગણિએ આ રચ્યો છે એમ મનાય છે.

‘તિડન્ત્વયોક્તિ-આ વ્યાકરણની કૃતિ ન્યાયાચાર્ય યશોવિજયગણિએ રચી છે. આનું આદ્ય પદ p. ૧૦૩ નીચે મુજબ છે. :- “ એન્દ્રવ્રજાભ્યર્ચિતપાદપદ્મં સુમેરુધીરં પ્રણિપત્ય વીરમ્ ।

વદામિ નૈયાયિકશાબ્દિકાનાં મનોવિનોદાય તિડન્ત્વયોક્તિમ્ ॥૧૧ ॥”

[ઉક્તિરત્નાકર : સાધુસુન્દરગણી. પ્રકા. રાજસ્થાન પુરાતત્ત્વ મંદિર, જયપુર.]

[ઋગાદિપ્રકરણમ્ : સંયોજક-મુનિ ચોથમલ. પ્રકા. જૈન વિશ્વભારતી, લાડનું.]

[હૈમનૂતનલઘુપ્રક્રિયા : પં. ચન્દ્રશેખર ઝા. સંપા. આ. ચન્દ્રોદયસૂરિ. પ્રકા. અનંતનાથ દેરાસર, સૂરત.]

Treasures of Jain Bhandaras Dr. U. P. Shah એલ. ડી. સિરિજ-૬૯

શ્રીશાન્તિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા ગુજરાતી આ. શીલચન્દ્રસૂરિ એલ. ડી. સિરિજ-૧૦૧ અંગ્રેજી ૧૦૨.

[વૈયાકરણ ન્યાયદર્શ : ગિરજાશંકર શાસ્ત્રી. સંપા. આ. ચન્દ્રગુપ્તસૂરિ.]



૧. આ સૂત્રોના અંક ઉપર્યુક્ત આવૃત્તિમાં અપાયા છે.

૨. કવિકલ્પદ્રુમ નામની એક અજ્ઞાતકર્તૃક કૃતિ છે અને એના ઉપર વિજયવિમલની અવચૂરિ છે.

૩. આ નામથી તો એની એકે હાથપોથી જિ. ૨. કો.માં નોંધાયેલી નથી. આ કૃતિને કેટલાક તિડન્તાન્વયોક્તિ કહે છે. [“યશોભારતીપ્રકાશન” મુંબઈથી પ્રસિદ્ધ “ગ્રન્થત્રયી”માં (અપૂર્ણ) ‘તિડન્તાન્વયોક્તિ’ આ. યશોદેવસૂરિજીના સંપાદન પૂર્વક છપાઈ છે આમાં શબ્દ વિષે દાર્શનિક ચર્ચા છે.]

૪. એમની જીનવરેખા મેં “ન્યાયાચાર્યને વંદન” નામના લેખમાં આલેખી છે. એ લેખનું શીર્ષક કોઈકને હાથે બદલાઈને એ લેખ “જૈન” (સાપ્તાહિક)ના તા. ૭-૩-૫૩ના અંકમાં પ્રસિદ્ધ કરાયો છે. આ ગણિવર્ચન અંગેની વિવિધ કિંવદન્તીઓ “ન્યાયાચાર્યને અંગેની કેટલાક કિંવદન્તીઓ” નામના મારા લેખમાં અપાઈ છે. એ લેખ “ગુ. મિ. તથા ગુ. દ.” (સાપ્તાહિક)ના તા. ૮-૬-૫૩ના અંકમાં છપાયો છે. “વાચક જશનું વંશવૃક્ષ” “આ. પ્ર.” (પુ. ૫૦, અં. ૧૦)માં, “વાચક યશોવિજયની ચોવીસીઓ” “જૈ. સ. પ્ર.” (વ. ૨૧, અં. ૧૦)માં, “દિક્ષપટ ચૌરાસી બોલ પ્રત્યુક્તિ (૮૪ બોલ વિચાર): રેખાદર્શન” “જૈ. સ. પ્ર.” (વિ. ૨૧, અં. ૧૧)માં, ‘થયપરિણા (સ્તવપરિણા) અને એની યશોવ્યાખ્યા’ “જૈ. સ. પ્ર.” (વ. ૨૧, અં. ૧૨)માં, “નવનિધાન નવ સ્તવનો” “આ. પ્ર.” (પુ. ૫૩, અં. ૧૧-૧૨)માં અને “છ બોલની વિહરમાણ-જિનવીસીનું વિહંગાવલોકન” “જૈ. ધ. પ્ર.” (પુ. ૭૨, અં. ૧૧)માં છપાયા છે, જ્યારે “તાર્કિક હરિયાળી સ્વોપજ વિવેચન સહિત”, “ન્યાયાચાર્યને વંદન” અને “વાચક જશનું વંશવૃક્ષ” એ ત્રણને ન્યાયાચાર્યને અંગેના ટૂંક સમયમાં પ્રસિદ્ધ થનારા નિબંધસંગ્રહમાં સ્થાન અપાયું છે.

પ્રકરણ ૪ : કોશ યાને નામમાલા

ભાષાની સમૃદ્ધિ-સામાન્ય રીતે એમ મનાય છે કે કોઈ પણ ભાષા, પછી તે ગમે તેટલી સમૃદ્ધ હોય તો પણ તે માનવ જાતિના પ્રત્યેક વિચારને અને એની હરકોઈ લાગણીને પરિપૂર્ણ સ્વરૂપે રજૂ કરી શકે નહિ. બાકી દરેક ભાષા પાસે ખપપૂરતો તો શબ્દ-ભંડોળ હોય જ; નહિ તો એ દ્વારા વ્યવહાર કેમ ચાલે ? જે ભાષા પાસે અર્થના જાતજાતના સૂક્ષ્મ ભેદો (shades of meaning) ને રજૂ કરવા માટે યોગ્ય શબ્દ હોય-પુષ્કળ પર્યાયો હોય અને જેનામાં સંયોગાનુસાર નવા નવા શબ્દો યોજવા માટેની અનુકૂળતા હોય તે સમૃદ્ધ ગણાય. આવી એક આગળ પડતી સમૃદ્ધ ભાષા તે ‘સંસ્કૃત’ છે.

નિઘંટુ-ભાષાનો શબ્દ-ભંડોળ તે એનો ‘કોશ’ કહેવાય છે. કાવ્યો કરવા માટે તેમજ અન્ય પ્રકારનું કથન કે લખાણ સમજવા માટે કોશ ઉપયોગી છે. આથી આપણે ત્યાં સૌથી પ્રથમ વૈદિક શબ્દોના અર્થોના સ્પષ્ટીકરણ માટે નિઘંટુની રચના થઈ છે. નિઘંટુનો સામાન્ય અર્થ ‘કોશ’ છે. એને ‘નામસંગ્રહ’ તેમજ ‘નામમાલા’ પણ કહે છે. એને માટેનો અંગ્રેજી શબ્દ લેક્સિકૉન (lexicon) છે.

ત્રિવિધ કોશ-સંસ્કૃત ભાષામાં ગુજરાતી, અંગ્રેજી વગેરે ભાષાઓની પેઠે એકાર્થક તેમજ અનેકાર્થક

P. ૧૦૫ એમ ઉભય પ્રકારના શબ્દો છે. વળી આ તેમજ પાઈય વગેરે ભાષામાં એકાક્ષરી શબ્દો પણ છે. આને લઈને આપણને સંસ્કૃત ભાષાને અંગે ચાર અને એક રીતે ત્રણ પ્રકારના કોશો મળે છે.

(૧) એકાર્થક નામમાલા

અમર-કોશ-આજકાલ અકારાદિ કમે શબ્દોને રજૂ કરી તેના અર્થ આપનારા કોશો જોવાય છે. એની રચના ગદ્યમાં હોય છે. વિવિધ પ્રકારના આવા કોશને અંગ્રેજીમાં વોકેબ્યુલરિ (vocabulary) અને મોટાને ડિક્શનરિ (dictionary) કહે છે. અનેકાક્ષરી એકાર્થક સંસ્કૃત કોશોની રચના વિષયોને લક્ષીને પદ્યમાં કરાયેલી જોવાય છે. એ એક જાતના ‘પર્યાય-કોશ’ છે. આ જાતનો સુપ્રસિદ્ધ કોશ એ અમર-કોશ છે. એ નામલિંગાનુશાસનના પ્રણેતાનું નામ અમરસિંહ છે. એ અમરસિંહ ‘બૌદ્ધ’ ગણાય છે. કોઈ આધુનિક જૈન મુનિવરો એમ કહેતા સંભળાય છે કે અમરસિંહ તો જૈન છે અને અમર-કોશનો જૈન તીર્થંકરો વિષે પ્રકાશ પાડતો ‘દેવાધિદેવ’ કાંડ હોવો જોઈએ અને એ માટે પ્રાચીન તાડપત્રીય પ્રતિઓ તપાસાવી ઘટે. આ બાબત એક યા બીજી રીતે સાચી સિદ્ધ ન થાય ત્યાં સુધી અમરસિંહને હું ‘અજૈન’ ગણું છું.

૧. પ્રકૃતિ, પ્રત્યય, ઉપસર્ગ ઇત્યાદિનો ઉપયોગ કરી નવા શબ્દો યોજી શકાય એ બળ તો સંસ્કૃત ભાષામાં છે, પરંતુ વિદેશી શબ્દોને પચાવવાની અને અપનાવવાની જે શક્તિ પાઈય ભાષામાં છે તે આ ભાષામાં નથી, અને એ માટે એના કહેવાતા ઈજારદારોનો પવિત્રતા સંબંધીનો વધુ પડતો આગ્રહ જવાબદાર છે.

૨-૩. એકાક્ષરી એકાર્થક કોશ, એકાક્ષરી અનેકાર્થક કોશ, અનેકાક્ષરી એકાર્થક કોશ અને અનેકાક્ષરી અનેકાર્થક કોશ આ પૈકી એકાક્ષરી એકાર્થક કોશની રચના સ્વતંત્ર સ્વરૂપે ભાગ્યે જ જોવાય છે, કેમકે પ્રાયઃ એની યોજના અનેકાક્ષરી એકાર્થક કોશમાં અંતર્ગત કરાવેલી માલૂમ પડે છે. આથી કોશના ત્રણ મુખ્ય પ્રકાર ગણાય.

‘ધનંજય-નામમાલા (ઉ. વિક્રમની ૧૧મી સદી) - આના કર્તા એક દિ. ગૃહસ્થ નામે ધનંજય P. ૧૦૬ છે. એમણે ૪૬ પદોની ‘અનેકાર્થ-નામમાલા, ‘રાઘવ-પાણ્ડવીય નામનું દ્વિસંધાન-કાવ્ય અને ૩૮ કે ૪૦ પદનું ‘વિષાપહારસ્તોત્ર એમ અન્ય ત્રણ કૃતિઓ રચી છે. ‘અનેકાર્થ-નિઘંટુ એમની કૃતિ છે કે એમના નામરાશિ ધનંજયની છે એનો નિર્ણય કરવો બાકી રહે છે.

દ્વિસંધાન-કાવ્યના અંતિમ પદની ટીકામાં એના કર્તાએ-ટીકાકારે ધનંજયનાં માતા, પિતા અને P. ૧૦૭ ગુરુનાં નામ અનુક્રમે શ્રીદેવી, વસુદેવ અને દશરથ દર્શાવ્યા છે.

પ્રસ્તુત ધનંજય વિક્રમની અગિયારમી સદીની પહેલાં થયા છે એમ બેધડક કહી શકાય, કેમકે પ્રેમેયકમલમાર્તંડ (પૃ. ૪૦૨)માં એના કર્તા પ્રભાચંદ્રે અને વાદિરાજસૂરિએ વિ. સં. ૧૦૮૨માં રચેલા પાર્શ્વનાથચરિત ()માં એમના દ્વિસંધાનકાવ્યનો ઉલ્લેખ કર્યો છે. જલ્દણે રચેલી સૂક્તિમુક્તાવલીમાં જે રાજશેખરના નામે એક ‘સૂક્તિ ધનંજયકૃત દ્વિસંધાનકાવ્યની પ્રશંસારૂપે જોવાય છે. એ રાજશેખર ‘કાવ્યમીમાંસાના કર્તાથી અભિન્ન જ હોય તો આ ધનંજય દસમી સદીની પછી થયા નથી એમ કહેવાય.

દિ. જિનસેનના ગુરુ વીરસેને ધવલા નામની ટીકા વિ. સં. ૮૭૩માં પૂર્ણ કરી છે. એમાં પૃ. ૩૮૭માં ‘‘હેતાવેવં’’થી શરૂ થતું પદ અવતરણરૂપે અપાયું છે. આ જ પદ અનેકાર્થ-નામમાલામાં ૪૦માં (અન્ય આવૃત્તિ પ્રમાણે ૩૯માં) પદરૂપે પણ જોવાય છે. એ ઉપરથી પં. મહેન્દ્રકુમારે ધનંજયનો સમય

૧. આ કૃતિ (શ્લો. ૨૦૫)ની, ધનંજયકૃત અનેકાર્થ-નામમાલા, પં. મોહનલાલ જૈનની એના ઉપરની તેમજ પ્રસ્તુત કૃતિ ઉપરની હિંદી ‘‘આદર્શ ટીકા’’ તેમજ અનેકાર્થવાચક શબ્દો અને હિંદી અર્થ સહિતની ચોથી આવૃત્તિ શ્રી હરપ્રસાદ જૈન વિ. સં. ૧૯૯૯માં પ્રકાશિત કરી છે. આમાં પહેલી નામમાલામાં કયા કયા શબ્દના પર્યાય અપાયા છે તેની અકારાદિ ક્રમે નોંધ છે.

પ્રસ્તુત ધનંજય-નામમાલા ત્રૈવિધ અમરકીર્તિકૃત ભાષ્ય, ધનંજયકૃત અનેકાર્થ-નામમાલા અને એની ટીકા, ધનંજયકૃત અનેકાર્થ-નિઘંટુ અને એકાક્ષરી કોષ તેમજ (૧-૨) બંને નામમાલાના અને (૩) પ્રથમ નામમાલાના ભાષ્યના શબ્દોની, (૪) યૌગિક શબ્દોની, (૫) અનેકાર્થ-નિઘંટુના શબ્દોની (૬) ભાષ્યગણ અવતરણોની તેમજ (૭) ભાષ્યગત ગ્રંથો અને ગ્રંથકારોનાં નામોની એમ સાતની અકારાદિ ક્રમે સૂચી (અનુક્રમણિકાઓ), ડૉ. પી. એલ. વૈદ્યના અંગ્રેજી તેમજ હિંદીમાં એકેક પાનાના પ્રાકૃત્યન અને પં. મહેન્દ્રકુમારની હિંદી પ્રસ્તાવના સહિત ‘‘ભારતીય જ્ઞાનપીઠ કાશી’’ તરફથી ઈ.સ. ૧૯૫૦માં પ્રકાશિત થઈ છે. એનું સંપાદન પં. શંભુનાથ ત્રિપાઠીએ કર્યું છે. સાથે સાથે એમણે સંસ્કૃત ટિપ્પણીઓ આપી છે.

૨. આ પ્રકાશિત છે. જુઓ ઉપર્યુક્ત ટિપ્પણ.

૩. આ કાવ્ય ટીકા સહિત ‘‘કાવ્યમાલા’’માં ઈ. સ. ૧૮૯૫માં પ્રકાશિત કરાયું છે. આ સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ પ્રકરણ ૧૯.

૪. આ ‘‘કાવ્યમાલા’’ના સપ્તમ ગુચ્છકમાં છપાયું છે. આની ત્રીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૦૭માં છપાઈ છે.

૫. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧.

૬. ‘‘દ્વિસન્ધાને નિપુણતાં સ તાં ચક્રે ધનજયઃ । યયા જાતં ફલં તસ્ય સતાં ચક્રે ધનં જયઃ ॥’’

અર્થાત્ ધનંજયે (અર્જુને) દ્વિ-સંધાન કાવ્યમાં (બેવડા નિશાન લગાવવામાં જે નિપુણતા પ્રાપ્ત કરી એથી એને (કવિને અને અર્જુનને) સજ્જનોમાં ધન અને કીર્તિરૂપે ફળ મળ્યાં.

૭. આના કર્તા રાજશેખરનો ઉલ્લેખ સોમદેવ (ઈ. સ. ૯૬૦)કૃત યશસ્તિલકચંપૂમાં છે.

નવમી સદીની પછીનો નથી એમ કહ્યું છે, પરંતુ પ્રો. વેલણકરે જિ. ૨૦ કો. (ખંડ ૧, પૃ. ૨૧૧)માં એમ P. ૧૦૮ સૂચવ્યું છે કે આ પદ્ય મૂળે ધનંજયનું નહિ, પરંતુ કોઈ પ્રાચીન કૃતિનું હશે. શકસંવત્ ૭૦૫માં હરિવંશ-પુરાણ રચનારા દિ. જિનસેન પહેલાએ તેમજ જયધવલાને સંવત્ ૮૯૪માં પૂર્ણ કરનારા દિ. જિનસેન બીજાએ પણ કવિઓની પ્રશંસા કરતી વેળા ધનંજયનું નામ લીધું નથી એ હકીકત પણ વિચારવી ઘટે.

ધનંજય-નામમાલાની ઈ. સ. ૧૯૫૦ની ઉપર્યુક્ત આવૃત્તિમાં ૨૦૩ પદ્યો છે, જ્યારે અન્યત્ર ૨૦૫ છે. આ આવૃત્તિનું ૨૦૧મું 'પદ્ય ધનંજયની કૃતિની પ્રશંસારૂપ છે એટલે એ ધનંજયનું કેમ હોઈ શકે ? તેમ છતાં પં. મહેન્દ્રકુમારે એને ધનંજયનું જ માની એમની પૂર્વ સીમા નક્કી કરી છે - દિ. અકલંક પછી એઓ થયા છે એમ કહ્યું છે.

ધનંજય-નામમાલામાં અસલ બસો જ પદ્યો હોવાં જોઈએ એમ લાગે છે, જો કે એની એક આવૃત્તિમાં ૨૦૩ અને બીજામાં ૨૦૫ પદ્યો જોવાય છે.

ધનંજયે એક શબ્દ ઉપરથી શબ્દાંતર બનાવવા માટે વિશિષ્ટ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. દા. ત. 'પૃથ્વી'વાચક શબ્દો રજૂ કરી એની આગળ 'ધર' શબ્દ જોડી 'પર્વત'વાચક શબ્દો, 'મનુષ્ય'વાચક શબ્દ આગળ 'પતિ' જોડી 'નૃપ'વાચક શબ્દો અને 'વૃક્ષ'વાચક શબ્દ આગળ 'ચર' જોડી 'વાનર'વાચક શબ્દો બનાવવાની વાત એમણે કહી છે.

ભાષ્ય—એના કર્તા અમરકીર્તિ છે. એમણે પર્યાયવાચક શબ્દોને રજૂ કરતી આ ધનંજય-નામમાલા ઉપર આ ભાષ્ય સંસ્કૃતમાં રચ્યું છે. એ દ્વારા એમણે શબ્દદીઠ પર્યાયોની સંખ્યા દર્શાવી પ્રત્યેક શબ્દની P. ૧૦૯ વ્યુત્પત્તિ સૂત્રના નિર્દેશપૂર્વક આપી એનું સ્પષ્ટીકરણ કર્યું છે. વળી એમણે અન્ય પર્યાયવાચક શબ્દો કોઈ કોઈ વાર ઉમેર્યા છે. અમરકોશની સુપ્રસિદ્ધ ટીકામાં એના ટીકાકાર ક્ષીરસ્વામીએ જે શૈલીએ કામ કર્યું છે એ શૈલીએ આ ભાષ્ય રચાયું છે.^૧ ધનંજય-નામમાલા (શ્લો. ૧૨૨)ના ભાષ્ય (પૃ. ૬૨)માં આશાધર-મહાભિષેકનો ઉલ્લેખ છે. આ દિ. આશાધરે વિ. સં. ૧૩૦૦માં અનગાર-ધર્મામૃતની સમાપ્તિ કરી હતી એટલે આ અમરકીર્તિના સમયની પૂર્વ સીમા છે. અમરકીર્તિએ ભાષાના પ્રારંભમાં કલ્યાણકીર્તિને નમસ્કાર કર્યો છે. એ કલ્યાણકીર્તિ તે વિ. સં. ૧૩૫૦માં જિનયજ્ઞલોદયને સમાપ્ત કરનાર જ હોય તો એ અમરકીર્તિના સમયની ઉત્તર સીમા ગણાય. અમરકીર્તિએ હૈમ નામમાલાનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે એટલે એમનો સમય આ કૃતિની રચના પછી લગભગ પચાસેક વર્ષ જેટલો તો મોડો હશે જ.

નિઘંટ-સમય-આ નામથી બે પરિચ્છેદ પૂરતી ધનંજયની નામમાલાની નોંધ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૧૨)માં લેવાઈ છે તો એ નામમાલા તે કઈ ?

ધનપાલીય કોશ (ઉ. વિક્રમની ૧૧મી સદી)- આ કોશના કર્તા જન્મે વૈદિક ધર્માવલંબી વિપ્ર ધનપાલ છે. આગળ જતાં એમના લઘુ બંધુ શોભન મુનિવરને હાથે પ્રતિબોધ પામી એમણે જૈન ધર્મ

૧. આ રહ્યું એ પદ્ય :-

“પ્રમાણમકલઙ્કસ્ય પૂજ્યપાદસ્ય લક્ષણમ્ । દ્વિસન્ધાનકવેઃ કાવ્યં રત્નત્રયમપશ્ચિમમ્ ॥૨૦૧॥”

૨. જુઓ ડો. પી. એલ. વૈદ્યનું પ્રાક્કથન.

સ્વીકાર્યો હતો. એમના પિતા અને પિતામહનાં નામ અનુક્રમે સર્વદેવ અને 'દેવર્ષિ' હતાં. એ ધનપાલને સુંદરી નામે બેન હતી. એ ધનપાલ 'ધારા'નગરીના રાજા 'મુંજના માનીતા હતા. એમને એ રાજા 'સરસ્વતી' કહેતા.^૩ મુંજ પછી ગાદીએ આવનાર 'ભોજ રાજાએ એમને સિદ્ધસારસ્વત, કવીશ્વર અને પ. ૧૧૦ કૂર્યાલ-સરસ્વતીનાં બિરુદ આપ્યાં હતાં એમણે ઉપર્યુક્ત કોશ ઉપરાંત નીચે મુજબની બે સંસ્કૃત કૃતિઓ રચી છે :-

(૧) 'તિલકમંજરી અને (૨) 'શોભન-સ્તુતિની ટીકા.

એમણે સર્વાંશે પાઠ્યમાં નીચે મુજબની ચાર કૃતિઓ રચી છે :- (૧) 'ઉસભ-પંચાસિયા, (૨) 'પાઠ્ય-લચ્છી-નામમાલા, (૩) 'વીર-થુઈ (૩૦ પદ્યો) અને (૪) સાવયવિહિ.

આ ઉપરાંત એમણે દસ પદ્યની 'વીર-થુઈ અર્ધ-સંસ્કૃતમાં અને 'સચ્ચઉરમંડણ' મહાવીર-ઉચ્છાહ 'અપભ્રંશ'માં રચ્યાં છે.

આ કવિવર ધનપાલે કોશ રચ્યો હતો એમ અભિ. ચિ. (કાંડ ૧, શ્લો. ૧)ની સ્વોપજ વિવૃતિ (પૃ. ૧)માં જે "વ્યુત્પત્તિર્ધનપાલતઃ" એવો ઉલ્લેખ 'કલિ.' હેમચન્દ્રસૂરિએ કર્યો છે એ ઉપરથી અનુમાનાય છે. એક પ. ૧૧૧ ટિપ્પણીમાં ૧૮૦૦ શ્લોક જેવડી નામમાલાના કર્તા તરીકે ધનપાલનો ઉલ્લેખ છે.^{૧૨} એ નામમાલા પાઠ્ય-લચ્છી-નામમાલાથી મોટી હોઈ એનાથી તો ભિન્ન ગણાય, પણ શું એ નામમાલા સંસ્કૃતમાં છે અને તે જ આ કોશ છે ? વિશેષમાં આ કોશ રચાયો ત્યારે ધનપાલ 'જૈન' બન્યા હતા કે નહિ એ પ્રશ્ન પણ વિચારવાનો રહે

૧. એઓ મધ્યદેશમાં 'સંકાસ્ય' નામના નિવેશમાં રહેતા હતા. એને સંયુક્ત પ્રાંતના ફરૂકાબાદ જિલ્લાના 'સંકિસ' ગામ તરીકે ઓળખાવાય છે.

૨. એમનું વિ. સં. ૧૦૩૧નું દાનપત્ર મળે છે. એ રાજાનું મૃત્યુ વિ. સં. ૧૦૫૦થી ૧૦૫૪ના ગાળામાં થયું હતું. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૧૮૮)

૩. જુઓ તિલકમંજરી (શ્લો. ૫૩).

૪. એમનો સમય વિ. સં. ૧૦૭૪થી ૧૧૧૬નો ગણાય છે.

૫. આ "કાવ્યમાલા" (૮૫)માં ઈ. સ. ૧૮૦૩માં છપાયેલી છે.

૬. આ સ્તુતિ આ ટીકા સહિત "આ. સ." તરફથી ઈ. સ. ૧૮૨૬માં છપાઈ છે. વળી એ સ્તુતિ "આ. સા." તરફથી અન્ય સંસ્કૃત ટીકાઓ સહિત ઈ. સ. ૧૮૩૦માં પ્રકાશિત થઈ છે. આ બંનેનું સંપાદન મેં કર્યું છે.

૭. આ "દે. લા. જૈ. પુ. સં." તરફથી ઈ. સ. ૧૮૩૩માં પ્રકાશિત થઈ છે. એમાં આજ ધનપાલની વિરોધાલંકારથી વિભૂષિત ૩૦ પદ્યોની વીરથુઈ તેમજ દસ પદ્યોની અર્ધ-સંસ્કૃત વીર-સ્તુતિ છપાયેલી છે. આનું સંપાદન મારે હાથે થયું છે.

૮. આની રચના વિ. સં. ૧૦૨૮માં થયાનો એમાં ઉલ્લેખ છે. આ પ્રકાશિત છે. એના પરિચયાદિ માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૫૬, ૫૮, ૨૪૨ અને ૨૪૩).

૯-૧૦. આ પ્રકાશિત છે. જુઓ ટિ. પ.

૧૧. આ "જૈ. સા. સં." (ખંડ ૩, અંક ૩)માં છપાયેલો છે. એના પરિચયાદિ માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૨૦૩).

૧૨. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૧૮૮).

છે, જો કે અહીં તો એમણે જૈન તરીકે આ કોશ રચ્યાનું મેં માની લીધું છે. વિશેષમાં આ કોશ શબ્દોની કેવળ વ્યુત્પત્તિ પૂરતો જ નહિ હશે, પરંતુ એના પર્યાયો પૂરા પાડતો હશે એવી હું કલ્પના કરું છું.

નિઘંટુ (લ. વિ. સં. ૧૦૮૦)- વર્ધમાનસૂરિએ વિ. સં. ૧૧૪૦માં મનોરમા-ચરિય^૧ રચ્યું છે. એની પ્રશસ્તિ (શ્લો.) ઉપરથી જણાય છે કે (વિ. સં. ૧૦૮૦માં બુદ્ધિસાગર વ્યાકરણ રચનારા) બુદ્ધિસાગરસૂરિએ વ્યાકરણ, છંદ, નિઘંટુ, કાવ્ય, નાટક, કથા, પ્રબંધ ઇત્યાદિ રચ્યાં છે. આમ અહીં જે નિઘંટુનો ઉલ્લેખ છે તેથી અભિ. ચિ. જેવો કોશ સમજવાનો હશે. જો એ વનસ્પતિને અંગેનો જ કોશ હોય અને સાથે સાથે એ સંસ્કૃતમાં હોય એ એ હૈમ નિઘંટુ-શેષ કરતાં પ્રાચીન ગણાય. બુદ્ધિસાગરસૂરિનો આ કોશ કે એમણે રચેલી કાવ્ય, નાટક, કથા કે પ્રબંધને અંગેની કોઈ કૃતિ હજી સુધી તો મળી આવેલ નથી.

P. ૧૧૨

અભિધાન-ચિન્તામણિ (લ. વિ. સં. ૧૨૦૭)- આ નામમાલાના-કોશના કર્તા 'કલિ.' હેમચન્દ્રસૂરિ છે. એમણે આ કોશ ઉપરાંત 'અનેકાર્થ-સંગ્રહ' અને 'નિઘંટુશેષ' તેમજ દેસિય (દેશ્ય) શબ્દોને અંગે 'રચણાવલિ' યાને દેસિસદ્સંગ્રહ એમ બીજા ત્રણ કૌશો રચ્યા છે, અને એ દ્વારા વ્યાકરણના જ્ઞાનને સક્રિય બનાવવા માટે અને વિદ્યાર્થીઓને સંસ્કૃતાદિ ભાષાનું જ્ઞાન મેળવવા માટે માર્ગ મોકળો કર્યો છે.

૧. [રુપેન્દ્રકુમાર પગારિયા સંપાદિત મનોરમાકહા નામે આ એલ.ડી.ઈસ્ટી. અમદાવાદથી પ્રસિદ્ધ છે.]

૨. આના અર્થ માટે જુઓ નિઘંટુ-શેષને લગતું મારું લખાણ (પૃ. ૧૨૪).

૩. આ કોશ વિદ્યાકર મિશ્રે ઈ. સ. ૧૮૦૮માં કલકત્તાથી બહાર પાડ્યો હતો. ત્યારબાદ એ અભિધાન-સંગ્રહમાં બીજા ભાગ તરીકે "મહાવીર જૈન સભા" તરફથી ખંભાતથી શકસંવત્ ૧૮૧૮માં પ્રસિદ્ધ કરાયો હતો. વળી એ કોશ સ્વોપજ વિવૃત્તિ સહિત "ય. જૈ. ગ્રં." તરફથી વીરસંવત્ ૨૪૪૬માં છપાવાયો છે. બીજા ભાગ તરીકે મૂળ કોશમાંના શબ્દોની સૂચિ તેમજ સ્વોપજ વિવૃત્તિમાં નોંધેલા શેષ શબ્દોની સૂચિ, સ્વોપજ વિવૃત્તિમાં નિર્દેશાયેલા ગ્રંથકારોની નામાવલી સહિત આ જ સંસ્થા તરફથી એ જ (વીરસંવત્ ૨૪૪૬) વર્ષમાં પ્રકાશિત થયો છે. બીજા ભાગનું તમામ સંપાદન મુનિશ્રી જયંતવિજયજીએ કર્યું છે. વળી "મુક્તિ-કમલ-જૈન-મોહન-માલા"માં ૨૧મા પુષ્પ તરીકે એ કોષ સ્વોપજ તત્વાભિધાયિની વૃત્તિને અનુસરનારી રત્નપ્રભા વ્યાખ્યા તેમજ શેષનામમાલા, જિનદેવકૃત શિલોંછ અને સુધાકલશકૃત એકાક્ષર-નામમાલા એ ત્રણ પરિશિષ્ટો સહિત છપાયો છે. એનું સંશોધન મુનિશ્રી ધર્મવિજયજીએ (હવે શ્રીવિજયધર્મસૂરિએ) કર્યું છે. આ ઉપરાંત "દે. લા. જૈ. પુ. સં." તરફથી આ કોશ અકારાદિ ક્રમપૂર્વકની શબ્દાનુક્રમણિકા તેમજ નિમ્નલિખિત અન્ય કૃતિઓ સહિત ઈ. સ. ૧૯૪૬માં પ્રકાશિત કરાયો છે.

(અ) શેષનામમાલા, (આ) જિનદેવકૃત શિલોંછ, (ઇ) (હૈમ) નિઘંટુશેષ, (ઈ) (હૈમ) લિંગાનુશાસન, (ઉ) એકાક્ષર-કોશ, (જી) પુરુષોત્તમે રચેલો શબ્દભેદપ્રકાશ અને (ઝ) સુધાકલશકૃત એકાક્ષર-નામમાલા. [વિ. સં. ૨૦૩૨માં જૈન સાહિત્યવર્ધકસભા અ. ચિં. સ્વોપજટીકા સાથે પ્રગટ કર્યો છે. સંપાદક આ. હેમચન્દ્રસૂરિએ સાર્થ શબ્દસૂચી પણ આપી છે. આની બીજી આવૃત્તિ હમણાં જ બહાર પડી છે. મુનિ પૂર્ણચન્દ્ર વિ. આદિએ સંકલિત કરેલ 'અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયાકોશ' વિ. ૨૦૪૪માં જિ. આ. ટ્ર. પ્વારા બે ભાગમાં બહાર પડ્યો છે. આમાં અ. ચિ. ના શબ્દો અકારાદિક્રમે અને સામે ટીકાનો અંશ પર્યાય તથા અર્થ ગુજરાતીમાં આપ્યો છે. સં. મુનિચન્દ્ર વિ.] 'સાર્થ શબ્દાવલી' નામે પણ અભિધાન ચિ. શેષ, શિલોંછના શબ્દો અકારાદિક્રમે પ્રગટ થયેલ છે.]

૪-૫ આનો પરિચય આગળ ઉપર અપાયો છે.

૬. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૫૮-૫૯).

યોજના આ નામમાલામાં રૂઢ, યૌગિક યાને વ્યુત્પત્તિ વડે સિદ્ધ અને મિશ્રશબ્દોને 'અમરકોશની' પેઠે ભિન્ન ભિન્ન કાંડમાં પર્યાયવાચક શબ્દો સહિત રજૂ કરાયા છે. અહીં નીચે મુજબનાં નામથી અલંકૃત P. ૧૧૩ છ કાંડો છે:-

(૧) દેવાધિદેવ, (૨) દેવ, (૩) મર્ત્ય, (૪) તિર્યચ, (૫) નારક અને (૬) સાધારણ, એમાં શ્લોકોની સંખ્યા નીચે મુજબ છે:-

૮૬, ૨૫૦, ૫૮૭, ૪૨૩, ૭ અને ૧૭૮.

આમ અહીં એકંદર ૧૫૪૧ શ્લોકો છે. આ દૃષ્ટિએ આ કોશ અમરકોશથી લગભગ દોઢો છે.

મહત્વ-અભિ. ચિ.માં કેટલાક 'દેશ્ય' શબ્દો પણ સંસ્કૃત તરીકે નોંધાયેલા જણાય છે.^૨ આથી ગુજરાતી વગેરે પ્રાદેશિક ભાષાઓના અભ્યાસી માટે આ કોશ ઉપયોગી છે.

વિષય-પ્રથમ કાંડમાં ઋષભદેવ વગેરે ૨૪ તીર્થંકરોનાં નામ અને લાંછન, એમના યક્ષાદિનાં નામ, તીર્થંકરના ૩૪ અતિશય વગેરે બાબતો છે.

દ્વિતીય કાંડમાં દેવો સંબંધી માહિતી અપાઈ છે. વળી કાલચક્રને અંગેના ઉત્સર્ગિણી અને અવસર્ગિણી એ બે વિભાગના છ છ આરાઓનું વર્ણન છે. ૧૪૭માં શ્લોકમાં 'બુદ્ધ' માટે 'ચતુર્સિંશજાતકજા' એવો પર્યાય અપાયો છે, અને એની સ્વોપજ વિવૃત્તિ (પૃ. ૧૦૦-૧૦૧)માં ૩૪ જાતક ગણાવાયાં છે.

ત્રીજા કાંડમાં મનુષ્યવાચક શબ્દો, મનુષ્યની શિશુત્વાદિ અવસ્થાઓ, ખાદ્યાદિ પદાર્થો, રોગો વગેરેને અંગેના શબ્દો તેમજ સગપણસૂચક શબ્દો ઇત્યાદિ અપાયા છે.

ચોથા કાંડમાં પૃથ્વીકાયાદિ પાંચ પ્રકારના એકેન્દ્રિય, ત્રણ પ્રકારના વિકલેન્દ્રિય અને ત્રણ જાતનાં P. ૧૧૪ પંચેન્દ્રિય તિર્યચ સંબંધી શબ્દો નોંધાયા છે.

પાંચમાં કાંડમાં નારકોને લગતા શબ્દો છે.

છઠ્ઠા કાંડમાં ભુવન અને જીવ તેમજ રૂપ વગેરે પાંચ જાતના વિષયોને લગતા શબ્દો છે અને અંતમાં અવ્યયોની સૂચી છે.

ઉપયોગ-અમરકોશમાંના કેટલાક શ્લોકો આ કોશમાં ગૂંથી લેવાયા હોય એમ જણાય છે. એવી રીતે વ્યાડિ વગેરેના કોશોનો પણ ઉપયોગ થયો હોય તો ના નહિ. કેટલીક વાર નામોલ્લેખ વિના પણ આમ કરાયું હોય તો તેમાં કંઈ નાનમ નથી, કેમકે હેમચન્દ્રસૂરિએ મૌલિક રચનાનો દાવો કર્યો નથી. એમને કંઈ પોતાના પાંડિત્યનું પ્રદર્શન કરવાનો મોહ ન હતો. એઓ તો વાત્સલ્યભાવે સર્વોપયોગી વસ્તુ સુગમ સ્વરૂપે જગત્ સમક્ષ મૂકવા અને ગુજરાતને સર્વતંત્ર-સ્વતંત્ર બનાવવા ઇચ્છતા હતા.

રચના-સમય-અભિ. ચિ.ના પ્રારંભમાં "સિદ્ધસાઙ્ગશબ્દાનુશાસનઃ" એવું વિશેષણ હેમચન્દ્રસૂરિએ પોતાને માટે વાપર્યું છે. એના ઉપરની સ્વોપજ વિવૃત્તિમાં 'સિદ્ધ'નો અર્થ 'પ્રતિષ્ઠા પામેલ' એવો એમણે

૧. અમરકોશમાં લિંગોનો સાથે સાથે જ અંતર્ગત સ્વરૂપે વિચાર કરાયો છે, જ્યારે અહીં કાંડ ૧, શ્લો. ૧૮માં સૂચવાયા મુજબ એ માટે લિંગાનુશાસન જોવાની ભલામણ કરાઈ છે.

૨. આવા કેટલાક શબ્દો હેમસમીક્ષા (પૃ. ૭૫-૭૭)માં નોંધાયા છે.

કર્ચો છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે એમનું પંચાંગ વ્યાકરણ તૈયાર થઈ આદરપાત્ર બન્યું ત્યાર બાદ આ કોશ એમણે રચ્યો છે.

ત્રીજા કાંડના નિમ્નલિખિત શ્લો. ૩૭૬-૩૭૭ ઉપરથી એ અનુમાન દોરાય કે કુમારપાલ નરેશ્વર ‘પરમાર્હત’ યાને જૈન બન્યા અને એમણે રાજ્યકારભાર ચલાવવા માંડ્યો ત્યાર પછી આ કોશની રચના થઈ છે:-

“કુમારપાલશૈલુક્યો રાજર્ષિઃ પરમાર્હતઃ ॥૩૭૬॥ મૃતસ્વમોક્તા ધર્માત્મા મારિવ્યસનમારકઃ ॥”

P. ૧૧૫ આ ઉપરથી આ કોશ વિ. સં. ૧૧૮૮ પછી ચારેક વર્ષે હેમસમીક્ષા (પૃ. ૭૦) પ્રમાણે વિ. સં. ૧૨૦૭-૮માં રચાયો હોય એમ જણાય છે.

સ્વોપજ વિવૃતિ—આનું નામ તત્વાભિધાયિની હોય એમ લાગે છે.^૧ લગભગ સાડા આઠ હજાર શ્લોક જેવડી આ વિવૃતિમાં પ્રારંભમાં શ્લો. ૩માં કહ્યું છે કે વાસુકિ અને વ્યાડિનાં પ્રામાણ્ય, ધનપાલમાંથી વ્યુત્પત્તિ અને વાયસ્પતિ વગેરેના પ્રપંચ અહીં લક્ષ્યમાં લેવાયાં છે. આમ આની રચનામાં સાધનીભૂત ગ્રંથોનો સંક્ષેપમાં નિર્દેશ છે. આ ઉપરાંતના ગ્રંથકારોનાં નામ “ય. જૈ. ગ્રં.”ની ઉપર્યુક્ત આવૃત્તિ અને એ પૂર્વે ‘ઓટ્ટો બોટલિંગ અને ચાર્લ્સ રિયુ દ્વારા સંપાદિત આવૃત્તિ ઉપરથી જાણી શકાય છે. એમાંથી સ્વેતાંબર આદ્ય વૈયાકરણ બુદ્ધિસાગર અને વિષ્ણુપુરાણ એ બે નામ હું અહીં નોંધું છું.

વિવૃતિ (પૃ. ૧૩)માં ત્રિષષ્ટિનો ઉલ્લેખ છે અને પૃ. ૧૦૦માં વ્યાડિના આધારે ૩૪ જાતકોનાં નામ અપાયાં છે.

આ વિવૃતિ ઉપરાંત આ અભિ. ચિ. ઉપર નીચે મુજબની નાની મોટી બીજી સાત ટીકા છે :-

- (૧) ટીકા-આના કર્તા કુશલસાગર છે.
- P. ૧૧૬ (૨) સારોદ્ધાર-‘ખરતર’ ગચ્છના જ્ઞાનવિમલના શિષ્ય શ્રીવલ્લભગણિએ આ ટીકા વિ. સં. ૧૬૬૭માં રચી છે. દુર્ગપદપ્રબોધ નામની ટીકા તે આ જ છે ? [આ. ધર્મધુરંધરસૂરિ સંપાદન કરે છે.]
- (૩) વ્યુત્પત્તિ-રત્નાકર— કલ્યાણસાગરસૂરિના રાજ્યમાં ‘અંચલ’ ગચ્છના રવિચન્દ્રના શિષ્ય દેવસાગરગણિએ વિ. સં. ૧૬૮૬માં આ ટીકા રચી છે. [સંપા. પં.શ્રીચન્દ્રવિજય ગ. પ્રકા. રાંદેર રોડ જૈન સંઘ-સૂરત]
- (૪) ટીકા-આના કર્તા ભાનુચન્દ્રગણિ છે
- (૫) ટીકા-આના રચનાર સાધુરત્ન છે.
- (૬) અવચૂરિ-જૈ. ગ્રં. (પૃ. ૩૧૦) પ્રમાણે આ અવચૂરિ ૪૫૦૦ શ્લોક જેવડી છે અને એની હાથપોથી પાટણમાં છે. આના કર્તાનું નામ જાણવામાં નથી.
- (૭) રત્નપ્રભા-આના કર્તા પં. વાસુદેવરાવ જનાર્દન કશેળીકર છે. એમાં કેટલીક વાર સંસ્કૃત શબ્દના ગુજરાતીમાં અર્થ અપાયા છે. દા. ત. જુઓ પૃ. ૧૦૬ અને ૧૦૭.

બીજક-અભિધાન-ચિન્તામણિ-નામમાલા-બીજક એ નામની ત્રણ કૃતિઓ જોવાય છે:-

૧. “મુ. ક. જૈ. મો.”માં છપાયેલી રત્નપ્રભાની (પ્રત્યેક કાંડના અંતમાં અપાયેલી) પુષ્પિકા જોતાં જણાય છે. દા.ત. ઇતિ પરમાર્હતં નામમાલાયા સ્વોપજતત્વાભિધાયિની-વૃત્યનુસારિણીરત્નપ્રભાવ્યાખ્યાયાં પ્રથમો દેવાધિદેવકાણ્ડઃ”
૨. Otto Bohtlingk. ૩. Charles Rieu. ૪. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૧૨, ટિ ૧= ૬૪ ટિ. ૩

(૧) 'તપા' ગચ્છના હીરવિજયસૂરિના શિષ્ય શુભવિજયગણિએ વિ. સં. ૧૬૬૧માં રચેલી કૃતિ. (૨) દેવવિમલગણિકૃત કૃતિ. (૩) અજ્ઞાતકર્તૃક કૃતિ.

અભિધાન-ચિંતામણિ-નામમાલા-પ્રતીકાવલી-આની એક હાથપોથી "ભા. પ્રા. સં. મં."માં છે. P. ૧૧૭ કર્તાનું નામ જાણવામાં નથી.^૧

શેષનામમાલા યાને શેષસંગ્રહનામમાલા-અભિ. ચિ.માં નહિ નોંધાયેલા એવા કેટલાક શબ્દોનો આ કોશ છે. એ પણ હેમચન્દ્રસૂરિની રચના છે. એમાં ૨૦૪ (૧+૮૮+૬૩+૪૧+૨+૮) શ્લોક છે.^૨

આ શબ્દકોશ ઉપર શ્રીવલ્લભગણિની અને કોઈક અન્યની એકેક ટીકા છે.

શિલોંછ (વિ. સં. ૧૪૩૩)- અભિ. ચિ.નાં બીજા વધારા તરીકે ૧૪૦ શ્લોકનો શિલોંછ જિનદેવે "ત્રિ-વસુ-ઈન્દુ"(?)થી સૂચિત વર્ષમાં રચ્યો છે. જિ. ર. કો. (ખંડ ૧, પૃ. ૩૮૩) પ્રમાણે આ રચના વિ. સં. ૧૪૩૩માં થઈ છે. જ્ઞાનવિમલના શિષ્ય શ્રીવલ્લભે વિ. સં. ૧૬૫૪માં આના ઉપર ટીકા રચી છે.

શબ્દરત્નપ્રદીપ (ઉ. વિ. સં. ૧૨૮૫)- સુમતિગણિએ ગણહરસદ્વસયગની વિ. સં. ૧૨૮૫માં રચેલી વૃત્તિમાં આનો અનેક વાર ઉલ્લેખ કર્યો છે. કલ્યાણમલ્લે પણ શબ્દરત્નપ્રદીપ રચ્યો છે તે તો આ કૃતિ નથી ? જો એ જ હોય તો આ અજ્ઞેન કૃતિ છે.

શબ્દચન્દ્રિકા- આ કોશની ૧૭ પત્રોની હસ્તલિખિત પ્રતિ લા. દ. વિદ્યામંદિરમાં છે. એના કર્તાનું નામ જાણવામાં નથી. આ પ્રતિ અપૂર્ણ હોય તો એના પછીના પત્રમાં કદાચ કર્તાનું નામ હશે. આના આદ્ય પદ્ય ઉપરથી એનું નામ 'બાલબોધ-પદ્ધતિ' અને દ્વિતીય ઉપરથી મનોરમા નામ હોવાનું અનુમાન છે. [હાંસિયામાં 'શબ્દચન્દ્રિકા' છે.]

સુન્દરપ્રકાશ, પદાર્થચિન્તામણિ કિંવા શબ્દાર્ણવ (ઉ. વિ. સં. ૧૬૧૮)-પદ્મમેરુના શિષ્ય P. ૧૧૮ પદ્મસુંદરે આ કોશ પાંચ પ્રકરણમાં રચ્યો છે. એની એક હાથપોથી વિ. સં. ૧૬૧૮માં લખાયેલી છે. આ કોશને કેટલાક પદાર્થચિન્તામણિ અને શબ્દાર્ણવ એ નામથી પણ ઓળખાવે છે. દિ. આનંદમેરુના શિષ્ય પદ્મમેરુના શિષ્ય પદ્મસુંદરે ચોવીસ તીર્થકરના ચરિત્રરૂપ અને રાયમલ્લ નામના શ્રાવકના નિર્દેશપૂર્વકનું રાયમલ્લાભ્યુદય કાવ્ય વિ. સં. ૧૬૧૫માં રચ્યું છે તો ઉપર્યુક્ત પદ્મસુંદર તે જ આ છે ?

શબ્દભેદનામમાલા (ઉ. વિ. સં. ૧૬૫૦)- આ 'મહેશ્વરની કૃતિ છે.' એના ઉપર 'ખરતર' ગચ્છના ભાનુમેરુના શિષ્ય જ્ઞાનવિમલે વિ. સં. ૧૬૫૪માં ૩૮૦૦ શ્લોક જેવડી વૃત્તિ રચી છે. શું આ

૧. નાગવર્માએ જે અભિધાન-રત્નમાલા રચ્યાનો જિ. ર. કો. (ખંડ ૧, પૃ. ૧૪)માં ઉલ્લેખ છે તેને પ્રસ્તુત અભિ. ચિ. સાથે કંઈ સંબંધ છે ખરો ?

૨. "ય. જૈ. ગ્રં."ની આવૃત્તિમાં "શેષશ્ચ"ના ઉલ્લેખપૂર્વક એ શબ્દો તે તે સ્થાનમાં વિવૃત્તિમાં અપાયા છે, જ્યારે બોટલિંક અને રિયુની આવૃત્તિમાં એ પરિશિષ્ટ રૂપે છપાયા છે અને અભિધાન-સંગ્રહમાં સાતમા કોશ તરીકે અપાયા છે. "દે. લા. જૈ. પુ. સં."ની આવૃત્તિમાં પણ આ કોશ છે.

૩. જુઓ હેમસમીક્ષા (પૃ. ૭૭-૭૮).

૪. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૧૨ = ૬૪ ટિ. ૩

૫. "દે. લા. જૈ. પુ. સં." તરફથી પ્રસિદ્ધ થયેલી આવૃત્તિમાં ૧૮૩૧નો ઉલ્લેખ છે તે ભ્રાંત છે.

૬. જુઓ જિ. ર. કો. (ખંડ ૧, પૃ. ૩૮૩).

૭. જૈ. ગ્રં. (પૃ. ૩૧૧)માં જે મહેશ્વરની કૃતિ તરીકે લિંગભેદનામમાલાનો ઉલ્લેખ છે તેઓ જ આ છે ? અહીં

લિંગભેદનામમાલાની કોઈએ વૃત્તિ રચ્યાની નોંધ છે. વિશ્વકોશના રચનારનું નામ પણ મહેશ્વર છે.

૮. જુઓ જિ. ર. કો. (ખં. ૧, પૃ. ૩૭૩). અહીં આ કૃતિનું શબ્દભેદપ્રકાશ એવું નામાંતર અપાયું છે.

મૂળ કૃતિ પુરુષોત્તમદેવે રચેલા 'શબ્દભેદપ્રકાશના જેવી છે ? જો એમ જ હોય તો એમાં અગાર અને આગાર, અખા અને આખા, અરાતિ અને આરાતિ એમ જરા જરા ફેરફારવાળા એકાર્થક શબ્દોની સૂચી હશે. [પંડિત વિનયસાગર દ્વારા શ. ભે. પ્ર.ની મુદ્રણયોગ્ય પ્રતિ તૈયાર કરવામાં આવી છે. એનું સંપાદન ટુંક સમયમાં થનાર છે.]

નામસંગ્રહ, નામમાલાસંગ્રહ કિંવા વિવિક્તનામસંગ્રહ (લ. વિ. ૧૬૬૦)- આના કર્તા ઉપા.

P. ૧૧૮ ભાનુચન્દ્રગણિ છે. એઓ વિજયદાનસૂરિના શિષ્ય સકલચન્દ્રના શિષ્ય સૂરચન્દ્રના શિષ્ય થાય છે.^૨ એમને વિ. સં. ૧૬૪૮માં લાહોરમાં 'ઉપાધ્યાય' પદ મળ્યું હતું. એઓ મોગલ સમ્રાટ અકબર આગળ દર રવિવારે સૂર્યસહસ્રનામ બોલતા હતા. એ ઉપા.ને શાંતિચન્દ્ર નામે એક વિદ્વાન શિષ્ય હતા. આ ભાનુચન્દ્રગણિએ નીચે મુજબની કૃતિઓ રચી છે:-

(૧) (પ્રસ્તુત) નામમાલાસંગ્રહ, (૨) રત્નપાલકથાનક (લ. વિ. સં. ૧૬૬૨) અને (૩) સૂર્યસહસ્રનામ.

આ ઉપરાંત એમણે નિમ્નલિખિત ગ્રંથો ઉપર વૃત્તિ રચી છે:-

(૧) *કાદંબરી (પૂર્વાર્ધ), (૨) *વસંતરાજશકુન, (૩) *વિવેકાવિલાસ^૩ અને (૪) સારસ્વત વ્યાકરણ.^૪

પ્રસ્તુત નામમાલાને એના કર્તાના નામ ઉપરથી ભાનુચન્દ્રનામમાલા તરીકે કેટલાક ઓળખાવે છે એમ જૈ. ગ્રં. (પૃ. ૩૧૧)માં એ નામથી એની નોંધ જોતાં જણાય છે. આ નામમાલામાં અભિ. ચિ.ની P. ૧૨૦ પેઠે છ કાંડ છે અને એનાં નામ પણ એ જ પ્રમાણે છે. આ નામમાલામાંથી કેટલાંક અવતરણો "ભાનુચન્દ્રગણિચરિત (પૃ. ૫૬)માં અપાયાં છે.

૧. આ ૫૪ પદ્યની નાનકડી કૃતિ "દે. લા. જૈ. પુ. સં." તરફથી પ્રકાશિત 'અભિધાનચિન્તામણિકોશ'ની આવૃત્તિમાં છપાઈ છે. જુઓ પૃ. ૧૧૨.

૨. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૫૯૫).

૩. એના મુખ્ય પ્રધાન અબુલ ફજલે આઈન-એ-અકબરીમાં અકબરના દરબારના એક ઉલ્લેખયોગ્ય વિદ્વાન તરીકે ભાનુચન્દ્રગણિની નોંધ લીધી છે. બાદશાહ જહાંગીરે જહાંગીરનામામાં પણ એમનો વિદ્વાન તરીકે નિર્દેશ કર્યો છે.

૪. આના ઉત્તરાર્ધની ટીકા સિદ્ધિચન્દ્રગણિએ રચી છે. આ ગુરુ-શિષ્યની ટીકા સહિત મૂળ કૃતિની છઠ્ઠી આવૃત્તિ "નિર્ણયસાગર મુદ્રણાલય" તરફથી ઈ. સ. ૧૯૨૧માં છપાઈ છે. [આનું સંપાદન મુનિ હિતવર્ધનવિ. કરે છે.]

૫. આ કૃતિ "વેંકટેશ્વર મુદ્રણાલય" તરફથી વિ. સં. ૧૯૬૩માં છપાઈ છે.

૬. આ કૃતિ "ડાયમંડ જ્યુબિલિ પ્રેસ"ના વ્યવસ્થાપકે અમદાવાદથી ઈ. સ. ૧૯૮૮માં પ્રકાશિત કરી હતી. ત્યાર બાદ એ આગ્રાથી "સરસ્વતી-ગ્રંથમાલા"માં ગ્રંથાંક ૧ તરીકે વિ. સં. ૧૯૭૬માં પ્રસિદ્ધ કરાઈ છે.

૭. આની વૃત્તિ વિ. સં. ૧૬૭૧માં રચાઈ છે.

૮. જિ. ર. કો. (ખંડ ૧, પૃ. ૪૫૨)માં સૂર્યસહસ્રનામની વૃત્તિના રચનાર તરીકે પ્રસ્તુત ભાનુચન્દ્રગણિનો ઉલ્લેખ છે. [સ્વોપજાટીકા સાથે સૂર્યસહસ્રનામનું સંપાદન આ. ધર્મધુરંધરસૂરિ કરી રહ્યા છે.]

૯. આ સિં. જૈ. ગ્રં. માં ઈ. સ. ૧૯૪૧માં પ્રકાશિત છે.

‘શબ્દ-સંદોહ-સંગ્રહ-આ કૃતિ જૈ. ગ્રં. (પૃ. ૩૧૩)માં નોંધાયેલી છે અને અહીં એની ૪૭૯ પત્રની તાડપત્રીય પ્રતિ હોવાનો ઉલ્લેખ છે. આ હકીકત બરાબર હોય તો આ મહત્વની કૃતિ ગણાય.

શારદીયનામમાલા યાને શારદીયાભિધાનમાલા - (લ. વિ. સં. ૧૬૬૦) - આ ‘નાગપુરીય તપા’ ગચ્છના હર્ષકીર્તિસૂરિની રચના છે. એઓ ચન્દ્રકીર્તિસૂરિના શિષ્ય થાય છે. એમણે યોગચિન્તામણિ અને વૈદ્યકસારોદ્ધાર એ બે વૈદ્યક કૃતિઓ રચી છે. એ ઉપરાંત એમણે જ્યોતિઃસાર રચ્યો છે. વળી એમણે નિમ્નલિખિત કૃતિઓની ટીકા રચી છે :-

કલ્યાણમંદિર-સ્તોત્ર, બૃહચ્છાન્તિ-સ્તોત્ર, સિન્દૂર-પ્રકર, શ્રુતબોધ, ધાતુપાઠ અને સેટ્-અનિટ્-કારિકા.^૧

શેષનામમાલા યાને શેષસંગ્રહનામમાલા (લ. વિ. સં. ૧૬૭૦ ?) - આ સાધુકીર્તિની કૃતિ છે. ૧૨૧ શું એ કોઈ નામમાલાની પુરવણીરૂપ રચના છે ? વળી આ સાધુકીર્તિ કયા ગચ્છના છે અને એઓ કોના શિષ્ય છે એની પણ તપાસ થવી ઘટે. શું એઓ ધાતુરત્નાકર ઉપર વિ. સં. ૧૬૮૭માં ક્રિયાકલ્પલતા રચનાર સાધુસુંદરગણિના ગુરુ છે ?

‘શબ્દરત્નાકર (લ. વિ. સં. ૧૬૮૦)-આના કર્તા ‘ખરતર’ ગચ્છના સાધુસુંદરગણિ છે. એમણે ઉક્તિરત્નાકર તેમજ ક્રિયાકલાપ નામની સ્વોપજ્ઞ વૃત્તિથી વિભૂષિત ધાતુરત્નાકર [યુક્તિસંગ્રહ, પાર્શ્વસ્તુતિ વગેરે] રચ્યા છે. આ વૃત્તિ એમણે વિ. સં. ૧૬૮૦માં રચી છે.

શબ્દરત્નાકર એ પદ્યાત્મક કૃતિ છે. એ છ કાંડમાં વિભક્ત કરાઈ છે. એનાં નામો અનુક્રમે અર્હત, દેવ, માનવ, તિર્યચ, નારક અને સામાન્ય એમ રખાયાં છે.

‘લઘુતમનામકોશ(વિ.સં. ૨૦૦૫)- આ આગમોદ્ધારકે બાલજીવોને ઉદ્દેશીને પદ્યમાં રચેલી કૃતિ છે. આ ઘણો નાનો કોશ છે. એ અભિ. ચિ.ના પ્રવેશદ્વારની ગરજ સારે તેમ છે.

૧. આની નોંધ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૧૪)માં જૈ. ગ્રં.ના આધારે કરાઈ છે. અહીં આની કોઈ બીજી હાથપોથીનો ઉલ્લેખ નથી.

૨. આ હર્ષકીર્તિસૂરિની પોતાની કૃતિ છે અને એ સારસ્વત વ્યાકરણને અંગે છે. એ વિ. સં. ૧૬૬૩માં રચાઈ છે. એના ઉપર ધાતુરંગિણી નામની સ્વોપજ્ઞ વૃત્તિ છે.

૩. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૫૨) પ્રમાણે તો આ મૂળ કૃતિ પણ હર્ષકીર્તિસૂરિએ વિ. સં. ૧૬૬૨માં રચી છે. એની સ્વોપજ્ઞ વૃત્તિ વિ. સં. ૧૬૬૮માં રચાઈ છે.

૪. જૈ. સા. સં. ઈ. (પૃ. ૫૮૩) પ્રમાણે હર્ષકીર્તિસૂરિએ સારસ્વતદીપિકા રચી છે. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૩૩)માં તો આ નામની કૃતિના કર્તા તરીકે ચન્દ્રકીર્તિસૂરિનો ઉલ્લેખ છે અને એ એમણે વિ. સં. ૧૬૬૪માં રચી છે.

૫. “ય. જૈ. ગ્રં.”માં ગ્રંથાંક ૩૬ તરીકે આ કૃતિ વીરસંવત્ ૨૪૩૮માં પ્રકાશિત કરાઈ છે. એમાં અંતમાં શબ્દોની અકારાદિ ક્રમે સૂચી છે.

૬. આ કૃતિ “જૈ. પુ. પ્ર. સં.” તરફથી સુરતથી વિ. સં. ૨૦૦૫માં પ્રકાશિત કરાઈ છે.

નામકોશ— ખરતરગચ્છીય રત્નસારના શિષ્ય સહજકીર્તિની આ રચના છે. લિંગનિર્ણય સાથે એ છ કાંડમાં રચાઈ છે. [સુશીલનામમાલા— આ. સુશીલસૂરિ. પ્ર. સુશીલ. જ્ઞાન. સિરોહી.]

આંશિક કોશો

સામાન્ય રીતે કોશમાં સમગ્ર વર્ણમાળાના અક્ષરોને સ્થાન હોય છે અને સાથે સાથે એમાં વિવિધ વિષયના શબ્દો રજૂ કરાયેલા હોય છે. પરંતુ કેટલીક વાર અમુક જ અક્ષરોના બનેલા શબ્દોનો અથવા તો કોઈ એક જ વિષયને લગતા શબ્દોનો કોશ નજરે પડે છે. જે કોશ અમુક જ વર્ણવાળા શબ્દોનો બોધ કરાવે છે એને હું “આંશિક કોશ” કહું છું. એવી રીતે જે કોશ અમુક જ વિષય પૂરતાં શબ્દો રજૂ કરે છે તેને પણ હું “આંશિક કોશ” કહું છું. આમ આંશિક કોશ બે પ્રકારના છે. તેમાં પ્રથમ પ્રકારના કોશોની હવે હું નોંધ લઉં છું.

P. ૧૨૨ **પંચવર્ગસંગ્રહનામમાલા** (લ. વિ. સં. ૧૫૨૫)– આ ‘સહસ્રાવધાની’ મુનિસુંદરસૂરિના શિષ્ય શુભશીલગણિની કૃતિ છે. એનું નામ વિચારતાં એમ લાગે છે કે જો એ ‘કોશ’જ હોય તો એમાં ક-વર્ગ ઇત્યાદિ પાંચ વર્ગના જ શબ્દોની સૂચી અપાઈ હશે. આ ગણિએ વિ. સં. ૧૫૧૮માં શત્રુંજયકલ્પકથા અને વિ. સં. ૧૫૪૦માં શાલિવાહનચરિત્ર રચેલ છે.

દ્વ્યક્ષરનામમાલા—આ કૃતિનું નામ વિચારતાં બે વિકલ્પ સ્ફુરે છે : (૧) એમાં બબે અક્ષરવાળા બધી જાતના શબ્દો હશે. (૨) અમુક જ બે અક્ષરવાળા શબ્દો હશે.

પંચવર્ગપરિહારનામમાલા—આ જાતની કૃતિમાં ક્ થી મ્ સુધીના ૨૫ અક્ષરોને જતા કરી બાકીના ય્, ર્, લ્, વ્, શ્, ષ્, સ્ અને હ્ એ આઠ અક્ષરો પૈકી ઓછાવત્તા અક્ષરોના બનેલા શબ્દોને સ્થાન અપાય છે.

વર્ણોની ઉત્પત્તિના અધિકરણ-ભાવને ધારણ કરનારું શરીરનું અવયવ એ વર્ણોનું સ્થાન ગણાય છે. આવાં સ્થાનો તરીકે (૧) છાતી, (૨) કંઠ, (૩) મસ્તક, (૪) જીભનું મૂળ, (૫) દાંત, (૬) નાક, (૭) બે હોઠ અને (૮) તાળવું એમ આઠ સ્થાનો નિમ્નલિખિત પદ્યમાં ગણાવાયાં છે:-

“અષ્ઠૌ સ્થાનાનિ વર્ણનામુરઃ કણ્ઠઃ શિરસ્તથા ।

જિહ્વામૂલં ચ દન્તાશ્ચ નાસિકોષ્ઠૌ ચ તાલુ ચ ॥”

આ પૈકી ઓષ્ઠસ્થાનીય વર્ણ તરીકે નીચે મુજબના અક્ષરો ગણાવાય છે:-

P. ૧૨૩ પ-વર્ગ, વ્ (દંતોષ્ઠ્ય) ઉ, ઊ, ઓ, ઔ અને ઉપધ્માનીય ્

પ્, ફ્, બ્, ભ્ અને મ્ એ પાંચ વર્ણો પ-વર્ગના ગણાય છે. એ ઉચ્ચારવા માટે હોઠની જરૂર પડે છે. અસલના જમાનામાં કેટલીક વાર એવી વાક્ય-ચાતુર્યની (acrobatic feat) હરીફાઈ યોજાતી હતી કે એમાં ભાગ લેનાર એવા શબ્દો ઉચ્ચારતો કે એમાં પ્ થી મ્ સુધીના પાંચ વર્ણો પૈકી એકનો ઉચ્ચાર કરવાનો વારો ન આવે. આ હરીફાઈમાં ભાગ લેનારના ઉપલા હોઠે સિંદૂર લગાડાતો કે જેથી એ જો ભૂલેયુકે પ-વર્ગનો વર્ણ બોલે તો એ હોઠ નીચલા હોઠને અડકે અને તેની ખબર એ સિંદૂરથી રંગાતાં તરત જ પડી જાય.

૧. આ નામની એક કૃતિ અપ્રસિદ્ધ છે. એની હાથપોથીઓ જેસલમેર અને કાશીના ભંડારમાં છે.

જિનભદ્રીય^૧અપવર્ગ-નામમાલા (લ. વિ. સં. ૧૨૫૦)- આના કર્તા ‘ખરતર’ ગચ્છના જિનભદ્રસૂરિ છે. એઓ જિનવલ્લભસૂરિના શિષ્ય થાય છે. વળી એઓ જિનપ્રિયના તેમજ જિનદત્તસૂરિના પણ ભક્ત થાય છે. એમણે ૨૨૦ ગાથામાં જિણસત્તરિ રચી છે. એમણે ‘ભાંડાગારિક’ નેમિયન્દ્રે રચેલા સદ્વિસયગ (પ્રવિશતક)ની તપાસત્કૃત વૃત્તિનું સંશોધન વિ. સં. ૧૫૦૧માં કર્યું હતું.^૨ એમણે જેસલમેર, જાબાલિપુર (જાલાર), દેવગિરિ, અહિપુર (નાગોર) અને અણહિલપુર પાટણના ભંડારો જાતજાતનાં સુંદર પુસ્તકો વડે ભરી દીધાં હતાં. એમની આ નામમાલામાં પૂ થી મ્ પૈકી એકે અક્ષર જેમાં આવતો હોય એવા શબ્દો અપાયા છે. આમ આ એકાર્થક અનેકાક્ષરી કોશનું મર્યાદિત સ્વરૂપ રજૂ કરે છે. આજ નામમાલાને જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૨૭)માં પંચવર્ગ પરિહારનામમાલા કહી છે, પણ તે વિચારણીય જણાય છે, કેમકે P. ૧૨૪ એવી કૃતિઓમાં તો પાંચે વર્ગના અક્ષરોનો નહિ કે કેવળ પ-વર્ગના અક્ષરોનો અભાવ હોય છે.

જિનચન્દ્રીય અપવર્ગ-નામમાલા-આ કદાચ ઉપર્યુક્ત જ કૃતિ હશે. તેમ ન હોય તો એના કર્તા જિનચન્દ્રસૂરિ છે.

જૈ. ગ્રં. (પૃ. ૩૦૮)માં ૨૧૫ શ્લોક જેવડી એક અજ્ઞાતકર્તૃક **અપવર્ગ-નામમાલા**ની નોંધ છે.

નિઘંટુ-શેષ (લ. વિ. સં. ૧૨૧૦)- વૈદિક શબ્દોના સમૂહને ‘નિઘંટુ’ કહે છે. એના ઉપર યાસ્કે નિરુક્ત રચ્યું છે. આમ ‘નિઘંટુ’ શબ્દ અતિપ્રાચીન છે. ‘નિઘંટુ’નો બીજો અર્થ ‘વનસ્પતિઓનાં નામોનો સમૂહ’ એમ પ્રાચીન સમયથી કરાતો આવ્યો છે એમ ધન્યન્તરિ-નિઘંટુ, રાજકોશ-નિઘંટુ, સરસ્વતી-નિઘંટુ, હનુમન્-નિઘંટુ ઇત્યાદિ નામો જોતાં જણાય છે. પ્રસ્તુત નિઘંટુ-શેષમાંનો ‘નિઘંટુ’ શબ્દ આ બીજા અર્થમાં વપરાયો છે. આમ આ વનસ્પતિનો કોશ (botanical dictionary) છે. એના કર્તા ‘કલિ.’ હેમચન્દ્રસૂરિ છે. એમણે આ કોશ છ કાંડમાં વિભક્ત કર્યો છે. એનાં નામ અને શ્લોક-સંખ્યા નીચે મુજબ છે:-

(૧) વૃક્ષ (શ્લો. ૧૮૧), (૨) ગુલ્મ (શ્લો. ૧૦૫), (૩) લતા (શ્લો. ૪૪), (૪) શાક (શ્લો. ૩૪), (૫) તૃણ (શ્લો. ૧૭) અને (૬) ધાન્ય (શ્લો. ૧૫)^૩

P. ૧૨૫

આમ આ ૩૮૬ શ્લોકોમાં ગુંથાયેલો કોશ વૈદકશાસ્ત્ર માટે પણ ઉપયોગી છે.

૧. “અપવર્ગ”ના બે અર્થ થાય છે : પ-વર્ગથી રહિત અને મોક્ષ પહેલો અર્થ અત્ર પ્રસ્તુત છે.

૨. એમનો વિસ્તૃત પરિચય વિજ્ઞાનિત્રિવેણીની પ્રસ્તાવનામાં જિનવિજયજીએ આપ્યો છે.

૩. આ કોશ “અભિધાન-સંગ્રહ”માં છઠ્ઠા કોશ તરીકે શકસંવત્ ૧૮૧૮માં છપાયો છે. “દે. લા. જૈ. પુ. સં.” તરફથી પણ આ અભિ. ચિ. વગેરે સહિત ઈ. સ. ૧૮૪૬માં છપાયો છે, પરંતુ એમાં પ્રારંભમાં ૨-૧૫ પદ્યો નથી. ૧૭મું પદ્ય ત્રુટક છે અને ત્રીજા કાંડમાં પણ એક પદ્ય અધૂરું છે. આ પરિસ્થિતિ જોતાં વિ. સં. ૧૨૮૦માં લખાયેલી હાથપોથી મેળવી એનું ફરીથી સંપાદન થવું ઘટે.

૪. પ્ર. ચ. (શૃંગ ૧૨, શ્લો. ૮૩૭)માં ચાર હેમકોશો ગણાવતાં ‘કોશ’ને બદલે ‘નિઘંટુ’ શબ્દ વપરાયો છે. આમ અહીં ‘શબ્દોનો સમૂહ’ એવો અર્થ ‘નિઘંટુ’નો કરાયો છે.

૫. વનસ્પતિના આ છ ભેદો શ્યામાચાર્યે પણ્ણવણા (પૃ. ૧)માં વનસ્પતિકાયના અધિકારમાં ‘પ્રત્યેક-શરીર’ બાદર વનસ્પતિકાયના વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વેલ, પર્વગ, તૃણ, વલય, હરિત, ઔષધિ, જલરુદ્ધ અને કુહણ એમ જે બાર ભેદો ગણાવ્યા છે તેનું તેમજ વિનયવિજયગણિએ વિ. સં. ૧૭૦૮માં રચેલા લોકપ્રકાશ (સ. ૫, શ્લો. ૮૮)માં પણ આપેલી આ જ હકીકતનું સ્મરણ કરાવે છે. આ બંને કૃતિઓમાં વૃક્ષાદિ બારેનાં ઉદાહરણો અપાયાં છે.

સાધન-ડૉ. બ્હીલર (Buhler)ના મતે 'ધન્વન્તરિ-નિઘંટુ અને રત્નપરીક્ષાનો આ નિઘંટુ-શેષની રચનામાં ઉપયોગ કરાયો હશે.

રચના-સમય-આ કોશના આદ્ય પદ્યમાં કહ્યું છે કે એકાર્થ, નાનાર્થ અને દેશ્ય એમ ત્રણ જાતના શબ્દ-સમુચ્ચય (અર્થાત્ અભિ. ચિ., અનેકાર્થ-સંગ્રહ અને રચણાવલી એ ત્રણ કોશો) જેણે રચ્યા છે એવો હું અરિહંતોનાં ચરણ-કમળને નમીને નિઘંટુ-શેષ કહીશ. આ ઉપરથી આ કોશ ચાર કોશો પૈકી છેલ્લો રચાયો છે એમ ફલિત થાય છે.

અભિ. ચિ. (કાંડ ૪, શ્લો. ૨૬૭)ની સ્વોપજ વિવૃત્તિ (પૃ. ૪૮૪)માં નીચે મુજબની પંક્તિ છે.

“પિપ્પલાદિવૃક્ષજાતીનાં તુ નામશેષોઽસ્મદુપજ્ઞનિઘંટોરવસેયઃ”

P. ૧૨૬ અર્થાત્ પીપળા વગેરે વૃક્ષોની જાતિઓનાં નામ અમે રચેલા નિઘંટુથી જાણવાં. આ ઉપરથી એમ કહી શકાય કે સ્વોપજ વિવૃત્તિ રચાયા પૂર્વે આ કોશ રચાયો છે અથવા તો એની સાથે સાથે આની રચના કરાઈ છે.

ટીકા-જ્ઞાનવિમલના શિષ્ય શ્રીવલ્લભે આ રચી છે. એમણે આ ટીકાનો ઉલ્લેખ અભિ. ચિ. ઉપરની પોતાની ટીકામાં કર્યો છે. [નિઘંટુશેષ- શ્રીવલ્લભની ટીકા સાથે આ ગ્રંથ મુનિશ્રી પુણ્યવિજયજી દ્વારા સંપાદિત થઈ લા.દ.વિદ્યામંદિર અમદાવાદથી ઇ.સ. ૧૯૬૮માં પ્રથમવાર જ છપાયો છે. અનેક ઉપયોગી પરિશિષ્ટ વ.થી સમૃદ્ધ છે.]

નિઘંટુ-સંગ્રહ-અકલંકદેવની કૃતિ તરીકે જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૧૨)માં આની નોંધ છે, પણ આ શી કૃતિ છે ?

ઔષધીનામમાલા-જૈ. ગ્રં. (પૃ. ૩૧૦)માં આ કૃતિની ચાર પત્રની એક હાથપોથી અમદાવાદમાં હોવાનો ઉલ્લેખ છે. આ અજ્ઞાતકર્તૃક કૃતિ છે. એનું નામ વિચારતાં એમ ભાસે છે કે એમાં ઔષધિઓનાં-વનસ્પતિઓનાં નામ ગણાવાયાં હશે.

બીજ-નિઘંટુ-આ અજ્ઞાતકર્તૃક કૃતિની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૧૧)માં છે. શું એમાં જાતજાતનાં બીજનો ઉલ્લેખ હશે ?^૧ [નિઘંટુ- ભા.૧-૨. ગુજરાતી પુસ્તકમંડળ વડોદરાથી ૧૯૮૮માં બીજી આવૃત્તિ પ્રગટ થઈ છે.]

[૨] અનેકાર્થક કોશો

અનેકાર્થ-નામમાલા (ઉ. વિક્રમની ૧૧મી સદી)-આ દિ. ગૃહસ્થ ધ્વનંજયે ૪૬ પદ્યોમાં રચેલી નામમાલા છે. એમાં અનેકાર્થી શબ્દોને સ્થાન અપાયું છે. આ કોશ ઉપલબ્ધ જૈન સાહિત્યની અપેક્ષાએ સૌથી પ્રથમ છે. આના ઉપર એક અવચૂરિ જેવી સંક્ષિપ્ત ટીકા છે.

૧. આ નિઘંટુ આજે અપ્રાપ્ય ગણાય છે, પરંતુ હેમચન્દ્રસૂરિના શિષ્ય મહેન્દ્રસૂરિની તો એ સામે હોય એમ અનેકાર્થસંગ્રહની એ શિષ્યે રચેલી ટીકા જોતાં જણાય છે.

૨. જૈ. ગ્રં. (પૃ. ૩૧૧)માં માતૃકાનિઘંટ નામની કૃતિ ડેક્કન કોલેજમાં હોવાની નોંધ છે અને એના કર્તા તરીકે મહીદાસનો અહીં ઉલ્લેખ છે. શું આ કોઈ જૈન નામમાલા છે ?

૩. એમની અન્ય કૃતિઓ માટે જુઓ પૃ. ૬૧.

૪. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૬૧.

^૧અનેકાર્થ-નિઘંટુ-આ પણ બે નામમાલા રચનારા ધનંજયની જ કૃતિ હોય એમ લાગે છે. એમાં P. ૧૨૭ લગભગ ૧૫૪ શ્લોક છે. એમાં ૭૫ મા, ૧૫૦મા અને ૧૫૩મા પછીનો શ્લોક અંશતઃ છપાયો છે. અંતમાં જે ઉલ્લેખ છે તે ઉપરથી એમ જાણી શકાય છે કે આ કૃતિના ^૨બે પરિચ્છેદ તો છે જ, પણ એકંદર કેટલા પરિચ્છેદ છે અને પ્રથમ પરિચ્છેદ ક્યાં પૂર્ણ થાય છે તે જાણવું બાકી રહે છે.

^૩અનેકાર્થ-સંગ્રહ (લ. વિ. સં. ૧૨૧૦) - આ કોશમાં એક શબ્દના અનેક અર્થ અપાયા છે, જ્યારે અભિ. ચિ. જેવા કોશોમાં એકાર્થવાચક અનેક શબ્દો અપાયા છે. આમ આ નાનાર્થ-કોશ છે. એના કર્તા ‘કલિ.’ હેમચન્દ્રસૂરિ છે, એના આદ્ય પદમાં છ કાંડનો ઉલ્લેખ છે, જ્યારે આજે સાત કાંડ મળે છે. એ સાતમો કાંડ અવ્યયો પૂરતો છે અને અભિ. ચિ.ને અંગે જેમ શેષનામમાલા રચાઈ છે તે પ્રકારનો જણાય છે. આ સાત કાંડનાં નામ અને એની શ્લોક-સંખ્યા નીચે મુજબ છે :-

(૧) એક-સ્વર (શ્લો. ૧૬), (૨) દ્વિ-સ્વર (શ્લો. ૫૮૧), (૩) ત્રિ-સ્વર (શ્લો. ૭૬૬), (૪) ચતુઃસ્વર (શ્લો. ૩૪૩), (૫) પંચ-સ્વર (શ્લો. ૪૮), (૬) ષટ્-સ્વર (શ્લો. ૫) અને (૭) અવ્યય (શ્લો. ૬૦).

આમ અહીં કુલ શ્લોકો ૧૮૨૮ (૧૭૬૮+૬૦) છે. અહીં પણ અભિ. ચિ.ની પેઠે કેટલાક દેશ્ય P. ૧૨૮ જણાતા ‘શબ્દોની નોંધ છે. એટલે આ કોશ પણ એના અભ્યાસીઓએ વિચારવો ઘટે.

યોજના-ગ્રંથકારે જાતે આ કોશની યોજના શ્લો. ૨-૪માં સમજાવી છે.

રચના-સમય--અભિ. ચિ. પછી આ કોશ રચાયો છે એમ આદ્ય પદ ઉપરથી જાણી શકાય છે.

આ કોશ ઉપર નીચે મુજબની વૃત્તિઓ છે :-

(૧) ‘અનેકાર્થ-કૈરવાકર-કૌમુદી’-આ કૃતિનો આ નામથી એના પ્રારંભમાં જ કર્તાએ - ‘કલિ.’ હેમચન્દ્રસૂરિના શિષ્ય મહેન્દ્રસૂરિએ જાતે ઉલ્લેખ કર્યો છે. એમણે આ કૃતિ પોતાના ગુરુને નામે ચડાવી છે એ વાત બીજા કાંડની ટીકાના અંતિમ પદ ઉપરથી જણાય છે; બાકી પ્રથમ કાંડની ટીકાને અંતે અપાયેલી પુષ્પિકામાં તો કર્તા તરીકે હેમચન્દ્રસૂરિનું નામ છે. આ ટીકા રચવામાં નિમ્નલિખિત ગ્રંથો સહાયક નીવડ્યાનો પ્રારંભમાં ઉલ્લેખ છે :-

૧. આ “ભારતીય જ્ઞાનપીઠ કાશી” તરફથી છપાયો છે.

૨. શું જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૧૨)માં ધનંજયના નામે જે નિઘંટ-સમય નામની બે પરિચ્છેદની કૃતિની નોંધ છે તે આ જ છે ?

૩. મહેન્દ્રસૂરિકૃત અનેકાર્થ-કૈરવાકર-કૌમુદી નામની ટીકા સહિત આ કોશનું અવતરણોનાં મૂળ સ્થાનના નિર્દેશપૂર્વક સંપાદન ઝેચારિઆએ (Zachariae)એ ઈ. સ. ૧૮૮૩માં કર્યું છે, જ્યારે કેવળ આ કોશ તો “અભિધાન-સંગ્રહ”માં શકસંવત્ ૧૮૧૮માં છપાયો છે (જુઓ પૃ. ૧૧૨). [હર્ષપુષ્પામૃત ગ્રંથમાલા દ્વારા વિ. સં. ૨૦૩૧માં અનેકાર્થ સટીક પ્રસિદ્ધ થયો છે. સંપા. આ. જિનેન્દ્રસૂરિ.]

૪. આવા છ શબ્દો ગુજરાતી અર્થ સહિત હેમસમીક્ષા (પૃ. ૮૨)માં અપાયા છે.

૫. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૩.

૬. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૧૦)માં આને જ ‘કૈરવાકરકૌમુદી’ કહી છે અને અનેકાર્થધ્વનિમંજરી તે શું હેમ અનેકાર્થસંગ્રહ જ છે એવો પ્રશ્ન ઉઠાવાયો છે.

વિશ્વપ્રકાશ, શાશ્વત, રત્નસ, અમરસિંહ, મંખ, હુગ્ગ, વ્યાડિ, ધનપાલ, ભાગુરિ, વાયસ્પતિ અને યાદવની કૃતિઓ તેમજ ધન્વંતરિકૃત નિઘંટુ અને લિંગાનુશાસનો.

P. ૧૨૯

(૨) ઉપસર્ગ-વૃત્તિ— આની રચના સિદ્ધિચન્દ્રગણિએ કરી છે.

(૩) પર્યાય—આના કર્તાનું નામ જાણવામાં નથી.

(૪) અવચૂરિ (? ટીકા)— આના કર્તા વિષે ખબર નથી.

‘વિશ્વલોચનકોશ યાને ‘મુક્તાવલીકોશ— આના કર્તા દિ. શ્રીધરસેન છે. એઓ ‘સેન’ અન્વય (સંઘ)માં થયેલા કવિ, આન્વીક્ષિકી વિદ્યામાં નિષ્ણાત અને વાદી એવા મુનિસેનના શિષ્ય થાય છે, વળી એઓ સમસ્ત શાસ્ત્રોના પારગામી, રાજાઓના વિશ્વાસપાત્ર અને કાવ્યશાસ્ત્રના મર્મજ્ઞ હતા તેમજ આ (અનેકાર્થક) કોશ વિવિધ કવીશ્વરોના કોશો જોઈને રચાયો છે એમ પ્રશસ્તિમાં કહ્યું છે. એમના સમય વિષે કોઈએ ઉલ્લેખ કર્યાનું જાણવામાં નથી એટલે આ કોશ વિક્રમની સોળમી સદીમાં રચાયો હશે એમ માની લઈ મેં એની અહીં નોંધ લીધી છે. આ કોશમાં અઢીએક હજાર પદો છે. આ કોશનો રચનાક્રમ એના દ્વિતીય પદમાં નીચે મુજબ અપાયો છે:—

સ્વર અને કકાર વગેરે વર્ણના ક્રમથી શબ્દોની આદિનો નિર્ણય કરાયો છે. વળી દ્વિતીય વર્ણ વિષે પણ કકારાદિનો ક્રમ રખાયો છે. દા. ત. ક (નરજાતિ), ક(નાન્યતરજાતિ), કુ, અક, અંક ઇત્યાદિ.

આ કોશના શબ્દોને કાન્ત, ખાન્ત એમ હાન્ત સુધીના ૩૩ વર્ગોમાં, ત્યાર પછીના શબ્દોને ક્ષાન્ત વર્ગમાં અને એના પછીના શબ્દોને— અવ્યયોને અવ્યય-વર્ગમાં એમ એકંદર ૩૫ વર્ગમાં વિભક્ત કરાયા છે.

‘ભાષાટીકા— કોશના પ્રત્યેક પૃષ્ઠના ઉપરના લગભગ અડધા ભાગમાં છએક પદો છે અને એના નીચલા ભાગમાં બે સ્તંભ (column)માં સંસ્કૃત શબ્દ અને એની સામે એના વિવિધ અર્થ હિન્દીમાં અપાયા છે આ અર્થોનો ‘ભાષાટીકા’ તરીકે નિર્દેશ છે.

નાનાર્થકોશ અને નાનાર્થસંગ્રહ— આના કર્તા અનુક્રમે અસગ કવિ અને રામચન્દ્ર છે.

અનેકાર્થ-નામમાલા (વિ. સં. ૧૭૦૨)— ‘અંચલ’ ગચ્છના વિનયસાગરસૂરિએ વિ. સં. ૧૭૦૨માં આ રચી છે. જૈ. ગ્રં. (પૃ. ૩૦૯)માં કોઈ અંચલગચ્છીય વ્યક્તિએ જે અનેકાર્થરત્નકોશ રચ્યાનો અને જેની ૧૫ પત્રની એક હાથપોથી અમદાવાદના ભંડારમાં હોવાનો ઉલ્લેખ છે તે ગ્રંથ તે આ જ છે ?

[૩] એકાક્ષરી નામમાલા

આપણે અત્યાર સુધી એકાર્થક તેમજ અનેકાર્થક એમ બે પ્રકારના અનેકાક્ષરી કોશોનો વિચાર કર્યો. હવે આપણે ‘એકાક્ષરી’ કોશો— નામમાલા પરત્વે વિચાર કરીશું. આ જાતની નામમાલા અ,

૧. આ કોશ પં. નંદલાલ શર્માકૃત ભાષાટીકા (હિન્દી શબ્દાર્થ) સહિત “ગાંધી નાથારંગ જૈન ગ્રંથમાલા”માં છે.

સ. ૧૯૧૨માં છપાયો છે.

૨. આ નામ જિ. ૨. કો (ખંડ ૧, પૃ. ૩૪) જોતાં અનુમનાય છે.

૩. આ પ્રકાશિત છે. જુઓ દિ. ૧

આ ઇત્યાદિ અક્ષરોના અર્થ અનુક્રમે પૂરા પાડે છે. જેમકે અ=વાસુદેવ (કૃષ્ણ), આ=પિતામહ, ઇ=કામદેવ ઇત્યાદિ.^૧

એકાક્ષર-નિઘંટુ (વિક્રમની ૧૨મી સદી)-આના કર્તા તરીકે ‘મલધારી’ ગચ્છના હેમચન્દ્રસૂરિનો ઉલ્લેખ જોવાય છે. આ નિઘંટુને નામમાલા માની મેં એનો અહીં નિર્દેશ કર્યો છે. આની હાથપોથી સુરતમાં છે.^૨

એકાક્ષર-નામમાલા (વિક્રમની ૧૪મી સદી) - આની રચના ‘વાયડ’ ગચ્છના જિનદત્તસૂરિના P. ૧૩૦ શિષ્ય અમરચન્દ્રસૂરિએ કરી છે. એમણે સ્યાદિશબ્દસમુચ્ચય, પદ્માનંદમહાકાવ્ય વગેરે વિવિધ કૃતિઓ રચી છે.^૩

એકાક્ષર-નામમાલા (લ. વિ. સં. ૧૪૦૦)-આ પચાસ પદ્યોની નાનકડી કૃતિના કર્તા સુધાકલશ છે. એઓ ‘હર્ષપુરીય’ ગચ્છના રાજશેખરસૂરિના શિષ્ય થાય છે આ રાજશેખરસૂરિ તે સ્વપરસિદ્ધાંતના જ્ઞાતા અને સંગીતશાસ્ત્રમાં પ્રવીણ એવા નરચન્દ્રસૂરિના શિષ્ય તિલકસૂરિની પાટે થયા છે. આ તિલકસૂરિએ સુધાકલશને દીક્ષા આપી હતી. આ સુધાકલશે વિ. સં. ૧૩૮૦માં સંગીતોપનિષદ્ અને વિ. સં. ૧૪૦૬માં એના સારરૂપ સંગીતોપનિષદ્ગ્રંથસારોદ્ધાર એમ બે ગ્રંથ રચ્યા છે.

ઉપયોગ—સમયસુંદરગણિએ વિ. સં. ૧૬૪૯માં રચેલી અર્થરત્નાવલીમાં સુધાકલશનો ઉલ્લેખ કર્યો છે^૪ એટલું જ નહિ પણ એમણે રચેલી ઉપર્યુક્ત નામમાલિકામાંથી પદ્યો પણ ઉદ્ધૃત કર્યાં છે.^૫

ગુણરત્ને નમસ્કાર-પ્રથમપદ્યાર્થમાં ઉપર્યુક્ત નામમાલામાંથી પદ્યો આપ્યાં છે^૬ અને આ નામમાલાનો **એકાક્ષરનામમાલા** અને **એકાક્ષર-નિઘંટુ** તરીકે નિર્દેશ કર્યો છે. ‘કલિ.’ હેમચન્દ્રસૂરિકૃત યોગશાસ્ત્ર P. ૧૩૧ (પ્ર. ૧, શ્લો. ૧૦)ની માનસાગરીય શતાર્થીમાં આ નામમાલામાંથી અવતરણો અપાયાં છે.

અવ્યયેકાક્ષર-નામમાલા (લ. વિ. સં. ૧૪૦૦)- આ સુધાકલશની રચના છે. આમાં અવ્યયોને સ્થાન અપાયું છે આની એક પત્રની હાથપોથી લા. દ. વિદ્યામંદિરમાં છે તો એ કૃતિ સત્વર પ્રકાશિત થવી ઘટે.

એકાક્ષરકોષ— આ મહાક્ષપણકે રચ્યો છે. એમાં પ્રારંભમાં આગમો, અભિધાનો, ધાતુઓ અને શબ્દસાધનથી એકાક્ષર નામ પાડ્યું છે. આની એક પ્રતિમાં નીચે મુજબ ઉલ્લેખ છે :—

૧. જુઓ “દે. લા. જૈ. પુ. સં.” તરફથી પ્રકાશિત અભિ. ચિ.કોશની આવૃત્તિ (પૃ. ૧-૪)માં છપાયેલ અજ્ઞાતકર્તૃક **એકાક્ષરકોશ**.

૨. જુઓ જિ. ર. કો. (ખંડ. ૧, પૃ. ૬૧).

૩. આ અપ્રકાશિત છે. એની એક હાથપોથી ભાં. પ્રા. સં. મં. માં છે.

૪. જુઓ પૃ. ૯૮

૫. “દે લા. જૈ. પુ. સં” તરફથી ગ્રંથાંક ૮૧ તરીકે (મેં સંપાદિત કરેલી અર્થરત્નાવલી ઇત્યાદિ કૃતિઓના સમૂહરૂપે) જે અનેકાર્થરત્નમંજૂષા ઇ. સ. ૧૯૩૩માં પ્રકાશિત થયેલી છે તેમાં ક-પરિશિષ્ટ તરીકે આ કૃતિ પૃ. ૧૧૯-૧૨૨માં છપાવાઈ છે. વળી આ સંસ્થા તરફથી પ્રકાશિત અભિ. ચિ. કોશની આવૃત્તિના અંતમાં આ **એકાક્ષરનામમાલા** છપાઈ છે.

૬-૭. દા. ત. જુઓ પૃ. ૩.

૮. જુઓ અ. ર. (પૃ. ૧૧૧ ને ૧૧૭)

૯. જુઓ અ. ર. (પૃ. ૧૧૧)

૧૦. જુઓ (પૃ. ૧૦૭).

૧૧. આ કૃતિ **એકાક્ષરનામકોષસંગ્રહ**માં “રાજસ્થાન પ્રાચ્ય વિદ્યા પ્રતિષ્ઠાન” (જોધપુર) તરફથી વિ. સં. ૨૦૨૧માં પ્રસિદ્ધ કરાઈ છે. એનું સંપાદન રમણીકવિજયજીએ કર્યું છે.

“एकाक्षरार्थसंलापः स्मृतः क्षपणकादिभिः”

આ કોષનાં પહેલાં ૪૧ પદોમાં ક્ થી ક્ષ સુધીના વ્યંજનોના અર્થની વિચારણા છે. ત્યાર બાદ સ્વરોના અર્થ દર્શાવાયા છે.

‘એકાક્ષર-નામમાલિકા (લ. વિ. સં. ૧૫૫૦)- આને એકાક્ષરી-નામમાલા તેમજ એકાક્ષરી-કોષ પણ કહે છે. એમાં ૧૯ પદો છે. એમાં અ=કૃષ્ણ, આ=સ્વયંભૂ એમ એકેક અક્ષરના અર્થ અપાયા છે. એના રચનારનું નામ અમર છે. એમણે પોતાને ‘કવીન્દ્ર’ કહ્યા છે અને વિશ્વકોશ જોઈને આ રચના કરી છે એમ આ નામમાલાના નિમ્નલિખિત આદ્ય પદ્ય ઉપરથી જાણી શકાય છે.

“विश्वाभिधानकोशानि प्रविलोक्य प्रभाष्यते । अमरेण कवीन्द्रेणैकाक्षरनाममालिका ॥१॥”

સમયસુંદરગણિએ અમરકવિ ‘એવા ઉલ્લેખપૂર્વક એમની આ કૃતિમાંથી અવતરણ આપ્યાં છે.’^૧ એ હિસાબે આ કૃતિ વિ. સં. ૧૬૪૯ કરતાં સોએક વર્ષ જેટલી તો પ્રાચીન હશે એમ ભાસે છે.

ધનંજય-નામમાલાના ભાષ્યના અંતમાંની ‘પુષ્પિકામાં એ ભાષ્યના કર્તા અમરકીર્તિને અંગે P. ૧૩૨ ‘શબ્દ-વેદસૂ’ એવું વિશેષણ વપરાયું છે. એ પુષ્પિકા જો ભાષ્યકારની પોતાની જ હોય તો એ પોતાને ‘કવીન્દ્ર’ કહે એમાં નવાઈ નહિ. આ પરિસ્થિતિમાં હું ઉપર્યુક્ત અમરને આ અમરકીર્તિથી અભિન્ન માનવા લલચાઉં છું.

‘એકાક્ષર-નામમાલા (લ. વિ. સં. ૧૫૫૦)- આ ૧૧૫ પદોમાં રચાયેલી કૃતિના કર્તા વિશ્વશંભુ છે. સામાન્ય રીતે એઓ ‘જૈન’ ગણાય છે એટલે મેં આ કૃતિની નોંધ લીધી છે. એમને વિષે વિશેષ જાણવામાં નથી. એમનો ઉલ્લેખ કરી^૨ સમયસુંદરગણિએ અષ્ટલક્ષાર્થીમાં એમની આ કૃતિમાંથી પદો ઉદ્ધૃત કર્યાં છે.’^૩ એ ઉપરથી આ કૃતિ વિ. સં. ૧૬૪૯ કરતાં સોએક વર્ષ જેટલી પ્રાચીન હશે એમ ભાસે છે.

એકાક્ષર-નામમાલા—આ એક અજ્ઞાતકર્તૃક કૃતિ છે. એની નોંધ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૬૧)માં લેવાઈ છે. શું “દે. લા. જૈ. પુ. સં.” તરફથી જે અભિ. ચિ. કોશ વિવિધ કૃતિઓ સહિત છપાયો છે તેમાં જે અજ્ઞાતકર્તૃક એકાક્ષરકોશ અપાયો છે તે જ આ છે ?

‘અભિધાનરાજેન્દ્ર (વિ. સં. ૧૯૪૬- વિ. સં. ૧૯૬૦)- આ સાડા ચાર લાખ શ્લોક જેવાડા મહાકાવ્ય કોશના કર્તા વિજયરાજેન્દ્રસૂરિ છે. એઓ ‘સૌધર્મબૃહત્તપા’ ગચ્છના પ્રમોદસૂરિજીના શિષ્ય થાય છે. એમણે આ કોશનો પ્રારંભ સિયાણામાં વિ. સં. ૧૯૪૬માં કર્યો હતો અને એની પૂર્ણાહૂતિ એમણે

૧. આ ભારતીય જ્ઞાનપીઠથી પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૦૬.

૨. જુઓ અ. ૨. (પૃ. ૨, ૩ અને ૪)

૩. જુઓ અ. ૨. (પૃ. ૨, ૩, ૪ ઇત્યાદિ).

૪. “इति महापण्डित श्रीअमरकीर्तिना त्रैविद्येन श्रीसेन्द्रवंशोत्पन्नेन शब्दवेदसा कृतायां धनञ्जयनाममालायां प्रथमं काण्डं व्याख्यातम् ।”

૫. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૬૧)માં આની નોંધ છે. એ હિસાબે પ્રો. વેલણકર પણ આને જૈન કૃતિ ગણતા હોય એમ લાગે છે.

૬. જુઓ અ. ૨. (પૃ. ૧),

૭. જુઓ અ. ૨. (પૃ. ૧, ૩ ઇત્યાદિ).

૮. આ પાઈય-સંસ્કૃત કોશ સાત વિભાગમાં રતલામથી ઈ. સ. ૧૯૧૩, ૧૯૧૦, ૧૯૧૪, ૧૯૧૩, ૧૯૨૧, ૧૯૩૪ અને ૧૯૩૪માં અનુક્રમે પ્રસિદ્ધ કરાયેલો છે. [આનું પુનર્મુદ્રણ દિલ્હીથી બે પુસ્તક વિકેતાઓએ અને અમદાવાદથી ત્રિસ્તુતિકસંઘ હાથીખાના દ્વારા થયું છે.]

અહીં (સુરતમાં) વિ. સં. ૧૯૬૦માં કરી હતી. એમણે આ કોશમાં ૬૦૦૦૦ પાઈય શબ્દોનાં મૂળના નિર્દેશપૂર્વક એનાં સંસ્કૃત સમીકરણ આપ્યાં છે. શબ્દનો અર્થ સમજાવતી વેળા પાઈય કે સંસ્કૃત અવતરણ અપાયું છે. કોઈ કોઈ વાર તો સમગ્ર કૃતિ અવતરણરૂપે અપાઈ છે. એવી કોઈ કોઈ કૃતિ સંસ્કૃતમાં છે. આ કોશની આ વિશિષ્ટતાને લઈને મેં એનો આ સંક્ષિપ્ત પરિચય આપ્યો છે, જ્યારે આ જ 'કર્તાના શબ્દામ્બુધિકોશનો, પં. હરગોવિન્દદાસ ત્રિકમચંદ શેઠે રચેલા 'પાઈયસદ્મહણાવ નામના પાઈય-સંસ્કૃત કોશનો, 'શતાવધાની' શ્રીરત્નચન્દ્રકૃત 'Ardhmagadhi Dictionary નો કે જેમાં જૈન આગમોના શબ્દોના સંસ્કૃતાદિ ચાર ભાષામાં અર્થ અપાયા છે તેનો તેમજ 'આગમોદ્ધારક' શ્રીઆનન્દસાગરસૂરિએ સંકલિત કરેલા 'અલ્પપરિચિતસૈદ્ધાન્તિકશબ્દકોષનો પરિચય હું આપતો નથી. [આ ઉપરાંત જૈનેન્દ્ર સિદ્ધાંત કોશ, જૈન લક્ષણાવલી, ભિક્ષુઆગમકોશ વગેરે કોષો પ્રસિદ્ધ થયા છે.]

એકાક્ષરી નાનાર્થ કાંડ- આ દિ. ધરસેનાચાર્યે ૩૫ પદ્યોમાં રચેલી કૃતિ છે.

પારસીક-નામમાલા યાને શબ્દ-વિલાસ (વિ. સં. ૧૪૨૨) - આ કૃતિના રચનાર હરિ બ્રાહ્મણ અજૈન હોવાનો ઘણો સંભવ છે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૪૪)માં ઉલ્લેખ છે. જૈ. ગ્રં. (પૃ ૩૧૧) પ્રમાણે આના કર્તાનું નામ સલક્ષમંત્રી છે અને એ કૃતિનું બીજું નામ શબ્દ-વિલાસ છે.

[સંખ્યાવાચકશબ્દકોશ : સં. આ. જિનેન્દ્રસૂરિ, પ્રકા. હર્ષપુષ્પા-૨૦૪. લેશ્યાકોષ-સં. મોહનલાલ બાંકીયા, કલકત્તા, ઈ. ૧૯૯૬. સંધિવિનોદપંચદશી-આ. ધર્મધુરંધરસૂરિ, જૈન સા. પ્ર. સભા.]

સંદિગ્ધ કૃતિઓ

P. ૧૩૩

હવે હું એવી કેટલીક કૃતિઓ નોંધું છું કે જે ખરેખર શબ્દોની નામમાલા છે કે કેમ તે વિષે સંદેહ રહે છે.

મનોરથ-નામમાલા - આની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૧૧)માં છે.

વસ્તુવિજ્ઞાનરત્નકોશ - આ કૃતિ જૈ. ગ્રં. (પૃ. ૩૧૨)માં નોંધાયેલી છે.

વસ્તુ-કોશ-આનો ઉલ્લેખ જૈ. ગ્રં. (પૃ. ૩૧૨)માં કરાયો છે.

વસ્તુ-કોશ-આનો ઉલ્લેખ જૈ. ગ્રં. (પૃ. ૩૧૨)માં કરાયો છે.

રસસાર-જૈ. ગ્રં. (પૃ. ૩૧૧) પ્રમાણે આના કર્તા ગોવિન્દાચાર્ય છે.

રત્નકોશ-વ્યાખ્યા (વિ. સં. ૧૧૭૬)-શું આ કોઈ રત્નકોશ નામની કૃતિની ટીકાનું નામ છે ?

પદ્યકોશ-જૈ. ગ્રં. (પૃ. ૩૧૧)માં આને શબ્દોનો કોશ ગણ્યો છે. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૩૩)માં જ્યોતિષની એક કૃતિનું નામ પદ્યકોશ અપાયું છે તો તે જ આ કૃતિ છે ?

લોક-સંવ્યવહાર-આ 'ચંદ્રપ્રભવિજય નામનું કાવ્ય રચનારા રવિગુપ્તની કૃતિ છે એમ જૈ. ગ્રં. (પૃ. ૩૧૨)માં ઉલ્લેખ છે, પણ મને તો એ નીતિનો ગ્રંથ હશે એમ એનું નામ વિચારતાં સ્ફુરે છે.

[સંખ્યાવાચક શબ્દકોશ : સં. આ. જિનેન્દ્રસૂરિ, પ્ર. હર્ષપુષ્પા. ૨૦૪ લેશ્યાકોષ- સ. મોહનલાલ બાંકીયા કલકત્તા ઈ. ૧૯૯૬. સંધિવિનોદપંચદશી- આ. ધર્મધુરંધરસૂરિ, જૈન સા. પ્ર. સભા.]



૧. આ ઉપરાંતની કૃતિઓનાં નામ વગેરે માટે જુઓ અભિધાનરાજેન્દ્રના પ્રથમ ભાગની પ્રસ્તાવના (પૃ. ૧૩-૧૪)

૨. આના પરિચય માટે જુઓ પાઈય (પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય (પૃ. ૫૯-૬૦) ૩. એજન પૃ. ૬૦

૪. એજન પૃ. ૬૦ ૫. આ નામથી આ કૃતિની નોંધ જૈ. ગ્રં.માં કે જિ. ૨. કો.માં જોવાતી નથી તેનું શું.

પ્રકરણ ૫ : છંદ:શાસ્ત્ર

‘છંદ’ એ છ વેદાંગ પૈકી એક છે. ‘છંદ:શાસ્ત્ર’ એટલે અક્ષર કે માત્રાના મેળથી-નિયમથી ઉદ્ભવતાં વિવિધ વૃત્તોની શાસ્ત્રીય વિચારણા. આને અંગ્રેજીમાં પ્રોસોડી (Prosody) તેમજ મેટ્રિક્સ (Metrics) કહે છે. સામાન્ય રીતે એમ મનાય છે કે દરેક દેશમાં સૌથી પ્રથમ પદ્યાત્મક કૃતિ એટલે કે છંદોબદ્ધ રચના યોજાઈ છે. આપણે ત્યાં પણ પ્રાચીનતમ સાહિત્ય તરીકે નિર્દેશાતા ઋગ્વેદનાં સૂક્તો છંદમાં-વિવિધ છંદમાં છે. જૈનોના આગમો પૈકી કેટલાક સર્વાંશે તો કેટલાક અંશતઃ છંદમાં રચાયેલા છે. આને લઈને છંદ:શાસ્ત્ર સંબંધી કૃતિઓ જૈનોને તેમજ અજૈનોને હાથે યોજાયેલી મળે છે. આપણે અહીં મૌલિક જૈન કૃતિઓ અને એનાં વિવરણો વિષે વિચારીશું.

છંદ:શાસ્ત્ર (વિક્રમની છઠી સદી)- આના કર્તા જૈનેન્દ્ર વ્યાકરણ ‘વગેરેના પ્રણેતા દિ. પૂજ્યપાદ છે. જયકીર્તિએ પોતાના છંદોડનુશાસનમાં જે પૂજ્યપાદની કૃતિનો ઉપયોગ કર્યાનું પોતે કહ્યું છે તે આ જ પૂજ્યપાદ હોવા જોઈએ. ગમે તેમ પણ એમનું આ છંદ:શાસ્ત્ર હજી સુધી તો અપ્રાપ્ય છે.

‘જયદેવચ્છન્દસ્’ (ઉ. વિ. સં. ૯૫૦)- આના કર્તા જયદેવ છે. [વૃત્તરત્નાકરના ટીકાકાર સુલ્લેણે જયદેવ માટે ‘ચેતપટ’ વિશેષણ વાપર્યું છે એટલે ગ્રંથકાર શ્વેતાંબર છે એ નિશ્ચિત થાય છે.]

P. ૧૩૫ વિષયના નિરૂપણ માટે પિંગલને અનુસરીને એમણે પોતાની પદ્ધતિએ આ કૃતિ રચી છે. એમાં આઠ અધ્યાય છે. પહેલામાં સંજ્ઞા, બીજામાં વૈદિક છંદ ‘ગાયત્રી’ અને ત્રીજામાં વિવિધ વૈદિક છંદો વિષે વિચાર કરાયો છે, અને ચોથાથી લૌકિક છંદો હાથ ધરાયા છે. ચોથા અધ્યાયમાં આર્યા અને વૈતાલીય છંદના પ્રકારો ઉપર અને પાંચમાથી સાતમા અધ્યાયમાં સમ-વૃત્ત, અર્ધ-સમ-વૃત્ત અને વિષમ-વૃત્તો ઉપર પ્રકાશ પડાયો છે. આ અધ્યાયોમાં લૌકિક છંદોનાં લક્ષણો તે તે છંદમાં અપાયાં છે. આઠમા અધ્યાયમાં પ્રસ્તાર વગેરે વિષે પદ્યમાં નિરૂપણ છે.

ત્રૈવિદ્યગોષ્ઠી (પત્ર ૮આ)માં કહ્યું છે કે જાતિ વિવિધ પ્રકારની છે અને દંડકના ઘણા પ્રકારો છે. ‘માત્રા’ છંદના ‘માગધી’મા ૬૭ કરોડ અને ૬૦ લાખ ભેદ છે, ‘ઉપહાસિની’ના ૪ અબ્જ (અબજ), ૫૬ કરોડ, ૯૭ લાખ અને ૬૦ હજાર ભેદ છે, અને ‘આર્યા’ના ૮ કરોડ, ૨૯ લાખ અને ૨૦ હજાર ભેદ છે. આને લગતા પ્રસ્તાર વગેરે છ પ્રત્યય છે.

હર્ષટની ટીકા સહિતના મૂળમાં જે પાઠ હોવાનું જોવાય છે તે સ્વતંત્ર મૂળથી કેટલીક વાર ભિન્ન છે અને એ તો બની શકે, પરંતુ એમાં આઠમા અધ્યાયને લગતો ભાગ સ્વતંત્ર કૃતિમાં પાંચ જ પદ્યો પૂરતો છે, જ્યારે આ સટીક મૂળમાં બાર જેટલો છે.

૧. જુઓ પૃ. ૮-૯.

૨. “હરિતોષ સમિતિ” તરફથી ઈ. સ. ૧૯૪૯માં “જયદામન” નામથી પ્રસિદ્ધ થયેલી આવૃત્તિમાં જે નીચે મુજબની ચાર કૃતિ છપાઈ છે તેમાં આ પહેલી છે:-

(અ) જયદેવચ્છન્દસ્ (હર્ષટકૃત ટીકા સહિત), (આ) જયકીર્તિકૃત છંદોડનુશાસન. (ઇ) કેદારકૃત વૃત્તરત્નાકર અને (ઈ) હૈમ છંદોડનુશાસન.

૩. આને અંગેનો મારો લેખ નામે “જયદેવકૃત જયદેવચ્છન્દસ્” “જૈ. સ. પ્ર.” (વ. ૧૫, અં. ૧૦)માં છપાયો છે.

સંપ્રદાય-નમિસાધુ સ્વયંભૂ કવિદર્પણના કર્તા અને ‘જયકીર્તિ’ એ તમામ જૈન ગ્રન્થકારો જયદેવને પિંગલ જેટલું મહત્વ આપવા પ્રેરાયા છે એ બાબત એઓ જૈન હોવાનું સૂચવે છે. વળી એઓ કેદાર કરતાં વધારે પ્રાચીન અને કેદાર જેટલા તો વ્યવસ્થિત લેખક હોવા છતાં વૈદિક ધર્મના અનુયાયીઓમાં એઓ લોકપ્રિય ન બની શક્યા તે પણ એમના જૈનત્વને આભારી હશે.^૩

ઈ. સ.ની દસમી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા ભટ્ટ હલાયુધે પિંગલના છંદ:સૂત્ર ઉપર ટીકા રચી છે. અહીં ૧, ૧૦ અને ૫, ૮ એ બંને ઉપરની ટીકામાં શ્વેતપટના ઉલ્લેખપૂર્વક એમણે નીચે મુજબ P. ૧૩૬ કથન કરેલ છે:-

(૧) “વાન્તે ગ્વક્રઃ” ઇતિ પ્રોક્તં વૈશ્વ શ્વેતપટાદિભિઃ”

(૨) “ ‘અન્યદતોઽપિ વિતાનં’ શ્વેતપટેન યદુક્તમ્”

‘ચિત્રપદાઽપિ ચ ભો ગૌ’ તેન ગતાર્થમિવૈત્ત ।”

આ પૈકી “વાન્તે ગ્વક્રઃ” એ જયદેવચ્છન્દસૂ નામની કૃતિના પહેલા અધ્યાયનું ચોથું સૂત્ર છે. “અન્યદતો હિ વિતાનં” એમ અ. ૫માં જોવાય છે. “ચિત્રપદાઽ ચ ભો ગૌ” એ અ. ૬ માં છે. આથી ‘શ્વેતપટ’ તે જયદેવ જ છે એમ અનુમાન કરાય છે અને એ અનુમાનને આધારે જયદેવ શ્વેતપટ એટલે શ્વેતાંબર મનાય છે.

કેદારકૃત વૃત્તરત્નાકર ઉપર સુલ્હણે વિ. સં. ૧૨૪૬માં “વૃત્તિ રચી છે. એમાં એમણે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે :-

“ ‘અન્યદતો હિ વિતાનં’ ઇતિ શૂદ્રશ્વેતપટજયદેવેન યદુક્ત ભૌગિતિ ચિત્રપદા ગઃ ઇત્યનેન ગતાર્થત્વાત્”

આથી ઉપરના અનુમાનને ટેકો મળે છે.

સમયનિર્ણય-ભટ્ટ હલાયુધે જયદેવનો મુખ્યત્વે નિર્દેશ કરીને ઉલ્લેખ કર્યો છે એ હિસાબે એઓ ઈ. સ. ની દસમી સદીના ઉત્તરાર્ધ જેટલા તો પ્રાચીન છે જ એટલે કે વિ. સં. ૧૦૫૬ પૂર્વે થયા છે.

ઈ. સ. ૧૦૦૦ કરતાં પહેલાં થઈ ગયેલા સ્વયંભૂએ ‘સયંભૂછંદ (૧-૧૪૪)માં નીચે મુજબ P. ૧૩૭ ઉલ્લેખ કર્યો છે :-

૧. એમના છંદોડનુશાસનને અંગે મેં “જયકીર્તિનું છંદોડનુશાસન” નામના લેખમાં વિચાર કર્યો છે. આ લેખ અહીંના (સુરતના) “દિગંબર જૈન” (વ. ૪૩, અં. ૪)માં છપાયો છે.

૨. જુઓ જયદામન્ (પૃ. ૩૩).

૩. જુઓ જયદામન્ની પ્રસ્તાવના (પૃ. ૩૩).

૪. આ ‘કલિ.’ હેમચન્દ્રસૂરિકૃત છંદોડનુશાસન (અ. ૧)માં પણ છે.

૫. વૃત્તરત્નાકર (અ. ૧-૬)ને અંગેની આ વૃત્તિ મુંબઈ વિદ્યાપીઠના સામયિકમાં (Arts Nos. 26, 28 & 29)માં ત્રણ કટકે ઈ.સ. ૧૯૫૧, ૧૯૫૩ અને ૧૯૫૪માં અનુક્રમે છપાઈ છે.

૬. જુઓ જયદામન્ની પ્રસ્તાવના (પૃ. ૩૧).

૭. આ કૃતિ “JBBRASમાં” ઈ. સ. ૧૯૩૫માં છપાઈ છે.

“જયદેવ-પિંગલા સક્કયંમિ દોચ્ચિ અ જઈ સમિચ્છંતિ ।

મંડબ્બ-ભરહ-કાસવ-સેયવપમુહા ન ઇચ્છંતિ ॥”

ભરતના નાટ્યશાસ્ત્ર ઉપર અભિનવગુપ્તે ^૧ટીકા રચી છે. એના પૃ. ૨૪૪માં જયદેવ વિષે ઉલ્લેખ છે.

કન્નડ છંદ:શાસ્ત્રી નાગવર્માએ ઈ. સ. ૯૯૦માં રચેલા છંદોડમ્બુધિમાં જયદેવનો ઉલ્લેખ કર્યો છે.

વરાહમિહિરની બૃહત્સંહિતા ઉપર ભટ્ટ ઉત્પલે ઈ. સ. ૯૬૬માં ટીકા રચી છે. અ. ૧-૩ ઉપરની ટીકામાં છંદોનાં જે લક્ષણો એમણે આપ્યાં છે તે આ જયદેવચ્છન્દસૂત્રને આધારે હોય એમ એમ લાગે છે.^૩

શકસંવત્ ૪૨૭ (વિ. સં. ૫૬૨)માં પંચસિદ્ધાંતિકા રચનાર વરાહમિહિર આ જયદેવને જાણતા હશે.

આ ઉપરથી એમ કહી શકાય કે જયદેવ ઈ. સ. ૯૦૦ પહેલાં ક્યારેક થઈ ગયા છે અને કદાચ ઈ. સ. ૬૦૦ કરતાં પણ પહેલાં થયા હશે. પૂજ્યપાદના પણ કદાચ પુરોગામી હશે.

P. ૧૩૮ ઉલ્લેખો-વૃત્તજાતિસમુચ્ચય (૬, ૭) ઉપરની ટીકામાં ગોપાલે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે :-

“તથા ચોક્તમન્યૈઃ - ‘एष्वेव पिण्डितेषु (च) सङ्ख्या प्रस्तारविरचिता भवति’ ।”

આ અવતરણ જયદેવચ્છન્દસૂત્રમાં અ. ૮ ના શ્લો. ૧૧ તરીકે જોવાય છે.

વૃત્તરત્નાકરની ટીકામાં ત્રિવિક્રમે, જયકીર્તિએ છંદોડનુશાસન (અ. ૮, શ્લો. ૧૯)માં, ‘કલિ.’ હેમચન્દ્રસૂરિએ છંદોડનુશાસન (૨, ૨૯૭; ૩, ૫૧-૫૨)ની સ્વોપજ્ઞ ટીકા નામે છંદશ્યૂડામણિમાં, અજ્ઞાત ‘છંદ:શાસ્ત્રીએ કવિદર્પણ (૬, ૧૦)માં, વૃત્તરત્નાકર (અ. ૨, શ્લો. ૩૬)માં નારાયણે અને વૃત્તરત્નાકર (૩, ૩૧; ૫, ૬; અને ૫, ૯)ની ટીકામાં બૌદ્ધ રામચન્દ્ર વિભુષે જયદેવ વિષે ઉલ્લેખ કર્યો છે.

વિશેષમાં શીલાંકસૂરિએ સૂચગડ (સુચ. ૧, અ. ૨, ઉ. ૧)ની નિજજુત્તિ (ગા. ૩૮)ની ટીકામાં જે નીચે મુજબનું ‘વૈતાલીય’ છંદનું લક્ષણ અવતરણરૂપે રજૂ કર્યું છે તે આ જયદેવચ્છન્દસૂ (અ. ૪, પૃ. ૧૫)ગત લક્ષણ સાથે લગભગ અક્ષરશઃ મળે છે:-

“वैतालीयं लर्गनैधनाः । षडयुक् पादोष्टौ समश्चलः ॥

न समोऽत्र परेण युज्यते । नैता षट् च निरन्तरा युजोः ।”

P. ૧૩૮ મુનિ અને સૈતવ-જયદેવે અ. ૫ (પૃ. ૨૦)માં મુનિ અને સૈતવ એ બેના મત નોંધ્યા છે. ‘મુનિ’નો અર્થ હપ્ટે પિંગલ કર્યો છે.

૧. જુઓ જયદામન્ની પ્રસ્તાવના (પૃ. ૩૨).

૨. આ ટીકાના મૂળ સહિત ત્રણ ભાગ “ગા. પૌ. ગ્રં.”માં ઈ. સ. ૧૯૨૬, ૧૯૩૪ અને ૧૯૫૪માં અનુક્રમે છપાયા છે.

૩. જુઓ પ્રો. વેલણકરનો વરાહમિહિર અને ઉત્પલને અંગેનો લેખ. આ “સી. કે. રાજા સ્મારકગ્રન્થ” (પૃ. ૧૪૧-૧૫૨)માં ઈ. સ. ૧૯૪૬માં છપાયો છે.

૪. આ સુલ્લેખ કરતાં પહેલાં થયા હશે.

૫. આ જૈન છે અને એઓ ‘કલિ.’ હેમચન્દ્રસૂરિને અનુસરે છે.

૬-૭. પાદોષ્ટ અને “સમૈ ચ લઃ” એમ બે પાઠાન્તર મળે છે.

વૈદિક છંદોમાંથી લૌકિક વર્ણવૃત્તો સર્વથા છૂટાં પડી નહિ ગયાં હતાં એવા સમયમાં જયદેવે પોતાની કૃતિ રચી હશે એમ પ્રો. વેલણકરે પૃ. ૩૪માં કહ્યું છે. વિશેષમાં એમણે એમ પણ કહ્યું છે કે અભિજ્ઞાન-શાકુંતલ (અંક ૪, શ્લો. ૮)માં જે વૈદિક છંદ વપરાયો છે તે એ પ્રસંગને બરાબર અનુરૂપ છે, પરંતુ એ વૈદિક છંદોની લૌકિક છંદો ઉપરની અસર અને પકડની છેલ્લી નિશાની સૂચવે છે. સંક્રાંતિ-કાળમાં જયદેવ થયાનું પ્રો. વેલણકર માને છે. સંસ્કૃત એ વૈદિક ધર્મના જ અનુયાયીઓનો વારસો છે એવી માન્યતા હજી પ્રચલિત હતી એવે સમયે જયદેવે પોતાની કૃતિ રચી હોવી જોઈએ. લૌકિક સંસ્કૃત છંદો વિષે નિરૂપણ કરનાર એ છંદોના જન્મદાતા રૂપ વૈદિક છંદોની અવગણના કરી શકે તેમ ન હતું એવા સમયની જયદેવની કૃતિ હોવાથી એમાં વૈદિક છંદોને લગતી હકીકત જોવાય છે એમ પ્રો. વેલણકરનું કહેવું છે.

જયદેવચ્છન્દસૂ ઉપર હર્ષટની વિવૃત્તિ, વર્ધમાનની વૃત્તિ અને શ્રીચન્દ્રનું ટિપ્પણ છે.

હર્ષટ— આ મુકુલભટ્ટના પુત્ર થાય છે. એમના નામનો વિચાર કરતાં એઓ કાશ્મીરના હોવા જોઈએ. કાવ્યપ્રકાશના કર્તા મમ્મટે એક મુકુલભટ્ટનો ઉલ્લેખ કર્યો છે. એમણે અભિધાવૃત્તિમાતૃકા રચી છે અને એમનો સમય ઈ. સ. ૯૨૫ની આસપાસનો છે. આ જ મુકુલભટ્ટના પુત્ર તે હર્ષટ છે કે કેમ એનો નિર્ણય કરવો બાકી રહે છે; બાકી હર્ષટની ટીકાની હાથપોથી જે વર્ષમાં લખાયેલી મળે છે એ હિસાબે હર્ષટ ઈ. સ. ૧૧૨૪ પહેલા થયા છે.

'છંદોડનુશાસન (લ. વિ. સં. ૧૦૫૦)- આના કર્તા કાનડી દિ. જયકીર્તિ છે. એમણે આ પ. ૧૪૦ પદ્યાત્મક કૃતિ રચવામાં જનાશ્રય, જયદેવ, પિંગલ, પાદપૂજ્ય (પૂજ્યપાદ), માંડવ્ય અને સૈતવની છંદોવિષયક કૃતિઓનો ઉપયોગ કર્યો છે.^૧ એમણે આ કૃતિ નિમ્નલિખિત નામવાળા આઠ અધિકારોમાં વિભક્ત કરી છે:-

(૧) સંજ્ઞા, (૨) સમ-વૃત્ત, (૩) અર્ધ-સમ-વૃત્ત, (૪) વિષમ-વૃત્ત, (૫) આર્યા-જાતિ-માત્રાસમક-જાતિ, (૬) મિશ્ર, (૭) કર્ણાટવિષયભાષા-જાતિ અને (૮) પ્રસ્તારાદિ-પ્રત્યય.

આ કૃતિમાં વૈદિક છંદોને સ્થાન અપાયું નથી, પણ જ્ઞન્નડ (કાનડી) છંદોને અપાયું છે.

સમગ્ર લખાણ માટે મુખ્યત્વે અનુષ્ટુભ્, આર્યા અને સ્કન્ધક યાને આર્યાગીતિ એ ત્રણ છંદોનો ઉપયોગ કરાયો છે. આ ઉપરાંત છંદોનાં લક્ષણો તે તે છંદમાં અપાયાં છે. એ રીતના બીજા પણ છંદો છે. પૃ. ૪૫માં એમણે 'ઉપજાતિ'ને માટે 'ઇન્દ્રમાલા' એવું અન્ય નામ નોંધ્યું છે. પૃ. ૪૬માં મુનિ દમસાગરના, પૃ. ૫૨ માં શ્રીપાલ્યકીર્તિશિના અને સ્વયંભૂવેશના અને પૃ. ૫૬માં કવિ ચારુકીર્તિ મુનિના મત વિષે ઉલ્લેખ છે.

૧. આ પ્રકાશિત છે (જુઓ પૃ. ૭૮) આની એક હાથપોથી વિ. સં. ૧૧૮૦માં લખાયેલી છે. આ કૃતિને અંગેના મારા લેખ માટે જુઓ પૃ. ૭૮.

૨. "છંદ : શાસ્ત્રી જયકીર્તિ તે કોણ ?" એ નામનો મારો લેખ "દિગંબર જૈન" (વ. ૪૩, અં. ૫)માં પ્રસિદ્ધ થયો છે.

૩. જુઓ આઠમા અધિકારનું અંતિમ (૧૮મું) પદ.

૪. આની માહિતી માટે જુઓ પ્રો. વેલણકરનો ઈ. સ. ૧૯૪૫માં "JBBRAS"માં પ્રસિદ્ધ થયેલો લેખ. મુંબઈ વિદ્યાપીઠના સામયિક (Arts No. 22)માં ઈ. સ. ૧૯૪૭ના જાન્યુઆરીના અંકમાં પણ આ છંદો વિષે લેખ છે.

P. ૧૪૧ પૃ. ૬૬માં ચોવીસ માટે 'જિન' સંજ્ઞા વપરાઈ છે. સંજ્ઞાધિકારના નામના પહેલા અધિકારના શ્લો. ૨૨માં 'કર્ણાટક'નો અને પૃ. ૬૬માં 'કર્ણાટ'નો તેમજ 'કર્ણાટક'નો ઉલ્લેખ છે. પૃ. ૬૭માં કર્ણાટ-માલતીમાધવ અને કર્ણાટ-કુમારસંભવનો પૃ. ૬૬માં શૃંગારપિંડ કાવ્યનો ઉલ્લેખ છે.

જયકીર્તિએ અ. ૧, શ્લો. ૧૩માં કહ્યું છે કે 'પિંગલ, વસિષ્ઠ, કૌણિન્ય, કપિલ અને કંબલ મુનિ યતિ ઈચ્છે છે, જ્યારે ભરત, કોહલ, માંડવ્ય, અશ્વતર, સૈતવ વગેરે એ ઈચ્છતા નથી.

જયકીર્તિનું છંદોડનુશાસન એ સંસ્કૃત છંદ:શાસ્ત્રને લગતો એક મહત્વનો ગ્રન્થ છે. એનું સ્થાન કાલક્રમ અને વિકાસની દૃષ્ટિએ કેદારના વૃત્તરત્નાકર અને 'કલિ.' હેમચન્દ્રસૂરિના છંદોડનુશાસનની વચ્ચે છે એમ પ્રો. વેલણકરનું કહેવું છે. એમણે એમની પ્રસ્તાવના (પૃ. ૩૭-૩૮)માં જયકીર્તિનો સમય ઈ. સ. ૧૦૦૦ની આસપાસનો દર્શાવ્યો છે અને તેને માટે એ કારણ આપ્યું છે કે ઈ. સ.ની દસમી સદીના પૂર્વાર્ધમાં ઈ. સ. ૯૫૦ના અરસામાં થઈ ગયેલા અસગ વગેરે વિષે જયકીર્તિએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે (જુઓ અ. ૭, પૃ. ૬૭).

ધમ્મોવએસમાલા ઉપર વિ. સં. ૯૧૫માં વિવરણ રચનારા જયસિંહસૂરિના શિષ્ય અને ૧૧૬ ગાથામાં જ. મ.માં સીલોવએસમાલા રચનારનું નામ જયકીર્તિ છે. શું આ પ્રસ્તુત છંદ:શાસ્ત્રી છે ?

P. ૧૪૨ જોઈદુ (યોગીન્દુ)કૃત યોગસારની હાથપોથી વિ. સં. ૧૧૯૨માં જેઠ સુદ તેરસે લખાઈ છે. એ લખાવનાર જયકીર્તિસૂરિના શિષ્ય અમલકીર્તિ છે એમ નિમ્નલિખિત પદ્ય જોતાં જણાય છે :-

“શ્રીજયકીર્તિસૂરીણાં શિષ્યેણામલકીર્તિના । લેખિતં યોગસારાચ્ચં વિદ્યાર્થિધામકીર્તિના ॥”

જો અહીં નિર્દેશાયેલા જયકીર્તિ તે જ પ્રસ્તુત છંદ:શાસ્ત્રી હોય તો એમના શિષ્યનું નામ અમલકીર્તિ હતું એમ આપણે કહી શકીએ.

ચિતોડગઢનો એક શિલાલેખ વિ. સં. ૧૨૦૭માં લખાયેલો છે. એમાં અંતમાં નીચે મુજબ ઉલ્લેખ છે:-

“શ્રીજયકીર્તિશિષ્યેણદિગંબરગણેશિના । પ્રશસ્તિરીટ્કશીચકે...શ્રીરામકીર્તિનાસંવત્ ૧૨૦૭ સૂત્રધા.... ?”

આ ઉપરથી એમ કહી શકાય કે દિ. જયકીર્તિને રામકીર્તિ નામે શિષ્ય હતા. અહીં આપેલો સંવત્ વૈક્રમીય હોય તો આ જયકીર્તિનો સમય વિ. સં. ૧૧૯૦ની અર્ધાત્ ઈ. સ. ૧૧૩૪ની આસપાસનો ગણાય. છંદ:શાસ્ત્રી જયકીર્તિનો સમય પ્રો. વેલણકરનું મતે ઈ. સ. ૧૦૦૦ની આસપાસનો છે.^૧ આ બાબત સાચી જ નીકળે તો છંદ:શાસ્ત્રી જયકીર્તિ શિલાલેખમાં નિર્દેશાયેલા દિ. જયકીર્તિથી ભિન્ન ઠરે; બાકી છંદ:શાસ્ત્રીનો સમય સો વર્ષ જેટલો અર્વાચીન ઠરે એટલે કે ઈ. સ. ૧૧૦૦નો ઠરે તો આ બંને એક હોવાની કલ્પના કરી શકાય.

૧-૨. માંડવ્યનો તેમજ કૌષ્ટિક, તંડિન્, યાસ્ક, કાશ્યપ, સૈતવ અને રાટનો ઉલ્લેખ પિંગલે કર્યો છે. જુઓ M.

Krishnamachariarનું પુસ્તક History of Classical Sanskrit Literature (p. 902)

૩. જુઓ “અનેકાન્ત” (વ. ૧, કિ. ૬-૭, પૃ. ૩૨૯)ગત પં. નાથૂરામ પ્રેમીના લેખ ઉપરનું સંપાદકીય ટિપ્પણ તેમજ જૈ. સા. ઈ. (પૃ. ૫૨૬).

૪. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૫૨૬).

૫. જુઓ ઉપરનો પેરેગ્રાફ ૩.

છંદ:શાસ્ત્ર (લ. વિ. સં. ૧૦૮૦)- આના કર્તા વિ. સં. ૧૦૮૦માં બુદ્ધિસાગર વ્યાકરણ P. ૧૪૩ રચનારા બુદ્ધિસાગરસૂરિ છે એમ ગુણયન્દ્રગણિએ વિ. સં. ૧૧૩૯માં પૂર્ણ કરેલા મહાવીરચરિયની પ્રશસ્તિ (શ્લો.) જોતાં જણાય છે પણ આ છંદ:શાસ્ત્ર સંસ્કૃતમાં છે કે કેમ તે જણાવું બાકી રહે છે. બાકી ઉપર્યુક્ત ઉલ્લેખનું સમર્થન કરનારું સાધન મળે છે અને એ તો વર્ધમાનસૂરિએ વિ. સં. ૧૧૪૦માં રચેલી મનોરમાકહાની પ્રશસ્તિ છે. આ છંદ:શાસ્ત્ર ગમે તે ભાષામાં હોય પણ એ વિ. સં. ૧૦૮૦ની આસપાસની રચના હોય એમ લાગે છે, અને જો ઉપર્યુક્ત જયકીર્તિનો સમય ઈ. સ. ૧૦૦૦ની લગભગનો હોય તો તેમનું છંદોડનુશાસન પણ લગભગ આ સમયનું હશે. આમ બે કૃતિઓ પ્રાયઃ સમકાલીન હશે.

છંદ:શેખર (ઉ. વિ. સં. ૧૧૭૯)- આના કર્તા રાજશેખર છે. એમના કથન મુજબ એઓ ઠક્કર દુદ્ધક અને નાગદેવીના પુત્ર થાય છે અને યશના પુત્ર લાહરના એઓ પૌત્ર છે. આ કૃતિ ભોજદેવને પ્રિય હોવાનું અહીં કહ્યું છે. આની એક હાથપોથી વિ. સં. ૧૧૭૯માં લખાયેલી મળે છે. આ કૃતિનું પાંચમું પ્રકરણ સંસ્કૃતમાં છે અને એમાં ઉત્સાહથી માંડીને દ્વિપદી સુધીના ‘અપભ્રંશ’ છંદોનું નિરૂપણ છે. આ કૃતિને અંગે પ્રો. વેલણકરે “Chandas’s’ekhara of Rajas’ekhara” નામનો લેખ લખ્યો છે.

સમાનનામક કૃતિ—જયશેખરે છંદ:શેખર રચ્યાનો ઉલ્લેખ મળે છે પણ એમને વિષે કે એમની આ કૃતિ વિષે વિશેષ માહિતી મને મળી નથી. આથી જો આ જયશેખર તે જૈનકુમારસંભવના કર્તા અંચલગચ્છીય જયશેખર જ હોય તો એમનો પરિચય આગળ ઉપર મેં આપ્યો છે.

‘છંદોડનુશાસન (લ. વિ. સં. ૧૨૧૦)- આ નામ એના કર્તા ‘કલિ.’ હેમચન્દ્રસૂરિએ આદ્ય P. ૧૪૪ મંગલશ્લોકમાં આપ્યું છે. સાથે સાથે એમણે આ કૃતિ શબ્દાનુશાસન અને કાવ્યાનુશાસન બાદ રચાઈ છે અને એમાં કાવ્ય માટે ઉપયોગી છંદોનું નિરૂપણ છે એ વાત કહી આના પછી સૂત્રરૂપે છંદ:શાસ્ત્રની યોજના કરી છે. હૈમ કાવ્યનુશાસન (અ. ૩, સૂ. ૫) ઉપરની અલંકારચૂડામણિ નામની સ્વોપજ વૃત્તિ (પૃ. ૨૧૪)માં પ્રસ્તુત ‘છંદોડનુશાસન જોવાની ભલામણ કરાઈ છે.

૧. આ લેખ “JBBRAS” (Vol. 22)માં ઈ. સ. ૧૯૪૬માં છપાયો છે.

૨. આ કૃતિ સ્વોપજ વૃત્તિ સહિત દેવકરણ મૂલચંદ્ર (મૂળજી) તરફથી ઈ. સ. ૧૯૧૨માં છપાવાઈ છે. એનું સંપાદન ‘આગમોદ્ધારક’ આનંદસાગરસૂરિજીએ મુનિ-અવસ્થામાં કર્યું છે. એમણે સંસ્કૃતમાં નાનકડી પ્રસ્તાવના લખી છે. એના પછી ભરતના મતે તમજ અન્ય છંદ:શાસ્ત્રીઓના મતે છંદોનાં જે નામાંતર ‘કલિ.’ હેમચન્દ્રસૂરિએ આપ્યાં છે. તેની નોંધ લીધી છે. અ. ૫માં “પ્રાયોડપન્નજો” એવું સૂત્ર પ્રારંભમાં નોંધાયું નથી, જો કે એ હોવું જોઈએ એમ એની સ્વોપજ વૃત્તિ જોતાં જણાય છે. [સિંધી ગ્રંથમાળામાં છંદોડનુશાસન છપાયું છે.]

પ્રો. હરિ દામોદર વેલણકરે ચોથા અધ્યાયના ઉત્તરાર્ધથી-ગીતિના લક્ષણથી માંડીને તે સાતમા અધ્યાયના અંત સુધીનો ભાગ સ્વોપજ વૃત્તિ તેમજ પર્યાય સહિત સંપાદિત કર્યો છે (પરંતુ ઉદાહરણોના મૂળ સૂચવ્યાં નથી). એ ભાગ બે કટકે “JBBRAS” ના Vol. 19 અને Vol. 20 માં અનુક્રમે ઈ.સ. ૧૯૪૩ અને ૧૯૪૪માં પ્રકાશિત થયો છે. આના અનુસંધાનરૂપ લેખ આ સામયિક (Vol. 22) માં ઈ.સ. ૧૯૪૬માં છપાયો છે. એ દ્વારા “પ્રાકૃત અને અપભ્રંશ છંદો”ની સૂચી અપાઈ છે.

૩. ખરી રીતે એની સ્વોપજ વૃત્તિની - અ. ૧, સૂ. ૧૫ની વૃત્તિની ભલામણ છે. આથી એમ કહી શકાય કે ‘કલિ.’ હેમચન્દ્રસૂરિ વૃત્તિનો મૂળને નામે ઉલ્લેખ કરે છે.

છન્દોડનુશાસનનું નામ જિનપ્રભસૂરિએ 'અજિય-સંતિ-યયના ઉપરની વિ. સં. ૧૩૬૫ની વૃત્તિમાં છંદશ્ચૂડામણિ આપ્યું છે.^૨

P. ૧૪૫ છંદોડનુશાસન એ આઠ અધ્યાયમાં વિભક્ત છે. આગમોદ્ધારકની આવૃત્તિ પ્રમાણે એમાં અનુક્રમે નીચે મુજબની સંખ્યામાં સૂત્રો છે :-

૧૬, ૪૧૫, ૭૩, ૮૧, ૪૮, ૩૦, ૭૩ અને ૧૭. આમ કુલે અહીં ૭૬૪ સૂત્રો છે.

આ કૃતિની સ્વોપજ્ઞ વૃત્તિમાં કહ્યું છે તેમ અહીં વૈદિક છંદોની ચર્ચા નથી.

પ્રથમ અધ્યાયમાં છંદ:શાસ્ત્રને લગતી પરિભાષાનું એટલે કે વર્ણગણ, માત્રાગણ, વૃત્ત, સમવૃત્ત, વિષમવૃત્ત, અર્ધસમવૃત્ત, પાદ અને યતિનું નિરૂપણ છે.

બીજા-અધ્યાયમાં સમવૃત્ત છંદના પ્રકારો અને ગણોની યોજના અને અંતમાં દંડકના પ્રકારો વિચારાયાં છે. અહીં ૪૧૧ છંદોનાં લક્ષણો અપાયાં છે.

ત્રીજા અધ્યાયમાં અર્ધ-સમ, વિષમ, વૈતાલીય, માત્રા-સમક, ઇત્યાદિ ૭૨ છંદનાં લક્ષણ અપાયાં છે.

ચોથા અધ્યાયમાં પાઈય છંદોનાં 'આર્યા', 'ગલિતક', ખંજક અને શીર્ષક એમ મુખ્ય ચાર વિભાગો પડાયા છે. પહેલા વિભાગના પચ્ચીસેક છંદોનાં, બીજાના ત્રેવીસેકનાં એમ વિવિધ છંદોનાં લક્ષણ અહીં નજરે પડે છે. ટૂંકમાં કહું તો પાઈય ભાષાના બધા માત્રામેળ છંદ અહીં વિચારાયા છે.

P. ૧૪૬ પાંચમા અધ્યાયથી 'અપભ્રંશ' છંદોનો અધિકાર શરૂ થાય છે. એમાં ઉત્સાહ, રાસક, રક્ષા, રાસાવલય, ધવલમંગલ વગેરે છંદોનાં લક્ષણ રજૂ કરાયાં છે.

છઠ્ઠા અધ્યાયમાં ષટ્પદી અને ચતુષ્પદીના વિવિધ પ્રકારો વિચારાયા છે. પ્રારંભમાં ધ્રુવા, ધ્રુવક યાને ઘટ્તાનું લક્ષણ અપાયું છે.

સાતમા અધ્યાયમાં 'અપભ્રંશ' સાહિત્યમાં નજરે પડતી દ્વિપદીની ચર્ચા છે.

આઠમા અધ્યાયમાં 'પ્રસ્તાર વગેરેની સમજણ અપાઈ છે.

આમ આ કૃતિ લૌકિક સંસ્કૃત, પાઈય અને 'અપભ્રંશ'ના જાત-જાતના છંદો વિષે પ્રકાશ પાડે છે. એની આ મહત્તામાં એની સ્વોપજ્ઞ વૃત્તિગત સ્પષ્ટીકરણ અને ઉદાહરણો વૃદ્ધિ કરે છે. આથી એમ પ્રશ્ન પૂછવા હું લલચાઉં છું કે આના કરતાં સુગમ અને સાંગોપાંગ એવી કોઈ અન્ય કૃતિ છે ખરી ?

૧. આના પરિચય વગેરે માટે જુઓ D C G C M (Vol. XVII pt. 4, pp.1-10) તેમજ મારો લેખ નામે "અજિયસંતિથય (અજિતશાંતિસ્તવ) અને એનાં અનુકરણો". આ લેખ "આત્માનંદ પ્રકાશ" (પૃ. ૪૮, આ ૪-૫)માં છપાયો છે.

૨. જુઓ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૧૨૭)

૩. ગીતિ, ઉપગીતિ અને ઉદ્ગીતિ એ આર્યાના પ્રકારો છે.

૪. પ્રવરસેનકૃત રાવણવહ યાને સેઉબંધમાં ૪૪ પદો 'ગલિતક'માં છે. એના સાત પ્રકાર વગેરે માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૩૩).

૫. સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ૪૬આ)માં કહ્યું છે કે વૃત્તોનો વિસ્તૃત વિન્યાસ અર્થાત્ છંદોનો વિસ્તૃતપણે વિસ્તાર તે 'પ્રસ્તાર' છે.

મુનિવર નંદિષેણે જાતજાતના અને કેટલાક તો વિરલ જણાતા છંદોમાં અજિયસંતિથયની રચના કરી છે. આ 'તમામ છંદોનાં નામ પ્રસ્તુત છંદોડનુશાસનમાં જણાતાં નથી. જે નામથી જે છંદોનાં લક્ષણો અહીં અપાયાં નથી તે છંદોનાં લક્ષણો અન્ય નામથી અપાયાં છે ખરાં ? જો ન જ અપાયાં હોય (અને લાગે છે તો એમ જ) તો એનું શું કારણ હશે ? શું આ પાઈય સ્તોત્રથી હેમચન્દ્રસૂરિ અપરિચિત હશે P. ૧૪૭ કે આ સ્તોત્ર એમના સમય પછી રચાયું હશે કે અન્ય જ કારણ હશે ?

સ્વોપજ વૃત્તિ— જૈ. ગ્રં. (પૃ. ૩૧૭) પ્રમાણે તો આનું જ નામ છન્દશ્ચૂડામણિ છે. શરૂઆતમાં 'કલિ.' હેમચન્દ્રસૂરિએ અનુશાસનનો અર્થ 'પૂર્વાચાર્યોના શાસનને અનુસરનાર' એવો કર્યો છે, જો કે કેટલીક વાર છંદનાં નામો અન્ય પ્રકારનાં આપ્યાં છે. અહીં એમણે ભરત, સૈતવ, પિંગલ, જયદેવ, કાશ્યપ અને સ્વયંભૂનો તેમજ સિદ્ધસેન (દિવાકર), સિદ્ધરાજ, કુમારપાલ વગેરેનો ઉલ્લેખ કર્યો છે. કુમારપાલનો જે અહીં ઉલ્લેખ છે એ ઉપરથી આ વૃત્તિ તો એમના સમયમાં રચાયું ફલિત થાય છે.

અ. ૧, સૂ. ૧૫ની સ્વોપજ વૃત્તિ (પત્ર ૨ અ)માં “નમોઽસ્તુવર્ધમાનાય” થી શરૂ થતી સ્તુતિનું આદ્ય પદ્ય પાદાન્તે યતિના ઉદાહરણરૂપે અપાયું છે.

અ. ૪, સૂ. ૧ની સ્વોપજ વૃત્તિ (પત્ર ૨૬આ)માં કહ્યું છે કે 'આર્યા' તે જ સંસ્કૃતેતર ભાષાઓમાં 'ગાથા' કહેવાય છે.

અ. ૪, સૂ. ૫૫ની સ્વોપજ વૃત્તિ (પત્ર ૩૦ અ)માં નીચે મુજબનું પદ્ય છે :-

“જયતિ વિજિતાન્યતેજા: સુરાસુરાધીશસેવિત: શ્રીમાન્ ।
વિમલસ્ત્રાસવિરહિતસ્ત્રિલોકચિન્તામણિર્વીર: ।।”

અ. ૨, સૂ. ૧૫૫ની સ્વોપજ વૃત્તિ (પત્ર ૭અ)માં ઉપજાતિના ચૌદ પ્રકારો દર્શાવી ત્યાર બાદ પત્ર ૭અમાં દસવેયાલિય (અ. ૨)ના પાંચમા પદ્યનો અને અ. ૮, ઉ. ૧ના બીજા પદ્યનો અંશ ઉદ્ધૃત P. ૧૪૮ કરાયા છે.

અ. ૪, સૂ. ૫ની સ્વોપજ વૃત્તિ (પત્ર ૨૭ આ)માં 'કમલા'થી શરૂ થતાં ત્રણ પદ્યો 'ગાહા-લક્ષ્મણમાં ૪૦માથી ૪૨મા પદ્યરૂપે કંઈક પાઠભેદપૂર્વક જોવાય છે.

અ. ૫, સૂ. ૧૬ની સ્વોપજ વૃત્તિ (પત્ર ૩૬અ)માં તિલકમંજરી (પૃ. ૧૭૭)ગત “શુષ્કશિર્ષાર્ગવ” થી શરૂ થતું પદ્ય ઉદ્ધૃત કરાયું છે.

૧. બધા મળીને ૨૮ છંદો છે અને 'ગાહા'ના પાંચ ઉપપ્રકારોને ભિન્ન ગણીએ તો ૩૨ થાય.

૨. અજિયસંતિથય ઉપર જિનપ્રભસૂરિએ બોધિદીપિકા (કેટલાક આને બોધદીપિકા કહે છે)માં તમામ છંદોનાં લક્ષણો હૈમ છંદોડનુશાસનમાંથી ન આપતાં કેટલાકના કવિદૃષ્ટાંતમાંથી આપ્યાં છે એ વાત અહીં વિચારવી ઘટે.

૩. આ દેવકરણ મૂળજી તરફથી પ્રકાશિત છે.

૪. એમણે રચેલી પ્રથમ દ્વાત્રિંશિકાનું ૩૦મું પદ્ય પત્ર ૧અમાં ઉદ્ધૃત કરાયું છે.

૫. આ ત્રણ પદ્યની સ્તુતિ ત્રણ ભિન્ન ભિન્ન છંદમાં છે. છંદની દૃષ્ટિએ એ 'વિશાલલોચનથી' શરૂ થતી સ્તુતિ સાથે સામ્ય ધરાવે છે.

૬. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૬૨-૬૪).

અ. દ, સૂ. ૧ની સ્વોપજ વૃત્તિ (પત્ર ૪૨આ)માં મુંજના પાંચ દૂહાનાં મુખ્ય પ્રતીક આપી એને કામદેવનાં પાંચ બાણ સાથે સરખાવ્યાં છે. આ પૈકી બે 'દૂહા આ પછી અપાયા છે; બાકીના ત્રણની તપાસ કરવી બાકી રહે છે.

અ. ૭માં દ્વિપદી-ખંડનું ઉદાહરણ શ્રીહર્ષની રત્નાવલીમાંથી અપાયું છે.

શાસ્ત્રીય ચર્ચાની તેમજ ઐતિહાસિક સામગ્રીની દૃષ્ટિએ મહત્વની આં વૃત્તિમાં જે અનેક સંસ્કૃત અને પાઈય ઉદાહરણો અપાયાં છે એ સર્વેનાં મૂળ શોધાવાં જોઈએ.

વૃત્તિ— મૂળ કૃતિ ઉપર કે પછી એની આ સ્વોપજ વૃત્તિ ઉપર 'ન્યાયાચાર્ય' યશોવિજયગણિએ આ રચાણું મનાય છે જૈ. ગ્રં. (પૃ. ૧૦૭)માં આ ન્યાયાચાર્યને છન્દશ્ચૂડામણિટીકાના કર્તા કહ્યા છે.

ટીકા-આના રચનાર વર્ધમાનસૂરિ છે.

P. ૧૪૯ રત્નમંજૂષા- આ અજ્ઞાતકર્તૃક સૂત્રાત્મક સંસ્કૃત છંદ:શાસ્ત્રમાં 'વૈદિક' છંદોને સ્થાન અપાયું નથી. સામાન્ય રીતે પિંગલના છંદ:શાસ્ત્રને અનુસરતી આ કૃતિ આઠ અધ્યાયોમાં વિભક્ત કરાયેલી છે. આ કૃતિમાં કેટલાક છંદો એવા છે કે જે પિંગલના છંદ:શાસ્ત્રમાં કે કેદારકૃત વૃત્તરત્નાકરમાં જોવાતાં નથી, પરંતુ હૈમ છંદોડનુશાસનમાં નજરે પડે છે. આ બાબતને તેમજ એની ઉપર કોઈક જૈને ટીકા રચી છે એને લક્ષ્યમાં રાખી પ્રો. વેલણકરે પ્રસ્તુત કૃતિના કર્તા 'જૈન' હોવાની સંભાવના કરી છે.

પ્રથમ અધ્યાયમાં ગ્રંથકારે કામમાં લીધેલી વિવિધ સંજ્ઞાઓનું નિરૂપણ છે. પિંગલે છંદ:શાસ્ત્રમાં મ્, ય્, ર્, સ્, ત્, જ્, ભ્ અને ન્ એમ અક્ષર-ગણો માટે આઠ ચિહ્ન વાપર્યાં છે જ્યારે અહીં એ માટે અનુક્રમે ક્, ચ્, ત્, પ્, શ્, ષ્, સ્ અને હ્ એમ આઠ વ્યંજનોનો તેમજ આ, એ, ઔ, ઈ, અ, ઉ, ઋ અને ઈ એમ આઠ સ્વરોનો આમ બે રીતે ચિહ્નોનો ઉલ્લેખ કરાયો છે. વળી બે દીર્ઘ અક્ષર માટે ય્, એક હ્રસ્વ માટે લ્, બે હ્રસ્વ માટે વ્, એક દીર્ઘ અક્ષર માટે મ્ અને એક હ્રસ્વ અક્ષર માટે ન્ ની યોજના કરાઈ છે. આ ઉપરાંત ૧, ૨, ૩, ૪ ઇત્યાદિ અંક દર્શાવવા માટે દ, દા, દિ, દી ઇત્યાદિનો અને કેટલીક વાર એમાં 'ણ'નો પ્રક્ષેપ કરીને ઉપયોગ કરાયો છે. જેમકે દ = દણ = ૧; દા = દાણ = ૨ ઇત્યાદિ.

બીજા અધ્યાયમાં આર્યા, ગીતિ, આર્યાગીતિ, ગલિતક તેમજ 'ઉપચિત્રક' વર્ગનાં અર્ધસમવૃત્તોનાં લક્ષણ અપાયાં છે.

ત્રીજા અધ્યાયમાં વૈતાલીય, માત્રાવૃત્તોના 'માત્રાસમક' વર્ગો, ગીત્યાર્યા, વિશિખા, કુલિક, નૃત્યગતિ અને નટચરણનાં લક્ષણો રજૂ કરાયાં છે.

૧. એમાંનો એક દૂહો પાઠભેદપૂર્વક સિ. હે. (અ. ૮, સૂ. ૩૯૫)ની સ્વોપજ વૃત્તિમાં જોવાય છે.

૨. આનું અજ્ઞાતકર્તૃક ભાષ્ય સહિતનું સંપાદન ભોજ-પત્ર ઉપર લખાયેલી બે કાનડી હાથપોથીના આધારે પ્રો. હરિ દામોદર વેલણકરે અંગ્રેજી પ્રસ્તાવના અને ટિપ્પણો સહિત કર્યું છે અને એ "ભારતીય જ્ઞાનપીઠ" કાશીથી ઈ. સ. ૧૯૪૯માં "સભાષ્ય રત્નમંજૂષા"ના નામથી પ્રસિદ્ધ થયું છે. એમાં અંતમાં ભાષ્યગત પદોની અનુક્રમણિકા તેમજ છંદોની સૂચી એમ બે પરિશિષ્ટ છે.

૩. બધાં મળીને ૨૬ + ૨૮ + ૨૦ + ૩૭ + ૩૮ + ૩૪ + ૧૯ = ૨૩૦ સૂત્રો છે.

૪-૫. "નટચરણ અને નૃત્યગતિ" નામનો મારો લેખ "જૈ. ધ. પ્ર." (પૃ. ૬૬, અં. ૧૧)માં છપાયો છે. આ બેનાં લક્ષણ હૈમ છંદોડનુશાસન સિવાય અન્યત્ર હોય એમ જણાવામાં નથી.

ચોથા અધ્યાયમાં વિષમ વૃત્તના ત્રણ વર્ગો નામે (૧) ઉદ્ગીતા, (૨) દામાવારા યાને પદ્યતુરુર્ધ્વ P. ૧૫૦ અને (૩) અનુષ્ટુભ્ વક્ત્રનો વિચાર કરાયો છે.

અ. ૫-૭માં તમામ વર્ણ-વૃત્તોનું નિરૂપણ છે. લગભગ ૮૫ વૃત્તોને છ છ અક્ષરવાળાં ચાર ચરણોથી યુક્ત 'ગાયત્રી'થી માંડીને 'ઉત્કૃતિ' સુધીના ૨૧ વર્ગમાં વિભક્ત કરી એનો અહીં વિચાર કરાયો છે. આ લગભગ ૮૫ વૃત્તો પૈકી ઓછામાં ઓછાં ૨૧ વૃત્તોની નોંધ પિંગલે કે કેદારે લીધી નથી. વળી પિંગલે વર્ણવેલાં વૃત્તો પૈકી સોળેકનો ઉલ્લેખ આ રત્નમંજૂષામાં જણાતો નથી.

પાંચમા અધ્યાયના પ્રારંભમાં સમસ્ત વર્ણવૃત્તો સમાન, પ્રમાણ અને વિતાન એમ ત્રણ વર્ગમાં વિભક્ત કરાયા છે, પણ અ. ૫-૭માં અપાયેલાં તમામ વૃત્તો 'વિતાન' વર્ગના છે. એકવીસે વર્ગના વૃત્તોનું આવું વિભાજન અન્યત્ર-હૈમ છંદોડનુશાસનમાં યે જોવાતું નથી. એથી એ એની વિશિષ્ટતા ગણાય.

આઠમા અધ્યાયમાં (૧) પ્રસ્તાર, (૨) નષ્ટ, (૩) ઉદ્વિષ્ટ, (૪) લગક્રિયા, (૫) સંખ્યાન અને (૬) અધ્વન્ એમ છ પ્રકારના 'પ્રત્યયોનું નિરૂપણ છે.

ભાષ્ય-આના કર્તાનું નામ જાણવામાં નથી, પરંતુ એઓ જૈન છે એ વાત તો મંગલાચરણ ઉપરથી તેમજ આ ભાષ્યમાં અપાયેલાં કેટલાંક ઉદાહરણો વિચારતાં તરી આવે છે. લગભગ ૮૫ ઉદાહરણો પૈકી ૪૦ તે તે છંદના નામસૂચક છે. અભિજ્ઞાન-શાર્કુતલ (અંક ૧, શ્લો. ૩૩), P. ૧૫૧ પ્રતિજ્ઞાયૌગંધરાયણ (૨, ૩) ઇત્યાદિ ઉદ્ધૃત કરાયાં છે. ત્રણેક વાર ભાષ્યમાં સૂત્રકારનો 'આચાર્ય' તરીકે નિર્દેશ છે. અ. ૮ના અંતિમ ઉદાહરણમાં પુત્રાગચન્દ્રનો 'ખંડમેરુ' પ્રસ્તારના રચયિતા તરીકે ઉલ્લેખ છે.

છંદોરત્નાવલી (લ. વિક્રમની ૧૩મી સદી)- આના કર્તા 'વેણી-કૃપાણ' અમરચન્દ્રસૂરિ છે. એમણે આ ૭૦૦ શ્લોક જેવડી કૃતિ પિંગલાદિના આધારે રચી અને નવ અધ્યાયમાં વિભક્ત કરી એ દ્વારા નીચે મુજબના વિષયો ચર્ચ્યા છે :-

સંજ્ઞા, સમવૃત્ત, અર્ધસમવૃત્ત, વિષમવૃત્ત, માત્રાવૃત્ત, પ્રસ્તારાદિ, પ્રાકૃત છંદ, ઉત્પ્રાહાદિ, ષટ્પદી, ચતુષ્પદી અને દ્વિપદી.

આ કૃતિમાં અનેક ઉદાહરણો અપાયાં છે. એમાં પાઈય પદ્યો પણ ઘણાં છે. આ કૃતિનો ઉલ્લેખ ગ્રંથકારે જાતે પોતાની કાવ્યકલ્પલતાવૃત્તિમાં કર્યો છે. [આ અધ્યાવધિ અપ્રગટ છે.]

છન્દોડનુશાસન (લ. વિ. સં. ૧૩૫૦)- પાંચ અધ્યાયની આ કૃતિના કર્તા નેમિના પુત્ર વાગ્ભટ છે. એમણે પોતાના કાવ્યાનુશાસનની સ્વોપજ્ઞ ટીકા (પૃ. ૧૫)માં આનો ઉલ્લેખ કર્યો છે. પત્તનસ્થ પ્રાચ્ય જૈન ભાંડાગારીય ગ્રંથસૂચી (ભા. ૧, પૃ. ૧૧૭)માં આ છંદોડનુશાસનમાંથી અવતરણ અપાયું છે. આ કૃતિ ઉપર વાગ્ભટે જાતે વૃત્તિ રચી છે. [આ અપ્રગટ છે.]

નંદિતાઢ્ય-વૃત્તિ-આ નંદિયઢ્ઠના ગાહાલકખણ ઉપરની રત્નચન્દ્રકૃત સંસ્કૃત વૃત્તિ છે.

૧. આનો વિસ્તારથી વિચાર પ્રો. વેલણકરે વિરહાંકૃત વૃત્તજાતિસમુચ્ચય (૫-૬)ની પ્રસ્તાવનામાં કર્યો છે. જુઓ ઈ. સ. ૧૯૩૨માં છપાયેલ "JBBRAS" (Vol. 18).

૨-૩. જુઓ પા. ભા. સા. (પૃ. ૬૨-૬૪).

છંદ:કોશટીકા- ‘નાગપુરીય તપા’ ગચ્છના હેમતિલકસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિએ ૭૪ ગાથામાં પાઈયમાં ‘છન્દકોસ’ નામની જે કૃતિ રચી છે તેના ઉપર આ ટીકા રાજરત્નના શિષ્ય ચંદ્રકીર્તિએ રચી છે.

P. ૧૫૨

છન્દ:શાસ્ત્ર- આના કર્તા રામવિજયગણિ છે.

છન્દસ્તત્ત્વ- ‘અંચલ’ ગચ્છના ધર્મનંદનગણિની આ કૃતિ છે. એમણે એના ઉપર સ્વોપજ્ઞ ટીકા રચી છે. [આની પ્રત છાણીના જ્ઞાનભંડારમાં છે.]

છન્દ:શેખર- આના કર્તા રાજ(જય ?) શેખર છે.

રત્નમંજૂષા યાને છંદોવિચિતિ- આ અજ્ઞાતકર્તૃક કૃતિ બાર વિભાગમાં વિભક્ત છે અને એના ઉપર કોઈકની ટીકા છે એમ જિ. ર. કો. (ખંડ ૧, પૃ. ૩૨૭)માં કહ્યું છે. શું આ સંસ્કૃત કૃતિ છે ? [આ સંસ્કૃતમાં ૨૩૦ સૂત્રમય રચના આઠ અધ્યાયમાં વિભક્ત છે. ગ્રંથકાર ક.સ. હેમચન્દ્રસૂરિથી પ્રભાવિત છે.]

છન્દોલ્લંકાર- આ અજ્ઞાતકર્તૃક કૃતિ છે. એના ઉપર કોઈકનું ટિપ્પણ છે.

છન્દ:સુંદરટીકા- આ કોઈની છન્દ:સુંદર ઉપરની ટીકા હોય એમ લાગે છે.

અજિતશાંતિછંદોવિવરણ- નંદિષેષકૃત અજિયસંતિથય જે વિવિધ છંદોમાં રચાયું છે. એ છંદોનાં લક્ષણ આ કૃતિમાં અપાયાં હશે.

ગાથારત્નકોશ- આ અજ્ઞાતકર્તૃક કૃતિ છે. શું એ સંસ્કૃતમાં છે ?

ગાથારત્નાકર- આ અજ્ઞાતકર્તૃક કૃતિ છે. શું એ સંસ્કૃતમાં છે ?

છંદ (? દો) રૂપક- આના કર્તાનું નામ જાણવામાં નથી.

પિંગલસારોદ્ધાર- ૫૫૯ શ્લોક જેવડી આ કૃતિ પિંગલકૃત છંદોવિષયક કૃતિના સારરૂપ હશે. જો તેમજ હોય તો આનો ઉલ્લેખ પ્ર. ૧૭માં થવો ઘટે.

સંગીતસહપિંગલ- આ નામ વિચિત્ર જણાય છે.

[આર્યાસંખ્યાઉદ્દિષ્ટનષ્ટવર્તનવિધિ- કર્તા સમયસુન્દર જિ. ર. કો. છન્દોદ્ધાત્રિંશિકા-શીલશેખરગણિ- આની હ. લિ. પ્રત લા. દ. વિદ્યામંદિરમાં છે. વૃતમૌકિતક- ઉપા. મેઘવિજયગણિ. (જે. સ. પ્ર. વર્ષ ૧૨/અંક ૫-૬). પિંગલશિરોમણિ- ખરતરશસ્ત્રીય કુશલલાભ. (વિશેષ માટે જુઓ. જૈનચાર્યો કા છંદ:શાસ્ત્રકો અવદાન “લે. કુ. મધુમાલિકા પ્ર. શ્રમણ ૨૦૦૨ જુલાઈ-ડિસેમ્બર”)]

Wall Painting of Rajasthan By Y. K. Shukla. એલ. ડી. સિરિજ-૭૪

Panorama of Jain Art. લે. સી. શિવરામમૂર્તિ “ભારતીય જ્ઞાનપીઠ.”

યશોધરચરિતકી સચિત્ર પાંડુલિપિમાં ડૉ. કમલાગર્ગ. “ભારતીયજ્ઞાનપીઠ”



પ્રકરણ ૬ : 'અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર)

અલંકાર એટલે ? — ‘અલંકાર’ એ અનેકાર્થી શબ્દ છે. એના (૧) ઘરેણું, (૨) શણગાર, (૩) શબ્દની અથવા અર્થની ચમત્કૃતિવાળી રચના અને (૪) તાન કે આલાપમાં વપરાતી સ્વરોની મધુર ગૂંથણી એ ચાર અર્થ ગુજરાતીમાં સુપ્રસિદ્ધ છે. ‘અલંકાર’ એ મૂળે સંસ્કૃત શબ્દ છે. એના અહીં અપાયેલા પહેલા ત્રણ અર્થ ઉપરાંત અલંકારનું શાસ્ત્ર એવો પણ એનો અર્થ સંસ્કૃત ભાષામાં કરાય છે. અહીં ગુજરાતીમાં અપાયેલા પહેલા બે અર્થો તેમજ ચોથો અર્થ પ્રસ્તુત નથી. વિશેષમાં ‘અલંકાર’થી કેવળ શબ્દાલંકાર, અર્થાલંકાર કે શબ્દાર્થાલંકાર એટલા જ વિષયનું નિરૂપણ કરનાર શાસ્ત્ર એવો સંકુચિત અર્થ કરવાનો નથી. તેમ બીજી બાજુએ નાટ્યશાસ્ત્રનો એમાં સમાવેશ કરવાનો નથી, જોકે કેટલીક વાર તેમ કરાય છે.^૧ કહેવાની મતલબ એ છે કે કાવ્યનાં પ્રયોજન, કાવ્ય-હેતુ કે કાવ્યનું લક્ષણ, રસની નિષ્પત્તિ, રસની સંખ્યા, ગુણો, દોષો, રીતિઓ, વૃત્તિઓ, ઉપમા વગેરે અલંકારો, કવિ-સમય ઇત્યાદિ બાબતોમાંથી થોડીક કે બધી બાબતોનો વિચાર કરનારી જૈન કૃતિઓ અત્ર અભિપ્રેત છે.

‘આગમોમાં અલંકારો— જેમ સામાન્ય રીતે દેહ સુંદર હોય છતાં એને અલંકાર વડે વિભૂષિત P. ૧૫૪ કરાય છે એમ ભાષા પણ સાદી હોય તેના કરતાં એ શબ્દાલંકાર કે અર્થાલંકાર વડે વિભૂષિત હોય તો સાહિત્યને અનુરૂપ ગણાય. આગમો વગેરે જૈન કૃતિઓનો સાહિત્યમાં સમાવેશ થાય છે. એટલે એમાં આપણને ઉપમા, અર્થાન્તરન્યાસ, શૃંખલાયમક ઇત્યાદિ અલંકારોથી વિભૂષિત લખાણ જોવાનું મળે છે એ સ્વાભાવિક છે.

જૈનોનું આ વિષયને અંગેનું ઉપલબ્ધ સાહિત્ય વિચારતાં એમ જણાય છે કે વિક્રમની નવમી સદીની પૂર્વે કોઈ જૈન ગ્રંથકારે અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર)ને અંગે સ્વતંત્ર કૃતિ રચી હોય એમ જણાતું નથી એટલું જ નહિ પણ કોઈ અજૈન કૃતિના વિવરણરૂપે પણ કશી રચના કરી જણાતી નથી. બારમી સદીથી તો આમાં વિશેષ પલટો આવે છે. ‘થારાપદ્વીય’ ગચ્છના નમિસાધુ રુદ્રટકૃત કાવ્યાલંકાર ઉપર વિ.સં. ૧૧૨૫માં ટીકા રચે છે. એમને હાથે આ દ્વાર ખૂલતાં આગળ ઉપર આ માર્ગે અન્ય જૈન લેખકો વિવરણકાર તરીકે વિહરે છે. એ દરમ્યાનમાં વાગભટ અને ‘કલિ.’ હેમચન્દ્રસૂરિ જેવા તો મહત્વની સ્વતંત્ર કૃતિ પણ રચે છે.

કવિશિક્ષા (લ. વિ. સં. ૮૫૦)— આના કર્તા જબ્બલઢિસૂરિ (વિ. સં. ૮૦૦-૮૮૫) છે એમ

૧. આને અંગે મેં “અલંકારશાસ્ત્ર સંબંધી જૈન કૃતિઓ” નામના મારા લેખમાં એ કૃતિઓનો અકારાદિક ક્રમે વિચાર કર્યો છે. એ લેખ “જૈ. ધ. પ્ર.”માં આઠ કટકે છપાયો છે. જુઓ એ માસિક (પુ. ૭૦, અં. ૧, ૪, ૫ અને ૧૨ તથા પુ. ૭૧, અં. ૨, ૩-૪, ૫ અને ૬).

૨. ઈ. સ. ૮૦૦થી કંઈક પહેલાના વખતમાં ‘કાવ્ય-શાસ્ત્ર’એ અર્થમાં ‘સાહિત્ય’ શબ્દ વપરાતો હતો.

૩. આગમોમાં ક્યાં ક્યાં કયા કયા અલંકારો દક્ષિણેયર થાય છે એની એક કાચી નોંધ મેં કરી છે. એ પાકી થાય અને છપાય તે પૂર્વે આ વિષયના વિશિષ્ટ અભ્યાસીને હાથે આ બાબત રજૂ થશે તો તેથી મને આનંદ થશે.

૪. એમણે તારાગણ નામનું કાવ્ય રચ્યું છે તે મળતું નથી. એમની ચતુર્વિંશતિકાનું મેં સંપાદન કર્યું છે અને એ “આ. સ.” તરફથી ઈ. સ. ૧૯૨૬માં છપાવાયું છે. [‘તારાગણ’ના નામે આનું સંપાદન હરિવલ્લભ ભાયાણીએ કર્યું છે.]

P. ૧૫૫ વિનયચંદ્રસૂરિકૃત કવિશિક્ષા^૧ જોતાં જણાય છે. આ અનુમાન સાચું હોય તો કવિશિક્ષા નામની પાંચ કૃતિઓ ગણાય. આ પૈકી એકનો તો અહીં નિર્દેશ થાય જ છે. બાકીની ચાર પૈકી એકના કર્તા જયમંગલસૂરિ છે, બીજાના અમરચન્દ્રસૂરિ છે, ત્રીજાના વિનયચન્દ્રસૂરિ છે ચોથાના 'વાગ્ભટના પુત્ર' દેવસેન છે.

શૃંગારમંજરી (લ. વિ. સં. ૧૦૧૦)- આ ૧૨૮ પદ્યોની કૃતિ અજિતસેને ઈ.સ.ની ૬સમી સદીના ઉત્તરાર્ધમાં રચી છે. એ અલંકારશાસ્ત્રની સામાન્ય કૃતિ છે. આની નોંધ કૃષ્ણમાચારિઅરે HCSL (p. 752)માં લીધી છે. આની એક હાથપોથી અહીંના (સુરતના) વડા ચૌડાના ભંડારમાં હોવાનો ઉલ્લેખ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૮૬)માં છે.

'વાગ્ભટાલંકાર' (લ. વિ. સં. ૧૧૮૦)આના કર્તા વાગ્ભટ પહેલા છે. એમનું પાઈય નામ બાહડ છે. એઓ સિદ્ધરાજના સમકાલીન અને એમના દ્વારા સન્માનિત વિદ્વાન છે. એમના પિતાનું નામ 'સોમ' છે અને એઓ મહામંત્રી હતા. પ્ર. ચ. (શૃંગ ૨૨, શ્લો. ૪૭૨ અને ૬૭૪) પ્રમાણે વાગ્ભટ વિ. સં. ૧૧૭૯થી ૧૨૧૩ સુધી વિદ્યમાન હતા. એ ઉપરથી જો આ જ વાગ્ભટ અત્ર પ્રસ્તુત હોય તો એમની આ કૃતિ વિ. સં. ૧૧૮૧થી ૧૨૦૦ના ગાળામાં રચાઈ હશે. એમણે આ વાગ્ભટાલંકાર પાંચ પરિચ્છેદોમાં

P. ૧૫૬ રચ્યો છે. એમાં એકંદર ૨૬૦ પદ્યો છે. એમાંનાં ઘણાંખરાં પદ્યો 'અનુષ્ટુભ્' છંદમાં છે. પ્રત્યેક પરિચ્છેદનું અંતિમ પદ્ય ભિન્ન છંદમાં છે. ત્રીજા પરિચ્છેદમાં 'ઓજસ્' ગુણને અગેનું લખાણ ગદ્યમાં છે. આ બાદ કરતાં તમામ લખાણ પદ્યમાં છે.

વિષય- પ્રથમ પરિચ્છેદમાં કાવ્યનું લક્ષણ, કાવ્યની રચનામાં હેતુ તરીકે પ્રતિભાનો ઉલ્લેખ, પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસની વ્યાખ્યા, કાવ્ય રચવા માટેના અનુકૂળ પ્રસંગો અને કવિઓને પાળવાના નિયમો એમ વિવિધ બાબતો રજૂ કરાઈ છે.

બીજા પરિચ્છેદમાં કહ્યું છે કે કાવ્ય સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ભૂતભાષા એમ ચાર ભાષામાં રચી શકાય. કાવ્યના છંદોનિબદ્ધ અને અછંદોનિબદ્ધ એ બે પ્રકારો અને પદ્ય, ગદ્ય અને મિશ્ર એમ એના ત્રણ પ્રકારો પણ પડાયા છે. વિશેષમાં અહીં પદ્ય, વાક્ય અને અર્થના દોષોનો વિચાર કરાયો છે.

ત્રીજા પરિચ્છેદમાં ૬૬ ગુણોની વ્યાખ્યા આપી એનું વિવરણ કરાયું છે.

ચોથા પરિચ્છેદમાં શબ્દાલંકારના (૧) ચિત્ર, (૨) 'વક્રોક્તિ', (૩) અનુપ્રાસ અને (૪) યમક એ ચાર પ્રકારોનો, અર્થાલંકારના ૩૫ પ્રકારોનો તેમજ વૈદર્ભ્ય અને ગૌડી એ બે રીતિનો વિચાર કરાયો છે.

૧. આ કવિશિક્ષાના પરિચય માટે જુઓ પૃ. ૧૭૧

૨-૩. જુઓ પત્તન. સૂચી (ભા. ૧)ની પ્રસ્તાવનાનું પૃ. ૪૮.

૪. શૃંગારચન્દ્રિકા એ વિજયવર્ણીની કૃતિ છે એમ સ્વયંભૂસ્તોત્રની હિંદી પ્રસ્તાવના (પૃ. ૮૮)માં ઉલ્લેખ છે તો શું આ કોઈ અલંકારશાસ્ત્રની કૃતિ છે ?

૫. આ કૃતિ સિંહદેવગણિકૃત વ્યાખ્યા સાથે "કાવ્યમાલા" (૪૮)માં ઈ.સ. ૧૮૦૩માં પ્રસિદ્ધ થઈ છે. મૂળ કૃતિની અન્ય આવૃત્તિની ડૉ. એસ. કે. ડે કૃત History of Sanskrit Poetics (Vol. I, p. 208) માં નોંધ છે.

૬. કેટલાકને મતે ઉદયન (મંત્રી) છે.

૭. "વક્રોક્તિની વણજાર" નામનો મેં એક લેખ લખ્યો છે. એ "ફા. ગુ. સ. ત્રૈ" માટે એના તંત્રીએ સ્વીકાર્યો છે પણ હજી સુધી તો છપાયો નથી.

www.jainelibrary.org

આ તો શ્વેતાંબરીય ટીકાઓ છે. દિ. વાદિરાજે પણ એક ટીકા રચી છે. આ ઉપરાંત કૃષ્ણશર્મા, ગણેશ વગેરે અજૈનોએ પણ આ વાગ્ભટાલંકાર ઉપર ટીકાઓ રચી છે.

વાગ્ભટાલંકારની ટિપ્પની— આ ટિપ્પની બાલચંદ્રે રચી છે અને એની ‘કન્નડ’ લિપિમાં લખાયેલી એક હાથપોથી મળે છે એમ ક. તા. ગ્રં. (પૃ. ૧૩૭)માં ઉલ્લેખ છે. આ બાલચંદ્ર દિ છે ?

બાલાવબોધ—સદ્વિસયગપયરણના કર્તા જૈન ગૃહસ્થ મારવાડી નેમિચંદ્ર ભંડારીએ એક બાલાવબોધ રચ્યો છે.

‘ખરતર’ ગચ્છના ‘મેરુસુંદરે પણ વિ. સં. ૧૫૩૫માં બાલાવબોધ રચ્યો છે. એમાં પ્રારંભમાં પાંચ P. ૧૫૮ પદ્યો અને અંતના બે પદ્યો સંસ્કૃતમાં છે. આ બાલાવબોધમાં મૂળનું સંસ્કૃતમાં કટકે કટકે વિવરણ છે અને ‘સાથે સાથે ગુજરાતીમાં સમજૂતી છે.’

અલંકારશાસ્ત્રની સંસ્કૃતમાં રચાયેલી કૃતિઓના ગુજરાતી બાલાવબોધ બહુ થોડા મળ્યા છે. એ હિસાબે આ બે બાલાવબોધ મહત્વના ગણાય.

કાવ્યાનુશાસન (ઉ.વિ.સં. ૧૧૮૮)– આના પ્રણેતા ‘કલિ.’ હેમચંદ્રસૂરિ છે. આ નામની એક બીજી કૃતિ છે, પરંતુ એના કર્તા તો એમના પછી થયેલા જૈન ગૃહસ્થ વાગ્ભટ છે.

P. ૧૬૦ **નામ**— ‘કાવ્યાનુશાસન’ એ મૂળ ‘સૂત્રાત્મક કૃતિનું નામ છે કે એની અ. ચૂ. નામની ટીકા સહિત મૂળનું નામ છે ? આવો પ્રશ્ન આની હાથપોથીઓ અને વિવેક જોતાં ઉદ્ભવે છે. આના ઉત્તર તરીકે ડૉ. આનંદશંકર બા. ધ્રુવે કહ્યું છે કે હેમચંદ્રાચાર્યે પ્રથમ સૂત્ર રચી અને કાવ્યાનુશાસન નામ આપ્યું અને પછી એના ઉપર સ્પષ્ટીકરણાર્થે વૃત્તિ રચી તેને અલંકારચૂડામણિ કહી અને આ બંને મળીને કાવ્યાના અનુશાસન એટલે કે શાસ્ત્રની ગરજ સારશે એવો ઈરાદો રાખ્યો.

૧. એમણે સદ્વિસયગપયરણની જેમ વિદગ્ધમુખમંડનનો પણ બાલાવબોધ રચ્યો છે.

૨. આનો અર્થ એ નથી કે ચુણિજના લખાણની જેમ આ લખાણ મિશ્રભાષામય છે.

૩. આનો નમૂનો ‘‘પષ્ટિશતક પ્રકરણ’’ની પ્રસ્તાવના (પૃ. ૧૬-૨૦)માં ડૉ. સોરસરાએ આપ્યો છે. એના પૃ. ૧૮માં બે મુદ્રણદોષ હોય એમ લાગે છે.

૪. આ કૃતિ અલંકાર-ચૂડામણિ તેમજ વિવેક સહિત ‘‘નિર્ણયસાગર મુદ્રણાલય’’ તરફથી ‘‘કાવ્યમાલા’’ (૭૦)માં ઈ.સ. ૧૮૦૧માં છપાઈ છે. [‘‘પ્રવચનપ્રકાશન’’ પુનાથી; પુનર્મુદ્રણ થયું છે.] ત્યાર બાદ આ કૃતિ અ. ચૂ., વિવેક અને તાડપત્ર ઉપર લખાયેલા અજ્ઞાતકર્તૃક ટિપ્પણ તેમજ પાઈય પદ્યોની સંસ્કૃત છાયા, છ અનુક્રમણિકાઓ તથા ડૉ. આનંદશંકર બાપુભાઈ ધ્રુવની ‘‘પૂર્વ-વચનિકા’’ પૂરતા લખાણ સહિત પ્રથમ ખંડ તરીકે છપાઈ છે અને શ્રી રસિકલાલ છો. પરીખના અંગ્રેજી ઉપોદ્ધાત અને પ્રો. રામચંદ્ર આયવલેના અંગ્રેજી ટિપ્પણ પૂરતું લખાણ બીજા ખંડ તરીકે છપાયું છે. આ બંને ‘‘શ્રીમહાવીર જૈન વિદ્યાલય’’ તરફથી મુંબઈથી ઈ.સ. ૧૯૩૮માં-એક જ વર્ષમાં પ્રસિદ્ધ કરાયા છે. [આનું પુનઃ પ્રકાશન વી. એમ. કુલકર્ણીના માર્ગ દર્શન મુજબ મ. જૈ. વિ. એ કર્યું છે.]

ઉપર્યુક્ત છ અનુક્રમણિકામાં પહેલી અ. ચૂ.ગત અને વિવેકગત ઉદાહરણોને લગતી છે. બીજી અનુક્રમણિકા પ્રમાણરૂપ ઉદ્ધૃત કરાયેલા સંદર્ભોની છે. ત્રીજી સૂત્રોને અંગેની છે. ચોથી, બે વૃત્તિમાં નિર્દેશાયેલાં ગ્રંથો અને ગ્રંથકારોની સૂચીરૂપ છે. પાંચમી સંપાદકે નિર્દેશેલા ગ્રંથોને લગતી છે. છઠ્ઠી વિશિષ્ટ શબ્દોની સૂચીરૂપ છે.

૫. સૂત્ર પૂરતી આ કૃતિ હે. કુ. (પૃ. ૨૨૫-૨૪૦)માં પ્રકાશિત થયેલી જુઓ પૃ. ૩૪.

કાવ્યાનુશાસન એ વિશેષનામ છે કે પુસ્તકનું પરિચયાત્મક નામ છે ? જેમ શબ્દાનુશાસનનું સિદ્ધહેમચન્દ્ર એવું વિશેષનામ છે એવી રીતે કાવ્યના શાસ્ત્રનું પણ કોઈ વિશેષનામ હોવું જોઈએ એમ વિદ્વાનો સૂચવે છે.

વિભાગ— મૂળ કૃતિ આઠ અધ્યાયોમાં વિભક્ત છે. પ્રારંભમાં બે પદ્યો છે. એને કેટલાક એકેક સૂત્ર ગણે છે. એ હિસાબે પ્રથમ અધ્યાયમાં ૨૫ (૨૩ + ૨) સૂત્ર છે. બાકીના અધ્યાયોનાં સૂત્રની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે :-

૫૯, ૧૦, ૮, ૮, ૩૧, ૫૨ અને ૧૩. આમ એકંદરે ૨૦૮ (૨૦૬ + ૨) સૂત્રો છે.

વિષય— પ્રથમ અધ્યાયમાં કાવ્યના પ્રયોજન, કાવ્યનો હેતુ, કાવ્યનું લક્ષણ, શબ્દ અને અર્થનું સ્વરૂપ તેમજ મુખ્ય, ગૌણ, લક્ષ્ય અને વ્યંગ્ય એમ ચાર જાતના અર્થ એમ વિવિધ બાબતો વિચારાઈ છે.

બીજા અધ્યાયમાં રસનું તેમજ સ્થાયી, વ્યભિચારી અને સાત્ત્વિક ભાવોનું નિરૂપણ છે. વિશેષમાં પ. ૧૬૧ રસાભાસ અને ભાવાભાસની ચર્ચા પછી છેલ્લાં ચાર સૂત્રોમાં કાવ્યના ઉત્તમાદિ ત્રણ પ્રકારો વિચારાયા છે.

ત્રીજા અધ્યાયમાં શબ્દ, વાક્ય, અર્થ અને રસના દોષો વિષે વિચાર કરાયો છે.

ચોથા અધ્યાયમાં ગુણો ચર્ચાયા છે.

પાંચમાં અધ્યાયમાં અનુપ્રાસ, યમક, ચિત્ર, શ્લેષ, વકોક્તિ અને પુનરુક્તાભાસ એ છ જાતના શબ્દાલંકારનો અધિકાર છે.

છઠ્ઠા અધ્યાયમાં 'સંકર' સહિત ૨૮ અર્થાલંકારનું નિરૂપણ છે, જ્યારે મમ્મટે ૬૧ અર્થાલંકારો વિષે વિવેચન કર્યું છે અને ભોજે સરસ્વતીકંઠાભરણમાં ૨૪ શબ્દાલંકારો, ૨૪ અર્થાલંકારો અને ૨૪ શબ્દ અને અર્થ એ ઉભયને લગતા અલંકારો (ઉભયાલંકારો) વર્ણવ્યા છે.

'કલિ.' હેમચન્દ્રસૂરિએ સ્વભાવોક્તિને બદલે 'જાતિ' શબ્દ અને અપ્રસ્તુત-પ્રશંસાને બદલે 'અન્યોક્તિ' શબ્દ વાપરેલા છે.

સાતમા અધ્યાયમાં નાયક અને નાયિકાના ભેદો તેમજ પ્રતિનાયકનું સ્વરૂપ એ બાબતો હાથ ધરાઈ છે.

આઠમા અધ્યાયમાં પ્રેક્ષ્ય (દૃશ્ય) અને શ્રવ્ય એમ કાવ્યના બે પ્રકાર સૂચવી એના ઉપપ્રકારો સમજાવાયા છે.

રચના-સમય—કાવ્યાનુશાસનમાં કુમારપાલ વિષે ઉલ્લેખ જણાતો નથી. એથી આ કૃતિ વિ. સં. ૧૧૯૯ પહેલાં રચાઈ હશે એમ અનુમાનાય છે.

અલંકાર-ચૂડામણિ— આ સૂત્રાત્મક કાવ્યાનુશાસનની 'કલિ.' હેમચન્દ્રસૂરિએ રચેલી સ્વોપજ્ઞ પ. ૧૬ : ટીકા છે. રચણાવલી (વગ્ગ ૧)ના ત્રીજા પદ્યની સ્વોપજ્ઞ વૃત્તિમાં આ હેમચન્દ્રસૂરિએ જે અલંકાર-

૧. આના વિવિધ પ્રકારો છે. જેમકે સ્વર-ચિત્ર, વ્યંજન-ચિત્ર, આકાર-ચિત્ર, ગૂઢ-ચિત્ર ઇત્યાદિ.

૨. આ મહાવીરવિદ્યાલય, પ્રવચનપ્રકાશન, કાવ્યમાલા વ.માં પ્રકાશિત છે.

ચૂડામણિનો ઉલ્લેખ કર્યો છે તે આ જ છે. આ અ. ચૂ.નો અવતરણપૂર્વક ઉલ્લેખ સિ. હે. (૧-૧-૨૬) ઉપરના બૃહન્ન્યાસ (પૃ. ૩૪)માં નીચે મુજબ કરાયો છે :-

“યદાહ સ્વોપજ્ઞાલક્ષારચૂડામણૌ-વક્ત્રાદિવૈશિષ્ટ્યાદર્થસ્થાપિ મુખ્યામુખ્યાત્મનો વ્યજકત્વમ””

અ. ચૂ. ૨૮૦૦ શ્લોક જેવડી છે. આ સરળ છે અને એમાં વિવાદગ્રસ્ત વિષયો હાથ ધરાયા નથી. આમાં ૭૪૦ ઉદાહરણો છે અને ૬૭ પ્રમાણો અપાયાં છે.

અ. ૩ ઉપરની આ ટીકા અને ખાસ કરીને એના ઉપરનો વિવેક મનનીય છે. અ. ચૂ.માં પૃ. ૧૧૫, ૧૫૯ ને ૪૧૮માંનાં અવતરણો શૃંગારતિલકમાંથી જ ઉદ્ધૃત કરાયાં હોય એમ લાગે છે. જો એ મૂળે આજ કૃતિનાં હોય તો આમ અવતરણ આપનાર તરીકે ‘કલિ.’ હેમચન્દ્રસૂરિ પ્રથમ છે.

અ. ચૂ. (પૃ. ૨૧૪)માં છંદોડનુશાસનનો ઉલ્લેખ છે. અ. પ, સૂ. પને અંગેની અ. ચૂ. (પૃ. ૩૨૮)માં તિલકમંજરીનું દ્વિતીય પદ ઉદ્ધૃત કરાયું છે.

P. ૧૬૩

અ. ૭ને અંગેની અ. ચૂ.માં નાયક નાયિકા અને પ્રતિનાયક વિષે વિસ્તૃત નિરૂપણ છે. એથી તો એને અંગેના વિવેકમાં કશું વિશેષ કહેવાયું નથી. આ તૈયાર કરવા માટે ધનંજયના દશરૂપકનો તેમજ ભરતના નાટ્યશાસ્ત્રનો અને એના ઉપરની અભિનવગુપ્તકૃત ટીકાનો ઉપયોગ કરાયો છે.

અ. ૮, સૂ. ૩ને અંગેની અ. ચૂ. ભરતના નાટ્યશાસ્ત્ર (અ. ૨૦)માંથી ઉતારા કરી સમૃદ્ધ બનાવાઈ છે.

વિવેક-કાવ્યાનુશાસન તેમજ અ. ચૂ. એ બંનેને લક્ષીને અને કાવ્યશાસ્ત્રની ઝીણવટભરી વિગતો રજૂ કરવાના ઇરાદે આ વૃત્તિ ‘કલિ.’ હેમચન્દ્રસૂરિએ રચી છે. એમાં અનેક વિષયના મુદ્દાઓની છણાવટ છે. એમાં ૬૨૪ ઉદાહરણો અને ૨૦૧ પ્રમાણો અપાયાં છે.*

આ વિવેકમાં બે સ્થળે-પૃ. ૭ અને ૪૬૨માં છંદોડનુશાસનના ઉલ્લેખપૂર્વક અવતરણ અપાયાં છે. અ. પ, સૂ. ૪ના વિવેક પૃ. (૩૧૭)માં ભગવદ્ગીતાના અ. ૧૫નું ૧૨મું પદ ઉદ્ધૃત કરાયું છે. અ. ૨, સૂ. ૧ને લગતા વિવેક (પૃ. ૧૦૩)માં ભરતના નાટ્યશાસ્ત્ર અને એના ઉપરની અભિનવગુપ્તકૃત ટીકામાંથી પુષ્કળ મસાલો લેવાયો છે. રસનું નિરૂપણ કરતી વેળા આ ટીકામાંથી લગભગ અક્ષરશઃ લખાણ લેવાયું છે.

અ. ૩, સૂ. ૩ના વિવેક (પૃ. ૧૭૯-૧૮૯)માં દેશ અને કાળનો વિચાર કરતી વેળા રાજશેખરની

P. ૧૬૪ કાવ્યમીમાંસાનો આશ્રય લેવાયો છે. પણ અહીં રાજશેખરના નામનો ઉલ્લેખ જણાતો નથી. આનું શું કારણ હશે ? શું રાજશેખરે પણ એમના કોઈ પુરોગામી લેખકની કૃતિમાંથી આ ભાગ ઉદ્ધૃત કર્યો હશે ?

૧. આ પૃષ્ઠાંક શ્રીવિજયલાવણ્યસૂરિ દ્વારા સંપાદિત આવૃત્તિનો છે.

૨. આ પંક્તિ પૈકી “મુખ્યામુખ્યાત્મનઃ” એટલો અંશ અ. ચૂ. (પૃ. ૫૮)- નો છે જ્યારે બાકીનો અંશ અ. ૧ના ૨૧મા સૂત્રરૂપે છે.

૩. આ મહાવીર જૈન વિદ્યાલય વ. દ્વારા પ્રકાશિત છે.

૪. આમ અ. ચૂ. સાથે આનો વિચાર કરતાં જુદા જુદા ગ્રંથકારોની કૃતિમાંથી લગભગ ૧૫૦૦ ઉદાહરણો અપાયાં છે. આ પૈકી કેટલીક કૃતિ તો નામશેષ બની છે. આ દૃષ્ટિએ પણ આનું મહત્ત્વ છે.

અ. ૪, સૂ. ૧ના વિવેકમાં પૃ. ૭૪, ૭૬-૭૮, ૮૦ અને ૮૨-૮૫માં ભરતના, પૃ. ૭૪ અને ૭૫માં મંગલના, પૃ. ૭૫-૭૮ અને ૮૧-૮૭માં વામનના અને પૃ. ૭૫, ૭૮, ૭૯, ૮૧, ૮૨, ૮૫ અને ૮૬માં દંડીના વિચારો રજૂ કરાયા છે.

અ. ૪, સૂ. ૪ના વિવેક (પૃ. ૩૨૧)માં આનંદવર્ધનનો નોણના પુત્ર તરીકે ઉલ્લેખ છે. આ આનંદવર્ધનકૃત 'દેવીશતક'માંથી શબ્દાલંકારો માટે સ્પષ્ટીકરણપૂર્વક ઉદાહરણો અપાયાં છે. આ અધ્યાયની રચનામાં કાવ્યાદર્શનો તેમજ કાવ્યાલંકારનો પણ ઉપયોગ કરાયો છે. કાવ્યાલંકાર અને દેવીશતકમાંનાં આકાર-ચિત્રને લગતાં જે ઉદાહરણો અહીં અપાયાં છે તે સચિત્ર સ્વરૂપે મુંબઈ વિદ્યાપીઠના સામયિક Arts No. 30) માં જે મારો લેખ નામે ILD છપાયો છે તેમાં અપાયાં છે.

અ. ૪, સૂ. ૭ના વિવેકમાં પાઠધર્મત્વ સમજાવતી વેળા નાટ્યશાસ્ત્રની કોઈ ટીકામાંથી અવતરણ અપાયાં છે. અભિનવગુપ્તકૃત ટીકાનો ઉપયોગ કરાયો હોય એમ લાગે છે.

અ. ૬ના વિવેકમાં મૂળમાં ગણાવાયેલા ઉપરાંતના વધારાના અલંકારો વિષે વિચાર કરાયો છે.

અ. ૮ને લગતા વિવેકમાં અભિનવગુપ્તની ટીકાનો લાભ લેવાયો હોય એમ લાગે છે.

મૂલ્યાંકન— ડૉ. એસ. કે. ડેએ એવું કથન કર્યું છે કે મમ્મટકૃત કાવ્યપ્રકાશ કરતાં હૈમ P. ૧૬૫ કાવ્યાનુશાસન શિક્ષાગ્રંથ તરીકે ઊતરતી કોટિનો ગ્રંથ છે. આની તથ્યતા વિચારવાનું કાર્ય હું વિશેષજ્ઞોને ભળાવું છું એટલે અહીં તો હું એટલું જ કહીશ કે કાવ્યાનુશાસનમાં કાવ્યપ્રકાશમાં આપેલા અલંકારોની સંખ્યાને યોગ્ય રીતે ઘટાડાઈ છે, અલંકારાદિકનાં લક્ષણોમાં સમુચિત સુધારો કરાયો છે અને કાવ્યપ્રકાશ કરતાં 'સંક્ષિપ્ત અને તેમ છતાં સુગમ એવો આ ગ્રંથ રચાયો છે.

મહામહોપાધ્યાય કાણેનું મંતવ્ય— 'મહામહોપાધ્યાય' પી. વી. કાણેએ વિશ્વનાથના સાહિત્ય-દર્પણ (પરિ. ૧, ૨ ને ૧૦)નું અંગ્રેજી ટિપ્પણો તેમજ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર (poetics)ના ઇતિહાસપૂર્વક સંપાદન કર્યું છે. આની ઈ.સ. ૧૯૫૧માં પ્રસિદ્ધ થયેલી બીજી આવૃત્તિ (પૃ. ૨૭૭-૨૭૮)માં હૈમ કાવ્યાનુશાસન વિષે એમણે નીચે મુજબની મતલબના ઉદ્ગાર કાઢ્યા છે;—

કાવ્યાનુશાસન એ સંગ્રહાત્મક કૃતિ છે. એમાં મૌલિકતાનાં ભાગ્યે જ દર્શન થાય છે. એમાં (રાજશેખરની) કાવ્યમીમાંસા, કાવ્યપ્રકાશ, ધ્વન્યાલોક અને અભિનવગુપ્તના ગ્રંથોમાંથી ખૂબ મસાલો ઉઠાવાયો છે. દા. ત. કાવ્યાનુશાસનનાં પૃ. ૩૮-૧૦ને કાવ્યમીમાંસા, (પૃ. ૫૬) સાથે, પૃ. ૧૧-૧૬ને કાવ્યમીમાંસા (પૃ. ૪૨-૪૪) સાથે અને પૃ. ૧૨૨-૧૨૩ને કાવ્યમીમાંસા (પૃ. ૪૨-૪૪) સાથે સરખાવો. વળી અભિનવગુપ્ત અને ભરતનાં મંતવ્યોને આધારે પોતે અમુક અમુક બાબતો કહ્યાનો ઉલ્લેખ હેમચન્દ્રસૂરિએ P. ૧૬૬ જાતે કર્યો છે. જુઓ વિવેક (પૃ. ૪૬૬).

૧. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે "દેવીશતક અને શ્રીહેમચન્દ્રસૂરિ" આ "આત્માનંદ પ્રકાશ" (પૃ. ૫૨, અ.. ૪-૫)માં છપાયો છે.

૨. કાવ્યપ્રકાશમાં દસ ઉલ્લાસમાં ૨૧૨ સૂત્રોમાં જે વિષય આલેખાયો છે તે આ હૈમ કાવ્યાનુશાસનમાં છ અધ્યાયમાં ૧૪૩ સૂત્રોમાં અપાયો છે (જુઓ શ્રી. રસિકલાલ છો. પરીખનો ઉપોદ્ધાત પૃ. ૩૨૧).

૩. આ નિર્ણયસાગરી આવૃત્તિ અનુસાર સમજવાનાં છે. ૪. આ મ. વિ.ના પ્રકાશનનું ૧૦૩મું પૃષ્ઠ છે.

કાવ્યાનુશાસનનો એક ગુણ (merit) એ છે કે એની વૃત્તિ અને વિવેકમાં જુદા જુદા ગ્રંથકારોની કૃતિઓમાંથી લગભગ ૧૫૦૦ ઉદાહરણો અપાયાં છે. હેમચન્દ્રસૂરિની આ કૃતિનો પ્રભાવ પાછળના અલંકારશાસ્ત્રીઓ ઉપર ભાગ્યે પડ્યો છે. વળી 'રત્નાપણ' (પૃ. ૪૬, ૭૫, ૨૨૪, ૨૩૩, ૨૫૮, ૨૭૮ અને ૨૮૮)માં કાવ્યાનુશાસનમાંથી અવતરણ અપાયાં છે એ વાતને બાજુ ઉપર રાખીએ તો ભાગ્યે જ કોઈ પાછળા લેખકે આમાંથી અવતરણ આપ્યાં છે.

શ્રી કાણેએ કાવ્યાનુશાસનની મૌલિકતા વિષે કરેલા વિધાનના સંબંધમાં શ્રી વિષ્ણુપાદ ભટ્ટાચરજીએ "Indian Culture" (Vol XIII, pp. 218-224)માં વાંધા ઉઠાવ્યા છે. આ વાતનો શ્રી કાણેએ નિર્દેશ કરી એ વાંધાઓની નીચે પ્રમાણે નોંધ એમણે સાહિત્યદર્પણની બીજી આવૃત્તિમાં પૃ. ૨૭૭માં લીધી છે :-

- (૧) કાવ્ય રચવાનો એક લાભ અર્થની - પૈસાની પ્રાપ્તિ છે એમ જે મમ્મટે કહ્યું છે તે વાત હેમચન્દ્રને માન્ય નથી.
 - (૨) મુકુલ અને મમ્મટની જેમ લક્ષણનો આધાર રૂઢિ કે પ્રયોજન છે એમ ન માનતાં કેવળ પ્રયોજન જ છે એમ હેમચન્દ્ર પ્રતિપાદન કરે છે.
 - (૩) અર્થ-શક્તિ-મૂલ-ધ્વનિના (૧) સ્વતઃસંભવી, (૨) કવિપ્રૌઢોક્તિનિષ્પન્ન અને (૩) કવિનિબદ્ધ-વક્તૃ-પ્રૌઢોક્તિનિષ્પન્ન એમ ત્રણ પ્રકાર દર્શાવનાર ધ્વનિકારથી હેમચન્દ્ર જુદા પડે છે. જુઓ પૃ. ૪૬.
- P. ૧૬૭ (૪) મમ્મટના મતે "પુંસ્ત્વાદપિ પ્રવિચલેત્" વાળું પદ શ્લેષમૂલક અપ્રસ્તુતપ્રશંસાનું ઉદાહરણ છે, જ્યારે હેમચન્દ્રને મતે એ 'શબ્દ-શક્તિ-મૂલધ્વનિ'નું છે.
- (૫) રસોમાં અલંકાર પરત્વેના સિદ્ધાંતોના પાલનનો ભંગ જે મહાકવિઓને હાથે થયો છે તેનો ધ્વનિકારે નિર્દેશ કર્યો નથી જ્યારે હેમચન્દ્રે તેમ કર્યું છે.

આ બધા મુદ્દા સ્વીકારી લઈએ તો પણ કાવ્યાનુશાસન એ મૌલિક કૃતિ છે એમ ભાગ્યે જ કહી શકાય. આવા મતભેદો તો અનેક બીજા ગ્રંથકારોની કૃતિઓમાં જોવાય છે.

આ પ્રમાણે પ્રતિવિધાનની સમાલોચના શ્રી કાણેએ કરી છે.

ડૉ. આ. બા. ધ્રુવે અ. ચૂ. અને વિવેક સહિતના કાવ્યાનુશાસનની "પૂર્વવચનિકા"માં કહ્યું છે કે કાવ્યમીમાંસા, કાવ્યપ્રકાશ, ધ્વન્યાલોક અને લોચનમાંથી આખા પાકના પાઠ હેમચન્દ્રસૂરિએ લઈ લીધા છે. એથી કેટલાક એને 'ચોરી' કહે છે, પરંતુ વાત એ છે કે હેમચન્દ્રની ઈચ્છા એ જણાય છે કે બ્રાહ્મણો જે જે જાણતા હતા તે બધું જૈનો જાણે. એથી પુરોગામી બ્રાહ્મણોના જ્ઞાનનો ઉપયોગ કરતાં એઓ અચકાયા નથી. એમણે જે વારસો પોતાને મળ્યો હતો તેમાં પોતાની તરફથી સંગીન ઉમેરો કર્યો છે.

કાવ્યમીમાંસા એ વિચારો અને એની રજૂઆતની દૃષ્ટિએ મૌલિક ભલે ગણાય, પણ એ કાવ્યપ્રકાશ કે કાવ્યાનુશાસન જેવી વ્યવસ્થિત કૃતિ નથી.

મમ્મટે કાવ્યપ્રકાશમાં ભામહથી માંડીને એમના સમય સુધીનાં કાવ્યશાસ્ત્રને લગતાં બધાં મંતવ્યો

P. ૧૬૮ રજૂ કર્યાં છે ખરાં, પરંતુ નાટ્યશાસ્ત્ર સાથે સંબંધ રસની વાત જવા દઈએ તો નાટ્યશાસ્ત્રને એમણે જતું કર્યું છે જ્યારે હેમચન્દ્રે અને આગળ જતાં વિશ્વનાથે એ ઉણપ રહેવા દીધી નથી (જુઓ પૃ. ૧૨).

૧. વિદ્યાનાથે રચેલા પ્રતાપરુદ્રયશોભૂષણ ઉપરની આ ટીકા છે. એ ટીકા મલ્લિનાથના પુત્ર કુમારસ્વામીએ રચી છે. એ ટીકા સહિત મૂળ કૃતિ B S Sમાં ૬૫માં ગ્રંથાંક તરીકે છપાવાઈ છે.

ધ્વન્યાલોક અને લોચનનું ક્ષેત્ર કાવ્યપ્રકાશ જેટલું બે વ્યાપક નથી તો કાવ્યાનુશાસનના અતિવિશાળ ક્ષેત્ર સાથે એની શી તુલના કરવી ?

આ પ્રમાણે ડૉ. ધ્રુવે ‘કલિ.’ હેમચન્દ્રસૂરિ ઉપર કરતા આલેખનો રહિયો આવ્યો છે.

વૃત્તિ—કાવ્યાનુશાસનની અ. ચૂ. નામની ટીકાને અંગે ‘ન્યાયાચાર્ય યશોવિજયગણિએ વૃત્તિ રચી હતી એમ જે મનાય છે તે વાત સાચી છે, કેમકે એમણે પ્રતિમાશતક (શ્લો. ૧૧)ની સ્વોપજ ટીકામાં નિમ્નલિખિત ઉલ્લેખ કર્યો છે :-

“પ્રપશ્ચિતં ચૈતદલક્ષ્ણચૂડામણિવૃત્તાવસ્માભિ”

કવિશિક્ષા (લ. વિ. સં. ૧૨૦૦) - આ ૩૦૦ શ્લોક જેવડી કૃતિના કર્તા જયમંગલસૂરિ છે. એમની આ કૃતિની તાડપત્રીય હાથપોથી ખંભાતના શાંતિનાથના ભંડારમાં છે. એના પ્રારંભની અને અંતમાંની થોડીક પંક્તિ પ્રો પિટર્સને એમના પ્રથમ હેવાલ (પૃ. ૭૮-૮૦)માં આપી છે. આ કૃતિમાં સિદ્ધરાજ જયસિંહની સ્તુતિરૂપ દૃષ્ટાંત છે એટલે જયમંગલસૂરિ વિક્રમની બારમી સદીના ઉત્તરાર્ધમાં થયા હશે એમ લાગે છે. એમની આ કૃતિ કોઈ સ્થળેથી પ્રસિદ્ધ થઈ હોય એમ જણાતું નથી તો એ સત્વર પ્રકાશિત થવી ઘટે.

કલ્પલતા (ઉ. વિ. સં. ૧૨૦૦)— આના કર્તાનું નામ જાણવામાં નથી પરંતુ એઓ શ્વેતાંબર છે એમ એના પ્રારંભિક પદ ઉપરથી જાણી શકાય છે. આ કૃતિમાં ચાર પરિચ્છેદ છે.^૧

પલ્લવ— આ કલ્પલતા ઉપરની વૃત્તિનું નામ છે.

વિવેક યાને શેષ— ઉપર્યુક્ત પલ્લવ ઉપરની ટીકાનાં બે નામ છે: વિવેક અને શેષ. એનું પરિમાણ ૬૫૦૦ શ્લોક જેવડું છે. એની હાથપોથી વિ. સં. ૧૨૦૫માં લખાયેલી મળે છે. એમાં શરૂઆતમાં નીચે મુજબનું અશુદ્ધ પદ છે :-

“યત્ પલ્લવેન વિવૃત્તં દુર્બોધિં મન્દબુદ્ધિશ્ચાપિ ।

ક્રિયતે કલ્પલતાયાં તસ્ય વિવેકોડયમતિસુગમઃ”

આ ટીકાનાં બે નામ હોવાથી આ ટીકાને કલ્પલતાવિવેક તેમજ કલ્પપલ્લવશેષ પણ કહે છે. એમાં મૂળનાં પ્રતીક અપાયાં છે. એની પ્રશસ્તિમાં કલ્પલતાને વિબુધમંદિર, પલ્લવને એ મંદિરનો કલશ અને શેષને આનો ધ્વજ કહેલ છે.

‘કાવ્યકલ્પલતા (લ. વિ. સં. ૧૨૮૦)— આના કર્તા ‘વાયડ’ ગચ્છના જિનદત્તસૂરિના શિષ્ય P. ૧૬૯ અને સ્યાદિશબ્દસમુચ્ચય વગેરેના પ્રણેતા અમરચન્દ્રસૂરિ તેમજ ‘અરિસિંહ છે.’ આ ચાર પ્રતાનોમાં વિભક્ત છે. એમાં એકંદર જપર જેટલાં પદો છે.

૧. જુઓ જેસલમેરભાંડાગારીયગ્રન્થસૂચી (પૃ. ૨૨)

૨. કવિશિક્ષા નામની વૃત્તિ સહિત આ મૂળ કૃતિ કાશીથી વિ. સં. ૧૮૪૨માં પ્રસિદ્ધ થઈ છે અને એનું મરાઠી ભાષાંતર ગાયકવાડ સરકાર તરફથી છપાયેલું છે. એ બેમાંથી એકે પુસ્તક મારા જોવામાં આવ્યું નથી. [જગન્નાથશાસ્ત્રી સંપાદિત “કાવ્યકલ્પલતાવૃત્તિ” “ચૌખંબા સં. સિરિઝ”માં ૧૯૩૧માં પ્રસિદ્ધ છે.]

૩. ગચ્છનું આ નામ ‘અણહિલપુર પાટણ’ના વાયવ્ય ખૂણામાં પંદર માઈલને અંતરે આવેલા ‘વાયડ’ને આભારી છે.

૪. એમણે સુકૃતસંકીર્તન રચ્યું છે અને બ્હીલરના મતે કવિતારહસ્ય પણ એમની કૃતિ છે.

૫. જુઓ કાવ્યકલ્પલતા (૧, ૨)

કાવ્યકલ્પલતા અને એની સ્વોપજ વૃત્તિમાં વર્ણવાયેલા વિષયોની નોંધ ડૉ. ડેએ HSP (ભા. ૨, પૃ. ૩૬૪-૩૬૬)માં નીચે મુજબ લીધી છે :

પ્રથમ પ્રતાનનું નામ 'છન્દઃસિદ્ધિ' છે. એમાં પાંચ સ્તબક છે: (૧) 'અનુષ્ટુભ્' છંદની રચના (અનુષ્ટુભ્ શાસન); (૨) મુખ્ય વૃત્તોનો ઉલ્લેખ, એક છંદનું બીજા છંદમાં પરિવર્તન તેમજ યતિ ઇત્યાદિ (છન્દોઢબ્યાસ); (૩) છંદ પૂર્ણ કરવા માટે વપરાતા શબ્દો જેમકે શ્રી, સમં, સત્, દ્રાક્, વિ, પ્ર, ઇત્યાદિ (સામાન્ય-શબ્દક); (૪) વાદ, પ્રશંસાના વિષયો, કુલ-શાસ્ત્રાદિ અને સ્વશાસ્ત્રાધ્યયન પ્રથા સંબંધી પ્રશ્નો ઇત્યાદિ (વાદ); અને (૫) રાજા, મંત્રી વગેરેનાં વર્ણન માટેની રીતિ અને કવિ-સમય (વર્ણ-સ્થિતિ).

બીજા પ્રતાનનું નામ 'શબ્દ-સિદ્ધિ' છે. એમાં શબ્દોની વ્યુત્પત્તિ, અનુપ્રાસ, સંબંધી વાક્યોના ઉલ્લેખ, સૂચિત વગેરે અર્થો ઇત્યાદિનું નિરૂપણ છે. એમાં ચાર સ્તબક છે.

ત્રીજા પ્રતાનનું નામ 'શ્લેષ-સિદ્ધિ' છે. ભિન્ન ભિન્ન પરિચ્છેદ પ્રમાણે શબ્દોના ભિન્ન ભિન્ન અર્થ, P. ૧૭૦ શ્લેષોપયોગી શબ્દોની સૂચી, દ્વયર્થી શબ્દો, બંધો ચિત્ર-કાવ્યો ઇત્યાદિ બાબતો અહીં અપાઈ છે. એમાં પાંચ સ્તબક છે.

ચોથા (છેલ્લા) પ્રતાનનું નામ 'અર્થ-સિદ્ધિ' છે. કઈ વસ્તુને શેની સાથે સરખાવવી એ બાબત અહીં વિચારાઈ છે. એમાં સાત સ્તબક છે.

કાવ્યકલ્પલતાના અંતમાં 'અષ્ટચક્ર' બંધથી વિભૂષિત પરિધિશ્લોક છે. એની ચિત્ર સહિત નોંધ મેં ILD માં લીધી છે.

આ કૃતિની સ્વોપજ વૃત્તિમાં એના કર્તાએ પોતાની નિમ્નાલિખિત કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે :-
કાવ્યકલ્પલતા-પરિમલ, કાવ્યકલ્પલતા-મંજરી, અલંકાર-પ્રબોધ અને છંદોરત્નાવલી.

વૃત્તિઓ :-

કવિશિક્ષા- આ ૩૩૫૭ શ્લોક જેવડી સ્વોપજ વૃત્તિ છે.

કાવ્યકલ્પલતા-પરિમલ- આ કાવ્યકલ્પલતા ઉપરની ૧૧૨૨ શ્લોક જેવડી સ્વોપજ વૃત્તિ છે.

કાવ્યકલ્પલતા-મંજરી- આ સ્વોપજ વૃત્તિ હજી સુધી તો મળી આવી નથી. એ કાવ્યકલ્પલતા-પરિમલ કરતાં પહેલી રચાઈ હશે એમ આ બેનાં નામ ઉપરથી કલ્પના કરાય છે.

કાવ્યકલ્પલતા ઉપર ઉપર્યુક્ત ત્રણ સ્વોપજ વૃત્તિ ઉપરાંત નીચે મુજબનું વિવરણાત્મક સાહિત્ય છે :-

મકરન્દ- આ વૃત્તિના રચનાર હીરવિજયસૂરિના શિષ્ય-શુભ-વિજયગણિ છે. એમણે વિ. સં. ૧૬૬૫માં આ વૃત્તિ ૩૧૮૬ શ્લોક જેવડી રચી છે.

P. ૧૭૧ વૃત્તિ- યશોવિજયગણિએ પણ ૩૨૫૦ શ્લોક જેટલા પરિમાણવાળા એક વૃત્તિ રચી છે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૮) જોતાં જણાય છે. શું આ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય યશોવિજયગણિની કૃતિ છે ?

૧. વસ્તુપાલકૃત નરનારાયણાનંદ (સ. ૧૪)માંનું ૧૬મું પદ્ય આ પ્રતાનમાં જોવાય છે.

૨. જુઓ મુંબઈ વિદ્યાપીઠનું સામયિક (Arts No. 30).

વિવેક યાને પલ્લવ- આ નામની એક વૃત્તિ વિબુધમન્દિરગણિએ રચ્યાનું કહેવાય છે. એનો પ્રારંભ “યત્ પલ્લવેન વિવૃત્ત” થાય છે. મારા લખાણને લક્ષીને પ્રા. પી. આર. વોરાએ ‘કલ્પલતાવિવેક’ અંગેની પોતાની પ્રસ્તાવના (પૃ. ૧૬-૧૭)માં ચર્ચા કરી છે. આ પ્રસ્તાવનામાં કલ્પલતા, ‘પલ્લવ’ અને વિશેષતઃ ક. વિ. વિષે વિસ્તૃત અને મહત્વપૂર્ણ માહિતી અપાઈ છે. એ અંગ્રેજીમાં હોઈ મુખ્યત્વે એના આધારે હું ખાસ ખપપૂરતી વિગતો ગુજરાતીમાં રજૂ કરું છું:-

કલ્પલતા (ઉ. વિ. સં. ૧૨૦૦)- આ અલંકારશાસ્ત્રને લગતી કૃતિ છે. એ અદ્યાપિ મળી આવી નથી. એમાં પુરોગામીઓની કૃતિઓમાંથી કારિકાઓને, સ્વરચિત કારિકાઓને તેમ જ વિવેચનોને સ્થાન અપાયું છે. પ્રસ્તુત કૃતિ નિમ્નલિખિત ચાર પરિચ્છેદોમાં વિભક્ત છે :-

(૧) દોષ-દર્શન, (૨) ગુણ-વિવેચન, (૩) જબ્દાલંકાર દર્શન અને (૪) અર્થાલંકાર-નિર્ણય.

કલ્પલતા ઉપર જે પલ્લવ કિંવા કલ્પલ્લવ નામની વૃત્તિ રચાઈ છે તે અત્યારે તો અનુપલબ્ધ છે એટલે એમાં કલ્પલતાના કે આ વૃત્તિના કર્તા વિષે માહિતી અપાઈ હોય તો તે અપ્રાપ્ય છે. ક. વિ. માંથી પણ આ સંબંધમાં કશો પ્રકાશ પડતો નથી. સદ્ભાગ્યે પ્ર. ન. ત. ના દ્વિતીય સૂત્રની વૃત્તિ નામે સ્થા. ૨. આ કલ્પલતા કે પછી પલ્લવનું એક પદ્ય ઉપસ્થિત કરે છે તેમ જ એના પ્રણેતા વિષે થોડીક માહિતી પૂરી પાડે છે. એ પદ્ય નીચે મુજબ છે :-

“સૂર્યચન્દ્રમસૌ યત્ર ચિત્ર ચ્છદ્યોતપોતકૌ ।
નિત્યોદયજુષે તસ્મૈ પરસ્મૈ જ્યોતિષે નમઃ ॥”

આ આદ્ય પદ્ય હોય એમ લાગે છે એ મંગલાચરણરૂપ જણાય છે. પ્રણેતાને લગતો ઉલ્લેખ નીચે મુજબ છે :-

“શ્રીમદમ્બાપ્રસાદસચિવપ્રવરેણ કલ્પલતાયાં તત્સંકેતેકલ્પપલ્લવે ચ પ્રપન્નિતમસ્તિ તત્ત એવાવસેયમ્.”

આ ઉપરથી ત્રણ બાબતો ફલિત થાય છે :-

- (૧) કલ્પલતાના કર્તાનું નામ ‘અંબાપ્રસાદ’ છે.
- (૨) એઓ સચિવપ્રવર છે. આથી એઓ મુખ્ય મંત્રી હોવાનું અનુમનાય છે.
- (૩) કલ્પલતા તેમ જ કલ્પપલ્લવ એ બંનેના કર્તા એક જ છે.

પ્ર. ચ. (શૃંગ ૨૧, પૃ. ૧૭૨)માં અંબ(બા) પ્રસાદનો ‘મંત્રી’ તરીકે ઉલ્લેખ છે. વિશેષમાં એ મંત્રીને અંગે અહીં બે બાબતો અપાઈ છે :-

૧. આ કૃતિના સંપાદક મુરારિ લાલે નાગર અને હરિશંકર શાસ્ત્રી છે અને એના પ્રસ્તાવનાકાર પ્રા. પ્રદ્યુમ્ન રં. વોરા છે. આ કૃતિ “લા. દ. વિદ્યામંદિર” તરફથી ઈ. સ. ૧૯૬૮માં પ્રકાશિત કરાઈ છે. પ્રારંભમાં મંત્રી અંબાપ્રસાદ અને એની પત્ની સીતાદેવીની પ્રતિકૃતિ અપાઈ છે. અંતમાં પાંચ પરિશિષ્ટો છે.
૨. અહીં પં. ૧૨માં ‘પલ્લવ’ છપાયું છે તે ‘પલ્લવશેષ’ જોઈએ.
૩. જુઓ કલ્પલતાવિવેકનું આદ્ય પદ્ય.
૪. ક. વિ. (પૃ. ૩૨૦)માં ‘કલ્પપલ્લવ’ તરીકે આનો નિર્દેશ છે.
૫. “વ્યયકરણે મહામાત્સ્યશ્રીઅમ્બાપ્રસાદપ્રતિનિબદ્ધ.”

૧. વાદી દેવસૂરિની સાથે અંબાપ્રસાદ 'આબુ' ગિરિ ઉપર ચડતા હતા તેવામાં એમને એક સર્પ ડસે છે. વાદી દેવસૂરિને એની ખબર પડતાં એ પોતાનું પાદોદક મોકલે છે, એનો ઉપયોગ કરતાં એ મંત્રી નિર્વિષ બને છે.

૨. અંબાપ્રસાદે સિદ્ધરાજ સાથે વાદી દેવસૂરિનો સમાગમ કરાવ્યો હતો.

'ગાલા'ના શિલાલેખમાં અંબાપ્રસાદને વ્યયકરણમાં રોકેલા મહામાત્ય કહેલ છે. અંબાપ્રસાદ વિષે આથી વિશેષ માહિતી મળતી નથી. એ જૈન હોય એમ પ્ર. ચ.ગત ઉપર્યુક્ત બાબતો વિચારતાં જણાય છે. આ પરિસ્થિતિમાં કલ્પલતા અને કલ્પપલ્લવ તો જૈન કૃતિ ગણાય જ.

સ્યા. ૨. વિ. સં. ૧૨૦૦ની આસપાસમાં રચાયાનું મનાય છે.^૧ ક. વિ.ની એક હાથપોથી વિ. સં. ૧૨૦૫માં લખાયેલી મળે છે. એ જોતાં કલ્પલતા મોડામાં મોડી વિ.સં. ૧૨૦૦માં રચાઈ હશે.

પલ્લવ કિંવા કલ્પપલ્લવ— સ્યા. ૨. પ્રમાણે આ સ્વોપજ્ઞ વૃત્તિ છે.

'કલ્પલતાવિવેક' (ઉ. વિ. સં. ૧૨૦૫)— આનું આદ્ય પદ નીચે મુજબ છે :—

“યત્ પલ્લવે ન વિતૃતં દુર્બોધ મન્દબુદ્ધિભિશ્ચાપિ ।

ક્રિયતે કલ્પલતાયાં તસ્ય વિવેકોઽતિસુગમઃ ॥૧ ॥”

એમાં સૂચવાયા મુજબ આનો વિષય નીચે પ્રમાણે છે :—

જેનું પલ્લવમાં વિવરણ નથી અને જેનો મંદબુદ્ધિવાળાઓને બોધ સહેલાઈથી થાય તેમ નથી તેનું અતિસુગમ નિરૂપણ અત્ર છે.

આ ઉપરથી જાણી શકાય છે કે આ કલ્પલતાના સ્પષ્ટીકરણરૂપ છે. સંસ્કૃતમાં વિષયાનુક્રમ અપાયો છે તેમ જ પ્રસ્તાવનામાં ક. વિ. નું તુલનાત્મક નિરૂપણ છે એટલે આ સંબંધમાં તો મારે ખાસ કંઈ ઉમેરવાનું રહેતું નથી. મીમાંસાસૂત્ર અને શાબરભાષ્યનો તેમ જ રઘુવંશ આદિ મહાકાવ્યો અને 'કાવ્યપ્રકાશ વગેરેનો ક. વિ.માં ઉપયોગ કરાયો છે. ક. વિ.નું 'કલ્પપલ્લવશેષ' નામાંતર નથી એમ પ્રસ્તાવના (પૃ. ૭-૮)માં સૂચવાયું છે ખરું પરંતુ એ વિચારણીય જણાય છે.

પૃ. ૧માં અવતરણરૂપ અપાયેલા નિમ્નલિખિત પદમાં જૈન ધર્મની પ્રશંસા કરાઈ છે એ ઉપરથી ક. વિ.ના કર્તા જૈન હોવાનું અનુમનાય છે :—

“જિણધમ્મો મોક્ષફલો સાસયસોક્ષ્હો જિણેહિં પન્નત્તો ।

નરસુરસુહાઈ અનુસઙ્ગિયાઈં હિહ કિસિપલ્લાલં વ ॥”

ક. વિ.ના કર્તાએ પોતાનું નામ જણાવ્યું નથી. એ વિબુધમંદિર છે એમ નિમ્નલિખિત અંતિમ પદ ઉપરથી જિ. ૨. કો. (વિ. ૧, (પૃ. ૮૯)માં શંકારૂપે સૂચવાયું છે એટલે એ વિશેષ વિચાર માંગી લે છે :—

૧. જુઓ ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૬).

૨. આ પ્રકાશિત છે, જુઓ પૃ. ૯૯, ટિ. ૧.

૩. આના કર્તા મમ્મટનો ઉલ્લેખ 'કલિ.' હેમચન્દ્રસૂરિએ વિવેક (પૃ. ૧૫૭)માં કર્યો છે. એ પૂર્વે કોઈએ તેમ કર્યું છે ખરું ?

“પલ્લવકલશવિરાજિનિ કલ્પલતાવિવુધમન્દિરે રચિતઃ ।

શેષધ્વજો વિજયતાં છેદપરુ(?) ધ્વપતાકોડયમ્ ॥”

આ પદ્યમાં કલ્પલતાને વિબુધમન્દિર, પલ્લવને એનો કલશ અને ક. વિ.ને એનો ધ્વજ કહ્યો છે.

ક. વિ. (પૃ. ૪૨, પં. ૧૮)માં ઉદ્દેશનો પરિહાર જે કલ્પલતામાં કરાયો છે તે ચિન્ત્ય છે એવો ઉલ્લેખ એના કર્તા કલ્પલતાના પ્રણેતા નથી એમ સિદ્ધ કરે છે.

પ્રકરણ ૮, ૯, ૧૧, ૧૩ અને ૧૫. ‘ભૂવલય (ઉ. વિક્રમની નવમી સદી)— આ ગ્રંથમાં કેવળ અંકો છે. ઉપલક દષ્ટિએ તો આ ગ્રંથ ‘કન્નડ’ ભાષામાં ‘સાંસત્ય’ નામના છંદમાં રચાયો છે જ્યારે એના પ્રણેતાના કથન મુજબ એ ૭૧૮ ભાષાઓમાં રચાયેલો છે અને એમાં ૧૮ ભાષાઓ મુખ્ય છે. પ્રત્યેક પ્રકરણનો પ્રારંભ એક મૂળાક્ષરથી કરાયો છે. આ ગ્રંથની એક હાથપોથીના પ્રત્યેક પાના ઉપર ત્રીસ પાનાં પાડી ત્રીસ અંક લખાયા છે. આ દરેક અંક નાગરી લિપિના એકેક અક્ષરનું સૂચન કરે છે. આ લિપિમાં સ્વર, વ્યંજન, વિસર્ગ, ઇત્યાદિ મળીને ૬૪ અક્ષરો હોવાનું ગ્રંથકાર માને છે.

ઉપર્યુક્ત અંકો સીધી લીટીમાં વાંચીએ તો કન્નડ ભાષાનાં પદ્યો બને છે^૧ જ્યારે ૨૧મા અંકને (? ૨૭) ઉપરથી નીચે વાંચીએ તો સંસ્કૃત ભાષાનાં પદ્યો બને છે. અંકો ઊભા વંચાય તો પાઈય ભાષાની કૃતિ નિષ્પન્ન થાય છે. દરેક પંક્તિનો પહેલો પહેલો અંક નીચે વાંચીએ તો ઋગ્વેદના મંત્રો બને છે જ્યારે છેલ્લો છેલ્લો અંક વાંચીએ તો ભગવદ્ગીતાનાં પદ્યો બને છે.

આ ગ્રંથનું પરિમાણ છ લાખ શ્લોક જેટલું હોવાનું કહેવાય છે.^૨

કર્તા— આ ગ્રંથના કર્તા એક દક્ષિણી જૈન બ્રાહ્મણ છે. એમનું નામ આચાર્ય કુમુદેન્દુ છે. ઉદયચન્દ્ર એમના પિતા થાય અને વાસુપૂજ્ય પિતામહ થાય એમ દેવધા નામના કવિએ કુમુદેન્દુશતકમાં કહ્યું છે. કુમુદેન્દુ નૃપતિ અમોઘવર્ષ પહેલાના રાજગુરુ થાય છે અને વીરસેનના મુખ્ય શિષ્ય થાય છે.

વિષય— આ ગ્રંથમાં જાતજાતના વિષયોને સ્થાન અપાયું છે. જેમકે સંગીતશાસ્ત્ર, ગણિત, ભૂગોળ, રસવાદ, આયુર્વેદ, મનોવિજ્ઞાન, જાતીયજ્ઞાન, તત્ત્વજ્ઞાન, વાદનકળા, કર્મસિદ્ધાન્ત, ભાષાવિજ્ઞાન અને અણુવિજ્ઞાન.^૩ આ ગ્રંથ ઉપનિષદ્ રામાયણ, ભગવદ્ગીતા અને મહાભારત ઉપર પણ પ્રકાશ પડે છે.

પ્રસ્તુત ગ્રંથની રૂપરેખા “જૈન”ના તા. ૨-૧-૬૦ના અંકમાં અપાઈ છે.^૪ મુખ્યત્વે એના આધારે મેં આ ગ્રંથનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે.

૧. આ ગ્રંથ એક વેળા તો બેંગલોરના ભાસ્કરપંત શાસ્ત્રી અને પેલ્લાપ્પા શાસ્ત્રીના કબજામાં હતો. આજે પણ કદાચ તેમ જ હશે. [આ છપાયો છે.]

૨. એ આઠ તીર્થંકરોની જીવનરેખા રજૂ કરે છે.

૩. એ સમગ્ર ગ્રંથ છપાતાં ૧૬૦૦૦ પૃષ્ઠ જેવડો થશે એમ અનુમનાય છે.

૪. આમાં એકી અંકને શેષ ન વધે એવી રીતે બેકીથી ભાંગી શકાય છે એ બાબત છે એમ “દિગંબર જૈન” (વ. ૪૫, અં. ૫)માં ઉલ્લેખ છે. અહીં બે સૂર્યો અને બે ચન્દ્રો વિષે પણ આ ગ્રંથમાં નિર્દેશ હોવાનું કહ્યું છે.

૫. આ વિષયનું આ ગ્રંથમાં વિસ્તૃત નિરૂપણ છે. ૬. પરમાણુના વિભાજનને પણ અત્ર સ્થાન અપાયું છે.

૭. આ પૂર્વે “દિગંબર જૈન” (વ. ૪૫ અં. ૫) માં અને “પ્રતાપ”ના સૌજન્યથી “હિંદુ મિલન મંદિર” (વ. ૧૩ અં. ૬)માં આ ગ્રંથ વિષે કેટલીક વિગતો અપાઈ છે.

અલંકાર-પ્રબોધ (લ. વિ. સં. ૧૨૮૦)- આના કર્તા પદ્માનન્દમહાકાવ્ય વગેરેના કર્તા અમરચન્દ્રસૂરિ છે. એમણે આ કૃતિનો ઉલ્લેખ કાવ્યકલ્પલતાવૃત્તિ (પૃ. ૧૧૬)માં કર્યો છે. અલંકાર-પ્રબોધમાં અલંકારોનું નિરૂપણ હશે એમ નામ વિચારતાં લાગે છે. આ કૃતિ મળે છે ખરી ?

કવિશિક્ષા (લ. વિ. સં. ૧૨૮૦)- આના કર્તા વિનયચન્દ્રસૂરિ છે. એઓ વિ. સં. ૧૨૮૫ના અરસામાં વિદ્યમાન હતા. એમણે પાર્શ્વનાથચરિત્ર ઇત્યાદિ વીસ પ્રબંધો રચ્યાં છે. [ડો. હરિપ્રસાદ શાસ્ત્રી સંપાદિત “કાવ્યશિક્ષા” લા.દ. વિદ્યામંદિર અમદાવાદ દ્વારા ઇ.સ. ૧૯૬૪માં પ્રસિદ્ધ થયેલ છે.]

કેટલાકને મતે વિ. સં. ૧૨૮૬માં મલ્લિનાથચરિત્ર રચનારા અને ઉદયસિંહે રચેલી ધર્મવિધિવૃત્તિને સુધારનારા વિનયચન્દ્ર તે જ આ કવિશિક્ષાના કર્તા છે. એમની આ કવિશિક્ષા એ ‘વિનય’ અંકથી અંકિત છે. એના પ્રારંભમાં એના કર્તાએ કહ્યું છે કે ભારતી દેવીને પ્રણામ કરીને બખ્ખભટ્ટિગુરુની વાણીમાં વિવિધ શાસ્ત્રો જોઈને હું કવિશિક્ષા કહીશ. આથી એમ લાગે છે કે બખ્ખભટ્ટિએ કવિશિક્ષા રચી હશે તેનો P. ૧૭૨ વિનયચન્દ્રે ઉપયોગ કર્યો છે. એમણે આ કવિશિક્ષામાં તે વખતના ચોર્યાસી દેશોની-સૌરાષ્ટ્ર, લાટ વગેરે વિષે થોડીક માહિતી આપી છે. પં. લાલચન્દ્ર ગાંધી કહે છે કે આ કવિશિક્ષા રવિપ્રભ ગણીશ્વરે રચેલા શિક્ષાશતનું શિક્ષણ આપનારી છે.

અલંકારમહોદધિ (લ. વિ. સં. ૧૨૮૦)- આના કર્તા નરેન્દ્રપ્રભસૂરિ છે. એઓ નરચન્દ્રસૂરિના શિષ્ય થાય છે. એમણે ‘વિવેક-કલિકા અને ‘વિવેક-પાદ્ય એ નામના બે સૂક્તિ-સંગ્રહ, કાકુત્સ્થકેલિ નામનું નાટક, બે વસ્તુપાલ-પ્રશસ્તિ તેમજ ‘ગિરનાર’ ઉપરના વસ્તુપાલના પ્રશસ્તિ-લેખોમાંનો એક લેખ રચ્યાં છે. એઓ વસ્તુપાલના સમકાલીન છે અને એ મંત્રીશ્વરની અભ્યર્થનાથી અને એમના પ્રમોદને માટે એમણે આ અલંકારમહોદધિની રચના કરી છે.

આ કૃતિ આઠ ભાગમાં વિભક્ત છે. પ્રત્યેક ભાગને ‘તરંગ’ કહેવામાં આવ્યો છે. દરેક તરંગનું તદ્દગત વિષય અનુસાર નામ યોજાયું છે. સમગ્ર કૃતિ પદ્યમાં છે. આઠ તરંગોનાં પદ્યોની સંખ્યા અનુક્રમે ૧૮, ૩૫, ૬૬, ૫, ૨૪, ૩૨, ૨૫ અને ૮૯ છે. આમ એકંદરે ૩૦૪ (ત્રણસો ને ચાર) પદ્યો છે.

પ્રથમ તરંગમાં કાવ્યના પ્રયોજન અને એના ભેદનું, બીજામાં શબ્દવૈચિત્ર્યનું ત્રીજામાં ધ્વનિના નિર્ણયનું ચોથામાં ગુણીભૂત વ્યંગ્યનું, પાંચમામાં દોષનું, છઠ્ઠામાં ગુણના નિર્ણયનું સાતમામાં શબ્દાલંકારનું અને આઠમામાં અર્થાલંકારનું નિરૂપણ છે.

૧. આ માટે જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૩૯૩)

૨. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૮૩)માં જે શિક્ષાશતકનો ઉલ્લેખ છે તે જ આ કૃતિ છે ?

૩. આ તેમજ એની સ્વોપજ વૃત્તિ ભાવદેવસૂરિકૃત કાવ્યાલંકાર યાને અલંકારસાર નામના પરિશિષ્ટ સહિત “ગા. પૌ. ગ્રં.”માં ઈ. સ. ૧૯૪૨માં પ્રસિદ્ધ થઈ છે, છતાં મુખપૃષ્ઠ ઉપર સ્વોપજ વૃત્તિનો ઉલ્લેખ નથી, એનું સંપાદન પં. લાલચન્દ્ર ગાંધીએ કર્યું છે. એમણે આને અંગે સંસ્કૃતમાં પ્રસ્તાવના અને અન્તમાં વૃત્તિગત ઐતિહાસિક ઉપયુક્ત નામોની સૂચી, આ વૃત્તિમાંનાં ઉદાહરણોનાં મૂળ સ્થળોની સૂચી, નરચન્દ્રસૂરિકૃત વસ્તુપાલ-પ્રશસ્તિ અને નરેન્દ્રપ્રભસૂરિકૃત બે વસ્તુપાલ-પ્રશસ્તિ પરિશિષ્ટો તરીકે રજૂ કર્યાં છે.

૪-૫. આ બે કૃતિ ઉપરથી એ જાણી શકાય છે કે નરેન્દ્રપ્રભસૂરિનું ઉપનામ (pen-name) “વિબુધચન્દ્ર કવિ” હતું. જુઓ પત્તન.સૂચી (ભા. ૧, પૃ. ૧૮૬ ઈ.)

‘સ્વોપજ વૃત્તિ- આ વૃત્તિ નરેન્દ્રપ્રભસૂરિએ વિ. સં. ૧૨૮૨માં રચી છે અને એનું પ્રમાણ ૪૫૦૦ શ્લોક જેટલું છે આ સ્વોપજ વૃત્તિમાં પ્રાચીન કવિવરોની કૃતિમાંથી ૯૮૨ પદો ‘ઉદાહરણરૂપે અપાયાં છે. આમાંના પાઈય પદોની છાયા સંપાદકે આપી છે.

અર્થાલંકાર-વર્ણન-અલંકારમહોદધિની સંસ્કૃત પ્રસ્તાવના (પૃ. ૨૨-૨૩)માં આ અર્થાલંકારવર્ણનની અમદાવાદના ડેલાના ભંડારની ૩૯ પત્રની હાથપોથીનો પરિચય અપાયો છે અને સાથે સાથે એના છેલ્લા પત્રની પ્રતિકૃતિ પણ અપાઈ છે, આ પ્રતિકૃતિ જોતાં એ વાત નિઃસંદિગ્ધ બને છે કે અર્થાલંકારવર્ણનમાં અલંકારમહોદધિના આદ્યમાં તરંગનો મૂળ ભાગ વૃત્તિ સહિત અપાયેલો છે એટલે આ કોઈ સ્વતંત્ર કૃતિ નથી.

‘કાવ્યાનુશાસન (લ. વિ. સં. ૧૩૫૦)- આ નામની આ બીજી કૃતિ છે. એના કર્તા વાગ્ભટ બીજા છે. એમણે ‘છન્દોડનુશાસન, ‘ઋષભદેવચરિત્ર ઇત્યાદિની રચના કરી છે. એમનો સમય વિક્રમની ૯૧૭૪ ચૌદમી સદી છે. એમણે મેદપાટ (મેવાડ), રાહડપુર અને નલોટકપુરનો ઉલ્લેખ કર્યો છે.

મેવાડ વગેરેમાં પ્રસિદ્ધ નેમિકુમારના એઓ પુત્ર થાય છે. કાવ્યાનુશાસન (પૃ. ૩૧)માં એમણે વાગ્ભટ પહેલાનો ઉલ્લેખ કર્યો છે એટલે એઓ વાગ્ભટ બીજા છે એ વાત નિર્વિવાદ બને છે.

આ કાવ્યાનુશાસન પાંચ અધ્યાયમાં વિભક્ત છે. પ્રથમ અધ્યાયમાં કાવ્યનાં પ્રયોજનો અને હેતુ તેમજ એ બંનેનાં લક્ષણ, કવિ-સમય, કાવ્યનું લક્ષણ અને એના ગદ્યાદિ ત્રણ ભેદ, મહાકાવ્ય, આખ્યાયિકા, કથા, ચંપૂ અને મિશ્ર કાવ્યનાં લક્ષણો તેમજ દસ રૂપકો અને ગેયો એમ વિવિધ બાબતો અપાઈ છે.

બીજા અધ્યાયમાં પદ ને વાક્યના દોષો, અર્થના ચૌદ દોષ, દંડીએ, વામને અને વાગ્ભટ પહેલાએ નિર્દેશેલા દસ ગુણ અને ખરી રીતે ત્રણ હોવા સંબંધી પોતાનો અભિપ્રાય તેમજ ત્રણ રીતિ એ બાબતો હાથ ધરાઈ છે.

ત્રીજા અધ્યાયમાં તેંસઠ અલંકારોનું નિરૂપણ છે. એમાંના કેટલાક વિરલ છે. જેમકે, અન્ય, અપર, આશિસૂ, ઉભય-ન્યાસ, પિહિત, પૂર્વ, ભાવ, મત અને લેશ.

ચોથા અધ્યાયમાં શબ્દાલંકારના ચિત્ર, શ્લેષ, અનુપ્રાસ, વકોક્તિ, યમક અને પુનરુક્તવદાભાસ એ પ્રકારો તેમજ એના ઉપપ્રકારો સમજાવાયા છે.

પાંચમા અધ્યાયમાં નવ રસ, વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ, નાયક અને નાયિકાના પ્રકારો, કામની દસ દશા અને રસના દોષો એમ વિવિધ વિષયો ચર્ચાયા છે.

૧. આ ગા. પૌ. ગ્રં. માં પ્રકાશિત છે.

૨. તરંગ ૭, શ્લો. ૨૧ની વૃત્તિમાં કોઈક કૃતિમાંથી અષ્ટદલ કમલનું ઉદાહરણ અપાયું છે. એ ચિત્ર સહિત મારા લેખ નામે ILD ના બીજા હપ્તામાં અપાયું છે.

૩. આ અલંકારતિલક નામની સ્વોપજ વ્યાખ્યા સહિત ‘‘કાવ્યમાલા’’ (૪૩)માં પ્રસિદ્ધ થયેલું છે.

૪. આનો ઉલ્લેખ ગ્રંથકારે કાવ્યાનુશાસન (સટીક)માં પૃ. ૧૫માં કર્યો છે.

૫. આ કૃતિ સટીક કાવ્યાનુશાસન (પૃ. ૨૦)માં નોંધાઈ છે ખરી પણ અપ્રાપ્ય છે.

P. ૧૭૫ આ કૃતિનો મુખ્ય ભાગ ગદ્યમાં સૂત્રરૂપે રજૂ કરાયો છે. એનું નિરૂપણ અને એને લગતાં ઉદાહરણો સ્વોપણ ટીકામાં જોવા મળે છે.

અલંકારતિલકમાં વિવિધ દેશો, નદીઓ અને વનસ્પતિ વિષે ઉલ્લેખ છે.

પૃ. ૩૨માં નેમિકુમારનો નિર્દેશ છે. પૃ. ૫૮માં જે વાગ્ભટનો ઉલ્લેખ છે તે ગ્રંથકારે પોતાને જ વિષે કર્યો હોય એમ લાગે છે.

ઉલ્લેખ—આ વાગ્ભટ બીજાએ અનેક ગ્રંથ અને ગ્રંથકારોનું ટાંચણ કર્યું છે. જેમકે ચંદ્રપ્રભકાવ્ય, નેમિનિર્વાણ, ગ્રામ્ય ભાષામાં ભીમકાવ્ય (પૃ. ૧૫), રાજમતી-પરિત્યાગ, શીતા નામની કવયિત્રી (પૃ. ૨૦), અપભ્રંશનિબદ્ધ અધિમંથન (પૃ. ૧૫) ઇત્યાદિ.

એમણે કાવ્યમીમાંસા, કાવ્યપ્રકાશ વગેરેનો પુષ્કળ ઉપયોગ કર્યો છે. વાગ્ભટાલંકાર (૪-૩૦) યમકને પ્રસંગે અવતરણરૂપે અપાયેલ છે. નેમિનિર્વાણકાવ્ય (૭-૫૦) વિષે પણ ઉલ્લેખ છે.

‘અલંકારસાર યાને અલંકારસંગ્રહ (વિ. સં. ૧૪૧૨)- આ ‘ખંડિલ્લ’ ગચ્છના ભાવદેવસૂરિની કૃતિ છે. એમણે પાટણમાં વિ. સં. ૧૪૧૨માં પાર્શ્વનાથચરિત્ર રચ્યું છે. વળી એમણે પાઈયમાં પણ બે કૃતિ રચી છે: (૧) જઈદિણચરિયા (યતિદિનચર્યા) અને કાલકકલા (કાલકકથા).

અલંકારસાર નામની આ પદ્યાત્મક કૃતિના પ્રથમ પદ્યમાં આ કૃતિનો કાવ્યાલંકારસારસંકલના તરીકે, એના પ્રત્યેક અધ્યાયની પુષ્પિકામાં એનો અલંકારસાર તરીકે અને આઠમાં અધ્યાયના અંતિમ પદ્યમાં એનો અલંકારસંગ્રહ તરીકે ઉલ્લેખ છે.

P. ૧૭૬ આમ વિવિધ નામોથી ઓળખાવાતી આ કૃતિને સમ્પાદકે કાવ્યાલંકારસંગ્રહ તરીકે નિર્દેશી છે. આમાં એકંદર આઠ અધ્યાય છે. એનાં પદ્યોની સંખ્યા અનુક્રમે ૫, ૧૫, ૨૪, ૧૩, ૧૩, ૪૮, ૫ અને ૮ની છે.

પહેલા અધ્યાયમાં કાવ્યનું ફળ, કાવ્યનો હેતુ અને કાવ્યનું સ્વરૂપ વિચારાયાં છે. બીજામાં શબ્દ અને અર્થના સ્વરૂપનું નિરૂપણ છે. ત્રીજામાં શબ્દ અને અર્થના દોષો જણાવાયા છે. ચોથામાં ગુણ ઉપર પ્રકાશ પડાયો છે. પાંચમાં શબ્દાલંકારનું, છઠ્ઠામાં અર્થાલંકારનું, સાતમાં રીતિનું અને આઠમાં ભાવનું—વિભાવ અને અનુભાવનું સ્વરૂપ આલેખાયું છે. આ પ્રમાણેના વિષય અનુસાર અધ્યાયોનાં નામ યોજાયાં છે.

અંતિમ પદ્યમાં કર્તાએ પોતાને ‘આચાર્ય ભાવદેવ’ તરીકે ઓળખાવેલ છે. પ્રત્યેક પુષ્પિકામાં આ આચાર્યનો ‘કાલકાચાર્યના સંતાનીય’ તરીકે ઉલ્લેખ છે.

‘અલંકાર-મંડન (લ. વિ. સં. ૧૪૭૫)- આ ઉપસર્ગમંડન વગેરે રચનારા જૈન મંત્રી મંડનની કૃતિ છે. એ પાંચ પરિચ્છેદોમાં વિભક્ત છે. એમાં કાવ્યનાં લક્ષણ, પ્રકાર, રીતિઓ, દોષો અને ગુણો તેમજ રસ અને અલંકારો વિષે માહિતી અપાઈ છે.

૧. આ કાવ્યાલંકારને નામે અલંકારમહોદધિ નામની કૃતિના પરિશિષ્ટ તરીકે છપાવાયો છે.

૨. આ “હેમચન્દ્રાચાર્યસભા” પાટણ તરફથી પ્રકાશિત છે.

આ કૃતિની તેમજ બીજી ‘મંડન’ અંતવાણી સાથે કૃતિઓની તથા ચંદ્રવિજયની, કાયસ્થ વિનાયકદાસે તાડપત્ર ઉપર વિ. સં. ૧૫૦૪માં લખેલી હાથપોથી પાટણનાં ભંડારમાં છે.

ત્રૈવિદ્યગોષ્ઠી (પત્ર ૧૦અ)માં કહ્યું છે કે વિદ્વાનો શબ્દ અને અર્થના વૈચિત્ર્યથી મનોહર એવા કવિ-કર્મને (કાવ્યને) ‘સાહિત્યનો સાર’ કહે છે. તેમાં શબ્દના ત્રણ પ્રકાર છે: (૧) વાચક, (૨) ઔપચારિક અને (૩) વ્યંજક, અર્થના પણ ત્રણ પ્રકાર છે: (૧) મુખ્ય, (૨) ઉપચરિત અને (૩) વ્યંગ્ય. શબ્દનું વૈચિત્ર્ય દોષ દૂર કરવાથી, ગુણ સ્થાપિત કરવાથી કરવાથી અને ભૂષણ (અલંકાર)નો ઉપયોગ કરવાથી ઉદ્ભવે છે. દુષ્ટ, અસંસ્કાર ઇત્યાદિ દોષો અને માધુર્યાદિ ત્રણ ગુણો ગણાવી અલંકાર તરીકે અનુપ્રાસ ઇત્યાદિ એમ કહ્યું છે. અર્થનું વૈચિત્ર્ય વસ્તુ, અલંકાર અને રસના ભેદથી ત્રણ પ્રકારનું છે એમ અહીં કહ્યું છે. ત્યાર બાદ ‘ત્રણ પદ્યો આપી વિષમવૃત્ત, વિષમતર વૃત્ત, સમસ્યા, ચિત્ર, ક્રિયાગુપ્તક ઇત્યાદિ કુશલતાઓ કે જે અનેક વિદ્વાનોના મનોવિનોદના ફળરૂપ હોય તે અનેક પ્રકારે સંભવે છે એમ કહ્યું છે.

કવિતામદપરિહાર (લ. વિ. સં. ૧૭૦૦)- જિ. ર. કો. (ખંડ ૧, પૃ. ૮૨) પ્રમાણે આના કર્તા પ. ૧૭૭ સકલચન્દ્રના શિષ્ય શાંતિચન્દ્ર છે. એમણે આ કૃતિને સ્વોપજ વૃત્તિથી વિભૂષિત કર્યાનો પણ અહીં ઉલ્લેખ છે. આ ઉલ્લેખની પૂર્વે ‘કવિતામદપરિહારવૃત્તિ’ને ‘કવિમદપરિહાર’ હોવાનું સંભવે છે એમ જે કહ્યું છે તે વિચારણીય જણાય છે.

‘અલંકારચિન્તામણિ (ઉ. વિક્રમની ૧૮મી સદી)- દિ. અજિતસેને રચેલી આ કૃતિમાં પાંચ પરિચ્છેદ છે. આમાં કવિશિક્ષા, ચિત્રાલંકાર, યમકાદિ, અર્થાલંકાર અને રસાદિનું અનુક્રમે નિરૂપણ છે.

ટીકા-જિ. ર. કો. (ખંડ ૧, પૃ. ૧૭) પ્રમાણે અલંકાર-ચિન્તામણિ ઉપર કોઈકની ટીકા છે.

અલંકારસંગ્રહ-આના કર્તા અમૃતનંદિ છે. એમણે આ કૃતિ છ પ્રકરણોમાં વિભક્ત કરી છે. એમાં અનુક્રમે નિમ્નલિખિત વિષયોનું નિરૂપણ છે :-

વર્ણગણવિચાર, શબ્દાર્થનિર્ણય, રસવર્ણન, નેત્રભેદનિર્ણય, અલંકારનિર્ણય અને ગુણનિર્ણય.

આ કૃતિની વિવિધ હાથપોથીઓની નોંધ જિ. ર. કો. (ખંડ ૧, પૃ. ૧૭)માં લેવાઈ છે. આ કૃતિની ‘કન્નડ’ લિપિમાં લખાયેલી ત્રણ હાથપોથીની નોંધ ક. તા. ગ્રં. માં છે (જાઓ પૃ. ૧૩૫, ૨૨૫ અને ૨૮૩). પૃ.૩૧૩ આ કૃતિના પ્રણેતાનું નામ ‘અમૃતાનન્દ યોગી’ અપાયું છે.

૧. આ ત્રણે પદ્યો ત્રીજાના ગુજરાતી અનુવાદ સહિત મેં “સહસ્રાવધાની મુનિસુન્દરસૂરિનું લાક્ષણિક સાહિત્ય” નામના મારા લેખમાં આપ્યાં છે.

૨. આ કૃતિ સોલાપુરના રહીશ સખારામ નેમચંદ દોશી દ્વારા શકસંવત્ ૧૮૨૮માં સચિત્ર સ્વરૂપે પ્રસિદ્ધ કરાઈ છે પણ એ અપૂર્ણ જણાય છે.

૩. “આકાર-ચિત્ર”નાં ઉદાહરણો તેમજ એને લગતાં ચિત્રો મેં ILD નામના મારા લેખમાં આપ્યાં છે અને એ એના ત્રીજા હપ્તામાં મુંબઈ વિદ્યાપીઠના સામયિક (Arts No. 31)માં પ્રસિદ્ધ થનાર છે.

કાવ્યલક્ષણ—જૈ. ગ્રં. (પૃ. ૩૧૬)માં આ અજ્ઞાતકર્તૃક કૃતિ ૨૫૦૦ શ્લોક જેવડી હોવાનો ઉલ્લેખ છે. આ કૃતિ વિષે વિશેષ, હકીકત જાણવામાં નથી.

P. ૧૭૮ કાવ્યાભ્યાસ— આ કૃતિ વિષે જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૧)માં નોંધ છે, પરંતુ અહીં એ પ્રશ્ન ઉઠાવાયો છે કે શું આ ચન્દ્રાલોકની ટીકા છે ?

ચન્દ્રાલોક (લ. વિ. સં. ૧૨૭૫)– મહાદેવના પુત્ર ‘પિયૂષવર્ષ’ જયદેવે દસ મયૂખમાં વિભક્ત કરાયેલું ચન્દ્રાલોક નામનું અલંકારશાસ્ત્ર લગભગ ૩૫૦ પદોમાં ઇ.સ. ૧૨૦૦થી ૧૨૫૦ના ગાળામાં રચ્યું છે. અને ભામહ તથા દંડીની પેઠે ઉદાહરણો પોતાનાં આપ્યાં છે. આ કૃતિ અત્ર અભિપ્રેત હોય એમ લાગે છે. જો એમ જ હોય તો કાવ્યાભ્યાસ એ સ્વતંત્ર કૃતિ ન ગણાય; એ તો એક અજૈન કૃતિની જૈન ટીકા ગણાય.

જૈ. ગ્રં. (પૃ. ૩૧૫)માં ૨૦ પત્ર પૂરતો અમરચન્દ્રે કાવ્યાભ્યાસ રચ્યાનો ઉલ્લેખ છે પણ એ વિચારણીય જણાય છે.

પ્રકાન્તાલંકાર-વૃત્તિ— આ નામની કૃતિ જિનહર્ષના શિષ્યે રચી છે અને એની તાડપત્રીય હાથપોથી પાટણના ભંડારમાં છે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૫૭)માં નોંધ છે.

કર્ણાલંકારમંજરી—જૈ. ગ્રં. (પૃ. ૩૧૫)માં આ કૃતિ ૭૦ પદોમાં ત્રિમલ્લે રચ્યાનો ઉલ્લેખ છે પણ જિ. ૨. કો.માં તો આ નામથી કોઈ કૃતિની નોંધ નથી તો શું આ કૃતિ અલંકારશાસ્ત્રને લગતી છે અને એના કર્તા કોઈ જૈન છે ?

અલંકારચૂર્ણિ— આ નામની કૃતિ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૧૭)માં નોંધાઈ છે. વિશેષ હકીકત માટે જુઓ પૃ. ૫૭ (ઉપોદ્ધાત).

[અકબરસાહિત્યગ્રંથાવલોક— પદ્મસુંદરગણિની આ રચના માધવકૃષ્ણશર્મા દ્વારા સંપાદિત થઈ “અનૂપ સંસ્કૃત લાયબ્રેરી” બિકાનેરથી ૧૯૪૩માં પ્રસિદ્ધ થઈ છે.

અલંકારદ્વિપ્પણ— આનું પ્રકાશ “મરુધર કેશરી મિશ્રીમલજીઅભિનંદન ગ્રંથ” ખંડ ૪ પૃ. ૪૩૦-૪૫૮માં થયું છે.]

P. ૧૭૯

આંશિક કૃતિઓ

રૂપક-મંજરી (વિ. સં. ૧૬૪૪)– આ ગોપાલના પુત્ર રૂપચન્દ્રની સો શ્લોક જેવડી કૃતિ હોવાનો જૈ. ગ્રં. (પૃ. ૩૧૨)માં ઉલ્લેખ છે. આ નામથી કોઈ કૃતિ જિ. ૨. કો.માં નોંધાયેલી નથી. પણ એમાં (ખંડ ૧, પૃ. ૩૩૨માં) આ હકીકત રૂપમંજરીનામમાલાને અંગે જોવાય છે. જો ખરી રીતે તેમ ન જ હોય તો પ્રસ્તુત નામ વિચારતાં એમાં ‘રૂપક’ નામના અલંકાર વિષે નિરૂપણ હશે એમ લાગે છે અને એ હિસાબે એ અલંકારશાસ્ત્રની કૃતિ ગણાય.

રૂપક-માલા—આ ઉપા. પુણ્યનંદનની કૃતિ છે અને એના ઉપર સમયસુંદરગણિએ વિ. સં. ૧૬૬૩માં ટીકા રચી છે. આ નામની એક કૃતિ પાર્શ્વચન્દ્રસૂરિએ વિ. સં. ૧૫૮૬માં રચી છે. વળી આ નામની એક અજ્ઞાતકર્તૃક કૃતિ પણ છે.

વક્રોક્તિ-પંચાશિકા—આ રત્નાકરની રચના છે એમ જૈ. ગ્રં. (પૃ. ૩૧૨)માં ઉલ્લેખ છે. મને તો આ નામ વિચારતાં બે કલ્પના સ્ફુરે છે : (૧) આ વક્રોક્તિનાં પચાસ ઉદાહરણરૂપ હશે. (૨) આમાં વક્રોક્તિ વિષે પચાસ પદ્યો હશે. પ્રથમ વિકલ્પ સાચો હોય તો એ અલંકારશાસ્ત્રની કે કાવ્યરૂપ કૃતિ ગણાય. બીજો વિકલ્પ ખરો હોય તો એ અલંકારશાસ્ત્રની કૃતિ ગણાય.

[વિશેષ માટે જુઓ— ‘જૈનાચાર્યો કા અલંકારશાસ્ત્ર મેં યોગદાન’ ડો. કમલપ્રકાશ જૈન પ્ર. પાર્શ્વનાથ શોધપીઠ વારાણસી.]

[‘હેમચન્દ્રાચાર્યકૃત કાવ્યાનુશાસન એવં ભૌજકૃત સરસ્વતી કંઠાભરણકા તુલનાત્મક અધ્યયન’ લે. પ્રમિલા ત્રિપાઠી.]

[“Kavyanusāsan of Acharya Hemachandra A critical study” By A. M. Upādhyay Ahmedabad. “કાવ્યાનુશાસન” આ. સુશીલસૂરિકૃત અવચૂરિ સાથે પ્રકા. લાવણ્યસૂરિ-જ્ઞાનમંદિર બોટાદ.]

કેશરીયાજી તીર્થ ઇતિહાસ— ચંદનમલ નાગોરી.

જૈનતીર્થસર્વસંગ્રહ ભા.૧-૨.— પ્ર. આણંદજી કલ્યાણજી પેઢી.

હરિભદ્રસૂરિચરિત્રમ્— પં. હરગોવિન્દદાસ.

કુંભોજગિરિતીર્થ ઇતિહાસ—

મીનમાલતીર્થ કા ઇતિહાસ— ભા.૧-૨ આ. પદ્મસાગરસૂરિ, મહાવીર જૈન આ. કેન્દ્ર કોબા.

નગરકોટ કાંગડા મહાતીર્થ— ભંવરલાલ નાહટા.

જીરાવલા દર્શન— સોહનલાલ પટણી, પ્ર. જીરાવલા પેઢી.

મણિભદ્રજીવન ચરિત્ર— નંદલાલ દેવલુક, પ્ર. અરિહંત પ્રકાશન

મ. પાર્શ્વનાથ કી પરમ્પરા કા ઇતિહાસ— ભા.૧-૨-૩, જ્ઞાનસુન્દર. સંપા. રત્નસેન વિ. પ્ર. દિવ્યસન્દેશ પ્રકાશન.

યશોવિજય ઉપાધ્યાય સ્વાધ્યાય ગ્રંથ— સં. પ્રદ્યુમ્નસૂરિ. પ્ર. મહાવીર વિદ્યાલય.

આગમસદ્ધકોસો ભા.૧-૪. દીપરત્નસાગર, પ્ર. આગમસૂત્ર પ્રકાશન.

ભદ્રેશ્વર મહાતીર્થ— રતીલાલ દેસાઈ. પ્ર. ગૂર્જર.

ભીલડીયાજી તીર્થ— પ્ર. ભીલડીયાજી પેઢી

નવપદપ્રકરણ (સ્વોપજ્ઞટીકા)— દેવગુપ્તસૂરિ, પ્ર. જિ. આ. દ્ર.

સ્વર્ણગિરિ જાલોર— ભંવરલાલ નાહટા, પ્ર. પ્રાકૃત ભારતી.



‘નાટ્ય’નો અર્થ નૃત્ય અને અભિનય એમ કરાય છે. એની કળાને ‘નાટ્યકળા’ કહે છે. એ કળાનું શાસ્ત્રીય નિરૂપણ પૂરા પાડનારા ગ્રંથને ‘નાટ્યશાસ્ત્ર’ તરીકે ઓળખાવાય છે. ઉપલબ્ધ જૈન સાહિત્ય જોતાં આ જાતના સ્વતંત્ર ગ્રંથો વિક્રમની દસમી સદી કરતાં પ્રાચીન સમયમાં રચાયા હોય^૧ તો પણ તે હજી સુધી તો મળ્યા નથી. આથી આ જાતનો આદ્ય ગ્રંથ નાટ્યદર્પણ ગણાય. આ વિષયનો બીજો કોઈ સ્વતંત્ર જૈન ગ્રંથ આ પછી રચાયો હોય એમ જોવા-જાણવામાં નથી. આમ જ હોય તો આ બાબતમાં જૈન સાહિત્ય જેવું જોઈએ તેવું સમૃદ્ધ નથી એમ કહેવું પડે.

નાટ્યદર્પણ (લ. વિ. સં. ૧૨૦૦)- આના કર્તા ‘કલિ.’ હેમચન્દ્રસૂરિના બે શિષ્ય છે : (૧) ‘કવિ-કટારમલ્લ’ સ્વાતંત્ર્યપ્રિય રામચન્દ્રસૂરિ અને (૨) એમના ગુરુભાઈ (સતીર્થ) ગુણચન્દ્રગણિ. આમ P. ૧૮૧ આ કૃતિ તેમજ એની વિવૃત્તિ સટીક દ્રવ્યાલંકારની જેમ દ્વિકર્તૃક છે. આ ત્રૈવિધવેદી રામચન્દ્રસૂરિએ સો પ્રબંધો યાને ગ્રંથો રચ્યા છે. તેમાંના નીચે મુજબના એમના અગિયાર ગ્રંથોનો ઉલ્લેખ તો આ કૃતિના ઉપર્યુક્ત બંને કર્તાના સંયુક્ત પરિશ્રમના પરિપાકરૂપ વિવૃત્તિમાં જોવાય છે :

(૧) કૌમુદીમિત્રાણંદ (પ્રકરણ) પૃ. ૭૦.

(૨) નલવિલાસ (નાટક) પૃ. ૩૧-૩૪, ૪૦, ૪૫, ૫૦, ૫૧, ૬૯, ૭૫, ૭૯, ૧૦૬, ૧૩૫, ૧૪૭, ૧૪૮ અને ૧૫૬.

(૩) નિર્ભય-ભીમ (વ્યાયોગ) પૃ. ૬૮.

(૪) મલ્લિકા-મકરન્દ (પ્રકરણ) પૃ. ૧૭૧.

(૫) યાદવાલ્યુદય (નાટક) પૃ. ૪૨, ૬૩, ૮૪, ૯૪, ૧૦૫, ૧૧૨, ૧૧૩ ને ૧૧૫.

(૬) રઘુવિલાસ (નાટક) પૃ. ૩૬, ૩૭, ૫૭, ૮૦, ૮૨, ૮૫, ૮૦, ૮૨, ૮૪, ૮૭, ૧૦૭, ૧૧૦, ૧૩૬, ૧૪૫ ને ૧૫૬.

૧. શયપ્પસેણાઈજજ નામના ઉવંગ (સુ. ૨૩)ની વૃત્તિ (પત્ર ૫૨ આ)માં મલયગિરિસૂરિએ નાટ્યવિધિપ્રાભૃત (પા. નાડ્યવિહિપાહુડ)નો ઉલ્લેખ કર્યો છે. એ પાહુડમાં નાટ્યશાસ્ત્રને લગતું નિરૂપણ હશે. આ ઉવંગમાં સૂર્યાભદેવે ભજવી બતાવેલાં બત્રીસ નાટકોને અંગે માહિતી અપાઈ છે.

૨. ચાર વિવેક પૂરતો આ ગ્રંથ, એની બે ગ્રંથકારે રચેલી વિવૃત્તિ અને ત્રણ પરિશિષ્ટરૂપે આ વિવૃત્તિમાં (અ) ઉદાહરણરૂપે અપાયેલાં પદ્યોની, (આ) વીસ ગ્રંથકારનાં નામની અને (ઈ) તેસઠ ગ્રંથોનાં નામની સૂચી તેમજ અંગ્રેજી પ્રસ્તાવના સહિત “ગા. પૌ. ગ્રં.”માં ગ્રંથાંક ૪૮ તરીકે ઈ. સ. ૧૯૨૮માં છપાયો છે. શું આ ગ્રંથ અહીં પૂર્ણ થયો નથી કે જેથી એનો પ્રથમ ભાગ તરીકે ઉલ્લેખ છે ? [ટી.સી. ઉપરેતી સંપાદિત નાટ્યદર્પણ પાર્શ્વપ્રકાશન અમદાવાદથી અને આચાર્ય વિશ્વેશ્વરસંપાદિત ‘દિલ્લી વિશ્વવિદ્યાલય’થી ઈ.સ. ૧૯૬૧માં પ્રસિદ્ધ છે.]

૩. ઉદયચન્દ્ર, દેવચન્દ્ર, બાલચન્દ્ર, મહેન્દ્રસૂરિ, યશશ્ચયન્દ્રગણિ અને વર્ધમાનગણિ એ પણ એમના ગુરુભાઈ ગણાય છે, કેમકે એ બધા એક જ ગુરુના શિષ્યો છે.

૪. આ મૂળના તેમજ એની ટીકાના કર્તા પણ આ રામચન્દ્રસૂરિ તેમજ એમના ગુરુભાઈ ગુણચન્દ્રગણિ છે. [દ્રવ્યાલંકાર સટીક મુનિશ્રી જંબૂવિજય ધ્વારા સંપાદિત થઈ એલ. ડી. ઈસ્ટી. અમદાવાદથી પ્રસિદ્ધ થયું છે.]

૫. રઘુવિલાસમાં દ્રવ્યાલંકારને પ્રબંધ કહ્યો છે અને એ ભજવી શકાય નહિ એમ કહ્યું છે. આથી સો પ્રબંધ એટલે સો નાટક એવો અર્થ થઈ શકે નહિ. [દ્રવ્યાલંકારમાં ષડ્ઢવ્યનું દાર્શનિક શૈલિએ પ્રથમવાર નિરૂપણ થયું છે.]

- (૭) રાઘવાભ્યુદય (નાટક) પૃ. ૪૭, ૪૯, ૫૨, ૫૩, ૬૧, ૬૩, ૬૬, ૧૦૨, ૧૦૬ ને ૧૭૦.
 (૮) રોહિણી-મૃગાંક (પ્રકરણ) પૃ. ૬૧ ને ૬૮.
 (૯) વનમાલા (નાટિકા) પૃ. ૧૭૧.
 (૧૦) સત્યહરિશ્ચન્દ્ર (નાટક) પૃ. ૩૦, ૩૬, ૪૨, ૫૪, ૫૮, ૭૧, ૭૮, ૧૩૯, ૧૫૪, ૧૫૭ ને ૧૫૮. P. ૧૮૨
 (૧૧) 'સુધાકલશ (કોશ) પૃ. ૧૪૭, ૧૪૮ ને ૧૬૫.

આ રામચન્દ્રસૂરિની અન્ય સ્વતંત્ર કૃતિઓ તરીકે નીચે મુજબની કૃતિઓ ગણાવાય છે :-

આદિદેવસ્તવ, કુમારવિહારશતક, જિનસ્તોત્રો, નેમિસ્તવ, મુનિસુવ્રતસ્તવ, રઘુવિલાસ, લઘુન્યાસ અને સ્તોત્ર સાધારણ-જિન-સ્તવ.

આ ઉપરાંત નિમ્નલિખિતદ્વાત્રિંશિકાઓને પણ કેટલાક આરામચન્દ્રસૂરિની કૃતિ તરીકે ઓળખાવે છે :-

(૧) પ્રસાદ-દ્વાત્રિંશિકા, (૨) યુગાદિદેવ-દ્વાત્રિંશિકા અને (૩) વ્યતિરેક-દ્વાત્રિંશિકા.

આ પ્રમાણેની વિવિધ કૃતિઓ રચનારા રામચન્દ્રસૂરિનો કાવ્યાદિના ગુણદોષોના પરીક્ષક તરીકે તેમજ સમસ્યા-પૂર્તિની શક્તિ ધરાવનારા તરીકેનો ઉલ્લેખ કેટલીક જૈન કૃતિઓમાં જોવાય છે. પ્ર. ચ. (શૃંગ ૨૨, શ્લોક. ૧૩૯) અને પ્ર. ચિ.માં સિદ્ધરાજ સાથેના એમના સમાગમ પછી એમની એક આંખ ગયાનો ઉલ્લેખ છે. પ્ર. ચિ. અને પ્ર. ચ. (પૃ. ૨૦૧) પ્રમાણે આ બહુશ્રુત સૂરિનાં અપમૃત્યુ માટે અજયપાલ રાજા જવાબદાર છે.

આ રામચન્દ્રસૂરિ સિદ્ધરાજ, કુમારપાલ અને અજયપાલ એ ત્રણેનાં રાજ્ય દરમ્યાન વિદ્યમાન P. ૧૮૩ હતા. એમના ગુરુને આચાર્ય-પદ વિ. સં. ૧૧૬૬માં મળ્યું હતું એ બાબત આ સાથે વિચારતાં એમનો સમય લ. વિ. સં. ૧૧૫૫થી લ. વિ. સં. ૧૨૩૦ સુધીનો ગણાય.

આમ રામચન્દ્રસૂરિનો સંક્ષિપ્ત પરિચય પૂરો થાય છે એટલે ગુણચન્દ્રગણિનો વિચાર કરવો ઘટે છે, પરંતુ એમણે રામચન્દ્રસૂરિના સહયોગપૂર્વક નિમ્નલિખિત કૃતિઓ રચી છે અને એ સિવાય વિશેષ ખાસ કંઈ જાણવામાં નથી :-

(૧) દ્રવ્યાલંકાર, (૨) દ્રવ્યાલંકારની વૃત્તિ, (૩) નાટ્યદર્પણ અને (૪) નાટ્યદર્પણની વિવૃત્તિ.

પરિમાણ અને વિષય-પ્રસ્તુત નાટ્યદર્પણ એ ૨૦૭ પદોની કૃતિ છે. એ ચાર 'વિવેક'માં વિભક્ત છે. એમાં અનુક્રમે ૬૫, ૩૭, ૫૧ અને ૫૪ પદો છે. 'નાટક-નિર્ણય' નામના પ્રથમ વિવેકમાં નાટક સંબંધી સર્વે બાબતોનું નિરૂપણ છે. એના શ્લો. ૩-૪માં નીચે મુજબનાં બાર રૂપકો ગણાવાયાં છે :-

(૧) નાટક, (૨) પ્રકરણ, (૩) નાટિકા, (૪) પ્રકરણી, (૫) વ્યાયોગ, (૬) સમવકાર, (૭) ભાણ, (૮) પ્રહસન, (૯) ડિમ, (૧૦) અંક (૧૧) ઈલામૃગ અને (૧૨) વીથિ.

૧. આમાંથી નાટ્યદર્પણની વિવૃત્તિમાં જે અવતરણો અપાયાં છે એ જોતાં આ પાઈય સુભાષિતોનો કોશ હશે એમ લાગે છે.

૨. ઉપર્યુક્ત રઘુવિલાસમાં આનો ઉલ્લેખ છે.

૩. આનું જ બીજું નામ ષોડશ-ષોડશિકા છે કે એમની એ અન્ય કૃતિ છે ?

૪. આને અંગે કોઈ અવતરણ વિવૃત્તિમાં જણાતું નથી.

આ બારને જિનની વાણીરૂપ (આચાર વગેરે) બાર અંગો જેવાં કહ્યાં છે.^૧ શ્લો. ૩૪માં આરંભ P. ૧૮૪ ઇત્યાદિ પાંચ દશા પાને અવસ્થાનો ઉલ્લેખ છે. શ્લો. ૩૭માં મુખ વગેરે પાંચ સંધિનો નિર્દેશ કરી આગળ ઉપર એ પાંચનાં અનુક્રમે ૧૨, ૧૩, ૧૩, ૧૩ અને ૧૪ અંગો ગણવાયાં છે.

દ્વિતીય વિવેકનું નામ ‘પ્રકરણાદ્યેકાદશ-નિર્ણય’ છે. એમાં પ્રકરણથી માંડીને વીધિ સુધીનાં ૧૧ રૂપકોનું નિરૂપણ છે.

તૃતીય વિવેકનું નામ ‘વૃત્તિ-રસ-ભાવાભિનય-વિચાર’ છે અને તદનુસાર એ ભારતી વગેરે ચાર વૃત્તિ, શૃંગારથી માંડીને શાંત સુધીના નવ રસ, નવ સ્થાયી-ભાવ, તેત્રીસ વ્યભિચારી-ભાવ, રસાદિક આઠ અનુભાવ અને ચાર અભિનય ઉપર પ્રકાશ પાડે છે.

ચતુર્થ વિવેકનું નામ ‘સર્વરૂપક-સાધારણ-લક્ષણ-નિર્ણય’ છે. આ દ્વારા તમામ રૂપકોમાં ઘટી શકે એવાં લક્ષણો અપાયાં છે.

વિકમોર્વશીય નાટકની રંગનાથકૃત ટીકામાં નાટ્યદર્પણના ઉલ્લેખપૂર્વક જે અવતરણ અપાયું છે તે આમાં નથી. આ અવતરણ દ્વારા નાંદીના એક પ્રકારરૂપ ‘પત્રાવલી’નો ઉલ્લેખ કરાયો છે. પ્રસ્તુત નાટ્યદર્પણની રચના એવી સીધીસાદી છે કે એમાં નાંદીના આવા પ્રકારો માટે સ્થાન હોઈ ન શકે. આથી એમ અનુમનાય છે કે ઉપર્યુક્ત નાટ્યદર્પણ આ પ્રસ્તુત નાટ્યદર્પણથી ભિન્ન છે.^૨

ભટ્ટિકાવ્ય (સ. ૧૪, શ્લો. ૩) ઉપરની ભરતમલ્લિકની ટીકામાં પણ નાટ્યદર્પણનો ઉલ્લેખ છે. વળી એમાં ‘કાહલા’ નામના વાદ્ય ઉપર પ્રકાશ પાડનારું અવતરણ છે. એ પ્રસ્તુત નાટ્યદર્પણમાં નથી. એથી એ નાટ્યદર્પણ નાટક ઉપરાંત સંગીતના નિરૂપણનો કોઈ ભિન્ન ગ્રંથ હશે એમ અનુમનાય છે.^૩

P. ૧૮૫ સ્વોપજ વિવૃત્તિ— આમાં અંતમાં નીચે મુજબનાં તેર ઉપરૂપકોનું સ્વરૂપ આલેખાયું છે :-

(૧) સદ્ગત, (૨) શ્રીગહિત, (૩) દુર્મિલિતા, (૪) પ્રસ્થાન, (૫) ગોષ્ઠી, (૬) હલ્લીસક, (૭) નર્તનક, (૮) પ્રેક્ષણક, (૯) રાસક, (૧૦) નાટ્ય-રાસક, (૧૧) કાવ્ય, (૧૨) ભાણક અને (૧૩) ભાણિકા.

આ વિવૃત્તિમાં બાર રૂપકનાં સ્વરૂપ સમજાવવા માટે નાટક વગેરે પંચાવન રૂપકોમાંથી ઉદાહરણ અપાયાં છે. વળી હેતુ, બિન્દુ ઇત્યાદિના નિરૂપણાર્થે નલવિલાસના અંશોનો ઉપયોગ કરાયો છે.

એકવાક્યતા અને ભિન્નતા- ધનંજયના દશરૂપક સાથે કેટલીક બાબતમાં આ વિવૃત્તિ મળતી આવે છે. વળી આ દશરૂપકમાંથી જ અહીં અવતરણો અપાયાં હોય એમ લાગે છે. તેમ છતાં એના કે એના કર્તાના કે એના વૃત્તિકાર ધનિકના નામનો અહીં નિર્દેશ નથી. આ વિવૃત્તિમાં એક બે સ્થળે આ

૧. ધનંજયે દશરૂપકમાં દસ રૂપકોને વિષ્ણુના દસ અવતાર જેવાં કહ્યાં છે.

૨. જુઓ પ્રસ્તુત નાટ્યદર્પણની અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૨).

૩. એજન, પૃ. ૨.

૪. આમાં કેટલીક સ્વરચિત છે. બાલિકા-વંચિતક, માયા-પુષ્પક અને વિધિ-લિખિત એ ત્રણ અજ્ઞાત નાટક છે.

એમાંથી અપાયેલાં અવતરણો ઉપરથી એ કંસ, રામ અને નળને અંગે હોય એમ લાગે છે.

ધનંજયથી ભિન્ન અભિપ્રાય દર્શાવાયો છે. ભરતના નાટ્યશાસ્ત્રમાં પૂર્વાપરવિરોધાત્મક કથન છે એમ પણ અહીં કહેવાયું છે. સદૃક એ બારમું પાઠ્ય છે એટલે કે રૂપક છે એમ ‘કલિ’ હેમચન્દ્રસૂરિએ કાવ્યાનુશાસન (અ. ૮, સૂ. ૩^૧)માં કહ્યું છે. પણ પ્રસ્તુત વિવૃત્તિમાં તો એને ‘ઉપરૂપક’ ગણ્યું છે.

આ ઉપરાંત રસ એ સુખ અને દુઃખ એમ બંને લાગણી ઉત્પન્ન કરે છે એવું આ વિવૃત્તિનું વિધાન P. ૧૮૬ છે. એ ઉપર્યુક્ત કાવ્યાનુશાસન અને કાવ્યપ્રકાશથી ભિન્ન મત દર્શાવે છે.

રસના દોષોના નિરૂપણ પ્રસંગે કાવ્યપ્રકાશ સાથે વિવૃત્તિ મળે છે તો કોઈ કોઈ વાર જુદી પણ પડે છે.

નવમાં ‘શાંત’ રસને શ્રવ્ય કાવ્યમાં જ નહિ પણ નાટકમાં યે સ્થાન છે એમ વિવૃત્તિમાં પ્રતિપાદન કરાયું છે.

[અંજનાપવનંજયનાટકમ્- હસ્તિમલ્લ, હિંદી અનુવાદ ડો. રમેશચન્દ્ર જૈન. પ્ર. ઋષભદેવગ્રંથમાળા સાંગાનેર.]

[કાવ્યાનુશાસન : નિર્ણયસાગરીય આવૃત્તિનું પુનર્મુદ્રણ : પ્રવચનપ્રકાશન પુના]

હસ્તિકુંડી કા ઇતિહાસ— સોહનલાલ પટણી, પ્ર. રાતામહાવીર તીર્થ

સૂરતનો ઇતિહાસ— કેશરીચંદ ઝવેરી.

ગૌતમસ્વામિ મહાગ્રંથ— નંદલાલ દેવલુક, પ્ર. અરિહંત પ્રકાશન

ઉપરિયાળા તીર્થ ઇતિહાસ— જયંતવિજય.

શંખેશ્વરતીર્થ— જયંતવિજય, પ્ર. યશો વિ. ગ્રંથમાળા

રાજનગરના જિનાલયો— સં. જિતેન્દ્ર બી. શાહ, પ્ર. આ. ક. પેઢી

સત્યપુરતીર્થ ઇતિહાસ— પ્ર. જૈન સંઘ સાંચોર, લે. મીશ્રીમલ બોધરા.

રાણકપુર ઇતિહાસ— પ્ર. પ્રાગ્વાટ સંઘ.

કાપરડ કા ઇતિહાસ— પ્ર. કાપરડાતીર્થ સમિતિ

ભોજવ્યાકરણ અને વિદ્વચિન્તામણિ— વિનયસાગર, સવિવરણ અનુવાદ ડૉ. જયદેવ પ્ર. આર્યજયકલ્યાણ કેન્દ્ર.

સાહિત્યશિક્ષામંજરી— (અલંકારવર્ણન) ધુરંધર વિ. પ્ર. જે સાહિત્ય વ. સભા



૧. કાવ્યના પ્રેક્ષ્ય અને શ્રવ્ય એમ બે પ્રકાર પાડી પ્રેક્ષ્યના પાઠ્ય અને ગેય એમ બે ભેદ દર્શાવી પાઠ્યના ઉપભેદો તરીકે આ સૂત્ર નીચે મુજબ યોજાયું છે.

‘‘પાઠ્યં નાટક-પ્રકરણ-નાટિકા-સમવકારેહામૃગ-હિમ-વ્યાયોગ્તેત્સૃષ્ટિતાઙ્ક-પ્રહસન-ભાણ-વીથી-સદ્વકાદિ’’
અહીં અંકને બદલે ઉત્સૃષ્ટિતાંકનો ઉલ્લેખ છે.

પ્રકરણ ૮ : સંગીતશાસ્ત્ર

સંગીત સંબંધી લેખો—સંગીત એ અતિપ્રાચીન કાળની એક વિદ્યા છે—કળા છે અને એ આપણા તેમજ અન્ય દેશોમાં વિકસિત થયેલી છે. એનો સાંસારિક તેમજ ધાર્મિક કાર્યો માટે ઉપયોગ થયો છે અને થાય છે. જૈન તેમજ અજૈન જગતે એનો ભાવભીનો સત્કાર કર્યો છે અને એને અંગે વિવિધ કૃતિઓનું સર્જન કર્યું છે. જૈન આગમો વગેરેમાં સંગીત સંબંધી કેટલાક ઉલ્લેખોની નોંધ મેં “સંગીત અને જૈન સાહિત્ય” નામના મારા લેખમાં લીધી છે. એ છપાયા બાદ, આ પૂર્વે આ સંબંધમાં બે લેખ લખાયાનું મને જાણવા મળ્યું છે :-

(૧) “ભારતીય સંગીતનું ઐતિહાસિક અવલોકન.” આના લેખક અધ્યાપક નારાયણ મોરેશ્વર ખરે છે. એમના આ લેખ (પુ. ૨, અં. ૧, પૃ. ૨૯-૩૫)માં જૈન સંગીત-સાહિત્યની ચર્ચા છે.

(૨) “કુછ જૈન ગ્રંથોમેં સંગીત-ચર્ચા. આના લેખક ડૉ. વી. રાઘવનૂ છે.

‘સંગીત-સમયસાર’ (લ. વિ. સં. ૧૩૫૦)- આના કર્તા અભયચન્દ્રના શિષ્ય મહાદેવાયના P. ૧૮૮ શિષ્ય દિ. પાર્શ્વચન્દ્ર છે. એમણે આ નવ અધિકરણમાં વિભક્ત કરેલી કૃતિમાં ભોજ, સોમેશ્વર અને પરમદર્શિ એ ત્રણ રાજાઓનો ઉલ્લેખ કર્યો છે જ્યારે એમનો (પાર્શ્વચન્દ્રનો) નિર્દેશ સિંગભૂપાલે કર્યો છે. એ જોતાં એઓ ઈ. સ.ની ૧૩મી સદીમાં થઈ ગયેલાનું અનુમાનાય છે. એમણે પ્રસ્તુત કૃતિમાં નાદ, ધ્વનિ સ્થાયી, રાગો, વાદ્ય, અભિનય, તાલ, પ્રસ્તાર અને આધ્વયોગ એમ વિવિધ બાબતો આલેખી છે. આ કૃતિમાં એમણે પ્રતાપ, દિગંબર અને શંકર એ ગ્રંથકારોનો ઉલ્લેખ કર્યો છે.

સંગીતોપનિષદ્ (વિ. સં. ૧૩૮૦) અને સંગીતોપનિષત્સારોદ્ધાર (વિ. સં. ૧૪૦૬)- આ બંનેના કર્તા રાજશેખરસૂરિના શિષ્ય સુધાકલશ છે. એમની વિ. સં. ૧૩૮૦માં રચાયેલી પહેલી કૃતિની કોઈ હાથપોથી હજી સુધી તો મળી આવી નથી પરંતુ વિ. સં. ૧૪૦૬માં પ્રથમ કૃતિના સારરૂપે રચાયેલી બીજી કૃતિની હાથપોથીઓ મળે છે. એવી એકને આધારે ‘દક્ષિણાવિહારી’ અમરવિજયજીના શિષ્ય મુનિશ્રી ચતુરવિજયજીએ એનો ‘પરિચય આપતાં કહ્યું છે કે એમાં છ અધ્યાય છે અને એનાં નામ અને પ્રત્યેકની શ્લોક-સંખ્યા નીચે મુજબ છે :-

૧. આ લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૧૦, અં. ૮)માં છપાયો છે.

૨. આ લેખ “પુરાતત્ત્વ” (પુ. ૧, અં. ૩ અને પુ. ૨, અં. ૧)માં બે કટકે છપાયો છે.

૩. “જૈન સિદ્ધાન્ત ભાસ્કર” (ભા. ૭, અં. ૧)માં આ છપાયો છે.

૪. આ કૃતિ “ત્રિવેન્દ્રમ સંસ્કૃત ગ્રંથમાલા”માં ઈ. સ. માં છપાઈ છે. એનો પરિચય “જૈન સિદ્ધાન્ત ભાસ્કર” (ભા.

૮, અં. ૨ ને ભા. ૧૦, અં. ૧)માં અપાયો છે. [“કુન્દકુન્દભારતી” દીલ્હીથી છપાયું છે. ઈ. સ. ૧૯૭૭]

પ. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૦૮)માં આના નામાંતર તરીકે સંગીત-સારસંગ્રહનો ઉલ્લેખ છે. અહીં એમ કહ્યું

છે કે પાર્શ્વદેવકૃત સંગીતરત્નાકર પણ આ જ કૃતિ હોવાનો સંભવ છે.

૬. જુઓ “આત્માનંદ-શતાબ્દિ-સ્મારક-ગ્રંથ”માં છપાયેલો એમનો લેખ નામે “વાચનાચાર્ય શ્રીસુધાકલશ અને તેની ગુરુપરંપરા” (પૃ. ૩૫).

અધ્યાય	નામ	શ્લોક-સંખ્યા	
૧	ગીત - પ્રકાશન	૯૪	
૨	પ્રસ્તારાદિ - સોપાશ્રય - તાલ - પ્રકાશન	૯૮	
૩	ગુણ - સ્વર - રાગાદિ - પ્રકાશન	૧૨૮	
૪	ચતુર્વિધ - વાદ્ય - પ્રકાશન	૨૯૮	
૫	નૃત્યાંગ - ઉપાંગ - પ્રત્યંગ - પ્રકાશન	૧૪૧	P. ૧૮૯
૬	નૃત્ય - પદ્ધતિ - પ્રકાશન	૧૫૧	

આમ આ કૃતિમાં એકંદરે ૬૧૦^૩ શ્લોકો છે. ઉપર્યુક્ત મુનિશ્રી ચતુરવિજયજીના ‘મતે સંગીત-મકરંદ’ અને સંગીત-પારિજાત કરતાં આ કૃતિ વધારે મહત્વની છે.

પ્રત્યેક અધ્યાયના પ્રારંભમાં ભિન્ન ભિન્ન રીતે મનોરમ પદ્ય દ્વારા જિનેશ્વરની સ્તુતિ કરાઈ છે. અ. ૧નું આદ્ય પદ્ય નીચે મુજબ છે. :-

“આનન્દનિર્ભરપુરન્દરપદ્મજાક્ષી-

નાટ્યક્ષણત્રુટિતહારલતાવિમુક્તૈઃ ।

મુક્તાફલૈઃ કિલ દિવાડપિ વિસર્પિતારા

યદ્દેશનાડવનિરભૂત્સજ્જિનઃશ્રિયેવઃ ॥૧॥”

આ ગ્રંથની પ્રશસ્તિમાં સંગીતોપનિષદ્ વિ. સં. ૧૩૮૦માં રચાયેલો ‘ઉલ્લેખ છે. વળી નરચન્દ્રસૂરિનો ‘સંગીતજ્ઞ’ તરીકે અહીં નિર્દેશ છે.”

વીણા-વાદન- ‘ઉપકેશ’ ગચ્છના દેવગુપ્તસૂરિને વીણા વગાડવાનો ખૂબ શોખ હતો. એ સાધુને શોભે નહિ એમ એમને ઘણી વાર કહેવામાં આવ્યા છતાં એમની આસક્તિ ઓછી ન થઈ ત્યારે એઓ પોતાના પટ્ટધર તરીકે કક્કસૂરિને સ્થાપી ‘લાટ’ દેશમાં ચાલ્યા ગયા.

‘સંગીત-મંડન (લ. વિ. સં. ૧૪૯૦)- આના કર્તા જૈન ગૃહસ્થ મંડન છે. એમણે અલંકાર-મંડન P. ૧૯૦ વગેરે બીજી સાત કૃતિઓ રચી છે. એ આઠેની એક હાથપોથી વિ. સં. ૧૫૦૪માં લખાઈ છે.

સંગીત-દીપક, સંગીત-રત્નાવલી અને ‘સંગીત-સહ-પિંગલ-આ ત્રણ કૃતિઓ જૈ. ગ્રં.માં અનુક્રમે પૃ. ૩૬૩, અને ૩૧૮માં નોંધાયેલી છે. એ ઉપરાંત એ સંબંધમાં વિશેષ માહિતી મળી શકી નથી.

૧-૨. શ્રી. અગરચંદ નાહટા ‘પ્રમાણે ૧૨૭ અને ૯૯ શ્લોક છે.

૩. મૂળ લેખમાં ‘૫૯૦’ છપાયા છે.

૪. જુઓ પૃ. ૧૮૮ના પ્રથમ ટિપ્પણમાં નોંધાયેલો લેખ (પૃ. ૩૫)

૫-૬. જુઓ “જૈ. સ. પ્ર.” (વ. ૧૦, અં. ૯)ગત શ્રી. અગરચંદ નાહટાનો લેખ :-

“સંગીત અને જૈન સાહિત્ય કે વિષયમેં કુછ વિશેષ બાતેં.”

૭. આ કૃતિ પ્રકાશિત કરાઈ હોય એમ જણાતું નથી તો તેમ થવું ઘટે.

૮. જુઓ પૃ. ૮૮.

સંગીત, નૃત્ય અને નાટ્યશાસ્ત્ર સંબંધી જૈન ઉલ્લેખો— આ નામથી ગુજરાતીમાં લિખિત ભાષણ જાહેર વ્યાખ્યાનરૂપે આપવા માટે મને વડોદરાની “College of Indian Music, Dance & Dramatics” તરફથી તા. ૨૬-૧૧-૧૯૪૬ને રોજ આમંત્રણ મળતાં એ ભાષણ તૈયાર કરી એ વિદ્યાલયમાં મેં તા. ૧૩-૧-૧૯૪૭ને રોજ એ ભાષણમાંથી થોડાક મુદ્દા વાંચી સંભળાવ્યા હતા અને કેટલાક મોઢેથી કહ્યા હતા.

[સંગીતનાટ્યરૂપાવલી નામનો ગ્રંથ કળુ. વિદ્યા સારાભાઈ નવાબ દ્વારા સંપાદિત થઈ સારાભાઈ નવાબ દ્વારા અમદાવાદથી ઇ.સ. ૧૯૬૩માં પ્રસિદ્ધ થયેલ છે. આમાં કલ્પસૂત્રની સુવર્ણશરી પ્રતમાંથી સંગીત અને નાટ્ય વિષેના સેંકડો દુર્લભ ચિત્રો અને એનો પરિચય અપાયા છે.]

કાવ્યાનુશાસનનું અલંકારચૂડામણિવૃત્તિ અને વિવેક વ્યાખ્યા સાથે સંપૂર્ણ અધ્યયન— લે. અમૃત એમ. ઉપાધ્યાય. પ્ર. સરસ્વતી પુસ્તક ભંડાર, ઇ. સ. ૧૯૮૪

[“Jain Painting Vol. 1-2, પ્રકા. રાજેન્દ્ર સારાભાઈ નવાબ. આમાં ૭૮૧ રંગીન ચિત્રો છે. ષડાવશ્યક બાલાવબોધ (૧૪૭ ચિત્રો સાથે) પ્રકા. સારાભાઈ નવાબ. વિ. સં. ૨૦૩૩”]

જૈન કાષ્ઠ પટચિત્ર— દક્ષિણ ગુજરાતના જૈન મંદિરોમાં રહેલા પટચિત્રો વિષે સચિત્ર-વિવેચન. (ગુજરાતી અને અંગ્રેજી બે આવૃત્તિઓ) સંશોધન, અનુકૃતિ અને આલેખન ડૉ. વાસુદેવ સ્માર્ત. પ્રકાશક : આ. ઝેંકારસૂરિજ્ઞાનમંદિર ગ્રંથાવલિ. ૨૦ આ. ઝેંકારસૂરિ આરાધના ભવન. સૂરત.

P. Peterson, operation in search of Sanskrit, Mss in the Bombay circle, Vol. I-VI, Bombay 1882-1898 A.D.

C. D. Dalal, A Descriptive catalogue of Manuscripts in the Jain Bhandaras at Pattan, Vol. I, G.O.S. No. Lxxvi, Baroda 1937.

H. R. Kapadia, Descriptive Catalogue of the Government Collections of Manuscripts deposited at the Bhandarkar Oriental Research Institute. Vol. XVII-XIX, Poona 1935-1977.

Muni Punya Vijaya, Catalogue of Palm Leaf, Mss. in the Shanti Natha Jaina Bhandar, Cambay. Vol-I, II, G.O.S. No. 139, 149, Baroda, 1961-1966 A.D.

A. F. Shah, Catalogue of Sanskrit and prakrit, Mss. Muni Shree punya Vijayaji's Collection, Vol, I, II, III, L.D. Series No. 2,6,15, Ahmedabad, 1962, 1965, 1968 A.D.

A. P. Shah, Catalogue of sanskrit and prakrit Mss. Ac. vijayadevasuri and Ac. Ksantisuri's collection, part IV, L. D. Series, No. 20, Ahmedabad, 1968 A.D.

Muni Punya Vijaya, New Catalogue of Sanskrit and Prakrit, Mss : Jesalmer Collection. L. D. Series No. 36, Ahmedabad 1972. A.D.



૧. આ લગભગ સો પાનાંનું ભાષણ અપ્રકાશિત છે.

સામાન્ય રીતે કોઈ જૈન શ્રમણ કામશાસ્ત્રને અંગે સ્વતંત્ર કૃતિ રચે નહિ, કેમકે કામથી વિમુખ બનેલા એઓ અન્યને એનાથી વિમુખ બનવાનો ઉપદેશ આપવામાં કૃતાર્થતા માને એ સ્વાભાવિક છે. કોઈ વ્રતધારી શ્રાવક પણ આ વિષયને ભાગ્યે જ ચર્ચે. તેમ છતાં કોઈકને કોઈક વાર આ વિષય હાથ ધરવાનો પ્રસંગ આવતાં એ આ વિષયને ન્યાય આપે. જિનદત્તસૂરિકૃત વિવેકવિલાસ (ઉલ્લાસ પ, શ્લો. ૧૩૮-૧૮૮)માં, જિનસૂરિકૃત પ્રિયંકરનૃપકથા (પૃ. ૨૪)માં નિર્દેશાયેલી ‘કમલ-શ્રેષ્ઠિ-કથા’માં તેમજ કેટલાંક કાવ્યોમાં અને કાવ્યશાસ્ત્રોમાં કામવિષયક હકીકતો જોવાય છે. આ સંબંધમાં સ્વતંત્ર કૃતિઓ હોય તો તે કઈ કઈ છે તેની તપાસ કરવી બાકી રહે છે.

‘કંદર્પ-ચૂડામણિ’ (વિ. સં. ૧૬૩૩)- જ. સા. સં. ઈ. (પૃ. ૫૮૬) પ્રમાણે વીરભદ્રે વિ. સં. ૧૬૩૩માં ભૈરવ અને કૃષ્ણના સ્મરણપૂર્વક આ કૃતિ રચી છે. એને આ ઇતિહાસના લેખકે ‘જૈન’ રચના ગણી હોય એમ લાગે છે, પણ મને તો એ બાબત શંકા રહે છે. તેમ છતાં એ વિષે હું થોડુંક કહું છું.

આ વીરભદ્ર ‘વાઘેલ’ વંશમાં ઉત્પન્ન થયેલા ક્ષત્રિય છે. એમણે વાત્સ્યાયનકૃત કામસૂત્રના P. ૧૮૨ વિષયોનું નિરૂપણ આપ્યા છંદમાં કર્યું છે. એમણે પ્રસ્તુત કૃતિ સાધારણ, સાંપ્રયોગિક, કન્યા-સંપ્રયુક્તક, ભાર્યાધિકારિક, પારદારિક, વૈશિક અને ઔપનિષદિક એ નામનાં સાત અધિકરણોમાં વિભક્ત કરી છે. આ દરેકના પેટાવિભાગરૂપ ઓછાવત્તા અધ્યાયો છે. બધા મળીને ૩૬ (૫+૧૦+૫+૨+૬+૬+૨) અધ્યાયો છે. પ્રારંભમાં કર્તાએ પોતાનો પરિચય આપ્યો છે. અને કામસૂત્ર રચનારા વિવિધ ગ્રંથકારોનાં નામો ગણાવ્યાં છે.

નિમ્નલિખિત કૃતિઓનાં નામ વિચારતાં એમાં પ્રસ્તુત વિષય ચર્ચાયો હોય તો ના નહિ : -

કામપ્રદીપ- આના કર્તા ગુણાકર છે.

“કોકપ્રકાશસાર- આ અજ્ઞાતકર્તૃક કૃતિની એક હાથપોથી ભાં. પ્રા. સં. મં.માં છે.



૧. મેં સંપાદિત કરેલી આ કૃતિ “દે. લા. જૈ. પુ. સં.” તરફથી “કમલ-શ્રેષ્ઠિ-કથા” વગેરે પાંચ કથારૂપ પરિશિષ્ટ સહિત ઈ. સ. ૧૯૩૨માં પ્રસિદ્ધ કરાઈ છે.
૨. જુઓ ઉપર્યુક્ત ટિપ્પણ.
૩. “નિતાન્તં ગોપનીયમ્” એવા ઉલ્લેખપૂર્વક આ કૃતિ વિ. સં. ૧૯૮૧માં પ્રસિદ્ધ કરાઈ છે. એનું સંશોધન સ્વ. જાદવજી ત્રિકમજી વેદે કર્યું છે અને એ મણિલાલ ઈ. દેશાઈના મુદ્રણાલયમાં છપાઈ છે.
૪. આ કૃતિની આ નામથી નોંધ જિ. ૨. કો.માં નથી.
૫. નર્બદાચાર્યે વિ. સં. ૧૬૫૩માં કોકશાસ્ત્ર-ચોપાઈ રચી છે.

પ્રકરણ ૧૦ : સ્થાપત્ય અને મુદ્રાશાસ્ત્ર

કળાના વિવિધ પ્રકારો છે. એમાંનો એક પ્રકાર તે 'શિલ્પ-કળા' છે. બાંધકામની વિદ્યાને 'શિલ્પ વિદ્યા' અને એનું નિરૂપણ કરનાર ગ્રંથને 'શિલ્પ-શાસ્ત્ર' કહે છે. શિલ્પ-શાસ્ત્રનું બીજું નામ 'સ્થાપત્ય' છે. સ્થાપત્યનો અર્થ ઈમારત, બાંધકામ એમ પણ કરાય છે. પ્રસ્તુતમાં પ્રથમ અર્થ અભિપ્રેત છે. આબુ, રાણકપુર, શત્રુંજય વગેરે જૈન તીર્થસ્થળોમાં આવેલાં ભવ્ય મંદિરો જૈન સ્થાપત્યના ઉત્તમ નમૂના પૂરા પાડે છે.

આ પૈકી પ્રથમ ગ્રંથ જેઈમ્સ ફર્ગ્યુસને રચ્યો છે અને એના બંને ભાગ ઈ. સ. ૧૯૧૦માં પ્રકાશિત થયા છે. બીજો ગ્રંથ ઈ. બી. હાવેલ (Havell)ની રચના છે. એની બીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૨૭માં છપાઈ છે. ફર્ગ્યુસનના ગ્રંથમાં જૈન સ્થાપત્ય વિષે જેટલું લખાણ છે તેના પ્રમાણમાં હાવેલના ગ્રંથમાં બહુ જ થોડું લખાણ છે. પૃ. ૧૯૩ ટિ. ૨ થોડા વખત ઉપર ડૉ. ઉમાકાંત પ્રેમાનંદ શાહનું Studies in Jaina Art નામનું પુસ્તક (પૃ. ૮+૧૬૬) ૩૬ પ્લેઈટમાં ૮૯ ચિત્રો સહિત "જૈન કલ્ચરલ રીસર્ચ સોસાયટી" તરફથી બનારસથી પ્રસિદ્ધ થયું છે ખરું પણ એ મારા જોવામાં આવ્યું નથી.

ધાર્મિક તેમજ નાગરિક એમ ઉભય પ્રકારની શિલ્પકળાની સામગ્રી રાયપ્પસેણઈજજ તેમજ કપ્પનું ભાસ પૂરી પાડે છે. રાય.માં સૂર્યાભદ્રેવે રચાવેલા વિમાનનું ઝીણવટભર્યું વર્ણન છે. એ ઉપરથી એક નવ્ય અને ભવ્ય પ્રાસાદ ઊભો થઈ શકે. વિશેષમાં આ વર્ણન સ્થાપત્યને અંગેના કેટલાક પારિભાષિક શબ્દો પણ પૂરા પાડે છે. વળી સમવસરણને લગતી જે હકીકત આગમિક તેમજ અનાગમિક સાહિત્યમાં મળે છે તે પણ સ્થાપત્યનો વિષય બની શકે તેમ છે. ભિન્ન ભિન્ન પ્રકારનાં નગરોનું તેમજ ગૃહનિર્માણકળા અને P. ૧૯૪ શિલ્પકળાનું વિસ્તૃત વર્ણન જૈન સાહિત્યમાં મળે છે, ડૉ. મોતીચન્દ્રે "જૈનાગમ ઔર સ્થાપત્ય" નામનો એક લેખ લખ્યો છે.

૧. સ્વ. હિમાંશુવિજયે "શિલ્પના બે જૈન ગ્રંથો" નામનો લેખ લખ્યો છે અને એ "બુદ્ધિપ્રકાશ" (પૃ. ૮૭, અં. ૧, પૃ. ૨૨-૨૯)માં છપાયો છે. [પં. કલ્યાણવિજયજી રચિત કલ્યાણકલિકા ભા. ૧માં શિલ્પશાસ્ત્રના અનેક ગ્રંથોનું દોહન છે. આની બીજી આવૃત્તિ પ્રગટ થઈ છે.]

૨. આપણા દેશના સ્થાપત્ય વિષે અંગ્રેજીમાં બે મહત્વના ગ્રંથ છે :-

(અ) History of Indian and Eastern Architecture. (આ) Indian Architecture. આ પૈકી પ્રથમ ગ્રંથ જેઈમ્સ ફર્ગ્યુસને રચ્યો છે અને એના બંને ભાગ ઈ.સ. ૧૯૧૦માં પ્રકાશિત થયા છે. બીજો ગ્રંથ ઈ. બી. હાવેલ (Havell)ની રચના છે. એની બીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૨૭માં છપાઈ છે. ફર્ગ્યુસનના ગ્રંથમાં જૈન સ્થાપત્ય વિષે જેટલું લખાણ છે તેના પ્રમાણમાં હાવેલના ગ્રંથમાં બહુ જ થોડું લખાણ છે. થોડા વખત ઉપર ડૉ. ઉમાકાંત પ્રેમાનંદ શાહનું Studies in Jaina Art નામનું પુસ્તક (પૃ. ૮+૧૬૬) ૩૬ પ્લેઈટમાં ૮૯ ચિત્રો સહિત "જૈન કલ્ચરલ રીસર્ચ સોસાયટી" તરફથી બનારસથી પ્રસિદ્ધ થયું છે ખરું પણ એ મારા જોવામાં આવ્યું નથી.

૩. આ લેખ "જૈ. સિ. ભા." (ભા. ૧૯, કિરણ ૨)માં છપાયો છે.

આ પ્રમાણેની મહામૂલ્ય સામગ્રી હોવા છતાં સ્થાપત્ય સંબંધી જૈન કૃતિઓ આંગળીને વેઢે ગણાય એટલી ઓછી સંખ્યામાં જોવાય છે. 'ઠક્કર ફેરુએ વિ. સં. ૧૩૭૨માં રચેલું વત્થુસારપરણ પાઈયમાં છે. આનો પરિચય મેં પા. ભા. સા. (પૃ. ૧૮૫)માં આપ્યો છે.

શિલ્પ-શાસ્ત્ર— આ નામની એક કૃતિ ભટ્ટારક એકસંધિએ રચી છે એમ જિ. ર. કો. (ખંડ ૧, પૃ. ૩૮૩)માં નોંધ છે, અને એના આધાર તરીકે રાઈસ (Rice) દ્વારા તૈયાર કરાયેલા અને ઈ. સ. ૧૮૮૪માં બેંગલોરથી પ્રસિદ્ધ કરાયેલા A Catalogue of Sanskrit Manuscripts in Mysore and Koorg (પૃ. ૩૧૬)નો ઉલ્લેખ કરાયો છે.

મુદ્રાશાસ્ત્ર—સિક્કાઓનું પણ શાસ્ત્ર છે. એને 'મુદ્રાશાસ્ત્ર' કહે છે. ઉપર્યુક્ત ઠક્કર ફેરુએ ૧૪૯ ગાથામાં કુતુબુદ્દીન તઘલખના રાજ્યમાં વિ. સં. ૧૩૭૫માં ભારતીય સિક્કાઓ વિષે 'દ્રવ્યપરીક્ષા' (દ્રવ્યપરીક્ષા)માં વિચાર કર્યો છે. મુદ્રાશાસ્ત્રની પ્રવેશિકાની ગરજ સારનારી આ કૃતિમાં ૨૦૦ ઉપર સિક્કાઓનું વર્ણન છે. આવી કોઈ સંસ્કૃત કૃતિ કોઈ જૈને રચી છે ખરી ?

[“આણંદજી કલ્યાણજી પેઢી” તથા “શારદાબેન ચી. એ. રી. સેન્ટર” અમદાવાદ દ્વારા તીર્થના પરિચય આપતાં કેટલાંક પુસ્તકો બહાર પડ્યા છે. એમાં તે તે તીર્થના જિનાલયોની શિલ્પસમૃદ્ધિ દર્શાવતાં ચિત્રો (ફોટોગ્રાફ્સ) છપાયાં છે.]

[નાકોડા પાર્શ્વનાથ તીર્થ— સંપા. વિનયસાગર, “આરાસણ અપરનામ કુંભરિયાજી તીર્થ” લે. મુનિ વિશાલવિજય. પ્રકા. યશોવિજય ગ્રંથમાળા.]

[“Osiaji Mahavir Temple” By Rabindra Vasavada પ્રકા. લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિર. અમદાવાદ.]

Vidhatri vora, Catalogue of Gujarati, Mss in the Muniraj ShreePunya vijayaji's collection. L. D. series No. 71. Ahmedabad-1978. A. D.

Catalogue of Palm-Leaf, Mss in the shanti Natha Jaina Bhandar-cambay, Part I, II, Ed. Muni shree punya vijayaji, G.O.S. NO. 139, 149, Baroda 1962-66 A.D.

Catalogue of Sanskrit and prakrit, Mss : Muni Shree punya Vijayaji's collection, part-I-III Acarya vijayadeva Suris and Acarya Khantisurie's collection, part IV, Ed- A. P. Shah, Ahmedabad 1963-68 A.D.



૧. એમના વિષેનો તેમજ એમની કૃતિઓ વિષેનો એક લેખ નામે “દ્રવ્યપરીક્ષા” મુનિશ્રી કાંતિસાગરજીએ લખ્યો છે અને એ “વિશાલભારત” (ભાગ ૩૯, અંક ૧, પૃ. ૧૧-૧૪)માં છપાયો છે. ‘ધંધકળશ’ કુળના ચન્દ્ર એ ઠક્કર ફેરુના પિતા થાય અને ચંદા એમની માતા થાય.
૨. આના પરિચય માટે જુઓ ઉપર્યુક્ત લેખ તેમજ “જૈ. સ. પ્ર.” (વ. ૨૧, અં. ૪, ૫, અને ૮)માં એ જ મુનિનો ત્રણ કટકે છપાયેલો લેખ નામે “ઠક્કર ફેરુરચિત મુદ્રાશાસ્ત્રનો અદ્વિતીય જૈન ગ્રંથ.”

ગણિતશાસ્ત્રનો વિષય ઘણાખરા જનોને મન માથાકૂટિયો, અટપટિયો અને કંટાળાભરેલો છે, પરંતુ મારા જેવાને તો એ સદાયે અતિશય રસિક અને આનંદજનક જણાયો છે અને એથી તો આજે ઉત્તરાવસ્થામાં પણ અનુસ્નાતકથી પણ ઉચ્ચ કોટિના અભ્યાસીઓની કક્ષાની ગણિતશાસ્ત્રને અંગેની વિવિધ વિગતો વાંચવાવિચારવા હું ઉત્સુક રહું છું. ગણિતશાસ્ત્રની એક શાખારૂપ અંકગણિત તો સામાન્ય જનતાને પણ ઉપયોગી છે, જ્યારે બીજાગણિત યાને અક્ષરગણિત 'વગેરે શાખાઓ તો ખાસ કરીને વૈજ્ઞાનિક શોધકોના કામની છે. વળી આ શાસ્ત્રના અધ્યયનનો માર્ગ કેવળ વિનયન (Arts) ના જ કે વિજ્ઞાન (Science)ના જ કે વાણિજ્યના જ વિદ્યાર્થીઓ માટે મોકળો ન રાખતાં જ્ઞાનની અન્ય શાખાઓના અભ્યાસીઓ માટે પણ ઓછેવત્તે અંશે તેમ કરવાનું સ્તુત્ય પગલું વિશ્વવિદ્યાલયોએ ભર્યું છે. આથી તો ગણિતશાસ્ત્રની સાથે એક રીતે સરખું મહત્ત્વ ધરાવનારા તત્ત્વજ્ઞાનના ક્ષેત્ર કરતાં યે ગણિતશાસ્ત્રનું ક્ષેત્ર વધારે વ્યાપક છે. જૈન દર્શનમાં ગણિતશાસ્ત્રને ગૌરવશાળી સ્થાન અપાયું છે એમ પુણ્યોમાંની ગમ અને ભંગ (વિકલ્પો)ની પ્રચુરતા સંબંધી જૈન પરંપરા અને સાંખ્યાનું નિરૂપણ વિચારતાં તેમજ કર્મસિદ્ધાન્તને લગતી ઝીણવટભરી બાબતોને ધ્યાનમાં લેતાં સહેજે ફલિત થાય છે. આજે પુણ્ય તો નથી પરંતુ કર્મસિદ્ધાન્ત P. ૧૮૬ રજૂ કરનારા વિશિષ્ટ ગ્રંથો છે એટલે એ તેમજ કાળ અને ક્ષેત્રનાં પરિમાણ વિષે જે પ્રરૂપણ છે તે સમજવા માટે ગણિતશાસ્ત્રના જ્ઞાનની આવશ્યકતા રહે છે. આવી પરિસ્થિતિ હોવા છતાં કોણ જાણે કેમ ગણિતશાસ્ત્રના સ્વતંત્ર અને એની કોઈ એક શાખા પૂરતા યે સર્વાંગીણ ગણાય તેવા ગ્રંથો બહુ જ થોડા પ્રમાણમાં હજી સુધી તો મળી આવ્યા છે. વત્યુસારપચરણ, દવ્યપરિક્ષા વગેરે રચનારા ઠક્કર ફેરુએ 'ગણિતસારકૌમુદી' (ગણિતસારકૌમુદી) રચી છે. એ પદ્યાત્મક કૃતિ પાંચ ઉદ્દેશમાં વિભક્ત છે.

‘ગણિતસારસંગ્રહ (લ. વિ. સં. ૮૦૦)- આના કર્તા દિ. મહાવીરાચાર્ય છે.

ગણિતશાસ્ત્ર અને ગણિતસૂત્ર (લ. વિ. સં. ૮૦૦)- આ ગણિતને અંગેના બંને ગ્રંથના કર્તા ‘ગણિતસારસંગ્રહ રચનારા દિ. મહાવીરાચાર્ય છે એમ કે. પ્ર. ચૂ.ની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૬) જોતાં જણાય છે. વળી ‘ગણિતસાર પણ એમની કૃતિ છે અને એમાં ગુણોત્તર શ્રેણીના સિદ્ધાન્તોનું વિસ્તૃત

૧. વગેરેથી સમતલ ભૂમિતિ, ધન ભૂમિતિ, સમતલ ત્રિકોણમિતિ, ગોલીય ત્રિકોણમિતિ, સમતલ બીજભૂમિતિ (Plane analytical geometry), ધન બીજભૂમિતિ, શૂન્ય-લઘ્વિ જ્ઞાને સૂક્ષ્મકલન, શૂન્યયુતિ યાને સમાસકલન અને શૂન્ય-સમીકરણ ઉપરાંત સ્થિતિ-શાસ્ત્ર, ગતિ-શાસ્ત્ર, ઉદય-સ્થિતિશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર જેવી શાખાઓ અત્ર અભિપ્રેત છે.
૨. આનો સંક્ષિપ્ત પરિચય મુનિશ્રી કાંતિસાગરજીએ “ઠક્કર ફેરુચરિત ‘ગણિતસાર-કૌમુદી’ એ અદ્વિતીય ગ્રંથ” નામના લેખમાં આપ્યો છે. આ લેખ “જૈ. સ. પ્ર” (વર્ષ ૨૧, અં. ૩, પૃ. ૫૮-૬૪)માં છપાવાયો છે.
૩. આ કૃતિ પ્રા. એમ. રંગાચાર્યનાં અંગ્રેજી અનુવાદ અને ટિપ્પણ સહિત મદ્રાસ સરકારની આજ્ઞાથી ઈ. સ. ૧૯૧૨માં પ્રકાશિત થઈ છે. અંતમાં ત્રણ પરિશિષ્ટ છે. પ્રથમ પરિશિષ્ટ ભરીકે સંસ્કૃત શબ્દો અને એ દ્વારા દર્શાવાતા અંક, દ્વિતીય પરિશિષ્ટ તરીકે અંગ્રેજી અનુવાદગત સંસ્કૃત શબ્દો અને એની સમજણ અને તૃતીય પરિશિષ્ટ તરીકે દાખલાઓના જવાબ અપાયાં છે.
૪. આનો કેટલોક પરિચય કેવલજ્ઞાનપ્રશ્નચૂડામણિની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૫-૧૦)માં અપાયો છે.
૫. આ નામની મહાવીરાચાર્યે સંસ્કૃતમાં રચેલી કૃતિની ‘કન્નડ’ લિપિમાં લખાયેલી વિવિધ હાથપોથીઓની નોંધ ક. તા. (પૃ. ૧૬૮-૧૬૯)માં છે.

નિરૂપણ છે એમ કે. પ્ર. ચૂની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૫)માં ઉલ્લેખ છે. તો શું એ ગણિતસાર ઉપર્યુક્ત કૃતિઓથી ભિન્ન છે ? બ્રહ્મગુપ્ત 'બ્રાહ્મસ્ફુટસિદ્ધાંત' સાથે પ્રસ્તુત કૃતિ સરખાવતાં એમ લાગે છે કે આ મહાવીરાચાર્ય આથી પરિચિત હતા, એમણે ગણિતસારસંગ્રહમાં એક સ્થળે 'શ્રીધરનો ઉલ્લેખ કર્યો છે.'^૧ વિશેષમાં એમણે શ્લો. ૩માં અમોઘવર્ષનો અને શ્લો. ૮માં એમનો 'નૃપતુંગ' તરીકે નામોલ્લેખ કર્યો છે અને શ્લો. ૬માં આ રાજાને 'ચક્રિકાભંજન' કહ્યા છે. આ 'રાષ્ટ્રકૂટ' વંશના રાજાનો સમય ઇ.સ. ૮૧૪ P. ૧૯૭ કે ૮૧૫થી ઇ.સ. ૮૭૭ કે ૮૭૮ ગણાય છે. આ હિસાબે આ કૃતિ ઇ. સ. ૮૫૦ની લગભગની ગણાય. આ પદ્માત્મક કૃતિના પ્રારંભમાં જૈનોના ચરમ તીર્થંકર મહાવીરસ્વામીને વંદન કરી ઉપર્યુક્ત રાજાની તારીફ કરી ગણિતની પ્રશંસા કરાઈ છે. ત્યાર બાદ સંજ્ઞાઓ ધાને 'ક્ષેત્રાદિકની પરિભાષાઓ સમજાવાઈ છે. પછી નીચે મુજબના આઠ વ્યવહારોનું નિરૂપણ છે :-

(૧) પરિકર્મ, (૨) કલાસવર્ણ, (૩) પ્રકીર્ણક, (૪) ત્રૈરાશિક, (૫) મિશ્રક, (૬) ક્ષેત્રગણિત, (૭) ખાત અને (૮) છાયા.

મિશ્રક વ્યવહારમાં વ્યાજને અંગેની રીતો (rules)ની અને એના 'દાખલાની સંખ્યા' 'આર્યભટ્ટીય' કરતાં વણી વધારે છે.

સંપ્રદાય— આ કૃતિના કર્તા જૈન છે એમ જિનેશ્વરની પુષ્પ-પૂજા (પૃ. ૮), ફલ-પૂજા (પૃ. ૩૪), દીપ-પૂજા (પૃ. ૪૦), ગંધ-પૂજા (પૃ. ૪૨), ધૂપ-પૂજા (પૃ. ૪૨) ઇત્યાદિને લગતાં ઉદાહરણો ઉપરથી તેમજ પૃ. ૫૨ માંના બાર પ્રકારના તપ અને બાર અંગ (દ્વાદશાંગી)ના ઉલ્લેખ ઉપરથી તથા આકાશચારી મુનિ (પૃ ૧૩૮)ને લગતા ઉલ્લેખ ઉપરથી પણ જાણી શકાય છે.

સ્ખલન— કોઈ સંખ્યાને શૂન્યથી ભાગે તો તે અવિકારી રહે છે— તેવી ને તેવી જ રહે છે એવો P. ૧૯૮ જે ઉલ્લેખ પૃ. ૬માં શ્લો. ૪૮માં કરાયો છે તે બ્રાન્ત છે. બ્રહ્મગુપ્તે તો આવી ભૂલ કરી નથી.^૨

સત્કાર— દક્ષિણ ભારતમાં ગણિતસારસંગ્રહને સારો આવકાર મળ્યો હોય એમ લાગે છે કેમકે ઇ. સ.ની અગિયારમી સદીમાં તો પાવુલૂરિ મલ્લને એનો 'તેલુગુ' ભાષામાં પદ્યમાં અનુવાદ કર્યો હતો.

ટીકાઓ— વરદરાજે તેમજ અન્ય કોઈએ ગણિતસારસંગ્રહ ઉપર સંસ્કૃતમાં એકેક ટીકા રચી છે.

કાનડી અને તેલુગુ ટીકા— વલ્લભ નામની કોઈક વ્યક્તિએ ગણિતસારસંગ્રહ ઉપર કાનડી ભાષામાં તેમજ તેલુગુમાં એકેક ટીકા રચી છે.

૧. આના ટીકાકાર પૃથુદક્ષ્વામી (ઈ. સ. ૮૬૦) અને આ મહાવીરાચાર્ય વચ્ચે વિશેષ અંતર નહિ હશે એમ પ્રા. રંગચાર્યે કહ્યું છે.

૨. આ શ્રીધર તે ત્રિશતિકા (ઈ.સ. ૭૫૦)ના કર્તા છે.

૩. જુઓ જિ. ર. કો. (ખંડ ૧, પૃ. ૧૦૩).

૪. અહીં ૨૪ અંકસ્થાનો ગણાવાયાં છે. છેલ્લાનું નામ 'મહાશોભ' અપાયું છે.

૫. History of Hindu Mathematics (ખંડ ૧, પૃ. ૨૨૩-૨૨૬)માં તેર દાખલા અપાયા છે.

૬. આ આર્યભટ પહેલા (ઈ. સ. ૪૯૯)ની કૃતિ છે.

૭. આ પૃષ્ઠગત શ્લો. ૪૫માં 'સમુદાય' એ અર્થમાં "યતિસમિતિ:" દ્વારા 'સમિતિ' શબ્દ વપરાયો છે.

૮. જુઓ HHM (ખંડ ૧, પૃ. ૨૪૧).

ડૉ. દત્તના લેખ— ડૉ. બિભૂતિભૂષણ દત્તે જૈન ગણિતને અંગે નીચે મુજબના ત્રણ લેખ લખ્યા છે :-

- (1) 'The Jaina School of Mathematic.
- (2) 'On Mahavira's Solution of Rational Triangles and Quadrilaterals.
- (3) 'Geometry in the Jaina Cosmography.

P. ૧૯૯

ગણિતસંગ્રહ— આના કર્તા યલ્લાચાર્ય છે. શું એઓ જૈન છે અને એમની આ કૃતિ સંસ્કૃત છે ?

ગણિતશાસ્ત્ર (વિક્રમની ૧૧૧મી સદી)— આના કર્તા શ્રીધરાચાર્ય છે.

પાટીગણિત (લ. વિ. સં. ૧૨૫૦) - આના કર્તા 'જૈન ગૃહસ્થ અનંતપાલ છે. એઓ 'પલ્લીવાલ' કુળના અને નેમિચરિત નામનું મહાકાવ્ય રચનારા આમન કવિના ચાર પુત્રો પૈકી પ્રથમ છે. આ અનંતપાલના ધનપાલ નામના ભાઈએ તિલકમંજરીકથાસાર વિ. સં. ૧૨૬૧માં રચ્યો છે. પાટીગણિત એ નામ વિચારતાં એમ લાગે છે કે એમાં અંકગણિતનો વિષય વિચારાયો હશે.

ગણિયસાર (લ. વિ. સં. ૧૩૭૦)-આના કર્તા ઠક્કર ફેરુ છે. એમણે વિ. સં. ૧૩૪૭માં યુગપ્રધાનચોપાઈ રચી છે અને વિ. સં. ૧૩૭૨માં વત્યુસારપયરણ અને જ્યોતિઃસાર અને વિ. સં. ૧૩૭૫માં દલ્પરિક્ષ્મા રચ્યાં છે. આથી પ્રસ્તુત ગ્રંથ લ. વિ. સં. ૧૩૭૦માં રચાયો હશે એમ લાગે છે. એ ગમે તે હો પણ આ ગ્રંથ પ્રાકૃતમાં છે.

તિલક— આ ગણિતને લગતા ગ્રંથના કર્તા સિંહતિલકસૂરિ છે એમ કે. પ્ર. ચૂની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૬)માં ઉલ્લેખ છે તે ખરો છે ?

સિદ્ધ-ભૂ-પદ્ધતિની ટીકા (લ. વિ. સં. ૮૭૫)- આના કર્તા દિ. વીરસેન આચાર્ય છે. એઓ 'પંચસ્તૂપ' અન્વયના દિ. આર્યનન્દિના શિષ્ય અને ચન્દ્રસેનના પ્રશિષ્ય થાય છે. આ વીરસેન જિનસેન (પહેલા)ના ગુરુ થાય છે^૧ અને ઉત્તરપુરાણ રચનારા ગુણભદ્રના પ્રગુરુ થાય છે.^૨ એ વીરસેને છખંડાગમ

૧. આ લેખ Bulletin of the Calcutta Mathematical Society (Vol. XXI, No. 2, 1929)માં છપાયો છે.
૨. આ લેખ Bul. of the Cal. Math Society (Vol. XX, 1928-29)માં પ્રકાશિત થયેલો છે.
૩. આ લેખની મુદ્રિત નકલ મારા જોવામાં આવી નથી; બાકી એની હાથે લખેલી નકલ તો મને એના લેખક મહાશય તરફથી મળી હતી.
૪. આ સદીમાં પાઈયમાં એક ગણિતનો ગ્રંથ રચાયો છે અને એમાં મિશ્રિત પ્રશ્નનો ઉત્તર શ્રેણિવ્યવહાર અને કુટ્ટકની રીતિથી અપાયો છે.
૫. જિનવિજયજ્ઞના મતે આ દિ. છે (જુઓ જૈ. સા. ઈ.નું પૃ. ૪૭૧). જો એમ જ હોય તો તિલકમંજરીના કર્તા શ્વેતાંબર ધનપાલને આ અનંતપાલના ભાઈ ધનપાલે નમન કર્યું છે તે એમની મતસહિષ્ણુતા-ઉદારતા સૂચવે છે. આવા બીજા ઉદાહરણરૂપ પં. વાદિરાજ છે, કેમકે એમણે શ્વેતાંબરીય વાગ્ભટાલંકાર ઉપર ટીકા રચી છે. જુઓ પૃ. ૭૨.
૬. આ અન્વય આગળ જતાં 'સેનાન્વય' યા 'સેન-સંઘ' તરીકે પ્રસિદ્ધ થયો.
૭. એમના અન્ય શિષ્યો વગેરેના નામ માટે જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૫૦૧).
૮. આ વીરસેન, જિનસેન પહેલા અને ગુણભદ્ર એ ત્રણ વિદ્વાનો દિ. સાહિત્યક્ષેત્રના ત્રણ તેજસ્વી તારાઓ છે. એ ત્રિપુટી તે જાણે 'ભરણી' નક્ષત્ર છે.

પૈકી પહેલા પાંચ ખંડની ટીકા નામે **ધવલા શકસંવત્ ૭૩૮**માં પૂરી કરી છે. એમાં ચર્ચાયેલો ગણિતનો P. ૨૦૦ વિષય જોતાં એઓ ગણિતજ્ઞ હતા એમ કહી શકાય. એમણે **કસાયપાહુડ** ઉપર જયધવલા નામની ટીકા રચવા માંડી હતી પરંતુ વીસ હજાર શ્લોક જેટલો ભાગ રચાતાં એમનો સ્વર્ગવાસ થયો. એમનો જન્મ શકસંવત્ ૬૬૦ની આસપાસમાં અને સ્વર્ગવાસ શકસંવત્ ૭૪૫ની આસપાસમાં થયાનું અનુમાનાય છે.^૧

ઉત્તરપુરાણની પ્રશસ્તિમાં દિ. ગુણભદ્રે પોતાના દાદાગુરુ દિ. વીરસેન માટે એવો ઉલ્લેખ કર્યો છે કે સિદ્ધ-ભૂ-પદ્ધતિનાં પદે પદ વિષમ અર્થાત્ કઠણ હતાં. પરંતુ આ વીરસેને એની એવી ટીકા રચી છે કે એ જોઈને ભિક્ષુઓને એ ગ્રંથ સમજવો સુગમ થઈ પડ્યો છે. આ મૂળ ગ્રંથ ક્ષેત્રગણિત (geometry)નો હશે એમ અનુમાનાય છે.^૨

ક્ષેત્રગણિત— આના કર્તા નેમિચન્દ્ર છે.^૩

અહીં એ ઉમેરીશ કે ક્ષેત્રગણિતને અંગે છ *કરણો વાયકવર્ય ઉમાસ્વાતિએ ત. સૂ. (અ. ૩, સૂ. ૧૧)ના સ્વોપજ્ઞ ભાષ્ય (પૃ. ૨૫૮)માં આપ્યાં છે.

બૈજિક યાને વ્યચ્છેદક રેખાગણિત— આના કર્તા શ્રીધરાચાર્ય છે અને એમાં એમણે સરળ રેખા, વૃત્ત, રૈખિક ક્ષેત્ર, નલાકૃતિ, મોચાકૃતિ, વર્તુલાકૃતિ ઇત્યાદિ વિષયોનું નિરૂપણ કર્યું છે.^૪

Aspects of Jain Art. U. P. Shah

More documents of Jain Paintings U. P. Shah. પ્ર. લા. દ. વિદ્યા મંદિર.

Trislers of Jain Bhandar U. P. Shah, પ્ર. લા. દ. વિદ્યા મંદિર.

Sallekhana is not suside.

Early Jainism K. K. Dixit.

વર્ધમાન મહાવીર જીવનદર્શન ચિત્રોમાં આ. યશોદેવસૂરિ. પ્ર. જૈન સાહિત્યમંદિર જૈન સમ્રાટ સંપ્રતિ, લે. ત્રિભુવનદાસ, પ્ર. શશિકાન્ત એન્ડ કું. વડોદરા.

કર્પૂરમંજરી : રાજશેખર : સંસ્કૃત-હિંદી સાથે ગંગાસાગરરાય.

અમરુશતક : અમરુક વ્યા. અર્જુનમિશ્ર.

ભૈરવપદ્માવતીકલ્પ : મલ્લિષેણસૂરિ સંસ્કૃત વિવરણ અને શુકદેવ ચતુર્વેદી હિન્દી વ્યાખ્યા.



૧. જુઓ જૈ. સા. ઇ. (પૃ. ૫૧૨).

૨. એજન (પૃ. ૫૦૩).

૩. જુઓ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૯૮).

૪. જુઓ કે. પ્ર. ચૂ.ની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૭)

૫. આ કરણો જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે સમયખેત્તસમાસમાં પાઈયમાં પદ્યરૂપે રજૂ કર્યાં છે અને એના ઉપર કોઈકે પાઈયમાં ચુણ્ણિ રચી છે અને એ હાલમાં છપાય છે. મેં ઉપર્યુક્ત છ કરણો (formula) અંગ્રેજીમાં ત. સૂ. (દ્વિતીય વિભાગ)ના મારા અંગ્રેજી ઉપોદ્ધાત (પૃ. ૪૧)માં આપ્યાં છે.

પ્રકરણ ૧૨ : નિમિત્ત-શાસ્ત્ર

નિમિત્તશાસ્ત્રની વ્યાપકતા- ‘નિમિત્ત’ એટલે દેશાન્તરિત અને કાલાન્તરિત ભવિષ્યના બનાવને જણાવનારું ચિહ્ન. એ નિમિત્ત પર પ્રકાશ પાડનારું શાસ્ત્ર તે ‘નિમિત્ત-શાસ્ત્ર’ (Science of Divination) કહેવાય છે. આ વ્યાખ્યા પ્રમાણે જ્યોતિષનો નિમિત્તમાં અંતર્ભાવ થાય છે.^૧

વિસેસા. (ગા. ૨૧૬૩)માં નિમિત્તનું લક્ષણ વગેરે હકીકત અપાઈ છે. ત્યાં કહ્યું છે કે જેના વડે શુભ અને અશુભ જાણી શકાય તે ‘નિમિત્ત’ છે. આ નિમિત્તના આઠ પ્રકાર છે અને એથી તો “અષ્ટાંગ નિમિત્ત” એવો પ્રયોગ જોવાય છે. ઉપા. મેઘવિજયે હસ્તસંજીવનની સ્વોપજ્ઞ વિવૃત્તિમાં નીચે મુજબના આઠ નિમિત્તોનો ઉલ્લેખ કરી એની આછી રૂપરેખા આલેખી છે. અને એ નિમિત્તોનો બોધ કરાવનાર સાહિત્યનો નિર્દેશ કર્યો છે અને પહેલાં સાત નિમિત્તોને લગતા જ્ઞાનનો વર્તમાનમાં (પોતાના સમયમાં) દ્રાસ થયો છે એમ કહ્યું છે.^૨ :-

(૧) અંગ, (૨) સ્વપ્ન, (૩) સ્વર, (૪) ભૌમ, (૫) વ્યંજન, (૬) લક્ષણ, (૭) ઉત્પાત અને (૮) અંતરિક્ષ.

P. ૨૦૨

અન્યત્ર ઉત્પાતને બદલે ‘દિવ્ય’નો ઉલ્લેખ જોવાય છે. એને લક્ષ્યમાં રાખી હું આઠ નિમિત્તો ગણાવું છું અને સાથે સાથે એનો સંક્ષેપમાં અર્થ સૂચવું છું :-

- (૧) ભૌમ— ધરતીકંપ વગેરે પૃથ્વી સંબંધી.
- (૨) સ્વપ્ન— નિદ્રામાં ભાસતો દેખાવ, સપનાં,
- (૩) અંતરિક્ષ— આકાશમાં ફરતા ગ્રહોનાં અન્ય રાશિમાં ગમન, ઉદય, અસ્ત વગેરે.
- (૪) દિવ્ય— ઉલ્કાપાત, ગંધર્વનગર વગેરેનું દર્શન.
- (૫) આંગ— શારીરિક રચના વગેરે.
- (૬) સ્વર— કોમળ, કઠોર, ગંભીર ઇત્યાદિ સ્વર અથવા કોસલાગમાદિ પ્રતિપાદિત સ્વરવિદ્યા.
- (૭) લક્ષણ— શ્રીવત્સ વગેરે શારીરિક લક્ષણો.
- (૮) વ્યંજન— તલ, મસા, વગેરે શારીરિક ચિહ્ન.

કેટલીક વાર નિમિત્તના નીચે મુજબ છ પ્રકાર પણ ગણાવાય છે :-

- (૧) સુખ, (૨) દુઃખ, (૩) લાભ, (૪) હાનિ, (૫) જીવિત અને (૬) મરણ.

૧. આ સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૬૭).

૨. “અષ્ટાંગ નિમિત્ત અથવા ત્રિસ્કંધ જ્યોતિષશાસ્ત્ર એ એક જ વિદ્યાના બોધક શબ્દો છે.” એમ “જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથો”ના આમુખ (પૃ. ૪૭)માં કહ્યું છે. અહીં એવો પણ ઉલ્લેખ છે કે ત્રિસ્કંધમાં પહેલો સ્કંધ ગણિતનો છે અને એને જ્યોતિષની પરિભાષામાં ‘સિદ્ધાંત’ કહે છે.

૩. એમણેનારદકૃતઅંગવિદ્યાનો અને મહેશ્વરકૃતસ્વરોદયનો (આને જ કેટલાકશિવસ્વરોદય કહે છે) ઉલ્લેખ કર્યો છે.

૪. સ્વર-શાસ્ત્રને યાને સ્વરોદય-શાસ્ત્રને સામાન્ય જનતા ‘સરોદો’ કહે છે.

પ્રશ્નપ્રકાશ (લ. વિ. સં. ૧૭૫)– પ્ર. ચ. (શૃંગ ૫, શ્લો. ૩૪૭) પ્રમાણે આના કર્તા પાદલિપ્તસૂરિ છે. આગમોની યુષ્ણિઓ જોતાં એમ જણાય છે કે એમણે કાલજ્ઞાન નામનો ગ્રંથ રચ્યો હતો. “ગાહાજુઅલેખ”^૧ થી શરૂ થતો ‘વીરથય (વીર-સ્તવ) એમણે રચ્યો છે અને એમાં સુવર્ણસિદ્ધિ અને P. ૨૦૩ ઓમસિદ્ધિની (એટલે કે આકાશગામિની વિદ્યાની) હકીકત ગુપ્ત રીતે આપી છે.^૨ એમની સુપ્રસિદ્ધ અને કૌતુકપ્રિય કૃતિ તે તરંગવર્ધ છે. ^૩અણુઓગદાર વગેરેમાં એ નોંધાયેલી છે. એમાં ભારોભાર દેસિય (દેશ્ય) શબ્દો હતા.^૪ આ સૂરિએ ‘નિર્વાણકલિકા અને જોઈસ-કરંડગની ટીકા રચી છે. જિનપ્રભસૂરિના કથન પ્રમાણે આ પાદલિપ્તસૂરિએ શત્રુંજય-કલ્પ અને રેવંતગિરિ-કલ્પ પણ રચ્યા છે.^૫ વળી ‘ગાહાસત્તસંઈની કેટલીક ગાથા પણ આ સૂરિએ રચી હોય એમ લાગે છે.

આ સૂરિ ‘સંગમસિંહના શિષ્ય વાયનાયાર્ય મંડનગણિના શિષ્ય થાય છે અને ‘સ્કંદિલાયાર્યના P. ૨૦૪ ગુરુ થાય છે. કપ્પની યુષ્ણિમાં પાદલિપ્તસૂરિને ‘વાયક’ કહ્યા છે. હરિભદ્રસૂરિએ આવસ્સયની નિજજુતિ (ગા. ૯૪૪)ની ટીકા (પત્ર ૪૨૪આ)માં ‘વૈનયિકી’ બુદ્ધિનું ઉદાહરણ આપતાં આ પાદલિપ્તસૂરિનો ઉલ્લેખ કર્યો છે.

પ્ર. ચ. (શૃંગ ૫, શ્લો. ૫-૭ અને ૨૯) પ્રમાણે પાદલિપ્તસૂરિનો જન્મ અયોધ્યાના રાજા વિજયવ્રજની નગરીમાં વસનારા કુલ્લ શ્રેષ્ઠીની પ્રતિમા નામની સ્ત્રીને પેટે થયો હતો અને એમનું નામ નાગેન્દ્ર પડાયું હતું. આઠ વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી હતી. અને દસ વર્ષની નાની વયમાં એઓ આચાર્ય બન્યા હતા. આ સૂરિ ‘મથુરા’ થઈ ‘પાટલીપુત્ર’ ગયા હતા. અંતસમયે ‘શત્રુંજય’ ઉપર ૩૨ દિવસનું અનશન કરી એઓ સ્વર્ગે સિધાવ્યા હતા. એ પૂર્વે એઓ ‘ભરૂચ’ આવ્યા હતા. હાલ, પાટલિપુત્રનો રાજા મુરુંડ વગેરે આ સૂરિના સમકાલીન ગણાય છે.

૧. આ ચ. પ્ર. (પૃ. ૨૬૫-૨૬૬)માં ‘ધ-પરિશિષ્ટ’ તરીકે સંસ્કૃત છાયા સહિત છપાવાયો છે. આની સુવર્ણસિદ્ધિ પૂરતી વ્યાખ્યા પૂરી પાડતી અને જિનપ્રભસૂરિએ વિ. સ. ૧૩૮૦માં રચેલી વૃત્તિના સંક્ષેપરૂપ અવચૂરિ ચ. પ્ર.ના મારા ગુજરાતી અનુવાદમાં પ્રથમ પરિશિષ્ટ તરીકે છપાઈ છે.

૨. જુઓ પ્ર. ચ. (શૃ. ૫, શ્લો. ૩૦૨-૩૦૩).

૩. આ આગમ (સુ. ૧૩૦, પત્ર ૧૪૯આ)માં મલયવર્ધનો ઉલ્લેખ છે. એ કથા પણ પાદલિપ્તસૂરિએ રચી હશે એમ નિર્વાણકલિકાની અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૧૭ અ-૧૭ આ)માં એના લેખકે કહ્યું છે.

૪. આ તેમજ રચણાવલિ (વગ્ગ ૧, શ્લો. ૨)ની સ્વોપજ વૃત્તિ જોતાં પાદલિપ્તસૂરિએ ‘દેશ્ય’ શબ્દોનો કોશ રચ્યો હશે એમ લાગે છે.

૫. આ કૃતિ મોહનલાલ ભ. ઝવેરી દ્વારા સંપાદિત થયેલી છે અને એ એમની અંગ્રેજી પ્રસ્તાવના તેમજ પં. રમાપતિમિશ્રની સંસ્કૃત ભૂમિકા સહિત “મોહનલાલજી જૈન ગ્રંથમાલા”માં ગ્રંથાંક ૫ તરીકે ઈ. સ. ૧૯૨૬માં પ્રકાશિત થયેલી છે.

૬. જુઓ વિવિધતીર્થકલ્પગત “શત્રુંજય-કલ્પ” (શ્લો. ૧૨૨) અને “રેવંતકગિરિકલ્પસંક્ષેપ” (શ્લો. ૬)

૭. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૪૨-૧૪૬)

૮. એઓ ‘વિદ્યાધર’ વંશના-ગચ્છના આર્ય નાગહસ્તિસૂરિના ગુરુભાઈ ગણાય છે.

૯. એઓ સિદ્ધસેન દિવાકરના ગુરુ વૃદ્ધવાદીના ગુરુ ગણાય છે.

પ્રશ્નપ્રકાશ એ જ્યોતિ:શાસ્ત્રનો ગ્રંથ છે એમ પ્ર. ચ. (શં પ, શ્લો. ૩૪૭)માં કહ્યું છે. પ્રશ્ન ઉપરથી મૂળ ફળ કહેવાની બાબત આ ગ્રંથમાં વર્ણવાઈ હશે એમ એનું નામ જોતાં જણાય છે. હજી સુધી તો આ ગ્રંથ કોઈ સ્થળેથી મળી આવ્યો નથી.

કાલ-જ્ઞાન (લ. વિ સં. ૧૭૫)- આ ઉપર્યુક્ત પાદલિખસૂરિની કૃતિ છે. એ જ્યોતિષની હશે. એ પણ હજી સુધી તો અપ્રાપ્ય છે.

પ્રશ્નપ્રકાશ અને કાલજ્ઞાન એ બે ગ્રંથો કઈ ભાષામાં છે - સંસ્કૃતમાં છે કે નહિ તેનો નિર્ણય કરવા માટે મારી પાસે કોઈ સાધન નથી એટલે મેં એની અહીં નોંધ લીધી છે.

P ૨૦૫

ઋષિપુત્રની કૃતિ (ઉ. વિ. સં. ૧૦૦૦- ઋષિપુત્રએ ગર્ગાચાર્યના પુત્ર કે શિષ્ય કે બંને થતા હોય એમ લાગે છે. એમણે નિમિત્તશાસ્ત્રને અંગે કૃતિઓ રચી છે. તેમાં એકાદ સંસ્કૃતમાં પણ હશે એમ મનાય છે. કેટલાકને મતે એમનો સમય દેવલની પછી અને વરાહમિહિરની પહેલાંનો છે.^૧ ભટ્ટોપલી ટીકામાં ઋષિપુત્રને અંગે ઉલ્લેખ છે એટલે એઓ શકસંવત્ ૮૮૮થી પહેલાંના છે એ વાત તો નિર્વિવાદ છે.

જ્યોતિર્જ્ઞાનવિધિ- આના કર્તા શ્રીધરાચાર્ય છે અને એમણે ગણિતસાર નામની કૃતિ રચી છે. આની ‘કન્નડ’ લિપિમાં લખાયેલી નવ પત્રની તાડપત્રીય હાથપોથીની નોંધ ક. તા. ગ્રં. (પૃ. ૨૪૨)માં છે. આ કૃતિનું મંગલાચરણ નીચે મુજબ અહીં અપાયું છે :-

“પ્રણિપત્ય વર્ધમાનં સ્ફુટકેવલદૃષ્ટતત્ત્વમીશાનમ્ ।

જ્યોતિર્જ્ઞાનવિધાનં વક્ષ્યે સ્વામ્ભુવં સમ્યક્”

આ કૃતિમાં ‘પરિજ્ઞામન-વિધિના સંકેત મળે છે. વિશેષમાં આ કૃતિમાં ચરકરણ અને સ્થિર કરણની સમજણ અપાઈ છે.”

‘ભુવનદીપક યાને ગ્રહભાવપ્રકાશ (વિ. સં. ૧૨૨૧ ?^૨)- આના કર્તા ‘વાદી’ દેવસૂરિના શિષ્ય ‘પદ્મપ્રભસૂરિ છે.” એઓ નાગપુરીય ‘તપા’ ગચ્છના સ્થાપક છે. એમણે આ ગ્રંથ વિ. સં. ૧૨૨૧-(?)માં રચ્યો છે. એમાં એમણે કયો ગ્રહ ક્યારે કેવો ભાવ ભજવે એ હકીકત દર્શાવી છે.

ભુવનદીપક ઉપર નીચે મુજબનું વિવરણાત્મક સાહિત્ય છે :-

૧. આ શ્લોકમાં સિદ્ધાદેશનો જે ઉલ્લેખ છે તેને કેટલાક ગ્રંથો ગણે છે.

૨. એમના પરિચયાર્થે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૬૮).

૩. જુઓ “જૈ. સિ. ભા.” (ભા. ૧૮, કિ. ૨).

૪. પ્રતિભાગણિતમાં ગ્રહનાં વૃત્તોના પરિજ્ઞામનું નિરૂપણ છે.

૫. આને લગતાં સં. પદ્યો કે. પ્ર. ચૂ.ની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૧૧)માં છે.

૬. હિંદી અનુવાદ સહિત જે ભુવનદીપક “વેંકટેશ્વર મુદ્રણાલય” તરફથી પ્રકાશિત થયેલ છે તે આ જ છે ?

૭. આમ પ્રશ્નાર્થક ઉલ્લેખ જૈ. સા. સં. ઈ. (પૃ. ૨૭૮)માં છે જ્યારે જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૮૭)માં પ્રશ્નચિહ્નવિનાનો ઉલ્લેખ છે.

૮. વિ. સં. ૧૨૮૪માં મુનિસુવ્રતચરિત્ર રચનારાનું નામ પણ પદ્મપ્રભસૂરિ છે.

૯. જુઓ ‘નાગોરી તપા’ ગચ્છની પટ્ટાવલી.

- (૧) ભાવબોધિકા— આના રચનાર દૈવજ્ઞ શિરોમણિ છે.
- (૨) વૃત્તિ— આ વૃત્તિ સિંહતિલકસૂરિએ વિ. સં. ૧૩૨૬માં ૧૭૦૦ શ્લોક જેવડી રચી છે. એ સૂરિ યશોદેવસૂરિના શિષ્ય વિબુધયન્દ્રસૂરિના શિષ્ય થાય છે. એમણે વર્ધમાન-વિદ્યાકલ્પ તેમજ શ્રીપતિકૃત P. ૨૦૬ ગણિતતિલક ઉપર વૃત્તિ તેમજ મંત્રરાજ-રહસ્ય નામનો ગ્રંથ (વિ. સં. ૧૩૩૨)માં રચ્યાં છે અને એના ઉપર લીલાવતી નામની વૃત્તિ રચી છે.
- (૩) અવયૂરિ—લક્ષ્મીસાગરસૂરિએ આ અવયૂરિ વિ. સં. ૧૫૨૧માં રચી છે.
- (૪) વૃત્તિ— આના કર્તા હેમતિલક છે.
- (૫) ટીકા— આના કર્તાનું નામ જાણવામાં નથી.^૧

‘આરંભસિદ્ધિ યાને વ્યવહારચર્યા (લ. વિ. સં. ૧૨૮૦)— આ ૪૧૩ પદ્યોની કૃતિના પ્રણેતા ઉદયપ્રભસૂરિ છે. એઓ વસ્તુપાલના ગુરુ વિજયસેનસૂરિના અને શકસંવત્ ૧૨૧૪માં સ્યાદ્વાદમંજરી રચનારા મલ્લિપેશના તેમજ વસ્તુપાલના પુત્ર જયંતસિંહ માટે વિ. સં. ૧૨૮૦માં પ્રબંધાવલી રચનારા જિનભદ્રના ગુરુ થાય છે. એમણે ધર્માભ્યુદય અને નેમિનાથચરિત્ર તેમજ ‘સુકૃતકીર્તિકલ્લોલિની નામનું પ્રશસ્તિ-કાવ્ય રચ્યાં છે. વળી એમણે ધર્મદાસગણિકૃત ‘ઉવએસમાલા ઉપર ઉપદેશમાલાકર્ણિકા નામની P. ૨૦૭ ટીકા ‘ધોળકામાં વિ. સં. ૧૨૮૯માં રચી છે. આ ઉપરાંત એમણે છાસીઈ અને કમ્મત્યય એ બે કર્મગ્રંથો ઉપર ટિપ્પણ રચ્યાં છે. ‘ગિરનાર’ ઉપરના વસ્તુપાલના પ્રશસ્તિ-લેખો પૈકી વિ સં. ૧૨૮૮નો એક લેખ એ પણ એમની કૃતિ છે.

આ આરંભસિદ્ધિ પાંચ ‘વિમર્શમાં વિભક્ત છે. આ પદ્યાત્મક કૃતિ નીચે મુજબનાં ૧૧ દ્વાર ઉપર પ્રકાશ પાડે છે :—

૧. ‘મરતર’ ગચ્છના ઉપા. દાનસાગરના શિષ્ય વાયક રત્નધીરે ભુવનદીપક ઉપર વિ. સં. ૧૮૦૫માં બાલાવબોધ રચ્યો છે.
૨. આ કૃતિ સુધીશૃંગાર નામના વાર્તિક, મૂળ કૃતિગત પદ્યોની અકારાદિ ક્રમે સૂચી તેમજ વાર્તિકમાં નિર્દેશાયેલા ગ્રંથો અને ગ્રંથકારોની સૂચી સહિત “લ. જૈ. ગ્રં.”માં છાણીથી ઈ. સ. ૧૯૪૨માં પ્રસિદ્ધ થઈ છે. આ પ્રકાશન માટે શ્રી. પુરુષોત્તમદાસ ગીગુભાઈ તરફથી ભાવનગરથી ઈ. સ. ૧૯૧૬માં સુધીશૃંગાર સહિત છપાયેલી આવૃત્તિનો ઉપયોગ કરાયો છે. [ગુર્જર અનુવાદ સાથે આ. સિ. નું પુનઃ પ્રકાશન આ લબ્ધિસૂરિજીના પ્રયાસથી થયું છે. વિ.સં. ૨૦૧૩માં આ. સિ. વાર્તિક સાથે ખાંતીલાલે ભવનગરથી પ્રગટ કરી છે.]
૩. આ વિ. સં. ૧૨૭૭ના અરસામાં રચાયેલા કાવ્યમાં અણહિલપુર પાટણના નૃપતિઓને લગતી ઐતિહાસિક બાબતો આખી વસ્તુપાલ-તેજપાલનાં ધાર્મિક કૃત્યોની પ્રશંસા કરાઈ છે. વસ્તુપાલે ‘શત્રુંજય’ ઉપર બંધાવેલા ઈન્દ્રમંડપમાં આ કાવ્ય કોતરાવાયું હતું. પાટણમાં આ મંત્રીશ્વરના પ્રાસાદના અવશેષરૂપ મનાતા આરસના એક થાંભલા ઉપર આ કાવ્યનું એક પદ્ય કોતરાયેલું મળી આવ્યું છે.
૪. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૨૭ અને ૨૩૭).
૫. ‘ધોળકા યુનિવર્સિટિ’ તરીકે હાંસીપાત્ર ગણાતા આ ધોળકામાં વિદ્યાપીઠ હતી અને એ વસ્તુપાલની છાયા નીચે મહત્વનું વિદ્યાધામ બની હતી.
૬. પાંચ વિમર્શમાં અનુક્રમે ૪, ૨, ૧, ૨ અને ૨ દ્વાર છે, અને ૮૪, ૭૩, ૮૨, ૮૮ અને ૮૬ પદ્યો છે.

(૧) તિથિ, (૨) વાર, (૩) નક્ષત્ર, (૪) (સિદ્ધિ વગેરે) યોગ, (૫) રાશિ, (૬) ગોચર, (૭) (વિદ્યારંભ વગેરે) કાર્ય, (૮) ગમ (યાત્રા), (૯) (ઘર વગેરેનું) વાસ્તુ, (૧૦) વિલગ્ન અને (૧૧) મિશ્ર.

મતભેદ— વારોની માન્યતામાં, નક્ષત્રોમાંના તારાઓની સંખ્યામાં તેમજ યાત્રાદિના પ્રસંગે જોવાનાં દિગ્દ્વારક નક્ષત્રોમાં એમ કેટલીક બાબતોમાં આ કૃતિ સૂરપણ્ણતિ અને દિનશુદ્ધિથી ભિન્ન મત દર્શાવે છે.

સુધીશૃંગાર— આ આરંભસિદ્ધિનું સંસ્કૃતમાં રચાયેલું વાર્તિક છે. એની રચના રત્નશેખરસૂરિના શિષ્ય હેમહંસગણિએ વિ.સં. ૧૫૧૪માં ‘આશાપલ્લી’માં કરી છે. એમાં એમણે અનેક ગ્રંથોનો ઉપયોગ કર્યો છે.

૧૨૦૮

‘જ્યોતિઃસાર’ યાને નારયન્દ્ર—જ્યોતિઃસાર (લ. વિ. સં. ૧૨૮૦)— આ ૨૫૭ પદ્યોની કૃતિના કર્તા પ્રાકૃતદીપિકા રચનારા નરયન્દ્રસૂરિ છે. એઓ ‘મલધારી’ ગચ્છના દેવપ્રભસૂરિના શિષ્ય થાય છે. એમણે ચતુર્વિંશતિ-જિનસ્તોત્ર રચ્યું છે. વળી એમણે અનર્ધરાઘવ ઉપર તેમજ ન્યાયકંદલી ઉપર ટિપ્પણ રચ્યાં છે. આ ઉપરાંત એમણે પોતાના ગુરુએ રચેલા પાંડવચરિત્રનું અને ઉદયપ્રભસૂરિએ રચેલા ધર્માભ્યુદય કાવ્યનું સંશોધન કર્યું છે. એમના સંતાનીય રાજશેખરસૂરિએ ન્યાયકંદલીની પંજિકામાં ઉપર્યુક્ત બે ટિપ્પણ તેમજ જ્યોતિઃસાર (પ્રસ્તુત કૃતિ) અને પ્રાકૃતદીપિકા એમ ચાર કૃતિનો ઉલ્લેખ કર્યો છે. આ નરયન્દ્રસૂરિએ વસ્તુપાલની પ્રશસ્તિરૂપે વિ. સં. ૧૨૮૮માં રચેલા પદ્યો ગિરનાર ઉપરના શિલાલેખમાં મોજુદ છે. આ સૂરિના આદેશથી ગુણવલ્લભે વિ. સં. ૧૨૭૧માં વ્યાકરણચતુષ્કાવચૂરિ રચી હતી.

ટિપ્પણ—જ્યોતિષની ઉપર્યુક્ત કૃતિ ઉપર સાગરચન્દ્રે ૧૩૩૫ શ્લોક જેવડું ટિપ્પણ રચ્યું છે.

ત્રૈલોક્યપ્રકાશ*, ત્રૈલોક્યદીપક, નવ્યતાજિક, ભુવનદીપક યાને મેઘમાલા (વિ. સં. ૧૩૦૫) — જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૧૬૫) પ્રમાણે આ નામાંતરો છે. આ ગ્રંથના કર્તા દેવેન્દ્રસૂરિના શિષ્ય હેમપ્રભસૂરિ છે. એમણે આ ૧૨૫૦ શ્લોક જેવડી કૃતિ વિ. સં. ૧૩૦૫માં રચી છે.

૧૨૦૯

જન્મસમુદ્ર યાને જન્માંભોધિ (વિ. સં. ૧૩૨૩)— આના કર્તા ઉપા. નરયન્દ્ર છે. એઓ ‘કાસદ્રહ’ ગચ્છના ઉદ્ધોતનસૂરિના શિષ્ય સિંહસૂરિના શિષ્ય થાય છે.

બેડા—જન્મસમુદ્રના ઉપર કર્તાએ જાતે વૃત્તિ રચી છે. એને ‘બેડા’ વૃત્તિ કહે છે.

પ્રશ્નશતક (વિ. સં. ૧૩૨૪)— આ કૃતિ પણ ઉપર્યુક્ત ઉપા. નરયન્દ્રે રચી છે અને એને એમણે સ્વોપજ અવચૂર્ણિથી અલંકૃત કરી છે.

૧. આ કૃતિ પં. ક્ષમાવિજયગણિ દ્વારા ઈ. સ. ૧૯૩૮માં પ્રકાશિત કરાઈ છે.

૨. આ નામની બીજી પણ બે કૃતિઓ છે. જુઓ પૃ. ૨૦૮.

૩. આ કૃતિ ભીમસી માણેકે પ્રસિદ્ધ કરી છે. અન્ય સ્થળેથી પણ એ પ્રકાશિત કરાઈ છે.

૪. આ નામની હેમપ્રભસૂરિની વિશ્વરચના સંબંધીની કૃતિ છે. એનું સંપાદન શ્રી. રામસરૂપ શર્માએ કયુછે અને ડૉ. બનારસીદાસે એ કૃતિના વિષય ઉપર પ્રકાશ પાડનારી અંગ્રેજીમાં પ્રસ્તાવના લખી છે. જુઓ The Jaina Antiquary (Vol. XVII, No. 2)માં છપાયેલું ડૉ. એ. એમ. ઘાટગેનું ભાષણ.

૫. જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૧૩)માં રચના-સમય તરીકે ‘ત્રિનયના ઘોષેત્ર’નો ઉલ્લેખ છે અને એનો અર્થ ૧૩૨૩ હોય એમ લાગે છે.

જ્યોતિ:સાર (લ. વિ. સં. ૧૩૭૦)— આના કર્તા જૈન ગૃહસ્થ ઠક્કર ફેરુ છે.^૧ એમણે વિ. સં. ૧૩૭૨માં વત્યુસાર-પચરણ રચ્યું છે. વળી એમણે દ્રવ્ય-પરિક્ષા (દ્રવ્ય-પરીક્ષા) અને રત્ન-પરીક્ષા નામની એકેક કૃતિ પણ રચી છે અને એને સ્વોપજ વૃત્તિથી વિભૂષિત કરી છે.

સ્વોપજ વૃત્તિ— જ્યોતિ:સાર ઉપર પણ સ્વોપજ વૃત્તિ છે. એ મૂળ કૃતિ સંસ્કૃતમાં છે કે પાઈયમાં તે જાણવું બાકી રહે છે. વૃત્તિ તો સંસ્કૃતમાં જ હશે.

જ્યોતિ:સાર, જ્યોતિષસારસંગ્રહ યાને **જ્યોતિષસારોદ્ધાર** (લ. વિ. સં. ૧૬૬૦)— ચન્દ્રકીર્તિસૂરિ વિ. સં. ૧૬૩૦ના શિષ્ય હર્ષકીર્તિસૂરિએ આ કૃતિ રચી છે. એ ત્રણ પ્રકરણોમાં વિભક્ત છે. આ કૃતિને જ્યોતિષસારસંગ્રહ તેમજ જ્યોતિષસારોદ્ધાર પણ કહે છે. હર્ષકીર્તિસૂરિએ પૃ. ૧૨૦માં ગણાવેલી P. ૨૧૦ કૃતિઓ ઉપરાંત ભક્તામરસ્તોત્ર અને લઘુશાન્તિસ્તોત્ર ઉપર તેમજ નિમ્નલિખિત પાઈય કૃતિઓ ઉપર પણ સંસ્કૃતમાં ટીકા રચી છે :—

અજિતસંતિથય, ઉવસગ્ગહરથોત્ત અને નવકારમંત.

જન્મપત્રીપદ્ધતિ— આ નામની ચાર કૃતિઓ છે : (૧) હર્ષકીર્તિસૂરિકૃત, (૨) કલ્યાણનિધાનના શિષ્ય લખ્વિચન્દ્રગણિએ વિ. સં. ૧૭૫૧માં રચેલી, (૩) મહિમોદયકૃત અને (૪) અજ્ઞાતકર્તૃક. આ ચારેનો વિષય જન્મોત્તરીને લગતો છે.

માનસાગરી-પદ્ધતિ (ઉ. વિક્રમની ૧૮મી સદી)— આ કૃતિનું નામ વિચારતાં એના કર્તાનું નામ માનસાગર હશે એમ લાગે છે. જો એમજ હોય તો પણ એ જાણવું બાકી રહે છે કે શું એઓ બુદ્ધિસાગર શિષ્ય માનસાગર છે કે જીતસાગરના શિષ્ય માનસાગર છે કે અન્ય જ કોઈ છે ? આ પ્રશ્ન ઉપસ્થિત થવાનું કારણ એ છે કે ખેમરાજ દ્વારા પ્રકાશિત આવૃત્તિમાં પ્રારંભમાં કે અંતમાં ગ્રંથકારના પરિચયરૂપ લખાણ નથી અને મારી સામે કોઈ વિશિષ્ટ સાધન નથી. આ પદ્માત્મક કૃતિનો વિષય ફલાદેશ છે. એના પ્રારંભમાં આદિનાથ, પુંડરીક ગણધર, કૃષ્ણ અને પાર્શ્વનાથની તેમજ નવે ગ્રહોની સ્તુતિ કરાઈ છે. ત્યાર બાદ જન્મપત્રી બનાવવાની રીત દર્શાવાઈ છે, સંવત્સરનાં ૬૦ નામો, સંવત્સરો, યુગો, ઋતુ, માસ, પક્ષ, તિથિ, વાર અને જન્મલગ્નરાશિ ઇત્યાદિનાં ફળ, કરણ, દશા, અંતરદશા તથા ઉપદશાનાં વર્ષમાન, ગ્રહના ત્વાવ, યોગ, અપયોગ વગેરે બાબતો વિચારાઈ છે. પ્રસંગોપાત્ત જાતજાતની ગણનાની P. ૨૧૧ રીત રજૂ કરાઈ છે. કોઈ કોઈ સ્થળે (દા. ત. પત્ર ૩અ અને ૧૮આમાં) હિન્દીમાં લખાણ છે.

૧. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૩૧).

૨. આ નામની બીજી પણ બે કૃતિ છે. જુઓ પૃ. ૨૦૮ અને ૨૦૯.

૩. એમના પરિચય માટે જુઓ પૃ. ૧૨૦, ૨૦૯ અને ૨૧૦.

૪. આ કૃતિ ખેમરાજ કૃષ્ણદાસે વેંકટેશ્વર મુદ્રણાલયમાં ૧૦૩ પત્રમાં મોટાં બીબાંમાં છપાવી મુંબઈથી વિ. સં. ૧૯૬૧માં પ્રસિદ્ધ કરી છે. પત્ર ૬૪અ-૬૪આમાં નવ ગ્રહનાં તેમજ ગજચક્ર, ચમદૃષ્ટાચક્ર વગેરેનાં ચિત્ર અપાયાં છે. વળી દશા વગેરેને લગતાં કેટલાંક કોષ્ટકો પણ રજૂ કરાયાં છે.

૫. આની વિ. સં. ૧૮૧૩માં લખાયેલી એક હાથપોથી અહીંના (સુરતના) જૈનાનંદપુસ્તકાલયમાં છે.

સામુદ્રિક શાસ્ત્ર

‘સામુદ્રિક-તિલક (વિ. સં. ૧૨૧૬)– આના કર્તા જૈન ગૃહસ્થ જગદેવ (જગદેવ) છે અને એમણે સ્વપ્નશાસ્ત્ર પણ રચ્યું છે. એઓ ‘પરમાર્હત’ કુમારપાલના મહત્તમ (મંત્રી) દુર્લભરાજના પુત્ર થાય છે. એ ‘પ્રાગ્વાટ’ વંશના દુર્લભરાજે ગજપ્રબંધ ગજપરીક્ષા યાને હસ્તિપરીક્ષા, તુરંગ-પ્રબંધ, પુરુષ-સ્ત્રી-લક્ષણ તેમજ શકુન- (નિ ?)શાસ્ત્ર રચ્યાનું મનાય છે પણ એ અપ્રાપ્ય હોય એમ લાગે છે. શું પુરુષ-સ્ત્રી-લક્ષણ વ્યવસ્થિત સ્વરૂપે પદ્યમાં રચાયું નહિ હશે કે જેથી એમના પુત્રે એ સમર્થિત કર્યું ?

P. ૨૧૨ સામુદ્રિક-તિલક એ પુરુષ અને સ્ત્રીનાં લક્ષણોને રજૂ કરતી ૮૦૦ આર્યામાં રચાયેલી કૃતિ છે. એ પાંચ અધિકારોમાં વિભક્ત કરાયેલી છે. એમાં અનુક્રમે ૨૮૮, ૮૮, ૪૬, ૧૮૮ અને ૧૪૮ પદ્યો છે. પ્રારંભમાં ઋષભદેવ અને બ્રાહ્મીની સ્તુતિ કરાઈ છે. ત્યાર બાદ સામુદ્રિક શાસ્ત્રની ઉત્પત્તિ સમુદ્રથી થઈ એમ કહી એની થોડીક રચના નારદે, લલ્લે, વરાહ (વરાહમિહિરે) માંડવ્યે અને કાર્તિકસ્વામીએ કરી એવો નિર્દેશ કરાયો છે.

પ્રથમ અધિકારમાં પગના તળિયાથી માંડીને માથાના વાળ સુધીનું વર્ણન છે અને સાથે સાથે એનું ફળ દર્શાવાયું છે. જેમકે અમુક પ્રકારનું પગનું તળિયું હોય તો રાજસંપત્તિ મળે.

બીજા અધિકારમાં ક્ષેત્રના સંહતિ, સાર વગેરે આઠ પ્રકારોનું તેમજ પુરુષનાં ૩૨ લક્ષણોનું નિરૂપણ છે.

ત્રીજા અધિકારમાં આવર્ત (ભમરી), ગતિ (ચાલ), છાયા (કાંતિ), સ્વર (અવાજ) ઇત્યાદિ વિષે વિચાર કરાયો છે.

૧. આ તેમજ હસ્તસંજ્ઞવન, સામુદ્રિક-શાસ્ત્ર, હસ્તકાંડ અને (પાઈથમાં) અર્હચ્યૂડામણિસાર એમ પાંચ ગ્રંથો ગુજરાતી અનુવાદ સહિત જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથો એ નામથી શ્રી સારાભાઈ મણિલાલ નવાબે ઇ.સ. ૧૯૪૭માં પ્રસિદ્ધ કર્યા છે. એમાં વિસ્તૃત વિષયસૂચી અપાઈ છે. આ પૂર્વે સામુદ્રિકતિલક (?) હિંદી ભાષાંતર સહિત “વેંકટેશ્વર મુદ્રણાલય” તરફથી અને એ કૃતિ મરાઠી અનુવાદ સહિત શ્રી. રઘુનાથ શાસ્ત્રી પટવર્ધન તરફથી છપાવાઈ હતી.

૨. એઓ ભીમદેવ નૃપતિના અમાત્ય વાહિલ્લના (જૈ. સા. સં. ઇ.ના પૃ. ૨૭૭ પ્રમાણે તો જાહિલના) પુત્ર રાજપાલના પૌત્ર અને નૃસિંહના પુત્ર થાય છે. આ દુર્લભરાજે પુરુષ-સ્ત્રી-લક્ષણ નામનો જે ગ્રંથ રચ્યો તેને એમના પુત્ર જગદેવે સમર્થિત કર્યો (? પદ્યમાં ઉતાર્યો) આ પદ્યાત્મક કૃતિ તે જ પ્રસ્તુત સામુદ્રિકતિલક હોય એમ એની પ્રશસ્તિ જોતાં જણાય છે. આ અનુમાન સાચું ન હોય તો એમના (જગદેવના) પિતા આ ગ્રંથના પ્રણેતા ગણાય. જૈ. સા. સં. ઇ. (પૃ. ૨૭૭)માં દુર્લભરાજને પ્રસ્તુત કૃતિના પ્રણેતા કહ્યા છે અને પૃ. ૨૭૮માં આ કૃતિ એમણે વિ. સં. ૧૨૧૬માં રચ્યાનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ મુદ્રિત કૃતિમાં તો રચનાવર્ષ નથી.

૩. દિ. જિનસેને શકસંવત્ ૭૦૫માં રચેલા હરિવંશપુરાણના સર્ગ ૨૩ (શ્લોક ૫૫-૧૦૭)માં પુરુષનાં લક્ષણો અને એ સર્ગ (શ્લોક ૮૫-૯૭)માં કરલક્ષણ અને એની સાર્થકતા વિષે નિરૂપણ કર્યું છે.

ચોથો અધિકાર સ્ત્રીઓને લગતો છે. એમાં એનાં વિવિધ અવયવાદિનું નિરૂપણ છે.

પાંચમા અધિકારમાં સ્ત્રીનાં વ્યંજન (તલ, મશક યાને મસો, લાંછન ઇત્યાદિ), સ્ત્રીની દેવાદિ બાર પ્રકૃતિ-પદ્ધિની વગેરેનાં લક્ષણ ઇત્યાદિ બાબતો રજૂ કરાઈ છે. અંતમાં દસ પદ્યોની પ્રશસ્તિ છે. આ પ્રશસ્તિ જગદેવે રચી હોય એમ લાગે છે.

હસ્તસંજીવનમાં આ સામુદ્રિક-તિલકમાંથી અવતરણો અપાયાં છે.

'સામુદ્રિક-શાસ્ત્ર'— આ અજ્ઞાતકર્તૃક કૃતિ ત્રણ અધ્યાયમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૨૪, ૧૨૭ અને ૧૨૧ પદ્યો છે. પ્રારંભમાં આદિનાથને નમસ્કાર કરી પુરુષ અને સ્ત્રીનું સામુદ્રિક કહીશ એવી P. ૨૧૩ પ્રતિજ્ઞા કરાઈ છે. પ્રથમ અધ્યાયમાં ૩૨ લક્ષણો, નેત્ર વગેરેનું વર્ણન અને હાથની રેખા ઇત્યાદિ બાબતો રજૂ કરાઈ છે.

બીજા અધ્યાયમાં શરીરનાં અવયવોનાં લક્ષણો અપાયાં છે.

ત્રીજા અધ્યાયમાં સ્ત્રીઓનાં લક્ષણો રજૂ કરાયાં છે. કેવી કન્યા પસંદ કરવી એ વિષયથી શરૂઆત કરાઈ છે અને અંતમાં પદ્મિની વગેરેનું સ્વરૂપ આલેખાયું છે.

'વાયડ' ગચ્છના જિનદત્તસૂરિએ રચેલા વિવેકવિલાસમાંના કેટલાક શ્લોકો આ સામુદ્રિક-શાસ્ત્રમાંના શ્લોકો સાથે સામ્ય ધરાવે છે. આથી એકે બીજામાંથી એ ઉદ્ધૃત કર્યા હશે અથવા તો બંનેએ કોઈ અન્ય ગ્રંથમાંથી એ લીધા હશે એમ ફલિત થાય છે.

પત્તન.સૂચી (ભા. ૧, પૃ. ૮૧ ને ૧૭૧)માં જે જૈન સામુદ્રિકશાસ્ત્રનો ઉલ્લેખ છે તે આ પ્રસ્તુત કૃતિ છે કે કેમ તેનો નિર્ણય કરવો બાકી રહે છે.

'હસ્તકાંડ'— આના કર્તા શ્રીચન્દ્રસૂરિ કે ચન્દ્રસૂરિના શિષ્ય પાર્શ્વચન્દ્ર છે. આ ૧૨૦ પદ્યની કૃતિના પ્રારંભમાં વર્ધમાનસ્વામીને નમસ્કાર કરીને સર્વજ્ઞે કહેલું અને પોતે અનુભવેલું એવું જ્ઞાન રજૂ કરવાની ગ્રંથકાર પ્રતિજ્ઞા કરે છે. ત્યાર પછી 'ઉત્તર અને અધર' સંબંધી પરિભાષાની સમજણ અપાઈ છે. ત્યાર બાદ લાભ અને હાનિ, સુખ અને દુઃખ, જીવિત અને મરણ, જય અને પરાજય, ભૂભંગ (જમીન અને છત્રનું પતન), મનોગત વિચારો, વર્ણોનો ધર્મ, સંન્યાસી વગેરેનો ધર્મ, દિશા, દિવસ વગેરેનો કાલનિર્ણય, 'અર્ધકાંડ, ગર્ભમાં રહેલા અપત્યનો નિર્ણય, ગમનાગમન, વૃષ્ટિ અને શલ્યોદ્ધાર એ બાબતોને લગતા પ્રશ્નો P. ૨૧૪ વિચારાયા છે. આના સંતુલન માટે અર્હચ્યૂડામણિસાર તેમજ ચન્દ્રોન્મીલન જોવાં ઘટે.

૧. આ ગુજરાતી અનુવાદ સહિત સારાભાઈ નવાબ દ્વારા પ્રકાશિત છે.

૨. ગુણચન્દ્રગણિએ (દેવભદ્રસૂરિએ) વિ. સં. ૧૧૩૯માં રચેલા મહાકાવ્ય મહાવીર-ચરિયમાં જે સમુદ્ર-સત્યનો ઉલ્લેખ છે તે જ શું આ કૃતિ છે ?

૩. આ ગુજરાતી અનુવાદ સહિત સારાભાઈ નવાબ દ્વારા મુદ્રિત છે.

૪. ૮૦મું અને ૮૧મું પદ્ય પાઈયમાં છે. એનો અનુવાદ અપાયો નથી પણ એ ચોરને લગતો વિચાર રજૂ કરે છે એમ કહ્યું છે, પરંતુ પ્રારંભમાં જે વિષયો ગણાવાયા છે તેમાં તો આ વિષય જણાતો નથી.

૫. ચીજ મોંઘી (મહાર્ધક) થશે કે સસ્તી (સ્વર્ધક) એ બાબત એટલે તેજી કે મંદી થશે એ વાત અહીં વિચારાઈ છે.

‘હસ્ત-સંજીવન’ યાને ‘સિદ્ધજ્ઞાન’ (લ. વિ. સં. ૧૭૩૫)– આના કર્તા ચંદ્રપ્રભા વગેરેના પ્રણેતા ઉપા. મેઘવિજય છે. આ કૃતિમાં ૫૧૯ પદો છે અને એનો ગ્રંથાગ્ર પરપ શ્લોકનો છે. અષ્ટાંગ નિમિત્તને ઘટાવવાના ઉદ્દેશથી રચાયેલો આ સમગ્ર ગ્રંથ ચાર અધિકારમાં વિભક્ત કરાયો છે. એનાં દર્શન, સ્પર્શન રેખા-વિમર્શન અને વિશેષ એમ અનુક્રમે નામ છે અને એનાં પદોની સંખ્યા અનુક્રમે ૧૭૭, ૫૪, ૨૪૧ અને ૪૭ છે. આમ ત્રીજો અધિકાર સૌથી મોટો છે.

‘શંખેશ્વર’ પાશ્વનાથ, ઋષભદેવ અને વર્ધમાનસ્વામીને નમસ્કાર કરી પ્રથમ અધિકારનો પ્રારંભ P. ૨૧૫ શાસ્ત્ર-પીઠિકા (શ્લો. ૧-૧૯)થી કરાયો છે. એમાં હાથની પ્રશંસા કરાઈ છે. શ્લો. ૮માં હસ્તજ્ઞાન-દર્શન, સ્પર્શન અને રેખા-વિમર્શન એમ ત્રણ પ્રકારો છે એમ કહ્યું છે. શ્લો. ૧૯માં હાથનો બ્રહ્માએ બનાવેલી અક્ષય જન્મપત્રી (જન્મોત્તરી) તરીકે ઉલ્લેખ છે.

હાથમાં ૩ તીર્થ, ૨૪ તીર્થકરો વગેરે રહેલા છે એ રીતે એનું ધ્યાન ધરવાની હકીકત અપાઈ છે. ત્યાર બાદ હાથ તેમજ એનાં પાંચ આંગળાં વગેરેનાં નામ અપાયાં છે. આના પછી ગુરુને હાથ દેખાડવાનો વિધિ અને પ્રસંગવશાત્ ગુરુનાં લક્ષણ એ બાબત આલેખાઈ છે. ત્યાર બાદ તિથિ, વાર વગેરેને લગતાં એકંદર ૧૭ ચક્રોની સમજણ અપાઈ છે. અંતમાં હાથના વર્ણાદિનો વિચાર કરાયો છે. આ અધિકારના અંતમાં સામુદ્રિક-ભૂષણમાંથી પદો ઉદ્દ્યુત કરાયાં છે.^૧

‘સ્પર્શન’ નામના બીજા અધિકારમાં હાથમાં આઠે નિમિત્તો કેવી રીતે ઘટે તે સમજાવાયું છે.^૨ એમ કરતી વેળા પુસ્તક શકુન યાને શકુન-શલાકા તેમજ પાશક-કેવલી યાને પાસાકેવલીનો પણ વિચાર કરાયો છે. શ્લો. ૪૬માં જ્યૂડામણિનો ઉલ્લેખ છે.

ત્રીજા અધિકારમાં જાતજાતની રેખાઓનું વર્ણન છે.

ચોથામાં રેખાની વિશ્વા (વસા)–લંબાઈ, નખનાં અને આવર્તનાં લક્ષણો, સ્ત્રીઓની રેખા સંબંધી વિશેષ વક્તવ્ય, અને પુરુષના ડાબા હાથનું વર્ણન એ બાબતો રજૂ કરાઈ છે.

૧. આ કૃતિ “મોહનલાલજી જૈન ગ્રંથમાલા”માં છપાઈ છે. “જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથો” નામના સંસ્કરણમાં એ ગુજરાતી અનુવાદ સહિત છપાઈ છે (જુઓ પૃ. ૨૧૧) અને એમાં ચિત્રો, ચક્રો અને કોષ્ટકો અપાયાં છે.

૨. હાથ દ્વારા અષ્ટાંગ નિમિત્તને સંજીવન આપનારી આ કૃતિ હોવાથી એનું આ નામ સાર્થક ઠરે છે.

૩. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૬૧)માં તો આને હસ્તસંજીવનનો એક ભાગ કહ્યો છે. કોઈ કોઈ હસ્તસંજીવનને હસ્તસંજીવની કહે છે.

પૃ. ૫૪માં નીચે મુજબની પુષ્પિકા છે :-

“इति श्रीहस्तसंजीवने सिद्धज्ञाने प्रथमे दर्शनाधिकारे शास्त्रपीठिका”

૪. આમુખમાં (પૃ. ૭, ૧૦ ઈ.)માં એ વાત ઉપર ભાર મૂકાયો છે કે આ હસ્તસંજીવનમાં નષ્ટ-જાતક-પદ્ધતિ નથી.

૫. જુઓ આમુખ (પૃ. ૨). શું શ્લો. ૯૭થી ૧૦૪ સામુદ્રિક-ભૂષણમાંના છે ? જો એમ હોય તો એ માટે પ્રમાણ રજૂ થવું ઘટે. આ સંબંધમાં સ્વોપજ્ઞ વિવૃત્તિ તપાસવી ઘટે.

૬. જુઓ શ્લો. ૫૨.

૭. વસંતરાજે, રાજમૃગાંકે (શકસંવત્ ૮૬૪) અને નરપતિએ આનો ઉલ્લેખ કર્યો છે. વિશેષ માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૭૧-૧૭૨).

રચના-સમય—સામુદ્રિક-લહરી નામની સ્વોપજી 'વિવૃત્તિમાં વિ.સં. ૧૭૩૭ની સાલનું ઉદાહરણ P. ૨૧૬ છે. એ ઉપરથી મૂળ કૃતિ આ વર્ષની આસપાસમાં રચાયેલી મનાય છે.

સ્વોપજી ટિપ્પણ અને સામુદ્રિક-લહરી— મૂળ કૃતિને અંગે ગ્રંથકારે ટિપ્પણ રચ્યું છે અને એ બંનેના વિશદીકરણ માટે જીવરામ કવિના આગ્રહથી સામુદ્રિક-લહરી નામની ૩૮૦૦ શ્લોક જેવડી 'વિવૃત્તિ રચી છે. આ વિવૃત્તિમાં સામુદ્રિક-ભૂષણ અને શૈવ-સામુદ્રિક એ બે કૃતિઓનો પરિચય અપાયો છે. વિશેષમાં આ વિવૃત્તિમાં ૪૩ ગ્રંથોની સાક્ષી અપાઈ છે અને 'હસ્ત-બિંબ', 'હસ્તચિહ્ન-સૂત્ર, કરરેહાપયરણ (કરરેખા-પ્રકરણ), વિવેકવિલાસ મગરેનો ઉપયોગ કરાયો છે.

લોકકલ્પ (ઉ. ઈ. સ. પૂર્વે ૩૦૦)— આના કર્તા શ્રુતકેવલી 'સમન્તભદ્ર છે અને એમણે પોતાની ઈચ્છાથી આ શાસ્ત્ર વિદ્યાપ્રવાહ નામના પૂર્વમાંથી ઉદ્ભૂત કર્યું હતું એમ જિનદત્તસૂરિએ શકુનરહસ્યની પ્રશસ્તિમાં કહ્યું છે. એ લોકકલ્પ હજી સુધી તો અપ્રાપ્ય છે. એટલે એની રચના સંસ્કૃતમાં કરાઈ હશે કે કેમ તે જાવણું બાકી રહે છે. બાકી એના આધારે શકુનરહસ્ય રચાયું છે એટલે એ લોકકલ્પમાં શકુનનો તો અધિકાર હોવો જોઈએ એમ બેધડક કહી શકાય.

‘શકુન-શાસ્ત્ર

શકુન અને અપશકુનની માન્યતા જગજૂની જણાય છે. તેમ છતાં વિક્રમની તેરમી સદી સુધી કોઈ જૈન ગ્રંથકારે આ વિષયની સ્વતંત્ર ગણનાપાત્ર કૃતિ સંસ્કૃતમાં રચી હોય એમ જણાતું નથી.

નરપતિજયચર્યા (વિ. સં. ૧૦૧૨૩૨) — આના કર્તા ધારાના આમ્રદેવા પુત્ર જૈન ગૃહસ્થ નરપતિ P. ૨૧૭ છે એમણે અજયપાલના રાજ્યમાં અણહિલપુરમાં વિ. સં. ૧૨૩૨માં આ કૃતિ રચી છે. એમાં એમણે "સ્વરો ઉપરથી શકુન જોવાની અને ખાસ કરીને તો માંત્રિક યંત્રો વડે યુદ્ધમાં વિજય મેળવવા માટે શકુન જોવાની હકીકત આલેખી છે. આ પ્રમાણે જૈ. સા. સં. ઈ. (પૃ. ૩૩૫)માં કહ્યું છે. પરંતુ જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથોના આમુખ (પૃ. ૩૫-૩૬)માં નરપતિજયચર્યાના ટીકાકાર હરિવંશ કવિનું જે લખાણ રજૂ

૧. આને કેટલાંક 'ભાષ્ય' કહે છે અને એનું રેખા-શાસ્ત્ર એવું નામ રજૂ કરે છે. જુઓ "સંપાદકીય નિવેદન" (પૃ. ૧૭).
૨. આની ઈ. સ. ૧૬૮૦થી ૧૭૦૦ના ગાળામાં લખાયેલી એક હાથપોથીના નિર્દેશ માટે જુઓ "જૈ. સિ. ભા." (ભા. ૮, પૃ. ૨૫).
૩. જુઓ અ. ૩ શ્લો. ૧૮૭ની વિવૃત્તિ.
૪. આમાંથી ત્રણ ચિત્રો મેઘવિજયે ઉદ્દ્યુત કર્યા છે.
- ૫-૬. શું આ બે ગ્રંથો તેમજ સામુદ્રિક-ભૂષણ મળે છે ?
૭. ઉલ્લેખ વાસ્તવિક છે એમ માની મેં લોકકલ્પનો સમય દર્શાવ્યો છે.
૮. અભિ. ચિ.(કાંડ ૧, શ્લો. ૩૨-૩૩)માં જે છ શ્રુતકેવલી ગણાવાયા છે તેમાં એમનું નામ નથી.
૯. 'શકુન' એ સંસ્કૃત શબ્દ છે. એને ગુજરાતીમાં 'શકુન' તથા 'શકન' પણ કહે છે.
૧૦. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૩૩૫).
૧૧. આ ઉપરથી કેટલાક પ્રસ્તુત કૃતિને 'સ્વરોદય' કહે છે. આ નામની એક કૃતિ યશકીર્તિએ રચી છે તેમજ અન્ય કોઈએ પણ ગચી છે.

કરાયું છે તે આ પ્રસ્તુત કૃતિને અંગેનું જણાય છે અને એમ હોય તો નરપતિ એ નરદેવના પુત્ર છે. અને એમણે આશાપલ્લી (આધુનિક અમદાવાદ)માં પ્રસ્તુત કૃતિ રચી છે. આમુખ (પૃ. ૩૪-૩૫)માં જે અવતરણરૂપે સાત પદ્યો અપાયાં છે તે નરપતિજયચર્યાનાં હોય એમ જણાય છે. એમાં બ્રહ્મ-યામલ વગેરે સાત યામલનો ઉલ્લેખ છે અને એ વગેરેનો પ્રસ્તુત કૃતિમાં ઉપયોગ કરાયાનો ઉલ્લેખ છે.

‘શુકન-રહસ્ય’ (લ. વિ. સં. ૧૨૫૦)—આના કર્તા ‘વાયડ’ ગચ્છનાં જિનદત્તસૂરિ છે. એઓ અમરચન્દ્રસૂરિના અને અરિસિંહના ગુરુ થાય છે. એમણે ‘વિવેકવિલાસ વિ. સં. ૧૨૭૦ના અરસામાં રચ્યો છે. પ્રસ્તુત કૃતિ પદ્યમાં છે અને એ નવ પ્રસ્તાવમાં વિભક્ત છે.

વિષય— પ્રારંભમાં મંગલાચરણ છે. ત્યાર બાદ સંતાનના જન્મ, લગ્ન અને શયન સંબંધી શુકનો, પ્રભાતે જાગતી વેળાનાં, દાતણ અને સ્નાન કરતી વખતનાં, પરદેશ જતી વેળાનાં અને નગરમાં પ્રવેશ કરતી વેળાનાં શુકનો, વરસાદ સંબંધી પરીક્ષા, વસ્તુના મૂલ્યમાં વધઘટ, ઘર બાંધવા માટેની જમીનની પરીક્ષા, જમીન ખોદતાં નીકળતી વસ્તુઓનાં ફળ, સ્ત્રીને ગર્ભ નહિ રહેવાનાં કારણ, સંતાનોના અપમૃત્યુની ચર્ચા, ‘મોતી’, ‘હીરા વગેરે રત્નોના પ્રકાર અનુસાર તેનાં શુભાશુભ ફળ અને ગ્રંથકારની પ્રશસ્તિ એમ વિવિધ બાબતો આલેખાઈ છે.

આધાર— ‘શ્રુતકેવલી’ સમન્તભદ્રે રચેલા લોકકલ્પના આધારે આ પ્રસ્તુત કૃતિ યોજાઈ છે એમ પ્રશસ્તિમાં ઉલ્લેખ છે.

‘શકુનશાસ્ત્ર યાને શાકુનસારોદાર (વિ. સં. ૧૩૩૮) — આના કર્તા માણિક્યસૂરિ છે. એમણે આ કૃતિ ૧૧ વિભાગોમાં વિભક્ત કરી છે. એમાં ૫૦૭ શ્લોક છે. એની રચના વિ. સં. ૧૩૩૮માં કરાઈ છે. આની વિવિધ હાથપોથીઓ મળે છે.

શકુનશાસ્ત્ર સંબંધી આ ઉપરાંત કેટલીક કૃતિ નીચે મુજબ છે :—

શકુનદીપિકા— આ સ્વતંત્ર કૃતિ છે કે કોઈ કૃતિની વૃત્તિ છે તેમજ આના કર્તા જૈન છે કે કેમ એ પ્રશ્નો વિચારવાના રહે છે.

P. ૨૧૮ શકુનપ્રદીપ— આના કર્તા લાવણ્યશર્મા છે. શું એઓ જૈન છે ?

શકુનવિચાર— પત્તન.સૂચી (ભા. ૧, પૃ. ૮૦)માં આમાંથી અવતરણ અપાયું છે.

૧. આનું ગુજરાતી ભાષાંતર હીરાલાલ વિ. હંસરાજે કર્યું છે અને એ શુકનશાસ્ત્રના નામથી જામનગરથી ઈ.સ. ૧૮૯૮માં એમણે પ્રકાશિત કર્યું છે.

૨. મૂળ સંસ્કૃત કૃતિ પ્રસિદ્ધ થઈ હોય તો તે હજી સુધી મારા જોવામાં આવી નથી.

૩. આ કૃતિ પં. દામોદર ગોવિન્દાચાર્ય કરેલા ગુજરાતી ભાષાંતર સહિત બાલાભાઈ રાયચંદ અને દેવીદાસ છગનલાલ એ બે જણે મળીને વિ. સં. ૧૯૫૪માં પ્રસિદ્ધ કરી છે.

૪. આને અંગે મેં “મોતી: શુકનિયાં અને અપશુકનિયા” નામનો લેખ લખ્યો છે. એ હવે પછી પ્રસિદ્ધ થનાર છે.

૫. આના ૬૧ પ્રકારનાં ફળ મેં “હીરો કેવો લેશો ?” એ નામના મારા લેખમાં દર્શાવ્યાં છે. એ લેખ “હિંદુ મિલન મંદિર” (વ. ૮, અં. ૧૧, પૃ. ૫૩૦-૫૩૪)માં પ્રસિદ્ધ થયો છે.

૬. આ કૃતિ હીરાલાલ હંસરાજે ઈ. સ. ૧૯૧૭માં છપાવી છે.

શકુનસમન્નિશિકા— આ અજ્ઞાતકર્તૃક કૃતિ છે.

શકુનરત્નાવલિ યાને કથાકોશ— આના કર્તા અભયદેવના શિષ્ય વર્ધમાન છે.

શકુનાવલિ યાને બીજકૌસ્તુભ— આના કર્તા મહર્ષિ ગૌતમ છે. શકુનાવલિ નામની બીજ બે કૃતિ છે. એકના કર્તા હેમચન્દ્ર છે અને બીજાના કર્તાનું નામ જાણવામાં નથી.

આમ શકુન-શાસ્ત્ર સંબંધી વિવિધ કૃતિઓ છે. આજકાલ શકુન જોવાની પદ્ધતિ લુપ્તપ્રાય થયેલી જોવાય છે. બાકી એક વેળા એનો ખૂબ પ્રચાર હશે એમ “શકુનો દણ્ડનાયકઃ” અને લોકગીતમાંની નિમ્નલિખિત પંક્તિ જેવાં અવતરણો વિચારતાં જણાય છે :-

“ડાબી તે ભૈરવ રોઈ રહી.”

‘પંખીઓનો પરિચય, એના ભાવાભાવ અને ‘અવાજ વગેરે બાબતો શકુન-શાસ્ત્રમાં વિચારાયેલી જોવાય છે.

સ્વપ્ન-શાસ્ત્ર

સ્વપ્ન-શાસ્ત્ર (લ. વિ. સં. ૧૨૨૦) — આના કર્તા જૈન ગૃહસ્થ જગદેવ છે. એઓ દુર્લભરાજના પુત્ર થાય છે. એ જગદેવે સામુદ્રિકતિલક રચ્યું છે. એમનું આ ‘સ્વપ્ન-શાસ્ત્ર બે અધ્યાયમાં વિભક્ત છે. P. ૨૧૮ આ કૃતિનું નામ જ કહી આપે છે તેમ એનો વિષય સ્વપ્ન છે. પ્રથમ પ્રકરણમાં શુભ સ્વપ્નો વિષે અને બીજામાં અશુભ સ્વપ્નો વિષે વિચાર કરાયો છે.

સ્વપ્નસપ્તતિકાવૃત્તિ (વિ. સં. ૧૨૮૭)— જ. મ.માં કોઈએ સુમિણસપ્તરિયા (સ્વપ્ન-સપ્તતિકા) રચી છે. એના ઉપર ‘ખરતર’ ગચ્છના સર્વદેવસૂરિએ જેસલમેરમાં વિ. સં. ૧૨૮૭માં વૃત્તિ રચી છે. અને એ દ્વારા સ્વપ્નનો વિષય વિશદ બનાવ્યો છે.

સ્વપ્ન-પ્રદીપ યાને ‘સ્વપ્ન-વિચાર— આના કર્તા વર્ધમાનસૂરિ છે.

સ્વપ્નને અંગે અજ્ઞાતકર્તૃક કૃતિઓ નીચે મુજબ છે :-

‘સ્વપ્ન-ચિન્તામણિ, સ્વપ્ન-લક્ષણ, સ્વપ્ન-સુભાષિત, સ્વપ્નાધિકાર, સ્વપ્નાધ્યાય, ‘સ્વપ્નાવલી અને સ્વપ્નાષ્ટકવિચાર.

૧. એને વિષે જાણવા જેવી બાબતો કઈ કઈ છે તે વિષય મેં “પક્ષીઓના પરિચયની પ્રવેશિકા” નામના મારા લેખમાં ચર્ચ્યો છે. આ લેખ “ગુજરાતી”ના વિ. સં. ૨૦૦૮ના દીપોત્સવી અંકમાં તેમજ “ગુ. મિત્ર તથા ગુ. દ.”ના તા. ૧૭-૧૧-’-પરના અંકમાં પણ પ્રસિદ્ધ કરાયો છે.
૨. શિયાળની બોલી ઉપરથી ભવિષ્ય ભાખનારા ગામડાંઓમાં જોવાય છે.
૩. શું જગદેવે રચેલી સ્વપ્ન-ચિન્તામણિ નામની કૃતિ તે આ જ છે ?
૪. આને જ કેટલાક સ્વપ્ન-ચિન્તામણિ કહે છે.
૫. જિનપાલગણિએ ૮૭૫ શ્લોક જેવડી જે પાઈય કૃતિ રચી છે એનું સંસ્કૃત નામ સ્વપ્ન-વિચાર છે.
૬. શું આના કર્તા જગદેવે છે ?
૭. આમાં ૨૧ શ્લોક છે.

રમલ-શાસ્ત્ર

રમલ-શાસ્ત્ર (લ. વિ. સં. ૧૭૩૫)– આના કર્તા ચન્દ્રપ્રભા વગેરેના પ્રણેતા ઉપા. મેઘવિજય છે. એમણે મેઘમહોદયમાં આ કૃતિનો ઉલ્લેખ કર્યો છે. એમણે આ કૃતિ પોતાના શિષ્ય મેરુવિજય માટે સંસ્કૃતમાં રચી છે. આની કોઈ હાથપોથી હજી સુધી તો મળી આવી નથી પાસા ફેંકી ભવિષ્ય જોવાની P. ૨૨૦ વિદ્યાને ‘રમલ (ળ)’ કહે છે અને એના જાણકારને ‘રમલી(ળી)’ કહે છે. ભોજસાગરે તેમજ વિજયદેવે પણ એકેક રમલ-શાસ્ત્ર રચ્યું છે.^૧

પાશક-કેવલી– આના કર્તા ગર્ગાચાર્ય છે. “જૈ. સિ. ભા.” (ભા. ૧૨, કિ. ૨, પૃ. ૨૪)માં આના અંતમાંનાં બે પદો અપાયો છે. શું સમગ્ર કૃતિ સંસ્કૃતમાં છે ?

પાશક કેવલી– આના કર્તા સકલકીર્તિ છે.

અંગ-વિદ્યા

અંગચેષ્ટાવિદ્યા– આ શરીરનાં અવયવોની હિલચાલ ઉપરથી અને અંગોના સ્ફુરણ (ફરકવા) ઉપરથી ભવિષ્ય ભાખવાનો બોધ કરાવનારી કૃતિ હશે.

અંગસ્ફુરણ વિચાર– કયું અંગ ફરકે છે એ ઉપરથી બનનાર બનાવનો નિર્દેશ આ કૃતિમાં કરાયો હશે.

પ્રશ્નવિચાર

ચૂડામણિ ઇત્યાદિ– પણ્ડાવાગરણ (પ્રશ્નવ્યાકરણ) એ જ. મ.માં રચાયેલી લગભગ ૪૫૦ ગાથાની કૃતિ છે. એમાં પ્રશ્ન પૂછનારના મુખમાંથી નીકળેલા પ્રશ્નાક્ષરો ઉપરથી શુભાશુભ ફળનો નિર્ણય કરવાની સમજણ અપાઈ છે. એની એક તાડપત્રીય પ્રતિ પાટણના ભંડારમાં છે અને એના અંતમાં લીલાવતી નામની એક પ્રાચીન પાઈય વૃત્તિનો ભાગ જળવાઈ રહ્યો છે.

P. ૨૨૧ વૃત્તિઓ– પણ્ડાવાગરણ ઉપર ત્રણ વૃત્તિઓ છે :–

(૧) ચૂડામણિ– આ ૨૩૦૦ શ્લોક જેવડી કૃતિ છે.

(૨) લીલાવતી.

(૩) દર્શન-જ્યોતિર્વૃત્તિ– આને પ્રશ્નવ્યાકરણ-જ્યોતિર્વૃત્તિ પણ કહે છે.

ચન્દ્રોન્મીલન– આનો વિષય ચૂડામણિને લગતો છે. એ પણ્ડાવાગરણને આધારે રચાયેલી કૃતિ છે.^૨

ટીકા– આના ઉપર કોઈકની ટીકા છે.

૧. આનો બીજો અર્થ ‘પાંચ ધાતુના પાસા’ એવો થાય છે.

૨. આવો ઉલ્લેખ શ્રી અગરચંદ નાહટાએ “ઉત્તરભાવ યંત્ર સંબંધી એક મહત્ત્વપૂર્ણ જૈન ગ્રન્થ” નામના લેખ (પૃ. ૧૧૯)માં કર્યો છે. આ લેખ “જૈ. સિ. ભા.” (ભા. ૧૮, કિ. ૨, પૃ. ૧૧૯-૧૨૬)માં છપાવાયો છે.

૩. જૈ. ગ્રં. (પૃ. ૩૫૫)માં માતૃકા-કેવલી નામની એક સંસ્કૃત કૃતિનો ઉલ્લેખ છે.

૪. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૬૯-૧૭૦).

૫. જુઓ પત્તન-સૂચી (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૫૫).

તીર્થકેવલિપ્રશ્ન— ‘કન્નડ’ ટિપ્પણીથી અલંકૃત આ અજ્ઞાતકર્તૃક અપૂર્ણ કૃતિની ‘કન્નડ’ લિપિમાં લખાયેલી ૪૨ પત્રની એક હાથપોથીની નોંધ ક. તા. ગ્રં. (પૃ. ૨૭૪)માં લેવાઈ છે.

‘કેવલજ્ઞાનપ્રશ્નચૂડામણિ (લ. વિક્રમની બારમી-તેરમી સદી)— આના કર્તા દિ. સમન્તભદ્ર હોવાનું મનાય છે. આ પુસ્તકના વિદ્વાન સંપાદક પં. નેમિચન્દ્ર જૈનના મતે એ સમન્તભદ્ર આમમીમાંસાના કર્તાથી તો ભિન્ન છે. એઓ અષ્ટાંગ આયુર્વેદના પ્રણેતા હોવાની અને પ્રતિષ્ઠા તિલકના કર્તા નેમિચન્દ્રના ભાઈ વિજયના પુત્ર હોવાની સંભાવના સંપાદકે દર્શાવી છે.

‘જ્યોતિષશાસ્ત્રના ગણિત અને ફલિત એવા બે વિભાગ પડાય છે. ફલિત જ્યોતિષના વિવિધ પેટાવિભાગ છે. દા. ત. હોરાશાસ્ત્ર, સંહિતાશાસ્ત્ર, મુહૂર્ત શાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, પ્રશ્નશાસ્ત્ર ઇત્યાદિ. પ્રશ્નશાસ્ત્ર એ જ્યોતિષિનું મહત્વનું અંગ છે. જૈનોના— ખાસ કરીને ઠિગંબરોના જ્યોતિષના ગ્રંથોમાં પ્રશ્નગ્રંથો વિશેષ પ્રમાણમાં જોવાય છે.’

પ્રસ્તુત પુસ્તકમાં ‘ચન્દ્રોન્મીલન’ નામની પ્રશ્નપ્રણાલીનું વર્ણન નજરે પડે છે. આ ગદ્યાત્મક પુસ્તક ચન્દ્રોન્મીલનના સંક્ષેપરૂપ છે, પરંતુ સુબોધ છે. એમાં ‘આયપ્રશ્ન’ પ્રણાલી અને ‘કલ્પિતસંજ્ઞાલગ્ન’ પ્રણાલીની છાંટ જોવાય છે. અક્ષરોના વર્ગીકરણથી શરૂ થતા આ પુસ્તકમાં વિવિધ વિષયને અંગેના પ્રશ્નોને સ્થાન અપાયું છે. જેમ કે કાર્યની સિદ્ધિ, લાભાલાભ, ચોરાયેલી વસ્તુની પ્રાપ્તિ, પ્રવાસીનું આગમન, રોગનું નિવારણ અને મુકદ્દમાની સફળતા. વિશેષમાં મુષ્ટિ-પ્રશ્ન અને મૂક-પ્રશ્નોનો પણ અહીં વિચાર કરાયો છે. નષ્ટ જન્મપત્ર બનાવવાની રીત એ આ પુસ્તકનો મહત્વનો અંશ છે. સંપાદકના મતે એ રીત સર્વથા નવીન અને મૌલિક છે.”

કે. પ્ર. ચૂ.માં કોઈ કોઈ સ્થળે પ્રાચીન કૃતિમાંથી પાઈય ગાથાઓ ઉદ્ધૃત કરાઈ છે.”

ચન્દ્રોન્મીલનપ્રશ્ન— આ નિમિત્તશાસ્ત્રની કૃતિની કાગળ ઉપર ‘કન્નડ’ લિપિમાં સોળ પત્ર ઉપર લખાયેલી એક હાથપોથીની નોંધ ક. તા. ગ્રં. (પૃ. ૨૪૨)માં લેવાઈ છે. શું આ કૃતિ બૃહજ્જ્યોતિષાર્ણવનો ભાગ છે ?

૧. આ પુસ્તક પં. નેમિચન્દ્ર જૈનનાં હિન્દી અનુવાદ તથા વિસ્તૃત અને અનેક ચક્રો રજૂ કરનારા વિવેચન તેમજ પ્રસ્તાવના અને ત્રણ પરિશિષ્ટ સહિત “ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી ઈ. સ. ૧૯૫૦માં પ્રસિદ્ધ કરાયું છે. પ્રથમ પરિશિષ્ટમાં નક્ષત્ર, યોગ અને કરણનાં નામ અપાયાં છે અને જાતજાતનાં મુહૂર્તને લગતાં ચક્રો અપાયાં છે. બીજા પરિશિષ્ટમાં જન્મપત્રી બનાવવાની રીત વિસ્તારથી સમજાવાઈ છે. ત્રીજા પરિશિષ્ટમાં વર અને કન્યાને કેવો મેળ રહેશે તેનો વિચાર કરાયો છે.
૨. દિ. અક્લંકે સિદ્ધિવિનિશ્ચયના આઠમા પરિચ્છેદમાં સર્વજ્ઞની સિદ્ધિ કરવા માટે જ્યોતિષના જ્ઞાનના ઉપદેશને હેતુ તરીકે દર્શાવ્યો છે.
૩. ઠિગંબર સાહિત્યમાં રમલશાસ્ત્રને બદલે ‘પાશાકેવલી’ નામની પ્રણાલીનો પ્રચાર જોવાય છે. જુઓ ઉપર્યુક્ત હિન્દી પ્રસ્તાવના (પૃ. ૨૩)
૪. જુઓ હિન્દી પ્રસ્તાવના (પૃ. ૧૭)
૫. જુઓ હિન્દી પ્રસ્તાવના (પૃ. ૨૪)
૬. જુઓ પૃ. ૧૮, ૧૯, ૨૪, ૪૬, ૪૭, ૪૮ અને ૮૪.

આયજ્ઞાનતિલક (ઉ. વિ. સં. ૧૪૪૧)– આ નિમિત્તશાસ્ત્રની ૭૫૦ પદ્યની કૃતિના રચનાર વોસરિભટ્ટ છે. એઓ દામનંદિના શિષ્ય થાય છે. એમણે અણહિગલવાડમાં રચેલી આ કૃતિની એક હાથપોથી વિ. સં. ૧૪૪૧માં લખાયેલી મળે છે. આ કૃતિ પચ્ચીસ પ્રકરણોમાં વિભક્ત છે.

સ્વોપજ ટીકા– આ ૧૨૦૦ શ્લોક જેવડી છે.

આયતત્ત્વરાજવલ્લભ– આ રાજવલ્લભની કૃતિ છે. શું એ નિમિત્તશાસ્ત્રને લગતી છે ?

આયપ્રશ્ન– આની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૪૬)માં છે.

આયસદ્ભાવ– આ ૧૮૫ શ્લોક જેવડી અજ્ઞાતકર્તૃક કૃતિ છે.

વૃત્તિ– આ ૧૬૦૦ શ્લોક જેવડી છે.

‘ફલાફલવિષયક પ્રશ્નપત્ર (લ. વિ. સં. ૧૭૩૦)– આ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય યશોવિજયગણિની કૃતિ હોય એમ લાગે છે. એમાં ચાર ચક્ર છે અને દરેકમાં સાત સાત કોઠા (કોષ્ટકો) છે. વચલા કોઠામાં “ૐ હ્રીં શ્રીં અર્હં નમઃ” એવું લખાણ છે. આસપાસના છ છ કોષ્ટકો ગણતાં એકંદર ૨૪ કોષ્ટકો છે અને તે અનુક્રમે ઋષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ૨૪ તીર્થંકરોનાં નામથી અંકિત છે એટલે P. ૨૨૨ કે એ એકેક કોષ્ટક ઉપર એકેક તીર્થંકરનું નામ છે.^૧ આસપાસનાં ૨૪ કોષ્ટકો નિમ્નલિખિત ૨૪ પ્રશ્નો– ૨૪ બાબતની પૃચ્છા રજૂ કરે છે :–

૧. આ કૃતિની એક હાથપોથી યશોવિજયગણિના હસ્તાક્ષરવાળી મળે છે. એથી એઓ જ કર્તા હોવાનું મનાય છે. એ હાથપોથીમાં એક જ પત્ર છે. એની પહેલી પૃઠીમાં સાત સાત કોઠા (કોષ્ટક)વાળાં ચાર ચક્રો છે અને ઋષભદેવથી સુવિધિનાથ સુધીના નવ તીર્થંકરોનાં નામથી અંકિત છ છ ફલાદેશ અપાયા છે જ્યારે બીજી પૃઠીમાં બાકીના ફલાદેશ છે. પહેલી પૃઠીની પ્રતિકૃતિ સહિત સંપૂર્ણ કૃતિ “જૈ. સા. સં.” (ખંડ ૩, અ. ૨, પૃ. ૧૬૨-૧૬૫)માં વિ. સં. ૧૯૮૩માં પ્રકાશિત કરાઈ છે. ઉપર્યુક્ત પ્રતિકૃતિ પૃ. ૧૬૧ની સામે અપાઈ છે.
૨. પ્રથમ ચક્રનાં સાત કોષ્ટકો નીચે મુજબ છે :–

શ્રીપ્રવચન ૬ અવહાર પૃચ્છા	શ્રીઋષભ ૧ કાર્યસિદ્ધિ પૃચ્છા	શ્રીઅર્જિત ૨ મેઘવૃષ્ટિ પૃચ્છા
	ૐ હ્રીં શ્રીં અર્હં નમઃ	
	શ્રી ૩ સામાજિક પૃચ્છા	
શ્રીસુમતિનાથ ૫ ગ્રામાંતર પૃચ્છા		શ્રીસંપલ ૪ દેશસૌખ્ય પૃચ્છા

કાર્યની સિદ્ધિ, મેઘની વૃષ્ટિ, દેશનું સૌખ્ય, સ્થાનનું સુખ, ગ્રામાંતર, વ્યવહાર, વ્યાપાર, વ્યાજદાન, ભય, ચતુષ્પદ, સેવા, સેવક, ધારણા, બાધારુધા, પુરોધ (નગરનો ઘેરો), કન્યાદાન, વર, જયાજય, મંત્રોષધિ, રાજ્યની પ્રાપ્તિ, અર્થચિન્તન, સન્તાન, આગંતુક અને ગત વસ્તુ.

ઉપર્યુક્ત ૨૪ તીર્થકરો પૈકી દરેકના નામ ઉપર ફલાફલવિષયક છ છ ઉત્તરો છે. જેમકે P. ૨૨૩ ઋષભદેવના નામ ઉપર નીચે મુજબના ઉત્તરો છે :

“શીઘ્રં સફલા કાર્યસિદ્ધિર્ભવિષ્યતિ; અસ્મિન્ વ્યવહારે મધ્યમં ફલં દૃશ્યતે; ગ્રામાન્તરે ફલં નાસ્તિ, કષ્ટમસ્તિ; ભવ્યં સ્થાનસૌખ્યં ભવિષ્યતિ; મધ્યમં દેશસૌખ્યં ભવિષ્યતિ; અલ્પા મેઘવૃષ્ટિઃ સમ્ભાવ્યતે.”

૨૪ પ્રશ્નો અને ૧૪૪ ઉત્તરો સંસ્કૃતમાં છે; બાકી પ્રશ્નો કેમ કાઢવા અને તેનું ફલાફલ કેમ જાણવું એ બાબત એ સમયની ગુજરાતી ભાષામાં દર્શાવાઈ છે અને એ ગુજરાતી લખાણથી જ આ કૃતિની શરૂઆત કરાઈ છે. એ નીચે મુજબ છે :-

“ૐ હ્રીં શ્રીં અર્હં નમઃ” એણિ મન્ત્રઈ વાર ૨૧ સ્થાપના ષડી અથવા પૂગીફલ અભિમન્ત્રી મૂકાવીઈ । જેહ બોલની પૃચ્છા કરઈ તેહ થકુ જિહાં થાપનાં મૂંકઈ તેહના તીર્થકરની ફાટિં । પૃચ્છાના બોલ ગણતાં જેહ તીર્થકરની ફાટિં મૂંકઈ । તેહની તે ઓલી ગણવી । પં. શ્રીનયવિજયગણિશિષ્યગણિ-જસવિજયલિખિતં ।૧૭॥

ઉદય-દીપિકા (વિ. સં. ૧૭૫૨)- આના કર્તા ચન્દ્રપ્રભા વગેરે રચનારા ઉપા. મેઘવિજય છે. એમણે આ કૃતિ શ્રાવક મદનસિંહને માટે જ્યોતિષ સંબંધી પ્રશ્ન અને એના ઉત્તર રૂપે વિ. સં. ૧૭૫૨માં રચી છે. આની હાથપોથીઓ મળે છે.

પ્રશ્નસુંદરી (લ. વિ. સં. ૧૭૫૫)- આના પ્રણેતા પણ ચન્દ્રપ્રભા વગેરેના કર્તા ઉપા. મેઘવિજય છે. આ દ્વારા એમણે પ્રશ્ન કાઢવાની પદ્ધતિ વર્ણવી છે.

વર્ષ-પ્રબોધ યાને મેઘમહોદય (પૂ. વિ. સં. ૧૭૩૨)- આના પ્રણેતા ચન્દ્રપ્રભા વગેરેના કર્તા P. ૨૨૪ ઉપા. મેઘવિજય છે. આ ગ્રંથ સર્વથા સંસ્કૃત કે જ. મ.માં નથી, પરંતુ બંનેમાં એના અંશો છે. એ તેર અધિકારમાં વિભક્ત છે. એમાં વિવિધ વિષયો આલેખાયા છે. જેમકે ઉત્પાત, કર્પૂર-ચક્ર, પદ્મિની-ચક્ર-મંડળ, સૂર્ય-ગ્રહણ અને ચંદ્ર-ગ્રહણના ફળ, માસદીઠ વાયુનો વિચાર, વરસાદ લાવવાના અને બંધ કરવાના મંત્ર-યંત્ર, ૬૦ સંવત્સરોનાં ફળ, રાશિઓ ઉપર ગ્રહોના ઉદયનું, અસ્તનું કે વક્રીનું ફળ, અયન, માસ, પક્ષ અને દિવસનો વિચાર, સંક્રાંતિનું ફળ, વર્ષના રાજા અને મંત્રી વગેરે, વરસાદનો ગર્ભ, વિશ્વા, આયવ્યય, સર્વતોભદ્ર-ચક્ર અને વરસાદ જણાવનાર શુકન.

રચના-સમય-ઠાણ સાથે સંબંધ ધરાવનારો આ ગ્રંથ ક્યારે રચાયો તેનો ગ્રંથકારે સ્પષ્ટ ઉલ્લેખ

૧. આ કૃતિ મેઘમહોદય-વર્ષપ્રબોધ એ નામથી પં. ભગવાનદાસ જેને જયપુરથી હિન્દી અનુવાદ સહિત ઈ.સ. ૧૯૨૬માં પ્રસિદ્ધ કરી છે. આનો હિન્દી અનુવાદ એમણે કર્યો છે. એવી રીતે આનો ગુજરાતી અનુવાદ પોપટલાલ સાકરચંદ શહ તરફથી પ્રકાશિત થયો છે. આ બીજી આવૃત્તિનું નામ વર્ષપ્રબોધ અને અષ્ટાંગ નિમિત્ત છે.

કર્ચો નથી, પરંતુ વિજયપ્રભસૂરિના પટ્ટધર વિજયરત્નસૂરિના રાજ્યમાં રચ્યાનું એમણે કહ્યું છે. એથી એ વિ. સં. ૧૭૩૨ની પૂર્વનો નથી' એમ ફલિત થાય છે.

પૃ. ૧૨૦-૧૫૦ ગદ્યમાં છે. અને પૃ. ૧૩-૧૭નું લખાણ જ. મ.માં છે, પૃ. ૪૮૩માં રક્ષાપર્વનો ઉલ્લેખ છે.

સાક્ષીભૂત ગ્રંથો— વર્ષ-પ્રબોધમાં નિમ્નલિખિત ગ્રંથોનો સાક્ષી તરીકે ઉલ્લેખ કરાયો છે અને એમાંથી અવતરણો અપાયાં છે :-

૧. ૨૨૫ અર્ધકાણ્ડ (પૃ. ૨૨૯, ૩૫૫, ૩૮૪, ૪૬૦), *કુલક (પૃ. ૩૭૮), ગાર્ગીયસંહિતા (પૃ. ૨૭૧, ૪૧૫, ૫૦૩), *ચતુર્માસકુલક (પૃ. ૩૫૪, ૩૭૪), જગન્મોહન (પૃ. ૨૭૨), *જંબૂદ્વીપપ્રજ્ઞાપ્તિ (પૃ. ૮૮), *તિથિકુલક (પૃ. ૩૫૮, ૩૮૧), ત્રૈલોક્યદીપક (પૃ. ૧૭૮, ૩૮૨, ૪૬૦), નરપતિજયચર્યા (પૃ. ૨૧૭), બાલબોધ (પૃ. ૪૦૪, ૪૦૮, ૪૧૭), *ભગવતી (પૃ. ૪૪, ૬૩, ૬૫, ૬૭) અને એની વૃત્તિ (પૃ. ૪૬), *ભદ્રબાહુસંહિતા (પૃ. ૪૨૭), મેઘમાલા (પૃ. ૫૨, ૨૪૮, ૨૫૧, ૩૧૮) રુદ્રકૃત મેઘમાલા (પૃ. ૪૭, ૧૦૦, ૧૭૨, *૧૮૦, ૨૧૨, ૩૨૭), હીરવિજયસૂરિકૃત મેઘમાલા (પૃ. *૪૧, ૬૨ *૨૩૭, *૨૫૩, *૩૧૧, ૩૪૨, ૩૮૫, *૪૫૧), રત્નમાલા (પૃ. ૮૬), વારાહીસંહિતા (પૃ. ૪૮૫), વિવેકવિલાસ (પૃ. ૫, ૩૦), *સ્થાન (પૃ. ૨, ૩, ૮૮, ૧૮૮) અને એની વૃત્તિ (પૃ. ૪), દુર્ગદેવકૃત ષષ્ઠિસંવત્સર (પૃ. ૧૦૮) અને અજ્ઞાતકર્તૃક સારસંગ્રહ (પૃ. ૧૮૮, ૩૫૮, ૩૬૨).

આ પુસ્તકમાં નીચે મુજબના ગ્રંથકારોનાં નામ આપી એમની કૃતિમાંથી અવતરણો અપાયાં છે :-

કેવલકીર્તિ (દિ. (પૃ. ૩૧૨, ૪૨૩), ગિરધરાનંદ (પૃ. ૩૮૫), મેઘજી ઉપા. (પૃ. ૨૬૨, ૩૪૭), મેઘમાલાકાર (પૃ. ૧૦), રુદ્રદેવ (પૃ. ૩૦, ૨૧૨, ૩૩૭, ૩૬૭, ૪૧૦, ૪૨૩, ૪૨૪, ૫૦૧), વરાહ (પૃ. ૩૧૮, ૩૨૨, ૩૩૦, ૩૩૫, ૪૧૮), અને હીરસૂરિ (પૃ. ૨૫૮, ૨૬૦, ૨૮૮, ૨૮૨, ૩૪૦, ૪૬૦, ૪૬૧).

‘લૌકિક’ કે ‘લોક’ એવા ઉલ્લેખપૂર્વક ગુજરાતી પદો નીચે મુજબનાં પૃષ્ઠોમાં અપાયાં છે :-

૧. ૨૨૬ ૧૧, ૨૩૦, ૨૩૨, ૨૩૪, ૨૩૮, ૨૪૮, ૨૬૦, ૨૮૮, ૨૮૦, ૨૮૬, ૨૮૮, ૩૨૦, ૩૨૬, ૩૪૨, ૩૪૮, ૩૫૨, ૩૬૧, ૩૬૬, ૩૮૩, *૪૦૧, ૪૦૫, ૪૦૭, ૪૧૨, ૪૪૨, ૪૫૦, *૪૫૧, ૪૫૪, ૪૫૮, ૪૬૦, ૫૦૦.

૧. જિ. ર. કો. (ખંડ ૧, પૃ. ૩૪૪)માં રચના-વર્ષે ‘તરીકે વિ. સં. ૧૭૩૨ પછીનો’ એવો ઉલ્લેખ છે.

૨. આ પૃષ્ઠાંક ઉપર્યુક્ત (પૃ. ૨૨૪) ભગવાનદાસના પ્રકાશનના છે.

૩. આ ચિત્રથી અંકિત કૃતિ પાઈયમાં છે.

૩-૪. આ પૃષ્ઠો ઉપર બ્રાહ્મણ રુદ્રદેવ એવો ઉલ્લેખ છે.

૫. અહીં હીરમેઘમાલા એવો ઉલ્લેખ છે.

૬-૮. આ અવતરણ ગુજરાતીમાં છે. પૃ. ૪૫૫માં મેઘમાલામાંથી ગુજરાતી ઉતારો છે.

૧૦-૧૧. અહીં ‘ભુલુ’ એવો નિર્દેશ છે.

પંચાંગતત્ત્વ— પંચાંગ એટલે (૧) તિથિ, (૨) વાર, (૩) નક્ષત્ર, (૪) યોગ અને (૫) કરણ. આ પાંચ અંગોના નિરૂપણરૂપ આ કૃતિ હશે એમ માની મેં એની અહીં નોંધ લીધી છે.

વૃત્તિ— આ ૯૦૦૦ શ્લોક જેવડી વૃત્તિ અભયદેવસૂરિએ રચી છે.

પંચાંગતિથિવિવરણ— આ કરણશેખર કે કરણશેષ તરીકે ઓળખાવાતી કૃતિની ૧૯૦ શ્લોક જેવડી વૃત્તિ છે કે કેમ તેની તપાસ કરવી બાકી રહે છે.

પંચાંગદીપિકા અને પંચાંગપત્રવિચાર— આ બંને પંચાંગને લગતી કૃતિ હોય એમ લાગે છે.

‘યન્ત્રરાજ’ (વિ. સં. ૧૪૨૭)— આ મેદનસૂરિના શિષ્ય મહેન્દ્રસૂરિની શકસંવત્ ૧૨૯૨ની રચના છે. એ પાંચ પ્રકરણમાં વિભક્ત છે.

ટીકા— આના કર્તા મલયેન્દુ છે.

યન્ત્રરાજરચનાપ્રકાર— આના કર્તા સવાઈ જયસિંહ છે.

યન્ત્રામ્નાય— આ અજ્ઞાતકર્તૃક કૃતિ નિમિત્તશાસ્ત્રને લગતી છે ?

‘ઉત્તારલાવ’ યંત્ર (લ. વિ. સં. ૧૫૫૦) — આના કર્તા વિ. સં. ૧૫૩૬માં સારસ્વત-દીપિકા રચનારા મેઘરત્ન છે. એઓ ‘વટ’ ગચ્છના વિનયસુંદરના શિષ્ય થાય છે. એમણે પ્રસ્તુત કૃતિ ૩૮ શ્લોકમાં રચી છે. આ ખગોળશાસ્ત્રીઓને ઉપયોગી એક યંત્ર ઉપર પ્રકાશ પાડે છે. એ યંત્રને ઉર્દૂ-હિંદી-કોશમાં નક્ષત્ર-યંત્ર અને અંગ્રેજીમાં એસ્ટ્રોલાબે (Astrolabe) કહે છે. એનો પરિચય Encyclopaedia Britanica (Vol. II, pp. 574-575; 14th edn.)માં અપાયો છે.^૧ એ ઉપરથી આ ગ્રીક યંત્ર હોવાનું મનાય છે. એની શોધ હિપાર્કસે (ઈ. સ. પૂ. ૧૫૦) અથવા પેર્ગાના એપોલોનિયસે (ઈ. સ. પૂ. ૨૪૦)માં કરી હતી. એ યંત્ર આકાશી પદાર્થોની—બ્રહ્માદિની ઊંચાઈ (Altitude) માપવાના કામમાં લેવાતું હતું. એ ઉપરથી કાળ (સમય) અને અક્ષાંશનો બોધ થતો હતો.

ટીકા ઈત્યાદિ— આ લઘુ કૃતિ ઉપર સંસ્કૃતમાં ‘ટીકા’ છે અને ‘રાજસ્થાની’ ભાષામાં અનુવાદ છે.^૨

[અંગવિજ્ઞા— સં. મુનિશ્રી પુણ્યવિજયજી. પ્રા.ટે.સો. દ્વારા બે વાર પ્રકાશિત થયું છે.

ભારતીય જ્યોતિષ— નેમિચન્દ્ર શાસ્ત્રી, પ્રકા. ભારતીય જ્ઞાનપીઠ વારાણસી ૩૬મું સંસ્કરણ ઈ. સ. ૨૦૦૩.]



૧. આ કૃતિ એસ દ્વિવેદી અને એલ. શર્માએ બનારસથી ઈ. સ. ૧૮૮૩માં પ્રસિદ્ધ કરી છે.

૨. બિકાનેરના “અનૂપ-સંસ્કૃત-પુસ્તકાલય”માં આની વિ. સં. ૧૬૦૦માં લખાયેલી એક હાથપોથી છે. એનો પરિચય શ્રી અગરચંદ નાહટાએ “ઉત્તરલાવ યંત્ર સમ્બન્ધી એક મહત્ત્વપૂર્ણ જૈન ગ્રંથ” નામના લેખમાં આપ્યો છે. આ લેખ “જૈ. સિ. ભા.” (ભા. ૧૮, કિ. ૨ પૃ. ૧૧૯ ૧૨૬)માં પ્રકાશિત છે.

૩. આ લેખ ઉપર્યુક્ત લેખમાં મૂળ કૃતિના શ્લો. ૧, ૩, અને ૩૮ સહિત ઉદ્ધૃત કરાયો છે. એને અંગેનું શ્રીનેમિચન્દ્ર શાસ્ત્રીએ હિન્દીમાં લખેલું ટિપ્પણ સાથે સાથે છપાવાયું છે.

૪-૫. ઉપર્યુક્ત હાથપોથીમાં આ બંને છે, પરંતુ મૂળ કૃતિ અશુદ્ધ લખાયેલી છે.

પ્રકરણ ૧૩ : વૈદ્યકશાસ્ત્ર

વૈદ્યક-શાસ્ત્રનો બોધ કરાવવા જતાં જૈન મુનિવરો અચકાયા છે, કેમકે વનસ્પતિઓનાં ઉપમર્દન વગેરે કાર્યને એઓ આરંભસમારંભના કારણરૂપ-પાપરૂપ ગણે છે. આથી આ વિષયમાં 'જૈન કૃતિઓ ઓછી રચાઈ હોય એમ લાગે છે. ઇતર વિષયની જૈન કૃતિઓમાં વૈદ્યકવિષયક છૂટાછવાયા ઉલ્લેખો જોવાય છે. આગમિક સાહિત્યમાંના આવા ઉલ્લેખોની એક નોંધ મેં આગમોદ્ધારકની સહાયતાથી તૈયાર કરી છે પણ તે અત્યારે તો અપ્રકાશિત છે. આવી પરિસ્થિતિમાં આ વિષયની કેટલીક કૃતિઓ હું નોંધું છું :-

સિદ્ધાંત-રસાયન-કલ્પ (વિક્રમની છઠ્ઠી સદી) દિ. ઉગ્રાદિત્યકૃત કલ્યાણકારકના વીસમા પરિચ્છેદ (શ્લો. ૮૬)માં સમંતભદ્રે આયુર્વેદ-માંના આઠે અંગોનું પ્રતિપાદન કર્યાનો ઉલ્લેખ છે. કેટલાકને મતે આ સમંતભદ્રે સિદ્ધાંત-રસાયણ-કલ્પ નામનો વૈદ્યક-ગ્રંથ ૧૮,૦૦૦ શ્લોક જેવડો રચ્યો છે. એના છૂટાછવાયા શ્લોકો મળે છે. એ એકત્રિત કરાય તો બેથી ત્રણ હજાર જેટલા થાય. આ કૃતિમાં જૈન પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરાયો છે. આવા શબ્દોના સ્પષ્ટીકરણરૂપ એક કોશ અમૃતનંદિએ રચ્યો હતો, પરંતુ તે 'સમ-સત્તિ' સુધીનો જ મળે છે.

P. ૨૨૮ વૈદ્યક-ગ્રંથના પ્રણેતાઓ- ઉપર્યુક્ત કલ્યાણકારકના વીસમા પરિચ્છેદ (શ્લો. ૮૫)માં કહ્યું છે કે 'પૂજ્યપાદે શાલાક્ય(તંત્ર), પાત્રકેસરીસ્વામીએ શલ્યતંત્ર, સિદ્ધસેને વિષ અને ઉગ્ર ગ્રહની 'શમન-વિધિ, દશરથ, ગુરુએ કાય-ચિકિત્સા, મેઘનાદે બાલ-ચિકિત્સા અને સિંહનાદ મુનીન્દ્રે વૈદ્ય, વૃષ્ય અને દિવ્યામૃતનું કથન કર્યું છે.

વૈદ્યક-ગ્રંથ (પૂ. વિક્રમની છઠ્ઠી સદી) - આના કર્તા જૈનેન્દ્ર વ્યાકરણના પ્રણેતા દિ. પૂજ્યપાદ હોવાનું મનાય છે. આ વૈદ્યકગ્રંથ તે જ પૂ. ૧૭માં નોંધાયેલો વૈદ્યસાર છે. આનો સંક્ષિપ્ત પરિચય D C G C M (Vol. XVI, pt. 1, pp. 311-312)માં અપાયો છે.

નાડીપરીક્ષા- આ પૂજ્યપાદની કૃતિ છે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૧૦)માં ઉલ્લેખ છે. આથી બે પ્રશ્ન ઉદ્ભવે છે :-

(૧) શું આ ઉપર્યુક્ત પૂજ્યપાદ છે ?

(૨) શું આ કૃતિ ઉપર્યુક્ત વૈદ્યકગ્રંથનો ભાગ છે ?

૧. શ્રી. પી. કે. "ગોડેનો Some Notes on the Mss. of medical works by Jain writers" નામનો લેખ The Jaina Antiquary (Vol. XIII No.1)માં છપાવાયો છે.

૨. પુષ્પાયુર્વેદમાં ૧૮૦૦૦ જાતનાં પરાગ વિનાનાં પુષ્પોનો ઉલ્લેખ છે. જુઓ કલ્યાણકારકની હિંદી પ્રસ્તાવના (પૃ. ૩૮)

૩. આ આઠ અંગો તે કાય, બાળ, ગ્રહ, ઊર્ધ્વાંગ, શલ્ય, દષ્ટા, જરા અને વૃષ એ છે.

૪. એમનો સાદર ઉલ્લેખ ગુપ્તદેવ મુનિએ મેરુતંત્ર નામના વૈદ્યક-ગ્રંથના પ્રાયઃ પ્રત્યેક પરિચ્છેદના અંતમાં કર્યો છે.

૫-૭. કલ્યાણકારકના હિંદી અનુવાદ (પૃ. ૫૫૪)માં આ ત્રણના અર્થ અનુક્રમે (૧) અગદ-તંત્ર અને ભૂતવિદ્યા,

(૨) કૌમારભૂત્ય અને (૩) વાજકરણતંત્ર અને દિવ્ય-રસાયન-તંત્ર એમ કરાયા છે.

૮. આ "જૈ. સિ. ભા."માં કટકે કટકે છપાયો છે.

નાડીવિચાર— આ નામની બે અજ્ઞાતકર્તૃક કૃતિ છે. એકમાં ૭૮ પદ્યો છે અને એનો પ્રારંભ “નત્વા વીરં”થી થાય છે. એની એક હાથપોથીમાંથી પ્રારંભના બે પદ્ય અને અંતમાંનાં પાંચ પદ્યો પત્તન.સૂચી (ભા. ૧, પૃ. ૮૪)માં ઉદ્ધૃત કરાયાં છે. તમામ પદ્યો ‘અનુષ્ટુભ્’માં હશે એમ લાગે છે.

નાડીચક્ર અને નાડીસંચારજ્ઞાન— આ બેમાંથી એકેના કર્તાનું નામ જાણવામાં નથી. બીજી કૃતિનો ઉલ્લેખ બૃ. ટિ.માં છે એટલે એ પાંચેક સૈકા જેટલી તો પ્રાચીન ગણાય.

નાડીનિર્ણય (ઉ. વિ. સં. ૧૮૧૨)— આ અજ્ઞાતકર્તૃક અને મુખ્યત્વે પદ્યાત્મક કૃતિની ‘પાંચ પત્રની એક હાથપોથી (૧૦.૨ “×૪.૪”) ‘બૃહત્ ખરતર’ ગચ્છના પં. માનશેખરે મોટા અક્ષરે વિ. સં. ૧૮૧૨માં લખી છે. એમાં પ્રારંભમાં “શ્રીધન્વન્તરયે નમઃ” એવા ઉલ્લેખપૂર્વક **નાડીનિર્ણય** એવું કૃતિનું નામ અપાયું છે. પ્રારંભનાં બે પદ્યો નીચે મુજબ છે :-

“સ્નાયુર્નાડી નિશા હિંસા ધમેની ધારિણી ધરા ।
તન્તુકીજીવિતજ્ઞે ચ સરો પર્યાયવાચકા(ઃ) ॥૧॥
વાતં (તં) પિત્તં કફં દ્વન્દ્વં ત્રિપથં સન્નિપાતકમ્ ।
સાધ્યાસાધ્યવિવેકં ચ સર્વનાડી પ્રકાસ્ય(શ્ચ)તૈઃ ॥૨॥”

૪૧ પદ્યો પછી ‘નાડીપરીક્ષા’ સંપૂર્ણ થયાનો ઉલ્લેખ છે. ત્યાર બાદ અનુક્રમે જે વિષયો ચર્ચાયા છે તેનાં નામ અને એનાં પદ્યોની સંખ્યા નીચે મુજબ છે :-

મૂત્રપરીક્ષા (૪૬), તેલના બિન્દુ ઉપરની દોષપરીક્ષા (૧૪)નેત્રપરીક્ષા(૮૩), મુખપરીક્ષા (૨) જિહ્વાપરીક્ષા (૪) રોગોની સંખ્યા (૨૨) અને જીવરના પ્રકાર.

‘પુષ્પિકાની પૂર્વે “નાડિવીચાર સમાપ્ત” એવો ઉલ્લેખ છે. આથી ‘નાડીવિચાર’ નામ અભિપ્રેત હશે એમ લાગે છે.

નિદાનમુક્તાવલી— ‘નિદાન’ શબ્દના સાત અર્થ થાય છે. એ પૈકી નિમ્નલિખિત બે અર્થ અત્ર પ્રસ્તુત જણાય છે -

- (૧) રોગનાં કારણોની તપાસ (pathology).
- (૨) રોગ નક્કી કરવો તે યાને રોગની ઓળખ (diagnosis).

જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૧૨)માં પૂજ્યપાદે નિદાનમુક્તાવલી રચ્યાનું અને એની બાર પત્રની એક હાથપોથી હોવાનો ઉલ્લેખ છે. આ પૂજ્યપાદ અને એમની આ કૃતિ વિષે **નાડીપરીક્ષા** માટે પૃ. ૩૦૮માં પુછાયેલા બે પ્રશ્નો ઉદ્ભવે છે.

૧. પહેલા પત્રની પહેલી પૂંઠી અને છેલ્લાની બીજી પૂંઠી કોરી છે.
૨. આ હાથપોથી વ્યાકરણ-સાહિત્ય-તીર્થ મુનિશ્રી સૂર્યોદયવિજયજી પાસે જોવા મળી હતી.
૩. આ લખાણ ગદ્યમાં છે.
૪. આ નીચે મુજબ છે :-

“સંવત્ ૧૮૧૨ના માગસર વિદ દ્વતીયાતિથૌ શ્રીગરુવાસરે શ્રીવૃહત્સ્વતરગચ્છૈ વાંશ્રીપુન્યસારગણિ તત્શિષયં
નત્યભક્તિગણિતં પંચદ્યારશેન પં માનશેખર લિખ્યત્તઃ”

નિદાન— આના કર્તા જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૧૨) પ્રમાણે લક્ષ્મીધર છે.

મંગરાજે કે મંગુવિભુએ ૨૫૦૦ શ્લોક જેવડો કાનડીમાં રચેલો ખગેન્દ્રમણિ-દર્પણ ગ્રંથ આને આધારે યોજાયો છે.

કલ્યાણકારક (લ. વિ. સં. ૮૮૫)— આના કર્તા દિ. ઉગ્રાદિત્ય છે. એમાં ૨૫ પરિચ્છેદ છે. એ ૨૫મા પરિચ્છેદ પછી પરિશિષ્ટ-શિષ્ટાધ્યાય અને ‘હિતાહિત’ અધ્યાય છે. મધ, મદ્ય અને માંસની વાત બાજુએ રાખતાં ચિકિત્સાની બાબતમાં આ ગ્રંથ ચરકસંહિતા સાથે ઘણો મળતો આવે છે.

આયુર્વેદની જેમ અહીં પણ કાયથી માંડીને વૃષ ‘સુધીનાં આઠે અંગોનો વિસ્તારથી વિચાર P. ૨૨૯ કરાયો છે. ‘હિતાહિત’ અધ્યાયમાં માંસાહારનો નિષેધ કરતું લખાણ ગદ્યમાં અપાયું છે. વિશેષમાં શલ્યતંત્રનો વિષય સારી રીતે ચર્ચાયો છે. આઠ પ્રકારનાં શસ્ત્ર-કર્મ અને એના વિધાનનું નિરૂપણ વ્યવસ્થિત સ્વરૂપે અહીં કરાયું છે.

કલ્યાણકારકની રચનામાં પ્રાણાવાય નામના મહાગમનો—પૂર્વનો ઉપભોગ કર્યાનું જાતે કહ્યું છે.^૧ પરિ- શ્લો. ૧૮માં ‘વિદ્યા’ ઉપરથી ‘વૈદ્ય’ ઉદ્ભવ્યો છે એમ કહ્યું છે.

આત્મોત્તતિમાં શરીર મહત્ત્વનું સ્થાન ભોગવે છે એટલે આરોગ્ય જાળવવું જરૂરી છે. પરંતુ તેમ કરવા માટે અભક્ષ્ય કે હિંસાજન્ય દ્રવ્યનું સેવન કરતાં જરૂર વિચાર કરવો ઘટે એમ જૈનાચાર્યોનું — ઉગ્રાદિત્ય વગેરેનું માનવું અને કહેવું છે. આથી તો એમણે પ્રસ્તુત કૃતિમાં મધ, મદ્ય અને માંસનું સેવન ન કરવું પડે એવી ઔષધીઓ બતાવી છે.

રચના—સમય— ‘હિતાહિત’ અધ્યાયના લગભગ અંતમાં જે કેટલાંક પદ્યો છે તેમાંના એકમાં કહ્યું છે કે નૃપતુંગવલ્લભ મહારાજાધિરાજની સભામાં માંસાહારના પુરસ્કર્તાઓની સમક્ષ માંસાહારની નિષ્ફળતા સિદ્ધ કરી આ જૈનેન્દ્ર વૈદ્યે વિજય મેળવ્યો. આ ઉપરથી આ કલ્યાણકારકના કર્તા અમોઘવર્ષ પહેલાના સમકાલીન હોવાનું મનાય છે.

સમાનનામક કૃતિઓ— પૂજ્યપાદે અને કુમારસેને પણ આ નામની એકેક કૃતિ સંસ્કૃતમાં રચી છે, જ્યારે ચિત્રકવિસેને કાનડીમાં રચી છે.^૨

પરાશ્રયી કૃતિઓ— નાગાર્જુને રચેલી યોગરત્નમાલા^૩ નામની વૈદ્યકની કૃતિ ઉપર ગુણાકરસૂરિએ વિ. સં. ૧૨૯૬માં વૃત્તિ રચી છે. એવી રીતે વાચ્સ્પત્કૃત અષ્ટાંગહૃદય ઉપર દિ. આશાધરે અને વરરુચિકૃત યોગશત ઉપર પૂર્ણસેને વૃત્તિ રચી છે.

૧. આ કૃતિ શ્રી. વર્ધમાન પાર્શ્વનાથ શાસ્ત્રીનાં હિંદી અનુવાદ, પ્રસ્તાવના અને વનૌષધિ શબ્દાદર્શ (કોષ) સહિત “સખારામ નેમચંદ ગ્રંથમાલા”માં પુષ્પ ૧૨૯ તરીકે સોલાપુરથી ઈ. સ. ૧૯૪૦માં છપાવાઈ છે. આમાં વિસ્તૃત વિષયાનુક્રમણિકા છે.

૨. વૃષ-ચિકિત્સાથી વાજકરણ-ચિકિત્સા સમજવાની છે.

૩. સુશ્રુતસંહિતા (સૂત્ર-સ્થાન, અ. ૫, શ્લો. ૫)માં શસ્ત્રકર્મના છેદ્ય, ભેદ્ય ઇત્યાદિ આઠ પ્રકારો દર્શાવાયા છે.

૪. જુઓ પરિ. ૨૫, શ્લો. ૫૪.

૫. જુઓ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૭૯-૮૦).

૬. યોગરત્નમાલા માટે જુઓ D C G C M (Vol. XVI. pt. 1, Nos.170-174)

‘યોગ-ચિન્તામણિ વૈદ્યકસારસંગ્રહ કિંવા ‘વૈદ્યકસારોદ્ધાર (લ. વિ. સં. ૧૬૬૦)— આના કર્તા P. ૨૩૦ ‘નાગપુરીય તપા’ ગચ્છના ચંદ્રકીર્તિ-સૂરિના શિષ્ય ‘હર્ષકીર્તિસૂરિ છે. આ ગ્રંથમાં કિરંગ (syphilis)નું વર્ણન છે. એથી એ ભાવપ્રકાશ પછી રચાયેલાનું અનુમાનાય છે.

જૈ. ગ્રં. પ્રમાણે વૈદ્યકસારસંગ્રહ ૧૧૦ શ્લોક જેવડો છે અને વૈદ્યકસારોદ્ધાર ૮૦૦ શ્લોક જેવડો છે. જો આ હકીકત ખરી હોય તો આ બે ભિન્ન કૃતિ ગણાય.

‘વૈદ્યવલ્લભ (લ. વિ. સં. ૧૭૧૦)— આના કર્તા ‘હિતરુચિના શિષ્ય હસ્તરુચિ છે. એમણે આ કૃતિ આઠ અધ્યાયમાં વિભક્ત કરી છે. એમાં એમણે જ્વર, સ્ત્રીરોગ, કાસ, (ઉધરસ, ક્ષય વગેરે રોગો, ધાતુરોગ, અતિસારાદિ, કોઢ વગેરે, મસ્તક, કાન અને આંખના રોગો તેમજ સ્તંભન પર મુરાદિ-સાહિ ગુટિકા વગેરે વિષયો પર પ્રકાશ પાડ્યો છે.

‘યોગ-રત્નાકર વિ. સં. ૧૭૩૬)— આ કૃતિ અંચલ ગચ્છના જ્ઞાનશેખરના શિષ્ય નયનશેખરે P. ૨૩૧ વિ. સં. ૧૭૩૬માં ગુજરાતીમાં ચોપાઈમાં રચી છે. એનું પરિમાણ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૨૨) પ્રમાણે ૮૦૦૦ શ્લોકનું છે.

‘દ્રવ્યાવલી-નિઘંટુ— આના કર્તા મહેન્દ્ર છે. એમણે આ કૃતિ ૮૦૦ શ્લોક જેવડી રચી છે. આ નામ વિચારતાં એમ લાગે છે કે એ વનસ્પતિઓનો કોશ હશે.

૧. આ મુંબઈમાં ઈ. સ. ૧૮૬૮માં છપાવાયો છે. આ ગ્રંથનું સંપાદન પૂર્ણચન્દ્ર શર્માના ગુજરાતી રૂપાંતર સહિત મહાદેવ રામચન્દ્ર જાગુજેએ ઈ. સ. ૧૮૮૮માં કર્યું હતું. એની બીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૦૮માં છપાવાઈ હતી. મૂળ કૃતિનું મરાઠી અનુવાદ સહિત સંપાદન વી. જી. સાંડેકરે ખાનાપુરથી ઈ. સ. ૧૯૦૭માં કર્યું હતું. યોગચિન્તામણિ માટે જુઓ D C G C M (Vol. XVI, pt. 1, Nos. 158-161)

૨. જૈ. સા. સં. ઈ. (પૃ. ૫૯૩)માં આને યોગ-ચિન્તામણિથી ભિન્ન કૃતિ ગણી છે. જ્યારે જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૬૫)માં એને અભિન્ન ગણી છે.

૩. એમની અન્ય કૃતિઓ માટે જુઓ પૃ. 69 અને 127.

૪. પૂર્ણસેન્તૂતમસૂરિએ આ નામની કૃતિ રચી છે. એને વૃદ્ધયોગશતક પણ કહે છે ગૌડવંશતિલકે વૃદ્ધયોગશતક રચ્યું છે. આ બંને કૃતિ અજૈન હશે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૬૪)માં કહ્યું છે. તો એ વાત સાચી છે ? વૈદ્યવલ્લભ માટે જુઓ D C G C M (Vol. XVI, pt. 1, Nos. 281-283)

૫. ‘તપ’ ગચ્છના વિજયસિંહસૂરિના શિષ્ય ઉદયરુચિના શિષ્યનું નામ હિતરુચિ છે. એઓ જ અત્ર પ્રસ્તુત હશે. જો એમ જ હોય તો એમણે ષડાવશ્યક ઉપર વિ. સં. ૧૬૮૭માં વ્યાખ્યા રચી છે.

૬. આ નામનો ગ્રંથ મયૂરપાદ ભિક્ષુ નામના પ્રખ્યાત વૈદ્યે રચ્યો છે. યોગરત્નાકરના અંતિમ ભાગની કડી ૮૧-૮૬ જૈન ગૂર્જર કવિઓ (ભાગ ૨, પૃ. ૩૫૧-૩૫૨)માં અને એ અંતિમ ભાગની કડી. ૮૪-૮૦ અને ૮૭-૧૦૮એ પુસ્તક (ભા. ૩, ખંડ ૨, પૃ. ૧૩૨૫-૬)માં અપાઈ છે. યોગરત્નાકર નામની કોઈ અજ્ઞાતકર્તૃક કૃતિ પણ છે.

૭. માધવે દ્રવ્યાવલિ રચી છે. દ્રવ્યાવલીનિઘંટુ અને રસન્તામણિ (આ પ્રકાશિત છે) માટે જુઓ D C G C M (Vol. XVI, p. 1)ના અનુક્રમે ક્રમાંક .૧૦૫-૧૦૮ અને ૧૮૨-૧૮૩

વૈદ્યકકલ્પ અને વૈદ્યકસાર— આ બંનેની તાડપત્રીય પ્રતિ મળે છે પણ એના કર્તાનાં નામ જાણવામાં નથી.

સિદ્ધયોગમાલા— આ ૫૦૦ શ્લોકની કૃતિના પ્રણેતા સિદ્ધર્ષિ છે.

રસપ્રયોગ— આના કર્તા સોમપ્રભાચાર્ય છે. જિ. ર. કો. (ખંડ ૧, પૃ. ૩૨૯) પ્રમાણે એ વૈદ્યકનો ગ્રંથ છે. એમાં રસ વિષે નિરૂપણ તથા પારાના ૧૮ સંસ્કારનું વર્ણન હશે.

૧૨સચિન્તામણિ— અનંતદેવસૂરિએ ૮૦૦ શ્લોક જેવડી આ કૃતિ રચી છે.

માધરાજપદ્ધતિ— આ ૧૦૦૦૦ શ્લોક જેવડી કૃતિના કર્તા માધચન્દ્રદેવ છે.

P. ૨૩૨

સંદિગ્ધ કૃતિઓ

સિદ્ધસાર — શું આ વૈદ્યકને અંગેની જૈન કૃતિ છે ?

આયુર્વેદ-મહોદધિ— આ ૧૧૦૦ શ્લોક જેવડી કૃતિના કર્તા સુષેણ છે. શું એઓ જૈન છે ?

ચિકિત્સો (? ત્સો) ત્સવ— આ ૧૭૦૦ શ્લોક પ્રમાણ કૃતિના કર્તા હંસરાજ છે. શું એઓ જૈન છે ?

પ્રતાપકલ્પદ્રુમ— આ ૬૦૦૦ શ્લોક જેવડી કૃતિ પ્રતાપસિંહદેવે રચી છે. જિ. ર. કો.માં આની નોંધ નથી તો શું એના કર્તા અજૈન છે ?

યોગરત્નસમુચ્ચય— આ ૪૫૦ શ્લોક જેવડી કૃતિના કર્તાનું નામ જાણવામાં નથી. શું એઓ જૈન છે ?

વૈદ્યામૃત— આ ૨૦૦ શ્લોક જેવડી કૃતિ શ્રીધરદેવે રચી છે. શું એઓ જૈન છે ?

રત્નસાગર— આ શું વૈદ્યકની જૈન કૃતિ છે ? રત્નસાગર માટે જુઓ ઉપર્યુક્ત પુસ્તકનો ક્રમાંક ૧૯૧

રસરત્નદીપિકા— મલ્લરાજ મહીપતિની ૬૦૦ શ્લોક જેવડી આ રચના છે. શું એઓ જૈન છે ?

[રસરત્નસમુચ્ચય— કર્તા દેવચન્દ્રના શિષ્ય માણેક્યદેવ ૧૬મી સદીની આ રચનાનું પ્રકાશન પ્રાકૃતભારતી અકાદમીએ ઇ.સ. ૧૯૮૬માં જે.સી.સિકદરે સંપાદિત કર્યું છે.]

[લીલાવતીસાર— આ. જિનરત્નસૂરિ. સંપા. હરિવલ્લભ ભાયાણી. પ્રકા. લા. દ. વિદ્યામંદિર ઇ.સ. ૧૯૮૩.]

તત્ત્વાર્થસૂત્ર (અભિનવ ટીકા) દીપરત્નસાગર. પ્ર. અભિનવશ્રુત પ્રકાશન.

આરાધક વિરાધક ચતુર્ભંગી ઉપા. યશોવિજયજી વિવેચન પ્રવીણચંદ્ર મોતા પ્ર. ગીતાર્થ ગંગા.



૧. આ કૃતિ ભાષાટીકા સાથે વેંકટેશ્વર મુદ્રણાલયમાં છપાવાઈ છે. [વિશેષ માટે પૃ. ૧૪૩ ટિ. ૭ જુઓ.]

૨. શું આ દક્ષિણ ભારતમાં રચાયેલો નિબંધ છે ?

૩. આ નામની એક કૃતિ ત્રીસટના પુત્ર ચન્દ્રદેવે રચી છે.

૪. આ નામની એક કૃતિ માણિક્યભટ્ટના પુત્ર મોરેશ્વરે શકસંવત્ ૧૬૦૩માં રચી છે.

જૈન દષ્ટિએ જીવોના બે પ્રકાર છે : (૧) શરીરી ને (૨) અશરીરી શરીરી જીવોને દેહ હોવાથી એ ટકી રહે તે વાસ્તે-એનાથી જીવી શકાય તે માટે એને આહાર લેવો પડે છે. દરેક જાતના જીવનો આહાર એક-સરખો ન જ હોય તે સ્વાભાવિક છે. તેમાં યે મનુષ્ય બુદ્ધિશાળી પ્રાણી છે એટલે એ તો કેવળ આરોગ્યની જ દષ્ટિએ આહારનો વિચાર ન કરે પણ એમાં યે વિવિધતા અને મનોરમતા લાવવા મથે. આવા કોઈ પ્રયત્નના પરિણામે રસોઈની કળા ઉદ્ભવી અને વિકસી હશે. એને અંગેનું વ્યવસ્થિત ગ્રંથસ્થ લખાણ તે ‘પાકશાસ્ત્ર’ યાને ‘સૂપશાસ્ત્ર’ કહેવાય છે. આ જાતની કૃતિઓ ભિન્ન ભિન્ન ભાષામાં રચાયેલી મળે છે. સંસ્કૃત કૃતિઓ પૈકી ‘નલપાકદર્પણ’ અને ક્ષેમશર્માએ વિ. સં. ૧૬૦૫માં રચેલા ‘ક્ષેમકુતૂહલ’ ગણાવી શકાય. ગુજરાતીમાં પાકશાસ્ત્રને લગતી જાતજાતની કૃતિઓ છે.^૧ વળી જે જૈન સાહિત્ય કાનડીમાં રચાયું છે તેમાં સૂપશાસ્ત્ર સંબંધી કૃતિ છે. પરંતુ સંસ્કૃતમાં આવી કોઈ કૃતિ કોઈ જૈન ગૃહસ્થ-શ્રાવિકાએ પણ રચી હોય એમ જણાતું નથી. વસુદેવહિંડીમાં જે ‘પોરાગમ’ એવો ઉલ્લેખ છે તે શું પાકશાસ્ત્ર છે કે એના કોઈ એક અંગરૂપ વિષય સાથે સંબદ્ધ છે ? ગમે તે હો પણ એ સંસ્કૃતમાં છે કે કેમ અને એની રચના જૈનને હાથે થયેલી છે કે કેમ એ પ્રશ્ન તો ઊભા જ રહે છે.

શ્રી હિમાંશુવિજયજીના લેખો (પૃ. ૪૮૪-૪૮૮)માં પ્રગટ કરવા યોગ્ય ગ્રંથોની નોંધ મુનિ હિમાંશુવિજયજીએ આપી છે. તેમાંથી કેટલાક.....

અપશબ્દ ખંડન : કીર્તિચન્દ્ર (પાટણ), અપૌરુષેય-દેવનિરાકરણ યશોદેવ (પાટણ), એક સમયજ્ઞાન-દર્શનવાદ (કોડાય), દષ્ટાન્તદૂષણ (ડક્કન કોલેજ-પુના), નાસ્તિકનિરાકરણમ્ (લીંબડી), પંચદર્શનખંડન (કોડાય), વેદખંડન (પાટણ), વેદબાહ્ય નિરાકરણ : હરિભદ્રસૂરિ : (ડક્કન-પુના), દ્વિજવદનચપોટિકા : હેમચન્દ્રસૂરિ (લાલબાગ), સર્વજ્ઞવાદસ્થલ (ડક્કન-પુના), ધર્મોત્તર ટિપ્પણ : મલ્લવાદી : (જેસલમેર), મંગલપાદ : યશોવિજયજી, સિદ્ધાન્તતર્કપરિષ્કાર યશોવિજયજી, સ્યાદ્વાદમંજૂષા : યશોવિજયજી, પાંડિત્યદર્પણ : ઉદયચન્દ્ર : જેસલમેર, લીલાવતીસાર મહાકાવ્ય-જિનરત્નસૂરિહ (જેસલમેર), અલંકારવર્ણન : નરેન્દ્રપ્રભ (અમદાવાદ), કાવ્યામ્નાય-અમરચન્દ્ર, વાગ્ભટ્ટાલંકારવૃત્તિ-જિનપવર્ધન-કુમુદચન્દ્ર (અમદાવાદ) - રાજહંસોપાધ્યાય (અમદાવાદ), ઋષભોલ્લાસકાવ્ય (અમદાવાદ), કવિગુહ્યકાવ્ય-રવિધર્મ : (જેસલમેર), ચન્દ્રદૂતકાવ્ય જંબૂકવિ, નલોદયકાવ્ય રવિદેવ (ડક્કન-પુના), નેમિદૂત વિક્રમ (લિંબડી).

[વિશેષ યાદી પેજ નં : ૧૮૫ ઉપર]



૧. આ “ચૌખમ્ના સંસ્કૃત સિરીઝ”માં છપાયેલા છે.

૨. આ “આયુર્વેદીય ગ્રન્થમાળા”માં વૈદ જાદવજી ત્રિકમજીએ છપાવેલ છે. એનો સંક્ષિપ્ત પરિચય શ્રી દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીએ આયુર્વેદનો ઈતિહાસ (પૃ. ૨૨૭)માં આપ્યો છે.

૩. આની એક સૂચી મેં રસોઈનું રસાયણ નામના પુસ્તકના અવલોકનમાં આપી છે. એ અવલોકન “માનસી” (વ. ૧૦, અં. ૩)માં છપાયું છે.

પ્રકરણ ૧૫ : વિજ્ઞાન

‘વિજ્ઞાન’નો સામાન્ય અર્થ ‘વિશિષ્ટ જ્ઞાન’ એમ થાય છે. વળી આ શબ્દના બીજા પણ અર્થ કરાય છે : (૧) શાસ્ત્રીય જ્ઞાન, (૨) અનુભવ-જ્ઞાન અને (૩) બ્રહ્મજ્ઞાન. અહીં તો હું આ શબ્દ ભૌતિક-શાસ્ત્ર, રસાયન-શાસ્ત્ર, જીવ-શાસ્ત્ર, ભૂસ્તર-શાસ્ત્ર, ખનિજ-શાસ્ત્ર, ધાતુ-શાસ્ત્ર એમ વિવિધ વૈજ્ઞાનિક શાખાઓને અંગેના ગ્રંથો એ અર્થમાં વાપરું છું. અન્ય શબ્દોમાં કહું તો જેને અંગ્રેજીમાં સાયન્સ (science) કહે છે તેને લગતા ગ્રંથો એમ અહીં હું ‘વિજ્ઞાન’ શબ્દથી સૂચવું છું.

કલાકલાપ (લ. વિ. સં. ૧૨૮૦)— ચ. પ્ર. (પૃ. ૧૨૬)માં ‘વાયડ’ ગચ્છના જિનદત્તસૂરિના શિષ્ય અમરચન્દ્રસૂરિની કૃતિઓ ગણાવાઈ છે. એમાંની એકનું નામ અહીં કલાકલાપ એમ અપાયું છે અને એનો ‘શાસ્ત્ર’ તરીકે ઉલ્લેખ કરાયો છે. શું એમાં ૭૨ કે ૬૪ કળાઓનું નિરૂપણ હશે ? ક્ષેમેન્દ્રે કલાવિલાસ રચ્યો છે તેના જેવી આ કૃતિ હશે ? કલાકલાપની એકે હાથપોથી હજી સુધી તો મળી આવી નથી એટલે એ કૃતિના વિષય વિષે ખાતરીથી શું કહેવાય ?

મૃગ-પક્ષિ-શાસ્ત્ર (લ. વિ. સં. ૧૩૨૫)— આના કર્તા હંસદેવ છે. એઓ શૌંડદેવના આશ્રિત-કૃપાપાત્ર (protége) થાય છે. ઈ.સ.ની ૧૩મી સદીમાં વિદ્યમાન આ હંસદેવે બે ખંડમાં ૧૭૧૨ શ્લોકમાં આ કૃતિ રચી છે. પ્રાણિ-વિદ્યા (zoology)ના આ વિરલ પુસ્તકની એક હાથપોથી ત્રિવેન્દ્રમના “રાજમહેલ-પુસ્તકાલય”માં છે. આ પુસ્તકમાં પશુ-પંખીના આયુષ્ય વિષે ઉલ્લેખ છે. એની સંક્ષિપ્ત નોંધ “જૈ. સ. પ્ર.” (વ. ૮, અં. ૭, પૃ. ૩૪૦)માં લેવાઈ છે. અંગ્રેજી અનુવાદ— આ શ્રીસુન્દરાચાર્ય પ્રકાશિત કર્યો છે. જુઓ જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ (ભા. ૫) “લાક્ષણિક સાહિત્ય” (પૃ. ૨૫૦) આમાં અપાયેલી “સહાયક ગ્રંથોકી સૂચી”માં મારા ત્રણ પુસ્તકનો ઉલ્લેખ છે. તે પૈકી એક તે જૈ. સં. સા. ઈ. (ખંડ ૧) છે. બીજા બે પુસ્તકો તે આગમોનું દિગ્દર્શન અને પા. ભા. સા. છે. ઉપર્યુક્ત, ભા. ૫માં સંસ્કૃત ઉપરાંત પાઈય કૃતિઓનો પણ પરિચય અપાયો છે.

ગજ-પ્રબંધ, ગજ-પરીક્ષા યાને હસ્તિપરીક્ષા (લ. વિ. સં. ૧૨૧૫)— આના કર્તા જગદેવના પિતા દુર્લભરાજ હોવાનું મનાય છે. શું ૧૫૦૦ શ્લોક જેવડી જે કૃતિનો ઉલ્લેખ જૈ. ગ્રં. (પૃ. ૩૬૧)માં છે તે જ આ છે ? શું એમાં પાલકાપ્યના ‘હસ્ત્યાયુર્વેદ’નો ઉપયોગ કરાયો છે ?

તુરંગ-પ્રબંધ (લ. વિ. સં. ૧૨૧૫)— આના કર્તા જગદેવના પિતા દુર્લભરાજ હોવાનું મનાય છે.

૧. આ ભાગ “પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન” તરફથી સને ૧૯૬૯માં પ્રકાશિત થયો છે. એના લેખક પં. અંબાલાલ પ્રે. શાહ છે. [બૃહદ્ ઇતિહાસના સાતેય ભાગનું પુનર્મુદ્રણ એ જ સંસ્થા દ્વારા થયું છે. આ ભાગોનો ગુજરાતી અનુવાદ આ. સોમચન્દ્રસૂરિ મ. સા. ના માર્ગદર્શન મુજબ થઈ રહ્યો છે.]
૨. આમાં હાથીનાં લક્ષણ, વર્ણ, લગભગ ૧૮૦ રોગો અને એની ચિકિત્સા, હાથીના પાલન, એને પકડવાની રીત ઇત્યાદિ વિષે નિરૂપણ છે. આ ચાર સ્થાનમાં કુલ ૧૬૦ અધ્યાયમાં રચાયેલી કૃતિ પૂનાની “આનંદાશ્રમ ગ્રંથમાલા”માં પ્રસિદ્ધ કરાઈ છે.

શાલિ-હોત્ર— આ ઘોડા પારખવાની વિધાને અંગેની કૃતિ હશે. આ નામની ૧૩૮ શ્લોકની કૃતિ ભોજે રચી છે.

અશ્વાદિગુણ— આ નામથી એક કૃતિ જૈ. ગ્રં. (પૃ. ૩૬૧)માં નોંધાયેલી છે એમાં ઘોડા વગેરેના ગુણો વર્ણવાયા હશે. **શ્વ-શકુનાધ્યાય**— જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૦૦)માં આ કૃતિનું નામ શ્વાનશકુનાધ્યાય અપાયું છે. એ ઉપરથી મેં આ નામ યોજ્યું છે. આ કૃતિની નોંધ પત્તન.સૂચી (ભાગ ૧, પૃ. ૧૨૬)માં છે. આ કૃતિમાં ૨૨ પદો છે. એમાં કૂતરાની હિલચાલ ઉપરથી શુકન જાણવાની હકીકત અપાઈ છે.

શ્વાન-સમતિકા— આ નામની એક કૃતિ જૈ. ગ્રં. (પૃ. ૩૫૭)માં નોંધાયેલી છે. શું એ સંસ્કૃતમાં છે ?

શ્વ-રુદિત— જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૮૬)માં “શુનોરુત” નામની કૃતિની એક હાથપોથી સુરતના જૈનાનંદ પુસ્તકાલયમાં હોવાનો ઉલ્લેખ છે. એ હાથપોથી મેં જોઈ તો જણાયું કે એ એક પત્રની હાથપોથી છે અને એમાં ૨૫ પદો છે. એના પ્રારંભમાં “શ્રીશંખે(સ્વે)શ્વરા(૨)પાર્શ્વ નાથાય નમઃ” એમ છે. અંતમાં “इति शुनरुतं समाप्तं ॥श्री॥ छ ॥ श्री ॥” એવો ઉલ્લેખ છે.

પ્રારંભમાં આ કૃતિનું આદ્ય પદ નીચે મુજબ છે :—

P. ૨૩૬

“प्रस्थाने च प्रवेशे च स्वग(गृ)हाभ्यन्तरेऽपि वा।

शुना वै रुदितं चित्रं प्रवक्ष्याम्यनुपूर्वश(ः) ॥१॥”

આ કૃતિમાં પોતાના ઘરથી પ્રસ્થાન કે એમાં પ્રવેશ કરતી વેળા કૂતરાની પ્રવૃત્તિ કેવી છે તે ઉપરથી મળનારા ફળનો ઉલ્લેખ કરાયો છે. જેમ કે ગામમાં પેસતાં મનુષ્યના કરતાં પહેલાં જો કૂતરો પ્રવેશે તો એ મનુષ્યને ગામમાંથી ઈષ્ટ ભોજન અને સુખે નિવાસ મળે (શ્લો. ૩). જે વ્યક્તિને પ્રસ્થાનની વેળાએ કૂતરાનું મુખ માંસથી અથવા અન્ય ભક્ષ્યથી પૂર્ણ દેખાય તેને લાભ થાય અને એનું કાર્ય સિદ્ધ થાય (શ્લો. ૬). હરિત (લીલી વસ્તુ)ને મુખમાં રાખી કૂતરો દોડતો જોવાય તો રાજાની કૃપા અને ખ્યાતિ મળે અને ચિન્તવેલું કાર્ય સફળ થાય (શ્લો. ૧૩). પ્રસ્થાનના સમયે જો કૂતરો ડાબી બાજુથી જમણી બાજુ જાય તો પ્રસ્થાન દુઃખકર જાણી ન કરવું (શ્લો. ૧૫). જો કૂતરો અકાળે વિસ્વર અને તીક્ષ્ણ રુદન કરતો હોય તો મોટો ક્ષય ઉપસ્થિત થશે એમ જાણવું (શ્લો. ૨૦). મધ્યાહ્નના સમયે ગામમાં ઊંચું મુખ રાખીને કૂતરો રહે તો આગનો ભય રહે (શ્લો. ૨૧)

કાક-રુત— આ કૃતિની એક હાથપોથી અહીંના (સુરતના) જૈનાનંદ પુસ્તકાલયમાં હોવાનો ઉલ્લેખ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૩)માં છે. એ જોતાં જણાયું છે. કે આ લગભગ અઢીસો વર્ષ ઉપરની ગુજરાતી ભાષામાં લખાયેલી કૃતિ છે. એમાં કાગડાને ઉદ્દેશીને ત્રણ પિંડ બનાવી જાતજાતના પ્રશ્નોના ઉત્તર વિચારાયા છે.

ધનુર્વેદ—આ કૃતિની જૈ. ગ્રં. (પૃ. ૩૬૨)માં નોંધ છે.

૧. આ નામ મેં યોજ્યું છે.

૨. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૦૦)માં ૨૦ પાઈય પદોમાં રચાયેલી અને શ્વાનરુતશકુનવિચાર એવા નામાંતરવાળી શ્વાનરુત નામની કૃતિની નોંધ છે.

P. ૨૩૭ ધનુર્વિદ્યા અને એની વૃત્તિ— આ કૃતિઓ વિષે જૈ. ગ્રં. (પૃ. ૩૬૨)માં ઉલ્લેખ છે. શું આ બંને કૃતિ સંસ્કૃતમાં છે અને એના કર્તા જૈન છે ?

સમસ્તરત્નપરીક્ષા— આ નામ ઉપરથી એમ જણાય છે કે એમાં તમામ જાતનાં 'રત્નોની પરીક્ષાનું નિરૂપણ હશે. આ ૬૦૦ શ્લોક જેવડી કૃતિની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૬૩)માં છે. સંગ્રામસિંહે બુદ્ધિસાગરમાં રત્નાદિની પરીક્ષાનો વિષય ચર્ચ્યો છે.

રચણપરિક્ષા (લ. વિ. સં. ૧૩૭૦)— આ નામની એક કૃતિ ઠક્કર 'ફેરુએ 'કલિકાલચકવર્તી' અલાઉદ્દીન ખીલજના રાજ્યમાં પોતાના પુત્ર હેમપાલને બોધ કરાવવા માટે રચી છે. એ પ્રાકૃતમાં છે.

હીરક-પરીક્ષા— આ કોઈ દિગંબરે ૮૦ શ્લોક જેવડી રચેલી કૃતિનું નામ વિચારતાં એમ લાગે છે કે હીરાની પરીક્ષા કેમ કરવી એ બાબત આ કૃતિમાં ચર્ચાઈ હશે.

P. ૨૩૮ ધાઉપ્પત્તિ (ધાતૂત્પત્તિ) (લ. વિ. સં. ૧૩૭૫)— આના કર્તા ઠક્કર ફેરુ છે. શું આ કૃતિ સંસ્કૃતમાં છે ?

મધ્વી-વિચાર- જેસલમેરના ભંડારમાં આ કૃતિની હાથપોથી હોવાનો અને એમા તાડપત્ર તેમજ કાગળ ઉપર લખવા માટે કામમાં લેવાની શાહી (મધ્વી) કેમ બનાવવી એ હકીકત હોવાનો ઉલ્લેખ જૈ. ગ્રં. (પૃ. ૩૬૨)માં છે. આ સંબંધમાં કેટલીક માહિતી જૈન ચિત્ર કલ્પદ્રુમમાંનું વિદ્વદ્વલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીનું લખાણ (પૃ. ૩૭-૪૫) પૂરી પાડે છે.

લેખ-પદ્ધતિ— આની નોંધ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૩૮)માં છે.

લેખન-પ્રકાર—જૈ. ગ્રં. (પૃ. ૩૬૨)માં આ કૃતિ વિષે ઉલ્લેખ છે.

વિજ્ઞાન-ચંદ્રિકા વિજ્ઞાનાર્ણવ અને વિજ્ઞાનાર્ણવોપનિષદ્— આ ત્રણે કૃતિની નોંધ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૫૫)માં છે.

[સુવર્ણ-રુપ્યસિદ્ધિશાસ્ત્ર— સંપા. જે. સી. સિકદર. ઇ. સ. ૧૮૮૮. પ્રકા. પં. સુખલાલજી ગ્રંથમાલા.]



૧. કેટલાંક રત્નોનાં નામ અભિ. ચિ. (કાંડ ૪, શ્લો. ૧૨૮-૧૩૪)માં અપાયાં છે. શ્લો. ૧૨૮ની સ્વોપજા વિવૃત્તિમાં વાયસ્પતિના નામથી રત્નની આઠ જાતિ ગણાવાઈ છે : (૧) હીરો, (૨) મોતી, (૩) સુવર્ણ, (૪) રૂપું, (૫) ચન્દન (૬) શંખ, (૭) ચર્મ અને (૮) વસ્ત્ર. વિવિધ જાતનાં રત્નોનો—હીરા, મોતી વગેરેનો અનેક આકૃતિઓ અને ચિત્રો સહિત પરિચય જી. એફ. હર્બર્ટ સ્મિથકૃત (Gem-stones and their distinctive characters) નામના પુસ્તકમાં અપાયો છે. એની “મેથુએન એન્ડ કંપની લિમિટેડ” તરફથી લંડનથી બીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૧૩માં પ્રકાશિત કરાઈ છે.

૨. એમની અન્ય કૃતિઓ માટે જુઓ પૃ. ૧૮૪, ૧૮૬, ૧૮૮ અને ૨૩૮.

૩. આ કૃતિની નોંધ પ્રો. પિટર્સને એમના ચોથા હેવાલમાં લીધી છે. એનો ક્રમાંક ૧૫૦૪ છે.

૪. આ નામ મેં યોજ્યું છે.

‘નીતિ’ એ અનેકાર્થી શબ્દ છે. એના (૧) સદાચાર, (૨) આચરણને અંગેના નિયમો, (૩) ચાલચલગત, (૪) રાજનીતિ, (૫) પદ્ધતિ અને (૬) ધોરણ એમ વિવિધ અર્થ કરાય છે. આ પૈકી અંતિમ બે અર્થ તો અત્ર અપ્રસ્તુત છે.

આચરણના નિયમોનું શાસ્ત્ર તેમજ રાજનીતિનું શાસ્ત્ર પણ ‘નીતિશાસ્ત્ર’ કહેવાય છે. વ્યવહારકુશળતાને પણ એમાં સ્થાન છે. વિશેષમાં બોધદાયક મિતાક્ષરી વચ્ચેનો-વાક્યોનો-નીતિસૂત્ર (maxim)નો- ‘સુભાષિતોનો પણ આ નીતિશાસ્ત્રમાં સમાવેશ કરાય છે. આમ વિવિધ બાબતો ઉપર નીતિશાસ્ત્ર પ્રકાશ પાડે છે. એને અંગેની કૃતિઓ હવે આપણે વિચારીએ તે પૂર્વે એ વાત નોંધી લઈશું કે ‘ધર્મ’ એ અંગ્રેજી શબ્દ રીલિજિયન (religion) કરતાં વિશેષ વ્યાપક હોવાથી એમાં નીતિ (ethics)નો અંતર્ભાવ થાય છે, પરંતુ કેવળ નીતિમય જીવન એ કંઈ ધાર્મિક જીવન નથી એટલે કે નીતિને ધર્મ સાથે લેવાદેવા હોય જ એમ નહિ. તેમ છતાં નીતિમય જીવન જીવવું એ માનવતાના સોપાનનું પ્રથમ પગથિયું તો છે જ.

(૧) સામાન્ય નીતિ

P. ૨૪૦

‘પ્રશ્નોત્તરરત્નમાલા યાને ૩રત્નમાલિકા (ઉ. વિ. સં. ૯૦૦)– આ ૨૯ પદ્યોની કૃતિનો વિષય સામાન્ય નીતિ છે અને એ પ્રશ્ન અને ઉત્તર દ્વારા ઘણી સુગમ સંસ્કૃત ભાષામાં ચર્ચાયો છે. આના કર્તા ‘વિમલસૂરિ છે તો કેટલાકને મતે દિ. જિનસેનના અનુરાગી અમોઘવર્ષ છે.’ કેટલાક આને ‘બૌદ્ધ’ કૃતિ

૧. સુભાષિતો સદાચારના દ્યોતક અને પોષક છે. એને લગતા સંગ્રહને અંગ્રેજીમાં એન્થોલોજી (anthology) કહે છે. એમાં સૈકાઓનો અનુભવ મધુરી વાણીમાં વિશદ રીતે રજૂ કરાયેલો હોય છે.
૨. આ કૃતિ “કાવ્યમાલા” (ગુ. ૭)માં ઈ. સ. ૧૯૦૭માં (ત્રીજી આવૃત્તિ) છપાયેલી છે. દેવેન્દ્રકૃત ટીકા સહિત એ હીરાલાલ હંસરાજે જામનગરથી ઈ. સ. ૧૯૧૪માં છપાવી છે.
૩. જુઓ H I L (Vol. II, p. 559 fn.)
૪. કોઈ કોઈ એમને વીરસંવત્ ૫૩૦માં પઉમચરિય રચનારા વિમલસૂરિ માને છે. વળી કેટલાક ‘વિમલ’ને બદલે વિમલસૂરિ માને છે. વળી કેટલાક ‘વિમલ’ને બદલે વિમલચન્દ્ર નામ રજૂ કરે છે.
૫. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૫૨૦). અહીં કહ્યું છે કે તિબેટી અનુવાદમાં અમોઘવર્ષનું નામ છે. આ સંબંધમાં પં લાલચન્દ્ર ગાંધીએ “આચાર્ય શ્રીવિજય-વલ્લભસૂરિ સ્મારક ગ્રંથ.” (પૃ. ૫૭-૬૫)માં છપાયેલા એમના લેખનામે “શ્વેતાંબર ગુરુ વિમલસૂરિની પ્રશ્નોત્તરરત્નમાલા”માં વિરુદ્ધ મત દર્શાવ્યો છે. તેમ કરવા માટે એમણે નીચે મુજબનાં કારણ આપ્યાં છે :–
- (અ) પ્રશ્નોત્તરરત્નમાલાની ઘણી તાડપત્રીય હાથપોથીઓ પણ શ્વેતાંબરોના ભંડારોમાં જોવાય છે અને વિ. સં. ૧૨૨૩થી આ કૃતિના કર્તા શ્વેતાંબર વિમલ હોવાની પરંપરા જળવાઈ રહી છે.
- (આ) અમોઘવર્ષના નામવાળું પદ્ય આર્યાને બદલે અનુજુભમાં છે તે વ્યાજબી નથી.
- (ઈ) અમોઘવર્ષ દીક્ષા લીધા બાદ પોતાનો પૂર્વાવસ્થાના નામે–રાજા તરીકે ઉલ્લેખ કરે એ સમુચિત ન ગણાય.
- (ઈ) અમોઘવર્ષના નામવાળું પદ્ય કેટલું પ્રાચીન છે તેની તપાસ થવી ઘટે.
- (ઉ) પ્રશ્નોત્તરરત્નમાલાના ‘તિબેટી’ અનુવાદમાં અમોઘવર્ષનું નામ મળે છે એ માટે પ્રમાણ દર્શાવાયું નથી.

P. ૨૪૧ તો કેટલાક આને વૈદિક 'હિંદુઓની કૃતિ ગણે છે.^૨ એ ગમે તે હો, પણ એ ઉપરથી એ વાત ફલિત થાય છે કે આ કૃતિ સર્વમાન્ય-સર્વધર્મસંમત થઈ શકે તેવી છે અને થઈ છે. આના ઉપર નીચે મુજબનું વિવરણાત્મક સાહિત્ય છે :-

(૧) વૃત્તિ- આ ૨૧૩૪ શ્લોક જેવડી છે. એનો પ્રારંભ "ચન્દ્રાદિત્યમહૌષધી" થી થાય છે. એની રચના યશોધોષના શિષ્ય હેમપ્રભે વિ. સં. ભુવન-શ્રુતિ-રવિ એટલે ૧૨૭૩માં કરી છે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૭૬)માં ઉલ્લેખ છે. પં. લાલચન્દ્ર ગાંધીએ તો એમના લેખમાં વિ. સં. ૧૨૨૩નો ઉલ્લેખ કર્યો છે.

(૨) ટીકા- આ ૭૩૨૬ શ્લોક જેવડી ટીકાના કર્તા 'રુદ્રપલ્લીય' ગચ્છનાં સંઘતિલકના શિષ્ય દેવેન્દ્ર છે. એમણે આ ટીકા વિ. સં. ૧૪૨૮માં રચી છે અને પ્રત્યેક પ્રશ્નને અંગે એકેક કથા આપી છે.

(૩) વૃત્તિ- આ મુનિભદ્રે રચી છે. HIL (Vol. II, p. 559, fn.) માં મણિભદ્રનો ઉલ્લેખ છે તે શું સાચો છે ?

(૪) ટીકા- આના કર્તાનું નામ જાણવામાં નથી.

રૂપાંતર-ભવ્યોત્તમ મુનિએ આ પ્રશ્નોત્તર-રત્નમાલાનું રૂપાંતર પાઈયનું કર્યું છે.^૪ શાઈફનર P. ૨૪૨ (Schieffner) દ્વારા તિબેટી રૂપાંતર તિબેટીમાં અને જર્મનમાં સંપાદિત કરાયું છે.^૫ ઈ. સ. ૧૮૬૭માં 'ફ્રેન્ચ અનુવાદ છપાયો છે.^૬

સમાનનામક કૃતિ- ઉત્તમર્ષિની એક કૃતિનું નામ પ્રશ્નોત્તર-રત્નમાલા છે.

નીતિશાસ્ત્ર (લ. વિ. સં. ૧૩૦૦)- આના કર્તા તિલકપ્રભસૂરિ છે. એઓ 'પૂર્ણિમા' ગચ્છના દેવસૂરિના શિષ્ય થાય છે. એમણે સુભાષિતાવલી રચી છે. આ બંને કૃતિનો ઉલ્લેખ અજિતપ્રભસૂરિએ વિ. સં. ૧૩૦૭માં રચેલા શાંતિનાથચરિત્રની પ્રશસ્તિ (શ્લો.)માં કર્યો છે. ઉપર્યુક્ત તિલકપ્રભસૂરિએ આ નીતિશાસ્ત્ર રચ્યું તે પૂર્વે ભાવનાસાર રચ્યો હતો.

‘નીતિધનદ’ (વિ. સં. ૧૪૮૦)- આના કર્તા ધનદ છે. એમને ધન્યરાજ અને ધનરાજ પણ

૧. કેટલાક આ કૃતિના કર્તા તરીકે શુક યતીન્દ્રનો ઉલ્લેખ કરે છે.

૨. જુઓ (HIL (Vol. II pp. 557-560) મંજૂશ્રી, ગણેશ અને મહાવીર'ને ઉદ્દેશીને પણ મંગલાચરણો જોવાય છે. કોઈકે કર્તા તરીકે શંકરાચાર્યનો ઉલ્લેખ કર્યો છે.

૩. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૨૪૦.

૪. પવોલિનિએ કરેલું પાઈઅ રૂપાંતર GSAI (II pp. 153-163)માં છપાયું છે.

૫. એ રૂપાંતર પેટ્રોપોલીથી ઈ. સ. ૧૮૫૮માં પ્રસિદ્ધ થયું છે.

૬. Indische Streifen (I, pp. 210. ff) માં બે રૂપાંતરોના જર્મન અનુવાદો પ્રસિદ્ધ થયા છે. શ્લો. ૮, ૧૦, ૨૬ અને ૨૭નો વિન્તર્નિસે કરેલો અંગ્રેજી અનુવાદ HIL (Vol. II, pp. 559-560)માં અપાયો છે.

૭. "Indian Historical Quarterly (V, p. 1431)માં ઈ. સ. ૧૮૨૮માં વિધુશેખર ભટ્ટાચાર્યનો લેખ છપાયો છે.

૮. આ તેમજ શૃંગાર-ધનદ અને વૈરાગ્ય-ધનદ એ ત્રણે શતકો "કાવ્યમાલા" (ગુ. ૧૩)માં ઈ. સ. ૧૮૧૬માં મુદ્રિત થયાં છે.

૯. આ કૃતિને જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૧૬)માં નીતિ-શતક કહી છે.

કહે છે. મંડન મંત્રીના કાકા 'દેહડના પુત્ર થાય છે. એમની માતાનું નામ ગંગાદેવી હતું. આ ધનદે P. ૨૪૩ ભર્તૃહરિકૃત શતકત્રયની પેઠે ત્રણ શતકો રચ્યાં છે. એને ધનદ-ત્રિશતી તરીકે ઓળખાવાય છે. આ પૈકી એક શતક તે નીતિ-ધનદ છે, અને બીજાં બે તે શૃંગાર-ધનદ અને વૈરાગ્ય-ધનદ છે. નીતિ-ધનદ નામની કૃતિ મંડપદ્યુર્ગમાં વિ.સં. ૧૪૮૦માં રચાયેલી છે. એમાં ધનદે પોતાનો પરિચય આપ્યો છે. સાથે સાથે એમાં એમણે જિનભદ્રસૂરિનું સ્મરણ કર્યું છે.

નીતિશાસ્ત્ર (લ. વિ. સં. ૧૫૩૦)— આ ધર્મશ્રેણીની કૃતિ છે. એની એક હાથપોથી વિ. સં. ૧૫૩૪માં લખાયેલી મળે છે.

નીતિસાર— આ ૧૧૩ પદ્યની કૃતિના રચનાર દિ. ઈન્દ્રનંદિ છે. 'ઈન્દ્રનંદિ' શબ્દ આના આદ્ય પદ્યમાં છે. અંતિમ પદ્ય કર્તાની પ્રશંસારૂપ છે તો એ કર્તાના કોઈ ભક્તે ઉમેર્યું હશે. ૭૦મા પદ્યમાં પ્રભાચન્દ્ર તેમજ નેમિચન્દ્રનો ઉલ્લેખ છે.

નીતિસારસમુચ્ચય— આના કર્તાનું નામ કુંદકુંદાર્ય છે.

નીતિ-રસાયણ— આના કર્તા શુભચન્દ્ર છે. શું એમણે જ વિ. સં. ૧૬૦૮માં પાંડવ-પુરાણ રચ્યું છે ?

નીતિગ્રન્થ— આ અજ્ઞાતકર્તૃક કૃતિ છે.

નીતિસાર— પ્રભાચન્દ્રે તેમજ સમયભૂષણે આ નામની એકેક કૃતિ રચી છે.

સજ્જન-ચિત્ત-વલ્લભ— આ સામાન્ય નીતિને લગતી ૨૫ પદ્યોની કૃતિના કર્તા મલ્લિષેણ છે. ત્રીજા પદ્ય ઉપરથી એઓ દિ. હોય એમ લાગે છે. એ પદ્યમાં મલ્લિષેણનો ઉલ્લેખ છે.

ટીકા— આ લઘુ કૃતિના ઉપર કોઈકની ટીકા છે. અભિનવ શ્રુતમુનિએ કાનડીમાં આ મૂળ કૃતિની ટીકા રચી છે.

રત્નમાલા— આ સદાચારને અંગેની ૬૭ શ્લોકની કૃતિ છે. એ દિ. સમંતભદ્રના શિષ્ય P. ૨૪૪ શિવકોટિની રચના છે. એના સંપાદકના મતે આ કૃતિના પ્રણેતા આરાહણાના કર્તાથી ભિન્ન છે, કેમકે શ્લો. ૨૨, ૬૩ અને ૬૪ એ આરાહણામાંના નિરૂપણથી ભિન્ન મત દર્શાવે છે. વિશેષમાં એમણે કહ્યું છે કે શ્લો. ૬૫ યશસ્તિલકમાંથી ઉદ્ધૃત કરાયો હશે.

(૨) સુભાષિતો

સૂક્તિસમુચ્ચય (લ. વિ. સં. ૧૦૨૫)— આના કર્તા યશસ્તિલક (વિ. સં. ૧૦૧૬), નીતિવાક્યામૃત 'વગેરે રચનારા દિ. સોમદેવસૂરિ હોવાનું કેટલાક માને છે.

૧. એઓ ગુર્જર પાદશાહનો ગર્વ તોડનારા ધોરી આલમશાહના મંત્રી થાય છે. એમણે 'ખરતર' ગચ્છના મુનિઓ પાસેથી તીર્થંકરોનાં ચરિત્રો સાંભળી તત્વોપદેશ પ્રાપ્ત કર્યો હતો.

૨. આ 'મા. દિ. ગ્રં.'માં ગ્રંથાંક ૧૩ નામે "તત્ત્વાનુશાસનાદિસંગ્રહ"માં પૃ. ૫૮-૬૯માં વિ. સં. ૧૯૭૫માં છપાવાયો છે.

૩. આ નામની એક કૃતિ પં. નેમિદાસે રચી છે.

૪. આ "મા. દિ. ગ્રં."માં ગ્રંથાંક ૨૧માં વિ. સં. ૧૯૭૯માં છપાવાઈ છે.

૫. જુઓ પૃ. 161.

‘સુભાષિત-રત્ન-સન્દોહ (વિ. સં. ૧૦૫૦)– આના કર્તા દિ. ‘અમિતગતિ બીજા છે. એઓ ‘માથુર’ સંઘના માધવસેનના શિષ્ય અને ‘નેમિષેણના પ્રશિષ્ય થાય છે.’ એમણે ‘આરાધના, ‘ઉપાસકાચાર યાને P. ૨૪૫ શ્રાવકાચાર ‘ભાવના-દ્વાત્રિંશતિકા, ‘ધર્મપરીક્ષા, ‘પંચસંગ્રહ અને ૧૨૧ પદ્યનો ‘સામાયિક-પાઠ પણ રચ્યાં છે. પ્રસ્તુત કૃતિ એમણે ૮૨૨ પદ્યોમાં ૩૨ પ્રકરણોમાં વિભક્ત કરી વિ. સં. ૧૦૫૦માં રચી છે. આપ્તનું સ્વરૂપ વિચારતી વેળા વૈદિક હિંદુઓના દેવોની કડક સમાલોચના રદમા પ્રકરણમાં કરાઈ છે. વિશેષમાં અંતમાં ૨૧૭ પદ્યો દ્વારા શ્રાવકોના ધર્મ વિષે નિરૂપણ કરાયું છે અને એ રીતે શ્રાવકાચારની આ નાની આવૃત્તિ ગણાય. સ્ત્રીઓના ગુણો અને દોષો, ઇન્દ્રિયોનો નિગ્રહ વગેરે બાબતો આ કૃતિમાં આલેખાઈ છે.

‘હેમચન્દ્ર-વચનામૃત (લ. વિ. સં. ૧૨૨૦^{૧૧})– આ રચના ‘કલિ.’ હેમચન્દ્રસૂરિએ વિ. સં. ૧૨૨૦ની આસપાસમાં રચેલા ત્રિષષ્ટિના દસે પર્વમાંથી ચૂંટી કાઢેલાં વચનામૃતોના સંગ્રહરૂપ છે. આ

૧. આની બીજી આવૃત્તિ “કાવ્યમાલા” (ગુ.)માં ઈ. સ. ૧૮૦૮માં છપાઈ છે. આ મૂળ કૃતિ હિંદી અનુવાદ સહિત “હરિભાઈ દેવકરજી જૈન ગ્રંથમાલા”માં ગ્રંથાંક ૩ તરીકે છપાઈ છે. વળી આ કૃતિ આર. શિમટ અને હર્ટલ એ બેના સંયુક્ત જર્મન અનુવાદ સહિત ZDMG માં બે કટકે ઈ.સ. ૧૮૦૫ અને ઈ. સ. ૧૮૦૭માં Vol. 59 માં અને 61 માં છપાઈ છે. સુભાષિતરત્નસંદોહના નામથી મૂળ કૃતિ, એના દયાળજી ગંગાધર ભણસાળીએ શરૂ કરી લગભગ પૂર્ણ કરેલા અને છેલ્લાં સો એક પદ્યોના ભોગીલાલ અમરતલાલ જવેરીએ કરેલા ગુજરાતી ભાષાંતર સહિત હીરજી ગંગાધર ભણસાળીએ વિ. સં. ૧૮૮૮માં પ્રકાશિત કરી છે. મૂળ કૃતિ અશુદ્ધ છપાઈ છે.
૨. “આચાર્ય અમિતગતિ” એ નામનો પં. નાથૂરામ પ્રેમીનો લેખ જૈ. સા. ઈ. (પૃ. ૧૭૨-૧૮૨)માં છપાયો છે.
૩. એમના ગુરુ તે ‘વીતરાગ’ અમિતગતિ યાને અમિતગતિ પહેલા છે. એ અમિતગતિ વીરસેનના શિષ્ય દેવસેનના શિષ્ય થાય છે. એ અમિતગતિ પહેલાએ યોગસાર-પ્રાભૃત રચ્યું છે એમ કેટલાક કહે છે.
૪. એમની શિષ્ય-પરંપરા નીચે મુજબ છે :-
શાન્તિષેણ, અમરસેન, શ્રીષેણ, ચન્દ્રકીર્તિ અને વિ. સં. ૧૨૪૭માં ‘અપભ્રંશ’માં છક્કમોવએસ રચનાર અમરકીર્તિ.
૫. આ વિજયોદયા અને દર્પણની સાથે છપાઈ છે.
૬. આ કૃતિ “અનંતકીર્તિ દિગંબર જૈન ગ્રંથમાલા”માં વિ. સં. ૧૮૭૮માં છપાઈ છે.
૭. આને સામાયિકપાઠ પણ કહે છે. આ ૩૩ પદ્યની કૃતિ “મા. દિ. ગ્રં.”માં ગ્રંથાંક ૧૩માં પૃ. ૧૩૨-૧૩૭માં વિ. સં. ૧૮૭૫માં છપાઈ છે.
૮. આ કૃતિ હિન્દી અનુવાદ સહિત ઘણાં વર્ષો ઉપર છંપાઈ છે.
૯. આ “મા. દિ. ગ્રં.”માં ગ્રંથાંક ૨૫ તરીકે ઈ.સ. ૧૮૨૭માં છપાયો છે.
૧૦. આ કૃતિ “મા. દિ. ગ્રં.”માં ગ્રંથાંક ૨૧ નામે “સિદ્ધાન્તસારાદિસંગ્રહ”માં ૧૭૦-૧૮૧માં વિ. સં. ૧૮૭૮માં છપાઈ છે.
૧૧. આ કૃતિ ‘વિજયધર્મસૂરિગ્રંથમાલા’માં પુસ્તક ૩૬ તરીકે વિ. સં. ૧૮૮૩માં પ્રકાશિત થયેલી છે. આમાં બે અનુક્રમણિકાઓ અપાઈ છે. પહેલીમાં પર્વ અને સર્ગના ક્રમાંક અપાયા છે અને બીજીમાં વિષયનો ઉલ્લેખ માનનીય-વર્ગ, કુટુંબ-વર્ગ, રાજ-વર્ગ, દ્વન્દ્વ-વર્ગ, ગુણિ-વર્ગ, અવગુણિ-વર્ગ ઈત્યાદિ વર્ગો પાડીને કરાયો છે. વિશેષમાં એને દેવ-કાંડ (૪૮), માનવ-કાંડ (૪૭૬), તિર્યક્-કાંડ (૬૫) અને અજીવ-કાંડ (૩૨૪) એમ ચાર કાંડમાં વિભક્ત કર્યા છે. અહીં ૪૮ ઈત્યાદિ વચનોની સંખ્યા છે.
૧૨. આ રચનાસમય હેમચન્દ્રવચનામૃતગત સંસ્કૃત લખાણને અંગેનો છે.

સંગ્રહમાં સાતમા પર્વ પૂરતો અંશ ન્યાયતીર્થ સાહિત્યતીર્થ મુનિશ્રી હિમાંશુવિજયે યોજયો છે અને એનો ગુજરાતી અનુવાદ પણ એમણે કર્યો છે, જ્યારે બાકીનાં નવે પર્વમાંથી વચનામૃતો એકત્રિત કરી તેનો ગુજરાતી અનુવાદ મુનિશ્રી જયન્તવિજયજીએ કર્યો છે. આ સમગ્ર સંગ્રહમાં ૯૧૫ વચનામૃતો છે. આમાં P. ૨૪૬ કેટલાંક વચનામૃતો એવાં છે કે જેમાં બબ્બે નીતિવાક્યો સંકળાયેલાં છે.

આ સંગ્રહમાં પરમાત્મા, સૂર્ય, ચન્દ્ર, મુનિ, સંત, ગુરુ, વડીલ, શિષ્ય, અતિથિ, સાધર્મિક, આપ્ત, ચક્રવર્તી, મંત્રી, સુભટ, સારથિ, પ્રજા, બ્રાહ્મણ, મિત્ર, શત્રુ, સ્ત્રી, પશુ, પક્ષી, રાજનીતિ ઇત્યાદિને લગતાં વચનામૃતો છે.

‘સૂક્તિમુક્તાવલી, સિન્દૂરપ્રકર યાને સોમશતક (લ. વિ. સં. ૧૨૫૦)– આના કર્તા સોમપ્રભસૂરિ છે. એઓ ‘પોરવાડ’ વૈશ્ય સર્વદેવના પુત્ર અને જિનદેવના પૌત્ર થાય છે. એમણે કુમારાવસ્થામાં ‘બૃહદ્’ ગચ્છના અજિતદેવના શિષ્ય વિજયસિંહ પાસે દીક્ષા લીધી હતી અને એઓ ટૂંક સમયમાં આચાર્ય બન્યા હતા. એમણે વિ. સં. ૧૨૪૧માં ‘કુમારવાલપરિબોહ રચ્યો છે. વળી ‘સુમર્ધનાહચરિય, ‘શતાર્થ-કાવ્ય અને એની ‘સ્વોપજ્ઞ વૃત્તિ તેમજ ‘શૃંગારવૈરાગ્યતરંગિણી પણ એમની P. ૨૪૭ કૃતિઓ છે. એમનો સ્વર્ગવાસ ‘શ્રીમાલ’ નગરમાં વિ. સં. ૧૨૮૪ની આસપાસમાં થયાનું મનાય છે. એમના પટ્ટધર તે જગચન્દ્રસૂરિ છે.

આ પ્રાસાદિક કૃતિ સૂક્તિરૂપ મુક્તકોની માળા જેવી હોવાથી એનું **સૂક્તિમુક્તાવલી** એવું નામ કર્તાએ અંતિમ શ્લોકમાં દર્શાવ્યું છે. આ કૃતિનો પ્રારંભ ‘સિન્દૂર-પ્રકર’થી થતો હોવાથી એનું આ નામ પડ્યું છે. એમાં સો શ્લોક હોવાથી એના કર્તાનું નામ જોડી એને **સોમશતક** કહે છે. ભર્તૃહરિકૃત **નીતિશતક** જોઈને કર્તાએ આ શતક રચ્યું હશે. એ વિવિધ છંદોમાં ગુંથાયેલું છે.

૧. આ કાવ્ય “કાવ્યમાલા” (ગુ. ૭)માં ઈ. સ. ૧૮૦૭માં (ત્રીજી આવૃત્તિ) છપાયું છે. એ હર્ષકીર્તિસૂરિકૃત વ્યાખ્યા સહિત અમદાવાદથી ઈ. સ. ૧૮૨૪માં પ્રસિદ્ધ થયું છે. ભીમસી માણેક તરફથી આ કાવ્ય આ વ્યાખ્યા, એને અંગેનાં કોઈકનો બાલાવબોધ તેમજ પં. બનરસીદાસે વિ. સં. ૧૬૯૧માં આ કાવ્ય પરત્વે કરેલ હિંદી કવિત્ત સહિત ઈ. સ. ૧૮૦૨માં પ્રસિદ્ધ કરાયું છે. વળી આ મૂળ કૃતિ હર્ષકીર્તિસૂરિકૃત વ્યાખ્યા સહિત “હંસવિજય ફી લાયબ્રેરી” તરફથી ઈ. સ. ૧૮૨૪માં છપાવાઈ છે. શ્રી. માવજી દામજી શાહે મૂળ કૃતિ પદ્યાનુક્રમશિકા, શબ્દ-કોષ અને ગુજરાતી અનુવાદ સહિત પ્રસિદ્ધ કરી છે અને એની ચોથી આવૃત્તિ ઈ. સ. ૧૯૩૬માં બહાર પડી છે.

૨. જુઓ પા. ભા. સા. (પૃ. ૧૧૮)

૩. એજન, પૃ. ૧૧૭-૧૧૮.

૪. આ કાવ્ય એની સ્વોપજ્ઞ વૃત્તિ તેમજ એના ગુજરાતી અનુવાદ સહિત **અનેકાર્થસાહિત્યસંગ્રહ**ના પ્રથમ વિભાગમાં ઈ. સ. ૧૮૩૫માં છપાવાયું છે.

૫. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧

૬. આ પ્રકરણરત્નાકર (ભા. ૨. પૃ. ૨૧૭-૨૪૭)માં ગુજરાતી અનુવાદ સહિત ઈ. સ. ૧૮૭૬માં છપાયું છે. નંદલાલની ટીકા સહિત આ કૃતિ વડોદરાના શ્રાવક જગજીવને વિ. સં. ૧૮૪૨માં છપાવી છે. “જૈન સ્વયંસેવક મંડળે” ઇન્દોરથી આ કૃતિ મારા ગુજરાતી અનુવાદ અને સ્પષ્ટીકરણ સહિત ઈ.સ. ૧૯૨૩માં છપાવી છે.

વિષય— મંગલાચરણથી શરૂ કરાયેલા આ શતકમાં શ્લો. ૯-૯૨-૩૫ એકવીસ ચતુષ્ટયમાં એકેક વિષય રજૂ કરાયો છે. આ ૨૧ની નોંધ શ્લો. ૮માં જોવાય છે. જિનેશ્વર, ગુરુ, ધર્મ અને સંઘની મહત્તા, અહિંસાદિ પાંચ 'મહાવ્રતો, ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય ઉપર વિજય, સહૃદયતા તેમજ દાન, શીલ, તપ અને ભાવ અહીં વર્ણવાયા છે. ટૂંકમાં આમ અહીં જૈન ધર્મ અને નીતિ સાથે સંબંધ ધરાવનારા વિવિધ વિષયો સુબોધ અને હૃદયંગમ શૈલીએ રજૂ કરાયા છે. 'આમાંના કેટલાંક પદો

P. ૨૪૮ કુમારવાલપરિબોહમાં અને "ભવારણ્ય"થી શરૂ થતું ૯૭મું પદ શૃંગાર-વૈરાગ્ય-તરંગિણીમાં ૪૫મા પદ તરીકે જોવાય છે.

ઉલ્લેખ— જલ્લશદેવે પોતાની સૂક્તિમુક્તાવલી (લ. વિ. સં. ૧૨૫૦)માં આ કાવ્યનો સોમપ્રભસૂરિના નામથી ઉલ્લેખ કર્યો છે અને "લક્ષ્મીઃ પશ્યતિ (? સર્પતિ)" થી શરૂ થતું ૭૬મું પદ ઉદ્ધૃત કર્યું છે.

વૃત્તિઓ— આ સોમશતક જૈન સમાજમાં ઘણું પ્રિય બનતાં એના ઉપર વિવિધ વૃત્તિઓ રચાઈ છે :—

- (૧) વૃત્તિ — આના કર્તા 'ખરતર' ગચ્છના જિનહિતસૂરિના શિષ્ય કલ્યાણરાજના શિષ્ય ચારિત્રવર્ધન છે. એમણે આ વૃત્તિ વિ. સં. ૧૫૦૫માં રચી છે.
- (૨) વ્યાખ્યા— 'ભૂર્ભુવસ્વસ્ત્રયી'થી શરૂ થતી આ વ્યાખ્યા જિનસાગરના શિષ્ય ધર્મચન્દ્રે રચી છે.
- (૩) વ્યાખ્યા— આ 'નાગપુરીય તપા' ગચ્છના ચન્દ્રકીર્તિસૂરિના શિષ્ય હર્ષકીર્તિસૂરિએ રચી છે.
- (૪) ટીકા— આના કર્તા 'ખરતર' ગચ્છના જિનતિલકસૂરિ છે. આની એક હાથપોથી વિ. સં. ૧૬૬૨માં લખાયેલી મળે છે.
- (૫) ટીકા— આ ગુણકીર્તિસૂરિની વિ. સં. ૧૬૬૭ની રચના છે. એઓ 'મલધારી' ગચ્છના ગુણનિધાનસૂરિના અનુગામી થાય છે.
- (૬) ટીકા— આના કર્તા વિમલસૂરિ છે.
- (૭) ટિપ્પણ— આ ભાવચારિત્રે રચ્યું છે.
- (૮) ટીકા— આના કર્તાનું નામ જાણવામાં નથી.

પ્રમોદકુશલગણિના નામે જે સિન્દૂરપ્રકરનો ઉલ્લેખ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૪૨)માં છે તે શું પ્રસ્તુત સિન્દૂરપ્રકરની ટીકા તો નથી ને ?

P. ૨૪૯ ઇટાલિયન અનુવાદ— સિન્દૂર-પ્રકરનો પવોલિનિએ 'ઇટાલિયન ભાષામાં અનુવાદ કર્યો છે. એ અનુવાદ એફ. એલ. પુસે દ્વારા રચાયેલા ઉપોદ્ધાત સહિત SIFI (II, 33-72) માં ઈ. સ. ૧૮૯૮માં છપાયો છે.

અનુકરણો— પ્રસ્તુત સિન્દૂર પ્રકરના અનુકરણરૂપે કર્પૂર-પ્રકર, કસ્તૂરી-પ્રકર અને હિંગુલ-પ્રકર રચાયા છે.

૧. પ્રાજ્ઞાતિપાત-વિરમણ, મૃષાવાદ-વિરમણ, અદત્તાદાન-વિરમણ, અબ્રહ્મવિરમણ અને પરિબ્રહ્મ-વિરમણ.

૨. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે "જર્મન અને ઇટાલિયન અનુવાદોથી અલંકૃત જૈન કૃતિઓ." આ લેખ જૈ. ધ. પ્ર. (પુ. ૬૯, અં. ૧)માં છપાયો છે.

સૂક્તાવલી (લ. વિ. સં. ૧૨૮૦) – ચ. પ્ર. (પૃ. ૧૨૬)માં **પદ્માનંદ મહાકાવ્ય** વગેરે રચનારા અમરચન્દ્રસૂરિની કૃતિઓ ગણાવતી વેળા આનો ઉલ્લેખ કરાયો છે પણ આ કૃતિની એકે હાથપોથી હજી સુધી તો મળી આવી નથી.

વિવેક-કલિકા અને વિવેક-પાદપ (લ. વિ. સં. ૧૨૮૦) – આ બે સૂક્તિસંગ્રહ છે અને એ બંનેના કર્તા અલંકાર-મહોદધિના પ્રણેતા નરેન્દ્રપ્રભસૂરિ છે. પહેલા સૂક્તિ સંગ્રહમાં ૧૧૦ પદ્યો અને બીજામાં ૪૨૧ પદ્યો હોવાનું અનુમાન છે.

વિવેકકલિકા ભિન્ન ભિન્ન છંદોમાં રચાયેલી છે. જ્યારે **વિવેકપાદપ**નાં ઉપલબ્ધ ૧૦૯ પદ્ય પૈકી ૧૦૭ અનુષ્ટુભમાં છે. બાકીનાં બે પદ્ય પ્રશસ્તિ-રૂપ છે અને એ બે પદ્યો અનુક્રમે શાર્દૂલવિકીરિત અને P. ૨૫૦ વસન્તતિલકા છંદમાં છે. આ બંને કૃતિમાંથી **અવતરણો પત્તન.સૂચી** (ભા. ૧ પૃ. ૧૮૭)માં અપાયાં છે. પરંતુ આ બંને કૃતિ પાટણના ભંડારની એક ખંડિત તાડપત્રીય હાથપોથીમાં અપૂર્ણ સ્વરૂપે મળે છે. એ હાથપોથીમાં **વિવેકકલિકા**નાં ૬૯ અને **વિવેકપાદપ**નાં ૧૦૯ પદ્યો મળે છે. એ ઉપરથી જાણી શકાય છે કે આ બંને કૃતિઓ મોટે ભાગે સુભાષિતો પૂરાં પાડે છે, જ્યારે જૈન ધર્મને લગતી બાબતો ઓછા પ્રમાણમાં નિરૂપાઈ છે.

સુભાષિતાવલી (લ. વિ. સં. ૧૨૮૦)– આના કર્તા તિલકપ્રભ-સૂરિ છે. એઓ ‘પૂર્ણિમા’ ગચ્છના દેવસૂરિના શિષ્ય થાય છે. એમણે **નીતિશાસ્ત્ર** રચ્યું છે. એઓ વિ. સં. ૧૩૦૭માં **શાંતિનાથચરિત્ર** રચનારા અજિતપ્રભસૂરિના ગુરુ વીરપ્રભના ગુરુ હોય એમ ભાસે છે. જો એમ જ હોય તો એમની આ રચના વિ. સં. ૧૨૮૦ની આસપાસની હશે.

સૂક્ત-રત્નાકર (લ. વિ. સં. ૧૨૮૦)– આના કર્તા ગૃહસ્થ માઘસિંહ ઉર્ફે મન્યથસિંહ છે. એઓ વિદ્યાસિંહના પુત્ર થાય છે. એમણે આ કૃતિ બે ભાગમાં વિભક્ત કરી છે. એનું પરિમાણ ૮૮૬૫ શ્લોક જેવડું છે. આની એક હાથપોથી વિ. સં. ૧૩૪૭માં લખાયેલી છે.^૧

સૂક્તિ-સમુચ્ચય (લ. વિ. સં. ૧૨૮૦)– આ નામ મેં યોજ્યું છે. આના કર્તા **વસ્તુપાલ** છે. P. ૨૫૧ સોમેશ્વરકૃત ઉલ્લાઘ-રાઘવ (અંક ૮) ઉપરથી જણાય છે કે વસ્તુપાલને સૂક્તિઓ રચવાનો શોખ હતો. એમની કેટલીક સૂક્તિ નરનારાયણાનન્દના બીજા પરિશિષ્ટમાં અપાયેલી છે.

૧-૨. આ બે વિષે કેટલીક માહિતી ડૉ. સાંડેસરાએ એમની નિમ્નલિખિત કૃતિ (પૃ. ૧૪૨-૧૪૩)માં આપી છે :-

Literary Circle of Mahamatya Vastupala and its contribution to Sanskrit Literature.

આ કૃતિ “સિ. જૈ. ગ્રં.”માં ઈ. સ. ૧૯૫૩માં પ્રકાશિત કરાઈ છે.

૩. **વિવેકપાદપ**નો શ્લો. ૨૪ અને **વિવેકકલિકા**ના શ્લો. ૧૨, ૩૯ અને ૮૦ ઉપર્યુક્ત અંગ્રેજી કૃતિમાં ઉદ્ધૃત કરાયા છે.

૪. આ નામની એક કૃતિ ધર્મકુમારે રચી છે.

૫. જુઓ **પત્તન.સૂચી** (ભા. ૧, પૃ. ૧૩૭).

૬. એમને અને સાથે એમના ભાઈ તેજપાલને વીરધવલ રાજાએ વિ.સં. ૧૨૭૬માં મંત્રી નીમ્યા હતા (જુઓ જૈ. સા. સં. ઈ.નું પૃ. ૩૫૫). વસ્તુપાલનું અવસાન વિ. સં. ૧૨૯૬માં થયું હતું. (જુઓ જૈ. સા. સં. ઈ.નું પૃ. ૩૬૯).

સૂક્તાવલી યાને સૂક્ત-સંગ્રહ— આ ૧૫૦૦ શ્લોક જેવડી કૃતિના કર્તા લક્ષ્મણ છે. એની શરૂઆત ‘સૂક્તિરત્નસુધા’ થી થાય છે અને એની એક હાથપોથી પાટણના ભંડારમાં છે.

‘સૂક્ત-મુક્તાવલી (લ. વિ. સં. ૧૫૨૫)— આ અજ્ઞાતકર્તૃક કૃતિમાં ૧૨૭ અધિકાર છે. સૌથી પ્રથમ અધિકાર ધર્મોપદેશને અંગેનાં ૫૦ સૂક્તોરૂપ છે. ૪૭મો અધિકાર મૂર્ખને લગતો છે અને એમાં દસ પદ્યો છે. આ કૃતિ સૂક્ત અર્થાત્ સુભાષિતરૂપ મોતીની માળા છે. એમાંનાં ઘણાંખરાં સૂક્તો સંસ્કૃતમાં છે; કેટલાંક પાઈયમાં છે તો કોઈકોઈ જૂની ગુજરાતીમાં છે. એ ભાષા જોતાં એમ અનુમનાય કે આ કૃતિ વિક્રમની પંદરમી સદી પહેલાંની નહિ હશે.

P. ૨૫૨ સૂક્તાવલી યાને ‘કર્પૂર-પ્રકર (ઉ. વિ. સં. ૧૫૫૦)— આ વજ્રસેનના શિષ્ય હરિ (હરિષેણ)ની કૃતિ છે. એમાં ૧૭૯ પદ્યમાં ૮૭ દ્વાર દ્વારા શ્રાવકના બાર પ્રતો, દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્વો, ‘સાત ક્ષેત્રો, શબ્દાદિ પાંચ વિષયો અને કોષાદિ ઉપર વિજય એમ વિવિધ વિષયો નિરૂપાયા છે. પ્રસંગોપાત્ત વિષયને વ્યક્ત કરનાર ઉદાહરણોનું સૂચન કરાયું છે. આ કૃતિને એના કર્તાએ સૂક્તાવલી કહી છે. એને કેટલાક સુભાષિતકોશ પણ કહે છે. આના અંતિમ પદ્યમાં ગ્રંથકારે પોતાના ગુરુ વજ્રસેનને ત્રિષષ્ટિસારના અને પોતાને નેમિયરિત્રના કર્તા કહ્યા છે.

વિવરણો— ‘કર્પૂરપ્રકર’થી શરૂ થતી આ કૃતિ ઉપર ‘ખરતર’ ગચ્છના જિનવર્ધનસૂરિના શિષ્ય ‘જિનસાગરસૂરિએ જૈ. ગ્રં. (પૃ. ૧૭૬) પ્રમાણે વિ. સં. ૧૫૫૧માં અવચૂરિ રચી છે અને એના મૂળમાં P. ૨૫૩ સૂચવાયેલા ઉદાહરણોનો કથા દ્વારા સ્કોટ કર્યો છે. ‘તપા’ ગચ્છના લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય જયરાજે, હર્ષકુલે, યશોવિજયગણિએ તેમજ અન્ય કોઈકે પણ એકેક ટીકા રચી છે.’

૧. આ ‘દે. લા. જૈ. પુ. સં.’ તરફથી ઈ. સ. ૧૯૨૨માં પ્રકાશિત થયેલી છે. અંતમાં આ કૃતિમાંના પદ્યોની અકારાદિ ક્રમે સૂચી અપાઈ છે. વળી ૧૨૭ અધિકારોનાં નામ અનુક્રમે આપી એનાં પદ્યોની સંખ્યા દર્શાવાઈ છે.

૨. જુઓ ૧૧૬મો અધિકાર (પત્ર ૯૧આ-૯૨આ).

૩. આ કૃતિ ગુજરાતી અનુવાદ અને જિનસાગરની ટીકા સહિત હરિશંકર કાલિદાસે ઈ. સ. ૧૯૦૧માં છપાવી છે. મૂળ કૃતિ ઉપર્યુક્ત ટીકા તેમજ સોમચન્દ્રકૃત કથામહોદધિ સહિત હીરાલાલ હંસરાજે ઈ. સ. ૧૯૧૬માં પ્રસિદ્ધ કરી છે. વળી જિનસાગરીય ટીકા સહિત મૂળ કૃતિ ‘જૈ. ધ. પ્ર. સ.’ તરફથી વિ. સં. ૧૯૭૫માં પ્રકાશિત થઈ છે. (એમાં ટીકાનો રચના સમય અપાયો નથી.) આ ઉપરાંત મૂળ કૃતિ શ્રીવિજયનેમિસૂરિના શિષ્યરત્ન શ્રી. વિજયપદ્મસૂરિએ વિ. સં. ૨૦૦૩માં રચેલાં ગુજરાતી પદ્યાત્મક ટીકા, શ્લોકાર્થ અને સ્પષ્ટાર્થ સહિત ‘જૈ. ગ્રં. પ્ર. સ.’ તરફથી થોડાંક વર્ષ ઉપર છપાઈ છે, પરંતુ એમાં પ્રકાશનવર્ષનો ઉલ્લેખ નથી.

૪. આ બાર પ્રતો નીચે મુજબ છે :—

સ્થૂલ-પ્રાણાતિપાત-વિરમણ, સ્થૂલ-મૃષાવાદ-વિરમણ, સ્થૂલ-અદત્તાદાન-વિરમણ, સ્વદારસંતોષ, પરિગ્રહનું પરિમાણ, દિગ્ગત, ભોગોપભોગપરિમાણ, અનર્થદંડવિરમણ, સામાયિક, દેશાવકાશિક, પૌષ્ઠ અને અતિથિસંવિભાગ,

૫. જિન-પ્રતિમા, જિન-મંદિર, શ્રુતજ્ઞાન તેમજ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ સાત ક્ષેત્રો ગણાય છે.

૬. એમણે ‘દેવકુલપાટક’ નગરમાં શાન્તિનાથના ઊંબની પ્રતિષ્ઠા વિ. સં. ૧૪૯૪માં કરાવી હતી.

૭. મેરુસુંદરે બાલાવબોધ અને ધનવિજયે સ્તબક (ટબ્બો) રચ્યા છે.

સૂક્ત-મુક્તાવલી (લ. વિ. સં. ૧૬૦૦)— આ નામની ૨૩૩૨ શ્લોક જેવડી એક અજ્ઞાતકર્તા કૃતિની હાથપોથી વિ. સં. ૧૬૧૮માં લખાયેલી છે. શું આ કૃતિ તે જ પૃ. ૨૫૧માં નોંધાયેલી **સૂક્તમુક્તાવલી** છે ?

સૂક્ત-સંગ્રહ (લ. વિ. સં. ૧૬૨૦)— આના કર્તા લક્ષ્મીકલ્લોલગણિ છે. એઓ હર્ષકલ્લોલના શિષ્ય થાય છે. એમણે **આચાર** ઉપર **તત્વાવગમા** નામની અવચૂરિ સૌભાગ્યહર્ષના રાજ્યમાં એટલે કે વિ. સં. ૧૫૮૩થી ૧૫૮૭માં ગાળામાં રચી છે. વળી એમણે **નાયાધમ્મકહા** ઉપર **મુગ્ધાવબોધા** નામની વૃત્તિ સોમવિમલસૂરિના રાજ્યમાં અર્થાત્ વિ. સં. ૧૫૮૦થી ૧૬૩૭ના ગાળામાં રચી છે.

અવચૂરિ— આના કર્તાનું નામ જાણવામાં નથી.

‘સૂક્ત-રત્નાવલી (વિ. સં. ૧૬૪૭)— આના કર્તા હીરવિજયસૂરિના પટ્ટાલંકાર વિજયસેનસૂરિ છે. એમણે વિ. સં. ૧૬૪૭માં ‘અનુષ્ટુભ’માં ૫૧૧ પદ્યોમાં આ કૃતિ રચી છે અને એ દ્વારા વિવિધ વિષયનાં મનોરમ અને સચોટ સુભાષિતો પૂરાં પાડ્યાં છે.

સૂક્તરત્નાવલી (લ. વિ. સં. ૧૬૫૦— વિજયપ્રશસ્તિ કાવ્યની વૃત્તિની પ્રશસ્તિ (શ્લો. ૫૩) ઉપરથી જણાય છે કે હેમવિજયગણિએ **સૂક્ત-રત્નાવલી** રચી છે પણ એ ઉપર્યુક્ત કૃતિથી ભિન્ન હોવી જોઈએ કેમકે એમાં તો વિજયસેનસૂરિનું જ નામ છે. આ હેમવિજયગણિ એ લક્ષ્મીભદ્રની શાખામાં થયેલા પ. ૨૫૪ ‘તપા’ ગચ્છના અમરવિજયના શિષ્ય કમલવિજયના શિષ્ય થાય છે. એઓ કુશળ કવિ હતા. એમણે નિમ્નલિખિત કૃતિઓ રચી છે :-

(૧) અન્યોક્તિમુક્તાવલી યાને અન્યોક્તિમુક્તામહોદધિ, (૨) ઋષભ-શતક, (૩) કથારત્નાકર,^૧ (૪) ‘કસ્તૂરીપ્રકર, (૫) ‘કીર્તિલ્લોલિની, (૬) ‘જિનસ્તવન-ચતુર્વિંશતિકા યાને ચતુર્વિંશતિજિનસ્તુતિ, (૭) જિનસ્તુતિ, (૮) ‘પાર્શ્વનાથ-ચરિત, (૯) ‘વિજયપ્રશસ્તિ, (૧૦) સદ્ભાવશતક અને (૧૧) સ્તુતિત્રિદશશતરંગિણી.

આ ઉપરાંત એમણે અનેક સ્તોત્રો રચ્યાં છે.^૨ એમની આ **સૂક્તરત્નાવલી** પ્રસિદ્ધ થવી ઘટે.

૧. આ કૃતિ “જૈ. આ. સ.” તરફથી વિ. સં. ૧૮૬૮માં પ્રકાશિત થઈ છે અને એમાં કેટલેક સ્થળે પદ્યો ખંડિત છે. આ નામની બીજી પણ કૃતિ છે. [સૂ. ૨. નું તાજેતરમાં પુનઃ પ્રકાશન થયું છે.]

૨. [પં. હીરાલાલ હંસરાજે પ્રતાકારે બે ભાગમાં પ્રગટ કરેલ ‘કથારત્નાકર’ ગ્રંથ આ. મુનિચન્દ્રસૂરિના હાથે સંપાદિત થઈ આ. ઊંકારસૂરિજ્ઞાનમંદિર ગ્રંથાવલી સૂરતથી પુસ્તકાકારે પ્રગટ થયો છે. આમાં Introduction શ્રીહરિવલ્લભ ભાયાણીએ લખ્યું છે.]

૩. આ કૃતિ ભીમસી માણેકે.ઈ. સ. ૧૮૦૮માં પ્રકાશિત કરી છે.

૪. આ વિજયસેનસૂરિની પ્રશસ્તિરૂપ કૃતિ છે.

૫. આ જૈન-સ્તોત્ર-સમુચ્ચય (પૃ. ૨૬૭-૨૮૪)માં પ્રકાશિત થયેલી છે.

૬. આ વિ. સં. ૧૬૩૨માં રચાયેલું ચરિત “ચુનીલાલ ગ્રંથમાલા”માં ભીખીબાઈ ચુનીલાલ પન્નાલાલ તરફથી વિ. સં. ૧૯૭૨માં છપાવાયું છે.

૭. આ કાવ્ય ગુણવિજયની વિજયદીપિકા નામની ટીકા સહિત “ય. જૈ. ગ્રં.”-માં વીરસંવત્ ૨૪૩૭માં પ્રસિદ્ધ કરાયું છે. [જિનશાસન આ. ટ્રસ્ટે આનું પુનર્મુદ્રણ કર્યું છે.]

૮. હેમવિજયગણિએ ગુજરાતીમાં કમલવિજયરાસ વિ. સં. ૧૬૬૧માં રચ્યો છે.

સૂક્તિ-રત્નાકર (લ. વિ. સં. ૧૬૫૦)– આ **ધાતુમંજરી** વગેરે રચનારા 'સિદ્ધિચન્દ્રગણિ'એ સંકલિત કરેલી કૃતિ છે. એમાં ૩૭૭ સુભાષિતોનો સંગ્રહ કરાયો છે. એમાં વિવિધ 'ગ્રન્થકારો અને ગ્રન્થો વિષે P. ૨૫૫ ઉલ્લેખ છે. જે 'વૃદ્ધપ્રસ્તાવોકિતરત્નાકર' આ જ ગણિએ રચ્યો છે તે શું પ્રસ્તુત કૃતિથી ભિન્ન છે ?

સૂક્તિ-દ્વાત્રિંશિકા– યાને **સૂક્ત-દ્વાત્રિંશિકા** (લ. વિ. સં. ૧૬૫૦)– આ કૃતિ 'દોષક' છંદમાં ૩૨ પદ્યમાં વિ. સં. ૧૬૫૦માં મુનિ સારંગ કવિએ રચી છે.

સ્વોપજીવિવરણ– કર્તાએ જાતે આ કૃતિને વિ. સં. ૧૬૫૦માં વિવરણથી વિભૂષિત કરી છે.

કસ્તૂરી-પ્રકર (લ. વિ. સં. ૧૬૫૦)– આ કમલવિજયગણિના શિષ્ય હેમવિજયગણિની ૧૮૨ કારિકા પૂરતી રચના છે. એમણે આ કૃતિ હીરવિજયસૂરિના રાજ્ય દરમ્યાન રચી છે.

સ્વોપજીવૃત્તિ– ઉપર્યુક્ત **કસ્તૂરી-પ્રકર** ઉપર કર્તાએ જાતે વૃત્તિ રચી છે.

કસ્તૂરી-પ્રકરણ–સોમસુંદર ઉપાધ્યાયે ૧૦૦૦ શ્લોક જેવડું **કસ્તૂરી-પ્રકરણ** રચ્યું છે. સંવેગસુંદરે પણ આ નામની કૃતિ રચી છે.

હિંગુલ-પ્રકર (લ. વિ. સં. ૧૭૦૦)– આના દ્વિતીય પદ્યનો પ્રારંભ 'હિંગુલપ્રકર'થી થાય છે. P. ૨૫૬ એના કર્તા ઉપા. વિનયસાગર છે. એમણે આ કૃતિ મુખ્યત્વે 'અનુષ્ટુભ'માં રચી છે. અને એને પ્રક્રમોમાં વિભક્ત કરી છે. શ્લો. ૧૫ અને ૧૬માં સૂચવાયા મુજબ આમાં '૧૮ પાપસ્થાનકને અંગે ૧૮ પ્રક્રમો, '૭ વ્યસન સંબંધી ૭, '૧૦ દાનાદિ ચાર પ્રકારના ધર્મ પરત્વે ૪ તેમજ જિનેન્દ્રપૂજા, ગુરુ-ભક્તિ અને ઉદ્યમને અંગે એકેક પ્રક્રમ છે. આ પ્રત્યેક પ્રક્રમમાં ચચ્યાર કે પાંચ પાંચ પદ્યો છે.

૧. એમની અન્ય કૃતિઓ માટે જુઓ પૃ. ૫૪-૫૫.

૨-૩. આનાં નામ માટે જુઓ ભાનુચન્દ્રગણિચરિત (પૃ. ૬૩-૬૪) અને એની શ્રી. મો. દ. દેસાઈની પ્રસ્તાવના (પૃ. ૭૩)

૪. આનો ઉલ્લેખ સિદ્ધિચન્દ્રગણિએ ભક્તામરસ્તોત્રની ટીકામાં કર્યો છે એમ જિ. ર. કો. (ખંડ ૧, પૃ. ૩૬૪)માં કહ્યું છે.

૫. આ કૃતિ પ્રકાશિત છે. જુઓ પૃ. ૨૫૪

૬. આ કૃતિ "હિંગુલ-પ્રકરણ" એવા નામથી પં. હીરાલાલ હંસરાજના ગુજરાતી અનુવાદ સહિત ભીમસી માણેક તરફથી ઈ. સ. ૧૯૦૦માં છપાવાઈ છે. એનું આદ્ય પદ્ય હાથપોથી લખનારનું હશે એમ લાગે છે. બીજું પદ્ય 'હિંગુલ'થી શરૂ થાય છે અને આ કૃતિનો વાસ્તવિક પ્રારંભ આ પદ્યથી જ હશે એમ લાગે છે. એ પદ્ય નીચે મુજબ છે :-

‘હિંગુલપ્રકરોડયં ચ બાલારુણો વિચક્ષણાઃ।

તર્કયન્તીતિ યં દૃષ્ટ્વા પદ્યપ્રભો મુદેઽસ્તુ સઃ ॥”

૭. "હિંગુલ"નો અર્થ 'હિંગલોક' થાય છે.

૮. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાપ્ત્યાન, પૈશુન્ય, રત્યરતિ, પરાપવાદ, માયામૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય.

૯. ઘૂત, માંસ, મદિરા, વેશ્યા, આખેટ (શિકાર), ચોરી અને પરદારગમન

૧૦. દાન, શીલ, તપ અને ભાવ.

‘અનુવાદ’— આનો ગુજરાતી અનુવાદ પં. હીરાલાલ હંસરાજે કર્યો છે.

કર્તા—હિંગુલપ્રકરના કર્તા વિનયસાગર તે કોણ એ નક્કી કરવા માટે પૂરતાં સાધન નથી. જૈ. સા. સં. ઈ. (પૃ. ૬૦૬)માં એક વિનયસાગરનો કાવ્યકાલ વિ. સં. ૧૬૧૭માં દર્શાવાયો છે. અને પૃ. ૮૭૨માં એમના ગચ્છ તરીકે ‘ખરતર’નો ઉલ્લેખ છે. પૃ. ૬૫૬માં ‘અંચલ’ ગચ્છના વિનયસાગર વિષે કહ્યું છે કે એઓ કલ્યાણસાગરસૂરિ (વિ. સં. ૧૬૭૦-વિ. સં. ૧૭૧૮)ના શિષ્ય થાય છે. એમણે ભોજવ્યાકરણ રચ્યું છે તેમજ એમણે સારસ્વત વ્યાકરણનાં સૂત્રોને છંદોબદ્ધ કરી **વૃદ્ધચિન્તામણિ** નામના ગ્રંથમાં ગૂઢ્યાં છે.

આ બે વિનયસાગર ઉપરાંત વિનયસાગર નામના એક ત્રીજા મુનિવર પણ છે.^૧ શું આ ત્રણમાંથી P. ૨૫૭ કોઈ એક અત્ર અભિપ્રેત છે કે પ્રસ્તુત ઉપા. વિનયસાગર આ બધાથી ભિન્ન છે એ જાણવું બાકી રહે છે. આ પરિસ્થિતિમાં હિંગુલપ્રકરનો રચનાસમય મેં કેવળ કલ્પનાના આધારે સૂચવ્યો છે.

સદ્ભાષિતાવલી (વિ. સં. ૧૬૬૦)— સંકલકીર્તિએ લગભગ ૪૦૦ સુભાષિતોના સંગ્રહનું સંકલન કર્યું છે. એની એક હાથપોથી વિ. સં. ૧૬૭૧માં લખાયેલી છે. શું આ કૃતિ તે જ એમણે રચેલી સુભાષિતરત્નાવલી યાને સુભાષિતાવલી છે ?

સુભાષિત-વિજય-મત-શાસ્ત્ર— આ અજ્ઞાતકર્તૃક કૃતિ છે.

આર્યાગાથા— આ મુખ્યત્વે ‘આર્યા’માં રચાયેલાં ૧૪૦ પદ્યોની કૃતિ છે. એના કર્તાનું નામ જાણવામાં નથી. એમાં અનેક સુભાષિતો અપાયેલાં છે. આકૃતિનાં પ્રારંભનાં બે પદ્યો અને અંતમાંનાં ત્રણ પદ્યો મેં D C G C M (Vol. XVIII, pt. 1, p. 269)માં આપ્યાં છે. આ અપ્રસિદ્ધ કૃતિની એક જ હાથપોથી મળતી હશે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૪) જોતાં અનુમાનાય છે.

સુભાષિતરત્નકોશ— આના કર્તા મુનિદેવ આચાર્ય છે. એમાં ૫૮ કારિકા છે. શું આ કૃતિ સંસ્કૃતમાં છે ?

‘સૂક્તમુક્તાવલી યાને સૂક્તિમુક્તાવલી— આના કર્તા મેઘપ્રભસૂરિ છે. એનો પ્રારંભ “શ્રીવર્ધમાનમભિનૌમિ” થી થાય છે.

‘સૂક્તરત્નાવલી’ (ઉ. વિ. સં. ૧૮૪૭)— આના કર્તા ક્ષમાકલ્યાણ છે. એઓ વિ. સં. ૧૮૦૧માં જન્મ્યા હતા. એઓ ‘ખરતર’ ગચ્છના અમૃતધર્મના શિષ્ય થાય છે. એમણે પોતાના દાદાગુરુ જિનલાભસૂરિએ

૧. આ ભીમશી માણેકદ્વારા ઈ.સ. ૧૯૦૦માં પ્રકાશિત છે.

૨. હિંગુલપ્રકરની વિવિધ હાથપોથીઓ જોવા મળે તો હિંગુલપ્રકર ક્યારે રચાયું તે વિષે અનુમાન થઈ શકે. કોઈક હાથપોથીમાં તો એ કૃતિ ક્યારે લખાઈ તેનો પણ નિર્દેશ હોય તો ના નહિ.

૩. જુઓ પૃ. ૮૦.

૪. આ “જૈ. આ. સ.” તરફથી ઈ. સ. ૧૯૧૮માં પ્રસિદ્ધ થયેલી છે.

૫. આ કૃતિ સ્વાપણ વૃત્તિ સહિત “શ્રી જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર” તરફથી અહીંથી (સુરતથી) આ છપાતી વેળાએ (વિ. સં. ૨૦૧૨)માં પ્રકાશિત કરાઈ છે. એની પ્રસ્તાવના (પૃ. ૧૧-૧૨)માં ક્ષમાકલ્યાણની ૨૫ કૃતિની નોંધ છે.

૬. આ નામની બીજી ત્રણ કૃતિ છે. જુઓ પૃ. 155, 156.

P. ૨૫૮ વિ. સં. ૧૮૩૩માં રચેલા આત્મ(પ્ર)બોધનો પ્રથમાદર્શ લખ્યો હતો. વિશેષમાં એમણે નીચે મુજબ ગ્રંથો રચ્યા છે :-

પરતરગચ્છપટ્ટાવલી (વિ. સં. ૧૮૩૦), દશપર્વકથા (વિ. સં. ૧૮૩૫), પરસમયસારવિચારસંગ્રહ, પ્રશ્નોત્તરસાર્થશતક (વિ. સં. ૧૮૫૧), યશોધરચરિત (વિ. સં. ૧૮૩૮), વિચારશતકબીજક અને સમરાદિત્યચરિત (વિ. સં. ૧૮૭૩)

વળી એમણે નિમ્નલિખિત કૃતિ ઉપર વિવરણ રચ્યું છે :-

ગૌતમીય કાવ્ય, જીવવિષય, તર્કસંગ્રહ, ભૂ-ધાતુ, મેરુત્રયોદશી, સિરિવાલકહા (શ્રીપાલચરિત્ર) અને સૂક્તરત્નાવલી (સ્વરચિત).^૧

આ કૃતિમાં ૧૦૮ પદ્યો છે. એ ઉપજાતિ, અનુષ્ટુભ, વગેરે છંદોમાં રચાયેલાં છે. એમાં પુરાતન આધ્યાત્મિક પરંપરા અને ભારતીય નૈતિકતાને લક્ષ્યમાં રાખી વિવિધ વિષયો આલેખાયા છે. જેમકે શત્રુંજયાદિ તીર્થોની પ્રશંસા, ધર્મ, ગુરુ અને દેવ એ તત્ત્વત્રયીનું સ્વરૂપ, અમરકોશનું આદ્ય પદ્ય લઈને સમસ્યારૂપે પાર્શ્વનાથની પાંચ પદ્યની સ્તુતિ, ‘કલિ’ યુગનું વર્ણન, કામવિકાર, બ્રહ્મચર્યની નવ વાડ, કાર્યસિદ્ધિનાં પાંચ કારણો, ઇન્દ્રિયોનો વિજય, મનની ચંચળતા, પ્રમાદના પાંચ અને આઠ પ્રકારો, સંતોષ, આત્માનું સ્વરૂપ, ચાર ગતિ, પરનિન્દાની નિન્દા, આત્મનિન્દા, ગુરુને નિવેદન, અન્તર્લાપિકા P. ૨૫૮ અને બહિર્લાપિકા દ્વારા સુભાષિત, નિરોષ્ઠ્ય પદ્યો દ્વારા મહાવીરસ્વામીની સ્તુતિ, ધર્માચાર્ય (જિનલાભસૂરિ) અને વિદ્યાગુરુઓ ઉપા. રાજસોમ અને રામવિજયની સ્તુતિ અને કર્તાના નામ (ક્ષમાકલ્યાણ)નો નિર્દેશ.

સ્વોપજ વૃત્તિ— આ સંક્ષિપ્ત વૃત્તિમાં અંતમાં ચાર પદ્યો છે. એમાં કહ્યું છે કે આ વૃત્તિ વિ. સં. ૧૮૪૭માં મકસૂદાબાદમાં ‘ઊકેશ’ વંશના મૂલચન્દ્રના પુત્ર ધોંકલચન્દ્ર અને કીર્તિચન્દ્રના આગ્રહથી રચી.

સુભાષિત-પદ્ય-રત્નાકર— આ જૈન તેમજ અજૈન ગ્રંથોમાંથી વિવિધ વિષયોને લગતાં પ્રાસંગિક પદ્યો-સુભાષિતાદિના મુનિશ્રી જયંત-વિજયજીના શિષ્ય મુનિશ્રી વિશાળવિજયજીએ કરેલા સંગ્રહરૂપ છે અને એનો ગુજરાતીમાં અનુવાદ એમણે કર્યો છે. આ પ્રમાણે તૈયાર કરાયેલી કૃતિનું નામ એમણે સુભાષિત-પદ્ય-રત્નાકર રાખ્યું છે. કયા કયા ગ્રંથોમાંથી અવતરણરૂપે પદ્યો લેવાયાં છે તેનો નિર્દેશ તે તે પદ્યની નીચે કરાયો છે. કેટલાંક પદ્યો પાઈયમાં પણ છે.

૧. એમણે ગુજરાતીમાં પણ કેટલીક કૃતિઓ રચી છે. એનાં તેમજ સંસ્કૃત કૃતિનાં નામ માટે જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૬૭૬-૬૭૭.)

૨. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, ઉદ્યમ અને પૂર્વકૃત કર્મ.

૩. મધ, કષાય (કોષાદિ), ઇન્દ્રિયોના વિષય, નિદ્રા અને વિકથા (શ્લો. ૪૫).

૪. અજ્ઞાન, સંશય, વિપર્યય, વિભાવોનો રાગ, દ્વેષ, વિસ્મરણ દુષ્પ્રશિધાન અને ધર્મકાર્યનો અનાદર (શ્લો. ૫૦-૫૧).

૫. નરક, તિર્યંચ, દેવ અને મનુષ્ય સંબંધી ગતિ.

૬. આ સંગ્રહાત્મક કૃતિ પાંચ ભાગમાં “શ્રીવિજયધર્મસૂરિ જૈન ગ્રન્થમાલા”માં પુ. ૨૭, ૩૧, ૩૪, ૫૨ (ભા.

૪) અને ૪૮ (ભા. ૫) તરીકે ઉજ્જૈનથી અનુક્રમે વિ. સં. ૧૮૮૧, ‘૮૨’, ‘૮૩’, ‘૮૫’ અને ‘૮૫’માં પ્રકાશિત કરાઈ છે. પાંચમો ભાગ જિનેશ્વરની સ્તુતિઓ વગેરેના સંગ્રહરૂપ છે.

૭. આમાં ત્રિષ્ટિ. સિન્દૂરપ્રકર, ધર્મકલ્પદ્રુમ, ઉપદેશપ્રાસાદ ઇત્યાદિનો સમાવેશ કરાયો છે.

જૈન-સૂક્ત-સંદોહ— આ એક આધુનિક સંગ્રહાત્મક કૃતિ છે. એમાં અપાયેલાં સૂક્તોનો સંગ્રહ પં. કૈલાસસાગરગણિએ કર્યો છે. આ કૃતિમાં એમણે મંગળ તરીકે પાંચ પદ્યો આપી સમ્યગ્દર્શનથી ૧૪૪ P. ૨૬૦ વિષયોની શરૂઆત કરી છે. ત્યાર બાદ કેટલાંક પ્રકીર્ણક શ્લોક, સુભાષિત-રત્ન-ખંડો અને વચનામૃતો તેમજ અંતિમ મંગળરૂપે ત્રણ પદ્યો આપી આની પૂર્ણાહુતિ કરી છે. આ પદ્યાત્મક કૃતિનાં ઘણાંખરાં પદ્યો સંસ્કૃતમાં છે. મુખ્યત્વે જૈન કૃતિઓને લક્ષીને આ રચના કરાઈ છે. આ કૃતિ શ્રમણોનાં પાંચ મહાવ્રતો તેમજ શ્રાવકોનાં બાર વ્રતો, બાર ભાવના વગેરે બાબતો ઉપર પણ પ્રકાશ પાડે છે.

અન્ય કૃતિઓ— આ ઉપરાંત સુભાષિતોને અંગે કેટલીક કૃતિઓ જોવાય છે. તેમાં કેટલીકના કર્તાનાં નામ જાણવામાં છે અને કેટલીકનાં નથી. પ્રથમ પ્રકારની કૃતિઓ નીચે મુજબ છે :—

- (૧) **સુભાષિતકોશ**— આ કૃતિ રામચન્દ્રે રચી છે.
- (૨) **સુભાષિતગ્રંથ**— આના કર્તા કીર્તિવિજય છે.
- (૩) **સુભાષિતષટ્ત્રિંશિકા**— આ નામની બે કૃતિઓ છે. એકના કર્તા જ્ઞાનસાગર છે અને બીજાના ‘લુંકા’ ગચ્છના યશસ્વિગણિ છે.
- (૪) **સુભાષિતાર્ણવ**— આ શુભચન્દ્રની રચના છે.
- (૫) **સૂક્તસમુચ્ચય**— આના કર્તા આચાર્ય રવિગુપ્ત છે.
- (૬) **સૂક્તાવલી** — આ તત્ત્વવલ્લભની રચના છે.
- (૭) **સૂક્તિમુક્તાવલી** — આ નામની ત્રણ કૃતિઓ છે. એના કર્તાનાં નામ શ્રુતમુનિ, સોમદેવ અને સોમસેન છે.
- (૮) **સૂક્તિરત્નાવલી** — આના કર્તા અભયચંદ્ર છે.

P. ૨૬૧

[સૂક્તિરત્નાવલી— આના કર્તા વિજયસોમસૂરિ છે. મુનિ મોક્ષરતિ વિ. ધ્વારા સંપાદિત થઈ પરમપદ્ય પ્રકાશન મુંબઈથી પ્રસિદ્ધ થઈ છે.]

બીજા પ્રકારની કૃતિઓનાં નામ નીચે મુજબ છે :—

સુભાષિત, સુભાષિતશતક, સુભાષિતષટ્ત્રિંશિકા, સુભાષિતસારોદ્ધાર, સુભાષિતાર્ણવ, સૂક્તસંગ્રહ, સૂક્તસંદોહ અને સૂક્તાવલી યાને સુભાષિતસંગ્રહ.

૧. આ કૃતિ “બુદ્ધિસાગરસૂરીશ્વર-ગ્રંથમાળા”માં ગ્રંથાંક ૧ તરીકે વિ. સં. ૨૦૦૭માં પ્રસિદ્ધ કરાઈ છે.

૨. એઓ શ્રીબુદ્ધિસાગરસૂરિના શિષ્ય શ્રીકીર્તિસાગરસૂરિના પ્રશિષ્ય થાય છે. એમના ગુરુનું નામ જિતેન્દ્રસાગર છે.

૩. આ ત્રિષષ્ટિ.માંથી ઉદ્દ્યુત કરાયાં છે.

૪. અજૈન કૃતિઓ તરીકે અત્રિ-સંહિતા, આરણ્યકોપનિષદ્, મનુસ્મૃતિ, રામાયણ, મહાભારત, યોગવાસિષ્ઠ. વરાહ-પુરાણ, શંકરાચાર્યકૃત મનાતાં ચર્પટ-પંજરિકા અને મોહ-મુદ્ગર, પંચગંગ, હિતોપદેશ ઈત્યાદિ કૃતિઓ પસંદ કરાઈ છે.

૫. અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આશ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિની દુર્લભતા અને ધર્મનું સ્વામ્યાતત્વ.

૬. જિ. ર. કો. (ખંડ ૧, પૃ. ૪૪૮)માં આ કૃતિનો “સૂક્તાનિ”એ નામે ઉલ્લેખ જોઈ મેં આ નામ યોજ્યું છે.

(૩) 'રાજનીતિ

નીતિવાક્યામૃત (લ. વિ. સં. ૧૦૨૫) – આના કર્તા દિ. તાર્કિક કવિ સોમદેવસૂરિ છે. એઓ 'દેવ' સંઘના યશોદેવના શિષ્ય નેમિદેવના શિષ્ય થાય છે અને મહેન્દ્ર ભટ્ટારકના અનુજ થાય છે. એમણે શકસંવત્ ૮૮૧ (વિ. સં. ૧૦૧૬)માં યશસ્તિલક-ચંપૂ નામની કૃતિ રચી છે. નીતિવાક્યામૃતની પ્રશસ્તિમાં યશોધર-ચરિત્રનો જે ઉલ્લેખ છે તે આ જ કૃતિ છે. વિશેષમાં આ ગ્રંથકારની (૧) 'ત્રિવર્ગ-મહેન્દ્ર-
P. ૨૬૨ માતલિ-સંજલ્પ, (૨) 'યુક્તિ-ચિન્તામણિ અને (૩) 'પણ્ણવતિ-પ્રકરણ એ ત્રણ કૃતિઓનો પણ અહીં નિર્દેશ છે પણ એકે હજી સુધી તો મળી આવી નથી આ ઉપરાંત એમની કૃતિ તરીકે 'સ્યાદ્વાદોપનિષદ્ અને સૂક્તિ-સમુચ્ચય જેવી કૃતિઓ ગણાવાય છે.

પં. નાથૂરામ પ્રેમીના 'મતે કનોજના રાજા મહેન્દ્રને માટે યોજાયેલી આ નીતિવાક્યામૃત નામની કૃતિ ગદ્યમાં સૂત્રરૂપે રચાયેલા ૩૨ સમુદેશમાં વિભક્ત છે. એમાં રાજા અને રાજ્ય-શાસન સાથે સંબંધ ધરાવનારી પુષ્કળ માહિતી અપાઈ છે. આ 'રાજનીતિને અંગેનો મહત્વનો ગ્રંથ છે. આ પૂર્વે 'મૌર્ય' વંશના 'ચન્દ્રગુપ્તને માટે ચાણક્યે 'અર્થશાસ્ત્ર રચી આ વિષયનો આકર-ગ્રંથ પૂરો પાડ્યો છે. ત્યાર પછી કામંદકે એના સંક્ષેપરૂપે પદ્યમાં નીતિસાર રચ્યો છે.

નીતિવાક્યામૃત (પૃ. ૩૬, ૧૦૭, ૧૭૧ (ઈ.) જોતાં જણાય છે કે એમાં વિષ્ણુગુપ્ત અને
P. ૨૬૩ ચાણક્યનો તેમજ એમના 'અર્થશાસ્ત્રનો ઉલ્લેખ છે. વિવિધ નીતિકારો અને સ્મૃતિકારોના ગ્રંથોનો લાભ લઈ આ નીતિવાક્યામૃત રચાયું છે.

૧. આનો અંતર્ભાવ ચાર પુરુષાર્થ પૈકી અર્થ-પુરુષાર્થમાં કરાય છે. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૬૧).
૨. આ ગ્રંથ અજ્ઞાતકર્તૃક સંસ્કૃત ટીકા તેમજ એ ટીકાગત પદ્યાત્મક અવતરણોની સૂચી સહિત "મા. દિ. ગ્રં."માં ગ્રંથાંક ૨૨ તરીકે વિ. સં. ૧૮૭૯માં છપાયો છે. મૂળની એક સુંદર તાડપત્રીય હાથપોથી મળે છે. "સોમદેવસૂરિકા નીતિવાક્યામૃત" નામનો પં નાથૂરામ પ્રેમીનો મનનીય લેખ જૈ. સા. ઈ. (પૃ. ૬૧-૮૨)માં છપાયો છે. એ લેખ તે આ સટીક કૃતિની ભૂમિકા રૂપે હતો એનો અંશતઃ વિસ્તાર છે.
૩. મહેન્દ્ર અને એના સારથિ માતલિ વચ્ચેની ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગ-પુરુષાર્થને અંગેની ચર્ચા સંવાદરૂપે આમાં રજૂ કરાઈ હશે.
૪. આ તર્કવિષયક ગ્રંથ હશે.
૫. આ કૃતિમાં ૮૬ પ્રકરણ હોવાં જોઈએ પણ એના વિષય વિષે જાણવું બાકી રહે છે.
૬. જુઓ ઉપર્યુક્ત લેખના પરિશિષ્ટરૂપ શકસંવત્ ૮૮૮નું દાનપત્ર (પૃ. ૮૧).
૭. જુઓ એમનો "જૈ. સિ. ભા." (ભા. ૧૧, અં. ૨)માં છપાયેલો લેખ "સોમદેવ ઔર મહેન્દ્રદેવ"
૮. આ વિષય યશસ્તિલક (આશ્વાસ ૩)માં પણ સારી રીતે ચર્ચાયો છે.
૯. તિલોચપણ્ણવતિ પ્રમાણે મુકુટધારી રાજાઓ પૈકી જૈન દીક્ષા લેનાર તરીકે આ નૃપતિ અંતિમ છે.
૧૦. પૃથ્વીના લાભ અને એના રક્ષણ માટે જેટલાં અર્થશાસ્ત્રો પૂર્વાચાર્યોએ પ્રસ્થાપિત કર્યા છે પ્રાયઃ તે સર્વેનો સંગ્રહ કરી આ અર્થશાસ્ત્ર યોજાયું છે એમ એનાં પ્રારંભમાં કહ્યું છે.
૧૧. આની નીતિવાક્યામૃત સાથે તુલના માટે જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૬૪-૬૫)

‘ટીકા’-આના કર્તાનું કે એમના ગુરુનું નામ હરિબલ હશે એમ લાગે છે. એઓ હરિના ભક્ત હોય એમ જણાય છે એટલે આ ‘સંસ્કૃત ટીકા કોઈ વૈષ્ણવે-અજૈને રચી હશે. આ ટીકામાં અનેક અવતરણો અપાય છે એથી એ મહત્વની છે. એમાં જે કેટલીક કૃતિઓનો ઉલ્લેખ છે તે આજે મળતી નથી.

(૪) પ્રકીર્ણક

‘બુદ્ધિસાગર (વિ. સં. ૧૫૨૦)- આના કર્તા જૈન ગૃહસ્થ સોની સંગ્રામસિંહ છે. એઓ માળવાના મહમદ ખલ્વા (ખીલજી)ના ભાંડાગારિક (ભંડારી) હતા અને રત્નસિંહસૂરિના પટ્ટાલંકાર ઉદયવલ્લભસૂરિના ભક્ત હતા. એમના પિતાનું નામ નરદેવ હતું. એઓ સોની સાંગણના વંશજ થાય છે. માંડવગઢના આ ઓસવાળે સર્વદર્શનોને સંમત એવી આ કૃતિ વિ. સં. ૧૫૨૦માં ચાર તરંગમાં ૪૧૪ (૮૭+૧૦૭+૭૦+૧૫૦) પદોમાં ગોદાવરીને તીરે પ્રતિષ્ઠાનપુરમાં નિજામ ઉપરની વિજયયાત્રાને પ્રસંગે રચી છે.

ધર્મ, નય, વ્યવહાર અને પ્રકીર્ણક નામના ચાર તરંગ પૈકી પ્રથમમાં દેવ, ગુરુ તેમજ પાંચ મહાવ્રતરૂપ ધર્મનું સ્વરૂપ આલેખાયું છે. બીજામાં રાજા, રાણી, રાજકુમાર, મંત્રી, અધિકારી, પ્રજાના સેવક તેમજ અશ્વ વગેરેનાં લક્ષણો વિચારાયાં છે. ત્રીજામાં વિશ્વાસ ક્યાં રાખવો અને સોગન ન ખાવા એ વાત કહી વાસ્તુનું નિરૂપણ કરાયું છે. ચોથામાં શરીરનું સ્વરૂપ, વૈદ્યકસાર, જ્યોતિઃસાર, સામુદ્રિકસાર, સ્ત્રીનું P. ૨૬૪ સ્વરૂપ, રત્ન ‘આદિની પરીક્ષા તેમજ મંત્રાદિ ચાર યોગ એમ વિવિધ વિષયો રજૂ કરાયા છે. આ ચોથા તરંગમાં મોતીનાં આઠ ઉત્પત્તિસ્થાન દર્શાવાયાં છે : (૧) ‘હાથીનું કુંભસ્થળ, (૨) નાગની ફેણ, (૩) શુક્તિ, યાને છીપ, (૪) શંખ, (૫) અભ્ર, (૬) મત્સ્ય, (૭) ડુક્કરની દાઢ અને (૮) વાંસ.’ આ સંબંધમાં અહીં કહ્યું છે કે હમણાં તો શુક્તિમાંથી થનારું મોતી વિશેષ મળે છે. વળી અહીં એવો પણ ઉલ્લેખ છે કે શંખ, વાંસ, ડુક્કર, હાથી, નાગ, અભ્ર અને મત્સ્યમાંથી ઉદ્ભવતાં મોતી ઉત્તરોત્તર એકેકથી ચડિયાતાં અને અવેધ્ય હોય છે.

આમ આ નાનકડી કૃતિ ચાણક્ય-નીતિ અને કામંદક-નીતિ જેવા પ્રૌઢ ગ્રંથોની સંક્ષિપ્ત આવૃત્તિરૂપ છે.



૧. આ મા. દિ. ગ્રં. ૨૨માં પ્રકાશિત છે. જુઓ પૃ. ૨૬૧.

૨. નેમિનાથે કાનડીમાં એક ટીકા રચી છે.

૩. આ કૃતિ “ઋ. કે. શ્વે. સંસ્થા” તરફથી ઈ. સ. ૧૮૩૬માં છપાયેલી છે. એનું મણિલાલ નબુભાઈ દિવેદીએ કરેલું ગુજરાતી ભાષાંતર ઈ. સ. ૧૮૮૧માં “વડોદરા દેશી કેળવણી ખાતું” તરફથી છપાવાયું છે.

૪. ‘આદિ’થી વજ્ર, મોતી, પદ્માગ અને નામમણિ એ ચાર અહીં અભિપ્રેત છે.

૫. આ માટે જુઓ, ભક્તામરસ્તોત્ર (શ્લો. ૩૫)

૬. અગસ્ત્યે કહ્યું છે કે :-

“દ્વિપેન્દ્રજીમૂતવરાહશઙ્ખ-મત્સ્યાહિશુકત્યુદ્ભવવેણુજાનિ ।

મુક્તાપ્લાનિ પ્રથિતાનિ લોકે તેષાં તુ શુકત્યુદ્ભવમેવ ખૂરિ ॥”

આ પદ્ય કુમારસમ્ભવ (સ. ૧, શ્લો. ૬)ની મલ્લિનાથે રચેલી સંજીવની નામની વ્યાખ્યામાં જોવાય છે.

પ્રકરણ ૧૭ : અજૈન લાક્ષણિક સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો

સમસ્ત વિશ્વના સાહિત્યને આપણે જૈન અને અજૈન એમ બે વર્ગમાં વિભક્ત કરી શકીએ. અજૈન સાહિત્ય એ જૈન સાહિત્ય કરતાં અતિશય વિપુલ છે. એ સાહિત્યના ભારતીય અને અભારતીય એમ બે વિભાગ પાડી શકાય. અત્ર ભારતીય સાહિત્ય પ્રસ્તુત છે. એના સર્જનમાં વૈદિક હિંદુઓ અને બૌદ્ધોનો મુખ્ય ફાળો છે. અહીં 'અજૈન સાહિત્યથી મુખ્યત્વે આ બે જ સંપ્રદાયોના લાક્ષણિકાદિ સાહિત્યને અંગેના નીચે મુજબના વિષયોની કેટલીક કૃતિઓ અભિપ્રેત છે :-

(૧) વ્યાકરણ, (૨) કોશ, (૩) છંદ, (૪) અલંકાર, (૫) ગણિત, (૬) નિમિત્ત, (૭) વૈદ્યક, (૮) નીતિ, (૯) શ્રવ્ય કાવ્ય (૧૦) દશ્ય કાવ્ય, (૧૧) ન્યાય અને (૧૨) યોગ.

'શ્રવ્ય' કાવ્યથી મહાકાવ્ય, ખંડ-કાવ્ય અને ગદ્યાત્મક કાવ્ય એમ ત્રણ સમજવાનાં છે. આમ અહીં મુખ્ય ૧૨ વિષયો છે અને પેટા-વિષયોને ભિન્ન ગણાતાં ૧૪ થાય છે. આ પૈકી હું અહીં પહેલા 'આઠ વિષયની કૃતિઓનો ક્રમવાર વિચાર કરું તે પૂર્વે "જૈન માનસ" વિષે થોડોક ઉલ્લેખ કરીશ.

જૈન માનસ— 'જૈન માનસ' એટલે અનેકાંતવાદનું કીડાંગણ. આથી તો આત્મૌપમ્યની અનુપમ ભાવનાથી ઓતપ્રોત જૈન શ્રમણો ગમે તે દર્શનની અને ગમે તે વિષયની ઉત્તમ કોટિની કૃતિઓનું સંવર્ધન અને સંરક્ષણ કરતાં જરા યે સંકોચ ન અનુભવે એ સ્વાભાવિક છે. વિશેષ આનંદની વાત તો એ છે કે અજૈન મંતવ્યો અનુસાર કાવ્ય રચતાં પણ એઓ ખંચાયા નથી એટલું જ નહિ પણ એને પોતાના સાંપ્રદાયિક રંગથી રંગવાનું અનુચિત પગલું એમણે ભર્યું નથી. આમ એમણે ઉદારતાની સાચી લહાણી કરી છે અને સાહિત્યની સર્વદેશીય સેવા બજાવી છે.

સમ્યક્-શ્રુત અને મિથ્યા-શ્રુતની વ્યાખ્યાનો (૧) વિષય અને પ્રણેતા તેમજ (૨) અધિકારી એમ બે રીતે વિચાર થઈ શકે છે^૧ અને મિથ્યા-શ્રુતને પણ સમ્યક્-શ્રુત તરીકે પરિણામાવી શકે છે. જૈન દર્શનની આવી આદર્શ નીતિને લઈને જૈન શ્રમણો એમ સાચે જ માનતા હતા અને આજે યે માને છે કે સાહિત્ય અને વિજ્ઞાન એ કોઈનાં બાપીકાં ક્ષેત્ર નથી; સમસ્ત વિદ્યાવ્યાસંગી જનોનો એના ઉપર અધિકાર છે.

૧. મુસ્લિમ, પારસી અને ખ્રિસ્તી કોમની કૃતિઓ પૈકી ફક્ત એક મુસ્લિમની અને તે પણ અપભ્રંશમાં જ રચાયેલી કૃતિ પર જૈન વિવરણ છે. એવી રીતે ભાષાની દૃષ્ટિએ મુખ્યત્વે સંસ્કૃત અને ક્વચિત્ પાઈય કૃતિઓ ઉપર વિવરણો છે. આથી કરીને દ્રાવિડ કૃતિઓ ઉપર જૈનોએ સંસ્કૃતમાં વિવરણો રચ્યાં હોય તો તે વાત અહીં જતી કરાઈ છે.

૨. શ્રવ્ય અને દશ્ય કાવ્ય વિષે દ્વિતીય ખંડના પ્રથમ ઉપખંડમાં અને ન્યાય અને યોગ વિષે એ દ્વિતીય ખંડના દ્વિતીય ઉપખંડમાં વિચાર કરાયો છે.

૩. આ બાબત મેં "જૈન દર્શનનું તુલનાત્મક દિગ્દર્શન" નામના મારા લેખ (લેખાંક ૨, પૃ. ૧૩૧)માં દર્શાવી છે. આ લેખના લેખાંક ૧-૬ "હિંદુ મિલનમંદિર" (વર્ષ ૮, અં. ૨-૭)માં છ કટકે છપાયા છે. આ લેખ મેં ગુજરાતીમાં રચેલાં ૧૪૦ સૂત્રો અને એના વિવરણરૂપ છે.

ફાળો— અજૈન કૃતિઓને અંગે જૈનોનો જે ફાળો છે તેમાં મોટે ભાગે વિવરણો છે. એની સંખ્યા લગભગ ૨૦૦ની છે. આનાથી અજૈન કાવ્યોની પાદ-પૂર્તિઓની સંખ્યા ઉતરતી છે અને એનાથી પણ અલ્પ સંખ્યા કેટલીક અજૈન કૃતિઓના સંક્ષેપ કે સારાંશરૂપ રચનાઓની છે.

(૧) વ્યાકરણ

P. ૨૬૭

^૧અષ્ટાધ્યાયી (ઉ. ઈ. સ. પૂ. ચોથી સદી) — ઉપલબ્ધ સંસ્કૃત વ્યાકરણોમાં આ સૌથી પ્રાચીન છે. એ આઠ અધ્યાયોમાં વિભક્ત કરાયેલું હોવાથી એને અષ્ટાધ્યાયી કહે છે. એના પ્રત્યેક અધ્યાયમાં ચાર ચાર પાદ છે. આ વ્યાકરણમાં આશરે ૪૦૦૦ સૂત્રો છે. ચીની મુસાફર હ્યુએનસંગને મતે આ વ્યાકરણનું પરિમાણ ૧૦૦૦ શ્લોકનું છે.^૨

આ વ્યાકરણે અષ્ટક, વૃત્તિસૂત્ર તેમજ શબ્દાનુશાસન પણ કહે છે. આ વ્યાકરણ કાળ અને ઉપસર્જન વગેરેની પરિભાષાઓથી રહિત છે.

^૩શંકરાચાર્ય દ્વારા પ્રશંસિત આ વ્યાકરણના પ્રણેતાનાં દાક્ષીપુત્ર, ^૪શાલાતુરીય, પાણિનિ ઇત્યાદિ વિવિધ નામો છે તેમાં અંતિમ નામ વિશેષતઃ પ્રચલિત છે અને એને લઈને તો એમના વ્યાકરણને ‘પાણિનીય’ કહે છે. આ વ્યાકરણને અંગે પાઠાંતરો જોવાય છે. કેટલાક તો પાણિનિના સ્વકીય પ્રવચન-ભેદથી ઉદ્ભવ્યાં છે. આ પ્રવચન-ભેદને લઈને અષ્ટાની લઘુસૂત્ર-પાઠ અને બૃહત્સૂત્ર-પાઠ એમ બે વાચનાઓ મળે છે.

પાણિનિએ પોતે ગણપાઠ, ધાતુપાઠ, ઉજ્જાદિસૂત્ર અને લિંગાનુશાસન અષ્ટાનાં ^૫પરિશિષ્ટ રૂપે P. ૨૬૮ રચ્યાં છે.^૬

પાણિનિએ આપિશલ વ્યાકરણનો મુખ્યત્વે ઉપયોગ કર્યો છે. અને એમના પુરોગામી વૈયાકરણોનાં અનેક સૂત્ર અપનાવ્યાં છે.^૭ પ્રાતિશાખ્યોનાં અને શ્રૌતસૂત્રોનાં અનેક સૂત્ર પાણિનીય સૂત્ર સાથે સમાનતા ધરાવે છે.^૮ પાણિનિની પૂર્વે છંદોબદ્ધ વ્યાકરણ હશે એમ લાગે છે.

શબ્દાવતાર— આ અષ્ટા. ઉપરનો ન્યાસ છે. આ ન્યાસ હજી સુધી તો મળી આવ્યો નથી. આનું પરિમાણ ૩૦૦૦૦ શ્લોક હોવાનું કહેવાય છે. આ ન્યાસના કર્તા દિ. પૂજ્યપાદ છે, જુઓ પૃ. ૧૬.

૧. આ વ્યાકરણ જર્મન અનુવાદ સહિત બ્લોટલિંગે ઈ. સ. ૧૮૮૭માં પ્રકાશિત કર્યું હતું.

૨. જુઓ સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૧૪૧).

૩. એમણે બ્રહ્મસૂત્ર ઉપર શારીરક-ભાષ્ય, દસ મુખ્ય ઉપનિષદો અને ભગવદ્ગીતા ઉપર ટીકા તેમજ અનેક સ્તોત્રો રચ્યાં છે. નવાઈની વાત એ છે કે પૂર્વે રચેલી કોઈ પણ કૃતિનો ત્યાર બાદ રચાયેલી કૃતિમાં પોતાના નામે ઉલ્લેખ નથી. જુઓ Sanskrit Literature (The P.E.N. Books. The Indian Literatures No. XII) નું પૃ. ૫૧.

૪. ‘શલાતુર’ એ પાણિનિના પૂર્વજોનું વતન ગણાય છે.

૫. અષ્ટા. (૧-૩-૨)ની કશિકા-વૃત્તિ પ્રમાણે આ ચાર પરિશિષ્ટો ખિલ-ગ્રંથો છે.

૬. જુઓ સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૧૫૮).

૭-૮. એજન (ભા. ૧, પૃ. ૧૫૮-૧૫૯).

કાશિકા (લ. વિ. સં. ૭૦૦)— એ જ્યાદિત્ય અને વામનના ^૧સંયુક્ત પરિશ્રમનું ફળ છે. ^૨પતંજલિકૃત મહાભાષ્ય અને ભર્તૃહરિકૃત વાક્યપદીય પછીની, અષ્ટા.ને અંગેની ^૩મહત્વની કૃતિ તરીકે આનો ઉલ્લેખ કરાય છે. આ વૃત્તિમાં મહાભાષ્યને અનેક સ્થળે ન અનુસરતાં, પ્રાચીન વૃત્તિઓનું P. ૨૬૮ અનુસરણ કરાયું છે. ઈત્સિંગના મતે જ્યાદિત્યનું અવસાન વિ. સં. ૭૧૮ની આસપાસમાં થયું હતું. સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૩૩૪) પ્રમાણે વામન વિ. સં. ૭૦૦ની પહેલાં થયાં છે.

^૪કાશિકાવિવરણ-પંજિકા— આ પંજિકાના કર્તાનું નામ જિનેન્દ્રબુદ્ધિ છે. એમને કેટલાક વિદ્વાનો ‘બૌદ્ધ’ ગણે છે. “જૈ. સિ. ભા.” (વર્ષ ૮, પત્ર ૫૮)માં એઓ ‘જૈન’ હોવાની સંભાવના કરાઈ છે. એમની આ પંજિકા એ ઉપર્યુક્ત કાશિકાની સૌથી પ્રાચીન વ્યાખ્યા છે. એને ‘ન્યાસ’ પણ કહે છે. આના ઉપર મહામિશ્રની ટીકા છે.

આ ઉક્તિના સંગ્રહરૂપ ^૫કૃતિની બે હાથપોથીઓનો પરિચય D C G C M (Vol. II, pt. ૧)માં ક્રમાંક ૩૮૬ અને ૪૧૭ તરીકે અપાયો છે. પ્રારંભમાં ભારતીના સ્મરણપૂર્વકનું પદ્ય છે. ત્યાર બાદ વિભક્તિનું સ્વરૂપ ગદ્યમાં આલેખાયું છે. પાઈય શબ્દોનાં સંસ્કૃત સમીકરણો (દા. ત. કરાઈ=ક્રિયતે અને જણાઈ=જ્ઞાયતે) આ કૃતિનો મહત્વનો અને સૌથી મોટો અંશ છે.

પદ્યવ્યવસ્થા— આના કર્તા વિમલકીર્તિ છે. એમણે પાણિનિકૃત અષ્ટા. પ્રમાણે સંસ્કૃત ધાતુઓનાં ૫૬ જાણવાના નિયમો સૂત્રોને પદ્યાત્મક સ્વરૂપ આપી રજૂ કર્યા છે. એમણે પોતાને ‘વિદ્વાન’ કહ્યા છે.

ટીકા (વિ. સં. ૧૬૮૧)— આ ૩૩૦૦ શ્લોક જેવડી ટીકાના કર્તા ઉદયકીર્તિ છે. એઓ ‘ખરતર’ ગચ્છના સાધુકીર્તિના શિષ્ય વિમલતિલકના શિષ્ય સાધુસુન્દરના શિષ્ય થાય છે. એમણે આ ટીકા બાલજનોના બોધાર્થે વિ. સં. ૧૬૮૧માં રચી છે. એના અંતમાં એમણે છ પદ્યની પ્રશસ્તિ આપી છે. આની મૂળ સહિતની એક હાથપોથી વિ. સં. ૧૭૧૩માં સુખસાગરગણિના શિષ્ય સમયહર્ષને માટે લખાયેલી મળે છે. આ હાથપોથીનો અવતરણપૂર્વક પરિચય “પદ્યવ્યવસ્થાસૂત્રકારિકા સટીકા” નામથી D C G C M (Vol. II, pt. 1, pp. 191-193)માં અપાયો છે.

૧. ભારતીય સાહિત્યમાં એવી કેટલીક કૃતિઓ છે કે જે દ્વિકર્તૃક છે. જેમકે સ્કન્દે અને મહેશ્વરે મળીને રચેલી નિરુક્તની ટીકા.

૨. સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૩૩૩) પ્રમાણે કાશિકા જે આજે ઉપલબ્ધ છે તેની પાંચ અધ્યાય પૂરતી રચના જ્યાદિત્યની છે અને બાકીની વામનની છે. અસલમાં બંનેએ પૃથક્ પૃથક્ આઠે અધ્યાયની વૃત્તિ રચી હશે. (જુઓ સં. વ્યા. ઈ. (પૃ. ૩૩૬). જ્યાદિત્યની અપેક્ષાએ વામનની રચના વિશેષ પ્રૌઢ છે.

૩. કાશિકા કરતાં પ્રાચીન એવી કુણિ નામની વૃત્તિમાં ગણપાઠને સ્થાન નથી, જ્યારે આ કાશિકામાં છે.

૪. આ પંજિકા શ્રીશયન્દ્ર ચક્રવર્તિએ ઈ. સ. ૧૮૧૩-૧૮૨૫માં છપાવી છે. જુઓ DCGCM (Vol. II, pt. I, p. 56).

૫. જુઓ પૃ. 54.

૬. આ ભાગમાં વૈદિક અને પાણિનીય વ્યાકરણોને લગતી હાથપોથીઓનો પરિચય ડૉ. શ્રીપાદ કૃષ્ણ બેલ્લલકરે આપ્યો છે. એમાં ઉક્તિરત્નાકરને સ્થાન અપાયું છે એટલે એ પાણિનીય વ્યાકરણને લગતી કૃતિ ગણાય. એ હિસાબે મેં એની અહીં નોંધ લીધી છે.

વિશ્રાન્તવિદ્યાધર (ઉ. વિ. સં. ૬૦૦) – આ વ્યાકરણને ‘જૈન’ કૃતિ માની એનો પરિચય દ્વિતીય પ્રકરણ (પૃ. ૨૩-૨૪)માં મેં આપ્યો છે. જો એના પ્રણેતા વામન અજૈન જ હોય તો આ ‘અજૈન’ કૃતિ ગણાય અને એ હિસાબે એનો ઉલ્લેખ અહીં થવો ઘટે.

ન્યાસ– મલ્લવાદીએ આ ન્યાસ રચ્યો હતો (જુઓ પૃ. ૨૪) પણ એ હજી સુધી તો અપ્રાપ્ય છે.

‘કાતન્ત્ર (ઉ. વિ. સં. ૩૫૦) – આ કેવળ લૌકિક સંસ્કૃતનું ઘણું પ્રાચીન વ્યાકરણ છે. એને ‘કલાપક અને કૌમાર પણ કહે છે. એની રચના અષ્ટાને આધારે નહિ પણ અન્ય કોઈ પ્રાચીન વ્યાકરણને આધારે થયેલી હોય એમ જણાય છે. એના બે ભાગ પડે છે : (૧) આખ્યાતાન્ત્ર અને (૨) કૃદન્ત્ર. પ્રથમ ભાગના કર્તા તરીકે ‘શર્વવર્માનો અને બીજા ભાગના કર્તા તરીકે કાત્યાયનનો ઉલ્લેખ કરાય છે. સં. વ્યા. P. ૨૭૦ ઈ. (ભા. ૧, પૃ. ૪૦૪)માં એના કર્તાએ કાતન્ત્રને મહાભાષ્ય કરતાં પ્રાચીન ગણ્યું છે.^૧ કાતન્ત્રનો થોડોક ભાગ મધ્ય એશિયામાંથી મળી આવ્યો હતો. એનો ધાતુપાઠ તિબેટી ભાષામાં આજે પણ મળે છે. કવિ ધનપાલે શોભનસ્તુતિની ટીકા (શ્લો. ૪)માં પોતાના નાના ભાઈ મુનીશ્વર શોભનને અંગે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે :-

“કાતન્ત્રચન્દ્રોદિતતન્ત્રવેદી”

આ ઉપરથી એક સમયે કાતન્ત્રનો ખૂબ પ્રચાર હશે એમ ફલિત થાય છે.^૨ એમાં લગભગ ૧૪૦૦ સૂત્રો છે અને એ વિશેષતઃ પ્રચલિત પ્રયોગોને જ સ્પર્શે છે એથી એ લોકપ્રિય બન્યું હશે એમ લાગે છે.

કાતન્ત્ર ઉપર જે વૃત્તિઓ મળે છે તેમાં દુર્ગસિંહકૃત વૃત્તિ સૌથી પ્રાચીન ગણાય છે.^૩ આ વૃત્તિમાં ભારવિકૃત કિરાતાર્જુનીયમાંથી અને મયૂરકૃત સૂર્યશતકમાંથી એકેક અવતરણ અપાયું છે. એ ઉપરથી

૧. આ રૂપમાલા વૃત્તિ સહિત હીરાચંદ નેમિચંદે મુંબઈથી વિ. સં. ૧૯૫૨માં છપાવ્યું છે. ત્યાર બાદ બિહારીલાલ કથનેરાએ ઈ. સ. ૧૯૨૭માં આ વ્યાકરણ છપાવ્યું છે.

૨. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૭૪)માં કાતન્ત્રના નામાંતર તરીકે કલાપનો ઉલ્લેખ છે.

૩. આને બદલે જૈ. સા. સં. ઈ. (પૃ. ૨૮૪)માં શિવશર્મા અને જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૩)માં સર્વવર્મન નામ છે.

૪. ડૉ. શામશાસ્ત્રીનો એક લેખ Mythic Journalના ઈ. સ. ૧૯૨૮ના જાન્યુઆરીના અંકમાં છપાયો છે. તેમાં એમણે કહ્યું છે કે કાતન્ત્ર ઈ. સ. ની ત્રીજી સદીમાં રચાયું હોવું જોઈએ. જુઓ “જૈ. સ. પ્ર.” (વ. ૭, અં. ૧-૩, પૃ. ૮૦ ટિ.)

૫. “પુરાતત્ત્વ” (૨, ૪૧૯)માં છંપાયેલા લેખમાં જિનવિજયજીએ જે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે તેમાં કાલાપક અને કાતન્ત્રને ભિન્ન ગણ્યા છે :-

“ગૂજરાતમાં વ્યાકરણ-ગ્રંથોમાં પહેલું સ્થાન કાલાપકને અને બીજું સ્થાન કાતન્ત્રને મળેલું હતું. ગૂજરાતમાં રચાયેલા ગ્રંથોમાં પ્રમાણરૂપે જ્યાં વ્યાકરણનાં સૂત્રો મળી આવે છે ત્યાં મોટે ભાગે આ જ બે વ્યાકરણોનાં હોય છે.” - જૈ. સા. સં. ઈ. (પૃ. ૨૮૫).

આ લેખમાં વિદ્યાનંદ વ્યાકરણનો ઉલ્લેખ છે પણ એને દિ. કૃતિ ગણી છે તો શું એ સાચી વાત છે ?

૬. જુઓ સં. વ્યા. ઈ. (ભા ૧, પૃ. ૪૦૭).

P. ૨૭૧ દુર્ગસિંહ ભારવિ મયૂરથી પૂર્વવર્તી નથી એમ ફલિત થાય છે. સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૦૯) પ્રમાણે આ દુર્ગસિંહ એ કાશિકાના કર્તા કરતાં પ્રાચીન છે.

ચ. પ્ર. (વસ્તુપાલ-પ્રબંધ, પૃ. ૨૨૬)માં દુર્ગસિંહકૃત વૃત્તિનો ઉલ્લેખ છે.

“ભારતીય વિદ્યા” (વર્ષ ૨, અં. ૩)માં શ્રી, અગરચંદ નાહટાનો “જૈનેતર ગ્રન્થોં પર જૈન વિદ્વાનોંકી ‘ટીકાવેં’” નામનો લેખ છપાયો છે. એમાં એમણે કાતન્ત્રને અંગે નવ વૃત્તિઓ નોંધી છે :-

(૧) દૌર્ગસિંહીવૃત્તિ — આ ૩૦૦૦ શ્લોકની વૃત્તિના કર્તા પ્રધુમ્નસૂરિ (વિ. સં. ૧૩૬૯) છે.

(૨) દુર્ગપદ્મપ્રબોધવૃત્તિ — આ ‘ખરતર’ ગચ્છના પ્રબોધમૂર્તિ (જિનપ્રબોધસૂરિ)ની વિ. સં. ૧૩૨૮ની રચના છે.

(૩) બાલાવબોધવૃત્તિ— આ ‘અંચલ’ ગચ્છના મેરુતુંગસૂરિએ વિ. સં. ૧૪૪૪માં રચી છે.

(૪) કાતન્ત્રવિસ્તાર — આના કર્તા વર્ધમાન છે. *કર્ણદેવોપાધ્યાય એ એમનું નામાંતર હશે એમ શ્રી અગરચંદ નાહટાએ કહ્યું છે.

કાતન્ત્રવિસ્તાર— આના કર્તા કવિ વર્ધમાન છે અને એની ‘કન્નડ’ લિપિમાં લખાયેલી ૧૩૪ પત્રની (પંક્તિ પ્રતિપત્ર ૫, અક્ષર પ્રતિપંક્તિ ૩૬) હાથપોથી મળે છે એમ ક. તા. ગ્રં. (પૃ. ૧૦૭)માં ઉલ્લેખ છે. પૃ. ૩૨૨ પ્રમાણે આ કવિ વર્ધમાને શ્રીપાલચરિત રચ્યું છે. કાતન્ત્રવિસ્તાર નામ સાચું છે કે કાતન્ત્રવિસ્તર એ વાત બાજુ પર રાખીએ તો પણ આ કૃતિ કાતન્ત્રના સ્પષ્ટીકરણરૂપ હશે એમ જણાય છે.

P. ૨૭૨ (૫) કાતન્ત્રરૂપમાલા — આના કર્તા દિ. ત્રૈવિદ્ય ભાવસેન છે.

(૬) કાતન્ત્રરૂપમાલાલઘુવૃત્તિ — આના કર્તા દિ. સકલકીર્તિ છે.

(૭) કાતન્ત્રદીપકવૃત્તિ — આના કર્તા મુનીશ્વરસૂરિના શિષ્ય હર્ષચન્દ્ર હશે.

(૮) કાતન્ત્રભૂષણ — આ ૨૪૦૦૦ શ્લોક પૂરતી કૃતિના કર્તા ધર્મધોષ છે.

(૯) વૃત્તિત્રયનિબંધ — આ ૭૦૦૦ શ્લોક જેવડી કૃતિના કર્તા રાજશેખરસૂરિ છે.

[(૧૦) બાલાવબોધ— અંચલગચ્છના મહેન્દ્રસૂરિના શિષ્ય મેરુતુંગની આ કૃતિ છે. સત્તરીભાસની ૧૪૪૯માં રચેલી ટીકામાં કર્તાએ આનો ઉલ્લેખ કર્યો છે.]

૧. આ જાતની ટીકાઓની સંક્ષિપ્ત નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૦૪, ૩૦૫ ૩૩૪ અને ૩૩૫)માં અપાયેલી છે. એને લક્ષ્યમાં રાખી મેં શોભન-સ્તુતિની મારી (સંસ્કૃત ભૂમિકામાં સુચવાયા મુજબ વીરસંવત્ ૨૪૫૪માં લખેલી) ભૂમિકા (પૃ. ૩૦-૩૧)માં એની નોંધ લીધી છે. અહીં જે તર્કરહસ્યદીપિકાનો ઉલ્લેખ છે તે બ્રાન્ત છે એટલે એ રદ કરવો ઘટે.

૨. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૩)માં આનો “વૃત્તિવિવરણપંજિકાદુર્ગપદ્મપ્રબોધ” તરીકે ઉલ્લેખ છે.

૩. આની એક હાથપોથી વિ. સં. ૧૪૫૩માં લખાયેલી છે.

૪. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૪)માં વર્ધમાનને રાજા કર્ણદેવના પુરોહિત કહ્યા છે અને શું એઓ જૈન છે એવો પ્રશ્ન ઉઠાવાયો છે.

૫. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૪)માં એમની કૃતિ તરીકે રૂપમાલાવૃત્તિનો ઉલ્લેખ છે. એની એક હાથપોથી વિ. સં. ૧૫૩૫માં લખાયેલી છે.

૬. આ સંખ્યા ખરી છે ?

૭. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૪)માં ત્રણ પૂર્વવર્તી ટીકાને આધારે ૩૧૦૦ શ્લોક જેવડી અને પદ્યમાં રચાયેલી કૌમારસારસમુચ્ચય નામની જે ટીકાનો ઉલ્લેખ છે તે તો આ નથી ?

જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૮૩)માં હુંડુકના પુત્ર મહાદેવે રચેલી શબ્દસિદ્ધિવૃત્તિનો ઉલ્લેખ છે. એની તાડપત્રીય પ્રતિ વિ. સં. ૧૩૪૦માં લખાયેલી છે. વળી આ પૃષ્ઠમાં ઉપા. વીરસિંહના શિષ્ય ગૌતમે ૪૦૦૦ શ્લોક જેવડી દૌર્ગસિંહીદીપિકા રચ્યાનો ઉલ્લેખ છે. પૃ. ૮૪માં ગોલ્હણકૃત ચતુષ્કવૃત્તિનો મોક્ષેશ્વર (અજૈન ?) કૃત 'આખ્યાનવૃત્તિનો, પૃથ્વીચંદ્રસૂરિકૃત વૃત્તિનો અને એક અજ્ઞાતકર્તૃક વૃત્તિનો ઉલ્લેખ છે.

બૃ.ટિ.માં ૩૨૫ શ્લોક જેવડા કાલાપકવિશેષવ્યાખ્યાનની નોંધ છે.

*કલાપ-વ્યાકરણ-સંધિ-ગર્ભિત-સ્તવ-કલાપ વ્યાકરણનાં "સિન્દ્વો વર્ણસમામ્નાયઃ" જેવાં સંધિસૂત્રની P. ૨૭૩ પૂર્તિરૂપે આ સ્તવ ૨૩ પદોમાં ઋષભદેવના ગુણોત્કીર્તનરૂપે રચાયેલો છે.

અવચૂરિ-આના કર્તાનું નામ જાણવામાં નથી.

બાલશિક્ષા-આ ગુજરાતી ભાષા દ્વારા કાતન્ત્ર નામનું સંસ્કૃત વ્યાકરણ શિખવવા માટેનું સાધન છે. એ સાઠાકના પુત્ર કૂરસિંહના પુત્ર સંગ્રામસિંહે વિ. સં. ૧૩૩૬માં કરેલી રચના છે. આ સંગ્રામસિંહ જૈન હશે એમ પં. લાલચન્દ્ર ભ. ગાંધીએ "બાલશિક્ષા" નામના એમના લેખમાં કહ્યું છે. એ હિસાબે આનો અહીં હું વિચાર કરું છું. પ્રારંભમાં પરબ્રહ્મને પ્રણામ કરી કર્તાએ આ વ્યાકરણના 'પ્રકમ' નામના આઠ વિભાગોનાં નામ ગણાવ્યાં છે :-

(૧) સંજ્ઞા, (૨) સંધિ, (૩) સ્યાદિ, (૪) કારક, (૫) સમાસ, (૬) અન્યોક્તિ-વિજ્ઞાન, (૭) સંસ્કાર અને (૮) ત્યાદિ.

સાતમા પ્રકમમાં લગભગ ૬૦૦ ગુજરાતી શબ્દો એના સંસ્કૃત પર્યાય સાથે અપાયા છે.^૩ એમાંનાં વર્ણાખરાં ક્રિયાપદ છે. આ વ્યાકરણમાં શૃંગારતિલકાલંકાર, કુમારસંભવ, શિશુપાલવધ વગેરેમાંથી અવતરણ અપાયાં છે.

સારસ્વત વ્યાકરણ-સામાન્ય રીતે આના કર્તા તરીકે અનુભૂતિ-સ્વરૂપાચાર્ય (વિ. સં. ૧૩૦૦)નું નામ સૂચવાય છે, પણ સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૪૫૩) પ્રમાણે તો એઓ આ વ્યાકરણની પ્રક્રિયાને સરલ કરનારા છે અને સારસ્વતના વાસ્તવિક કર્તાનું નામ તો નરેન્દ્રાચાર્ય છે. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૩૩) પ્રમાણે પણ અનુભૂતિસ્વરૂપાચાર્ય તો કોઈકે રચેલાં સરસ્વતી-સૂત્રોની પ્રક્રિયા રચી છે. P. ૨૭૪

*ભોજ-વ્યાકરણ (લ. વિ. સં. ૧૬૬૫)-આના પ્રણેતા પાઠક વિનયસાગર છે. એઓ 'વિધિ' પક્ષના 'કલ્યાણસાગરસૂરિના શિષ્ય થાય છે. એમણે આ પદ્માત્મક વ્યાકરણ કચ્છના રાજા નામે ભારમલ્લના

૧. 'આખ્યાન' નહિ પણ 'આખ્યાત' જોઈએ.

૨. આ સ્તવ પ્રકાશિત છે ?

૩. આને લઈને આપણે આ વિભાગને અકારાદિ ક્રમ વિનાના પ્રાચીન ગુજરાતી-સંસ્કૃત કોશ તરીકે ઓળખાવી શકીએ

૪. આ વ્યાકરણ ઉમરસી રાયસીની વિધવા જેતબાઈએ વિ. સં. ૧૮૭૫માં મુંબઈથી પ્રકાશિત કર્યું છે. પ્રારંભમાં બે પાનાં જેટલો સંસ્કૃતમાં ઉપોદ્ઘાત છે.

૫. સંસ્કૃત ઉપોદ્ઘાતમાં સૂચવાયું છે કે સુધર્મસ્વામીથી ૩૪મી પાટે આ સૂરિ થયા વિ. સં. ૧૬૫૮માં એઓ હસ્તિનાપુરી આસપાસ વિહરતા હતા.

પુત્ર ભોજની તુષ્ટિ માટે એની આજ્ઞાથી રચ્યું છે. આ વ્યાકરણ ત્રણ વિભાગમાં વિભક્ત છે. એ વિભાગોને અનુક્રમે પ્રથમા વૃત્તિ, દ્વિતીયા વૃત્તિ અને તૃતીયા વૃત્તિ કહી છે. એમાં અનુક્રમે ૭૦૦ (પત્ર ૧અ-૨૮આ), ૧૦૭૮ (પત્ર ૨૮આ-૬૭આ) અને ૨૫૦ (પત્ર ૬૭આ-૭૬આ) પદો છે. આમ એકંદરે ૨૦૨૮ પદો છે. એ પૈકી ઘણાંખરાં ‘અનુષ્ટુભ’માં છે.

પ્રથમા વૃત્તિનો પ્રારંભ લોકેશને પ્રણામ કરીને કરાયો છે. બીજા પદમાં સારસ્વતીએ સંજ્ઞ સૂત્રો રચ્યાં છે એમ કહ્યું છે. ત્રીજા પદની શરૂઆત “અ ઇ ઉ ઋ લૃ સમાનાઃ” થી કરાઈ છે. આમ આ વ્યાકરણ સારસ્વત વ્યાકરણનાં ‘સૂત્રોનું પદ્યાત્મક વિવરણ છે.’ આ પ્રથમા વૃત્તિના અંતમાં પ્રશસ્તિરૂપે બે પદો છે. એમાં ભોજ રાજા રાજ્ય કરે છે એવો ઉલ્લેખ છે. આથી આ કૃતિ એ રાજાના રાજ્ય દરમ્યાન રચાઈ છે એમ ફલિત થાય છે.

P. ૨૭૫ દ્વિતીયા વૃત્તિની શરૂઆત શ્રીધરને નમનપૂર્વક કરાઈ છે. ત્યાર બાદ ધાતુઓના પ્રત્યયોનો અધિકાર હાથ ધરાયો છે. આમ આ ‘ત્યાદિ’ની વૃત્તિ છે. આના અંતમાં પણ પ્રથમા વૃત્તિની પેઠે પ્રશસ્તિરૂપે બે પદો અપાયાં છે અને તે પણ લગભગ એનાં એ જ છે.

તૃતીયા વૃત્તિના પ્રારંભમાં શંભુને નમસ્કાર કરાયો છે અને અંતમાં પહેલી બે વૃત્તિની જેમ બે પદો પ્રશસ્તિરૂપે છે. ત્યાર પછી નીચે મુજબનું એક વધારાનું પદ છે :

“અવતાદ્ વો હયગ્રીવઃ કમલાકર ઈશ્વરઃ । સુરાસુરનરાકારમધુપાષીતપત્કજઃ ॥”

આ સારસ્વત વ્યાકરણ તરફ જૈનોની અભિરુચિ સૂચવે છે. આની વિશેષ પ્રતીતિ તો એથી થાય છે કે એના ઉપર નીચે મુજબની ૧૮ જૈન ટીકાઓ મળે છે :-

(૧) દીપિકા યાને ઢુંઢિકા - આ વૃત્તિ ‘વટ’ ગચ્છના વિનયસુન્દરના શિષ્ય મેઘરત્ને વિ. સં. ૧૫૩૬માં રચી છે. આને કેટલાક ઢુંઢિકા કહે છે. આનું પરિમાણ લગભગ ૭૫૦૦ શ્લોક જેટલું છે. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૩૪)માં ૪૫૦૦ જેટલું કહ્યું છે તે સમુચિત નથી. વળી ગચ્છનો ‘બૃહત્ ખરતર’ તરીકેનો ઉલ્લેખ ભ્રાન્ત છે. આની વિ. સં. ૧૬૦૫માં લખાયેલી હાથપોથી મળે છે. એ ‘મહિમાભક્તિ’ ભંડારમાં છે.

(૨) વૃત્તિ - દયારત્ને વિ. સં. ૧૬૨૬ની આસપાસમાં આ વૃત્તિ રચી છે.

(૩) ક્રિયાચન્દ્રિકા- વિ. સં. ૧૬૪૧માં ‘ખરતર’ ગચ્છના ગુણરત્ને આ રચી છે.

P. ૨૭૬ (૪) ન્યાસ - આ રત્નહર્ષ અને હેમરત્નના સંયુક્ત પરિશ્રમનું ફળ છે.

(૫) રૂપરત્નમાલા - ભાનુમેરુના શિષ્ય નયસુન્દરે ૧૪૦૦૦ શ્લોક જેવડી આ ટીકા વિ. સં. ૧૬૭૬માં રચી છે.

૧. સરોવરમાં પદો જેમ ભમતા ભમરાઓની શ્રેણિમાં શોભે છે તેમ અંતર્ભૂત સૂત્રો પદોની શ્રેણિમાં શોભે છે. જુઓ પૃ. ૭૬આ, શ્લો. ૨૪૪.

૨. કેટલાક પ્રયોગો પાણિનિના વ્યાકરણને આધારે અપાયા છે. જુઓ પત્ર ૭૬આ

૩. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૩૪) પ્રમાણે આ ધનરત્નના શિષ્ય છે.

(૬) વૃત્તિ - ‘ખરતર’ ગચ્છના હેમનંદન અને રત્નહર્ષના શિષ્ય સહજકીર્તિએ લક્ષ્મીકીર્તિની સહાયતાથી વિ. સં. ૧૬૮૧માં આ રચી છે.

(૭) ‘ટીકા-ચન્દ્રકીર્તિસૂરિ’એ આ ટીકા વિક્રમની ૧૭મી સદીમાં રચી છે. સારસ્વત-ધાતુપાઠ રચનારા હર્ષકીર્તિસૂરિએ આનો પ્રથમાદર્શ લખ્યો છે.

(૮) ટીકા - હર્ષકીર્તિસૂરિએ આ રચી છે.^૧

(૯) પ્રક્રિયા-વૃત્તિ- વિક્રમની ૧૭મી સદીના ‘ખરતર’ ગચ્છના વિશાલકીર્તિની આ રચના છે.

(૧૦) ટીકા - ‘તપા’ ગચ્છના ઉપા. ભાનુચન્દ્રે આ રચી છે.

(૧૧) ટીકા - આની રચના ભાનુચન્દ્રના શિષ્ય દેવચન્દ્રે પદ્યમાં કરી છે.

(૧૨) ટિપ્પનક- આ હરિભદ્રની શિષ્ય ક્ષેમેન્દ્રે વિ. સં. ૧૬૮૨માં રચ્યું છે. ભાનુચન્દ્રગણિએ ૨૧૫૦ શ્લોક જેવડું જે ભાષ્યવિવરણ રચ્યું છે તે આ ટિપ્પનકની ટીકા છે એમ કેટલાક કહે છે.

(૧૩) પંજિકા - આના કર્તા ધર્મદેવ છે.

(૧૪) વૃત્તિ - આ વૃત્તિ છંદોબદ્ધ છે. એ ‘અંચલ’ ગચ્છના કલ્યાણસાગરના શિષ્ય વિનયસાગરે P. ૨૭૭ રચી છે.

(૧૫) સિદ્ધાન્તચન્દ્રિકા - આના કર્તા જ્ઞાનતિલક છે.

(૧૬) સિદ્ધાન્તરત્ન - આના કર્તા જિનેન્દ્ર છે.

(૧૭) ન્યાયરત્નાવલી - આ ૧૩૦૦ શ્લોક જેવડી ટીકાના કર્તા દયાનંદ છે.

(૧૮) સારદીપિકા - યતીશે આ વૃત્તિ ૨૨૦૦ શ્લોક જેવડી રચી છે.

(૧૯) અંયસંધિટીકા - આના કર્તા સોમશીલ છે.

સિદ્ધાન્ત-ચન્દ્રિકા- આ સારસ્વત વ્યાકરણની અજૈન જરામાશ્રમે રચેલી ટીકા છે. એ ટીકા ઉપર નીચે મુજબની જૈન ટીકાઓ છે :-

(૧) ટીકા - આ અજ્ઞાતકર્તૃક છે.

(૨) ટિપ્પન - આના કર્તા ચન્દ્રકીર્તિસૂરિ છે કે જેમણે સારસ્વત વ્યાકરણ ઉપર વૃત્તિ રચી છે.

(૩) વૃત્તિ - ‘ખરતર’ ગચ્છના ભક્તિવિજયના શિષ્ય સદાનંદગણિએ આ વૃત્તિ વિ. સં. ૧૭૯૮માં રચી છે. આને કેટલાક સુબોધિની કહે છે.

(૪) વૃત્તિ - વિજયવર્ધનના શિષ્ય જ્ઞાનતિલકે વિક્રમની ૧૮મી સદીમાં આ રચી છે.

૧. આ “વેંકટેશ્વર મુદ્રણાલય” તરફથી છપાઈ છે. [ભીમશી માણેકે પ્રગટ કરી છે.]

૨. જુઓ અમરવિજયજીના શિષ્ય ચતુરવિજયજીનો લેખ “જૈનેતર સાહિત્ય અને જૈનો.” આ લેખ “જે. ધ. પ્ર.” (પુ. ૫૪, અં. ૯)માં છપાયો છે.

૩. ઉપા. રાજસીએ પંચસંધિ-બાલાવબોધ રચ્યો છે.

૪. શ્રી અગરચંદ નાહટાએ રામચન્દ્રાશ્રય એવું નામ દર્શાવ્યું છે.

(૫) સુબોધિની — ‘ખરતર’ ગચ્છના રૂપચન્દ્રે (રામવિજયે) વિક્રમની ૧૮મી સદીના અંત ભાગમાં આ રચી છે.

P. ૨૭૮ સારસ્વત-મંડન (લ. વિ. સં. ૧૪૭૫) — આના કર્તા અલંકાર-મંડન વગેરેના રચનારા જૈન ગૃહસ્થ મંડન મંત્રી છે. એમણે આ ૧૫૦૦ શ્લોક જેવડી કૃતિ સારસ્વત વ્યાકરણને અંગે રચી છે. એની તાડપત્રીય પ્રતિ વિ. સં. ૧૫૦૪માં લખાયેલી છે અને એ પાટણના ભંડારમાં છે.

ધાતુપાઠ (વિ. સં. ૧૬૬૩) — આ સારસ્વત વ્યાકરણને અંગેનો ધાતુપાઠ છે. એ ‘નાગપુરીય તપા’ ગચ્છના હર્ષકીર્તિસૂરિએ વિ. સં. ૧૬૬૩માં રચ્યો છે. એના ઉપર ધાતુતરંગિણી નામની સ્વોપજ્ઞ વૃત્તિ છે.

‘વીરસ્તવ (ઉ. વિ. સં. ૧૭૮૦) — આ પાર્શ્વચન્દ્રે ૧૧ પદ્યમાં રચેલો અને સારસ્વત વ્યાકરણના ‘સંજ્ઞા’ અધિકારનાં સૂત્રોનાં પદોથી અંકિત સ્તવ છે.

ટીકા — આ ટીકા ‘પૂર્ણિમા’ ગચ્છના ભાવપ્રભસૂરિએ રચી છે. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧.

‘સિદ્ધાન્તરત્નિકા (લ. વિ. સં. ૧૮૫૦) — આ ‘નાગપુરીય તપા’ ગચ્છના સાગરચન્દ્રસૂરિના શિષ્ય જિનચન્દ્રે સરસ્વતી-સૂત્રોને લક્ષીને રચેલું વ્યાકરણ છે. એ જિનચન્દ્રે ‘ખરતર’ ગચ્છના ક્ષમાકલ્યાણને ગુણસાગર-ચરિત્ર અને પૃથ્વીચન્દ્ર-ચરિત્રની રચનામાં સહાય કરી હતી.

સારસ્વત-વિભ્રમની અવયૂર્જિ-આપણે પૃ. ૮૬-૮૭માં જોઈ ગયા તેમ ૨૧ કારિકાની એક કૃતિને હૈમ-વિભ્રમ તેમજ સારસ્વત-વિભ્રમ પણ કહે છે. એ કૃતિ ઉપર ‘ખરતર’ ગચ્છના મતિભદ્રગણિના શિષ્ય ચારિત્રસિંહે ‘ખરતર’ ગચ્છના જિનમાણિક્યસૂરિના પટ્ટધર જિનચન્દ્રસૂરિના રાજ્યમાં વિ. સં. ૧૬૨૫માં ધોળકામાં ‘અવયૂર્જિ’ રચી છે અને એ દ્વારા વ્યાકરણવિષયક કોપડાઓનો ઉકેલ સારસ્વત વ્યાકરણનાં સૂત્રો આપી કર્યો છે. ‘ચ’ કારથી જે કેટલીક બાબતો સમજવાની છે તે બાબતો એકંદર ૧૧ કારિકારૂપે આ અવયૂર્જિમાં અપાઈ છે* અને એમાંની બે અવયૂર્જિકારની રચના છે. વળી હૈમવિભ્રમની ગુણચન્દ્રસૂરિકૃત વૃત્તિવાળી આ વૃત્તિમાં “ઘૂથાનિ ઘૂથાનિ” થી શરૂ થતું છઠ્ઠું પદ છે તે આ સારસ્વત-વિભ્રમમાં નથી. કોઈ કોઈ સ્થળે પાઠાંતર છે તેને લક્ષીને આ અવયૂર્જિ રચાઈ છે.

અનિટ્-કારિકા— આના કર્તા વિષે ખબર નથી. એને અંગે ત્રણ સ્પષ્ટીકરણો મળે છે :—

(૧) ટીકા — આ અજ્ઞાતકર્તૃક છે.

(૨) વિવરણ — હર્ષકીર્તિસૂરિએ વિ. સં. ૧૬૬૩માં આ રચ્યું છે.

(૩) વિવરણ — આના કર્તા ક્ષમામાણિક્ય છે. આ વિવરણની એક હાથપોથીનો સંક્ષિપ્ત

૧. આ સ્તવ ભાવપ્રભસૂરિકૃત ટીકા સહિત સ્તોત્રરત્નાકર (ભા. ૨, પત્ર ૬૧અ-૬૪અ)માં છપાયો છે.

૨. આ કૃતિ “જૈન જ્ઞાન ભંડાર સમાજ” તરફથી વીસનગરથી વિ. સં. ૧૯૬૬માં પ્રકાશિત કરાઈ છે. વળી એ “ય. જૈ. ગ્રં.”માં ઈ. સ. ૧૯૩૦માં છપાઈ છે.

૩. આ મૂળ કૃતિ સહિત “ઋ. કે. શ્વે. સં.” તરફથી ઈ. સ. ૧૯૨૭માં પ્રકાશિત છે. જુઓ પૃ. ૮૬

૪. જુઓ પત્ર ૩૬, ૩૮, ૪૧, ૪૨, ૪૩, ૪૭, ૪૮ અને ૫૦. પત્ર ૩૬માં વધારાની બે કારિકા, ૪૧મામાં બે, ૪૨મામાં બે (આ બે પદો અવયૂર્જિકારની રચના છે) અને બીજાં બધાં પત્ર ઉપર એકેક છે.

પરિચય D C G C M (Vol. II, pt. 1, p. 187) માં અપાયો છે. ત્યાં કહ્યું છે કે અનિટ્કારિકામાં '૧૧ પદો છે. અને એ કાતન્ત્ર વ્યાકરણને અનુસરતાં હોય એમ જણાય છે.

આ વિવરણ વિનીત અક્ષયચન્દ્રના પઠનાર્થે જલંધરમાં ક્ષમામાણિક્યગણિએ રચ્યું છે એમ એના અંતિમ પદમાં ઉલ્લેખ છે.

અવચૂરિ—અનિટ્કારિકા ઉપર 'બે અવચૂરિ છે. એમાંની એક મુનિ ભાવરત્ને લખી છે. 'અવચૂરિ' શબ્દ વિચારતાં આ બંને અવચૂરિના કર્તા જૈન અને તે પણ શ્વેતાંબર હોય એમ લાગે છે. આને શ્રી. અગરચદ નાહટાએ અવચૂરિ કહી છે.

ભૂ-ધાતુ— આના કર્તાનું નામ જાણવામાં નથી.

ભૂ-ધાતુ-વૃત્તિ— આ વૃત્તિ 'ખરતર' ગચ્છના શ્લોકમાકલ્યાણે વિ. સં. ૧૮૨૮માં રચી છે.

ભૂધાતુ-વૃત્તિ-સંગ્રહ — આના કર્તા જિનલાભસૂરિ છે.

(૨) કોશ

P. ૨૮૦

અમર-કોશ— આ નામલિંગાનુશાસનના કર્તા અમરસિંહને ઘણાખરા વિદ્વાનો અજૈન-બૌદ્ધ માને છે. એથી હું એમની કૃતિ વિષે અહીં વિચાર કરું છું. એમના આ કોશનું નામ ન સાંભળ્યું હોય એવી સંસ્કૃતજ્ઞ વ્યક્તિ ભાગ્યે જ હશે. આ કોશ જે સ્વરૂપે અત્યાર સુધી મળ્યો છે તે જોતાં એમાં (૧) સ્વરાદિ, (૨) ભૂમ્યાદિ અને (૩) સામાન્ય એમ ત્રણ કાંડ છે. પ્રથમ કાંડમાં સ્વર્ગ, પાતાલ ઇત્યાદિ દસ વર્ગ છે; બીજામાં ભૂમિ વગેરે દસ વર્ગ છે; અને ત્રીજામાં વિશેષ્યનિઘ્ન ઇત્યાદિ પાંચ વર્ગ છે.

ક્રિયાકલાપ— વિ. સં. ૧૨૫૦ થી ૧૩૦૦ના ગાળામાં થઈ ગયેલા દિ. આશાપરે અમરકોશ ઉપર ટીકા રચી છે એમ અનગારધર્મામૃત ઉપરની એમની વૃત્તિની પ્રશસ્તિ ઉપરથી જણાય છે. પરંતુ હજી સુધી તો એ ટીકા મળી આવી નથી. આ ટીકાનું નામ ક્રિયાકલાપ છે એમ કેટલાક કહે છે, પણ એ તો આ દિ. પંડિતની અન્ય કૃતિ છે.

શંખેશ્વર-પાર્શ્વનાથ-સ્તુતિ— આ અમરકોશના આઠ પદનાં ચાર ચરણની પૂર્તિરૂપે ચાર અને પ્રશસ્તિનું એક પદ એમ પાંચ પદ ક્ષમાકલ્યાણે સૂક્તરત્નાવલીમાં શ્લો. ૧૨-૧૬ તરીકે રચ્યાં છે (જુઓ

૧. આ પૈકી આઠ અને અંતિમ એ બે પદો D C G C M (Vol. II, pt. 1, p.187.)

૨. આ બેનાં અવતરણ માટે જુઓ D C G C M (Vol. II, pt. 1,)નાં અનુક્રમે પૃ. ૧૮૯ અને ૧૯૧.

૩. એમની વિવિધ કૃતિઓની નોંધ માટે જુઓ પૃ. ૨૫૮.

૪. આનાં વિવિધ પ્રકાશનો જોવાય છે. જેમકે પાંડુરંગ જાદવજી દ્વારા “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી ઈ. સ.

૧૯૨૧માં પ્રકાશિત આઠમું સંસ્કરણ અને આ જ મુદ્રણાલય તરફથી ભટ્ટોજિ દીક્ષિતના પુત્ર ભાનુજિ દીક્ષિતે રચેલી વ્યાખ્યાસુધા યાને રામાશ્રમી નામની વૃત્તિ સહિતની મૂળ કૃતિનું ઈ. સ. ૧૯૪૪માં પ્રકાશિત છઠ્ઠું સંસ્કરણ.

૫. આ સ્તુતિ અવચૂરિ સહિત સ્તોત્રરત્નાકર (ભા. ૨, પત્ર ૮૮આ-૮૮અ)માં છપાવાઈ છે.

૬. “યસ્ય જ્ઞાનદયાસિન્ધોરગાધસ્યાનઘા ગુણાઃ । સેવ્યતામક્ષયો ધીરાઃ ! સશ્રિયે ચામૃતાય ચ ॥”

પૃ. ૨૫૮). પ્રથમ ચરણ પ્રથમ પદના પ્રથમ ચરણરૂપે, દ્વિતીય ચરણ દ્વિતીય પદના દ્વિતીય ચરણરૂપે એમ અહીં યોજના કરાઈ છે.

P. ૨૮૧

(૩) છન્દ

શ્રુતબોધ— આના કર્તા તરીકે કેટલાક કાલિદાસનું તો કેટલાક વરરુચિનું નામ સૂચવે છે. આ ૪૪ પદની નાનકડી કૃતિ એના પ્રણેતાએ પોતાની પત્નીને સંબોધીને રચ્યાનું કહેવાય છે. આમાં એમણે આઠ ગણો ગણાવી, આર્યા વગેરેનાં લક્ષણોથી શરૂઆત કરી, કયો અક્ષર ગુરુ છે અને કયો લઘુ છે એ રીતે, યતિના નિર્દેશપૂર્વક સમવૃત્તોનાં લક્ષણો આપ્યાં છે. આ શ્રુતબોધ ઉપર નીચે મુજબની છ જૈન ટીકાઓ છે :—

(૧) વૃત્તિ— આના કર્તા નાનક ઉર્ફે જીમૂતાનંદના શિષ્ય ‘હંસરાજ’ છે. એમણે આ વૃત્તિ વિ. સં. ૧૬૪૫માં રચી છે.

(૨) વૃત્તિ— આના રચનાર ‘નાગપુરીય તપા’ ગચ્છના ચન્દ્રકીર્તિ-સૂરિના શિષ્ય હર્ષકીર્તિસૂરિ છે. આમ આ વિક્રમની ૧૭મી સદીની કૃતિ છે.

(૩) વૃત્તિ — આના કર્તા નયવિમલ છે.

(૪) વૃત્તિ — આ વાચક મેઘચન્દ્રના શિષ્યની રચના છે. આનો પ્રારંભ “શ્રીમત્સારસ્વતં” થી થાય છે^૧ તો શું આ જ વૃત્તિ “વેંકટેશ્વર મુદ્રણાલય” તરફથી છપાઈ છે ?

(૫) પુરાણી વૃત્તિ — આના કર્તા કાન્તિવિજય છે.

(૬) ટીકા — આના કર્તા માણિક્યમલ્લ છે.

P. ૨૮૨

વૃત્ત-રત્નાકર (લ. વિ. સં. ૧૦૦૦)— આના કર્તા શૈવ શાસ્ત્રના જાણકાર પવ્યેકના પુત્ર કેદારભટ્ટ છે. એમનો સમય ઈ. સ. ૧૦૦૦ની આસપાસનો ગણાય છે.^૨ એમણે રચેલી આ પદ્યાત્મક કૃતિ શ્રુતબોધ કરતાં મોટી છે. એ નિમ્નલિખિત છ અધ્યાયમાં વિભક્ત છે :—

(૧) સંજ્ઞા, (૨) માત્રાવૃત્ત, (૩) સમવૃત્ત, (૪) અર્ધસમવૃત્ત, (૫) વિષમવૃત્ત અને (૬) પ્રસ્તાર.

ટીકાઓ— આ વૃત્તરત્નાકર ઉપર નીચે મુજબની છ જૈન ટીકાઓ રચાઈ છે :—

૧. આ કૃતિ “શ્રીમત્સારસ્વતં ધામ”થી શરૂ થતી વૃત્તિ તેમજ સદીક વૃત્તરત્નાકર સહિત ક્ષેમરાજ કૃષ્ણદાસે “વેંકટેશ્વર મુદ્રણાલય” તરફથી વિ. સં. ૧૮૭૮માં પ્રકાશિત કરી છે. શ્રુતબોધની આ વૃત્તિમાં વૃત્તરત્નાકરમાંથી અવતરણો અપાયાં છે.

૨. શું આ જૈન છે ?

૩. જુઓ પ્રો. પિટર્સનના ત્રીજા હેવાલનું પરિશિષ્ટ (પૃ. ૨૨૫).

૪. આ “હરિતોષ સમિતિ” દ્વારા અને “વેંકટેશ્વર મુદ્રણાલય” તરફથી છપાયો છે.

૫. જુઓ A B O R I (Vol. XVII, pp 397-399) માં છપાયેલો શ્રી. પી. કે. ગોડેનો લેખ.

(૧) 'ઉપાધ્યાયનિરપેક્ષા— આ નામની વૃત્તિના કર્તા આસડ છે. આ આસડ તે વિક્રમની તેરમી સદીમાં વિદ્યમાન, 'કવિસભાશૃંગાર'ના બિરુદથી વિભૂષિત અને મેઘદૂત ઉપર ટીકા રચનારા આસડ જ હશે એમ લાગે છે.

(૨) વૃત્તિ— 'વાઘી દેવસૂરિના સંતાનીય જયમંગલસૂરિના શિષ્ય સોમચન્દ્રગણિએ આ વૃત્તિ વિ. સં. ૧૩૨૮માં રચી છે.

(૩) ટિપ્પનક— 'ખરતર' ગચ્છના જિતભદ્રસૂરિના શિષ્ય ક્ષેમહંસે આ ટિપ્પનક રચ્યું છે. એઓ વિક્રમની ૧૫મી સદીમાં થઈ ગયા છે.

(૪) બાલાવબોધ — 'ખરતર' ગચ્છના મેરુસુન્દરે આ બાલાવબોધ રચ્યો છે. એઓ વિક્રમની સોળમી સદીના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા.

(૫) વૃત્તિ — આ વૃત્તિ સમયસુંદરગણિએ વિ. સં. ૧૬૮૪માં રચી છે.

P. ૨૮૩

(૬) વૃત્તિ — આના કર્તા હર્ષકીર્તિસૂરિના શિષ્ય અમરકીર્તિના શિષ્ય યશઃકીર્તિ છે.

(૪) અલંકાર

'કાવ્યાદર્શ' (લ. વિ. સં. ૭૦૦) — આની રચના 'દંડીએ કરી છે. એમનો સમય ઈ. સ. ૬૦૦થી ૭૦૦ના ગાળાનો ગણાય છે. કેટલાકને મતે ભારવિ એમના પિતામહના મિત્ર થાય છે. એમના આ કાવ્યાદર્શમાં ત્રણ પરિચ્છેદ છે. જેઓ ચાર ગણાવે છે તેઓ ત્રીજાના બે ભિન્ન ભિન્ન વિભાગ પાડી તેમ કરે છે. એમાં લગભગ ૬૬૦ પદ્યો છે. પ્રથમ પરિચ્છેદમાં કાવ્યની વ્યાખ્યા આપી એના ગદ્ય, પદ્ય અને મિશ્ર એમ ત્રણ પ્રકાર સુચવાયા છે. ગદ્યના આખ્યાયિકા અને કથા એવા બે ભેદ સૂચવી એ બેમાં વાસ્તવિક રીતે કશો તફાવત નથી એમ અહીં કહેવાયું છે. સાહિત્યના સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને મિશ્ર એમ ચાર પ્રકાર દર્શાવાયા છે. વૈદર્ભી અને ગૌડી એ બે રીતિ, દસ ગુણો, અનુપ્રાસ તેમજ કવિ બનવા માટેની ત્રિવિધ યોગ્યતા એ વિષયો પણ પ્રથમ પરિચ્છેદમાં જોવાય છે.

દ્વિતીય પરિચ્છેદમાં અલંકારની વ્યાખ્યા આપી પાંત્રીસ અલંકારો ગણાવાયા છે.

તૃતીય પરિચ્છેદમાં યમકનું વિસ્તૃત નિરૂપણ છે. સાથે સાથે જાતજાતના ચિત્રબંધો, સોળ પ્રકારની P. ૨૮૪ પ્રહેલિકા અને દસ દોષો વિષે માહિતી અપાઈ છે.

૧. જુઓ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૬૪)

૨. ભટ્ટિકાવ્યની જયમંગલા નામની ટીકાના કર્તા તરીકે કેટલાક આ સૂરિનો નિર્દેશ કરે છે.

૩. કેટલાકને મતે આ મંગલસૂરિના શિષ્ય થાય છે.

૪. આનાં વિવિધ પ્રકાશનો છે. ડૉ. એસ. કે. ડેએ H S P (Vol. I, pp. 72-73) માં આની નોંધ લીધી છે.

૫. આનું કાનડીમાં ભાષાંતર થયું છે.

૬. સંસ્કૃતમાં 'દંડિન' નામ છે.

ટીકા—કાવ્યાદર્શ ઉપર વિવિધ વૃત્તિઓ રચાયેલી છે. એ પૈકી ત્રિભુવનચન્દ્ર ઉર્ફે ‘વાદિસિંહસૂરિની ટીકા એ જૈન ટીકા છે. આની એક હાથપોથી વિ. સં. ૧૭૭૮માં ‘બંગાળી’ લિપિમાં લખાયેલી છે.

૨ કાવ્યાલંકાર (ઉ. વિ. સં. ૮૫૦) — પુષ્પદંતે મહાપુરાણ (સંધિ ૧, કડવક ૮)માં નિર્દેશેલા રુદ્રદે આ કૃતિ સોળ અધ્યાયમાં રચી છે. ભામહે અને વામને પણ પોતાની કૃતિનું નામ કાવ્યાલંકાર રાખ્યું છે. રુદ્રદેનો સમય ઇ.સ. ૮૦૦ કરતાં કંઈક વહેલો ગણાય છે.

અલંકારોના વર્ગીકરણ માટે સૈદ્ધાંતિક વ્યવસ્થા કરનાર તરીકે તેમજ નવ રસમાં ‘ત્રેયસુ’ નામનો દસમો રસ ઉમેરનાર તરીકે રુદ્રદેનું નામ મોખરે છે. એમણે ત્રીજા અધ્યાયમાં યમક વિષે ૫૮ પદ્યો આપ્યાં P. ૨૮૫ છે. એમણે અ. ૫માં ચક્ર-બંધ, મુરજ-બંધ ઇત્યાદિને સ્થાન આપ્યું છે. એમની આ કૃતિ ઉપર બે જૈન ટીકા છે :—

(૧) વૃત્તિ — આના કર્તા નમિસાધુ છે. એમણે વિ. સં. ૧૧૨૨માં આવશ્યકવૃત્તિ—ચૈત્યવંદનવૃત્તિ રચી છે.^૪ એઓ “થારાપદ્ર” ગચ્છના શાલિભદ્રસૂરિના શિષ્ય થાય છે. એમણે આ વૃત્તિ વિ. સં. ૧૧૨૫માં રચી છે. કેટલાક એને ‘ટિપ્પન’ કહે છે. અ. ૫, શ્લો. ૧૨-૧૪ની વૃત્તિમાં એમણે કહ્યું છે કે ભદ્ર વાસુકના પુત્ર શતાનંદ ઉર્ફે રુદ્રદે આ કૃતિ (કાવ્યાલંકાર) રચી છે. એ રુદ્રદે સામવેદના અભ્યાસી હતા.

નમિસાધુએ એમની પૂર્વે કાવ્યાલંકાર ઉપર રચાયેલી વૃત્તિનો લાભ લીધો છે. એમણે પોતાની ઉપર્યુક્ત વૃત્તિમાં કેટલાક ગ્રંથ અને ગ્રંથકારોનાં નામ આપ્યાં છે અને કેટલાકમાંથી અવતરણ આપ્યાં છે, જેમકે અર્જુનચરિત (૧૬-૪), ઉદ્ભટ (૬-૩૩), કાદંબરી, કિરાતાર્જુનીય, છંદ:શાસ્ત્ર રચનાર જયદેવ (૧-૧૮), તિલકમંજરી (૧૬-૩), દંડી, નામમાલા, પાણિનિકૃત પાતાલવિજયમહાકાવ્ય (૨-૮), પિંગલ, બૃહત્કથા (૨-૧૨), ભરત (૧૨-૪; ૧૨-૪૪), ભર્તૃહરિ, ભામહ (૮-૮૪; ૧૦-૨), માઘકાવ્ય (૧-૨૦; ૮-૬૪), માલતીમાધવ (૭-૩૩), મૃચ્છકટિક (૮-૧), મેઘદૂત, મેઘાવિરુદ્ધ (૧-૨; ૨-૨), રત્નાવલી (૭-૩૩), વામન (૧-૨૦; ૮-૧૦), વિકટનિતંબા (૬-૪૭), વેણીસંહાર (૭-૭૩), શિવભદ્ર P. ૨૮૬ (૪-૪), શિશુપાલવધ, અલંકારશાસ્ત્ર ઉપર પાઈયમાં કૃતિ રચનાર હરિ (૨-૧૮), અને હર્ષચરિત.^૫

૧. ‘વાદિ’ એ વિશેષણ હોય તો આ સિંહસૂરિ તે કોણ હશે તેની તપાસ કરતાં એમ જણાય છે કે ‘કાસદ્રહ’ ગચ્છના ઉપા. જે નરચંદ્ર વિ. સં. ૧૩૨૪માં પ્રશ્નશતક રચ્યું છે તેમના ગુરુનું નામ સિંહસૂરિ અને પ્રગુરુનું નામ ઉદ્ધોતનસૂરિ છે. જુઓ જૈ. સા. સં. ઈ.નું પૃ. ૪૧૩. પૃ. ૪૬૮માં તો એવો ઉલ્લેખ છે કે ‘કાસદ્રહ’ ગચ્છના ઉદ્ધોતનસૂરિના શિષ્ય સિંહસૂરિએ પોતાને માટે દેવમૂર્તિ નામના ઉપાધ્યાયે રચેલા વિક્રમચરિતની એક હાથપોથી શીલસુંદર પાસે વિ. સં. ૧૪૮૨માં અને બીજી મહીતિલક પાસે વિ. સં. ૧૪૮૬માં લખાવી હતી.

૨. આ કાવ્યાલંકાર નમિસાધુકૃત ટીકા સહિત “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી પ્રસિદ્ધ થયેલી “કાવ્યમાલા”માં ઇ. સ. ૧૮૮૬માં છપાયેલી છે.

૩. આ સંબંધમાં જુઓ “પુરાતત્ત્વ” (પુ. ૪, પૃ. ૧૫૫)માં છપાયેલો લેખ નામે “બે મહત્વના ગ્રંથોની શોધ.”

૪. ધમ્મોવએસમાલાનું પાઈયમાં વિ. સં. ૧૧૨૮માં વિવરણ કરનાર શું આ નમિસાધુ છે ?

૫. આ નામના નગરને ‘થરાદ’ કહે છે.

૬. આ કાવ્યમાંથી એક પદ્ય અને એક પદ્યનો અંશ અવતરણરૂપે નમિસાધુએ આપ્યાં છે.

૭. જુઓ મહામહોપાધ્યાય પી. વી. કાણેનો સાહિત્યદર્પણને અંગેનો વિસ્તૃત અંગ્રેજી ઉપોદ્ઘાત (પૃ. ૧૪).

અપભ્રંશનો પરિચય આપતાં નમિસાધુએ કહ્યું છે કે કેટલાક એના (૧) ઉપનાગર, (૨) આભીર અને (૩) ગ્રામ્ય એમ ત્રણ પ્રકાર ગણાવે છે, પરંતુ એના નિરસનાર્થે રુદ્રટે અપભ્રંશ ભાષાને અનેક પ્રકારવાળી કહી છે, કેમકે દેશો ઘણા હોવાથી એના ઘણા પ્રકાર સંભવે છે અને એ પ્રકારોનાં લક્ષણ તે તે દેશના લોકો પાસેથી જાણી શકાય તેમ છે.

(૨) નિબંધન-‘સપાદલક્ષ’ દેશથી નીકળીને માળવામાં ધારામાં રહી વિદ્યા પ્રાપ્ત કરનાર દિ. આશાધરે આ રચ્યું છે. આ આશાધરે સાગારધર્મામૃત અને અનગારધર્મામૃતની ટીકા અનુક્રમે વિ. સં. ૧૨૯૬ અને ૧૩૦૦માં રચી છે.

‘કાવ્યપ્રકાશ (લ. વિ. સં. ૧૧૧૦) – આના કર્તા ‘મમ્મટ છે. એમણે દસ ઉલ્લાસમાં ૧૪૩ કારિકામાં કાવ્યશાસ્ત્રને લગતી બધી બાબતો સમાવી દીધી છે. જૈન સાહિત્યમાં ત. સૂ., વેદાંતમાં શારીરક-ભાષ્ય અને વ્યાકરણમાં મહાભાષ્ય જેમ વિવિધ વ્યાખ્યા અને નિરૂપણના વિષય બન્યા છે તેમ આ કાવ્યપ્રકાશને અંગે પણ બનવા પામ્યું છે.

મમ્મટે કાવ્યપ્રકાશની કારિકાઓ ઉપર વૃત્તિ રચી છે.* એમણે અન્ય ગ્રંથકારોની કૃતિઓમાંથી પ. ૨૮૭ આશરે ૬૨૦ પદ્યો આપ્યાં છે. એમણે એમના પૂર્વગામી અભિનવગુપ્ત, વામન, રુદ્રટ, ભામહ, ઉદ્ભટ વગેરેની કૃતિઓનો ઉપયોગ કર્યો છે અને પ્રસંગવશાત્ એમનાથી ભિન્ન અભિપ્રાય વ્યક્ત કર્યા છે. એમણે કાલિદાસ જેવાની કૃતિમાં પણ દોષ દર્શાવ્યા છે. ‘કલિ.’ હેમચન્દ્રસૂરિએ આ કાવ્યપ્રકાશનો લાભ લીધો છે. એની રચના ઈ. સ. ૧૦૫૦થી ૧૧૦૦ના ગાળામાં થઈ હોય એમ લાગે છે. આના ઉપર નીચે મુજબની છ જૈન ટીકાઓ રચાઈ છે :-

(૧) ‘સંકેત-‘રાજ’ ગચ્છના સાગરચન્દ્ર મુનીન્દ્રનાં ચરણકમળને વિષે ભ્રમર સમાન માણિક્યચન્દ્રસૂરિએ કાવ્યપ્રકાશના ઉપર આ સંકેત નામની ટીકા રચી છે. આ રચના ક્યારે થઈ એ બાબતમાં ત્રણ મત જોવાય છે: કેટલાક એને વિ. સં. ૧૨૧૬ની રચના ગણે છે તો કેટલાક વિ. સં. ૧૨૪૬ની તો કેટલાક વિ.સં. ૧૨૬૬ની- સંકેતમાં રચના-સમય “રસ-વક્ત્ર-ગ્રહાધીશ” એમ શબ્દાંક દ્વારા સૂચવાયો છે. જેઓ આ માણિક્યચન્દ્રને વસ્તુપાલના સમકાલીન ગણે છે તેમને મતે વિ. સં. ૧૨૧૬ની સાલ બંધબેસતી થતી નથી.

મમ્મટના કાવ્યપ્રકાશ ઉપરની પ્રાચીન ટીકાઓમાંની એક તે આ સંકેત છે. એ જૈન ટીકાઓમાં સૌથી પ્રાચીન છે. એમાં ભામહ, ઉદ્ભટ, દંડી, વામન, અભિનવગુપ્ત, મુકુલ, ભોજ વગેરેના અભિપ્રાયોનો

૧. આનાં વિવિધ પ્રકાશનો જોવાય છે. તેમાં કેટલાંક મૂળ કૃતિ પૂરતાં તો કેટલાંક ટીકા સહિત મૂળ કૃતિનાં છે.

આની નોંધ D C G C M (Vol. XII p. 58) માં છે. મૂળ કૃતિનો ગંગાધરનાથ ઝાએ કરેલો અંગ્રેજી અનુવાદ ઈ. સ. ૧૯૧૮માં છપાયો છે.

૨. કેટલાક અલટનો પણ નિર્દેશ કરે છે.

૩. નાટ્યશાસ્ત્રની વિવિધ બાબતોની વાત જુદી છે. જુઓ પૃ. ૧૬૮.

૪. વિશ્વનાથને મતે કારિકા અને વૃત્તિ એ બંનેના કર્તા મમ્મટ છે. જુઓ એમનું સાહિત્યદર્પણ (પરિ. ૬ અને ૭).

૫. આ સંકેત ટીકા “આનંદાશ્રમ ગ્રન્થાવલી”માં ગ્રન્થાંક ૮૯ તરીકે ઈ.સ. ૧૯૨૧માં અને “મ્હેસુર સરકારની ગ્રન્થમાલા”માં ગ્રન્થાંક ૬૦ તરીકે ઈ. સ. ૧૯૨૨માં પ્રસિદ્ધ થયેલી છે.

P. ૨૮૮ ઉલ્લેખ છે. કેટલેક સ્થળે માણિક્યચન્દ્રે પોતાના 'કાવ્યમાંથી ઉદાહરણ આપ્યાં છે. જ્યાં સંક્ષિપ્ત વિવરણ જોઈએ ત્યાં તે અને જ્યાં વિસ્તૃત જોઈએ ત્યાં તે એ પ્રમાણેની પ્રમાણપુરસ્સરની વ્યવસ્થાથી આ ટીકાનું મહત્ત્વ વધે છે.

સામ્ય-કાવ્યપ્રકાશ (ઉ. ૮, શ્લો. ૮૫)માં ખડ્ગ, મુરજ અને પદ્મ એ ત્રણ બંધોનું એકેક ઉદાહરણ અપાયું છે. આ ત્રણ બંધોની રચના વિષે સંકેતમાં જે નિરૂપણ છે તે અ. ચૂ. અને વિવેક સાથે અક્ષરશઃ મળે છે તો આનું શું કારણ ?^૧

(૨) ટીકા-વિક્રમની સોળમી સદીમાં થઈ ગયેલા 'તપા' ગચ્છના હર્ષકુલે આ રચી છે.

(૩) સારદીપિકા- 'ખરતર' ગચ્છના જિનમાણિક્યસૂરિના શિષ્ય વિનયસમુદ્રગણિના શિષ્ય ગુણરત્નગણિએ પોતાના શિષ્ય રત્નવિશાલને માટે દસેક હજાર શ્લોક જેવડી આ ટીકા વિ. સં. ૧૬૧૦(?)માં રચી છે.

(૪) વૃત્તિ-જયાનંદસૂરિએ ૪૪૦૦ શ્લોક જેવડી આ વૃત્તિ રચી છે.

(૫) ટીકા-ભાનુચન્દ્રગણિએ આ રચી છે.^૨

(૬) ટીકા-'ન્યાયાચાર્ય' યશોવિજયગણિએ આ ટીકા રચી છે પણ તેનો થોડોક જ ભાગ બીજા અને ત્રીજા ઉલ્લાસ પૂરતો હજી સુધી તો મળી આવ્યો છે. જે ભાગ મળ્યો છે તેમાં યશોવિજયગણિએ વિવિધ મતો દર્શાવી પોતાનો મત પણ દર્શાવ્યો છે. [ડૉ. રુદ્રદેવ ત્રિપાઠી સંપાદિત આ ટીકા હિન્દી અનુ. સાથે યશોભારતી પ્ર. મુંબઈથી વિ. સં. ૨૦૩૨માં પ્રસિદ્ધ થઈ છે.]

અભ્યાસ-સોમસૌભાગ્ય કાવ્ય (સ. ૧૦)માં કહ્યું છે કે "કૃષ્ણ વાગ્દેવતા"ના બિરુદથી વિભૂષિત જયચન્દ્રસૂરિએ ઘણા શિષ્યોને કાવ્યપ્રકાશ, સંમતિપ્રકરણ વગેરે ગ્રંથો ભણાવ્યા હતા.

P. ૨૮૮ 'સરસ્વતીકંઠાભરણ (લ. વિ. સં. ૧૧૫૦)- 'શૃંગારપ્રકાશ રચનારા અજૈન ગ્રંથકાર ભોજે ઉર્ફે ભોજદેવે આ રચ્યું છે. શ્રી કાણેના મતે આ મહાકાવ્ય કૃતિ ઓછેવત્તે અંશે સંગ્રહાત્મક છે. કાવ્યાદર્શ, ધ્વન્યાલોક વગેરેમાંનાં પદ્યો અહીં ગૂંથી લેવાયાં છે. કાવ્યાદર્શમાંનાં લગભગ બસો પદ્યોનો અહીં ઉપયોગ કરાયો છે. આ સરસ્વતીકંઠાભરણમાં આસરે ૧૫૦૦ ઉદાહરણો છે અને એથી સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ માટે એ ઉપયોગી છે. આ કૃતિ પાંચ પરિચ્છેદોમાં ૬૪૩ કારિકામાં રચાયેલી છે. રસ અને ગુણને પણ અહીં 'અલંકાર' કહેલા છે. એ આ કૃતિની એક વિશિષ્ટતા છે.

ઉપમા વગેરેનો શબ્દ તેમજ અર્થના અલંકારરૂપે નિર્દેશ કરનાર તરીકે ભોજ લગભગ એકલા જ છે.

૧. આ કાવ્ય તે કયું તેની તપાસ કરવી બાકી રહે છે.

૨. આ સંબંધમાં મેં મારા લેખ નામે "અલંકારચૂડામણિ, વિવેક અને સંકેત"માં ચર્ચા કરી છે. આ લેખ "આ. પ્ર." (પુ. ૫૧, અં. ૧૨)માં છપાવાયો છે.

૩. જુઓ સિદ્ધિચન્દ્રગણિકૃત ભાનુચન્દ્રગણિચરિત. આ સિદ્ધિચન્દ્રગણિએ કાવ્યપ્રકાશખંડન રચ્યું છે.

૪. આ અનેક વાર પ્રસિદ્ધ થયું છે.

૫. આના પ્રકાશ ૨૨-૨૪માં ૨૫૧ પાઈય અવતરણો છે તો એ હિસાબે સમગ્ર ગ્રંથમાં તો કેટલાંયે હશે ?

પદપ્રકાશ—સરસ્વતીકંઠાભરણ ઉપર પાર્શ્વચન્દ્રના પુત્ર આજડે પદપ્રકાશ નામની આ ટીકા રચી છે. આ ટીકાની પુષ્પિકા તેમજ આ ટીકામાંથી કેટલાક ઉદ્દ્યુત ભાગો **પત્તન**. સૂચી (ભાગ ૧, પૃ. ૩૭-૩૮)માં અપાયેલાં છે.

ચન્દ્રાલોક (લ. વિ. સં. ૧૨૭૫)— આના કર્તા જયદેવ છે.^૧

૨કાવ્યામ્નાય— શું એ ઉપર્યુક્ત કૃતિની ટીકા છે ?

૩વિદગ્ધમુખમંડન (ઉ. વિ. સં. ૧૩૧૦) — આ ધર્મદાસ નામના બૌદ્ધની કૃતિ છે. એમાં ચાર પરિચ્છેદો છે. એમાં પ્રહેલિકાઓ (emigmatology) અને ચિત્ર-કાવ્યોને સ્થાન અપાયું છે. ૨નાપણ P. ૨૮૦ અને શાર્ફધરપદ્ધતિમાં આ કૃતિનો ઉલ્લેખ છે. ઇ. સ.ની ૧૩મી સદીની પૂર્વેની આ કૃતિ છે. એના ઉપર નીચે મુજબની જૈન ટીકાઓ છે :-

(૧) **અવચૂર્ણિ** — આના કર્તા ‘ખરતર’ ગચ્છના જિનપ્રભસૂરિ છે. એમણે ૭૦૦ સ્તોત્રો રચ્યાં છે.

(૨) ટીકા — ‘ખરતર’ ગચ્છના જિનસિંહસૂરિના શિષ્ય લક્ષ્મિચન્દ્રના શિષ્ય શિવચન્દ્રે આ ટીકા વિ. સં. ૧૬૬૮માં રચી છે.

(૩) **વૃત્તિ** — આ વિનયસુન્દરના શિષ્ય વિનયરત્નની રચના છે. એઓ ૧૭મી સદીમાં થઈ ગયા છે.

(૪) ટીકા — આ ‘ખરતર’ ગચ્છના સુમતિકલશના શિષ્ય વિનયસાગરે વિ. સં. ૧૬૮૮માં રચી છે.

(૫) ટીકા—આના કર્તા ભીમવિજય છે.

(૬) **અવચૂરિ**—આના કર્તાનું નામ જાણવામાં નથી.^૨

(૭) ટીકા — આના કર્તા કુ (? ક) કુદાચાર્યના સંતાનીય (?) છે.^૩

(૮) **બાલાવબોધ**—સદ્વિસયગપયરણ, વાગ્મટાલંકાર ઇત્યાદિ વિવિધ કૃતિઓ ઉપર બાલાવબોધ રચનાર ઉપા— મેરુસુંદરે ૧૪૫૪ શ્લોક જેવડો આ બાલાવબોધ રચ્યો છે. એઓ જિનચન્દ્રસૂરિ (વિ. સં. ૧૪૮૭-૧૫૩૦)ના શિષ્ય થાય છે. આ બાલાવબોધની શરૂઆતમાં પાંચ પદ્યો સંસ્કૃતમાં છે. એમાં મૂળ પદ્યાત્મક કૃતિનું P. ૨૯૧ કટકે કટકે સંસ્કૃતમાં વિવરણ અપાયું છે અને સાથે સાથે ગુજરાતીમાં એની સમજૂતી અપાઈ છે.^૪

(પ) ગણિત

ગણિતસાર—આના કર્તા શ્રીધર છે. શું ત્રિશતિકાના કર્તા શ્રીધર (ઇ. સ. ૭૫૦) તે જ આ છે ?

૧. જુઓ પૃ. 106.

૨. જુઓ પૃ. 106.

૩. આ કૃતિ અનેક સ્થળેથી છપાઈ છે.

૪. જિ. ર. કો. (ખંડ ૧, પૃ. ૩૫૫)માં એક અજ્ઞાતકર્તૃક ટીકાનો પ્રારંભ “સ્મૃત્વા જિનેન્દ્રમપિ” થી થાય છે એવો ઉલ્લેખ છે.

૫. જુઓ શ્રી અગરચંદ નાહટાનો પૃ. 168માં નિર્દિષ્ટ લેખ.

૬. આનો નમૂનો ષષ્ટિશતક પ્રકરણની પ્રસ્તાવના (પૃ. ૨૦-૨૨ અને ૨૯)માં અપાયો છે.

૭. આ પ્રકાશિત છે ?

‘વૃત્તિ-ગણિતસાર ઉપર ‘ઉપકેશ’ ગચ્છના સિદ્ધિસૂરિએ વૃત્તિ રચી છે.

‘ગણિતતિલક’^૩ યાને ગણિત-પાટી^૪ (લ. વિ. સં. ૧૧૦૦)— આના કર્તા શ્રીપતિ છે. એમણે શકસંવત્ ૮૬૧માં ધીકોટિદ-કરણ, શકસંવત્ ૮૭૮માં ધ્રુવમાનસ, ઇ. સ. ૧૦૪૦ની આસપાસમાં ‘સિદ્ધાન્ત-શેખર ઇત્યાદિ કૃતિઓ રચી છે એઓ લીલાવતીના કર્તા ભાસ્કરાચાર્યના પુરોગામી છે. એમણે સર્વ દર્શનોને સંમત થાય એવું મંગલાચરણ કરી પરિભાષાઓ સમજાવી છે. એમણે પાટીગણિતને લગતી P. ૨૮૨ વિવિધ બાબતો ઉદાહરણપૂર્વક જાતજાતના છંદોમાં રજૂ કરી છે. જેમકે પૂર્ણાંક તેમજ અપૂર્ણાંકનાં સંકલિત વગેરે આઠ પરિકર્મો, કલાસવર્ણ, ત્રૈશિક વગેરે બાબતો. એ માટે એમણે ત્રિશતીનો પુષ્કળ ઉપયોગ કર્યો હોય એમ લાગે છે.

વૃત્તિ—આ વૃત્તિ ગણિતતિલક ઉપર વિબુધચન્દ્રસૂરિના શિષ્ય અને મંત્રરાજરહસ્ય વગેરેના કર્તા સિંહતિલકસૂરિએ વિ. સં. ૧૩૩૦ની આસપાસમાં રચી છે. એમણે લીલાવતીનો તેમજ ત્રિશતીનો કેટલેક સ્થળે ઉલ્લેખ કર્યો છે. એમણે પૃ. ૩૦માં લીલાવતીની વૃત્તિ જોવાની ભલામણ કરી છે. શું આ વૃત્તિના કર્તા એઓ જાતે છે કે અન્ય કોઈ ? પૃ. ૮૫માં એમણે ગણિતની કોઈ કૃતિમાંથી એક અવતરણ આપ્યું છે.

(૬) નિમિત્તશાસ્ત્ર

લઘુજાતક (લ. વિ. સં. ૫૬૨) આના કર્તા શકસંવત્ ૪૨૭માં પંચસિદ્ધાંતિકા રચનારા વરાહમિહિર છે.

વૃત્તિ—લઘુજાતક ઉપર ‘ખરતર’ ગચ્છના ભક્તિલાભે વિ. સં. ૧૫૭૧માં વિક્રમપુરમાં આ રચી છે.^૫

જાતક(કર્મ)પદ્ધતિ (લ. વિ. સં. ૧૧૦૦)— આના કર્તા શ્રીપતિ છે.

ટીકા—જાતકપદ્ધતિ ઉપર ‘અંચલ’ ગચ્છના હર્ષરત્નના શિષ્ય સુમતિહર્ષે વિ. સં. ૧૬૭૩માં પદ્માવતીપત્તનમાં આ ટીકા રચી છે.^૬ એમણે આ અરસામાં બૃહત્પર્વમાલા રચી છે. વિશેષમાં એમણે તાજિકસાર, કરણતૂલ અને હોરામકરન્દ ઉપર એકેક ટીકા રચી છે.

૧. જુઓ શ્રી. અગરચંદ નાહટાનો લેખ. “જૈનેતર ગ્રંથોં પર જૈન ટીકાર્યે”

૨. આ કૃતિ સિંહતિલકસૂરિકૃત વૃત્તિ સહિત “ગા. પૌ. ગ્રં.”માં ગ્રંથાંક ૭૮ તરીકે ઈ.સ. ૧૮૩૭માં છપાઈ છે. એનું સંપાદન મેં કર્યું છે. એના અંગ્રેજી ઉપોદ્ઘાતમાં મેં “ગણિતશાસ્ત્રને અંગેનો જૈનોનો ફાળો” એ વિષય વિસ્તારથી ચર્ચ્યો છે.

૩. આ નામ સિંહતિલકસૂરિએ યોજ્યું છે. એમ કરવામાં એમણે પોતાના નામનો એક અંશ જોડ્યો હોય એમ જણાય છે.

૪. શ્રીપતિએ “ગણિતસ્ય પાટી” એમ કહ્યું છે. એ ઉપરથી મેં આ નામ યોજ્યું છે; બાકી સામાન્ય રીતે ‘પાટીગણિત’ એવું નામ હોય.

૫. આમાં જૈનોની બે સૂર્ય, બે ચન્દ્ર ઇત્યાદિને લગતી માન્યતાનું ખંડન કરાયું છે.

૬. લઘુજાતક ઉપર મતિસાગરે ભાષામાં વિ. સં. ૧૬૭૫માં વચનિકા રચી છે અને ખુશાલસુંદરે વિ. સં. ૧૮૩૮માં ટબો રચ્યો છે.

૭. ‘ઉપકેશ’ ગચ્છના ખુશાલસુંદરે બાલાવબોધ રચ્યો છે.

૧.તાજિકસાર (લ. વિ. સં. ૧૫૮૦)- આના કર્તા હરિભટ્ટ છે. એમને કેટલાક હરિભટ્ટ પણ કહે P. ૨૮૩ છે. એમણે શકસંવત્ ૧૧૦૫નો ઉલ્લેખ કર્યો છે. દીક્ષિતે એમના મરાઠી પુસ્તક નામે પ્રાચીન ખગોળ-શાસ્ત્રચ્યા ઇતિહાસ (પૃ. ૪૮૦)માં સૂચવ્યું છે કે આ હરિભટ્ટ શક-સંવત્ ૧૪૪૫માં વિદ્યમાન હતા.

ટીકા- ‘અંચલ’ ગચ્છના સુમતિહર્ષે વિ. સં. ૧૬૭૭માં વિષ્ણુદાસના રાજ્યમાં આ ટીકા રચી છે.^૧

કરણકુતૂહલ (વિ. સં. ૧૨૪૦)- આ ભાસ્કરની ઈ. સ. ૧૧૮૪ની રચના છે.

ગણક-કુમુદ-કૌમુદી- ‘અંચલ’ ગચ્છના સુમતિહર્ષે આ નામની ટીકા વિ. સં. ૧૬૭૮માં હેમાદ્રિના રાજ્યમાં રચી છે. એમણે જાતક-પદ્ધતિ વગેરે ઉપર પણ ટીકા રચી છે.

જ્યોતિર્વિદ્યાભરણ (લ. વિ. સં. ૧૨૮૫)- આ કૃતિ કાલિદાસે વિ. સં. ૧૨૮૫ની આસપાસમાં રચી છે.

મહાદેવીસારણી (વિ. સં. ૧૩૭૪)- આ કૃતિ મહાદેવે શકસંવત્ ૧૨૩૮માં રચી છે.

દીપિકા ઇત્યાદિ- મહાદેવીસારણી ઉપર ‘અંચલ’ ગચ્છના શુભવનરાજના શિષ્ય ધનરાજે દીપિકા વિ. સં. ૧૬૮૨માં પદ્માવતીપત્તનમાં રચી છે. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૦૩) પ્રમાણે એમણે P. ૨૮૪ ટિપ્પણ રચ્યું છે. વળી તત્ત્વસુંદરે વિવૃતિ અને કોઈકે ટીકા રચી છે.

વિવાહપટલ- આ હર્ષકીર્તિસૂરિની કૃતિ છે કે એ નામની અજૈન કૃતિ ઉપર એમની ટીકા છે ?

બાલાવબોધ- ‘ખરતર’ ગચ્છના સોમસુંદરના શિષ્ય અમરે વિવાહપટલ ઉપર આ બાલાવબોધ રચ્યો છે.

ગ્રહલાઘવ- આ ગણેશની કૃતિ છે.

ટીકા અને ટિપ્પણ-ગ્રહલાઘવ ઉપર ચારિત્રસાગરના પ્રશિષ્ય અને કલ્યાણસાગરના શિષ્ય યશસ્વત્સાગરે (જસવંતસાગરે) વિ. સં. ૧૭૬૦માં ટીકા રચી છે અને રાજસોમે ટિપ્પણ રચ્યું છે. આ યશસ્વત્સાગરે નિમ્નલિખિત કૃતિઓ રચી છે :-

જૈનસપ્તપદ્યાર્થી (વિ. સં. ૧૭૫૭), પ્રમાણવાદ્યાર્થી (વિ. સં. ૧૭૫૮), ભાવસપ્તતિકા (વિ. સં. ૧૭૪૦) રત્નાકરાવતારિકાની પંજિકામાંથી વાદ્યાર્થનિરૂપણ, સ્તવનરત અને શ્યાદ્વાદમુક્તાવલી.

આ ઉપરાંત એમણે વિ. સં. ૧૭૨૧માં વિચારષટ્ત્રિંશિકા ઉપર અવચૂરિ રચી છે. વિશેષમાં એમણે જન્મકુંડલી ઉપર યશોરાજિરાજ-પદ્ધતિ રચી છે અને જાતે એ વિ. સં. ૧૭૬૨માં લખી છે.

૧. આ કૃતિ “વેંકટેશ્વર મુદ્રણાલય” તરફથી પ્રકાશિત થયેલી છે.

૨. એમની અન્ય કૃતિઓ માટે જુઓ પૃ. 180.

૩. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૦૪)માં આનો મહાદેવી તરીકે ઉલ્લેખ છે.

૪. ઉપર્યુક્ત પુસ્તકમાં ભોજરાજગણિનો ઉલ્લેખ છે.

૫. વિવાહપટલ નામની કોઈ અજ્ઞાતકર્તૃક જૈન કૃતિ હોવાનો જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૫૮)માં ઉલ્લેખ છે.

૬. આ છપાઈ છે. આનું સંપાદન મુનિ હિમાંશુવિજયે કર્યું છે.

૭. આ અમદાવાદથી ઈ. સ. ૧૮૦૮માં પ્રસિદ્ધ કરાઈ છે.

‘ચન્દ્રાકી’- આ ‘મોઢ’ દિનકરની કૃતિ છે.

વૃત્તિ-ચન્દ્રાકી ઉપર ‘તપા’ ગચ્છના કૃપાવિજયે આ રચી છે. એઓ કમલવિજયના શિષ્ય અને ઉપા. મેઘવિજયના ગુરુ થાય છે.

P. ૨૮૫ ષટ્પંચાશિકા- આના કર્તા ભટ્ટોત્પલ છે.

ટીકા- આ ‘ખરતર’ ગચ્છના લબ્ધિવિજયના શિષ્ય મહિમોદયની રચના છે. એમણે વિ. સં. ૧૭૨૨માં અરસામાં જ્યોતિષરત્નાકર રચ્યો હતો.

ભુવનદીપક- આ હરિભટ્ટની કૃતિ છે.

બાલાવબોધ-ભુવનદીપક ઉપર ‘ખરતર’ ગચ્છના લક્ષ્મીવિજયે વિ. સં. ૧૭૬૭માં રચેલો આ બાલાવબોધ છે.

ચમત્કાર-ચિન્તામણિ- આના કર્તા રાજર્ષિભટ્ટ છે.

બાલાવબોધિની- આ ઉપર્યુક્ત ગ્રંથ ઉપરની વૃત્તિ છે. એ ‘ખરતર’ ગચ્છના પુણ્યહર્ષના શિષ્ય અભયકુશલે રચી છે.

બાલાવબોધ- આ અજ્ઞાતકર્તૃક રચના છે.^૫

હોરામકરન્દ- આ અજ્ઞાતકર્તૃક કૃતિ છે.

ટીકા-‘અંચલ’ ગચ્છના સુમતિહર્ષે આ રચી છે. એમણે ગણક-કુમુદ-કૌમુદી વગેરેની રચના કરી છે.

કેવલજ્ઞાનહોરા- ‘હોરા’ શબ્દના વિવિધ અર્થ કરાય છે : (૧) અઢી ઘડી યાને એક કલાક, (૨) એક રાશિ કે લગ્નનો અડધો ભાગ, (૩) જન્મકુંડળી અને (૪) જન્મકુંડળી પ્રમાણે ભવિષ્ય ભાખવાની વિદ્યા. જન્મકુંડળીનું ફળ બતાવનાર શાસ્ત્રને ‘હોરાશાસ્ત્ર’ કહે છે. એ શાસ્ત્ર લગ્ન ઉપરથી શુભાશુભ ફળનું જ્ઞાન કરાવે છે. પ્રસ્તુત કૃતિ આ શાસ્ત્રને લગતી હશે એમ લાગે છે. એના કર્તા ચન્દ્રસેન છે.

શકુન

‘વસન્તરાજ-શકુન, શકુન-નિર્ણય યાને શકુનાર્ણવ- આ શકુનને લગતી કૃતિના કર્તા વસન્તરાજ છે.

૧. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૧૨૧)માં ચન્દ્રાકી-પદ્ધતિ નામની એક અજ્ઞાતકર્તૃક પાઈય કૃતિ અને કર્તાના નામ વિનાની એના ઉપરની ટીકાની નોંધ છે.

૨. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૦૧)માં હરિભટ્ટની આ નામની પાઈય કૃતિ અને ઈલાભટ્ટે એના ઉપર રચેલી ટીકાનો ઉલ્લેખ છે.

૩. આ નામની બે જૈન કૃતિઓ છે. જુઓ પૃ. 124 અને 126.

૪. રામચંદ્રે શકસવંત્ ૧૫૨૨માં મુહૂર્તચિન્તામણિ નામની કૃતિ રચી છે અને એના ઉપર ‘તપા’ ગચ્છના ચતુરવિજયે ટબ્બો રચ્યો છે.

૫. મતિસારે ફરીદકોટમાં વિ. સં. ૧૮૨૭માં ટબ્બો રચ્યો છે.

૬. આ કૃતિ ભાનુચન્દ્રગણિકૃત ટીકા સહિત “વેંકટેશ્વર મુદ્રણાલય” તરફથી વિ. સં. ૧૯૬૩માં છપાવાઈ છે.

૧વૃત્તિ—આના કર્તા ભાનુચન્દ્રગણિ છે. એનું સંશોધન એમના શિષ્ય સિદ્ધિચન્દ્રગણિએ કર્યું છે. પ. ૨૯૬

(૭) વૈદ્યક

૧અષ્ટાંગહૃદય (ઉ. વિ. સં. ૮૪૦)— આના કર્તા વાગ્ભટ છે. એમનો સમય વહેલામાં વહેલો ઇ.સ.ની છઠ્ઠી સદી અને મોડામાં મોડો ઇ. સ. ૮૦૦ની આસપાસનો મનાય છે. આયુર્વેદની પરંપરામાં ચરક અને સુશ્રુત પછી આ વાગ્ભટનું સ્થાન છે. એ ત્રણેને ‘વૃદ્ધત્રયી’ કહે છે. વાગ્ભટ ‘સિન્ધુ’ દેશના વતની હતા એમ એમણે પોતે કહ્યું છે. એમણે જ અષ્ટાંગસંગ્રહ રચ્યાનું કેટલાક માને છે. વાગ્ભટે ‘ચરક-સંહિતા અને સુશ્રુત-સંહિતા એ બંનેનો સંગ્રહ કર્યો છે ખરો, પરંતુ પ્રસ્તુત વિષયમાં તો એઓ ચરકના સંપ્રદાયને થોડાક ફેરફાર સાથે અનુસર્યા છે.’

ટીકા— આના રચનાર દિ. આશાધર છે. એમણે આ ટીકાનો અનગારધર્મામૃતની સ્વોપજ વૃત્તિની પ્રશસ્તિ (શ્લો. ૧૯)માં ઉલ્લેખ કર્યો છે.

૨આશ્વર્યયોગમાલા યાને યોગરત્નમાલા— આ ૧૪૦ પદ્યની આર્યામાં રચાયેલી કૃતિના પ્રણેતા નાગાર્જુન છે. એઓ ભાસ્કરના શિષ્ય થાય છે. એમણે આમાં સ્તંભન-વિદ્યા વગેરેનું તેમજ કેટલાંક વિષયનું પ. ૨૯૭ વર્ણન કર્યું છે. આ વૈદ્યકનો ગ્રંથ ગણાય છે.

૩વિવૃત્તિ— ‘શ્વેતાંબર ભિક્ષુ’ ગુણાકરે વિ. સં. ૧૨૯૬માં આ વિવૃત્તિ રચી છે. એનો સુખાવબોધા તરીકે નિર્દેશ છે.

૪યોગશત^{૧૦}— આ કૃતિ ભિન્ન ભિન્ન છંદમાં ૧૦૫ પદ્યોમાં ૧૧વરરુચિએ રચ્યાનું મનાય છે. એમાં

૧. આ વેંકટેશ્વર મુદ્રણાલય તરફથી પ્રકાશિત છે.

૨. આ ગ્રન્થ “નિર્ણયસાગર મુદ્રણાલય” દ્વારા એ. એમ. કુન્તેએ અરુણદત્તની ટીકા સહિત ઇ. સ. ૧૮૯૧માં પ્રસિદ્ધ કર્યો છે.

૩. એઓ ઇ. સ.ની પહેલી સદીમાં કનિષ્ક રાજાના વૈદ્ય હતા એમ કેટલાક કહે છે.

૪. એઓ મોડામાં મોડા ઇ. સ.ના ચોથા સૈકામાં થયા હશે એમ કહેવાય છે.

૫. “ચરકાદિના વિચારકોને” એ નામનો મારો લેખ “ગુ. મિ. તથા ગુ. દ. ના તા. ૧૮-૩-’૪૫ના અંકમાં છપાયો છે.

૬. જુઓ ઐતિહાસિક સંશોધન (પૃ. ૪૭૬).

૭. આ તેમજ એના ઉપરની ગુણાકરસૂરિકૃત વૃત્તિની હાથપોથીઓના વર્ણન માટે જુઓ D C G C M (Vol. XVIII, pt. I, pp. 278-280 & 493).

૮. આની હાથપોથી માટે જુઓ પૃ. ૨૯૬, ટિ. ૭.

૯. આયુર્વેદના સારરૂપ આ મૂળ કૃતિ પદચ્છેદ, શબ્દાર્થ, ગુજરાતી ભાષાંતર (અનુવાદ), સ્પષ્ટીકરણ અને ઔષધોનાં સંસ્કૃત નામોનાં ગુજરાતી નામોની સૂચીરૂપ પરિશિષ્ટ તથા ભૂમિકા તેમજ ધન્વંતરિ વગેરેને લગતાં આઠ ચિત્રો સહિત ડૉ. રસિકલાલ જેઠાલાલ પરીખે યોગશતક એ નામથી પ્રકાશિત કરી છે. એમાં પ્રકાશનવર્ષનો ઉલ્લેખ નથી.

૧૦. આને કેટલાક વૃદ્ધયોગશત કહે છે. જુઓ D C G C M (Vol. XVI, pt. I, p. 226).

૧૧. કર્તાના નામનો ઉલ્લેખ મૂળ કૃતિમાં નથી.

વાત, પિત્ત અને કફના પ્રકોપનાં કારણ અને એનાથી ઉદ્ભવતા રોગો, કંઠ, મુખ, આંખ અને કાનના રોગોની તેમજ જાતજાતના જ્વર વગેરેની ચિકિત્સા, કેટલાક ઉપાયો અને ઉપચારોનું નિરૂપણ છે. આ કૃતિનું આદ્ય પદ્ય નીચે મુજબ છે :-

“કૃત્સનસ્ય તન્ત્રસ્ય ગૃહીતધામ્ન-શ્ચિકિત્સિતાદ વિપ્રસૃતસ્ય દૂરમ્ ।

વિદગ્ધવૈદ્યપ્રતિપૂજિતસ્ય કરિષ્યતે યોગશતસ્ય બન્ધઃ ॥૧૧॥”

વૃત્તિ— આ પૂર્ણસેને રચી છે. કેટલાક એમને પૂર્ણચન્દ્ર કહે છે. આ વૃત્તિના પ્રારંભની તેમજ અંતની થોડીક પંક્તિ D C G C (Vol. XVI, pt I, p. 227)માં ઉદ્ધૃત કરાઈ છે. આ સૂચીપત્રના P. ૨૮૮ પૃ. ૨૨૮માં પણ પ્રારંભિક ભાગ છે પણ એ બેમાં તફાવત છે. પૃ. ૨૨૭માં મંગલાચરણમાં ચન્દ્રમૌલિને એટલે કે મહાદેવને નમસ્કાર કરાયો છે, જ્યારે પૃ. ૨૨૮માં વર્ધમાનને એટલે મહાવીરસ્વામીને નમસ્કાર કરાયો છે. આથી પ્રશ્ન ઉદ્ભવે છેકે પૂર્ણસેન શૈવ અર્થાત્ અજૈન છે કે જૈન ?

(૮) નીતિશાસ્ત્ર

નીતિશતક (ઉ. વિ. સં. ૮૦૦)— આના કર્તા ભર્તૃહરિ હોવાનું મનાય છે. એમના સમય તરીકે કેટલાક ઇ. સ. ૬૫૦નો નિર્દેશ કરે છે. ભર્તૃહરિનો કવિ તરીકેનો ઉલ્લેખ યશસ્તિલકચંપૂમાં મળે છે. એનાથી પ્રાચીન ઉલ્લેખ કોઈ સ્થળે છે ખરો ?

ભર્તૃહરિએ નીતિશતક ઉપરાંત શૃંગારશતક અને વૈરાગ્યશતક રચ્યા હોવાનું મનાય છે. આ ત્રણ P. ૨૮૮ શતકોને શતક-ત્રય કહેવામાં આવે છે. નીતિશતકમાં પદ્યોની સંખ્યા ભિન્ન ભિન્ન જોવાય છે : ૧૦૩, ૧૦૪ અને ૧૧૦. બાકીનાં શતકો માટે પણ આવી પરિસ્થિતિ જોવાય છે. નીતિશતક અન્ય શતકોની પેઠે કાવ્યદષ્ટિએ પણ મહત્ત્વનું સ્થાન ભોગવે છે : અહીં તો મેં સુભાષિતની દષ્ટિએ એની નોંધ લીધી છે.

શતકત્રય જૈનોમાં ખૂબ પ્રિય હશે એમ લાગે છે. એના અનુકરણરૂપે સોમશતક, ધનદ-ત્રિશતી, પદ્માનન્દ-શતક અને શૃંગાર-વૈરાગ્ય-શતક રચાયાનું અનુમનાય છે.*

૧. કેટલીક વૈદ્યક કૃતિઓ જેવી કે માધવ (લ. ઇ. સ. ૮૦૦)કૃત માધવનિદાન અને લોલિમ્બરાજકૃત વૈદ્યજીવન ઉપર ટબ્બા રચાયા છે. આ વૈદ્યજીવનના તૃતીય વિલાસનું “પુલોમજા” થી શરૂ થતું ૧૬મું પદ્ય મેં “અર્થની આગગાડી” નામનો મારો જે લેખ “અખંડ આનંદ” (વર્ષ ૫, અં. ૮)માં છપાવ્યો છે તેમાં અવતરણરૂપે આપ્યું છે.

૨. આ કૃતિ અનેક સ્થળેથી આપણા દેશમાંથી તેમજ વિદેશમાંથી પણ પ્રસિદ્ધ થઈ છે. એમાં શતકત્રયાદિ-સુભાષિતસંગ્રહના નામથી જે પ્રકાશન “સિ. જૈ. ગ્રં.”માં ગ્રંથાંક ૨૩ તરીકે ઇ. સ. ૧૯૪૮માં પ્રસિદ્ધ કરાયું છે તે નોંધપાત્ર છે. એમાં નીતિને અંગે શ્લો. ૨૦૧-૩૫૨ને સંદિગ્ધ અને શ્લો. ૩૫૩-૮૫૨ને સંકીર્ણ ગણ્યા છે. એના પછી ૮૪ પદ્યનું વિટવૃત્ત અને ૧૦૩ પદ્યનું વિજ્ઞાનશતક છે. આ કૃતિનું સંપાદન પ્રો. દામોદર ધર્માનંદ કોસંભીએ કર્યું છે અને એમણે વિસ્તૃત ઉપોદ્ઘાત લખ્યો છે.

૩. આની વિ. સં. ૧૫૮૦માં પ્રતિષ્ઠાસોમગણિએ લખેલી હાથપોથી સૌથી પ્રાચીન ગણાય છે. એના એક પત્રની પ્રતિકૃતિ ઉપર્યુક્ત પ્રકાશનમાં અપાઈ છે.

૪. જુઓ ઉપર્યુક્ત પ્રકાશનનું અગ્રવચન (પૃ. ૮).

‘ટીકા (વિ. સં. ૧૫૩૫)– આ ‘શતકત્રય ઉપર ‘ઉપકેશ’ ગચ્છના સિદ્ધસૂરિના શિષ્ય ‘ધનસારે વિ. સં. ૧૫૩૫માં જયપુરમાં ટીકા રચી છે.’ એ ટીકા નીતિશતક વગેરે ત્રણ શતકો ઉપરની વિવિધ સંસ્કૃત ટીકાઓમાં સૌથી પ્રાચીન છે.” એ ટીકા વાતચીતની (colloquial) જૈન સંસ્કૃતમાં છે એમ પ્રો. દામોદર ધર્માનંદ કોસંબીનું કહેવું છે.”

સર્વાર્થસિદ્ધિમણિમાલા— આના રચનાર ‘ખરતર બેગડ’ ગચ્છના જિનસમુદ્રસૂરિ છે. એ સંસ્કૃતમાં હશે એમ માની મેં એની અહીં નોંધ લીધી છે.

રસાધ્યાય-આ અજૈન આચાર્ય નામે કંકાલયની કૃતિ છે, એથી એને કંકાલયાધ્યાય પણ કહે છે.

ટીકા - અંચલગચ્છના આ. મેરુતુંગસૂરિએ વિ. સં. ૧૪૪૩માં પાટણમાં ભદ્રિગ (ભડિગ)ના પુત્ર ચંપક રાવલની અભ્યર્થનાથી સંસ્કૃતમાં આ ટીકા (વાર્તિક) રચેલ છે.

લેખ - આ ગ્રંથ અને એની ટીકાને અંગે મેં નિમ્નલિખિત ‘લેખ લખ્યો છે- “રસાધ્યાય કિંવા કંકાલયાધ્યાય અને મેરુતુંગસૂરિકૃત સંસ્કૃત વાર્તિક (વિ. સં. ૧૪૪૩)”

[પેજ નં : ૧૪૫ની બાકી રહેલ યાદી]

પાણિનીયદ્વાયાશ્રય વિનયરત્ન, કિરાતાર્જુનીયવૃત્તિ : વિનયસુંદર, કિરાતાર્જુનદીપિકા : ધર્મવિજય (અમદાવાદ), કુમારસંભવવૃત્તિ વિજયગણિ (અમદાવાદ), ઘટખર્પવૃત્તિ શાન્તિસૂરિ જેસલમેર, રઘુવંશવૃત્તિસમયસુંદર અમદાવાદ, રાક્ષસકાવ્યવૃત્તિ શાન્તિસૂરિ જેસલમેર. શિશુપાલવઘટીકા ચારિત્રવર્ધન ડેક્કન, નૈષધીયકાવ્ય ટીકા જિનરાજસૂરિ, જ્ઞાનસૂર્યોદયનાટક મેઘપ્રભ પાટણ રોહિણીમૃગાંક પ્રકરણ રામચન્દ્રસૂરિ, વનમાલા નાટિકા રામચન્દ્રસૂરિ, સુધાકલશ રામચન્દ્રસૂરિ, વાદરત્નાકર (ડેક્કન-પુના), વાદવિજય, સિદ્ધાન્તરત્નાકર (ડેક્કન), કંટકોદ્ધાર (પાટણ), ન્યાયતત્ત્વ (જેસલમેર), લિંગ-લિંગીવિચાર (જેસલમેર), વિપ્રવક્ત્રમુદ્ર (ડેક્કન), વપૂમતનાટકમ્ (પાટણ), સર્વજ્ઞપરીક્ષા (જેસલમેર) સ્યાદ્વાદકલિકા : રાજશેખર (પાટણ), હેતુખંડન પાંડિત્ય : સુમતિસાધુ, આનંદ સાગરજી.



૧. આની મુંબઈ સરકારની માલિકીની એક હાથપોથી ભાં. પ્રા. સં.મં.માં છે. એનું આદ્ય પદ્ય તેમજ અંતિમ પંક્તિઓ D C G C M (Vol. XIII, pt. I, p. 403)માં ઉદ્ધૃત કરાયાં છે.

૨. શતકત્રયને અંગે બે ભાષા-ટીકા, હિન્દી પદ્યાનુવાદ, હિન્દી ગદ્યપદ્યાનુવાદ અને બાલાવબોધ રચાયાં છે એમ શ્રી અગરચંદ નાહટાએ એમના પૃ. ૨૭૧માં નિર્દિષ્ટ લેખમાં કહ્યું છે.

૩. એમના પ્રશિષ્યે શાન્તિનાથચરિત્રની એક હાથપોથી વિ.સં. ૧૬૨૮માં લખી છે.

૪-૫. જુઓ ઉપર્યુક્ત પ્રકાશનનો ઉપોદ્ધાત (પૃ. ૨૩).

૬. આ વૈદ્યક ગ્રંથ મેરુતુંગસૂરિકૃત ટીકા સહિત “ચૌખંબા ગ્રંથમાલા”માં પ્રકાશિત થયેલો છે. આ ગ્રંથનું અપર નામ રસાલય પણ છે.

૭. આ લેખ “ભિષગ્ ભારતી” (વ. ૫, અંક ૧૦)માં છપાયો છે.

પરિશિષ્ટ-૧ : ૧ ગ્રંથકારોની સૂચી

(અ) શ્વેતાંબર અને યાપનીય

અજિતપ્રભસૂરિ (પૌ.)	150,155	ઉદયસૌભાગ્ય	45
અજિતસેન	90	ઉપરેતી ટી.સી.	108
અનંતદેવસૂરિ	144	ઉમાસ્વાતિ (વાચક)	8-8,121
અભયકુશલ (ખ૦)	182	ઋષિપુત્ર	124
અભયચંદ્ર	161	કનકપ્રભ	41,43,44,47,54
અભયદેવસૂરિ (ચં.)	18	કર્ણદેવોપાધ્યાય જુઓ વર્ધમાન	168
અભયદેવસૂરિ	139	કલાપ્રભસાગરસૂરિ	33
અમર (ખ૦)	181	કલ્યાણસાગર (અં.૦)	33
અમરચંદ્ર (ત૦) 43,48,51,106		કલ્યાણસૂરિ	33
અમરચંદ્રસૂરિ (વા.) 41,56,56,75, 87,90, 97,102,146,155		કાન્તિવિજય	174
અમરસિંહ	60	કાન્તિસાગરજી (ખ૦)	117,118
અમ્બપ્રસાદ	99	કાપડિયા મોતીચંદ ગિ૦ (ગ૦)	46
અમ્માપ્રસાદ	99	કીર્તિચંદ્ર	25
અસગ (ગૃ?)	74	કીર્તિવિજય	161
આગમોદ્ધારક (ત૦) જુઓ		કુમારપાલ (નૃપ)	28
આનંદસાગરસૂરિ	50,69	કુમુદચંદ્ર	91
આજડ (ગૃ)	179	કુમુદેન્દુ	101
આનંદસાગરસૂરિ (ત૦)	8,48,77,83	કુલમણ્ડનસૂરિ (ત૦)	28-29-31
જુઓ આગમોદ્ધારક		કુશલસાગર	66
આર્યવજ્ઞ 14. જુઓ વજ્ઞયશ અને વજ્ઞસ્વામી		કૃપાચંદ્રસૂરિ	47
આસડ (ગૃ)	175	કૃપાવિજય (ત૦)	182
ઈંદ્ર	14	કેશરવિજય	54
ઈંદ્રભૂતિ	3	કૈલાસસાગરગણિ (ત૦)	161
ઈલાભટ્ટ (ગૃ?)	182	ક્ષમાકલ્યાણ (ખ૦)	159,160,172,173
ઉત્તમર્ષિ	150	ક્ષમામાણિક્ય (ખ૦)	172,173
ઉદયકીર્તિ (ખ૦)	166	ક્ષેમકીર્તિસૂરિ (ચં.)	22
ઉદયચંદ્ર	42	ક્ષેમહંસ (ખ૦)	175
ઉદયધર્મ (બૃ૦ ત૦)	30	ક્ષેમહંસગણિ	91
ઉદયપ્રભસૂરિ (ના૦)	125,126	ક્ષેમન્દ્ર	171
ઉદયસાગર	33	ખુશાલસુંદર (ઉ૦)	180
ઉદયસિંહ	102	"	180

૧. આથી ગ્રંથના પ્રણેતા, સંશોધક, સહાયક, સંકલનકાર, લેખ લખનાર, વક્તા તેમજ પ્રસ્તાવનાકાર અભિપ્રેત છે.

* આ 'યાપનીય' સૂચક ચિહ્ન છે.

ગમ્ભીરવિજયગણિ	46	જયદેવ જુઓ શ્વેતપટ	78,81,85,176
ગર્ગાર્ય	134	જયંતવિજયજી (ત૦)	153
ગાંધીલાલચંદ્રભગવાનદાસ(ગૃ)29,102,149,150,213		જયમંગલસૂરિ	90,97,175
ગુણકીર્તિસૂરિ (ખ૦)	154	જયરાજ (ત૦)	156
ગુણચંદ્ર (ખ૦)	18	જયશેખર (અં૦)	83
ગુણચંદ્રગણિ જુઓ દેવભદ્રસૂરિ	83,129	જયશેખર (અં.)	83
ગુણચંદ્રગણિ (પૂર્ણ)	108,108,109	જયસિંહ (સવાઈ)	139
ગુણચંદ્રસૂરિ	48,49,172	જયસિંહસૂરિ	82
ગુણરત્ન	75	જયસિંહસૂરિ (કૃ૦)	28
ગુણરત્ન (ખ૦)	170	જયાનંદ(સૂરિ)	29
ગુણરત્નગણિ (ખ૦)	178	જયાનંદસૂરિ	41,55,56,57,178
ગુણરત્નસૂરિ	58,58	જસવંતસાગર જુઓ યશસ્વત્સાગર	181
ગુણવલ્લભ	126	જસવિજયગણિ (ત૦)	
ગુણવિજય	157	જુઓ યશોવિજયગણિ	137
ગુણાકર	115	જિનચંદ્ર પર જિનચંદ્ર (ના૦ ત૦)	172
ગુણાકરસૂરિ	142	જિનચંદ્રસૂરિ	71
ગુણાકરસૂરિ	183,183	જિનતિલકસૂરિ	154
ગોલ્હણ	169	જિનદત્તસૂરિ (ખ૦)	18
ગોવિંદાચાર્ય	77	જિનદત્તસૂરિ (વા૦)	131,132,115,129
ગૌતમ	169	જિનદાસગણિ	7
ગૌતમ મહર્ષિ	133	જિનદેવ	64,67
ચતુરવિજય (ત૦)	182	જિનપાલગણિ	133
ચતુરવિજયજી (ત૦)	112,113,171	જિનપ્રબોધસૂરિ (ખ૦) જુઓ પ્રબોધમૂર્તિ	168
ચંદ્રકીર્તિ	88	જિનપ્રભસૂરિ (ખ૦)	84,123,179
ચંદ્રકીર્તિસૂરિ (ના૦ ત૦)	69,171,171	જિનભદ્ર (ના૦)	125
ચન્દ્રગુપ્તસૂરિ	39	જિનભદ્રગણિ (ક્ષમાશ્રમણ)	3,121
ચંદ્રતિલક (ખ૦)	23	જિનભદ્રસૂરિ (ખ૦)	71
ચંદ્રવિજય	105	જિનલાભસૂરિ (ખ૦)	159,173
ચંદ્રસાગરજી (ત૦)	38,39	જિનવર્ધનસૂરિ	91
ચંદ્રસાગરગણિ (હાલ સૂરિ) (ત૦)	41	જિનવિજય (હાલ ગૃ૦)	31
ચારિત્રવર્ધન (ખ૦)	154	જિનવિજયજી	32,71,120,167
ચારિત્રસિંહ (ખ૦)	49,172	જિનસમુદ્રસૂરિ (ખ૦ બેગડ)	185
જગદેવ (ગૃ૦)	128	જિનસાગર	45
જગદ્દેવ	128,129,133,133	જિનસાગર (ખ૦)	156
જમ્બૂવિજય	39,108	જિનસાગરસૂરિ	156
જયકીર્તિ	82		

જિનસૂર	115	દોશી બેચરદાસજી (ગૃ)	18,20,39
જિનેન્દ્ર	117	ધનચંદ્ર	40,40
જિનેશ્વરસૂરિ (ચં૦)	12,17,18	ધનદ (ગૃ૦)	31,150,151
જૈન કમલપ્રકાશ	107	ધનરાજ અને ધન્યરાજ ધનપાલ (ગૃ૦) જુઓ	62,63,66,74,120,167
જૈન ભગવાનદાસ (ગૃ૦)	138	ધનરાજ (ગૃ૦) ધનદ અને ધન્યરાજ જુઓ	150
જૈન રમેશ	111	ધનરાજ (અ૦)	181
જ્ઞાનતિલક (ખ૦)	171	ધનવિજય	156
જ્ઞાનપ્રમોદગણિ (ખ૦)	91	ધનસાર (ઉ૦)	185
જ્ઞાનવિમલ (ખ૦)	67	ધનેશ્વરસૂરિ	18
જ્ઞાનસાગર	161	ધન્યરાજ (ગૃ૦) ધનદ અને ધનરાજ જુઓ	150
ઝવેરી મોહનલાલ ભ૦ (ગૃ૦)	123	ધર્મકુમાર	155
ઠક્કરકેરુ (ગૃ૦) 117,118,120,127,148,148		ધર્મધોષ	168
તત્ત્વવલ્લભ	161	ધર્મધોષસૂરિ	44
તત્ત્વસુંદર	181	ધર્મચંદ્ર	154
તપારત્ન	71	ધર્મદાસગણિ	125
તિલકપ્રભસૂરિ (પૌ૦)	150,155	ધર્મદેવ	171
ત્રિભુવચંદ્ર (કા૦) જુઓ વાદિસિંહસૂરિ અને સિંહસૂરિ	176	ધર્મધુરન્ધરસૂરિ	68
ત્રિમલ્લ	106	ધર્મનંદનગણિ	88
દક્ષવિજયજી (ત૦)	52,57	ધર્મવિજયજી (ત૦) વિજયધર્મસૂરિ જુઓ	64
દયાનંદ	171	ધર્મશ્રેષ્ઠી (ગૃ૦)	151
દયારત્ન	170	નંદલાલ (ગૃ૦)	150
દાનવિજય (ત૦)	26	નંદસુંદર	40
દીપકકર્તા જુઓ ભદ્રેશ્વરસૂરિ	19,20	નન્દિધોષવિ.	57
દુર્લભરાજ (ગૃ૦)	128,146	નંદિયજી	87
દેવચંદ્ર	144,171	નંદિષેષ	85,88
દેવભદ્રસૂરિ જુઓ ગુણચંદ્રગણિ	129	નમિસાધુ (થા૦)	79,89,176,176
દેવમૂર્તિસૂરિ	33	નયચંદ્રસૂરિ (કૃ૦)	28
દેવમૂર્તિસૂરિ (કા૦)	176	નયનશેખર (અં૦)	143
દેવવિમલગણિ (ત૦)	67	નયવિમલ	174
દેવસાગરગણિ (અં૦)	66	નયસુંદર	170
દેવાનંદસૂરિ (ચં૦)	50	નરચંદ્ર (કા૦) (ઉપા૦)	126,176
દેવેન્દ્ર (રુ૦)	149,150	નરચંદ્ર (મ૦) (પં.)	45
દેવેન્દ્રસૂરિ	58	નરચંદ્ર (મ૦) (ઉપા૦)	45
દેવસેન	90	નરચંદ્રસૂરિ	102
દેશાઈ મોહનલાલ દલીચંદ (ગૃ૦)	46,158	નરચંદ્રસૂરી	126
દેવજી શિરોમણિ	125	નરપતિ (ગૃ૦)	131

નરેન્દ્રપ્રભસૂરિ	102,103,155	ભક્તિલાભ	29
નર્બુદાચાર્ય	115	ભક્તિલાભ (ખ૦)	180
નવાભ વિદ્યા	114	ભદ્રબાહુ (બીજા)	6
નાગવર્મા	67	ભદ્રબાહુસ્વામી	6
નાહટા અગરચંદ (ગૃ૦)	113,113,134,139, 168,171,173,180,179,185	ભદ્રશ્વરસૂરિ દીપકકર્તા	19,20
નેમિચંદ્ર (ભંડારી) (ગૃ૦)	71,92	ભવ્યોત્તમ મુનિ	150
*ન્યાસકાર પાલ્યકીર્તિ જુઓ	15	{ ભાનુચંદ્ર (ત૦)	171
(શકટાંગજ અને શાકટાપન પદ્યપ્રભ (ચં૦)	18	{ ભાનુચંદ્રગણિ (ત૦)	66,68,68
પદ્યપ્રભસૂરિ (ના૦ ત૦)	124		171,178,182,183
પદ્યસુંદર	67	ભાવચરિત્ર	154
પદ્યસુંદરગણિ	106	{ ભાવદેવ	104
પાદલિપ્તસૂરિ	123,123	{ ભાવદેસૂરિ (ખં૦)	102,104
પાર્શ્વચંદ્રસૂરિ	106	{ ભાવપ્રભસૂરિ (પૌ.)	172,181
પાર્શ્વચંદ્રસૂરિ	129	{ ભાવરત્ન	181
પાર્શ્વચંદ્રસૂરિ	172	ભીમવિજય	179
પાલ્યકીર્તિન્યાસકાર, શકટાંગજ અને શાકટાપન જુઓ	13,14	ભોજ	147
પુણ્યનંદન	106	ભોજસાગર	134
પુણ્યવિજયજી (ત૦)	20,21,72,148	મડ્ગલવિજયજી (ત૦)	48
પુણ્યસુંદર	53	મણિભદ્ર	150
પૂર્ણચંદ્ર પૂર્ણસેન પૂર્ણસેતૂત્તમસૂરિ જુઓ	184,183	મણ્ડન (મંત્રી) (ગૃ૦)	31,104,113,172
પૂર્ણસેન પૂર્ણચંદ્ર જુઓ	184,184	મતિસાગર	180
પૃથ્વીચંદ્રસૂરિ	169	મતિસાર	182
પ્રતાપસિંહદેવ	144	મંમથસિંહ (ગૃ૦) માધસિંહ જુઓ	155
પદ્યુન્નસૂરિ	168	મલયગિરિસૂરિ	13,20,22,108
પ્રબોધમૂર્તિ (ખ૦) જિનપ્રબોધસૂરિ જુઓ	168	મલયેન્દુ	139
પ્રભાચંદ્રસૂરિ (ચં૦)	3,51	મલ્લરાજ મહીપતિ	144
પ્રમોદકુશલગણિ	154	મલ્લવાદી જુઓ મહાતર્કિક	13,167
પ્રિયંકરવિજયજી (ત૦)	46	મલ્લવાદી	13,13
પ્રેમલાભ (અં૦)	22	મલ્લિપેશ (ના૦)	125
બનારસીદાસ (ગૃ)	126	મહાતાર્કિ મલ્લવાદી જુઓ	13
બાપ્પભટ્ટિસૂરિ	89,102	મહાદેવ	169
બાલચંદ્ર	92	મહાવીરસ્વામિ	12
બાહડ (ગૃ) વાગભટ જુઓ	90	મહિમાપ્રભસૂરિ	39
બુદ્ધિસાગરસૂરિ (ચં૦)	17,18,64,66,83	મહિમોદય	127
		મહિમોદય (ખ૦)	182
		મહીદાસ	72

મહેન્દ્ર	143	યશોવિજયગણિ (ત૦) જુઓ જસવવિજયગણિ	
મહેન્દ્રસૂરિ (અં.)	168		59,86,97,98,136,178
મહેન્દ્રસૂરિ (પૂર્ણ૦)	72,73,73	યશોવિજયગણિ	156
મહેન્દ્રસૂરિ	139	રત્નચંદ્ર	87
મહેશ્વર	32	રત્નચંદ્ર	27,77
મહેશ્વર	67	રત્નધીર	125
મહેશ્વર	67	રત્નમંદિરગણિ (ત૦)	44
માધચંદ્રદેવ	144	રત્નવલ્લભ વિ.	57
માધસિંહ (ગ૦) જુઓ મન્મથસિંહ	155	રત્નશેખર	55
માણિક્યસચંદ્રસૂરિ (રા૦)	177,178	રત્નશેખરસૂરિ (ના૦ ત૦)	88
માણિક્યમલ્લ	174	રત્નસાગર (ખ.)	70
માણિક્યસૂરિ	132	રત્નસૂરિ	31
માનસાગર	127	{ રત્નર્ષિ	12
મુનિચન્દ્ર વિ.	52	{ રત્નસાગર	27
મુનિચન્દ્રસૂરિ	157	રત્નહર્ષ	171
મુનિદેવ(બ૦)	50	રત્નાકર	107
મુનિદેવ આચાર્ય	159	રમણીકવિજય	75
મુનિભદ્ર	150	રવિગુપ્ત	77
મુનિશેખર	40	રવિગુપ્ત	161
મુનિસુંદરસૂરિ (ત૦)	23,50	રવિપ્રભગણિ	102
મેઘજી	138	રાજવલ્લભ	136
મેઘપ્રભસૂરિ	159	રાજશેખર (હ૦)	45
મેઘવિજય (ગણિ),	47,88,122,130,131,	રાજશેખર જુઓ	126
	134,137,137	રાજશેખર	83
મેઘરત્ન (વ૦)	139,170	રાજશેખર	168
મેરુતુંગ (અં૦)	22	રાજશેખર (હ૦) જુઓ રાજશેખર	126
મેરુતુંગસૂરિ (ના૦)	36	રાજ(?જય)શેખર	88
મેરુતુંગસૂરિ (અં૦)	168	રાજસી	171
મેરુસુંદર (ખ૦)	92,179	રાજસોમ	181
મેરુસુંદર	156,175	રાજહંસ (ખ૦)	91
મોક્ષરતિ વિ.	161	રામચંદ્ર	161
મોક્ષેશ્વર	169	રામચંદ્ર	74
મોતીચંદ્ર	116	રામચંદ્રસૂરિ (પૂર્ણ.)	44,108,109
"યક્ષવર્મા	14,15	રામવિજય (ખ૦) જુઓ રૂપચંદ્ર	172
યતીશ	171	રામવિજયગણિ	88
યશઃકીર્તિ	131	રૂપચંદ્ર	106
યશઃકીર્તિ	175	રૂપચંદ્ર (ખ૦) જુઓ રામવિજય	172
યશસ્વત્સાગર જુઓ જસવન્તસાગર	181	લક્ષ્મણ	156
યશોદેવસૂરિ	59	લક્ષ્મીકલ્લોલગણિ	157
યશસ્વિગણિ (વું.)	161		

લક્ષ્મીધર	142	વિજયાનંદ વિદ્યાનંદસૂરિ જુઓ	23
લક્ષ્મીવિજય (ખ૦)	182	વિદ્યાકર	43
લક્ષ્મીસાગરસૂરિ	125	વિદ્યાનંદસૂરિ જુઓ	22,23
લબ્ધિચંદ્રગણિ	127	વિજયાનંદ વિનયચંદ્ર	102
લાવણ્યશર્મા	132	વિનયચંદ્રસૂરિ	90,102,102
લીલાશુક	15	વિનયભૂષણ	57
વજ્રયશ આર્યવજ્ર અને વજ્રસ્વામી	14	વિનયરત્ન	179
વજ્રસ્વામી વજ્રસેન	156	વિનયવિજય	40
વજ્રસ્વામી આર્યવજ્ર અને વજ્રયશ	14	વિનયવિજયગણિ (ત૦)	7,31,46,47,71
વર્ધમાન	81	વિનયસાગર (ઉપા૦)	158,159
વર્ધમાન	133	વિનયસાગર (ખ૦)	68,159,159,179
વર્ધમાન કર્ણદેવોપાધ્યાય જુઓ	168	વિનયસાગર (અં૦)	159,159,169,171
વર્ધમાનસૂરિ	9,15,19,20	વિનયસાગર	159
વર્ધમાનસૂરિ	64,83	વિનયસાગરસૂરિ	45
વર્ધમાનસૂરિ	86	વિનયસાગરસૂરિ (અં૦)	74
વર્ધમાનસૂરિ	91	વિભુધમંદિરગણિ	101
વર્ધમાનસૂરિ	133	વિમલ	149
વલ્લભગણિ (ખ૦) શ્રીવલ્લભ જુઓ	67	વિમલકીર્તિ	166
વલ્લભ વાયક (ખ૦)	55	વિમલચંદ્ર	149
વસ્તુપાલ (ગૃ૦)	98,155	વિમલરત્ન વિ.	39
વાગ્બટ જુઓ બાહડ	89,90,91,103	વિમલસૂરિ	149
વાદિસિંહસૂરિ (કા૦) ત્રિભુવનચંદ્ર		વિમલસૂરિ	154
અને સિંહસૂરિ જુઓ	176	વિશાલકીર્તિ (ખ૦)	171
વામન	12,13,18	વિશાલવિજય (ત૦)	160
વિક્રમસિંહ	33	વિશ્રન્તવિદ્યાધર	13
વિજયદેવ	134	વિશ્વશમ્ભુ	76
વિજયધર્મસૂરિ (ત૦) ધર્મવિજયજી જુઓ	64	વીરભદ્ર	115,115
વિજયનેમિસૂરિ (ત૦)	48	વીરસેન	48
વિજયપદ્મસૂરિ	156	વોસરિભટ્ટ	166
વિજયરાજેન્દ્રસૂરિ	76,77	*શકટાંગજ	20
વિજયલાવણ્યસૂરિ (ત૦)	44,47,53	શાકટાયન ન્યાસકાર અને પાલ્યકીર્તિ	
વિજયવિમલ (ત૦)	12	જુઓ	13,15,16,20,54
વિજયવિમલ	59	શાન્તિચંદ્ર (ત૦)	105
વિજયસેન	157	શાહ માવજી દામજી	153
વિજયસેનસૂરિ	157	શિવચંદ્ર (ખ૦)	179
		શિવલાલ પંડિત	39

શિવાય	15	સાગરચંદ્ર	126
શીલશેખરગણિ	88	સાધુકીર્તિ (ખ૦)	69
શીલાંકસૂરિ	80	સાધુરત્ન	66
શુભચંદ્ર	161	સાધુસુન્દરગણિ (ખ૦)	53,54,69
*શિવાય	15	સારંગમુનિ	158
શીલાંકસૂરિ	80	સિંહતિલકસૂરિ	120,125,180,180
શુભચંદ્ર	161	સિંહદેવગણિ	90,91
શુભવિજયગણિ (ત૦)	67,98	સિંહસૂરિ (કા૦) ત્રિભુવનચંદ્ર અને	
શુભશીલ	52	વાદિસિંહસૂરિ જુઓ	176
શુભશીલગણિ (ત૦)	70	*સિદ્ધનંદિ	14
શેઠ હરગોવિંદદાસ ત્રિકમચંદ	77	સિદ્ધર્ષિ	144
શોભન	167	સિદ્ધસેનગણિ	8
શ્યામાચાર્ય	71	સિદ્ધસેન દિવાકર	10,10,18,49,85
શ્રીચંદ્ર	81	સિદ્ધિચંદ્રગણિ (ત૦)	32,68,74,
શ્રીચંદ્રસૂરિ	129	(સંશોધક)	158,158,178,183
શ્રીધરદેવ	144	સિદ્ધિસૂરિ (ઉ૦)	180
શ્રીપ્રભસૂરિ	48	સુધર્મસ્વામી	3
{ શ્રીવલ્લભ (ખ૦) વલ્લભગણિ જુઓ	67,72	સુધાકલશ (હ૦)	64,75,112
{ શ્રીવલ્લભગણિ (ખ૦)	66	સુમતિગણિ	67
ચેતપટ જયદેવ જુઓ	79	સુમતિહર્ષ (અં૦)	180,181,182
સંવેગસુંદર	158	સુલ્હણ	78
સક્લકીર્તિ	159	સુપેણ	144
સદ્ગ્રામસિંહ સોની (ગ૦)	17,148,163	સોમચંદ્ર (ત૦)	156
સંગ્રામસિંહ સોની (ગ૦)	29,169	સોમચંદ્રગણિ (બ૦)	175
સદાનન્દગણિ (ખ૦)	171	સોમચન્દ્રસૂરિ	146
*સમન્તભદ્ર	16	સોમપ્રભસૂરિ	31
સમન્તભદ્ર (શ્રુતકેવલી)	131,132	સોમપ્રભસૂરિ (બ૦)	153,154
સમયસુન્દરગણિ (ખ૦)	75,76,88,91,106,175	સોમપ્રભાચાર્ય	144
સર્વગુપ્ત	15	સોમશીલ	171
સવદેવસૂરિ	133	સોમસુંદર (ઉપા૦)	158
સર્વાનન્દ	15	સોમસૂરિ	161
સલક્ષ મંત્રી (ગ૦)	77	સોમોદયગણિ (ત૦)	91
સહજકીર્તિ (ખ૦)	27,70,171	સૌભાગ્યસાગર	43,45
સાગરચંદ્ર	20	હંસદેવ	146
		હંસરાજ	144

હંસરાજ	174	હીરાલાલ વિ. હંસરાજ (ગૃં)	132
હરિ	77	હીરાલાલ હંસરાજ (ગૃં)	158,158
હરિ હરિષેણ જુઓ	156	હૃદયસૌભાગ્ય	45
હરિભદ્ર હરિભદ્રસૂરિ જુઓ	42,45	હેમચંદ્ર (મલં)	3,8,75 (?)
હરિભદ્રસૂરિ	7,7,13,123	હેમચંદ્ર (પૂર્ણં)	92,95,96
હરિવંશ (કવિ)	131	હેમચંદ્ર આચાર્ય (પૂર્ણં)	
હરિષેણ હરિ જુઓ	156	હેમચંદ્રસૂરિ (પૂર્ણં) જુઓ	51,53,54
હર્ષકીર્તિસૂરિ (નાં તં)	69,127,127,	હેમચંદ્ર	133
143,153,154,171,172,172,		હેમચંદ્રસૂરિ (પૂર્ણં)	5,7,13,13,17,
174,181		18,35,35,36,39,40,42,44,44,51,52,54,	
હર્ષકુલ	31	55,57,63,64,65,67,71,73,73,75,79,80,	
હર્ષકુલ	156	82,83,85,92,93,94,96,111,152,177	
{ હર્ષકુલ (તં)	178	હેમચંદ્રાચાર્ય જુઓ	36
{ હર્ષકુલગણિ	31	હેમચંદ્ર(પૂર્ણં)	
હર્ષકુલગણિ	58	હેમતિલક	125
હર્ષચંદ્ર	168	હેમપ્રભ	150
હર્ષવર્ધન	17	હેમપ્રસૂરિ	126
હર્ષવિજય	52	હેમરત્ન	170
હસ્તરુચિ (તં)	143	હેમવિજયગણિ (તં)	157,158
હિતરુચિ (તં)	143	હેમહંસગણિ	42,57,57
હિમાંશુવિજયજી (તં)	116,153	હેમહંસગણિ	57
{ હીરવિજયસૂરિ (તં)	138	હેમહંસગણિ	126
{ હીરસૂરિ	138		



(આ) દિગમ્બર

અકલંક જુઓ રાજવાર્તિકકાર	11,62,135	ચંદ્રસેન	182
અકલંક	33	ચારુકીર્તિ	12
અકલંકદેવ	72	ચારુકીર્તિ	81
અજિતસેન	16	ચિત્રકુમારસેન	142
અજિસેન	105	જયકીર્તિ	78,78,80,81,83
અનન્તકીર્તિ	25	જવેરી ભોગીલાલ અમરતલાલ	152
અનન્તપાલ (ગૃ૦)	120	જિનેસન (પહેલા)	8,62,120
અભયચંદ્ર	13,16	જિનસેન (બીજા)	62,128
અભયનન્દિ	8,10,11	જિનેન્દ્રબુદ્ધિ જુઓ દિગ્વસ્ત્ર, દેવ, દેવનંદિ,	
અમર	76,76	દેવનંદિન, પાદપૂજ્ય અને પૂજ્યપાદ	8
અમરકીર્તિ(ત્રૈવિદ્ય)	62,76,76	જૈન મોહનલાલ	61
અમરકીર્તિ	152	જોઈદુ યોગીન્દુ દમસાગર (મુનિ) જુઓ	81
અમિતગતિ (પહેલા)	152	દપાલ (મુનિ)	16
અમિતગતિ (બીજા)	152	દશરથગુરુ	140
અમૃતનંદિ	105	દિગ્વસ્ત્ર જિનેન્દ્રબુદ્ધિ, પાદપૂજ્ય અને પૂજ્યપાદ જુઓ	914
અમૃતનંદિ	140	દેવ	8
અમૃતાનંદયોગી	105	દેવનંદિ	8,12,20
અમોઘવર્ષ	149	દેવનંદિન	8
અસગ	82	દેવેન્દ્રકીર્તિ	23,25
આમન	120	દ્વિવેદી એમ. એમ.	9
આશાધર(ગૃ) 9,24,25,62,142,173,177,183		ધનંજય (ગૃ૦)	61,62,72,73
ઈંદ્રનંદિ	151	ધનંજય	61
ઉગ્રાદિત્ય	140,142	ધનપાલ (ગૃ૦)	120
ઉપાધ્યે એ. એન	26	ધરસેન	77
એકસંધિ ભટ્ટારક	117	ધર્મચંદ્ર	24
કલ્યાણકીર્તિ	62	નેમિચંદ્ર	25
કુંદકુંદાચાર્ય	24	નેમિચંદ્ર	121
કુંદકુંદાચાર્ય	151	નેમિચંદ્ર	135
કુમારસેન	142	નેમિચંદ્ર, જૈન	135
કેવલકીર્તિ	138	નેમિચંદ્ર શાસ્ત્રી	139
ગુણનંદિ	10,10,11	નેમિદાસ	151
ગુણનંદિ	11	નેમિનાથ	163
ગુણભદ્ર	120,121	પદ્મસુંદર	67
ગુમ્મટદેવ મુનિ	140	પાત્રકેશરીસ્વામી	140
ચંદ્રકીર્તિ	25	પાદપૂજ્ય જિનેન્દ્રબુદ્ધિ, દિગ્વસ્ત્ર, દેવ,	
ચંદ્રચ્ચ	9	દેવનંદિ, દેવનંદિન અને પૂજ્યપાદ જુઓ	181
		પાર્શ્વચંદ્ર	112,112

પાર્શ્વદેવ	112	વસુનંદિ	33
પુષ્પદંત	176	વાગ્ભટ	87,92,103,104
પૂજ્યપાદજિનેન્દ્રબુદ્ધિ,દિગ્વસ્ત્ર,દેવ,દેવનંદિ,દેવનંદિનુસને		વાદિરાજ (પંડિત)	92,120
પૂજ્યપાદજુઓ	80,78,62,10,9,8,81,140,165	વાદિરાજસૂરિ	15,25,107
પૂજ્યપાદ	142	વિજયવર્ણી	90
પૂજ્યપાદ	140	વીરસેન	9,61,120,121
પૂજ્યપાદ	141	વૃષભનાથ	25
પૂર્ણસેન	142	શર્મા નંદલાલ	74
પ્રભાચંદ્ર	9	શાસ્ત્રી વર્ધમાન પાર્શ્વનાથ	142
પ્રભાચંદ્ર	10	શિવકોટિ	151
પ્રભાચંદ્ર	11,11,15,15,61,151	શુભચંદ્ર	24
પ્રભાચંદ્ર	25	શુભચંદ્રસૂરિ	24,25
પ્રેમી નાથુરામ	8,10,12,22,82,152,162,162	શુભચંદ્રસૂરિ	151
બંસીધર વંશીધર જુઓ	11	શ્રીચંદ્ર	23
બનારસીદાસ	153	શ્રીદત્ત	10
બ્રહ્મદેવ	25	શ્રીધરસેન	74
ભણસાળી દયાળજી ગંગાધર	152	શ્રીધરાચાર્ય	120
ભવશર્મા	25	શ્રીપાલ્યકીર્તિશ	81
ભાવસેન (ત્રૈવિદ્ય)	16,168	શ્રુતકીર્તિ (આર્ય)	10,11,11
ભૂતબલિ	10	શ્રુતમુનિ (અભિનવ)	151
મલ્લિષેણ	24	શ્રુતમુનિ	161
મલ્લિષેણ	151	શ્રુતસાગર	23,24,25,24
મહાક્ષપક	75	સકલકીર્તિ	24,25
મહાચંદ્ર	11	સકલકીર્તિ	168
મહાવીરાચાર્ય	118,118	સકલકીર્તિ	134
મહેન્દ્રકુમાર	11,15	સકલભૂષણ (સહાયક)	25
મહેન્દ્રકુમાર	61,62	સમંતભદ્ર	9,10
મેઘનાદ	140	સમન્તભદ્ર	140
યક્ષવર્મા	14,15	સમંતભદ્ર	135
યલ્લાચાર્ય	120	સમયભૂષણ	151
યશોભદ્ર	10	સિંહનાદ	140
યોગીન્દુ જોઈન્દુ જુઓ	82	સિદ્ધસેન	140
રત્નનન્દિ	25	સોમદેવ	6,61,151,161
રત્નભૂષણ	25	સોમદેવ(સૂરિ)	10,12
રાજકુમાર	11	સોમદેવ(સૂરિ)	162
રાજવાર્તિકકાર અકલંક જુઓ	11	સોમસેન	161
રામકીર્તિ	82	સ્વયમ્ભૂ	79,85
વંશીધર બંશીધર જુઓ	9	સ્વયમ્ભૂવેશ	81
વર્ધમાન	168		
વલ્લભ	119		



(ઇ) અજૈન

અગસ્ત્ય	163	કાસવ	80
અનુભૂતિ સ્વરૂપચાર્યા	192,192	કુમારસ્વામી	96
અબુલફઝલ	68	કૃષ્ણમાચારિઅર એમ.	82,90
અભિનવગુપ્ત	80,94,95,177	કૃષ્ણશર્મા	92
અમરસિંહ	60,74,173	કેદાર	82,86,87
અરિસિંહ	97	કેદારભટ્ટ	174
અરુણદત્ત	183	કોસમ્બી દામોદાર ધર્માનંદ	184,185
અલટ	177	કોહલ	82
અશ્વધોષ	2	કૌણ્ડિન્ય	82
અશ્વતર	82	કૌશિક	53
આડતિયા રતિલાલ દેવચંદ	1	કૌષ્ટુકિ	82
આથવલે રામચંદ્ર	92	ક્ષરસ્વામી	62
આનંદવર્ધન ધ્વનિકાર જુઓ	95	ક્ષેમશર્મા	145
આપર્ટન ગુસ્ટવ (Opetran Gustav)	16	ક્ષેમેન્દ્ર	146
આર્યભટ (પહેલો)	192	ખરે નારાયણ મોરેશ્વર	112
ઈત્સિંગ(Itsing)	166	ગણેશ	92
ઈદ્ર	6	ગણેશ	181
ઉત્પલ	80	ગાર્ગ્ય	5
ઉદ્ભટ	176,177	ગિરધરાનંદ	138
કંસારા નારાયણ	22	ગોડે પી. કે.	140,174
કણ્વ	53	ગોપાલ	80
કપિલ	82	ગૌડવશતિલક	143
કમ્બલ	82	ઘાટગે એ. એમ.	126
કલ્યાણમલ્લ	67	ચંદ્ર	16
કલ્હણ	34	ચંદ્રગોમિ	20,34
કશેળીકર વાસુદેવરાવ જનાર્દન	66	ચંદ્રટ	144
કાકલ (કાચસ્થ)	41,55	ચરક	183
કાણેપી. વી.	96,96,176,178	ચાણક્ય વિષ્ણુગુપ્ત જુઓ	162
કાત્યાયન (બૌદ્ધ)	37	ચેટરજી ક્ષિતિશચંદ્ર	37
કાત્યાયન (બૌદ્ધ)	167	જનાશ્રય	80
કામન્દક	162	જયદેવ	106,179
કાર્તિકસ્વામી	128	જપાદિત્ય	166
કાલિદાસ	53,174,177	જલ્હણ	61
કાલિદાસ	181	જલ્હણદેવ	154
કાશ્યપ	82,85	જહાંગીર (બાદશાહ)	68
		જિનેન્દ્રબુદ્ધિ (બૌદ્ધ)	8,166
		જીન્સ જેઈમ્સ (Jeans James)	1

જેકબ (Lacob) કર્નલ	91	નારદ	122
જા ગંગાધરનાથ	177	નારદ	128
ઝેચારિઆ (Zachariae)	73	નારાયાણ	80
ડે. એસ. કે.	90,95,98,175	પતંજલિ ભાષ્યકાર જુઓ	5,166
દણ્ડિન્	82	ભાષ્યકાર પરીખ રસિકલાલ છો.	92,95
ત્રિપાઠી રુદ્રદેવ	178	પરીખ રસિકલાલ જેઠાલાલ	183
ત્રિપાઠી શંભુનાથ	61	પવોલિનિ(Pavolini)	150,154
ત્રિવિક્રમ	23	પાણિનિ જુઓ દાક્ષીપુત્ર અને શાલાતુરીય	10,16,20,36,165,165,170,176,166
ત્રિવિક્રમ	80	પાલકાખ્ય	146
દણ્ડિન્	175	પાવુલૂરિ મલ્લન	119
દણ્ડી	95,103,106,175,176,177	પિંગલ જુઓ મુનિ	78,80-80,82
દત્ત બિભૂતિભૂષણ	120		85,86,88,176
દાક્ષીપુત્ર જુઓ પાણિનિ અને શાલાતુરીય અને	165	પિટર્સન (Peterson)	23,97,148,174
દામોદર ગોવિંદાચાર્ય	132	પિશલ આર.(Pischel R.)	39
દિગમ્બર	112	પુત્રાગચંદ્ર	87
દિનકર દીક્ષિત	182	પુરુષોત્તમ	64
દુર્ગ જુઓ દુર્ગસિંહ	50	પુરુષોત્તમદેવ	68
દુર્ગદેવ	138	પુસે એફ. એલ.(Puse F. L.)	154
દુર્ગસિંહ જુઓ દુર્ગ	18,167,168	પૃથુદક્ષવામી	119
દુર્ગાચાર્ય	6	પ્રતાપ	112
દેવધા	101	પ્રવરસેન	84
દેવલ	124	ફર્ગ્યુસન જેઈમ્સ(Fergusson James)	116
દ્રમિલ	53	બર્નેલ એ. સી.(Bernel A.C.)	6
દ્વિવેદી મણિલાલ નભુભાઈ	163	બાણ	14
ધનંજય	94,110,110	બૃહસ્પતિ	5
ધનિક	110	બેલ્લલકર શ્રીપાદ કૃષ્ણ	54,166
ધન્યન્તરિ	74	બોપદેવ	13,59
ધર્મદાસ (બૌદ્ધ)	179	બ્રહ્મગુપ્ત	119,119
ધર્મોત્તર	13	બ્રહ્મા	6
ધ્રુવ આનન્દશંકર બાપુભાઈ	92,92,96,97	બ્લૂમ્ફીલ્ડ (Bloomfield)	3
ધ્રુવ કે. ડો	29	બુહલર Buhler	72,97
ધ્વનિકાર જુઓ આનન્દવર્ધન	96,96	બોટલિંગ (Botling)	165
નરપતિ	130	ભટ્ટાચારજી વિષ્ણુપાદ	96
નરેન્દ્રાચાર્ય	169	ભટ્ટાચાર્ય વિધુશેખર	150
નાગર મુરારિ લાલે	99	ભટ્ટોજિ દીક્ષિત	47,55
નાગવર્મ(ર્મા)	34	ભટ્ટોત્પલ	182
નાગવર્મ (ર્મા)	80	ભડ્ડલી	138
નાગાર્જુન	142,183		

ભરત	80,82,83,85,94,95,111,176	મુકુલભટ્ટ	80
ભરતમલ્લિક	110	મુનિ પિંગલ જુઓ	80
ભરહ (વસહ)	80	મેઠ	55
ભર્તૃહરિ	20,34,166	મેધાવિરુદ્ધ	176
ભર્તૃહરિ	151,153,184	મોદી મધુસૂદન	37
ભર્તૃહરિ	176	મોરેશ્વર	144
ભાગુરિ	74	યાદવ	74
ભાનુજિ દીક્ષિત	173	યાસ્ક	2,5,71,82
ભામુહ	96,106,176,177	રક્ષાચાર્ય એમ.	119
ભાયાણી હરિવલ્લભ ચુ.	36,157	રક્ષાનાથ	110
ભારવિ	167,168	રભસ	74
ભાષ્યકાર પતંજલિ જુઓ	50	રમાપતિમિશ્ર	123
ભાસ	2	રાઈસ (Rice)	117
ભાસર્વજ્ઞ	28	રાધવન્ વી.	112
ભાસ્કર	181	રાજમૃગાંક	130
ભાસ્કરાચાર્ય	180	રાજર્ષિભટ્ટ	182
ભોજ	20,93,177,178	રાજશેખર	14
ભોજદેવ	178	રાજશેખર	61,94,95
મદ્ધ	74	રાટ	82
મજ્જરાજ	142	રામચંદ્ર (બૌદ્ધ)	80
મંગલ	95	રામચંદ્ર	182
મંગુલિભુ	142	રામચંદ્રાશ્રય	171
મણ્ડવ્ય જુઓ માણ્ડવ્ય	80	રામાશ્રમ	171
મમ્મટ	81,93,95,96,177	રુદ્ર (દેવ)	138
મયૂર	167,168	રુદ્રટ શતાનંદ જુઓ	89,176,177
મયૂરપાદ	143	લલ્લ	128
મલ્લિનાથ	163	લોલિમ્બરાજ	184
મહાદેવ	181	વરદરાજ	119
મહામિશ્ર	166	વરરુચિ	36
મહેશ્વર	68	વરરુચિ	142
મહેશ્વર	122	વરરુચિ	174
માધ	53	વરરુચિ	183
માણ્ડવ્ય મણ્ડવ્ય જુઓ	81,82	વરાહ	128
માણ્ડવ્ય	128	વરાહ	138
માધવ	144	વરાહમિહિર	80,124,128,180
માધવ	184	વસંતરાજ	33
મીમાંસક યુથિષ્ઠિર	6,13	વસંતરાજ	130
મુકુલ	96,177	વસંતરાજ	182

વસિષ્ઠ	82	શાસ્ત્રી હરિશંકર	99
વાગ્ભટ	142	શાસ્ત્રી હરિપ્રસાદ	102
વાગ્ભટ	183	શાહ ઉમાકાંત પ્રેમાનંદ	116
વાચસ્પતિ	66,74	શિવભદ્ર	176
વાચસ્પતિ	148	શિવશર્મા શર્વવર્મા અને સર્વવર્મન્ જુઓ	167
વાત્સ્યાયન	115	શીતા (કવયિત્રી)	104
વામન	8,20,166	શુક યતીન્દ્ર	150
વામન	176,95,103,176,176	શિમિટ આર (Schmit R.)	152
વામન	166	શ્રીધર	119,169,180
વાસુકિ	66	શ્રીધર	169
વિકટનિતમ્બા	176	શ્રીપતિ	125,180
વિદ્યાનાથ	96	શ્રીહર્ષ	86
વિન્તર્નિત્સ (Winrernitz)	150	સમુદ્ર	128
વિરહાંક	87	સરસ્વતી	169
વિશ્વનાથ	95,96,177	સર્વવર્મન્ જુઓ શર્વવર્મા અને શિવવર્મા	167,167
(વિષ્ણુગુપ્ત ચાણક્ય) વૃદ્ધત્રયી જુઓ	183	સાહેકર વી. જી.	143
વેલણકર હરિ દામોદર	54,62,76,80,	સાહેસરા ભો. જ.	28,92,155
	81,84,86,87	સાયણાચાર્ય	6
વોરા પી. આર	99	સિંગ ભૂપાલ	112
વોરા પ્રદ્યુમ્ન	96	સિકદર જે. સી.	144
વૈદ્ય પી. એલ.	39,61,62	સુલ્હણ	78,80
વ્યાડિ	65,66,74	સુશ્રુત	183
વ્યાસ	14	સેયવ	80
શંકર	112	સૈતવ	80,80,85
શંકરાચાર્ય	150,161,165	સોમેશ્વર	155
શતાનન્દ રુદ્રટ જુઓ	176	સ્કન્દ	166
શર્મા પૂર્ણચંદ્ર	143	સ્મિથ જી. એફ. હર્બર્ટ (Smith G. F. Hertbert)	148
શર્મા ભીમસેન	19	હરિ	176
શર્વવર્મા શિવશર્મા અને સર્વવર્મન્ જુઓ	167	હરિભલ	163
શાઈફનર (Schiefner)	150	હરિભટ્ટ	181,182
શાકટાયન	5,13,16	હરિભદ્ર	181
શાકલ્ય	5	હરિશંદ્ર ભટ્ટારક	6
શામશાસ્ત્રી	167	હર્ટલ (Heretl)	152
શાલાતુરીય દાક્ષીપુત્ર અને પાણિનિ જુઓ	20,165	હર્ષટ	78,78,80
શાસ્ત્રી ગિરજાશંકર મયાશંકર	42,48	હલાયુધ ભટ્ટ	79,79
શાસ્ત્રી જગન્નાથ	67	હાવેલ ઈ. બી. (Havell E. B.)	116
શાસ્ત્રી દુર્ગાશંકર કેવળરામ	145	હુગ્ગ	74
		હુએનસંગ (Hien Tsang)	165



પરિશિષ્ટ ૨ : ગ્રંથો અને લેખોની સૂચી

(અ) શ્વેતામ્બર અને યાપનીય

અકબરસાહિત્યકાર દર્પણ	106	અનુસન્ધાન	22
અક્ષયેષ્ટાવિદ્યા	134	અનેકશાસ્ત્ર સારસમુચ્ચય	27
અક્ષરકુરણવિચાર	134	અનેકાંતજય પત્રાકા	13
અંજનાપવનંજયનાટકમ્	111	અનેકાર્થ કૈરવાકરકૌમુદી	1
અજિતશાંતિ છંદોવિવરણ	88	જુઓ કૌરવાકરકૌમુદી	73
અજિયસંતિથય	85,88	અનેકાર્થધ્વનિમંજરી	73
—ટીકા	127	અનેકાર્થનામમાલા (વિનય૦)	
—વૃત્તિ	84	અનેકાર્થનામમાલા (હેમ.) જુઓ અનેકાર્થસંગ્રહ74	
xઅજિયસંતિથય (અજિતશાંતિસ્તવ)		—વૃત્તિ	33
અને એનાં અનુકરણો	84	અનેકાર્થરત્નકોશ	74
અગ્ન્યલમતનિરાકરણ વાસોડન્તિકાદિ-		અનેકાર્થરત્નમંજૂષા	75,76
પ્રકરણ જુઓ	57	અનેકાર્થસંગ્રહ-જુઓઅનેકાર્થનામમાલા	
*અદ્વારહજારી તત્ત્વપ્રકાશિકા અને		(હેમ.)	51,72,73,73
(હેમ) બૃહદ્વૃત્તિ જુઓ	41,42	—અવચૂરિ	74
અણુઓગદાર	123	—ટીકા	72
—ચુલ્લિ	8	અનેકાર્થસાહિત્યસંગ્રહ	153
—ટીકા	7	અનયયોગવ્યવસ્થેદદ્વાત્રિશિકા	19
અનર્ધરાવ		અન્યોક્તિમુક્તામહોદધિ	157
—ટિપ્પણ	126	અન્યોક્તિમુક્તાવલી	157
અનિદ્-કારિકા		અપવર્ગનામમાલા (અજ્ઞાત)	71
—અવચૂરિ વિવરણ જુઓ	173	અપવર્ગનામમાલા (જિનચંદ્રીય)	71
—અવચૂરિ	172	અપવર્ગનામમાલા (જિનભદ્રીય)	71
—અવચૂરિ	172	અપશબ્દખણ્ડન	25
—ટીકા	172	અભયકુમારરચિત	23
—વિવરણ (ક્ષમા૦) અવચૂરિ		અભિધાનચિંતામણિ	5,55,64,
જુઓ	172,172,172		66,67,68,71,72,73,73,148
—વિવરણ (હર્ષ૦)	172	—અવચૂરિ	66
અનિદ્-સ્વરાન્ત-કારિકા	12	—ટીકા (કુશલ૦)	66
—અવચૂરિ (સ્વોપણ)	12	—ટીકા (ભાનુ૦)	66

x આ ચિહ્ન મારો લેખ સૂચવે છે.

* આ ચિહ્ન આ કૃતિ મૌલિક નહિ પણ વિવરણરૂપ છે એમ સૂચવે છે.

—ટીકા (શ્રીવલ્લભઃ)	72	xઅલંકારશાસ્ત્ર સંબંધી જૈન કૃતિઓ	89
—ટીકા (સાધુ૦)	66	—અલંકારસંગ્રહ જુઓ કાવ્યાલંકાર,	
—પ્રતીકાવલી	67	કાવ્યાલંકારસંગ્રહ અને કાવ્યાલંકાર-	
—બીજક	66	સારસંકલના અલંકારસાર જુઓ	102,104
—બીજક	66	અલ્પપરિચિતસૈદ્ધાન્તિક શબ્દકોષ	77
—બીજક	66	અવ્યયૈકાંક્ષરનામમાલા	75
—વિવૃત્તિ (સ્વોપજ્ઞ) તત્વાભિધાયિની જુઓ		અશ્વાદિગુણ	147
18,51,54,63,64,66,67,72,72,148		અષ્ટલક્ષાર્થી અર્થરત્નાવલી જુઓ	76
અભિધાનચિંતામણિકોશ	67,71,75,76	અષ્ટાધ્યાયતૃતીયપ(?પા)દવૃત્તિ	45
અભિધાનરત્નમાલા	67	આઉરપચ્ચક્ષાણ	
અભિધાનરાજેન્દ્ર	76,77	—અવચૂરિ	57
અભિધાનસંગ્રહ	54,64,67,71,73	આગમોનું દિગ્દર્શન	3
અમરકોશ	60	આખ્યાન(ત)વૃત્તિ	169
અમરટીકાસર્વસ્વ	15	આચાર્ય શ્રીમલયગિરિ અને તેમનું શબ્દાનુશાસન	20
*અમોઘવૃત્તિ (યા૦)	14,14,21,35,42	આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરિ સ્મારક	
— ન્યાસ (યા૦)	15,15	ગ્રંથ	149
અયોગવ્યવચ્છેદ્વાત્રિશિકા	19,19	આત્મ(પ્ર)બોધ	160
xઅર્થની આગગાડી	184	આત્માનંદ શતાબ્દિ(બ્દી)	
અર્થરત્નાવલી અષ્ટલક્ષાર્થી જુઓ	75	સ્મારક ગ્રંથ	112
અર્હચ્યૂડામણિસાર	128,129	આદિદેવસ્તવ	109
અર્હપ્રમસ્કારસ્તોત્ર	46	*આનંદબોધિની	13,38,41,43
અલંકારચંદ્રિકા	106	આનન્દલેખ	46
*અલંકારચૂડામણિ 83,92,92,93,94,96,97,178		આયજ્ઞાનતિલક	136
—ટિપ્પણ	92	—ટીકા	136
—વૃત્તિ	97	આયતત્ત્વરાજવલ્લભ	136
xઅલંકારચૂડામણિ, વિવેક અને સંકેત	178	આયપ્રશ્ન	136
અલંકારચૂર્ણિ	106	આયસદ્ભાવ	136
*અલંકારતિલક	103,104	—વૃત્તિ	136
અલંકારદષ્ટપણ	106	આચાર	110,157
અલંકારપ્રબોધ	56,98,102	આયુર્વેદમહોદધિ	144
અલંકારમણ્ડન	32,104,113,172	આરમ્ભસિદ્ધિ વ્યવહારચર્યા જુઓ	57,125,125
અલંકારમહોદધિ	102,103,104,155	આરાધના (યા૦)	15
—વૃત્તિ (સ્વોપજ્ઞ)	102,103	આરાહણા (યા૦)	15,157,151
		આર્યાગાથા	159

૧. 'યા૦'થી 'યાપનીય' સમજવું.

આર્યાસંખ્યાઉદ્દિષ્ટ નષ્ટવર્તન વિચાર	88	*ઉપાધ્યાયનિરપેક્ષા	175
આવશ્યક જુઓ આવશ્યક	14	ઉવએસમાલા	125
-વૃત્તિ જુઓ ચૈત્યવંદનવૃત્તિ		ઉવસંગ્ગહરથોત્ત	
આવશ્યક આવશ્યક જુઓ	176	-ટીકા	127
-ચૂલ્લિશ	7,8	ઉસભપંચાસિયા	63
-ટીકા (હરિં)	7,7	ઉસ્તરલાવ યંત્ર સંબંધી એક મહત્ત્વપૂર્ણ જૈન ગ્રંથ	134,139
-નિજજજુતિ	7	ઉસ્તરલાવયંત્ર	139
-નિજજુતિની ટીકા	123	-ટીકા	139
-વૃત્તિ	20	ઋતુપ્રાશવ્યાકરણપ્રક્રિયા શબ્દાર્ણવ અને	
આશ્ચર્યયોગમાલા		સિદ્ધશબ્દાર્ણવ જુઓ	27
-વિવૃત્તિ (વૃત્તિ) સુખાવબોધા જુઓ	183	ઋષભદેવચરિત્ર	103
-વૃત્તિ (વિવૃત્તિ)	183	ઋષભશતક	157
ઈદુદૂત	46	ઋષિપુત્રની કૃતિ	124
ઈંદ્ર-વ્યાકરણ જુઓ ઐન્દ્ર-વ્યાકરણ અને		એકાક્ષરકોશ	64,75,76
જૈનેન્દ્ર-વ્યાકરણ	6	એકાક્ષરનામકોષસંગ્રહ	75
ઉક્તિરત્નાકર	53,69	એકાક્ષરનામમાલા (અજ્ઞાત)	76
ઉણાદિ (બુદ્ધિ)	18	એકાક્ષરનામમાલા (અમર)	56
ઉણાદિ (હેમં)	18,40	એકાક્ષરનામમાલા (વિશ્વ)	76
ઉણાદિગણસૂત્ર (હેમં) જુઓ ઉણાદિસૂત્ર		એકાક્ષરનામમાલા (સુધાં) એકા-	
અને ઉણાદિસૂત્રપાઠ	36,51	ક્ષરનિષ્ઠુ અને નામમાલા જુઓ	64,75
-ટીકા (સ્વોપજ્ઞ)	36,51	એકાક્ષરનિષ્ઠુ	72,75
ઉણાદિનામમાલા	51	એકાક્ષરનિષ્ઠુ એકાક્ષરનામમાલા	
ઉણાદિસૂત્ર (મલયં)	21	(સુધાં) અને નામમાલા જુઓ	75
ઉણાદિસૂત્ર (હેમં) જુઓ ઉણાદિગણસૂત્ર		એકાદિદશપર્યન્તશબ્દસાધનિકા	27
અને ઉણાદિસૂત્રપાઠ	43,51,54	ઐન્દ્રવ્યાકરણ ઈંદ્ર-વ્યાકરણ અને	
ઉણાદિસૂત્રપાઠ ઉણાદિસૂત્ર અને		જૈનેન્દ્રવ્યાકરણ જુઓ	7,37
ઉણાદિસૂત્ર જુઓ	51	ઔક્તિક (અજ્ઞાત)	31
ઉદયદીપિકા	137	ઔક્તિક (કુલં)	29
ઉપદેશતરંગિણી	44	ઔક્તિક (જિનં)	31
ઉપદેશપ્રાસાદ	160	ઔક્તિક(સોમં)	31
*ઉપદેશમાલાકર્ણિકા	125	ઔષધિનામમાલા	72
ઉપદેશરત્નાકર	50	*કક્ષાપટ્ટ	43
ઉપસર્ગમહુડન	31,32,104	કક્ષાપટ્ટવૃત્તિ જુઓ બૃહદ્વૃત્તિવિષમપદવ્યાખ્યા	43
*ઉપસર્ગવૃત્તિ	74	કથાકોશ શકુનરત્નાવલી જુઓ	133

કથામહોદધિ	156	કલ્પસૂત્ર	114
કથારત્નાકર	157	કલ્પાન્તર્વાચ્ય	57
કન્દર્પચૂડામણિ	115	કલ્યાણમંદિરસ્તોત્ર	
કપ્પ		—ટીકા	69
—ચૂણ્ણિ	123	કવિકલ્પદ્રુમ (હર્ષ)	58
—ટીકા	21	કવિકલ્પદ્રુમ (અજ્ઞાત)	58
—ભાસ	116	—અવચૂરિ	58
—કમલવિજયરાસ	157	કવિકલ્પદ્રુમસ્કંધ	32
કમ્મત્થય		કવિતામદ્યપરિહાર	105
—ટિપ્પણ	125	—વૃત્તિ (સ્વોપજ્ઞ) શું આ જ કવિમદ્ય-	
કરણકુતૂહલ - ટીકા જુઓ ગણક-ક		પરિહાર છે?	105
કુમુદકૌમુદી	180	કવિદમ્પણ	85
કરણશેખર	139	કવિદર્પણ	79,80
કરણશેષ	139	કવિમદ્યપરિહાર શું આ જ કવિતામદ્ય-	
કર્ણાલંકારમંજરી	106	પરિહારવૃત્તિ છે?	105
કર્પૂરપ્રકર સુભાષિતકોષ અને સૂક્તાવલી જુઓ		*કવિશિક્ષા (અમર૦)	56,90,97,98
—અવચૂરિ ટીકા (જિન૦) જુઓ	154,156	કવિશિક્ષા (જય૦)	90,97
—ટીકા (અજ્ઞાત)	156	કવિશિક્ષા (દેવ૦)	90
—ટીકા (જય૦)	156	કવિશિક્ષા (બખ્ખ૦)	89,90,102,89
—ટીકા (જિન૦)અવચૂરિ જુઓ	156	કવિશિક્ષા (વિનય૦)	89,90,102,102,90
—અવચૂરિ (યશો૦)	157	કસ્તૂરીપ્રકર	154,157,158
—અવચૂરિ (હર્ષ૦)	157	—વૃત્તિ (સ્વોપજ્ઞ)	158
—બાલાવબોધ	156	કસ્તૂરીપ્રકરણ (સંવેગ૦)	158
—સ્તબક	156	કસ્તૂરીપ્રકરણ (સોમ૦)	158
કર્મગ્રંથ (દેવેન્દ્ર)—અવચૂરિ	57	કાકરુત	147
કલાકલાપ	56,146	કાકલની કૃતિ દુષ્ટિકાદીપિકા, મધ્યમ-	
કલાપવ્યાકરણ સન્ધિગર્ભિતસ્તવ	169	વૃત્તિ અને લઘુવૃત્તિ જુઓ	41
—અવચૂરિ	169	કાકુત્સ્થકેલિ	102
×કલિકાવસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ એટલે?	35	કાતંત્ર	
*કલ્પપલ્લવશેષ કલ્પલતાવિવેક, પલ્લવશેષ,		—વૃત્તિ (અજ્ઞાત)	169
વિવેક અને શેષ જુઓ	97,99,100,101	—વૃત્તિ (અજ્ઞાત)	169
કલ્પલતા	97,97	—વૃત્તિ (અજ્ઞાત)	169
*કલ્પલતાવિવેક કલ્પપલ્લવશેષ, પલ્લવશેષ,		કાતંત્રદીપકવૃત્તિ	168
વિવેક અને શેષ જુઓ	97	કાતંત્રભૂષણ	168

કાતંત્રવિસ્તર	168	કાવ્યશિક્ષા	102
કાતંત્રવિસ્તાર	168,168	કાવ્યાદર્શ	
કાતંત્રોત્તર વિજયાનંદ, વિદ્યાનંદ અને સિદ્ધાનંદ જુઓ		-ટીકા	176
	23	-કાવ્યાનુશાસન (વાગ્૦)	92,103,103
કાદમ્બરી (ઉત્તરાર્ધ)		-ટીકા (સ્વોપજ) અલંકારતિલક	
-ટીકા (વૃત્તિ) (ઉત્તરાર્ધ)	68	જુઓ	103,104,87
-વૃત્તિ (ટીકા)	33	કાવ્યાનુશાસન (હૈમ૦)	19,83,92,94,95,97
કાદમ્બરી (પૂર્વાર્ધ)			111,111
-ટીકા	68	-વૃત્તિ (સ્વોપજ) જુઓ અલંકારચૂડામણિ	96
કાદમ્બરી-ઉદ્ધાર, સંક્ષિપ્તકાદમ્બરી કથાનક		*કાવ્યામ્નાય (અમર૦)	106
જુઓ	32	કાવ્યામ્નાય (અમર૦)	106,179
કાદમ્બરીમણ્ડન	32	કાવ્યાલંકાર (ભાવ૦) અલંકારસંગ્રહ,	
કામપ્રદીપ	115	અલંકારસાર, કાવ્યાલંકારસંગ્રહ અને	
કાયથિંઇથોત્ત	29	કાવ્યાલંકારસારસંકલના જુઓ	102,104
-અવચૂરિ	29	કાવ્યાલંકારસંગ્રહ	104
કાલકકથા	104	કાવ્યાલંકારસારસંકલના	104
કાલકકહા	104	કાવ્યાલંકાર (રુદ્રટ)	
કાલજ્ઞાન	123,124	-ટીકા (વૃત્તિ)	89,176,176
કાલાપકવિશેષવ્યાખ્યાન	169	-વૃત્તિ (ટીકા૦)	176
કાવ્યકલ્પલતા (અમર૦)	56,57,98	કીર્તિકલ્લોલિની	157
-વૃત્તિ (યશો૦)	98	કુછ જૈન ગ્રંથો મેં સંગીતચર્ચા	112
-વૃત્તિ (સ્વોપજ) કવિશિક્ષા	98	કુંથુનાથચરિત	18
જુઓ	87,98	કુમારપાલચરિત્ર	28
*કાવ્યકલ્પતાપરિમલ	98,56	કુમારવાલપડિબોહ	153,154
*કાવ્યકલ્પલતામંજરી	98,56	કુમારવિહારશતક	109
કાવ્યપ્રકાશ	100	કુમુદેન્દુશતક	101
-ટીકા (ભાનુ૦)	178	કુલક	138
-ટીકા (યશો૦)	178	*કેરવાકરકૌમુદી જુઓ અને કાર્યકેરવાકરકૌમુદી	73
-ટીકા (હર્ષ૦)	178	કોકપ્રકાશસાર	115
-વૃત્તિ	178	કોકશાસ્ત્રયોપાઈ	115
કાવ્યપ્રકાશખણ્ડન	178	કૌમારસારસમુચ્ચય	168
કાવ્યમણ્ડન	32	કૌમુદીમિત્રાનંદ	108
કાવ્યમનોહર	32	*ક્રિયાકલ્પલતા	69
કાવ્યલક્ષણ	106	*ક્રિયાચંદ્રિકા	170

કિયારત્નસમુચ્ચય	57,58	ગ્રન્થત્રયી	59
ખરતરગચ્છપદ્માવલી	160	ગ્રહલાઘવ	
ખેતસમાસ		-ટિપ્પણ	181
-અવચૂરિ	57	ચઉસરણ	
ગજપરીક્ષા હસ્તિપરીક્ષા જુઓ	128,128	- અવચૂરિ	58
ગજપ્રબંધ	128,146	ચાતુર્માસકુલક	138
"ગણકકુમુદકૌમુદી	181,182	ચતુર્વિંશતિકા	89
ગણદર્પણ	28	ચતુર્વિંશતિજિનસ્તુતિ જિનસ્તવન-	
ગણપાઠ (બુદ્ધિ○)	18	ચતુર્વિંશતિકા જુઓ	157
ગણપાઠ (શા○) (યા○)	14	ચતુર્વિંશતિજિનસ્તોત્ર	126
ગણપાઠ (હૈમ○)	39,42	ચતુર્વિંશતિજિનેન્દ્ર સંક્ષિપ્તચરિત	
-સ્પષ્ટીકરણ (સ્વોપણ)	42	ચતુર્વિંશતિપ્રબંધ 18,109,123,146,155,168	
ગણરત્ન મહોદધિ	9,19	ચતુષ્કવિત્ત	169
-અવચૂરિ	19	ચંદ્રપ્રભકાવ્ય	104
-વૃત્તિ (સ્વોપણ)	19	ચંદ્રપ્રભવિજય	77
ગણહરસદ્વસયગ	18,67	"ચંદ્રપ્રભા જુઓ બૃહત્પ્રક્રિયા અને હૈમ-	
ગણિતતિલક		કૌમુદી 47,130,134,137,137	
-વૃત્તિ	125,180	ચંદ્રવિજય	32,105
ગણિતસાર	179	ચંદ્રાર્કી	
-વૃત્તિ	180	-વૃત્તિ	182
ગણિતસારકૌમુદી	118	ચંદ્રાર્કીપદ્ધતિ	182
ગણિયસારકૌમુદી	118	-ટીકા	181
ગાથારત્નકોશ	88	ચંદ્રાલોકટીકા	106
ગાથારત્નાકર	88	ચંદ્રોન્મીલન	129,134,135
ગાહાલક્ષ્મણ	85	-ટીકા	134
-વૃત્તિ	87	ચમત્કારચિંતામણિ	
જુઓ નન્દિતાદ્યવૃત્તિ		-ટબ્બો	182
ગુ (ગુ)જરાતનું પ્રધાન વ્યાકરણ	18,38	-બાલવબોધ	182
ગુણરત્નાવૃત્તિ	39	ચમ્પૂમણ્ડન	32
ગુણસાગરચરિત્ર	172	ચચરકાદિના વિચારકોને	183
ગુર્વાવલી	23	ચિકિતો(ત્સો)ત્સવ	144
ગૌતમીકાવ્ય		ચિંતામણિ (યા○) લઘુવૃત્તિ જુઓ	26,26
-વિવરણ	160	-ટિપ્પણ	16
ગ્રહભાવ પ્રકાશ	124	-ટીકા	16,26,26
જુઓ ભુવન દીપક (પદ્મ○)		ચૂડામણિ	130,134,134

ચૈત્યવંદનવૃત્તિ આવશ્યકવૃત્તિ જુઓ	176	xછ બોલની વિહરમાણ જિનવીસીનું	
છંદકોસ	88	વિહંગાવલોકન	59
-ટીકા	88	છહજારી લઘુવૃત્તિ (હૈમં) જુઓ	39,41
છંદ(દો)રૂપક	88	છાસીઈ	
છંદચ્યુદામણિ જુઓ છંદોડનુશાસન (હૈમં)		-ટિપ્પણ	125
	80,83,85	જઈદિણચરિયા યતિદિનચર્યા જુઓ	104
-ટીકા (વૃત્તિ) (યશોં)	86	જગન્મોહન	138
-ટીકા (વર્ષં)	86	જન્મકુણ્ડલી	181
-વૃત્તિ (ટીકા) (યશોં)	86	જન્મપત્રીપદ્ધતિ (અજ્ઞાત)	127
છંદ:શાસ્ત્ર (જયં) જયદેવચ્છંદસ્ જુઓ	176	જન્મપત્રીપદ્ધતિ (મહિમોં)	127
છંદ:શાસ્ત્ર (બુદ્ધિં)	83	જન્મપત્રીપદ્ધતિ (લબ્ધિં)	127
છંદશાસ્ત્ર (રામં)	88	જન્મપત્રીપદ્ધતિ (હર્ષં)	127
xછંદ:શાસ્ત્રી જપકીર્તિ તે કોણ ?	81	જન્મસમુદ્ર	126
છંદ:શેખર (જયં)	83	જન્મામ્બોધિ	126
છંદ:શેખર (રાજં)	83	જમ્બૂદ્વીપપ્રજ્ઞપ્તિ	138
છંદ:શેખર (રાજં?)		xજપકીર્તિનું છંદોડનુશાસન	78
છંદસ્તત્ત્વ	88	જયદામન્ (ધે.+અજૈન)	78,79
-ટીકા (સ્વોપજ)	88	xજયદેવકૃત જયદેવચ્છંદસ્	78
છંદ:સુંદર		જયદેવચ્છંદસ્ છંદ:શાસ્ત્ર જુઓ	78,79,80
-ટીકા (સ્વોપજ)	88	-ટિપ્પણ	81
છંદોધ્વાત્રિશિકા	88	-ટીકા (વિવૃત્તિ) હર્ષટ)	78,78,80
છંદોડનુશાસન (વાગ્ં)	87	-વૃત્તિ	81
-વૃત્તિ (સ્વોપજ)	87	જયમંગલા	175
છંદોડનુશાસન (હૈમં)	78,79,80,82,	xજર્મન અને ઇટાલિયન અનુવાદોથી	
	83,85,86,87,94,94	અલંકૃત જૈનકૃતિઓ	154
-પર્યાય	83	જાતક(કર્મ) પદ્ધતિ	
-વૃત્તિ(યશોં)	86,56	-ટીકા	180,181
-વૃત્તિ (સ્વોપજ)	83,86	-બાલાવબોધ	180
છંદોરત્નાવલી	87,98	જિજ્ઞસત્તરિ	71
છંદોડલંકાર	88	જિનરત્નકોશ	12,15,18,
-ટિપ્પન	88	22,23,25,27,31,33,40,41,43,44,47,	
છંદોવિચિતિ રત્નમંજૂષા જુઓ	88	48,50,53,55,57,57,59,62,62,67,68,	
		71,72,75,76,77,84,88,98,102,105,	

૧. આમાં શ્લોકોના ગ્રંથો વધુ પ્રમાણમાં હોવાથી એની મેં અહીં નોંધ લીધી છે.

106,112,115,117,119,121,124,126, 130,138,142,143,147,147,148,150, 150,154,158,161,167,169,169,170, 175,179,181,182,74,141,142,159	જૈનાગમ ઔર સ્થાપત્ય	116
જિનસહસ્રનામસ્તોત્ર	46	
જિનસ્તવન ચતુર્વિંશતિકા		
ચતુર્વિંશતિજિનસ્તુતિ જુઓ	157	
જિનસ્તુતિ	157	
જિનસ્તોત્ર	109	
જીવવિયાર		
—વિવરણ	160	
જેસલમેર ભાણગારીયગ્રંથસૂચી	97	
જૈનકુમારસંભવ	83	
જૈન ગૂર્જક કવિઓ	143	
જૈન ગ્રંથાવલી	22,22,26,31,33, 40,42,43,43,45,48,48,53,54,55,66, 67,69,71,72,74,77,77,85,86,106,106, 113,134,136,143,147,148,156,168	
જૈન ચિત્ર કલ્પદ્રુમ	56,148	
જૈન દર્શનનું તુલનાત્મક દિગ્દર્શન	164	
જૈનપુસ્તક પ્રશસ્તિસંગ્રહ	23	
જૈનલક્ષણાવલી	77	
જૈનસત્રપદાર્થો	181	
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથો	122,128,130,131	
જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ	77	
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ	20,29,30, 31,63,63,68,69,102,115,124,126, 128,131,143,155,159,160,167,176	
જૈનસિદ્ધાંતકૌમુદી	27,27	
જૈનસૂક્તસંદોહ	161	
જૈનસ્તોત્રસંગ્રહ	28	
જૈનસ્તોત્રસંદોહ	273	
જૈનસ્તોત્રસમુચ્ચય	29,30,157	
જૈનચાર્યો કા છન્દ:શાસ્ત્ર કો અદાન	88	
જૈનચાર્યો કા અલંકારશાસ્ત્રમેં યોગદાન	107	
જૈનેતર ગ્રંથોં પર જૈન વિદ્વાનોં કી ટીકાચેં	168	
જૈનેતર સાહિત્ય અને જૈનો	171	
જૈનેન્દ્ર (પંચાધ્યાયી) વ્યાકરણ		
—કારિકા	12	
—કારિકાની અવચૂરિ (સ્વોપજ્ઞ)	12	
જૈનેન્દ્ર વ્યાકરણ ઇંદ્ર વ્યાકરણ અને		
એન્દ્ર વ્યાકરણ જુઓ	12	
જોઈસકરણ		
—ટીકા	123	
જ્યોતિષરત્નાકર	182	
જ્યોતિ:સાર (કેરુ)	120,126,127	
—વૃત્તિ (સ્વોપજ્ઞ)	126	
જ્યોતિ:સાર (નારો) નારચંદ્ર		
જ્યોતિ:સાર જુઓ	126	
—ટિપ્પણ	126	
જ્યોતિ:સાર (હર્ષો) જ્યૌતિષસાર-		
સંગ્રહ અને જ્યૌતિષસારોદ્ધાર		
જુઓ	126,127,69	
જ્યૌતિષસારસંગ્રહ જ્યોતિ:સાર		
જુઓ	127	
જ્યૌતિષસારોદ્ધાર	127	
ઠક્કર કેરુચિત ગણિતસારકૌમુદી		
એક અદિતીય ગ્રંથ	118	
ઠક્કર કેરુચિત મુદ્રાશાસ્ત્રનો અદિતીય		
જૈનગ્રંથ	116	
ઠાણ	2,127	
*દુષ્ટિકા તત્ત્વપ્રકાશિકા, પ્રકાશિકા		
અને બલાબલવૃત્તિ જુઓ	41	
*દુષ્ટિકા દીપિકા જુઓ	170	
*દુષ્ટિકાદીપિકા મધ્યમવૃત્તિ અને		
લઘુવૃત્તિ જુઓ	41	
*તત્ત્વપ્રકાશિકા (ગુણો)	49,48	
*તત્ત્વપ્રકાશિકા (હેમો) જુઓ અઢારહજારી,		

દુંદિકા, પ્રકાશિકા, બાલબલવૃત્તિ		ત્રૈલોક્યદીપક (હેમં) જુઓ નવ્યતાજિક,	126
અને (હેમં) બૃહદ્વૃત્તિ	41,49	ભુવનદીપક અને મેઘમાલા	
-પ્રકાશ ન્યાસ (હેમં),	41,44	ત્રૈલોક્યપ્રકાશ	126
બૃહન્ન્યાસ (હેમં), મહાર્ણવ		ત્રૈવિદ્યગોષ્ઠી	23,78,105
અને શબ્દમહાર્ણવ જુઓ	41,44	*થયપરિણા (સ્તવપરિણા) અને	
*તત્વાભિધાયિની	64,66	એની યશોવ્યાખ્યા	59
તત્વાર્થસૂત્ર	8,124,177	*દર્શનજયોતિવૃત્તિ પ્રશ્નવ્યાકરણ	
-ભાષ્ય	121	જયોતિવૃત્તિ જુઓ	134
*તત્વાર્થાધિગમશાસ્ત્ર		દવ્યપરિક્ષા દ્રવ્યપરીક્ષા	
-દીકા	7	જુઓ	117,118,120,127
*તત્વાવગમા	157	દશપર્વકથા	160
તંત્રવિભ્રમ		દસવેયાલિય	85
-વૃત્તિ	49	*દાનદીપિકા	26
તરંગવર્ણ	123	દાનષટ્ત્રિંશિકા	49
*તર્કરહસ્યદીપિકા	57,168	×દિક્ષપટ ચૌરાસી બોલ પ્રત્યુક્તિ	
તર્કસંગ્રહ		(૮૪ બોલવિચાર) : રેખાદર્શન	59
-વિવરણ	160	દિક્ષિવાય	3,7
તાજિકસાર		દિનશુદ્ધિ	126
-દીકા	180,181	*દીપિકા (અજ્ઞાત)	45
તારા(ય)ગણ	89	*દીપિકા (જયાં)	45
×તાર્કિક હરિયાળી સ્વોપજ્ઞ વિવેચન		*દીપિકા (જિનં)	45
સહિત	59	*દીપિકા (દક્ષં)	35
તિશ્વન્યયોક્તિ	59	*દીપિકા (ધનં)	181
તિશ્વતાન્વયોક્તિ	59	*દીપિકા (મેઘં) જુઓ દુષ્ટિકા	170
તિથિકુલક	138	*દીપિકા (હર્ષં)	31
તિલક	120	*દુર્ગપદપ્રબોધ	54,55
તિલકમંજરી	63,85,94,120,176	*દુર્ગપદપ્રબોધ	66
તિલકમંજરી કથાસાર	120	દુર્ગપદપ્રબોધવૃત્તિ વૃત્તિવિવરણપંજિકા	
તુરંગપ્રબંધ	128,146	દુર્ગપદપ્રબોધ જુઓ	168
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર	35,66,152	×દેવીશતક અને શ્રીહેમચંદ્રસૂરિ	95
	160,161	દેશ્ય શબ્દોનો કોશ	123
ત્રિષષ્ટિસાર	156	દેસિસદસંગહ જુઓ રચણાવલી	64
ત્રૈલોક્યદીપક (અજ્ઞાત?)	138	દેવમ્ (યાં?)	15
		*દોષકવૃત્તિ	45

*દૌર્ગસિંહીદીપિકા	169	*ધાતુરતંગિણી	69,172
*દૌર્ગસિંહીવૃત્તિ	168	ધાતુપરીક્ષા	148
દ્રવ્યપરીક્ષા (લેખ)	117	ધાતુપારાયણ (હેમં)	36,52,58
દ્રવ્યપરીક્ષા જુઓ	117,127	-ટિપ્પણ	52
દ્રવ્યપરિક્ષા		-વૃત્તિ (સ્વોપજ્ઞ)	52,53
દ્રવ્યાલંકાર	108,109	ધાતુમંજરી	32
-ટીકા (સ્વોપજ્ઞ)	108,109	ધાતુરત્નાકર (લાવં)	53
દ્રવ્યાવલીનિર્ધંટુ	143,143,	ધાતુરત્નાકર (સાધું)	53,53,69
દ્વયક્ષરનામમાલા	70	નટયરણ અને નૃત્ત(ત્ય)ગતિ	86
દ્વયાશ્રય	20,39,41	નંદિતાદ્યવૃત્તિ ગાહ્યાલક્ષણવૃત્તિ જુઓ	87
દ્વાત્રિંશિકા (સિદ્ધં)	49	નંદી	13
દ્વાત્રિંશિકા (સિદ્ધં) (પ્રથમ)	85	-ટીકા	13
ધનદ્વિત્રિશતી	151,184	નમસ્કાર પ્રથમ પદાર્થ	75
ધનપાલીય કોશ	62,63	'નમોઽસ્તુ વર્ધમાનાય' સ્તુતિ	85
ધનુર્વિદ્યા	148	નયકર્ણિકા	46
-વૃત્તિ	183	નરનારાયણાનંદ	98,155
ધનુર્વેદ	147	નરપતિજયચર્યા સ્વરોદય જુઓ	131,138
ધમ્મોવએસમાલા		નલવિલાસ	110,108
-વિવરણ (જયં)	82	નવકારમેત -ટીકા	127
-વિવરણ (નમિં)	176	નવતત્ત -અવચૂરિ	58
ધર્મકલ્પદ્રુમ	160	×નવનિધાન નવ સ્તવનો	59
ધર્મદીપિકા	48	નવ્યતાજિક જુઓ ત્રૈલોક્યદીપક, ત્રૈલોક્ય-	
ધર્મવિધિ		પ્રકાશ, ભુવનદીપક અને મેઘમાલા	126
-વૃત્તિ	102	'નાગોરી તપા'ગચ્છની પટ્ટાવલી	124
ધર્માભ્યુદય	125,126	નાટ્યદર્પણ	44,108,109,110
ધાતુચિંતામણિ	58	-વિવૃત્તિ	108,109,110,111
ધાતુપાઠ (અજ્ઞાત)	53	નાટ્યવિધિપ્રાભૃત	108
ધાતુપાઠ (પુણ્યં)	53	નાડયવિહિપાહુડ	108
ધાતુપાઠ (બુદ્ધિં)	18	નાડીચક્ર	141
ધાતુપાઠ (મલયં)	21	નાડીનિર્ણય નાડીવિચાર જુઓ	141
ધાતુપાઠ (રત્નં)	14	નાડીપરીક્ષા (અજ્ઞાત)	140
ધાતુપાઠ (શાં) (યાં)	14,16	નાડીવિચાર (અજ્ઞાત)	141
ધાતુપાઠ (હર્ષં)	69,172	નાડીવિચાર (અજ્ઞાત) નાડીનિર્ણય	
ધાતુપાઠ (હેમં)	40,47	જુઓ	141

નાડીસંચારજ્ઞાન	141	નીતિશતક	150
નાનાર્થકોશ	75	નીતિશાસ્ત્ર (તિલક)	150,155
નાનાર્થસંગ્રહ	74	નીતિશાસ્ત્ર (ધર્મ)	151
નામકોશ	27	નૂતન વ્યાકરણ	28
નામમાલા (અજ્ઞાત)	176	નેમિચરિત્ર	156
નામમાલા (જિન)	અપવર્ગનામમાલા	નેમિનાથચરિત્ર	91,104
અને પંચવર્ગપરિહારનામમાલા જુઓ	71	નેમિસ્તવ	109
નામમાલા (ધન)	63	-ટિપ્પણ	126
નામમાલા (ભાનુ)	68,69	ન્યાયકંદલી	
નામમાલા (મહી)	72	-ટીકા	45
નામમાલા (સુધા) એકાક્ષરનામ-		-પંજિકા	126
માલા અને એકાક્ષરનિધણ્ટુ જુઓ	75,75	*ન્યાયતાત્પર્યદીપિકા	28
નામમાલા (હેમ) એકાક્ષરનિધણ્ટુ		ન્યાયબિંદુટીકા	
જુઓ	75	-ટિપ્પણ	13
નામમાલા (હેમ) અભિધાન-		ન્યાયરત્નાવલી	171
ચિંતામણિ જુઓ	64,66	ન્યાયસંગ્રહ	19,57
નામમાલાસંગ્રહ જુઓ નામસંગ્રહ, ભાનુચંદ્ર-		ન્યાયસંગ્રહસૂત્ર	57
નામમાલા અને વિવિક્તનામસંગ્રહ	68,68	xન્યાયચાર્યને અંગેની કેટલીક	
નામમાલિકા (સુધા)	75	કિંવદંતીઓ	59
નામસંગ્રહ જુઓ નામમાલાસંગ્રહ, ભાનુચંદ્ર-		xન્યાયાર્થમંજૂષા હેમવ્યાકરણ-	
નામમાલા અને વિવિક્તનામસંગ્રહ	68	ન્યાયસંગ્રહ જુઓ	42,57,57
નાયાધમ્મકલા	157	-ન્યાસ (સ્વોપજ)	
નારચંદ્રજ્યોતિઃસાર જુઓ જ્યોતિઃસાર	126		57,57
નિધણ્ટુ (બુદ્ધિ)	64	ન્યાયાવતાર	18
નિધણ્ટુ (વર્ધ)	64	ન્યાસ (વિનય) હેમપ્રકાશ અને	
નિધણ્ટુ (હેમ)	72,72	હેમપ્રક્રિયાબૃહન્ન્યાસ જુઓ	47
નિધણ્ટુશેષ	64,64,71,72	ન્યાસ (હેમ) તત્ત્વપ્રકાશિકાપ્રકાશ,	
-ટીકા	72	બૃહન્ન્યાસ, મહાર્ણવ અને શબ્દમહાર્ણવ	
નિદાન	141	જુઓ	36,41,44
નિબંધસંગ્રહ	59	ન્યાસસારસમુદ્ધાર, બૃહન્ન્યાસ દુર્ગ-	
નિર્ભયભીમ	108	પદવ્યાખ્યા, ન્યાસોદ્ધાર અને	
નિર્વાણકલિકા	123	લઘુન્યાસ જુઓ	41,44
નીતિગ્રંથ	151	ન્યાસસારોદ્ધાર	
નીતિધનદ	31,150,151	-ટિપ્પણ	44

ન્યાસોદ્ધાર ન્યાસસારસમુદ્ધાર,		સુંદરપ્રકાશ જુઓ	67
બૃહન્યાસદુર્ગપદવ્યાખ્યા અને		પદ્મકોશ (જ્યોતિષ)	77
લઘુન્યાસ જુઓ	44	પદ્મકોશ (નામમાલા)	77
પઉમચરિય	149	પદ્માનંદમહાકાવ્ય	56,75,102,155
xપક્ષીઓના પરિચયની પ્રવેશિકા	133	પદ્માનંદશતક	184
પચ્ચક્ષ્માણસરૂપ પ્રત્યાખ્યાનસ્વરૂપ		સચરણસંદોહ	29
જુઓ	49	પરસમયસારવિચારસંગ્રહ	160
પજ્જોસવણાકપ્પ	7,26,46,	પરિભાષાવૃત્તિ	43
--અવચૂર્ણિ	29	*પર્યાય (અજ્ઞાત)	74
પગ્ગ્યગ્રંથી બુદ્ધિસાગર જુઓ	17	*પર્યાય (અજ્ઞાત)	83
પંચજિનહારબન્ધસ્તવ	29	*પલ્લવ	97
પંચવર્ગપરિહારનામમાલા (અજ્ઞાત)	70	*પલ્લવશેષ જુઓ કલ્પપલ્લવશેષ, કલ્પ-	
પંચવર્ગપરિહારનામમાલા (જિન૦)		લતાવિવેક, વિવેક અને શેષ	100
અપવર્ગનામમાલા અને નામમાલા જુઓ	71	પાઈય(પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય	2,63,
પંચવર્ગસંગ્રહનામમાલા	70	64,84,87,85,117,122,123,124,125,	
પંચાંગતત્ત્વ	139	130,134,153	
--વૃત્તિ	139	પાઈયલક્ષ્મીનામમાલા	63,63,77
પંચાંગતિથિવિવરણ	139	પાઈયસદ્મહાજ્ઞાવ	77
પંચાંગદીપિકા	139	પણ્ડવચરિત્ર	126
પંચાસગ		પારસીક-નામમાલા શબ્દવિલાસ જુઓ	77
--વૃત્તિ	18	પારસી(ક)ભાષાનુશાસન	33
પડિક્કમણસુત		પાર્શ્વનાથચરિત્ર	157
--અવચૂર્ણિ	29	પાર્શ્વનાથચરિત્ર (ભાવ૦)	104
પણ્ણવણા	71	પાર્શ્વનાથચરિત્ર (વિનય૦)	102
--તઈયપયસંગ્રહણીની અવચૂર્ણિ	29	પાર્શ્વસ્તુતિ	69
--સંગ્રહણી	29	પાશકકેવલી	134
પણ્ણવાગરણ પ્રશ્નવ્યાકરણ જુઓ	134,134	પિંગલશિરોમણિ	88
પત્તનસ્થપ્રાચ્યજૈનભાંડાગારીગ્રંથસૂચી	87,102	પિંગલસારોદ્ધાર	88
129,132,134,141,147,155,179		પુરુષકાર	15
પદપ્રકાશ	179	પુરુષસ્ત્રીલક્ષણ	128
પદવ્યવસ્થા	166	પૃથ્વીચંદ્રચરિત્ર	172
--ટીકા	166	પોરાગમ	145
પદવ્યવસ્થાસૂત્રકારિકા સટીકા	166	પ્રકરણરત્નાકર	153
પદાર્થચિંતામણિ શબ્દાર્ણવ અને		પ્રકાશિકા (હેમ૦) લઘુવૃત્તિ જુઓ	39

પ્રકાશિકા (હેમં) અઢારહજારી, ઢુણિકા, તત્ત્વ-	પ્રશ્નોત્તરસાર્થશતક	160
પ્રકાશિકા બલાબલવૃત્તિ અને બૃહદ્વૃત્તિ જુઓ	પ્રસાદહાત્રિશિકા	109
"પ્રકાન્તાલંકારવૃત્તિ	"પ્રાકૃતદીપિકા જુઓ પ્રાકૃતપ્રબોધ અને	
પ્રક્રિયાવૃત્તિ	પ્રાકૃતવૃત્તિઢુણિકા	45,126
"પ્રજ્ઞાપના	પ્રાકૃતપદાવયૂરિ	45
પ્રજ્ઞાપનાસૂત્ર	"પ્રાકૃતપ્રબોધ જુઓ પ્રાકૃતદીપિકા અને	
પ્રતાપકલ્પદ્રુમ	પ્રાકૃતવૃત્તિઢુણિકા પ્રાકૃતરૂપસિદ્ધિ	45
પ્રતિમાશતક	પ્રાકૃતવૃત્તિ	22
-વૃત્તિ (સ્વોપજ)	"પ્રાકૃતિવૃત્તિઢુણિકા (નરં) પ્રાકૃતદીપિકા	
પ્રત્યાખ્યાનસ્વરૂપ જુઓ પચ્ચક્ષાણસરૂવ	અને પ્રાકૃતપ્રબોધ જુઓ	45
પ્રબંધચિંતામણિ	"પ્રાકૃતવૃત્તિઢુણિકા (હદયં) વ્યુત્પત્તિ-	
પ્રબંધાવલી	દીપિકા અને હેમચર્તુથપાદવૃત્તિ જુઓ	45
પ્રભાવકચરિત	"પ્રાકૃતવૃત્તિદીપિકા હેમદીપિકા જુઓ	45
51,55,71,90,109,123,123	પ્રાકૃત વ્યાકરણ (હેમ)	47
પ્રમાણવાદાર્થ	પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ	30
પ્રમાલક્ષ્મ	પ્રાચીન જૈન લેખસંગ્રહ	56
-વૃત્તિ	પ્રાણાવાય	142
પ્રયોગમુખવ્યાકરણ	પ્રિયંકરનૃપકથા	115
પ્રશસ્તિલેખો	પ્રીતિષટ્ત્રિંશિકા	27
પ્રશ્નપ્રકાશ	પ્રેમલાભ	20,22
પ્રશ્નવ્યાકરણ પણ્ડાવાગરણ	ફલવર્ષિપાર્શ્વનાથ મહાત્મ્ય	27
જુઓ	ફલાફલવિષયક પ્રશ્નપત્ર	136
પ્રશ્નવ્યાકરણજયોતિર્વૃત્તિ દર્શન-	×બનાવટી સંસ્કૃત	3
જયોતિર્વૃત્તિ જુઓ	બંધહેતૂદયત્રિભંગી	31
પ્રશ્નશતક	બલાબલવૃત્તિ (અજ્ઞાત)	43
-અવયૂર્ણિ (સ્વોપજ)	બલાબલવૃત્તિ (હેમ) અઢારહજારી,	
પ્રશ્નચુંદરી	ઢુણિકા, તત્ત્વપ્રકાશિકા, પ્રકાશિકા અને	
પ્રશ્નોત્તરરત્નમાલા (ઉત્તમર્ષિ)	બૃહદ્વૃત્તિ જુઓ	41
પ્રશ્નોત્તરરત્નમાલા (વિમલં)	બાલબોધ (અજ્ઞાત)	138
રત્નમાલિકા જુઓ	"બાલબોધ (મેરું) બાલાવબોધવૃત્તિ	
-ટીકા (અજ્ઞાત)	જુઓ	22
-ટીકા (દેવેન્દ્ર)	બાલબોધ (મેરું)	22
-વૃત્તિ (મુનિભદ્ર)	-આખ્યાતવૃત્તિઢુણિકા	22
-વૃત્તિ (હેમપ્રભ)	-કૃદ્વૃત્તિટિપ્પન	22

—ચતુષ્ક(વૃત્તિ)ટિપ્પન	22	—સારોદ્ધાર	43
—વૃત્તિ (બૃહદ્)	22	બૃહદ્-હેમપ્રભા	48
—વૃત્તિ (લઘુ)	22	બૃહન્ન્યાસ (હેમ) તત્ત્વપ્રકાશિકાપ્રકાશ,	
બાલબોધપદ્ધતિ	67	ન્યાસ, મહાર્ણવ અને શબ્દમહાર્ણવ	
બાલભારત	56	જુઓ	13,41,42,44,44,47,94,41
બાલશિક્ષા (પ્રાચીન ગુજરાતી સંસ્કૃત		—દુર્ગ પદ્ધત્યાખ્યા ન્યાસસારસમુદ્ધાર,	
વ્યાકરણ)	29,169	ન્યાસોદ્ધાર અને લઘુન્યાસ જુઓ	41,45
બાલશિક્ષા (ભક્તિ○)	29	*બેડા	126
બાલશિક્ષા (સંગ્રામ○)	29,31,169	બે મહત્ત્વના ગ્રંથોની શોધ	176
બાલવબોધવૃત્તિ બાલબોધ જુઓ	29,30,168	*બોધદીપિકા	85
*બાલાવબોધિની	182	*બોધદીપિકા	85
બીજકૌસ્તુભ શકુનાવલી જુઓ	133	ભક્તામર-કલ્યાણ મંદિર-નમિગિણ-	
બીજનિધંતુ	72	સ્તોત્રત્રય	33
બુદ્ધિસાગર (નીતિ)	17,148,163	ભક્તામરસ્તોત્ર	163,33
બુદ્ધિસાગર (વ્યાકરણ) પંચગ્રંથી		—ટીકા (સિદ્ધિ○) વૃત્તિ જુઓ	158
જુઓ	17,18,22,22,35,64,83	—ટીકા (હર્ષ○)	127
બૃહચ્છાન્તિસ્તોત્ર		—વૃત્તિ (સિદ્ધિ○)ટીકા જુઓ	32,133
—ટીકા	68	ભગવતી	138
બૃહદ્-ટિપ્પનિકા	43,44,169,141	—વૃત્તિ	138
બૃહત્પર્વમાલા	180	ભગવદ્વાગ્વાદિની	12
બૃહત્પ્રક્રિયા ચંદ્રપ્રભા અને		ભત્તપરિણા	
હેમકોમુદી જુઓ	47	—અવચૂરિ	58
બૃહદ્વૃત્તિ (હેમ) અદ્વારહજારી,		ભદ્રબાહુસંહિતા	138
દુષ્ટિકા, તત્ત્વપ્રકાશિકા, પ્રકાશિકા		ભદ્રચર	19
અને બલાબલવૃત્તિ જુઓ	34,38,39,41,41	ભાનુચંદ્રગણિચરિત	32,68,158,178
44,57,36		ભાનુચંદ્રનામમાલા નામમાલાસંગ્રહ, નામસંગ્રહ	
—અવચૂરિકા સિદ્ધહેમચંદ્ર-બૃહદ્વચૂરિ		અને વિવિક્તનામસંગ્રહ, જુઓ	68
જુઓ	43,51	ભાવનાસાર	150
—ટિપ્પણ	43	ભાવબોધિકા	125
—દુષ્ટિકા	43	ભાવસમ્પત્તિકા	181
—દીપિકા	43	ભાષ્યવિવરણ	171
—પ્રક્રિયા હેમબૃહત્પ્રક્રિયા જુઓ	57	ભિક્ષુ આગમકોશ	77
—વિષમપદ્ધત્યાખ્યા કક્ષાપટવૃત્તિ અને		ભુવનદીપક	
કક્ષાપટ્ટ જુઓ	43	—બાલાવબોધ	182

ભુવનદીપક (પદ્ય) ગ્રહભાવપ્રકાશ		—ટિપ્પણ	181
જુઓ	124,182	—ટીકા	181
—અવયૂરિ	125	—વિવૃત્તિ	181
—ટીકા	125	“મહાર્ણવ તત્ત્વપ્રકાશિકાપ્રકાશ, ન્યાસ,	
—બાલાવબોધ	125	બૃહન્ન્યાસ (હૈમ) અને શબ્દમહાર્ણવ જુઓ	44
—વૃત્તિ(સિંહ)	125	મહાવીરચરિય	18,83,129
—વૃત્તિ (હેમ)	125	મહાવીરસ્તવન	30
ભુનદીપક (હેમ) ત્રૈલોક્યદીપક, ત્રૈલોક્યપ્રકાશ,		મહાવીરસ્તુતિ	28
નવ્યતાજિક અને મેઘમાલા જુઓ	126,173	માધરાજપદ્ધતિ	144
ભૂધાતુ		માતૃકાકેવલી	134
—વિવરણ	160	માતૃકાનિર્ધટ (? અજૈન)	72
—વૃત્તિ	173	માધવનિદાન	
ભૂધાતુવૃત્તિસંગ્રહ	173	—ટબ્બો	184
ભૂવલય	101	માનસાગરીપદ્ધતિ	127
ભોજપ્રબન્ધ	44	મિશ્રલિંગકોશ જુઓ લિંગાનુશાસન અને	
ભોજવ્યાકરણ	159,169	શિવસિન્ધુ મિશ્રલિંગનિર્ણય	33
મકરન્દ	98	મુગ્ધાબોધ ઔક્તિક	28,29,31
“મણિ (યા)	16	“મુગ્ધાવબોધા	157
મધ્યમપ્રક્રિયા	47	મુનિસુવ્રતચરિત્ર	124
મધ્યમવૃત્તિ (કાકલ) કાકલની કૃતિ,		મુનિસુવ્રતસ્તવ	109
દુષ્ટિકાદીપિકા અને જુઓ	41	મુષ્ટિવ્યાકરણ શબ્દાનુશાસન(મલય) જુઓ	20,21
લઘુવૃત્તિ		—વિષમપદવિવરણ	22
મધ્યમવૃત્તિ (સ્વોપજ)	41	—વૃત્તિ(સ્વોપજ)	20,21
મધ્યમ-હેમપ્રભા	48	મુદૂર્તચિંતામણિ	
મનોરથનામમાલા	77	—ટબ્બો	182
મનોરમા	17,67	મૃગપક્ષિશાસ્ત્ર	146
મનોરમાકહા	83	મેઘદૂત	
મનોરમાચરિય	64	—ટીકા	
મંત્રરાજરહસ્ય	125,180	મેઘમહોદય વર્ષપ્રબોધ તેમજ વર્ષ-	
મલયગિરિશબ્દાનુશાસન	20	પ્રબોધ અને અષ્ટાંગનિમિત્ત જુઓ	134,137
મલયવર્ષ	123	મેઘમહોદય-વર્ષપ્રબોધ	137
મલ્લિકામકરંદ	108	મેઘમાલા(?અજ્ઞાત)	138
મલ્લિનાથચરિત્ર	102	મેઘમાલા(હીરા)	138
મધીવિચાર	148	મેઘમાલા(હેમ) ત્રૈલોક્યદીપક,	
મહાદેવીસારણી		મેરુધરકેશરી મિશ્રીમલઅભિનંદનગ્રંથ	106

મેરુતુંગબાલાવબોધવ્યાકરણ	22	રત્નમંજૂષા છંદોવિચિત જુઓ	88
ત્રૈલોક્યપ્રકાશ, નવ્યતાજિક અને		—ટીકા	88
ભુવનદીપક જુઓ	126	રત્નમાલા	138
મેરુત્રયોદશી		રત્નમલિકા પ્રશ્નોત્તરરત્નમાલા જુઓ	149
—વિવરણ	160	રત્નસાગર	144,144
xમોતી: શુકનિયાં અને અપશુકનિયાં	128	*રત્નાકરાવતારિકા	
યતિદિનચર્યા જઈદિણચરિયા જુઓ	104	—પંજિકા	181
યંત્રરાજ	139	રમલશાસ્ત્ર (ભોજ૦)	134
યંત્રરાજરચના પ્રકાર	139	રમલશાસ્ત્ર (મેઘ૦)	134
યંત્રામ્નાય	139	રમલશાસ્ત્ર (વિજય૦)	134
યદુવિલાસ	109	રમણાવલી(લિ) દેસિસદસંગહ	
યશોધરચસ્તિ	160	જુઓ	64,72
યશોરાજિરાજપદ્ધતિ	181	—વૃત્તિ (સ્વોપજ)	93,123
યાદવાબ્યુદય	108	રસચિંતામણિ	144,144
યુક્તિસંગ્રહ	69	રસપ્રયોદ	144
યુગપ્રધાનચોપાઈ	120	રસરત્નદીપિકા	144
યુગાદિદેવદ્વાત્રિંશિકા	109	રસરત્નસમુચ્ચય	144
યોગચિંતામણિ વૈદ્યકસારસંગ્રહ અને		રસસાર	77
વૈદ્યકસારોદ્ધાર જુઓ	69,141,143	રહસ્યવૃત્તિ	40,40
યોગરત્નમાલા		રાધવાબ્યુદય	109
—વૃત્તિ	142	રાજમતીપરિત્યાગ	104
યોગરત્નસમુચ્ચય	144	રાયપ્પસેણાઈજજ	108,116
યોગરત્નાકર (અજ્ઞાત)	143	—વૃત્તિ	108
યોગરત્નાકર (નયન૦)	143,143	રૂપકમંજરી	106
યોગશત		રૂપકમાલા (અજ્ઞાત)	106
—વૃત્તિ	183	રૂપકમાલા (પાર્શ્વ૦)	106
યોગશાસ્ત્ર	7,35,75	રૂપકમાલા (પુણ્ય૦)	106
રઘુવિલાસ	108,109	—ટીકા	106
રત્નકોશ		રૂપમંજરીનામમાલા	106
—વ્યાખ્યા	77	રૂપરત્નમાલા	170
રત્નપરીક્ષા	127,148	રૂપસિદ્ધિ	16
—વૃત્તિ (સ્વોપજ)	127	*રેખાશાસ્ત્ર	131
રત્નપાલકથાનક	68	જુઓ સામુદ્રિક લહરી	131
*રત્નપ્રભા	64,66,66	રેવંતગિરિ-કલ્પ	103

રોહિણીમૃગાંક	109	લિંગાનુશાસન (બુદ્ધિ)	17
લઘુજાતક		લિંગાનુશાસન (શાં)	16,54
-ટબ્બો	180	(હર્ષ)	17
-વચનિકા	180	(હેમ) 18,36,40,41,53-55,64	
-વૃત્તિ	180	-અવચૂરિ	54
લઘુત્તમનામકોશ	69	-અવચૂરિ	55
લઘુન્યાસ (કનક)	41,43,44,47	-અવચૂરિ	55
જુઓ ન્યાસારસમુદ્ધાર, ન્યાસોદ્ધાર અને બૃહન્યાસ		-ટિપ્પનિકા	54
દુર્ગ પદવ્યાખ્યા		-ટીકા	36,41,55
લઘુન્યાસ (ધર્મ)	44	- વિવરણ (સ્વોપજ)	41
(રામ)	44,109	- વૃત્તિ (સ્વોપજ)	54,55
(હેમ)	44	*લીલાવતી (અજ્ઞાત, પાઈય)	134
લઘુપ્રક્રિયા (મેઘ)	47	લીલાવતી (ભાસ્કર)	
લઘુવૃત્તિ (કાકલ)	41	-વૃત્તિ	180
જુઓ કાકલની વૃત્તિ, દુષ્ટિકાદીપિકા અને		લીલાવતી (સિંહ)	125
મધ્યમવૃત્તિ		લેખનપ્રકાર	148
લઘુવૃત્તિ (શાં)	15,16	લેખ પદ્ધતિ	148
જુઓ ચિન્તામણિ.		લોકકલ્પ	131,132
લઘુવૃત્તિ (હેમ)	36,38-41,51	લોકપ્રકાશ	46,71
-અવચૂરિ	40	લોકસંવ્યહાર	77
-અવચૂરિ	40	લોદ્રપુરીયપાર્શ્વનાથ સ્તુતિ	28
-અવચૂરિ	40	વકોક્તિની વણજાર	90
-અવચૂરિ (ચતુષ્ક પૂરતી)	40	વકોક્તિ પંચાશિકા	107
અવચૂરિ પરિષ્કાર	40	વત્થુસાર પયરણ	117,118,120,127
-દુષ્ટિકા	40	વનમાલા	109
-દીપિકા	40	વર્ધમાનવિદ્યાકલ્પ	125
*લઘુવ્યાખ્યાનદુષ્ટિકા	40	વર્ષપ્રબોધ	138
લઘુશાન્તિસ્તોત્ર		જુઓ મેઘમહોદય તેમજ મેઘમહોદય-વર્ષપ્રબોધ,	
-ટીકા	127	વર્ષપ્રબોધ અને અષ્ટાંગનિમિત	137
લઘુહેમપ્રભા	48	વસન્તરાજશકુન	
લિંગનિર્ણય	33,70	-વૃત્તિ(ટીકા)	68,182
લિંગભેદનામમાલા	67	વસુદેવહિણી	145
-વૃત્તિ	67	વસ્તુકોશ	77
લિંગાનુશાસન (કલ્યાણ)	33	વસ્તુપાલપ્રશસ્તિ	102,125
જુઓ મિશ્રલિંગકોશ અને મિશ્રલિંગ નિર્ણય		જુઓ પ્રશસ્તિ લેખો	

વસ્તુવિજ્ઞાનરત્નકોશ	77	વિક્રમચરિત	176
વાક્યપ્રકાશ	30,47	વિક્રમચરિત્ર	33
--ટીકા (અજ્ઞાત)	31	વિચારશતકબીજક	160
-ટીકા (અજ્ઞાત)	31	વિચારઘટ્ટત્રિશિકા	
ટીકા (જિન૦)	31	-અવચૂરિ	181
ટીકા (રત્ન૦)	31	વિચારસંગ્રહ	29
ટીકા (હર્ષ૦)	31	વિચારમૃતસંગ્રહ	29
વાગ્મટાલંકાર	90,91,104,120	વિજયદીપિકા	157
-ટિપ્પની	92	વિજયપ્રશસ્તિકાવ્ય	157
-ટીકા (અજ્ઞાત)	91	-વૃત્તિ	157
-ટીકા (કુમુદ૦)	91	વિજયાનંદ કાતંત્રોત્તર, વિદ્યાનંદ અને	
-ટીકા (કૃષ્ણ૦)	91	સિદ્ધાનંદ જુઓ	23
-ટીકા (ક્ષેમ૦)	91	"વિજયોદય (યા૦)	152
--ટીકા (ગણેશ૦)	91	વિજ્ઞામિત્રિવેણી	71
-ટીકા (જિન૦)	91	વિજ્ઞાનચંદ્રિકા	--148
-ટીકા (રાજ૦)	91	વિજ્ઞાનાર્ણવ	148
-ટીકા (વર્ધ૦)	91	વિજ્ઞાનાર્ણવોપનિષદ્	148
-ટીકા (વાદિ૦)	91	વિદગ્ધમુખમણ્ડન	
-ટીકા (સમય૦)	91	-અવચૂરિ	179
-ટીકા (સોમ૦)	91	-અવચૂર્ણિ	179
બાલાવબોધ (નેમિં)	91	-ટીકા (અજ્ઞાત)	179
-બાલાવબોધ (મેરુ૦)	92,92,179	-ટીકા (ભીમ૦)	179
-વૃત્તિ	179	-ટીકા (વિનય૦)	179
-વ્યાખ્યા	90,91	-ટીકા શિવ૦)	179
xવાચક જશનું વંશવૃક્ષ	59	-બાલાવબોધ	179
xવાચક યશોવિજયની ચોવીસીઓ	59	-વૃત્તિ	179
વાચનાચાર્ય શ્રીસુધાકળશ અને		વિદ્યાનંદ કાતંત્રોત્તર, વિજયાનંદ અને	
તેની ગુરુપરંપરા	112	સિદ્ધાનંદ જુઓ	22,23
વાદ્યાર્થનિરૂપણ	181	વિદ્યાપ્રવાદ	131
વાસવદત્તા		વિવાહપટલ (અજૈન)	
-વૃત્તિ	33	-ટીકા	181
વાસોડન્તિકાદિપ્રકરણ અંચલમત-		-બાલાવબોધ	181
નિરાકરણ જુઓ	57	-ટીકા (અજ્ઞાત)	181
વિંશતિવિંશિકા વીસવીસિયા જુઓ	49	-ટીકા (હર્ષ૦)	181

વિવિક્તનામસંગ્રહ નામમાલાસંગ્રહ, નામસંગ્રહ અને ભાનુચંદ્રનામમાલા જુઓ 68	વૃત્તરત્નાકર -ટિપ્પન 175
વિવિધતીર્થકલ્પ 123	-બાલાવબોધ 175
*વિવેક (?વિબુધ૦) કલ્પપલ્લવશેષ કલ્પલતાવિવેક, પલ્લવશેષ અને શેષ જુઓ 99,97,97	-વૃત્તિ (યશ:૦) 175
*વિવેક (હૈમ૦) 92,92,94,95	-વૃત્તિ (સમય૦) 175
96,100,178	-વૃત્તિ (સોમ૦) 175
વિવેકકલિકા 102,155	વૃત્તરત્નાકર 78
વિવેકપાદપ 102,155	*વૃત્તિત્રયનિબન્ધ 168
વિવેકવિલાસ 115,129,131,138,132	*વૃત્તિવિવરણપંજિકાદુર્ગપદપ્રબોધ દુર્ગપદપ્રબોધવૃત્તિ જુઓ 168
-વૃત્તિ 68	વૃદ્ધચિંતામણિ 159
વિશાલલોચન 85	વૃદ્ધપ્રસ્તાવોક્તિરત્નાકર 32,158
વિશેષણવતી વિસેસણવર્ઠ જુઓ 49	વૃદ્ધયોગશતક વૈદ્યવલ્લભ 143
વિશ્રાન્ત 12,18	વેદવાદ-દ્વાત્રિશિકા 10
વિશ્રાન્તવિદ્યાધર 12,13,18	વૈદ્યકલ્પ 144
-ન્યાસ 13,13,166	વૈદ્યકસાર 144
-બૃહદવૃત્તિ 12	વૈદ્યકસારસંગ્રહ યોગચિંતામણિ જુઓ 143
લઘુવૃત્તિ 12	વૈદ્યકસારોદ્ધાર 69,143
વિસેસણવર્ઠ વિશેષણવતી જુઓ 49	વૈદ્યજીવન -ટાબો 184
વિસેસાવસ્સયભાસ 3,122	વૈદ્યવલ્લભ (પૂર્ણ૦) વૃદ્ધયોગશતક જુઓ 143
વીતરાગસ્તોત્ર 35	વૈદ્યવલ્લભ 143
વીરથય વીરસ્તવ જુઓ 123	વૈદ્યામૃત 144
-અવચૂરિ 123	વૈરાગ્યધનદ 31,150,151
-વૃત્તિ 123	વ્યતિરેકદ્વાત્રિશિકા 109
વીરથુર્ઠ (અર્ધ-સંસ્કૃત) 63	આરંભ સિદ્ધિ જુઓ 125
વીરથુર્ઠ (પાઈય) 63	સિદ્ધિ
વીરસ્તવ (કુલ૦) 29	વ્યાકરણચતુષ્કાવચૂરિ 126
વીરસ્તવ (પાદ૦) વીરથય જુઓ 123	xવ્યાકરણના કોયડા અને એનો ઉકેલ 49
વીરસ્તવ (પાર્શ્વ૦) 172	*વ્યુત્પત્તિદીપિકા પ્રાકૃતવૃત્તિકા અને હૈમચુર્થપાદવૃત્તિ જુઓ 45
-ટીકા 172	વ્યુત્પત્તિરત્નાકર 66
વીરસ્તુતિ 63	શકુનદીપિકા 132
વીસવીસિયા વિંશતિવિંશકા જુઓ 49	શકુનપ્રદીપ 132

શકુનરત્નાવલી કથાકોશ જુઓ	133	શબ્દસંદોહસંગ્રહ	69
શકુનરહસ્ય	131,132	શબ્દસિદ્ધિવૃત્તિ	169
શકુનવિચાર	132	શબ્દાનુશાસન (મલયઠ) મુષ્ટિવ્યાકરણ જુઓ	20,22
શકુન(?)નિ)શાસ્ત્ર (દુર્લભઠ)	128	શબ્દાનુશાસન (શાઠ) (યાઠ)	
શકુનશાસ્ત્ર (માણિક્ય) શાકુનસારોદ્ધાર જુઓ	132	શાકટાયન જુઓ	13,14,15
શકુનશાસ્ત્ર (વસંતઠ)		-ટીકા (યાઠ)	16
-વૃત્તિ	33	-રૂપસિદ્ધિ (યાઠ)	16
શકુનસમ્રાજ્ઞિશિકા	133	શબ્દાનુશાસન (હેમઠ) સિદ્ધહેમ અને	
શકુનાવલી (અજ્ઞાત)	133	સિદ્ધહેમચંદ્ર જુઓ	83,93
શકુનાવલી (ગૌતમ) બીજકૌસ્તુભ જુઓ	133	શબ્દામ્બુધિકોશ	77
બીજકૌસ્તુભ		શબ્દાર્ણવ (પદ્યઠ) પદાર્થચિંતામણિ અને	
શકુનાવલી (હેમઠ)	133	સુંદરપ્રકાશ જુઓ	67
શબ્દેસ્વરપાર્થનાથસ્તુતિ	173	શબ્દાર્ણવ (સહજઠ) ઋજુપ્રાણવ્યાકરણ-	
-અવચૂરિ	173	પ્રક્રિયા અને સિદ્ધશબ્દાર્ણવ જુઓ	27
શતકત્રય		-ટીકા	27
-ટીકા	185	મનોરમા (સ્વોપજટીકા)	28
-બાલાવબોધ	184	શાકટાયન (યાઠ) જુઓ શબ્દાનુશાસન	
શતાર્થકાવ્ય	153	(શાઠ)	6,10,13,14,15,38
-વૃત્તિ (સ્વોપજ)	153	-ન્યાસ (યાઠ)	15
શતાર્થી	75	-પ્રક્રિયાસંગ્રહ (યાઠ)	13,16
શત્રુંજયકલ્પ	123	શાકુનસારોદ્ધાર શકુનશાસ્ત્ર જુઓ	132
શત્રુંજયકલ્પકથા	70	શાન્તસુધારસ	46
શબ્દકૌમુદી		-ટીકા	46
શબ્દચન્દ્રિકા	67	શાંતિનાથચરિત્ર (અજિતઠ)	150,155
શબ્દપ્રાભૃત સદ્પાહુડ જુઓ	7,8	શાંતિનાથચરિત્ર (અજ્ઞાત)	185
શબ્દભૂષણ સદ્પાહુડ જુઓ	26	શાંતિનાથચરિત્ર (મુનિઠ)	50
શબ્દભેદનામમાલા શબ્દભેદપ્રકાશ જુઓ	67	શારદીયનામમાલા	69
-વૃત્તિ	67	શારદીયાભિધાનમાલા	69
શબ્દભેદપ્રકાશ શબ્દભેદનામમાલા જુઓ	68	શાલિવાહનચરિત્ર	70
શબ્દમહાર્ણવ તત્ત્વપ્રકાશિકાપ્રકાશ, ન્યાસ, (હેમઠ)		શાલિહોત્ર	147
બૃહન્ન્યાસ (હેમ) અને મહાર્ણવ જુઓ	36,44	શિક્ષાશત	102
શબ્દરત્નપ્રદીપ	67	શિક્ષાશતક	102
શબ્દરત્નાકર	53,69	શિલોછ	64,67
શબ્દવિલાસ પારસીકનામમાલા જુઓ	77	શિલ્પના બે જૈન ગ્રંથો	116
		શિવસિંધુ મિશ્રલિંગકોશ જુઓ	33

૧. આ કૃતિની સંખ્યા દર્શાવે છે.

શુકનશાસ્ત્ર	131	—ટીકા (વૃત્તિ) (હર્ષ૦)	69,174
શુનરુત	147	—પુરાણી વૃત્તિ	174
શુનોરુત ચરુદિત જુઓ	147	—વૃત્તિ (અજ્ઞાત)	174
શૃંગારધનદ	31,150,151	—વૃત્તિ (નય૦)	174
શૃંગારમંજરી	90	—વૃત્તિ (હંસ૦)	174
શૃંગારમહાન	32	ચરુદિત જુઓ શુનરુત અને શુનોરુત	147
શૃંગારવૈરાઘતરંગિણી	153,154	શ્વશકુનાધ્યાય શ્વાનશકુનાધ્યાય	147
—ટીકા	153	શ્વાનરુત- જુઓ શ્વાનરુતશકુનવિચાર	147
શૃંગારવૈરાગ્યશતક	184	શ્વાનશકુનાધ્યાય શ્વશકુનાધ્યાય	147
“શેષ કલ્પપલ્લવશેષ, કલ્પલતાવિવેક,		શ્વાનસમતિકા	147
પલ્લવશેષ અને વિવેક જુઓ	97,97	શ્વેતાંબર ગુરુ વિમલસૂરિની પ્રશ્નો-	
શેષનામમાલા (સાધુ૦) શેષસંગ્રહ-		તરત્તમાલા	149
નામમાલા જુઓ	69	ષટ્ત્રિંશજજલ્પસંગ્રહ	46
શેષનામમાલા (હેમ૦) શેષસંગ્રહનામ-		ષટ્પંચાશિકા (ભદ્રોત્પલ)	
માલા જુઓ	64,67,73	—ટીકા	182
—ટીકા(અજ્ઞાત)	67	ષટ્પંચાશિકા (હરિ૦)	182
—ટીકા(વલ્લભ૦)	67	—ટીકા	182
શેષસંગ્રહનામમાલા (સાધુ૦) શેષ-		ષડાવશ્યક	
નામમાલા (સાધુ૦) જુઓ	69	—બાલાવબોધ	57
શેષસંગ્રહનામમાલા (હેમ૦) શેષનામ-		—વ્યાખ્યા	143
માલા (હેમ૦) જુઓ	67	ષડ્દર્શનસમુચ્ચય	57
શોભનસ્તુતિ	33,63	ષષ્ઠિશતક(પ્રકરણ)સદ્વિસયગ- પચરણ જુઓ	71,92,179
—ટીકા (જય૦)	33	ષોડશષોડશિકા	109
—ટીકા (દેવ૦)	33	સફકેત	177,178
—ટીકા (ધન૦)	63,167	સદ્વૃક્ષિપ્તકાદમ્બરી કથાનક કાદમ્બરી-	
—ટીકા (સિદ્ધિ૦) વૃત્તિ જુઓ	33	ઉદ્ધાર જુઓ	33
—ટીકા (સૌભાગ્ય૦)	33	×સંગીત અને જૈન સાહિત્ય	112
—ટીકાઓ (અન્ય)	63	“સંગીત અને જૈન સાહિત્ય” કે	
—વૃત્તિ (સિદ્ધિ૦) ટીકા (સિદ્ધ૦) જુઓ	33	વિષયમેં કુછ વિશેષ બાતેં	113
શ્રીપાલચરિત્ર સિરિવાલકહા જુઓ	160	સંગીતદીપક	113
શ્રીપ્રશસ્તિસંગ્રહ	46	સંગીતનાટ્યરૂપાવલી	114
શ્રીસિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનમ્	38,41	×સંગીત, નૃત્ય અને નાટ્યશાસ્ત્ર	
શ્રુતબોધ		સંબંધી જૈન ઉલ્લેખો	114
—ટીકા(માણિક્ય૦)	174		

સંગીતમણ્ડન	32,114	સહસાવધાની મુનિસુંદરસૂરિનું લાક્ષણિક	
સંગીતરત્નાવલી	114	સાહિત્ય	105
સંગીતસહપિંગલ	88,114	સાધારણજિનસ્તવ ('૧૬)	109
સંગીતોપનિષત્સારોદ્ધાર		સાધરણજિનસ્તવન	28
સંગીતોપનિષદ્ગ્રંથસારોદ્ધાર જુઓ	112	સામુદ્રિકતિલક	128,128,133
સંગીતોપનિષદ્ 75,112,113		સામુદ્રિકલહરી રેખાશાસ્ત્ર જુઓ	131
સંગીતોપનિષદ્ગ્રંથસારોદ્ધાર		સામુદ્રિકશાસ્ત્ર (અજ્ઞાત)	128
સંગીતોપનિષત્સારોદ્ધાર જુઓ	75	સામુદ્રિકશાસ્ત્ર (અજ્ઞાત)	128,129
સચ્ચઉપમણ્ડલમહાવીરઉચ્છાલ	63	*સારદીપિકા	171,178
સદ્વિસયગપયરણ પશ્ચિશતક જુઓ	71,92	સારસંગ્રહ	138
-બાલાવબોધ	179	સારસ્વત	
-વૃત્તિ	71	-ટિપ્પનક	171
સત્તરિયા		-ટીકા (ચંદ્ર૦)વૃત્તિ જુઓ	171,171
-અવચૂરિ	57	-ટીકા (દિવ૦)	171
સત્યહરિશ્ચંદ્ર	109	-ટીકા (ભાનુ૦)	171
સદ્પાહુડ શબ્દપ્રાભુત જુઓ	7,8	-ટીકા (હર્ષ૦)	171
સદ્ભાવશતક	157	-ન્યાસ	171
સદ્ભાષિતાવલી	159	-પંચસંધિટીકા	171
સન્ધારગ		-પંચસંધિબાલાવબોધ	171
-અવચૂરિ	57	-પંજિકા	171
સમસ્મરણ	33	-વૃત્તિ (ચંદ્ર૦) ટીકા જુઓ	171
સમસ્મરણની વૃત્તિ	33	-વૃત્તિ (દયા૦)	170
સમયબેત્તસમાસ	121	-વૃત્તિ (વિનય૦)	171
-ચૂંછિણ (કરણ પૂરતી)	121	-વૃત્તિ (સહજ૦)	171
સમરાદિત્યચરિત	160	*સારસ્વતધાતુદીપિકા (? ચંદ્ર૦)	69
સમસ્તરત્નપરીક્ષા	148	*સારસ્વતધાતુદીપિકા (મેઘ૦)	139
સમુદ્સત્ય	129	સારસ્વતધાતુપાઠ	171,172
સમ્મર્ષપયરણ	24	સારસ્વતમણ્ડન	32,172
સમ્મતિ(પ્રકરણ)	178	સારસ્વતવિભ્રમ હૈમવિભ્રમ જુઓ	49,172,172
-ટીકા	24	-અવચૂર્ણિ	48,49,172,172
સર્વજિનસાધારણસ્તોત્ર	29	- સારસ્વતવૃત્તિ	27
સર્વાર્થસિદ્ધિમણિમાલા	185	સારસ્વત વ્યાકરણ	
		-વૃત્તિ	68
		*સારોદ્ધાર	66

૧. આ કૃતિની સંખ્યા દર્શાવે છે.

સાવયવિહિ	63	સિદ્ધાન્તાલાપકોદ્ધાર	29
સિદ્ધજ્ઞાન હસ્તસંજ્ઞવન અને હસ્ત-		સિન્દૂરપ્રકર (પ્રમોદ૦)	154
સંજ્ઞવની જુઓ	130	" (સોમ૦) સૂક્તિમુક્તાવલી	
સિદ્ધપ્રભા (બૃહત્)	48	અને સોમશતક	153,153,155,161
સિદ્ધપ્રભા (મધ્યમ)	48	-ટીકા	69
સિદ્ધપ્રભા (લઘુ)	48	સિરિવાલકહા	160
સિદ્ધયોગમાલા	144	-વિવરણ	
સિદ્ધરાજ-વર્ણન	19	સીલોવએસમાલા	82
સિદ્ધશબ્દાર્ણવ શબ્દાર્ણવ જુઓ	27	સુકૃતકીર્તિકલ્લોદિની	125
સિદ્ધસાર	144	*સુખાવબોધા	183
સિદ્ધસાર	51	સુધાકલશ	109
xસિદ્ધસેનીય દ્વાત્રિંશિકાઓમાંથી અવતરણો	50	સુધીશૃંગાર	57,125,125
સિદ્ધહેમ	36,58	સુંદરપ્રકાશ પદાર્થચિંતામણિ	
સિદ્ધહેમચંદ્ર	15,13,19,21,22,26,	અને શબ્દાર્ણવ જુઓ	67
32,34,35,36,42,43,44,44,47,48,49,50,		*સુબોધિકા	7,46
54,57,59,93,59,94		*સુબોધિની (ભાવ૦)	172
-ટીકા (સ્વોપજ)	13	*સુબોધિની (રામ૦)	172
-બૃહદવચૂરિ બૃહદ્વૃત્તિ-અવચૂર્ણિકા	43	*સુબોધિની (સદા૦)	171
-વૃત્તિ-અવચૂર્ણિકા		સુભાષિત	161
-બૃહદ્વૃત્તિ (સ્વોપજ)	41	સુભાષિતકોશ (રામ૦)	161
-વૃત્તિ (સ્વોપજ)	21,33,73,86	સુભાષિતકોશ (હરિ) કર્પૂરપ્રકર અને	
સિદ્ધહેમસારાંશ	39	સૂક્તાવલી જુઓ	156
સિદ્ધહેમશબ્દાનુશાસનમ્	41	સુભાષિતગ્રંથ	161
સિદ્ધાદેશ	123	સુભાષિતપદ્યરત્નાકર	160
સિદ્ધાનંદ કાતંત્રોત્તર, વિજયાનંદ		સુભાષિતરત્નકોશ	159
અને વિદ્યાનંદ જુઓ	23	સુભાષિતરત્નાવલી સુભાષિતાવલી જુઓ	159
સિદ્ધાન્તચંદ્રિકા (જ્ઞાન૦)	171	સુભાષિતવિજયમતશાસ્ત્ર	159
સિદ્ધાન્તચંદ્રિકા (રામા૦)	171	સુભાષિત શતક	159
-ટિપ્પણ	171	સુભાષિતષટ્ત્રિંશિકા (અજ્ઞાત)	161
-ટીકા	171	સુભાષિતષટ્ત્રિંશિકા (જ્ઞાન૦)	161
-વૃત્તિ (જ્ઞાન૦)	171	સુભાષિતષટ્ત્રિંશિકા (યશ૦)	161
-વૃત્તિ (સદા૦) સુબોધિની જુઓ	171	સુભાષિતસંગ્રહ સૂક્તાવલી	161
*સિદ્ધાન્તરત્ન	171	સુભાષિતસારોદ્ધાર	161
સિદ્ધાન્તરત્નિકા	172	સુભાષિતાર્ણવ (અજ્ઞાન)	161

સુભાષિતાર્ણવ (શુભ૦)	161	સૂક્તિદ્વાત્રિશિકા	
સુભાષિતાવલી (તિલક૦)	150,155	-વિવરણ (સ્વોપણ)	158
સુભાષિતાવલી (સકલ૦)	155	સૂક્તિમુક્તાવલી (મેઘ૦) સૂક્તિમુક્તાવલી જુઓ	159
સુભાષિતાવલી		સૂક્તિમુક્તાવલી (સોમ૦) સિંદૂરપ્રકર	
સુમઠનાહચરિય	153	અને સોમશતક જુઓ	153,153
સુમિશસત્તરિયા સ્વપ્ન સપ્તતિકા જુઓ	133	-કવિન	153
સુરસુંદરીચરિય	18	-બાલાવબેરધ	153
સૂક્તદ્વાત્રિશિકા		-વ્યાખ્યા	153
સૂક્તિદ્વાત્રિશિકા જુઓ	158	સૂક્તિરત્નાકર	157
સૂક્તમુક્તાવલી (અજ્ઞાત)	156,157	સૂક્તિરત્નાવલી	161
સૂક્તમુક્તાવલી (અજ્ઞાત)	157	સૂક્તિસંગ્રહ સુક્તાવલી જુઓ	156
સૂક્તમુક્તાવલી (મેઘ૦)		સૂક્તિસમુચ્ચય	155
સૂક્તમુક્તાવલી જુઓ	159	સૂયગડ	31
સૂક્તરત્નાકર (ધર્મ૦)	155	-નિજજુતિટીકા	80
સૂક્તરત્નાકર (માઘ૦)	155	સૂરપણ્ણતિ	126
સૂક્તરત્નાવલી (અજ્ઞાત)	157	સૂર્યહસ્તનામ	68
સૂક્તરત્નાવલી (શ્રમા૦)	159,173	-વૃત્તિ	68
-વિવરણ (વૃત્તિ) (સ્વોપણ)	159,157	સેત્-અનિત્-કારિકા	69
સૂક્તરત્નાવલી (વિજય૦)	157	-ટીકા	69
સૂક્તરત્નાવલી (હેમ૦)	158	સોમશતક સિંદૂરપ્રકર અને	
સૂક્તસંગ્રહ (અજ્ઞાત)	161	સૂક્તિમુક્તાવલી જુઓ	184,153,154
સૂક્તસંગ્રહ (લક્ષ્મણ૦) સૂક્તાવલી જુઓ	156	-ટિપ્પણ	154
સૂક્તસંગ્રહ (લક્ષ્મી૦)	157	-ટીકા (અજ્ઞાત)	154
-અવચૂરિ	157	-ટીકા (ગુણ૦)	154
સૂક્તસંદોહ	161	-ટીકા (જિન૦)	154
સૂક્તસમુચ્ચય	161	-ટીકા (વિમલ૦)	154
સૂક્તાવલી	161	-વૃત્તિ	154
સૂક્તાવલી (અજ્ઞાત) સુભાષિતસંગ્રહ	161	-વ્યાખ્યા (ધર્મ૦)	
જુઓ	161	-વ્યાખ્યા (હર્ષ૦)	154
સૂક્તાવલી (અમર૦)	56,155	સોમસૌભાઘ	178
સૂક્તાવલી (તત્ત્વ૦)	161	સ્તવનરત્ન	181
સૂક્તાવલી (લક્ષ્મણ૦) સૂક્તસંગ્રહ જુઓ	156	સ્તુતિત્રિદશતરંગિણી	157
સૂક્તાવલી (હરિ) કર્પૂરપ્રકર અને		સ્તોત્ર (૭૦૦)	179
સુભાષિતકોશ જુઓ	156	સ્તોત્રરત્નાકર	30,172,173

સ્ત્રીમુક્તિ-કેવલિભુક્તિ-પ્રકરણ (પા૦)	14	હસ્તકાણ	128,129
સ્થાન	138	હસ્તસંજીવન સિદ્ધજ્ઞાન અને	
-વૃત્તિ	138	હસ્તસંજીવની જુઓ	122,128,129,130
સ્નાત્રપંચાશિકા	33	-ટિપ્પણ	131
*સ્પાદિશબ્દદીપિકા દીપિકા અને		-વૃત્તિ (સ્વોપજ્ઞ)	112,130
સ્પાદિશબ્દસમુચ્ચયની જુઓ	41	હસ્તસંજીવની જુઓ સિદ્ધજ્ઞાન અને	
અવચૂરિ		હસ્તસંજીવની	130
સ્પાદિશબ્દસમુચ્ચય	41,56,57,75,97	હસ્તિપરીક્ષા જુઓ ગજપરીક્ષા અને ગજ-પ્રબંધ	128,146
-અવચૂરિ દીપિકા તેમજ સ્પાદિશબ્દ-			
દીપિકા જુઓ	56,57	હિંગુલપ્રકર	154,158,159
-દીકા	57	હિંગુલપ્રકરણ	158
સ્પાદ્યન્તરેત્નાકર	57	હીરમેઘમાલા	138
સ્પાદ્યાદ્યમંજરી	125	×હીરો કેવો લેશો?	132
સ્પાદ્યાદ્યમુક્તાવલી	181	હેમચંદ્રકૃતિકુસુમાવલી	19,51,54,92
સ્વપ્નચિંતામણિ (અજ્ઞાત)	133	હેમચંદ્રનું પ્રાકૃત વ્યાકરણ	39
સ્વપ્નચિંતામણિ (જગ૦) સ્વપ્ન-		હેમચંદ્રવચનામૃત	152
શાસ્ત્ર જુઓ	133,133	હેમચંદ્રીય અપભ્રંશનું સ્વરૂપ	36
સ્વપ્નપ્રદીપ સ્વપ્નવિચાર જુઓ	133	હેમશબ્દસમુચ્ચય, શ્રી	48
સ્વપ્નલક્ષણ	133	હેમસમીક્ષા	37,65,66,67,73
સ્વપ્નવિચાર (જિન૦)	133	હેમકારકસમુચ્ચય	48
સ્વપ્નવિચાર (વર્ધ૦) સ્વપ્નપ્રદીપ જુઓ	133	હેમકોમુદી ચંદ્રપ્રભા અને બૃહત્-	
સ્વપ્નશાસ્ત્ર (જગ૦)	128,133,133	પ્રક્રિયા જુઓ	47
સ્વપ્નસપ્તતિકા જુઓ સુમિશ્રસત્તરિયા	133	હેમચતુર્થપાદવૃત્તિ પ્રાકૃતવૃત્તિ-	
-વૃત્તિ	133	દુષ્ટિકા અને વ્યુત્પત્તિદીપિકા	45
સ્વપ્નસુભાષિત	133	હેમદુષ્ટિકા (ઉદય૦) હેમદુષ્ટિકા-	
સ્વપ્નાધિકાર	133	વૃત્તિ જુઓ	45
સ્વપ્નાધ્યાય	133	*હેમદુષ્ટિકા (સૌભાગ્ય૦)	45
સ્વપ્નાવલિ	113	હેમદુષ્ટિકાવૃત્તિ હેમદુષ્ટિકા જુઓ	45
સ્વપ્નાષ્ટકવિચાર	113	હેમદશપાદવિશેષ	45
સ્વરોદય (અજ્ઞાત)	131	હેમદશપાદવિશેષાર્થ	45
સ્વરોદય (નર૦)		હેમદીપિકા પ્રાકૃતવૃત્તિદીપિકા જુઓ	45
નરપતિજયચર્ચા	132	હેમદોષકાર્ય	45
સ્વરોદય (યશઃ)	131	હેમધાતુપાઠ (અજ્ઞાત)	53
હમ્મીરમહાકાવ્ય	28	હેમધાતુપાઠ (પુણ્ય૦)	53

હૈમધાતુવૃત્તિ	53	-વૃત્તિ	172
હૈમનામમાલા	62	હૈમવ્યાકરણ	55,56,23
હૈમન્યાય	42	હૈમવ્યાકરણન્યાયસંગ્રહ	
હૈમન્યાય	42	ન્યાયર્થમંજૂષા જુઓ	57
-વૃત્તિ	42	હૈમશબ્દસંચય	48
હૈમપંચાંગ વ્યાકરણ	18,35,55	હૈમસારસ્વતસત્ર	38
હૈમપંચાંગ વ્યાકરણના અભ્યાસ		હૈમોદાહરણવૃત્તિ	43
માટેનાં સાધનો	18	હોરામકરંદ	18
હૈમપ્રકાશ ન્યાસ અને		-ટીકા	182
હૈમપ્રક્રિયાબૃહદન્યાસ જુઓ	47	Ardhmagadhi Dictionar	77
હૈમપ્રક્રિયા (મેઘ૦)	47	Cataligue of Manuscripts in the	
હૈમપ્રક્રિયા (વીર૦)	48	Punjab Jain BHandars, A	33
હૈમપ્રક્રિયાબૃહદન્યાસ ન્યાસ અને		Chandas'sekhara of Rajas'ekhara	83
હૈમપ્રકાશ જુઓ	47	Descriptive Catalogue of	
હૈમપ્રક્રિયાશબ્દસમુચ્ચય	48	the Goverment Colletions	
હૈમપ્રાકૃતબૃહદ્વૃત્તિ-અવચૂરિ	45	of Manuscripts	84,183,166
હૈમબૃહદ્વૃત્તિપ્રક્રિયા હૈમપ્રાકૃત-		Geometry in the Jaina	
બૃહદ્વૃત્તિપ્રક્રિયા (?) જુઓ	45,48	Cosmography	120
હૈમલઘુન્યાયપ્રશસ્તિ-અવચૂરિ	44	History of the Canonical	
હૈમ(લઘુ)પ્રક્રિયા	31,40,46,47	Literationr of the Jaonas A	3
-ટિપ્પણ	46	I lluateations of Letter-	
-ટીકા (સ્વોપજ)	46	diarams	29
હૈમવિભ્રમ	48,49,172	Jaina School of Mathematics	
		46,95,98,103,105,120	
		The Studies in Jaina Art	116



(આ) દિગમ્બર

અક્ષપ્રજ્ઞપ્તિ	25	અપશબ્દખણ્ડન	25
અધ્યાત્મપદ્યવૃત્તિ	25	અમરકોશ	173
અનગારધર્મામૃત	62	-ટીકા	
-ટીકા (વૃત્તિ) (સ્વોપજ)	173,177,183	અર્હતપ્રતિષ્ઠાલક્ષણ	9
અનેકાર્થ-નામમાલા જુઓ નામમાલા	61,61,72	અલંકારચિંતામણિ	105
અનેકાર્થ-નિઘણ્ટુ	61,74	-ટીકા	105

અલંકારસંગ્રહ	105	કરકણુચરિત્ર	25
*અષ્ટસહસ્રી	11	કર્ણાટકશબ્દાનુશાસન	25
અષ્ટાંગ આયુર્વેદ	135	કર્મદાહવિધિ (ચંદ્ર)	25
અષ્ટાંગદૃઢય		કર્મદાહવિધિ (રત્ન)	25
-ટીકા	183	કર્મદાહવિધિ (શુભ)	25
-વૃત્તિ	142	કલ્યાણકારક (ઉગ્રા)	140,142
અષ્ટાધ્યાયી	142	કલ્યાણકારક (કુમાર)	142
-ન્યાસ શબ્દાવતાર જુઓ	165	કલ્યાણકારક (ચિત્ર)	142
આચાર્ય અમિતગતિ	152	કલ્યાણકારક (પૂજ્ય)	142
આદિપુરાણ	8	કસાયપાહુડ	121
આમમીમાંસા	135	કાતંત્રરૂપમાલા	168
આરાધના	152	-લઘુવૃત્તિ	168
આશાધરની અર્ચા		કાતંત્રવિસ્તર	168
-ટીકા	25	કાતંત્રવિસ્તાર	168
આશાધર મહાભિષેક	62	કાવ્યાલંકાર	
ઈષ્ટોપદેશ	9	-ટીકા નિબંધન જુઓ	176
ઉણાદિપ્રત્ય	33	કેવલજ્ઞાનપ્રશ્નચૂડામણિ	118,135
- ટીકા	33	કેવલજ્ઞાનહોરા	182
ઉત્તરપુરાણ	120,121	કોશ	140
ઉપાસકાચાર જુઓ શ્રાવકાચાર	152	ક્રિયાકલાપ	173
એકાક્ષરનામમાલિકા	76	ક્ષેત્રગણિત	121
જુઓ એકાક્ષરી-નામમાલા		ગણધરવલયપૂજા (શુભ)	ગણનાથસમર્થન જુઓ 25
એકાક્ષરીકોષ (અમર)	75	ગણધરવલયપૂજા (શ્રુત)	25
એકાક્ષરી (ધનંજય)	61	ગણધરવલયપૂજા (સકલ)	25
એકાક્ષરી નાનાર્થકાંડ	77	ગણનાથસમર્થન ગણધરવલયપૂજા જુઓ	25
એકાક્ષરી-નામમાલા જુઓ એકાક્ષર નામ માલિકા		ગણિતશાસ્ત્ર (મહા)	118
અને એકાક્ષરીકોષ (અમર)	76	ગણિતશાસ્ત્ર (શ્રીધર)	118
એકીભાવસ્તોત્ર		ગણિતસંગ્રહ	120
- ટીકા	24	ગણિતસાર	118
ઔદાર્યચિન્તામણિ	23	ગણિતસારસંગ્રહ	118,119,
- વૃત્તિ (સ્વોપજ)	23	-અનુવાદ (તેલુગુ)	119
કતિકેયાણુવેક્ષા		-ટીકા (અજ્ઞાત)	119
- ટીકા	24,25	-ટીકા (વરદ)	119
કનડપ્રાન્તીય તાડપત્રીય ગ્રંથસૂચી	26,92,118,	-ટીકા (વલ્લભ) (કાનડી)	119
	135,168		

-ટીકા (વલ્લભ) (તેલુગુ)	119	-ન્યાસ (સ્વોપજ)	9,11,11
ગણિતસૂત્ર	118	-પ્રક્રિયા (ગુણ૦)	9
ચતુસ્ત્રિંશદધિકદ્વાદશશતત્રતોઘાપન	25	-પ્રક્રિયા (ચારુ૦)	11
ચંદનાકથા	25	-પ્રક્રિયા (વંશી૦)	9,11
ચંદનાચરિત	25	-પ્રક્રિયા (શ્રુત૦)	9
ચંદ્રનાથચરિત	25	-ભાષ્ય	10,11
ચંદ્રપ્રભચરિત	25	-મહાવૃત્તિ ટીકા જુઓ	8,10,11
ચંદ્રોન્મીલન	135	-લઘુવૃત્તિ	11
ચંદ્રોમીલપ્રશ્ન	135	-વૃત્તિ (?મહાવૃત્તિ)	11
ચિંતામણિ	14,15,24,25	જૈનેન્દ્રસિદ્ધાન્તકોષ	77
-વૃત્તિ (સ્વોપજ)	25	જ્ઞાનાર્ણવ યોગપ્રદીપ જુઓ	24
ચિંતામણિ(યંત્ર)પૂજા	25	જ્યોતિર્જ્ઞાનવિધાન	124
છક્કમોવએસ	152	જ્યોતિર્જ્ઞાનવિધિ	124
છખંડાગમ	9,121	"તત્ત્વત્રયપ્રકાશિકા	24
છંદ:શાસ્ત્ર	78	તત્ત્વનિર્ણય	25
છંદોડનુશાસન (જય૦)	78,78,80	તત્ત્વાનુશાસનાદિસંગ્રહ	151
છંદોડનુશાસન (વાગ્૦)	103	તત્ત્વાર્થવૃત્તિ (પૂજ્ય૦) સર્વાર્થસિદ્ધિ	
જયધવલા	62,121	જુઓ	8
જિનયજ્ઞકલ્પ, નિત્યમહોદ્ધોત જુઓ		તત્ત્વાર્થવૃત્તિ (શ્રુત૦)	24
-ટીકા	24	તત્ત્વાર્થસૂત્ર	8,24
જિનયજ્ઞફલોદય	62	-ટીકા તત્ત્વાર્થવૃત્તિ (શ્રુત૦) જુઓ	24
જિનસહસ્રનામ		તિલોયપણ્ણત્તિ	14,162
-ટીકા	24,24	તીર્થકેવલિપ્રશ્ન	135
જીવકચરિત	25	-ટિપ્પણી	135
જીવંધરચરિત	25	ત્રિંશચ્યતુર્વિંશતિપૂજા (ભવ૦)	25
જૈન સાહિત્ય ઔર ઇતિહાસ	8,12,13,14, 20,22,23,24,82,82,120,121,149,152, 162,162	ત્રિંશચ્યતુર્વિંશતિપૂજા (શુભ૦)	25
જૈન સિદ્ધાન્ત ભાસ્કર	116,162,166	ત્રિવર્ગમહેન્દ્રમાતલિસંજલ્પ	162
જૈનાભિષેક	9	દંસણપાહુડ	
જૈનેન્દ્ર શબ્દાર્ણવ જુઓ	11,12	-ટીકા	24
જૈનેન્દ્ર વ્યાકરણ જુઓ પંચાધ્યાયી	8,9,9,11,12,15,18,22,78,140	દર્પણ	152
-ટીકા મહાવૃત્તિ જુઓ	21	દવ્યસંગ્રહ	
		-ટીકા	25
		દશભક્તિ	9
		દિગમ્બર જૈન	79
		દેવનન્દિ ઔર ડનકા જૈનેન્દ્ર વ્યાકરણ	8

દ્વિસન્ધાનકાવ્ય રાધવપાણ્ડવીય		જુઓ	25
જુઓ	61,62	પલ્યોપમવિધ્યુપધાપન (અનન્ત૦)	25
ધનંજયનામમાલા	61,62,76	પલ્યોપમવિધ્યુપધાપન (દિવેન્દ્ર૦)	25
-ભાષ્ય	61,62,62,76	પલ્યોપમવિધ્યુપધાપન (વૃષભ૦)	25
ધર્મપરીક્ષા	152	પલ્યોપમવિધ્યુપધાપન (શુભ૦)	
*ધવલા	9,61,121	પલ્યોપ્રતોધાપન જુઓ	25
નંદીચરકથા જુઓ સિદ્ધચક્રકથ	25	પાટીગણિત	120
નાડીપરીક્ષા	140,140	પાણ્ડવપુરાણ	25,25,151
નામમાલા (ધનંજય) જુઓ અનેકાર્થ-		પાર્શ્વનાથકાવ્ય પાર્શ્વભ્યુદય જુઓ	
નામમાલા	72,73	-પંજિકા	25
-ટીકા	72	પાર્શ્વનાથચરિત	8,13,61
નામમાલા (ધનંજય) ધનંજયનામ-		પાર્શ્વભ્યુદય પાર્શ્વનાથકાવ્ય જુઓ	25
માલા જુઓ	73	પાશકકેવલી	134
નિઘણ્ટસંગ્રહ	72	પુષ્પામુર્વેદ	140
નિઘણ્ટસમય	62,73	પૂજ્યપાદચરિત (કાનડી)	9
નિત્યમહાદ્દ્યોત જુઓ જિનયજ્ઞકલ્પ	24,24	પ્રતિષ્ઠાતિલક	135
નિદાનમુક્તાવલી	140	પ્રમેયકમલમાર્તણ્ડ	11,15,61
નિબંધન	177	બૃહજજ્યોતિષાર્ણવ	135
નીતિરસાયન	25,151	બૈજિક યાને વ્યવસ્થેદક રેખાગણિત	121
નીતિવાક્યામૃત	151,162,162	ભાવનાદ્વિત્રિશિતિકા. સામાયિકપાઠ જુઓ	152
-ટીકા (અજ્ઞાત)	163	ભાષામંજરી	34
-ટીકા (હરિ૦)	163	ભૂવલય	101
નીતિસાર (ઈંદ્ર૦)	151	મંજરીમકરંદ	34
નીતિસાર (પ્રભા૦)	151	મંત્રવ્યાકરણ	26
નેતિસાર (સમય૦)	151	મહાપુરાણ	176
નીતિસારસમુચ્ચય	151	મહાભિષેક	
નેમિચરિત	120	-ટીકા	24
ન્યાયકુમુચંદ્ર	21	મુક્તાવલીકોશ વિશ્વલોચનકોશ જુઓ	74
પંચવસ્તુ	21,21	મેરુતંત્ર	140
પંચવસ્તુપ્રક્રિયા	21	યશસ્તિલક-ચન્દ્રિકા	24
પંચસંગ્રહ	152	યશસ્તિલક (ચંપૂ) 6,24,61,151,162,162,184	
પંચાધ્યાયી જૈનેન્દ્ર વ્યાકરણ જુઓ	8,9	યશોધરચરિત	162
પદ્મનાભચરિત	25	યુક્તિચિંતામણી	162
પદ્મનાભપુરાણ	25	યોગપ્રદીપ જ્ઞાનાર્ણવ યોગશત જુઓ	24
પલ્યપ્રતોધાપન પલ્યોપમવિધ્યુપધાપન		-વૃત્તિ	142

યોગસાર	82	શબ્દાવતાર	8,165
યોગસારપ્રાભૃત	152	શાન્ત્યષ્ટક	9
રત્નમંજૂષા	86,87	શિલ્પશાસ્ત્ર	117
-ટીકા	86	શૃંગારચન્દ્રિકા	90
-ભાષ્ય	86,87,87	શ્રાવકચાર જુઓ ઉપાસકચાર	152
રત્નમાલા	151	શ્રીપાલચરિત્ર	168
રાધવપાણ્ડવીય દ્વિસન્ધાનકાવ્ય		શ્રુતસંઘપૂજા	24
જુઓ	61	ષટ્પદગમ	9
-ટીકા	61	ષટ્પ્રાભૃત	
રામલ્લાભ્યુદય	67	-ટીકા	24
રૂપમાલા	167	ષડ્વાદ	25
રૂપમાલા	167	ષણ્ણવતિપ્રકરણ	162
રૂપમાલાવૃત્તિ	168	સંશયવચનવિચ્છેદ	25
લઘુ જૈનેન્દ્ર	11	સંશયિવદનવિદારણ	25
વિદ્યાનંદ	167	સંગીતરત્નાકર	112
વિશ્વતત્ત્વપ્રકાશ	16	સંગીતસમયસાર	112
વિશ્વલોચનકોશ મુક્તાવલીકોશ જુઓ	140	સંગીતસારસંગ્રહ	112
વિષાપહારસ્તોત્ર	61	સજ્જનચિત્તવલ્લભ (નેમિં)	151
વૈદ્યકગ્રંથ	140,140	-ટીકા	151
વૈદ્યસાર	9,140	સજ્જનચિત્તવલ્લભ (મલ્લિં)	151
વૈરાગ્યમણિમાલા	23	સભાષ્ય રત્નમંજૂષા	86
વ્રતકથાકોશ (દેવેન્દ્ર)	23	સમાધિતંત્ર	9
વ્રતકથાકોશ (ધર્મં)	23	સરસ્વતીપૂજા	25
વ્રતકથાકોશ (મલ્લિં)	23	સર્વતોભદ્ર	25
વ્રતકથાકોશ (શ્રુતં)	23	-ટીકા	25
વ્રતકથાકોશ (સકલં)	23	સર્વાર્થસિદ્ધિ તત્ત્વાર્થવૃત્તિ જુઓ	8,22,24
શતકત્રય		સાગારધર્મામૃત	177
-અનુવાદ (હિન્દી)	185	-ટીકા	177
-બાલાવબોધ	185	સામાયિકપાઠ (અમિતં) ભાવના-	
-ભાષાટીકા	185	દ્વાત્રિંશતિકા જુઓ	152
-ભાષાટીકા	185	સારસંગ્રહ	9
શબ્દામ્બોજભાસ્કર	11,11,15	સિદ્ધચક્રકથા નન્દીશ્વરકથા જુઓ	25
શબ્દાર્ણવ જૈનેન્દ્ર જુઓ	11	સિદ્ધચક્રવ્રતપૂજા (આશાં)	25
શબ્દાર્ણવચન્દ્રિકા	8,10,12	સિદ્ધચક્રવ્રતપૂજા (પ્રભાં)	25
શબ્દાર્ણવપ્રક્રિયા	12	સિદ્ધચક્રવ્રતપૂજા (શુભં)	25

સિદ્ધભૂપદ્ધતિ	121	સોમદેવ સૂરિકા નીતિવાક્યામૃત	162
-ટીકા	120,121	સ્તોત્રસમુચ્ચય	25
સિદ્ધાન્તરસાયનકલ્પ	140	સ્યાદ્વાદોપનિષદ્	162
સિદ્ધાન્તસારાદિસંગ્રહ	152	સ્વયમ્ભૂચ્છન્દ	79
સિદ્ધવિનિશ્ચય	135	સ્વયમ્ભૂસ્તોત્ર	90
સુભાષિતરત્નસન્દોહ	152,152	સ્વરૂપસમ્બોધન	
સૂક્તિમુક્તાવલી (શ્રુત૦)	161	-વૃત્તિ	25
સૂક્તિમુક્તાવલી (સોમદેવ૦)	161	હરિવંશપુરાણ	62,127
સૂક્તિમુક્તાવલી (સોમસેન૦)	161	હીરકપરીક્ષા	148
સૂક્તિસમુચ્ચય	151,162	On Mahavira's Solution of Rational	
સોમદેવ ઓર મહેન્દ્રદેવ	162	Triangles & Quadrilaterals	120



(ઘ) અજૈન

અક્ષવિદ્યા	122	અષ્ટાધ્યાયી અષ્ટક, વૃત્તિસૂત્ર અને	
અત્રિસંહિતા	61	શબ્દાનુશાસન જુઓ 3,5,8,8,9,19,21,22,34,	
અથર્વવેદ	2	37,43,48,48,53,58,165,166,172,172	
અનિદ્-કારિકા	173,173	-ધાતુવૃત્તિ	16
અધ્યિમન્યન	104	-વાર્તિક	10
અભિજ્ઞાનશાકુન્તલા	81,87	-વૃત્તિઓ	165
અભિજ્ઞાવૃત્તિમાતૃકા	81	આઈન-એ-એકબરી	68
અમરકોશ નામલિંગાનુશાસન		આપિશલ	165
જુઓ 54,60,65,65,160,173		આયુર્વેદ	140,140,183
-ટીકા	62	આયુર્વેદનો ઇતિહાસ	145
અર્ધકાણ્ડ	138	આરણ્યકોપનિષદ્	161
અર્જુનચરિત	176	આર્યભટ્ટીય	119
અર્થશાસ્ત્ર	162	આશ્ચર્યયોગમાલા યોગરત્નમાલા જુઓ	183
અલંકારશાસ્ત્ર	176	ઈન્દ્ર ઐન્દ્ર-તન્ત્ર અને ઐન્દ્ર વ્યાકરણ	
અષ્ટક જુઓ અષ્ટાધ્યાયી, વૃત્તિસૂત્ર અને		જુઓ	5,6
શબ્દાનુશાસન જુઓ	165	ઉણાદિસૂત્ર	165
અષ્ટાંગસંગ્રહ	183	ઉપનિષદ્	101
અષ્ટાંગહૃદય	183	ઉલ્લાઘરાઘવ	155
-ટીકા	183	ઋગ્વેદ	2,5,78

ઐતિહાસિક સંશોધન	183	કાવ્યલંકાર (વામન)	176
આન્દ્ર-તન્ત્ર ઈન્દ્ર જુઓ	6	કાશિકા	18,165,166,168
ઐન્દ્ર વ્યાકરણ	5,6	—ન્યાસ કાશિકાવિવરણપંજિકા અને	
કથાસરિત્સાગર	6	પંજિકા જુઓ	8,166
કરણકુતૂહલ	181	—ન્યાસની ટીકા	166
કરેમાપ્રકરણ	131	કાશિકાવિવરણપંજિકા કાશિકાન્યાસ	
કરેલાપયરણ	131	અને પંજિકા જુઓ	166
કર્ણાટક-ભાષાભૂષણ	33	કિરાતાર્જુનીય	167,176
કર્ણાટ-કુમારસમ્ભવ	82	કુણિ	166
કલાપ કાતન્ત્ર અને કૌમાર જુઓ	166,169	કુમારસમ્ભવ	163,169
કલાપક	166	કોસલાગમ (?)	122
કલાવિલાસ	146	કૌમાર કલાપ, કલાપક અને કાતન્ત્ર	
કવિકલ્પદ્રુમ	58	જુઓ	167
કવિતારહસ્ય	97	ક્ષેમકુતૂહલ	145
કાતન્ત્ર જુઓ કલાપ, કલાપક અને		ખગેન્દ્રપ્રમણિદર્પણ	142
કૌમાર	18,22,23,29,34,37,37,	ખણ્ડમેરુ (પ્રસ્તાર)	87
43,49,467,168,169,173,167,168		ગણપાઠ	28,165
—વૃત્તિ દુર્ગ—ટીકા જુઓ	167,168	ગણિતતિલક પાટીગણિત જુઓ	180
કાતન્ત્ર-વિભ્રમ	48,49	ગણિતપાટી	180
કાદમ્બરી	176	ગણિતસાર	180
કામન્દકનીતિ	163	ગાર્ગીયસંહિતા	138
કામસૂત્ર	115	ગાહાસત્તસર્થ	123
કાલાપક	167	ગોપથ	5
કાવ્યપ્રકાશ	81,95,96,97,100,104,111,	ગ્રહલાઘવ	181
	177,178,178	ચન્દ્ર જુઓ ચાન્દ્ર (વ્યાકરણ)	18,34,167
—ટીકાઓ	177	—વૃત્તિ (સ્વોપજ્ઞ)	34
—વૃત્તિ (સ્વોપજ્ઞ)	177	ચન્દ્રાર્કી	181
કાવ્યમીમાંસા	14,61,94,95,96,104	ચન્દ્રાલોક	106,179
કાવ્યદર્શ	95,175,178	ચમત્કારચિંતામણિ	182
—વૃત્તિઓ	176	ચરક(સંહિતા)	6,142,183
કાવ્યાલંકાર (રુદ્રટ)	95,176,176	—વ્યાખ્યા	6
કાવ્યાલંકાર (ભામહ)	176	ચર્પટપંજરિકા	161

૧. આની કેટલીક ગાથાઓના કર્તા શ્વેતામ્બર પાદલિપિસૂરિ છે પરંતુ મોટા ભાગના કર્તા અજૈન હોવાથી આ કૃતિ મેં અહીં નોંધી છે.

ચાણક્યનીતિ	163	નિઘણ્ટુ (ધન્યન્તરિ)	74
ચાન્દ્ર (વ્યાકરણ) જુઓ ચંદ્ર	34	નિઘણ્ટુ (વૈદિક)	60
છન્દ:શાસ્ત્ર	86	નિરુક્ત	2,5,71
છન્દ:સૂત્ર		-ટીકા	166
-ટીકા	79,79	-વૃત્તિ	6
છન્દોઽમ્બુધિ	80	નીતિશતક	153,184,184
છાન્દસ વ્યાકરણ જુઓ વૈદિક વ્યાકરણ	10	નીતિસાર	162
જહાંગીરનામા	68	ન્યાયસાર	28
જાતક(કર્મ) પદ્ધતિ	180	પંચગંગ	161
જયોતિર્વિદ્યાભરણ	181	પંચસિદ્ધાન્તિકા	80,180
તાજિકસાર	181	પંજિકા જુઓ કાશિકાન્યાસ અને	
તૈત્તિરીયસંહિતા	5	કાશિકા-વિવરણ પંજિકા	166
ત્રિશતિકા	119,179	પટ્ટીગણિત જુઓ દશિતતિલક અને	
ત્રિશતી	179	ગણિતપાટી	180
દશરૂપક	94,110	પાણિનિ	18
દુર્ગ-ટીકા જુઓ કાન્તત્રવૃત્તિ	18	પાતાલવિજયમહાકાવ્ય	176
દેવીશતક	95	પ્રક્રિયાકૌમુદી	5
દ્રવ્યાવલિ	141	પ્રતાપરુદ્રયશોભૂષણ	96
ધ કૉન્સાઈઝ ઓક્સફર્ડ ડિક્શનરી		પ્રતિજ્ઞાયૌગન્ધરાયણ	87
The Concise Oxford Dictionary	4	પ્રાચીન ખગોળશાસ્ત્રચ્યા ઇતિહાસ	181
ધન્યન્તરિ-નિઘણ્ટુ	71,72	પ્રૌઢમનોરમા	47
ધાતુપાઠ (કાતન્ત્રીય)	167	બાલિકા-વંચિતક	110
ધાતુપાઠ (પાણિનીય)	32,165	બૃહકથા	176
ધાતુપાઠ (બોપ્)	13	બૃહત્સંહિતા	
ધીકોટિદકરણ	180	-ટીકા	80
ધ્રુવમાનસ	180	બ્રહ્મયામલ	132
ધ્વન્યાલોક	95,96,97,178	બ્રહ્મસૂત્ર	165
નલપાકદર્પણ	145	બ્રાહ્મસ્ફુટસિદ્ધાન્ત	119
નાટ્યદર્પણ	110	ભગવદ્ગીતા	53,94,10
નાટ્યશાસ્ત્ર	94,96,110	-ટીકા	165
-ટીકા	80,94,95	ભટ્ટિકાવ્ય	20,175
નામમાલા	176	-ટીકા	110
નામલિંગાનુશાસન અમરકોશ		ભટ્ટોપલીટીકા	124
જુઓ	60,173	ભારતીય સંગીતનું ઐતિહાસિક	
		અવલોકન	112

ભાવપ્રકાશ	143	રામાયણ	101,161
ભાસનાટકચક્ર	2	રામાશ્રમી જુઓ વ્યાખ્યા સુધા	173
ભીમકાવ્ય	104	રાવણવહ જુઓ સેઉબન્ય	84
ભુવનદીપક	182	લઘુજાતક	180
ભૂ-ધાતુ	173	લિંગાનુશાસન	165
મનુસ્મૃતિ	161	લીલાવતી	180,180
મહાદેવી	181	લોચન	96,97
મહાદેવીસારણી	181	વરાહપુરાણ	161
મહાભારત	101,161	વસંતરાજશકુન્ત જુઓ શકુન્તનિર્ણય અને	
મહાભાષ્ય	5,166,167,177,176	શકુન્તાર્ણવ	182
માઘકાવ્ય જુઓ શિશુપાલવધ	176	વાક્યપદીય	34,47,166
માનવ ઉત્પત્તિ અને વિકાસ	1	વાક્યપ્રકાશ	47
માયાપુષ્પક	110	વારાહીસંહિતા	138
માલતીમાધવ	176	વિક્રમોર્વશીય	
મીમાંસાસૂત્ર	100	-ટીકા	110
મુગ્ધબોધ	13	વિજ્ઞાનશતક	184
મુદૂર્તચિંતામણિ	182	વિટવૃત્ત	184
મુચ્છકટિક	182	વિદગ્ધમુખાણ્ડન	179
મેઘદૂત	182	વિધિલિખિત	110
મેઘમાલા	138	વિશાલભારત	117
મોહમુદ્ગર	161	વિશ્રાન્તવિદ્યાધર	167
યોગરત્નમાલા જુઓ આશ્ચર્યયોગમાલા	183,142	વિશ્વકોશ	67,76
યોગરત્નસમુચ્ચય	144	વિશ્વપ્રકાશ	74
યોગરત્નાકર	143	વિષ્ણુપુરાણ	66
યોગવાસિષ્ઠ	161	વૃત્તજાતિસમુચ્ચય	87
યોગશત વૃદ્ધયોગશત અને વૃદ્ધયોગશતક જુઓ	183	-ટીકા	80
યોગશતક	183	વૃત્તરત્નાકર	78,80,82,86,174,174
રઘુવંશ	100	-ટીકા	174,80
રત્નપરીક્ષા	72	-વૃત્તિ	79
રત્નાપણ	96,179	વૃત્તિસૂત્ર જુઓ અષ્ટક, અષ્ટાધ્યાયી અને	
રત્નાવલી	86,176	શબ્દાનુશાસન	165
રસોર્ધનું રસાયણ	145	વૃદ્ધયોગશત જુઓ યોગશત અને યોગશતક	183
રાજકોશનિઘણ્ટુ	71		
રાજતરંગિણી	34		

વૃદ્ધયોગશતક	143	સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રકા ઇતિહાસ 6,8,10,12,	
વેણીસંહાર	176	13,15,17,18,23,34,35,165,168,169	
વૈદિક વ્યાકરણ છાન્દસ વ્યાકરણ	166	સંગીતપારિજાત	113
જુઓ	10	સંગીતમકરન્દ	113
નૈઘજીવન	184	સંજીવની	163
વૈદ્યામૃત	144	સંજ્ઞાસૂત્ર	170
વૈયાકરણભૂષણસાર	47	સરસ્વતીકંઠાભરણ	93,179
વૈરાગ્યશતક	184	સરસ્વતીનિઘણ્ટુ	171
વ્યાખ્યાસુધા રામાશ્રમી જુઓ	173	સરસ્વતીસૂત્રપ્રક્રિયા	170
શકુનનિર્ણય વસન્તરાજશકુન જુઓ	182	સામવેદ	176
શતકત્રય	151,184,184	સામુદ્રિકભૂષણ	130,131
-ટીકાઓ	184	સારસંગ્રહ	138
શતકત્રયાદિસુભાષિતસંગ્રહ	184	સાસ્વતપ્રક્રિયા	169
શબ્દભેદપ્રકાશ	64,67	સરસ્વતીસૂત્રો	172
શબ્દમણિદર્પણ	34	સારસ્વતવિભ્રમ ૮૬ (કાતન્ત્ર)49,49,172,172	
શબ્દરત્નપ્રદીપ (કલ્યાણ)	67	સારસ્વતવ્યાકરણ	49,69,159,169
શબ્દાનુશાસન જુઓ અષ્ટક, અધ્યાધ્યાયી			170,171,172
અને વૃત્તિસૂત્ર	165	સાહિત્ય અને વિવેચન	29
શારીરકભાષ્ય	165,177	સાહિત્યદર્પણ	95,96,177,177
શાબરભાષ્ય	100	સિદ્ધાન્તકૌમુદી	9,14,16,36,47,47,55
શાર્કધરપદ્ધતિ	179	સિદ્ધાન્તચન્દ્રિકા	171
શાલિહોત્ર	147	સિદ્ધાન્તશેખર	180
શાશ્વત	74	સી. કે. રાજા સ્મારકગ્રંથ	80
શિવસ્વરોદય જુઓ સ્વરોદય	122	સુકૃતસંકીર્તન	97
શિશુપાલવધ જુઓ માઘકાવ્ય	169,176	સુશ્રુતસંહિતા	142,183
શૃંગારતિલક	94	સૂક્તિમુક્તાવલી	61,154
શૃંગારતિલકકાલંકાર	169	સૂર્યશતક	167
શૃંગારપિણ્ડ	82	સેઉબન્ધ જુઓ રાવણવહ	84
શૃંગારપ્રકાશ	178	સ્વરોદય જુઓ શિવસ્વરોદય	122
શૃંગારશતક	184	હનુમાનિઘણ્ટુ	71
શૈવશાસ્ત્ર	174	હયગ્રીવવધ	55
શૈવસામુદ્રિક	131	હર્ષચરિત	176
શ્રુતબોધ	174	હસ્તચિહ્નસૂત્ર	131
ષટ્પંચાશિકા	182	હસ્તબિમ્બ	131
ષષ્ટિસંવત્સર	138		

હસ્ત્યાયુર્વેદ	146	Lituratione	82,90
હિતોપદેશ	161	History of Hindu Mathe-	
[હેમચન્દ્ર ઓર ઁનકા શબ્દાનુશાસન]	37	matics	119,119
હેવાલ (Report) (ચોથો) ૪૨ ચોથો,	148	History of Indian & Eastern	
(ત્રીજો)	174	Architecture	116
હોરમાકરન્દ	182	History of Indian Lituratione	149,150
Catalogus Catalogorum	32	History of Sanskrit Poetics	
Catalogue of Sanskrit			90,98,175
Manu scripts in Mysore &	117	Indian Architecture	116
Koorg Descriptive Catalogue		Indian Literatures, The	165
Collection of Manuscripts	166,177	Literary Circle of Mahamatya	
	183,140,142	Vastupala & its to Contribution	
Encyclopaedia Britanica	139	to Sanskrit Literature	155
Ganadarpana, a Work on		On the Aindra School of	
Sanskrit Grammar ascribed		Sanskrit Grammarians	6
to King Kumarapala (1143-		Sanskrit Literature	55,165
1174 A.D) of Gujarat, The	28	Some Notes on the	
Gem-stones & their distinctive		Manuscripts of medical	
Characters	148	Works by Jaina Writers	140
Gospel in many Tongues, The		Technical terms & Technique	
History of Classical Sanskrit	1	of Sanskrit Grammar	37



પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો

અકબર (નૃપ)	68,32	—મુક્તકો	39
અક્ષયચંદ્ર	173	અભયચંદ્ર	112
અખંડ આનંદ	184	અભયદેવ	133
અક્ષ	55	અભિનન્દન	135
અંગ્રેજી	16,60,61,116,121	અભિમન્યુ (નૃપ)	34
	139,155	અમદાવાદ આશાપલ્લી જુઓ	22,41,46
—અનુવાદ	9,39,118,150,175		53,56,68,72,74,103,131,153
—ઉપોદ્ધાત	92,121,175,180	અમૃતધર્મ	159
—ટિપ્પણ	86,92,118	અમોઘવર્ષ જુઓ (નૃપ) નૃપતુંગ	14,101,118,142
—પ્રસ્તાવના	86,123,126	અયોધ્યા	123
અજયપાલ (નૃપ)	56,109,109,131	અરિસિંહ	132
અજિત	136	અર્જુન જુઓ ધનંજય જુઓ	61
અજિતદેવ	153	અર્ધમાગધી અદ્ધમાગધી અને આર્ષ જુઓ	2
અજિતનાથ	47	અર્ધસંસ્કૃત	4,63
અંચલ ગચ્છ	22,33,66,75,88	અલાઉદ્દીન ખીલજી	148
	143,149,168,171,180,181,182	અલિપૂર	26
અણહિલપુર	131	અલ્પખાં	31
અણહિલપુર પાટણ	71,97,125	અવલક અપભ્રંશ જુઓ	36,37
અણહિલવાડ	136	અવેસ્તા	3
અદ્ધમાગધી જુઓ અર્ધમાગધી અને આર્ષ	2,4,20,36	અવેસ્તા પહેલવી	2
અનન્કીર્તિ દિગમ્બર જૈન ગ્રંથમાલા	153	અહિપુર નાગોર જુઓ	71
અનૂપ સંસ્કૃત પુસ્તકાલય	[106]139	આગમોદય સમિતિ	13,33,63,89
અનેકાન્ત	33,82	આગમોદ્ધારક આનન્દ-	
અપભ્રંશ અવલક જુઓ	39,63,84	સાગરસૂરિ જુઓ	8,48,83,84
	90,104,151,164,175,177	આત્રા	68
—ઇંદો	83,83,84	આણંદજી કલ્યાણજી પેઢી	117

૧. આથી આ નામની ભાષા અભિપ્રેત છે. આ પ્રમાણે પાઈય (પ્રાકૃત), આર્ષ, અદ્ધમાગધી (અર્ધમાગધી), જઈણ મરહટ્ટી (જૈન માહારપ્ટ્ટી), સોરસેણી (શૌરસેની) માગધી (માગધી), પેસાઈ (પેશાચી), ચૂલિયા પેસાઈ (ચૂલિકા પેશાચી), અવલક (અપભ્રંશ), જૈન સંસ્કૃત, લૌકિક સંસ્કૃત, અર્ધ-સંસ્કૃત, જૂની ગુજરાતી, ઉર્દૂ-હિન્દી, દ્રાવિડ, કન્નડ (કાનડી), તેલુગુ, તિબેટી, અવેસ્તા, અવેસ્તા પહેલવી ઇત્યાદિ માટે સમજી લેવું.

આત્માન્દ પ્રકાશ	49,83,94,178,59	ઉદયવલસ્લભસૂરિ	163
આદર્શટીકા	61	ઉદ્ધોતસૂરિ	126,176
આદર્શટીકા	61	ઉપકેશ ગચ્છ જુઓ ઉકેશ ગચ્છ	
આદિનાથ	127,129		57,113,180,180,185
આનન્દમેરુ	67	ઉભયભાષાકવિચકવર્તી	23
આનન્દવિમલ	12	ઉમરસી રાયસી	169
આનન્દસાગરસૂરિ જુઓ આગમોદ્ધારક	83	ઉર્દૂ-હિન્દી	139
આનન્દસૂરિ	33	ઉષાસ્મારકગ્રંથમાલા	37
આનન્દાશ્રમ ગ્રંથાવલી ગ્રંથમાલા)	5,146,177	ઉકેશ (વંશ)	160
આબુ	116	ઋષભ	137
આપર્ટન ગુસ્ટવ (Opertan Gustav)	16	ઋષભદેવ	47,65,128,130
આમ્રદેવ	131		160,160,169
આયુર્વેદીય ગ્રંથમાલા	145	[એલ.ડી.ઈસ્ટીટ્યુટ જુઓ લા.દ.વિદ્યામંદિર,	
[આર્યજયકલ્યાણકેન્દ્ર	33]	એલ.ડી.સીરિઝ.]	20
આર્યનન્દિ	120	ઋષભદેવજી કેશરીમલજી શ્વેતામ્બર	
આર્ષ અદ્ધમાગહી અને અર્ધમાગધી જુઓ	36	સંસ્થા	29,49,163
આલમશાહ ધોરી	151	ઋષભદેવજી છગનીરામજી સંસ્થા	42,19
આલમશાહ હોશંગ ધોરી	31	એગિલંગ જે. (Eggling)	19
આશાપલ્લી અમદાવાદ જુઓ	126,132	એજ્યુકેશન સોસાયટી (Education	
ઈટાલિયન (Italian)		Society)	51,52
—અનુવાદ	154	એપોલોનિયસ પેર્ગાના	
ઈન્દોર	153	Apolonius Pergana	139
ઈંદ્ર	6	[ઋષભદેવગ્રંથમાળા	111]
ઈમ્પેરિયલ એકેડેમિ ઓફ સાયન્સીસ		એશિયા (મધ્ય)	167
(Imprial Academy of Sciences)	55	ઐકારસૂરિજ્ઞાનમંદિરગ્રંથાવલી	53,57,157
ઈશ્વર	170	ઐકારસાહિત્યનિધિ	46
ઉકેશ ગચ્છ જુઓ ઉપકેશ	57	ઓરીએન્ટલ કોન્ફરન્સ	
ગચ્છ		(Oriental Conference)	28
ઉજ્જેન	19,160	ઓસવાલ	163
ઉદયચંદ્ર	108	કંસ	110
ઉદયન (મંત્રી)	35,90	કક્કલ જુઓ કાકલ	49
ઉદયરુચિ	143	કક્કસૂરિ	113
ઉદયરુચિ	143	કચ્છ	169
ઉદીચ્ય	5	કનકમ્ભ	50

કનિષક (નૃપ)	183	કાકલ જુઓ કક્કલ	49,55
કનોજ	162	કાનડી છંદ જુઓ કનડ છંદ	81
કનડ	26,135	-ટીકા	163,119,151
કનડ છંદ જુઓ કાનડી છંદ	81	-ભાષાન્તર	175
કનડ પ્રાન્ત	26	-લિપિ	86
કનડ લિપિ	26,26,92,135,135,168	કામદેવ	75,86
કમલવિજય	157,158	કાયસ્થ	41,49,55,105
કમલવિજય	182	કારકલ	26
કમલાકર	170	કાલકાચાર્ય	104
કર્ણદેવ (નૃપ)	38,168	કાવ્યામાલા	24,46,56,61,63,90,
કર્ણાટ	82		91,92,103,49,150,152,153,176
કર્ણાટક	82	કાશી	24,56,70,86,97
કલકત્તા	64	કાશ્મીર	34,38,55,81
કલિકાગૌતમ	23	કાસદ્રહ	126,176
કલિકાલચકવર્તી	148	કિર્સ્ટ જોહ	51,52
કલિકાલસર્વજ્ઞ 5,7,13,13,17,18,19,20,23',		કીર્તિચંદ્ર	160
35,35,38,39,41,42,44,45,49,51,52,54,		કીર્તિવિજય	31,46
55,57,63,64,71,73,73,75,79,80,82,83,		કીર્તિસાગર	161
85,89,92,93,94,97,108,111,152,177		કુ(?)કુદાચાર્ય	179
કલિંગ	55	કુતુબુદ્દીન તખલખ	117
કલિયુગ	160	કુન્તે એ. એમ.	183
કલ્યાણકીર્તિ	62	કુમારપાલ	20,21,35,35,56
કલ્યાણરાજ	154		66,85,93,109,128
કલ્યાણવિધાન	127	કુલચરણગણિ	58
કલ્યાણસાગર	159,171	કૂરસિંહ જુઓ કૂરસિંહ	169
કલ્યાણસાગર	181	કૂર્યાલસરસ્વતી	63
કલ્યાણસાગરસૂરિ	66	કૃષ્ણવાગ્દેવતા	178
કલ્યાણસાગરસૂરિ	169	કૃષ્ણ(વાસુદેવ)	75,76,115,127
કવિકટારમલ્લ	44,108	કૃષ્ણાર્ષિ ગચ્છ	28
કવિસભાશૃંગાર	175	કેવલવિજયજી જુઓ મોતીલાલ લાધાજી	39
કવીન્દ્ર	76,76	કોલ્હાપુર	8
કવીશ્વર	63	કૂરસિંહ જુઓ કૂરસિંહ	29

૧. આ પૃષ્ઠાકગત બિરુદ દિ. શ્રુતસાગરનું છે જ્યારે બાકીનાં પૃષ્ઠામાંનું બિરુદ પૂર્ણતલ્લ ગચ્છના સુપ્રસિદ્ધ હેમચંદ્રસૂરિનું છે.

ક્ષમાવિજય (ઉપાં) જુઓ વિજયક્ષમા-		—અનુવાદ	46,123,128,130,137,
ભદ્રસૂરિ	47		153,153,156,158,159,160,
ક્ષમાવિજયગણિ	126		183,105
ક્ષમાશ્રમણ	3	—અર્થ	66,73
ક્ષેમકાજ કૃષ્ણદાસ	174	—ઉદાહરણો	58
ખણિડલ ગચ્છ	104	—નામો	184
ખમ્ભાત	64,67	—પદ્યાત્મક ટીકા	156
ખરતર ગચ્છ	23,47,49,53,54,55	—પર્યાય	55
66,68,70,71,91,92,125,133,150,154,		—ભાષણ	114
156,159,168,170,173,175,178,179,		—ભાષાન્તર	163,184,132,152
166,180,181,182		—રૂપાન્તર	143
ખરતર બેગડ	185	—શબ્દો	53,169
ખાનાપુર	143	—સમજૂતી	92
ખિસ્તી	164	ગુજરાતી શાળાપત્ર	29
ખુષ્કહમ્	32	ગુજરાતી સંસ્કૃત કોશ	169
ખેમરાજ કૃષ્ણદાસ	127	ગુજરાતી (સામયિક)	133
ગજા	151	ગુજરાતીસાહિત્ય પરિષદ	18
ગણેશ	150	ગુણકીર્તિ (દિ૦)	24
ગર્ગાચાર્ય	124	ગુણનિધાનસૂરિ	154
ગાંધી નાથારંગ જૈન ગ્રંથમાલા	74	ગુણભદ્ર	121
ગાંધી લાલચંદ્ર	102	ગુપ્ત (નૃપ)	34
ગાયકવાડ પૌર્વાત્ય ગ્રંથમાલા	56,80,102,180	ગુર્જર	150
ગાયકવાડ સરકાર	97	ગુર્જરધરા	26
ગિરનાર	125,126,102	ગુલાબચંદ્રજી	27
ગુજરાત	28,35,56,65,167	ગોદાવરી	163
ગુજરાતના પાણિનિ	36	ગોપાલ	106
ગુજરાતમિત્ર તથા ગુજરાતદર્પણ	3,59	ગોવિંદસૂરિ	19
	133,183	ગ્રંથમાલા	91
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી		ગ્રામ્ય ભાષા	104
(Gujarat Vernacular Society)	29	ગ્રીક (યંત્ર)	163
ગુજરાત વિદ્યાસભા	29	ચક્રિકાભંજન	119
ગુજરાતી	16,29,30,46,60,65,89,	ચંગદેવ જુઓ ચાંગદેવ	35
92,131,137,138,143,145,147,157,		ચંગી જુઓ ચાહિણી અને પહિણી	35
160,164,169,128		ચકવર્તી શ્રીશચંદ્ર	166

ચચ્ચ જુઓ ચાચ અને ચાચિગ	35	છાણી	125
ચતુર્દશપૂર્વધર જુઓ શ્રુતકેવલી	6	છાન્દસ ભાષા વૈદિક ભાષા જુઓ	2,10
ચતુસ્ત્રિંશજજાતકજ જુઓ બુદ્ધ	65	જઈણ મરહટ્ટી	20,82,133,134,138
ચંદા	117	જગચંદ્રસૂરિ	153
ચંદ્ર	117	જગજીવન	153
ચંદ્રકીર્તિ (દિ.)	152	જગદેવ	128,146
ચંદ્રકીર્તિસૂરિ	69,127,143,154,174	જગન્નાથમસાદ	34
ચંદ્ર(કુળ)	17	જયકીર્તિ (દિ.)	82
ચંદ્ર (ગચ્છ)	44,50	જયકીર્તિસૂરિ	82
ચંદ્રગુપ્ત	162	જયચંદ્રસૂરિ	57,178
ચંદ્રદેવસૂરિ	35	જયંતવિજયજી	64,160
ચંદ્રમૌલિ જુઓ મહાદેવ	184	જયંતસિંહ	125
ચંદ્રસાગરગણિ (હાલસૂરિ)	38	જયપુર	137,185
ચંદ્રસાગરજી	56	જયમંગલસૂરિ	175
ચંદ્રસૂરિ	129	જયાનંદ	43
ચંદ્રસેન	120	જયાદિત્ય	166
ચાંગદેવ ચંગદેવ જુઓ	35	જર્મન(German)	
ચાચ ચચ્ચ જુઓ	35	—અનુવાદ	40,150,151,165
ચાચિગ	35	જલન્ધર	173
ચામુણ્ડ (ગોત્ર)	35	જાગુષ્ટે મહાદેવ રામચંદ્ર	130
ચામુણ્ડરાજ (નૃપ)	38	જાબાલિપુર જુઓ જાલોર	17,71
ચારિત્રરત્નગણિ	57	જામનગર	149,132
ચારિત્રસાગર	181	જાલોર જુઓ જાબાલિપુર	71
ચારુકીર્તિ	33	જાહિલ	128
ચાહિણી જુઓ ચંગી અને પાહિણી	35	જિતેન્દ્રસાગર	160
ચિત્તોડગઢ	82	જિનચંદ્ર	22
ચીની મુસાફર	165	જિનચંદ્ર	172
ચીની સાહિત્ય	6	જિનચંદ્રસૂરિ	172,179
ચુનીલાલ ગ્રંથમાલા	157	જિનતિલકસૂરિ	91
ચૂલિયા પેસાઈ	36	જિનદત્ત	75
[ચૌખમ્બા વિદ્યાભવન	37]	જિનદત્તસૂરિ (વા.)	56,71,97,146
ચૌખમ્બા (Series) સિરીઝ	5	જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર શ્રી	159
ચૌખમ્બા સંસ્કૃત (Series) સિરીઝ	97,145	જિનદેવ	153
ચૌલુક્ય જુઓ સોલંકી	35,38,65	જિનપતિસૂરિ	22

જિનપ્રભસૂરિ	91	જૈનશ્રેયસ્કર મણ્ડલ	40,47
જિનપ્રિય	71	જૈન સંસ્કૃત	3,184
જિનભદ્રસૂરિ	151	જૈન સત્ય પ્રકાશ	20,78,112,113,
જિનભદ્રસૂરિ (ખ૦)	175		116,118,167,59,146
જિનમાણિક્યસૂરિ		જૈન(સામાહિક)	130
	172,178	[જૈનસાહિત્યવર્ધકસભા	64]
જિનરાજસૂરિ	91	જૈન સાહિત્ય સંશોધક	14,63,136
જિનલાભસૂરિ	160	જૈન સિદ્ધાન્ત ભાસ્કર	9,112,117,124
જિનવર્ધનસૂરિ	156		131,134,140,162,166
જિનવલ્લભસૂરિ	71	જૈન સ્વયંસેવક મણ્ડળ	153
જિનવજિયજી	56	જૈન હરપ્રસાદ	61
જિનસાગર	154	જૈન હિતૈષી	8
જિનસિંહસૂરિ	54,179	જૈનનાન્દ પુસ્તકાલય	8,40,127,147,147
જિનસેન	61	જૈનેન્દ્ર મુદ્રણાલય	8
જિનસેન(દિ૦)(પહેલા)	120,149	જોધપુર જુઓ યોધપુર	28,55
જિનહર્ષ	106	જ્ઞાનપ્રસારક મણ્ડળી	1
જિનેશ્વરસૂરિ(ચં૦)	17	જ્ઞાનભૂષણ (દિ.)	24
જિનેશ્વરસૂરિ	23	જ્ઞાનવિમલ	55,66,67,72
જીતસાગર	127	જ્ઞાનશેખર	143
જીમૂતાનન્દ જુઓ નાનક	174	જયેષ્ઠમલ્લ	27
જીવરામ	131	જયેષ્ઠરામ મુકુન્દજી	13
જૂની ગુજરાતી	29,156	ઝધડિયા તીર્થ	52
જેતબાઈ	169	ઝંઝણ સંઘવી	31
જેસલમેર	17,18,23,70,102,133,141	ટિબેટીય સાહિત્ય	6
જૈન આત્માનન્દ સભા	29,57,157,159	ઠક્કર દુદ્ધક	83
જૈન કલ્ચર રીચર્સ સોસાયટી (Jain		ડાયમંડ જ્યુબિલિ પ્રેસ	68
Cultural Research Society)	116	ડેક્કન કોલેજ (Deccan College)	72
જૈન ગૌરીલાલ	16	દુરુડક	168
જૈન ગ્રંથપ્રકાશકસભા	35,41,44,53,56,156	તપ ગચ્છ	143
જૈન જ્ઞાનભણ્ડાર સમાજ	172	તપાગચ્છ	28,66,91,157,
જૈન ધર્મ પ્રકાશ	59,86,89,155,171		157,170,177,181,182
જૈન ધર્મ પ્રસારક સભા	46,156	તાર્કિકકશિરોમણિ	23
જૈન પુસ્તકપ્રચારક સંસ્થા	50,69	તિબેટી	150,167
જૈનયશોવિજય ગ્રંથમાલા	57,59	—અનુવાદ	149,150

—રૂપાન્તર	150	દેવકરણ મૂલચંદ્ર (મૂલજી)	83
તિલકસૂરિ	75	દેવકુલપાટક નગર	156
તીર્થોદ્ધારક	48	દેવગિરિ	70
તીસટ	144	દેવગુપ્તસૂરિ	113
તેજપાલ	46,156,161	દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર	
'તેલુગુ'	119	ફંડ સંસ્થા	33,43,46,63,64,67,67,71,
—ટીકા	119		74,75,76,115,156
ત્રિપાઠી શમ્ભુનાથ	61	દેવચંદ્ર	108
ત્રિવેન્દ્રમ	146	દેવચંદ્રસૂરિ	36
ત્રિવેન્દ્રમ સંસ્કૃત ગ્રંથમાલા	112	દેવપ્રભ (વાદિ)	124
ત્રૈવિધ	61,76	દેવપ્રભસૂરિ	126
ત્રૈવિધવિદ્યાધર	24	દેવભદ્ર	51
ત્રૈવિધવેદી	108	દેવમૂર્તિ	33
થરાદ	176	દેવર્ષિ	63
થારાપદ્ર ગચ્છ	176	દેવ સંઘ	162
થારાપદ્રીય ગચ્છ	89	દેવસુંદરસૂરિ	28,58
દક્ષવિજયજી	40	દેવસૂરિ	49
દક્ષિણવિહારી	112	દેવસૂરિ	150,155
દર્શનવિજય	26	દેવ (વાદિ)	175
દશરથ (ગૃ૦)	61	દેવસેન	151
દાનસાગર	125	દેવીદાસ છગનલાલ	132
દામનન્દિ	136	દેવેન્દ્ર	40
દિગમ્બર જૈન	79,81,101	દેવેન્દ્રકીર્તિ (દિ૦)	23
દિગમ્બર જૈન ગ્રંથ ભણડારમાલા	8	દેવેન્દ્રસૂરિ	22
દિલવરખાન	31	દેવેન્દ્રસૂરિ	41,44
દિલ્હી	9	દેવેન્દ્રસૂરિ	126
દુર્લભરાજ (નૃપ)	38	દેશવિરતિ ધર્મારાધક સમાજ	46
દુર્લભરાજ (મંત્રી)	128,133	દેશાઈ મણીલાલ ઇ.	115

૧. ભારતમાં જેમ મુખ્ય ૧૧ લિપિઓ છે તેમ ૧૪ ભાષા અને ૨૨૫ પેટાભાષા છે. આમાંની એક ભાષા તે 'તેલુગુ' છે. આ 'તેલુગુ' ભાષા ૩ કરોડ અને ૩૩ લાખ લોકો બોલે છે. એટલે કે ૧૦૦ ભારતીઓએ ૯ જણ આ ભાષા બોલે છે.

—ગુ૦ મિત્ર તથા ગુ૦ દ૦ (દૈનિક)નો તા. ૧૭-૧૨-૧૬નો અંક ન્યા. તી. ન્યા. વિ. ઉપા૦ મંગલવિજયજીએ ગુજરાતીમાં તેલુગુશિક્ષણપદ્ધતિ વિ. સં. ૧૯૮૫માં રચી હતી તે શું ત્યાર બાદ પ્રસિદ્ધ કરાઈ છે?

દેશ્ય	51,64,65,72,73,123	તપાગચ્છ	69,87,124,143,154,172,174
દેસિય	65,123	નાગહસ્તી (આર્ય)	123
દેહડ	31,150	નાગેન્દ્ર પાદલિખસૂરિ જુઓ	123
દોશી સખારામને નેમચંદ	105	નાગોર અહિપુર જુઓ	71
દ્રવિડ સંઘ	16	નાગોરી તપાગચ્છ	124
દ્વાવિડ	51,164	નાથારંગજી ગાંધી	9
દ્વિવેદી એસ.	139	નાનક જુઓ જીમૂતાનંદ	174
ધનગ્જય જુઓ અર્જુન	61	નિઝામ	163
ધનદ જુઓ ધનરાજ અને ધન્યરાજ	31	નિટવે કલાપ્પા ભરમાપ્પા	8
ધનપાલ	34	નિર્ણયસાગર મુદ્રણાલય	33,54,68,92, 173,176,183
ધનરત્ન	171	નૃપતુંગ અમોઘવર્ષ જુઓ	118,142
ધનરાજ જુઓ ધનદ અને ધન્યરાજ	31	નૃસિંહ	127
ધન્યુકા	35	નેમિ(?કુમાર)	87
ધન્યકળશ	117	નેમિકુમાર	103,104
ધન્યરાજ ધનદ અને ધનરાજ જુઓ	31	નેમિચંદ્ર	157
ધન્યન્તરિ	183,137	નેમિ-દર્શન-પ્રિયંકર-ગ્રન્થરત્ન, શ્રી	46
ધર્મકીર્તિ	22	નેમિદેવ	162
ધર્મમૂર્તિ	33	નેમિષેણ	151
ધારા	62,131,177	[પરમપદપ્રકાશન	161]
ધોંકલચંદ્ર	160	નોણ	95
ધોળકા	125,172	ન્યાયતીર્થ	58,152
ધ્રુવ હરિલાલ હર્ષદ	28	ન્યાયવિશારદ	4,48,98,136
ન(નિ)ત્યભક્તિ	137	ન્યાયવિશારદ	4,59,86,97,98,136,141,59
નયવિજયગણિ	137	પંચસ્તૂપ સેન સંઘ અને સેનાવ્ય જુઓ	120
નરચંદ્રસૂરિ	75	પંજાબ	33
નરચંદ્રસૂરિ	102,113	પટવર્ધન રઘુનાથ શાસ્ત્રી	128
નરદેવ	132	પટવર્ધન ગ્રંથમાળા	128
નરદેવ	163	પણિડત ગ્રંથ	56
નલોટકપુર	103	પણિડત નવીન ગ્રંથમાળા	8
નવનવતિમહાવાદિવિજેતા	23	પદ્મનન્દિ (દિ.)	23
નવાબ સારાભાઈ મણિલાલ	127	પદ્મનન્દિ (દિ.)	24
નળ	110	પદ્મપ્રભ	137,158
નાગદેવી	83	પદ્મમેરુ	67
નાગપુરીય			

પદ્મમેરુ (દિ.)	67	પાર્શ્વ જુઓ પાર્શ્વનાથ	40
પદ્માવતીપત્તન	180,181	પાર્શ્વચંદ્ર	179
પરમદર્શી (નૃપ)	112	પાર્શ્વનાથ જુઓ પાર્શ્વ	3,127,160
[પરમપ્રકાશન	161]	[પાર્શ્વનાથશોધપીઠ	107]
પરમાગમપ્રવીણ	23	પાલિ	2,36,37
પરમાન્દ	50	પાહિણી જુઓ ચંગી અને ચાહિણી	36
પરમાર (નૃપ)	20	પિતામહ	75
પરમાર્હત	28,35,66,66,128	પીયૂષવર્ષ	106
પલ્લીવાલ	120	પુણ્ડરીક	127
પલ્યેક	174	પુણ્યહર્ષ	182
પાઈય પ્રાકૃત જુઓ	1,3,3,17,23,25, 25,36,37,60,60,63,84,85,85,85,87, 104,117,121,126,128,129,133,156, 164181,181,182	પુન્ય(ણ્ય)સારગણિ	141
-અવતરણ	178,177	પુરાતત્ત્વ	16,29,32,112,167,175
-અવ્યય	37	પુરુષાદ્દાનીય	3
-ઉદાહરણો	86,91	પુરુષોત્તમ	34
-ગાથાઓ	135	પુરુષોત્તમદાસ ગીગુભાઈ	125
-છંદો	84,84	પૂજ્યપાદ	80
-નામ	90	પૂના	147
-પદ્યો	39,92,103,147,160	પૂર્ણતલ્લ (ગચ્છ)	35
-રૂપાન્તર (ર)	150	પૂર્ણિમા (ગચ્છ)	150,155,172,181
-વિવરણ	176	પેટ્રોપોલી (Petropli)	150
-શબ્દો	166,77	પેસાઈ	36
-સુભાષિતો	109	પોરવાડ વેશ્ય	153
પાટણ	45,48,48,56,66,104, 104,106,125,134,150,155,172	પ્રજ્ઞાશ્રમણ	14
પાટલિપુત્ર	123	પ્રતાપ	101
પાણિનિ	13	પ્રતિમા	123
પાણ્ડુરંગ જાવજી	173	પ્રતિષ્ઠાનપુર	163
પાદલિખસૂરિ જુઓ નાગેન્દ્ર	123	પ્રતિષ્ઠાસોમગણિ	184
પારસી	2,2,165	પ્રતિસંસ્કૃત	4
પારસીક જુઓ ફારસી	33	પ્રદ્યુમ્નસૂરિ	51
પારેખ પ્રભુદાસ બેચરદાસ	40	પ્રભાચંદ્ર	151
		પ્રવચનપ્રકાશન	92
		પ્રમોદસૂરિજી	76
		પ્રાકૃત પાઈય જુઓ	1,29,31,90
		પ્રાકૃત છંદ(દો) જુઓ પાઈય છંદો	83,87

પ્રાકૃત ભારતી અકાદમી	144]	બેંગલોર	117
પ્રાકૃત સાહિત્ય	175	બૈજી	34
પ્રાગવાટ	128	બોટ્લિંગ ઓટ્ટો (Bohtlingk Otto)	
પ્રાચ્ય	5		66,67
ફતેહચંદ	9	બોદ્ધ	2,8,13,18,34,60,80,
ફરીદકોટ	182		149,164,166,173,178
ફરુકાબાદ જિલ્લો	62	બ્રાહ્મી	130
ફારસી પારસીક જુઓ	33	બ્રાહ્મી	128
ફાર્બસ ગુજરાતી સભા		ભક્તિવિજય	171
ત્રૈમાસિક	35,36,90	ભગવદ્દત્તજી	6
ફૂલ્લ	123	ભગવાનદાસ	138
ફેન્ય		ભટ્ટોજિ સત્યપ્રસાદ	37
-અનુવાદ	150	ભટ્ટોજિ દીક્ષિત	173
બક્ષ	55	ભણસાળી હીરજી ગંગાધર	152
બંગાળી		ભદ્રંકરપ્રકાશન	46
-લીપી	175	ભરૂચ	123
બરેમિયાં	28	ભાણગારિક	71
બનારસ	8,11,56,57,116,116	ભાણગારકર પ્રાચ્યવિદ્યાસંશોધન	
બનાવટી સંસ્કૃત	3	મંદિર	20,21,24,67,75,115,185
બલાત્કાર ગણ	23,24	ભાનુચંદ્રમણિ	32,171
બાલચંદ્ર	108	ભાનુમેરુ	67,171
બાલાભાઈ રાયચંદ	132	ભારત (દક્ષિણ)	119,144
બાહડ	31	ભારતવર્ષ	3,10
બિકાનેર	139,27	ભારતી	99,166
બિહાર	7	ભારતીય જ્ઞાનપીઠ, કાશી	24,61,73,86
બિહારીલાલ કથનેરા	166		26,135
બુદ્ધ જુઓ ચતુર્થિશજીતકજ્ઞ	65	ભારતીય વિદ્યા	168
બુદ્ધિપ્રકાશ	116	ભારતીય સાહિત્ય	6,9
બુદ્ધિસાગર	127	ભારમલ્લ (નૃપ)	169
બુદ્ધિસાગરસૂરિ	160	ભારવિ	18,175
બુદ્ધિસાગરસૂરિશ્વર ગ્રંથમાલા	160	ભાવનગર	53,57,125
બૃહત્પરતર (ગચ્છ)	170,141	ભાવરત્ન	173
બૃહત્તપા ગચ્છ	30,45	ભાવરત્ન	173
બૃહદ્ ગચ્છ	153	ભાષા જુઓ હિન્દી	1,180

ભાષાટીકા	74,143,184	મરહટ્ટી	2,36
ભાસ્કર	183	મરાઠી, ૧૭(૨),	181
ભીખીબાઈ યુનીલાલ પન્નાલાલ	157	-અનુવાદ	127,143
ભીમદેવ (નૃપ)	38,127	-ભાષાન્તર	96
ભીમસિંહ	22	મલધારી	3,7,45
ભીમસી માણેક	126,153,154,158	મલધારી (ગચ્છ)	74,126,154
ભુવનરાજ	181	મલ્લિનાથ	96
ભૂત ભાષા	90	મલ્લિભૂષણ(દિ.)	23
ભૈરવ	115	મહમદ ખલ્વા (ખીલજી)	163
ભૈરવદાન	26	મહાદેવ	106
ભોજ (નૃપ) ભોજદેવ જુઓ	63,112	મહાદેવ ચંદ્રભૌલિ જુઓ	184
ભોજ (નૃપ)	170	મહાદેવાય	112
ભોજદેવ (નૃપ) ભોજ (નૃપ) જુઓ	83	મહામહોપાધ્યાય	95,177
ભોજદેવ (પ્રતિહાર)	28	મહારાજા સયાજીરાવ વિશ્વ-	
ભોજપત્ર	85	વિદ્યાલય સામયિક	28
ભોજરાજગણિ	181	મહાવીર, જુઓ મહાવીરસ્વામી વર્ધમાન,	
મકસૂદાબાદ	160	વર્ધમાનસ્વામી અને વીર	150
મગધ	7	મહાવીર જૈન વિદ્યાલય, શ્રી	92,96
મંગલસૂરિ	175	મહાવીર જૈન સભા	65
મંજૂશ્રી	150	મહાવીરવિદ્યાલય	46
મણ્ડન (ગૃ૦)	150	મહાવીરસ્વામી	2,3,6,7,31
મણ્ડગણિ	123	(શ્રમણભગવાન), મહાવીર, જુઓ	119
મણ્ડપદ્યુર્ગ	151	વર્ધમાન, વર્ધમાનસ્વામી અને વીર	136,160,184
મતિભદ્રગણિ	172	મહિમાભક્તિભણ્ડાર	170
મતિસાગર	57	મહીતિલક	176
મતિસાગર (દિ.)	16	મહેન્દ્ર	48
મથુરા	123	મહેન્દ્ર	162
મદનચંદ્ર	56	મહેન્દ્ર (દિ.)	162
મદનપાલ ઠક્કુર	33	મહેન્દ્ર (નૃપ)	162
મદનસિંહ	137	મહેન્દ્ર(પં.)	56
મદનસૂરિ	139	મહેન્દ્રસૂરિ	30
મદ્રાસ વિદ્યાપીઠી	17	મહેન્દ્ર	108
મદ્રાસ સરકાર	118	મહેસાણા	30
મધ્યદેશ	62	માગધી	7,78

માગહી	36	મેદપાટ જુઓ મેવાડ	103
માણિકવ(ક)ચંદ્ર દિગમ્બર જૈન		મેરુવિજય	133
ગ્રંથમાલા	9,25,151,152,162	મેવાડ જુઓ મેદપાટ	103
માણિકવભટ્ટ	144	મોગલ	68
માણવલ	163	મોઢ (જ્ઞાતિ)	35,181
માતલિ	162	મોતીલાલ લાધાજી જુઓ કેવલવિજયજી	39
માથુર (સંઘ)	151	મોહનલાલજી જૈન ગ્રંથમાલા	123,130
માધવસેન	151	મૌર્ય	162
માનભદ્ર	44	મ્હૈસુર સરકારની ગ્રંથમાલા	177
માનશેખર	141	યશ	83
માનસી	145	યશ:કીર્તિ (દિ.)	24
માલવ	20	યશચંદ્રગણિ	108
માળવા	163,177	યશોધોષ	150
મિશ્ર ભાષા	4,92	યશોદેવ	162
મિશ્ર સાહિત્ય(Macaronic)	175	યશોદેવસૂરિ	124
મુકુલભટ્ટ	81	યશોભારતીપ્રકાશન	59,178
મુક્તિમલ જૈન મોહનમાલા	65,66	યશોવિજયગણિ	4,135
મુંજ (નૃપ)	63,63,85	યશોવિજય જૈન ગ્રંથમાલા	39,48,53,53,64,66,67,70,157,172
મુનિસુંદરસૂરિ	70	યસોવિજય જૈન સંસ્કૃત પાઠશાલા	30
મુનિસેન	74	યાકિની	7
મુનિશ્વરસૂરિ	168	યાપનીય	13,14
મુંબઈ 2,13,50,92,127,143,167,169		યાસ્ક	13
મુંબઈ સરકાર	185	યુનિવર્સિટીગ્રંથનિર્માણબોર્ડ	39
મુરુણ (નૃપ)	123	યુરોપીય સાહિત્ય	9
મુસ્લિમ	164	યોધપુર જુઓ જોધપુર	55
મૂડબિદ્રી	26	રતલામ	76
મૂલચંદ્ર	160	રત્નધીર	91
મૂલરાજ (નૃપ)	38	રત્નપ્રભ	50
મૂલ સંઘ	23,24	રત્નવિશાલ	178
મેઘચંદ્ર	174	રત્નશેખરસૂરિ	57,125
મેઘચંદ્ર (ત્રેવિધ)	11	રત્નસિંહસૂરિ	57,30
મેઘવિજય	182	રત્નસિંહસૂરિ	163
મેથ્યુએન એન્ડ કંપની લિમિટેડ		રત્નહર્ષ	171
(Matyuen & Company Limited)	148		

રવિચંદ્ર	67	લાટ	102,113
રાજ ગચ્છ	177	લાલબાગ જૈન સંઘ	50
રાજપાલ	128	લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિર	
રાજમહેલ પુસ્તકાલય	146		67,72,75,88,102
રાજરત્ન	87	લાહર	83
રાજશેખરસૂરિ	75	લાહોર	33,68
રાજશેખરસૂરિ	113	લીબડી	33
રાજશ્રી	46	લીબડી સંપ્રદાય	26
રાજસોમ	160	લુંકા (ગચ્છ) જુઓ લોંકા ગચ્છ	161
રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન	75	લોકેશ	169
રાજસ્થાની (ભાષા)	139	લોંકાગચ્છ જુઓ લુંકા ગચ્છ	27
રાજમતી	91	લૌકિક સંસ્કૃત	2,10,34,84
રાણકપુર	116	વજ્રયશ જુઓ વજ્રસ્વામી	14
રાંદેર	46	વજ્રસેન	156
રામ	110	વજ્રસ્વામી જુઓ વજ્રયશ	14
રામકીર્તિ (દિ.)	24	વટ ગચ્છ	139,170
રામકીર્તિ (દિ.)	82	વડોદરા	114,154
રામચંદ્રસૂરિ	44	વડોદરા દેશી કેળવણી ખાતું	163
રામવિજય	160	વણિક	46
રાયમલ્લ	67	વધેલ (વંશ)	115
રાષ્ટ્રકૂટ	119	વર્ધમાન	85,159
રાહડપુર	103	વર્ધમાન	168
રિખવદેવજીમહારાજની પેઢી	52	જુઓ મહાવીર મહાવીરસ્વામી,	
રિયુ ચાર્લ્સ (Reu Charles)	66,67	વર્ધમાનસ્વામી અને વીર	184
રુદ્રપલ્લીય ગચ્છ	150	વર્ધમાનગણિ	108
રુદ્રપલ્લીય ગચ્છ	150	વર્ધમાનસૂરિ	17
લક્ષ્મીકીર્તિ	170	વર્ધમાનસ્વામી જુઓ મહાવીર,	
લક્ષ્મીભદ્ર	157	મહાવીરસ્વામી, વર્ધમાન અને વીર	129,130
લક્ષ્મીસાગરસૂરિ	157	વલ્લભરાજ(પૃ)	38
લંડન	148	વસુદેવ	61
લબ્ધિચંદ્ર	179	વસ્તુપાલ	102,125,126,155,177
લબ્ધિવિજય	182	વાચક (પાદ૦)	123
લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાલા શ્રી	41,57	વાચક(વર્ધ)	8,121
લબ્ધિસૂરીશ્વર જૈન સંસ્કૃત ગ્રંથમાલા શ્રી	40,125	‘વાડી’પાર્શ્વનાથનો ભણ્ડાર	20

‘વાદિ’	176	વિજયરત્નસૂરિ	137
વાદિપર્વતવજ્ર	16	વિજયરાજસૂરિ	26
વાદિભૂષણ (દિ૦)	24	વિજયલાવણ્યસૂરિજી	13,41,94
વાદી	175,124,49	વિજયવર્ધન	171
વાયડ ગચ્છ	56,75,97,129,134,132	વિજયસિંહ	153
વાયડ (નગર)	97	વિજયસિંહસૂરિ	143
વાસુક ભટ્ટ	176	વિજયસેનસૂરિ	125,157
વાસુદેવ (કૃષ્ણ)	95	વિજાગાપકૃમ	23
વાસુપૂજ્ય	101	વિદ્યાકર મિશ્ર	64
વાહિદલ	128	વિદ્યાધર (વંશ)	123
વિક્રમ (નૃપ) જુઓ વિક્રમાદિત્ય 6,6,9,12,13, 24,29,34,35,49,58,61, 72,74,89,97,103,105,108, 127,127,131,140,140, 156, 171,174,175,178,74,120,135		વિદ્યાનિન્દ	23
વિક્રમપુર	180	વિદ્યાસિંહ	155
વિક્રમવિજયજી	41	વિધિ પક્ષ જુઓ અંચલ ગચ્છ	169
વિક્રમાદિત્ય (નૃપ) જુઓ વિક્રમ	17	વિનયસમુદ્રગણિ	178
વિજયકીર્તિ દિ૦)	24	વિનયસાગર	[28] 158
વિજયક્ષમાભદ્રસૂરિ જુઓ ક્ષમાવિજય (ઉપા૦)	41,47,54	વિનયસુંદર	139
વિજયચંદ્રસૂરિ	43	વિનયસુંદર	170,179
વિજયદર્શનસૂરિ	45	વિનાયકદાસ (કાયસ્થ)	105
વિજયદાનસૂરિ	68	વિનીતસાગર	33
વિજયધર્મસૂરિ	4	વિબુધચંદ્ર (Pen-name) કવિ	
વિજયધર્મસૂરિ ગ્રંથમાલા	152	જુઓ નરેન્દ્રપ્રભસૂરિ	102
વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાલા શ્રી	160	વિબુધચંદ્રસૂરિ	124,180
વિજયનેમિસૂરિ	156	વિમલતિલક	53,166
વિજયનેમિસૂરિગ્રંથમાલા	39	વિશાલભારત	117
[વિજયનેમિસૂરિજ્ઞાનમંદિર	27]	વિશાલરાજ	91
વિજયપ	135	વિષ્ણુ	110
વિજયપ્રતાપસૂરીશ્વર	3	વિષ્ણુદાસ	181
વિજયપ્રભસૂરિ	137	વીએના (Viana)	51
વિજયબ્રહ્મ	123	‘વીતરાગ’ અમિતગતિ જુઓ	
		અમિતગતિ (પહેલા)	152
		વીર મહાવીર, જુઓ મહાવીરસ્વામી વર્ધમાન અને	
		વર્ધમાનસ્વામી	59,85,157
		વીરધવલ	23,115
		વીરનન્દિ	11

વીરપ્રભ	155	શર્મા ભીમસેન	19
વીરસંવત્	6,10,14,17,48,53, 56,57,58,64,69,149,168	શર્મા રામસ્વરૂપ	126
વીરસમાજ	46	શલાતુર	165
વીરસિંહ	169	શાકમ્ભર	28
વીરસેન	101,152	શાન્તિચંદ્ર	68
વીસનગર	172	શાન્તિનાથ	97,156
વીસલદેવ (નૃપ)	56	શાન્તિષેણ	151
વૃદ્ધવાદી	123	[શારદાબેન ચીમનભાઈ એજ્યુ.રીસર્ચ સેન્ટર57,117]	
વેંકટેશ્વર મુદ્રણાલય	68,124,127, 128,144,171,174,182,182	શાલિભદ્રસૂરિ	176
વેણીકૃપાણ	56,87	શાસ્ત્રી જગન્નાથ	56
વેલણકર હરિ દામોદર	83	શાહ હીરાલાલ સોમચંદ	53
વૈદિક છંદ	78,81,81,84,86	શીલસુંદર	176
વૈદિક ધાતુ	50	શેખ ફત્તેહ	26
વૈદિક ભાષા જુઓ છાન્દસ ભાષા	2,2,10,34,36	શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી	38,39
વૈદિક શબ્દો	60,71	શેઠ મનસુખભાઈ ભગુભાઈ	41,44
વૈદિક હિન્દુઓ	149,152,164	શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરીટી	
વૈદ્ય જાદવજી ત્રિકમજી	115,145	પ્રકાશન (Charity)	41
વૈદ્ય વિનોદચંદ્ર મોહનલાલ	53	શૈવ	184
વોસરિ (દંડનાયક)	34	શોભન	62,167
વ્યાકરણકમલમાર્તણ્ડ	23	શૌંડદેવ	146
વ્યાકરણતીર્થ	141	શ્રવણ બેલ્ગોલ	9
શકસંવત્	9,12,15,33,35,53,62, 64,71,73,105,121,124,125,128,130,139, 144,162,162,180,181,182	શ્રીચંદ્રસૂરિ	129
શક જુઓ સક	6,7	શ્રીદેવી	61
શંખેશ્વર પાર્શ્વનાથ	130,147	શ્રીધર	170
શતાવધાની	32,26,77	શ્રીમાલ	29
શત્રુંજય	116,123,125,160	શ્રીમહાનગર	153
શબ્દવેપથ્	76	શ્રીષેણ	151
શમ્બુ	170	શ્રુતકેવલિદેશીય	16,132
શર્મા એલ.	139	શ્રુતકેવલી જુઓ ચતુર્દશપૂર્વધર	6
		ષડભાષાકવિચકવર્તી	24
		સંયુક્ત પ્રાન્ત	62
		સંસ્કૃત ટેક્સ્ટ સોસાયટી	
		(Sanskrit Text Society)	19
		સંસ્કૃતાભાસ	3

સંસ્કૃતેતર ભાષા	85	સાહિત્યતીર્થ	152,141
સકલચંદ્ર	68	સિંહસૂરિ	126
સકલચંદ્ર	105	સિંહસૂરિ	176
સક્ક જુઓ શક્ક	69	સિંધી જૈન ગ્રંથમાલા	32,[83]155,184
સખારામ નેમચંદ ગ્રંથમાલા	140	સિદ્ધચક્ર	30,41
સક્કાશ્ય	63	સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ, શ્રી	38
સંકિસ	63	સિદ્ધપુર	30
સંગમ (દેવ)	32	સિદ્ધરાજ જયસિંહ	19,20,21,35,
સંગમસિંહ	123		37,38,44,55,85,90,91,97,109,
સંઘતિલક	150		109,109
સનાતન જૈન ગ્રંથમાલા	8,9,11	સિદ્ધસારસ્વત (બિરુદ)	63
સપાદલક્ષ	177	સિદ્ધસૂરિ	184
સમધર જુઓ સમુદ્ર	31	સિદ્ધસેન દિવાકર	9,13,123
સમન્તભદ્ર	9	સિન્ધુદેશ	183
સમન્તભદ્ર	151	સિયાણા	183
સમયહર્ષ	166	સુખસાગરગણિ	166
સમસંસ્કૃત	4	સુધર્મસ્વામી	58,169
સમુદ્ર જુઓ સમધર	31	સુંદરી	62
સમ્ભવ	136	સુમતિકલશ	179
સરસ્વતી (ગચ્છ)	23,24	સુમતિકીર્તિ	24
સરસ્વતી ગ્રન્થમાલા	68	સુમતિનાથ	136
સરસ્વતી(બિરુદ)	63	સુરત	3,40,50,69,71,74,77,79,90,
સર્વદેવ	62		107,127,147,159
સર્વદેવ	153	સુરપ્રભ	22
સહસ્રાવધાની	23,70,50	સુવિધિનાથ	135
સહદયચક્રવર્તી	12	સૂરચંદ્ર	68
સાગરચંદ્ર	177	સૂર્યાભદેવ	108,116
સાગરચન્દ્ર	177	સૂર્યોદયવિજયજી	141
સાગરચંદ્રસૂરિ	172	સેન અન્વય	74
સાંગણ (સોની)	163	સેન સંઘ જુઓ પંચ સ્તૂપ	120
સાઢાક	169	સેનાવ્ય	120
સાધુકીર્તિ	53,166	સેન્દ્ર (વંશ)	75
સાધુસુંદર	166	સોમ	90
સારંગ (પંડિત)	28	સોમચંદ	35

સોમદેવ	35	હર્ષકીર્તિસૂરિ	175
સોમવિજય	45	હર્ષચંદ્ર ભૂરાભાઈ	57
સોમવિમલ	30	હર્ષપુરીયગચ્છ	75
સોમવિમલસૂરિ	157	[હર્ષપુષ્પામૃતગ્રંથમાળા	73]
સોમસુંદર	181	હર્ષરત્ન	180
સોમસુંદરસૂરિ	91,58	હસ્તિનાપુર	170
સોમેશ્વર (નૃપ)	112	હિતરુચિ	143
સોરસેણી	3,36,37	હાલ (નૃપ)	123
સોલંકી જુઓ ચૌલુક્ય	35	હિન્દી ભાષા	16,61,153,74
સોલંકીઓ	35	-અનુવાદ જુઓ	124,135,
સોલાપુર	142,105,9		138,140,151,152,184
સૌધર્મ બૃહત્તપા ગચ્છ	76	-અર્થ	61
સૌભાગ્યસાગરસૂરિ	45	કવિત્ત	135
સૌભાગ્યહર્ષ	157	-ટિપ્પણ	139
સૌભાગ્યહર્ષ	157	-પ્રસ્તાવના	26,61,90,140
સૌરાષ્ટ્ર	102	-ભાષાન્તર	126
સ્કન્દિલાચાર્ય	123	-વિલેચન	135
સ્વયમ્ભૂ જુઓ બ્રહ્મા	76	-શબ્દાર્થ	74
સ્વીડન (Sweden)	27	હિંદુ મિલન મંદિર	101,164,132
હંસવિજય ફ્રી લાઈબ્રેરી		હિપાર્કસ (Hiparkas)	139
(Hansavijaya Free Library)	153	હિમાંશુવિજયજી	39
હમ્મીરાજ (નૃપ)	28	હીરવિજયજીસૂરિ	66,98,155,158
હયગ્રીવ	170	હીરાચંદ નેમિચંદ	166
હરિ	163	હીરાલાલ વિ. હંસરાજ	132[157]
હરિચંદ્ર	11	હીરાલાલ હંસરાજ	132,149,156
હરિતોષસમિતિ	78	હૂણ	34
હરિભલ	163	હેમચંદ્ર	28
હરિભદ્ર	171	હેમચંદ્ર(સૂરિ)	35,37,41,44
હરિભદ્ર આચાર્ય (પહેલા)	42	હેમચંદ્રસૂરિ (કલિ○)	19,20,49,56,72,75,108
હરિભદ્રસૂરિ	41	[હેમચન્દ્રાચાર્યજ્ઞાનમંદિર	39]
હરિભાઈ દેવકરજી જૈન ગ્રંથમાલા	151	હેમચંદ્રાચાર્ય સભા	32,44,45
હરિશંકર કાલિદાસ	156	હેમતિલકસૂરિ	87
હર્યક્ષ	34	હેમનંદન	171
હર્ષકલ્લોલ	156	હેમપાલ	148

હેમવિમલસૂરિ	31	Education Siciary	51,52
હેમવિમલસૂરિ	58	G S A I	150
હેમાદ્રિ	181	Indian Culture	96
હોસંગ ધોરી	31	Indian Historical Quarterly	150
Annals of Bhandarkar Ori-		Indische Streifen	150
ental Research Institute	23,25,175	Jaina Antiquary	126,140
Bombay Sanskrit &		Journal of the Bombay	
Prakrit Series	3,9,96	Branch of the Royal Asiatic	
Bulletin of the Calautta		Society	79,81,83,83,87
Mathematical Society	119	Mythic Journal	167
College of Indian Music,		P. E. N.	55,165
Dance & Dramatics	114	S I F I	155
D C G C M	159	Z D M G	152



સંકેત-સૂચી

અં=અંચલ
 અંચૂં=અલંકારચૂડામણિ
 અભિંચિં=અભિધાનચિન્તામણિ
 અંમાં=અદ્ધમાગહી
 અષ્ટાં=અષ્ટાધ્યાયી
 અં રં=અનેકાર્થરત્નમંજૂષા
 આંદિં=આગમોનું દિગ્દર્શન
 આં પ્રં=આત્માનંદ પ્રકાશ
 આ સભાં=આત્મનંદ સભા
 આં સં=આગમોદય સમિતિ
 ઉં=ઉત્તર સીમા
 ઉં=ઉપકેશ યાને ઉકેશ
 ઉપાં=ઉપાધ્યાય
 ઋં કેં શ્વેં સંં=ઋષભદેવજી કેશરીમલજી
 શ્વેતામ્બર સંસ્થા
 ઋં છં=ઋષભદેવજી છગનીમલજી
 કં તાં ગ્રં=કનકપ્રાન્તીય તાડપત્રીય
 ગ્રન્થસૂચી
 કલિં=કલિકાલસર્વજ્ઞ
 કાં=કાસદ્રહ
 કૃં=કૃષ્ણાર્ષિ
 ખં=ખંડિલ
 ગંરંમં=ગણરત્નમહોદધિ
 કેંપ્રંચૂં=કેવલજ્ઞાનપ્રશ્નચૂડામણિ
 ગંસાંસંં=ગણિતસારસંગ્રહ
 ગાં પૌં ગ્રં=ગાયકવાડ પૌર્વાત્ય ગ્રંથમાળા
 ગુંમિં તથા ગું દં=ગુજરાતમિત્ર તથા
 ગુજરાત દર્પણ
 ગૃં=ગૃહસ્થ
 ચં=ચંદ્ર

ચં પ્રં=ચતુર્વિંશતિપ્રબન્ધ
 જં મં=જઈણ મરહટ્ટી
 જિંરંકોં= જિનરત્નકોશ
 જેસલં સૂચી=જેસલમેરીય ભાણગારીય ગ્રન્થસૂચી
 જૈં આં સંં=જૈન આત્માનંદ સભા
 જૈં ગ્રંં=જૈન ગ્રન્થાવલી
 જૈં ગ્રં પ્રં સંં=જૈન ગ્રન્થ પ્રકાશક સભા
 જૈં પું પ્રં સંં=જૈન પુસ્તક પ્રચારક સંસ્થા
 જૈં ધં પ્રં=જૈન ધર્મ પ્રકાશ
 જૈં ધં પ્રં સંં=જૈન ધર્મ પ્રસારક સભા
 જૈં સં પ્રં=જૈન સત્ય પ્રકાશ
 જૈં સાં ઇં=જૈન સાહિત્ય ઔર ઇતિહાસ
 જૈં સાં સંં=જૈન સાહિત્ય સંશોધક
 જૈં સાં સંં ઇં=જૈન સાહિત્યનો સંક્ષિપ્ત
 ઇતિહાસ
 જૈં સિં ભાં=જૈન સિદ્ધાન્ત ભાસ્કર
 તં=તપ, તપા
 તંસૂં=તત્ત્વાર્થસૂત્ર
 ત્રિષ્ઠિં=ત્રિષ્ઠિશલાકાપુરુષચરિત્ર
 ત્રૈં=ત્રૈમાસિક
 દિં=દિગંબર
 દિં જૈંં=દિગંબર જૈન
 દિં જૈં ગ્રંં=દિગંબર જૈન ગ્રન્થમાલા
 દેં લાં દૈં પું સંં=દેવચંદ લાલભાઈ જૈન
 પુસ્તકોદ્ધાર સંસ્થા
 નાં=નાગેન્દ્ર
 નાં તં=નાગપુરીય નાગોરી તપા
 પત્તનં સૂચી= પત્તનસ્થ પ્રાચ્ય જૈન ભાણગારીય
 ગ્રન્થસૂચી

પાં ભાં સાં=પાઈય (પ્રાકૃત) ભાષાઓ અને
 સાહિત્ય
 પૂં=પૂર્વ સીમા
 પૂર્ણં=પૂર્ણતલ્લ
 પૌં=પૌર્ણમિક યાને પૂર્ણિમા
 પ્રં ચં=પ્રભાવકચરિત
 પ્રં ચિં=પ્રબંધચિન્તામણિ
 ફાં ગું સં=ફાર્બસ ગુજરાતી સભા
 બૃં=બૃહત્
 બૃં ટિં=બૃહટ્ટિપ્પનિકા
 બૃં તં=બૃહત્ તપા
 ભં=ભટ્ટારક
 ભાં પ્રાં સં મં=ભાંડારકર પ્રાર્થ વિદ્યા
 સંશોધન મંદિર
 મં=મલધારી
 માં દિં જૈં ગ્રં=માણિક(કય) ચન્દ્ર દિગંબર
 જૈન ગ્રંથમાલા
 મુંકં જૈં મોંમાં=મુક્તિકમલ જૈન મોહનમાલા
 યાં=યાપનીય
 યં જૈં ગ્રં=યશોવિજય જૈન ગ્રંથમાલા
 યંજૈંસં=યશોવિજયજૈન સંસ્કૃત પાઠશાલા
 લં=લગભગ
 રાં=રાજ(ગચ્છ)
 રૂં=રુદ્રપલ્લીમ
 લં જૈં ગ્રં=શ્રીલલિપિસૂરીશ્વર જૈન ગ્રંથમાલા
 લુંં=લુંકા ગચ્છ
 વાં=વામડ
 વિ.સં=વિક્રમ સંવત્
 વિસેસા=વિસેસાવરસ્યભાસ

વં=વટ (ગચ્છ)
 શ્વેં=શ્વેતાંબર
 સંંવ્યાં ઈં=સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્ર કા ઇતિહાસ
 સં પં=સમ્મર્થપરણ
 સં જૈં ગ્રં=સનાતન જૈન ગ્રંથમાલા
 સિં જૈં ગ્રં=સિંધી જૈન ગ્રંથમાલા
 હેં કું= શ્રીહેમચન્દ્રકૃતિકુસુમાવલી
 હં=હર્ષપુરીય ગચ્છ
 હીં હં=હીરાલાલ હંસરાજ
 હેં સં=હેમચંદ્રાચાર્ય સભા
 A B O R I=Annls of the Bhandarkar Oriental Research Institute
 B S S=Bombay Sanskrit Series
 Bul. of the Cal. Msth. Society=Bulletin of the Calcutta Mathematical Society
 D C G C M=Descriptive Catalogue of the Government Collections of Manuscripts
 G S A I=Giornale Della Socitra Asiatica Italiana
 H C S L=History of Classical Sanskrit Literature
 H I L=History of Hindu Letcraturer
 I L D=ILLustrations of H.H.M. History of Hindu Mathematics
 Letter=Diagrams
 JBBRAS=Journal of the Bombay Branch of the Royal Asiatic Society
 J U B=Journal of the University of Bombay
 S I F I=Studi Italiani di Filologia Indo-Iranica
 Z D M G=Zeitschrift der Deutschen Morgenlandischen Gesellschaft



૧. આ જૈન ગ્રંથોની સૂચી છે. એ “જૈન સાહિત્ય સંશોધક” (ખંડ ૧, અં. ૨)માં છપાઈ છે.

**આચાર્ય શ્રી વિજયમુનિચન્દ્રસૂરિ સંપાદિત-સંકલિત
પ્રકાશિત ગ્રંથો**

હીરસૌભાગ્ય (સટીક)

પ્રવચન સારોદ્ધાર વિષમપદ વ્યાખ્યા

દસસાવગચરિયં

ધર્મરત્નકરંડક

કથારત્નાકર

પ્રભાવકચરિત્ર (ગુજરાતી ભાષાંતર)

ઉપમિતિ કથોદ્ધાર કર્તા : પં. શ્રી હંસરત્નગણી

વીરનિર્વાણ સંવત ઔર જૈન કાલગણના : લે. પં. કલ્યાણવિજય ગણી

શ્રમણ ભગવાન મહાવીર : પં. કલ્યાણવિજય ગણી

જીવાજીવાભિગમ

આ. હરિભદ્રસૂરિટીકા (મુદ્રણાલયમાં)

જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ લે. મોહનલાલ દેસાઈ

દસવૈકાલિકસૂત્ર : પૂ. આ. ભ. શ્રી ભદ્રંકરસૂરિ મ. સા. ના વિવેચન સાથે

કર્મગ્રંથ : રમ્યરેણુ, શાંતિનાથ ચરિત્ર-સાનુવાદ : રમ્યરેણુ,

દાનોપદેશમાલા-સવિવેચન : રમ્યરેણુ

પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરિ મ. સા.ની વાચનાઓ

દરિસણ તરસિએ ભા. ૧-૨

આપ હિ આપ બુઝાય

ઋષભ જિનેશ્વર પ્રિતમ માહરો

આતમજ્ઞાની શ્રમણ કહાવે

આત્માનુભૂતિ

: બિહુરત જાયે પ્રાણ

સો હિ ભાવ નિર્ગ્રંથ

મેરે અવગુણ ચિત્ત ન ધરો

પ્રભુનો પ્યારો સ્પર્શ

અસ્તિત્વનું પરોઢ

—: પ્રાપ્તિસ્થાન :—

આ. શ્રી ઐકારસૂરિ આરાધના ભવન
સુભાષચોક, ગોપીપુરા, સૂરત-૩૯૫૦૦૧.

: ભરત આફિકસ :
ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીયલિટી રોડ, અમદાવાદ-૧
ફોન : ૨૨૧૩૪૧૭૬, ૨૨૧૨૪૭૨૩